

**:: અનુક્રમણિકા ::**

| ક્રમ | વર્ષ | અંક   | વિષય                                     | પે.નં. |
|------|------|-------|--|--------|
| ૧.   | ૧૬   | ૨૬    | પ્રિસ્તી ધર્મ-મચાર સામે ચેતો             | ૧      |
| ૨.   | ૧૬   | ૨૭    | હદ્યમાં પ્રભુનું ભક્તિશી શ્યાપન          | ૩      |
| ૩.   | ૧૬   | ૨૮    | ભવનિર્વેદનો એક નક્કર સક્રિય ઉપાય         | ૪      |
| ૪.   | ૧૬   | ૨૯    | નિશ્ચયદટિનો હૃડુપયોગ                     | ૭      |
| ૫.   | ૧૬   | ૩૦    | નિશ્ચયદટિનો સહુપયોગ                      | ૯      |
| ૬.   | ૧૬   | ૩૧    | નિશ્ચયદટિ કેવી રીતે કેળવવી ?             | ૧૧     |
| ૭.   | ૧૬   | ૩૨-૩૩ | અથવસાયનું મહત્વ અને..., (લે.૨)           | ૧૪-૧૮  |
| ૮.   | ૧૬   | ૩૪    | મહાશાંતિનો એક અદ્ભુત પ્રયોગ              | ૧૮     |
| ૯૦.  | ૧૬   | ૩૫    | દોષાનો વિટેબણા ટાળવા અદ્ભુત ઉપાય         | ૨૦     |
| ૧૧.  | ૧૬   | ૩૬    | મુનિશ્રી ચન્દ્રશેખરવિજ્યજ્ઞનો...         | ૨૨     |
| ૧૨.  | ૧૬   | ૪૩    | આત્માની ઉન્નતિ ક્યાં અટકે છે ?           | ૨૬     |
| ૧૩.  | ૧૬   | ૪૪    | આત્માના મહત્વને કેમ લાગુ કરવું ?         | ૨૮     |
| ૧૪.  | ૧૬   | ૪૫    | મન એ વિકાસનું સાધન છે                    | ૩૦     |
| ૧૫.  | ૧૬   | ૪૬    | ઈન્ડ્રિયોના વિજ્યનું તાત્ત્વિક પ્રયોજન   | ૩૨     |
| ૧૬.  | ૧૬   | ૪૭-૪૮ | સમ્પર્કત્વમાં વેરાગ્યનું સ્થાન, (લે.૨)   | ૩૪-૩૭  |
| ૧૮.  | ૧૭   | ૨     | અરિહંતની ઉપાસનાનો ઉપાય                   | ૩૮     |
| ૧૯.  | ૧૭   | ૩     | આસ્તિક-નાસ્તિકનું માપ શાના પર ?          | ૪૦     |
| ૨૦.  | ૧૭   | ૪     | અક્ષય સુખના લવથી સર્વ ભૂખ કેમ લાગે ?     | ૪૨     |
| ૨૧.  | ૧૭   | ૫-૬   | કાળલંબિ લહી પંથ નિહાળણું, (લે.૨)         | ૪૪-૪૭  |
| ૨૩.  | ૧૭   | ૭     | મોક્ષમાં શું સુખ ? શું કરવાનું ?         | ૪૮     |
| ૨૪.  | ૧૭   | ૮     | વીર સંવત્ત ર૪૮૫ ના પ્રારંભે...           | ૪૦     |
| ૨૫.  | ૧૭   | ૯     | દાનધર્મ પહેલો કેમ ?                      | ૪૩     |
| ૨૬.  | ૧૭   | ૧૦    | વીતરાગના દર્શન ભક્તિભાવથી...             | ૪૫     |
| ૨૭.  | ૧૭   | ૧૧    | ભવપ્રવાહ કેમ સતત ચાલુ ?                  | ૪૭     |
| ૨૮.  | ૧૭   | ૧૨    | અનંતના પ્રવાસે                           | ૪૮     |
| ૨૯.  | ૧૭   | ૧૩-૧૪ | બ્રહ્મચર્ય પાળવું કેમ સહેલુ ?, (લે.૨)    | ૪૧-૪૪  |
| ૩૧.  | ૧૭   | ૧૫    | બાધ્ય તપ કેમ જરૂરી ?                     | ૪૪     |
| ૩૨.  | ૧૭   | ૧૬-૧૭ | ખોટા વિચારોથી બચવા અદ્ભુત ઉપાય, (લે.૨)   | ૪૬-૪૮  |
| ૩૪.  | ૧૭   | ૧૮    | પ્રભુનામની જરીબૂઝીનો ઉપયોગ               | ૪૯     |
| ૩૫.  | ૧૭   | ૧૯    | બ્રહ્મચર્ય-પાલન માટે મનનું મૂલ્યાંકન     | ૭૧     |
| ૩૬.  | ૧૭   | ૨૦-૨૨ | તકલાદી આનંદ અને સંતાપ..., (લે.૨), (લે.૩) | ૭૩-૭૮  |
| ૩૮.  | ૧૭   | ૨૪-૨૬ | અંતરગ શત્રુ લોભ કેમ દ્બાવામય, (લે.૨)     | ૭૮-૮૩  |
| ૪૧.  | ૧૭   | ૨૩-૨૪ | પ્રતિકમણ એ મહાયોગ, (લે.૨)                | ૮૩-૮૭  |
| ૪૩.  | ૧૭   | ૨૭-૨૮ | આત્મા અને મોક્ષ માટે પ્રમાણ..., (લે.૨)   | ૮૭-૯૦  |
| ૪૪.  | ૧૭   | ૨૮-૩૧ | આજના માનસમાં ભૂત... (લે.૨), (લે.૩)       | ૯૧-૯૬  |
| ૪૮.  | ૧૭   | ૩૨    | સંતાપ-ઉદ્ઘેગ ટાળવાનો અદ્ભુત ઉપાય         | ૯૬     |
| ૪૯.  | ૧૭   | ૩૩    | દિવ્યભૂમિમાં પ્રવેશ કેમ ?                | ૯૮     |
| ૫૦.  | ૧૭   | ૩૪    | જિનવાડી-શ્રવણનું મહત્વ...                | ૧૦૦    |
| ૫૧.  | ૧૭   | ૩૬    | અકલ્યાણમિત્રથી દૂર રહો                   | ૧૦૨    |

(G)

| ક્રમ | વર્ષ | અંક   | વિષય   | પે.નં.  |
|------|------|-------|--|---------|
| ૫૨.  | ૧૭   | ૩૭,૪૧ | મંત્રી તેતલીપુર દુઃખી કેમ ? (લે.૨)           | ૧૦૪-૧૦૮ |
| ૫૪.  | ૧૭   | ૩૮    | ધર્મવૃક્ષની ભૂમિ : ત્રિવિષ યોગ્ય પ્રવર્તન    | ૧૦૯     |
| ૫૫.  | ૧૭   | ૩૯    | મનનું યોગ્ય પ્રવર્તન                         | ૧૧૦     |
| ૫૬.  | ૧૭   | ૪૨-૪૩ | અદ્ભુત ધ્યાન યોગભર્યું પ્રભુદર્શન, (લે.૨)    | ૧૧૨-૧૧૫ |
| ૫૮.  | ૧૭   | ૪૪    | આત્મરોગ હટાવવા બે જરીબૂઝી                    | ૧૧૬     |
| ૫૯.  | ૧૭   | ૪૫    | 'પ્રેરક અવસર જિનવરુ'                         | ૧૧૮     |
| ૬૦.  | ૧૭   | ૪૬    | પરના જેલ ઉપર લહેવાઈ ન જવાય                   | ૧૨૦     |
| ૬૧.  | ૧૭   | ૪૭    | મનની કમાત્રે                                 | ૧૨૨     |
| ૬૨.  | ૧૭   | ૪૮    | કામ-કોધાદિ રોકવા એક નકર ઉપાય                 | ૧૨૪     |
| ૬૩.  | ૧૮   | ૨     | નિષ્ઠળ-નદ્ધામ વિચારોનો અતિ ભયંકર રોગ         | ૧૨૬     |
| ૬૪.  | ૧૮   | ૩     | ગૃહસ્થ બહારથી સુખી... સાથું અંદરથી સુખી      | ૧૨૮     |
| ૬૫.  | ૧૮   | ૪     | નિત્ય પ્રસ્નાતાનો એક ઉપાય                    | ૧૩૦     |
| ૬૬.  | ૧૮   | ૫     | મનુષ્ય જેવો હીનભાગી કોણ ?                    | ૧૩૨     |
| ૬૭.  | ૧૮   | ૬     | શું પૈસા ખર્ચી વિના પ્રભુભક્તિ ન થાય ?       | ૧૩૪     |
| ૬૮.  | ૧૮   | ૭-૮   | બીજાની પુષ્યાઈનાં અંત્રમાસમાં શા... (લે.૨)   | ૧૩૭-૧૪૦ |
| ૭૦.  | ૧૮   | ૯     | વિચાર-વાડી-વત્તાવ પર અંકુર કેમ આવે ?         | ૧૪૧     |
| ૭૧.  | ૧૮   | ૧૦    | શુક્લયાનની પ્રક્રિયા પરથી એક દિશા સુચન       | ૧૪૩     |
| ૭૨.  | ૧૮   | ૧૧    | અનંતા દેહ ભાતર આત્માને ચૂસ્યો                | ૧૪૫     |
| ૭૩.  | ૧૮   | ૧૨    | ધર્મ શું મોક્ષની જ ઈચ્છાથી કરવાનો ?          | ૧૪૭     |
| ૭૪.  | ૧૮   | ૧૩    | દુઃખ શાથી ? પૈસા દાની રાખીને ધર્મ...         | ૧૪૮     |
| ૭૫.  | ૧૮   | ૧૪    | મદ-ઈધ્યા-નિંદા-વિકથા એ ભયંકર...              | ૧૪૯     |
| ૭૬.  | ૧૮   | ૧૫-૧૬ | વિકાસ શો ? ધર્મ કરાય..., (લે.૨)              | ૧૫૩-૧૫૭ |
| ૭૮.  | ૧૮   | ૧૭    | આપણે આત્માર્થી છીએ ?                         | ૧૫૭     |
| ૭૯.  | ૧૮   | ૧૮    | સંયમનાં સૌંદર્ય : બ્રહ્મચર્યની ટાઢક          | ૧૫૮     |
| ૮૦.  | ૧૮   | ૧૯    | નિમણ હિલ માટે એક સુંદર ચાવી                  | ૧૬૧     |
| ૮૧.  | ૧૮   | ૨૦-૨૧ | 'સેવાધર્મ : પરમગણ : ' કેમ ?, (લે.૨)          | ૧૬૩-૧૬૬ |
| ૮૩.  | ૧૮   | ૨૨-૨૩ | દિલ ઉમદા રાખવા ચાર પ્રશ્ન :..., (લે.૨)       | ૧૬૭-૧૭૧ |
| ૮૪.  | ૧૮   | ૨૪    | શુદ્ધ અવસ્થા શુભ અવસ્થાની પ્રવૃત્તિથી આવે    | ૧૭૧     |
| ૮૫.  | ૧૮   | ૨૬    | અતિજરૂરી દસ્તિની નિર્મણા અને શાસ્ત્ર શ્રવણ   | ૧૭૩     |
| ૮૭.  | ૧૮   | ૨૭    | જિનવયનાની વિશેષતાઓ કરી ?                     | ૧૭૪     |
| ૮૮.  | ૧૮   | ૨૮    | ધર્મચૈતન્ય કેમ વિકસે ?                       | ૧૭૭     |
| ૮૯.  | ૧૮   | ૨૯    | પ્રતિકૂળ વેણું એ પણ એક અનિવાર્ય સાધના        | ૧૭૮     |
| ૯૦.  | ૧૮   | ૩૦    | પરચિતા અધમાધમ કેમ ?                          | ૧૮૧     |
| ૯૧.  | ૧૮   | ૩૧-૩૨ | ક્ષમા-બ્રહ્મચર્ય આદિની બે સુંદર ચાવી, (લે.૨) | ૧૮૩-૧૮૭ |
| ૯૩.  | ૧૮   | ૩૩    | વીતરાગની સાચી ઉપાસના માટે જરૂરી તત્ત્વ       | ૧૮૭     |
| ૯૪.  | ૧૮   | ૩૪    | ધર્મશ્રદ્ધાનો ત મહાન સૂત્ર                   | ૧૮૮     |
| ૯૫.  | ૧૮   | ૩૫    | વર્તમાન હાડમારીઓ : એમાં હુંકનું સાધન         | ૧૮૯     |
| ૯૬.  | ૧૮   | ૩૬    | વાસનાઓ મોળી પાડવા એક વિચારણા                 | ૧૯૩     |
| ૯૭.  | ૧૮   | ૩૭-૩૮ | કુવાદો કુધર્મો કેમ ભયંકર ? ..., (લે.૨)       | ૧૯૪-૧૯૮ |
| ૯૮.  | ૧૮   | ૩૯    | જીવનમાં પરલોક માટે કાઈ જોગવાઈ...             | ૧૯૯     |
| ૧૦૦. | ૧૮   | ૪૦    | આચાર પહેલો ? કે વિચાર ?                      | ૨૦૧     |

(H)

| ક્રમ | વર્ષ | અંક   | વિષય  | પે.ન.   |
|------|------|-------|---|---------|
| ૧૦૧. | ૧૮   | ૪૧-૪૨ | 'દિલ અટકો તોરા ચરણ કમળમેં', (લે.૨)              | ૨૦૩-૨૦૭ |
| ૧૦૩. | ૧૮   | ૪૩    | ભવસ્થિતિ-પરિપાક : ચાર શરણનો ચમત્કાર             | ૨૦૭     |
| ૧૦૪. | ૧૮   | ૪૪    | જીવન પર મહોદશાની અસર                            | ૨૦૮     |
| ૧૦૫. | ૧૮   | ૪૫    | 'શીલ'ની વિશુદ્ધમાં વર્તમાન દલીલોના રહિયા        | ૨૧૧     |
| ૧૦૬. | ૧૮   | ૪૬    | પ્રભુનાં દર્શન રોમાંચ ખડા કેમ થાય ?             | ૨૧૩     |
| ૧૦૭. | ૧૮   | ૪૭/૪૮ | આજના કણને શ્રાપ : વાસનાથી...                    | ૨૧૫     |
| ૧૦૮. | ૧૮   | ૧     | મુનિશ્રી વિશ્વધનવિજ્યજીની સમાપ્તિ               | ૨૧૭     |
| ૧૦૯. | ૧૮   | ૨     | કાયાને સુખ એ વિંબણા                             | ૨૧૮     |
| ૧૧૦. | ૧૮   | ૩     | કર્મની બ્રમજામાં પુરુષાર્થનો નાશ ન કરો          | ૨૨૧     |
| ૧૧૧. | ૧૮   | ૪     | શુષ્ઠ ભંડાર અને એની ચાવી                        | ૨૨૩     |
| ૧૧૨. | ૧૮   | ૫     | દ્રેક સાધનામાં જરૂરી તત્ત્વ                     | ૨૨૬     |
| ૧૧૩. | ૧૮   | ૬     | પ્રભુના નામની શીતલતા                            | ૨૨૮     |
| ૧૧૪. | ૧૮   | ૮-૯   | સંસ્કર્તવના ૫ લક્ષણનાં ઉત્પત્તિકમ..., (લે.૨)    | ૨૩૦-૨૩૪ |
| ૧૧૬. | ૧૮   | ૧૦    | સહિષ્ણુતા-સહનવૃત્તિના અદ્ભુત લાભ                | ૨૩૫     |
| ૧૧૭. | ૧૮   | ૧૧    | મા-બાપનો ઉપકાર : સાસુ-વહુ કેમ ન જગે ?           | ૨૩૭     |
| ૧૧૮. | ૧૮   | ૧૩    | આપકણે ભગવાનની કર્દ દયા ખપે ?                    | ૨૩૮     |
| ૧૧૯. | ૧૮   | ૧૪    | સંતોષનું સ્વરૂપ : સંપત્તિ પચાવવાની આવડત         | ૨૪૧     |
| ૧૨૦. | ૧૮   | ૧૫    | ધારિણીમાતાએ ચંદનાની ચિંતા કેમ ન કરી ?           | ૨૪૩     |
| ૧૨૧. | ૧૮   | ૧૬    | ભક્તિ એ મુક્તિની દૂરી કેવી રીતે ?               | ૨૪૫     |
| ૧૨૨. | ૧૮   | ૧૭    | પરોપકાર કરો છતાં સ્વોપકાર કદી ન ભૂલો            | ૨૪૭     |
| ૧૨૩. | ૧૮   | ૧૮    | જીવનમાં શાંતિ કેમ મળે ?                         | ૨૪૮     |
| ૧૨૪. | ૧૮   | ૧૯    | શું ભગવાન આપકા પનારે પડ્યા છે ?                 | ૨૪૯     |
| ૧૨૫. | ૧૮   | ૨૦    | ક્ષપકશ્રેણી અને વીતરાગભાવ કેમ આવે ?             | ૨૫૩     |
| ૧૨૬. | ૧૮   | ૨૧    | પુરુષ વટાવી કથાયો બરીદવાનો મૂર્ખ ધંધો           | ૨૫૫     |
| ૧૨૭. | ૧૮   | ૨૨-૨૩ | જીવનની પાંચ ખરાબી..., (લે.૨)                    | ૨૫૮-૨૬૨ |
| ૧૨૮. | ૧૮   | ૨૪-૨૫ | દર્શનની બલિહારી સામગ્રીમાં સમ્યગ્દર્શન, (લે.૨)  | ૨૬૨-૨૬૬ |
| ૧૩૧. | ૧૮   | ૨૬    | કોથાએ ક કષાયના ત્યાગ માટે વિચારણા               | ૨૬૭     |
| ૧૩૨. | ૧૮   | ૨૭    | 'ધ્યાનશાંતક' શાસ્ત્રપરિચ્ય અને ધ્યાનનું મહત્વ   | ૨૭૦     |
| ૧૩૩. | ૧૮   | ૨૮    | સંયમ-બ્રહ્મચર્ય માટે ખાતા વહેંચી લો             | ૨૭૧     |
| ૧૩૪. | ૧૮   | ૨૯    | દુઃખનાં રોધણા કેમ અટકે ?                        | ૨૭૩     |
| ૧૩૫. | ૧૮   | ૩૦    | ધોડો દોડે રે સાહિબ વાજમાં                       | ૨૭૬     |
| ૧૩૬. | ૧૮   | ૩૧    | જીવનના હિસાબ પર સુખ-દુઃખ...                     | ૨૭૮     |
| ૧૩૭. | ૧૮   | ૩૨-૩૩ | કર્મ ખટકે છે, પણ કબાંદું ખટકે છે ?, (લે.૨)      | ૨૮૦-૨૮૪ |
| ૧૩૮. | ૧૮   | ૩૪    | ધર્મપ્રેમની કેટલી જરૂર ?                        | ૨૮૪     |
| ૧૪૦. | ૧૮   | ૩૫    | ધર્મપ્રેમ માપવાની પારાશીશી                      | ૨૮૭     |
| ૧૪૧. | ૧૮   | ૩૬    | પરમાત્મા અંગે જૈનો અને અજૈનોની માન્યતાનું ફળ    | ૨૮૮     |
| ૧૪૨. | ૧૮   | ૩૭    | તમે શ્રાવક માબાપ ધો ?                           | ૨૮૯     |
| ૧૪૩. | ૧૮   | ૩૮    | વાંકાનેરના આંગડો 'ધ્યાન-શાંતક'નું બહુમાન        | ૨૯૪     |
| ૧૪૪. | ૧૮   | ૪૦-૪૨ | પાપના સંતાપ છતાં પાપ કેમ..., (લે.૩), (લે.૨)     | ૨૯૬-૩૦૨ |
| ૧૪૫. | ૧૮   | ૪૩-૪૪ | વીતરાગ પ્રભુની મૂર્તિમાં બે પ્રકારની..., (લે.૨) | ૩૦૨-૩૦૬ |
| ૧૪૬. | ૧૮   | ૪૭,૪૮ | બંગાળી માનવોનાં દુઃખ અને અનુકૂપા                | ૩૦૬     |

(II)

## ૭ પ્રિસ્તી ધર્મ-પ્રચાર સામે ચેતો

પરલોકની માન્યતાવાળા આર્થ ધર્મોના માથે આજે અનેકવિધ આપત્તિઓ આકમી રહી છે, એમાં સંસ્કૃતિ પરની આપત્તિઓ પૈકી એક આપત્તિ તેરાપંથ મત તરફથી છે. એ પૂર્વે એક લેખમાં અમે જણાવી ગયા છીએ. આ લેખમાં પ્રિસ્તીઓનો કંઈક વિચાર કરીએ.

ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા, અંગ્રેજોનો અહીં પગ પેસારો થયો અને યુનિવર્સિટી સ્થપાઈ તથા લોકો એની કેળવણીમાં ડીગ્રી અને નોકરીના લોભે જોડાવા લાગ્યા ત્યારે પ્રસિદ્ધ અંગ્રેજ લેખક લૉડ મેકેલેએ, બ્રિટનની સરકારને જણાવ્યું કે,- ‘પ્રિસ્તી સંસ્કૃતિનો ભારતમાં પ્રવેશ કરાવવાના પ્રયત્નમાં આપણે સફળ થયા છીએ.’

મૂઢ ને લાલચું ભારતને આની ગતાગમ નહોતી, એનાથી આર્થ સંસ્કૃતિ પર પડનાર જબરદસ્ત ફટકાનો વિચાર નહોતો, તેથી લોભમાં ને લોભમાં યુનિવર્સિટીની કેળવણી લેનારા વધતા જ ગયા. કહેવત છે ને કે, ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ આજે એનું પરિણામ દેખાય છે કે પહેરવેશ-ખાનપાન-મોજશોખ-વ્યવહાર વગેરેની પદ્ધતિમાં કેવું પરિવર્તન અને પાશ્ચાત્ય અંધ અનુકરણ ચાલી પડ્યું છે ! કેળવણીમાં પણ આર્થવિદ્યાઓ અને તત્ત્વજ્ઞાનનું કોઈ મહત્વ રહ્યું નથી. તો આર્થ ઇતિહાસ અને પૂર્વના મહાન આત્માઓના જીવન તથા સાહિત્યના તેવા અધ્યયન પણ ક્યાં છે ? ફાંસનો સુપ્રસિદ્ધ કવિ ગોઅથ અહીંનું શાકુતલ નાટક માથે લઈ સભાઓ વચ્ચે નાચ્યો હતો. એટલું બધું ઊંચું કવિત્વ અને વિદ્ધતા અને ભારતીય કવિ કાલીદાસમાં લાગી, ત્યારે આજે અહીંવાળા અંગ્રેજ કવિઓ શેક્સપિયર શેલી અને ડીટસ વગેરેમાં એ જુઝે છે. પાશ્ચાત્ય ફિલોસોફી કે જે મોટાભાગે ઇથિક્સ યાને ધર્મશાસ્ત્ર જેવી છે એને ‘ફિલોસોફી’ યાને દર્શનશાસ્ત્રના તત્ત્વજ્ઞાન તરીકે માની એના પર ભારતીયો ઓવારી જાય છે, ત્યારે અહીંના ઘણાં ગહન અને તક્કુલીં દર્શનશાસ્ત્રને જીવનમાં નકામા ગણી બંડારમાં પૂરી દીધા છે. આવો આવો પ્રિસ્તી સંસ્કૃતિએ કેટલોય ભંંકર અનર્થ સર્જ્યો છે.

વળી ભારતમાંથી અંગ્રેજ રાજ્ય ગયા પછી ભારતીયોના ધર્મ પરિવર્તન કરી પ્રિસ્તી ધર્મવાળાની વસ્તી જાલિમ વધારી દીધી છે ! અને એનાં દેવળો બમણાં ત્રણગણાં જેવા વધી ગયા છે.

એટલું જ નહિ પણ પ્રિસ્તી પાદરીઓ, પોસ્ટલ ટ્યુશનની ભારતવાપી યોજના ચલાવી આર્થ ધર્મવાળાઓમાં પણ પ્રિસ્તી સંસ્કારો નાખવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. એમાં લલચામણી ભાષા અને ગ્રલોભનો દ્વારા આર્થત્વના જ્ઞાનરહિત ભોળા આર્યો ઉપર પ્રિસ્તી ધર્મનું ભારે અંજામણ ને આવર્જન કરી રહ્યા છે.

એવું જ મીશનરી સ્કૂલ-કોલેજોમાં પણ સારી અંગ્રેજ ભાષા શીખવવાના ઓઠાં હેઠળ મૂર્ખ આર્થ બનેલ આર્થ પ્રજાને આ પ્રિસ્તીઓ તાજી રહ્યા છે, ને એમાં ય પ્રિસ્તી સંસ્કરણનાં ધૂપાં ઝેર પીરસ્યે જાય છે. હમણાં વડોદરામાં શ્રી શંકરાચાર્યે જાહેર સભામાં પ્રિસ્તી ધર્મનો કેવો ધૂમ પ્રચાર થઈ રહ્યો છે એનો જ્યાલ આપ્યો હતો. એમણે જણાવેલું તે શિબિર-વિદ્યાર્થીના હેવાલમાંથી નીચે મુજબ મળે છે,-

પ્રિસ્તી ધર્મના પ્રચાર માટે એ લોકો આજની ઉગતી આર્થ પ્રજાને અનેક રીતે ભોળવે છે. એના એક દસ્તાવ્ત તરીકે બાલ્યવધના કુમળા આર્થ બાળક બાળિકાઓના મન પર કેવી પ્રિસ્તી ધર્મની ધેરી અસરો નખાય છે એનો બહુ ઓછાને જ્યાલ હશે. કિશ્ચિયન સ્કૂલોમાં પ્રાયમરીથી જ ઈંગ્લીશ શિખવવાની લાલચ આપી ફિમાં રાહત પણ આપે છે, અને હાકિકતમાં અંગ્રેજ ભાષાનું સારું શિક્ષણ આપતા હોય તેમાં આકાર્ષાઈ હિંદુઓ તેમના બાળકોને ત્યાં મોકલતા હોય છે. એમાં પ્રિસ્તીધર્મનું આકર્ષણ ઊભું કરવા એ લોકો કેવી કેવી કુનેહ વાપરે છે કે દાખલા તરીકે સ્કૂલ તરફથી બાળકોને નિશાળે લઈ જવા મોટર તેડવા આવે છે. બાળકોને મોટરમાં બેસાડી ડ્રાઈવર જાણી જોઈને એની બારીઓ બંધ કરી દે છે. પછી નાના બાળકોને શિક્ષક કહે છે. ‘તમે ભગવાન રામનું નામ દો એટલે મોટર ચાલુ થશો.’ બાળકો પોતપોતાના ભગવાન રામ-કૃષ્ણ-મહાવીર વગેરેનું નામ લે છે પણ મોટર ચાલતી નથી. પછી કહે ‘ચાલો ત્યારે હવે ભગવાન ઈસુનું નામ લો.’ બાળકો ‘હે ઈસુ ભગવાન’ એમ બોલે ત્યાં મોટર ચલાવવામાં આવે છે. પછી શિક્ષક બાળકોને કહે છે, જુઓ બધા ભગવાન કરતાં ઈસુ ભગવાન કેવા ભલા છે, કે એમનું નામ દેવાથી બગડેલી મોટર ચાલુ થઈ ગઈ !’ આમ બાળકોને ઈસુના ભક્ત બનાવવાની અને પ્રિસ્તી ધર્મ પ્રચારની પેરવી કરવામાં આવે છે.’

આ તો એક નુસખો. બાકી તો બાળકોને નેકટાઈ, અમુક જ ગણવેશ. મા-બાપને પણ્યા મમ્મી જેવા શબ્દો બોલવાનું, ને પાદરીને ફાધર કહેવાનું, સ્કૂલ-કોલેજોમાં પાદરીઓ કલાસ લે તેમાં ગમે તે રીતે ઈસુ પ્રિસ્ત-બાઈબલ અને પ્રિસ્તી ધર્મનું મહત્વ ધૂસેડવાનું, વગેરે કેટલાય નુસખા ચાલે છે. વડોદરાનો શિબિર વિદ્યાર્થી લખે છે કે બાળકોને ઈંગ્લીશ શિખવવાના લાગેલા ગાંડિપણમાં આગળ જતાં કેવા

વિચારો જાગશે તે પ્રત્યે મા-બાપને ચિમકી આપી હતી. આ સાંભળી મને પણ થઈ જાય છે કે ક્યાં સુધી મારે બેસી રહેવું ? મારા જેવા દશ યુવકો પૂજ્યક્રીડા પાસે તૈયાર થઈ બહાર પડીએ.

સારાંશ, (૧) જૈનોએ સંતાનોને પ્રિસ્તી સંસ્થાઓમાં અંગ્રેજ ભજાવવાનો આવો વ્યામોહ છોડી દેવા જેવો છે, નહિતર એ સંતાનોમાંથી જૈન જ શું પણ આર્થ સંસ્કૃતિય નાથ થઈ પ્રિસ્તી માનસ ઘડાશે. (૨) વિશેષમાં જૈન સંસ્કૃતિ અને જૈન ધર્મની શિક્ષા આપનારી અનેકવિધ યોજનાઓ અમલી કરવાની અત્યંત જરૂર છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૬, અંક-૨૭, તા. ૧૬-૩-૧૯૬૮

## ૨ હૃદયમાં પ્રભુનું ભક્તિથી સ્થાપન

શ્રી ‘કલ્યાણમંદિર’ સ્તોત્રમાં ‘આકર્ષિતોક્ષિ’ વાળી ગાથામાં આચાર્યપુંગવ સિદ્ધસેન દિવાકર મહારાજે પ્રભુને આ સુતિ કરી કે ‘હે જનબાંધવ ! મેં, આપને સાંભળ્યા, પૂજ્યા, જોયા છતાં ચોક્કસ, ચિત્તમાં ભક્તિ સાથે આપને મેં ધારણ કર્યા નહિ તેથી હું દુઃખનું પાત્ર બન્યો છું. કારણ કે ભાવશૂન્ય કિયા ફળતી નથી.’

આ શબ્દો સૂચયે છે કે પૂર્વ અનંતા કાળમાં ભગવાનને સાંભળવામાં પૂજવામાં કે જોવામાં બાકી રહ્યી નથી. છતાં જીવ જન્મ-મરણાદિ દુઃખનો ભાગી બન્યો રહ્યો છે એ કઈ ખામીએ ? તો કહ્યું કે ભાવની.

આજે આપણે પ્રભુદર્શન-પૂજન વગેરે બાધ્ય કિયાથી સંતોષ માનીએ છીએ. કદી એ જોવા જતા નથી કે તે તે કિયા સાથે દિલમાં તેવા તેવા ભાવ જાગ્યા ? પ્રભુના દર્શન તો કર્યા, પણ હૃદયના તાર જણાજુયા ? જેમ ગરીબ માણસને શ્રીમંતને જોતા દિલ લહેવાઈ જાય છે, દીનતા આવે છે કે ‘આ કેવો મોટો તવંગર, ને હું મુફ્ફલીસ નિર્ધન ! એમ સાજાને જોતા રોજના માંદાના મનને લાગી આવે છે કે હું આ કેવો રોગમાં પીડાતો ! તો શું સંસાર પારગામી ભગવાનને જોતા એક સંસારના ભટકતા જીવ તરીકે યા વીતરાગને જોતા એક રાગ-દ્વેષાદિ રોગોથી રોગિષ તરીકે મનને લાગી ન આવે ? મન લહેવાઈ ન જાય, દીનતા ન આવે કે અરેરે ! આ ભગવાન મળવા છતાં હું ભટકતો ? હું રાગાદિનો રોગી ?

જાતની આવી સરિયામ હીનતા ન દેખાય પછી મંદિરમાં પણ અહંત્વ ને ઠસ્સો, બતાવવાનું નાટક શે મીટે ? ઈષ વિષયોના સ્મરણ અને ખેંચાણ ત્યાં પણ શાના ખટકે કે પડતા મૂકાય ?

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

કવિ જે કહે છે કે, ‘પ્રભુને દિલમાં ભક્તિસહિત ધર્યા નહિ,’ એ ભક્તિ શી ચીજ છે ? આ જ કે દિલ પ્રભુને એવું ભજે, એવું શરણું લે, આશરો લે, કે ‘હે નાથ ! તે જે રાગાદિ રોગો હટાવ્યા અને સંસારભ્રમણ મિટાવ્યું, એ જ અદ્ભુત ખરેખરું કાર્ય કર્યું.’ મારે પણ એ જ કર્તવ્ય છે, ને તે માટે મારે જગતમાં બીજા કોઈનો નહિ પણ તારો જ આધાર છે. તેથી મારું દિલ અશરણભૂત ને વિશ્વાસધાતી એવા પૈસાટકા-પ્રતિજ્ઞા-પરિવાર વગેરેથી ઉભગી તારા પર જ ઓવારી જાય છે.’

આવો કોઈ ભક્તિનો ભાવ-ગીભો થયા કરે તો રાગાદિ રોગોને અને ભવમાં ભટકાવનારા આરંભ-વિષય-પરિગ્રહની વૃત્તિને ધક્કો કેમ ન લાગે ? કમમાં કમ એટલું તો જરૂર થાય કે ‘પ્રભુએ જો એ બધું ફગાવી દીધું છે, તો ખરેખર એ રાગાદિ અને આરંભ-વિષયાદિ દુઃખદ છે, ખતરનાક છે, ભૂંડા છે.’ પછી વારંવાર વીતરાગ પ્રભુના દર્શન પૂજન-ગુણગાને એની પ્રયે ગ્લાનીનો ભાવ આવ્યા જ કરે, જે એને ઓછાં કરવાની વૃત્તિ ઉભી કરે ને તેવો પુરુષાર્થ-પ્રયત્ન કરાવે.

આ પરિજ્ઞામ જો ન દેખાતું હોય, એટલે હજી તો રાગાદિ અને આરંભાદિ ઉપર ઝેર જ ન વરસતું હોય તો એ સૂચ્યે છે કે દર્શન-પૂજનાદિ એળે જઈ રહ્યાં છે, લુખ્યા હૃદયે કે ભળતા આશયે થઈ રહ્યા છે.

આ સ્થિતિ અનંતા કાળ અનંતી વાર ચલાવી. પરંતુ હવે અહીં તો મનને એમ થવું જોઈએ કે ‘ઈષ દેવ તરીકે સરાગી દેવ નહિ, ને વીતરાગ દેવ મળ્યા’ તો એ મળવામાં કઈ અપેક્ષાએ ભાગ્યની ભળવતા ? આટલા જ માટે ને કે મહાન ભાગ્યોદયે મળેલ વીતરાગની ઉપર એમની વીતરાગતાના ડિસાને એવો જવલંત પ્રેમ થાય, આકર્ષણ થાય, કે આપણા રાગાદિ અકારા લાગે ? વીતરાગ મળવામાં ભાગ્ય સબળ આ અપેક્ષાએ હોય તો તે આપણા સતત જ્યાલમાં હોય, તો સહેજે રાગદ્વેષાદિ અને આરંભ-વિષય-પરિગ્રહાદિ પર ગ્લાની ઉભી કરવાની તમના રહે, ને દેવદર્શન-પૂજનાદિ કરી કરી વીતરાગ અને વીતરાગતા તરફ આકર્ષણ બહુમાન એવું વધારતા જવાય કે એ ગ્લાની ઉભી થાય, વધતી જાય, ને દિલ વીતરાગ અને એમની આજ્ઞામાં વધુ ગોઠે.

બસ, વીતરાગને ચિત્તમાં ભક્તિથી સ્થાપિત કરવાના છે, જેથી કિયા ભાવયુક્ત બને. અને ! દુઃખ જાય. ‘દુઃખ જાય’ એટલે આપણે દુઃખી છીએ એવી કલ્પના જ નીકળી જાય.

દુઃખની કલ્પના કાઢવામાં આ ભાવનારૂપ સાધનો છે,-

(૧) વીતરાગદેવ જેવા અચિંત્ય-પ્રભાવી અમૂલ્ય નાથ મળ્યા, પછી મારે શી

કમીના છે ? કે બીજુ ન્યૂનતામાં મનને ઓણું લગાડું ?

(૨) વીતરાગપ્રભુના સિદ્ધાન્તમાં દુઃખ એ તો એકમાત્ર ગણિત હિસાબ છે, પૂર્વ કર્મનો હિસાબ ચુક્તે થાય છે, પાપકચરો સાફ થાય છે.

(૩) દુઃખને બાધ્ય સાથે સંબંધ છે, આત્મને વેદન થવા સિવાય કશી ખોટ નથી, એની જ્ઞાનાદિ મૂડી અકબંધ રહે છે.

(૪) વીતરાગ પર પ્રેમ સાચો ત્યારે કે એમણે દુઃખ સહર્ષ વધાવ્યાં, તો હું પણ સહર્ષ વધાવું. પતિની પાછળ સતી એજ કરે છે.

(૫) ખરું દુઃખ બાધ્ય અગવડો નથી, પણ રાગાદિની સત્તામણી છે, આરંભ-વિષય-પરિગ્રહની ગુલામી છે, પણ વીતરાગ પ્રભુને હૈયામાં ધાર્યા પછી હું બળવાન છું. એ ય દુઃખ રવાના કરીશ.

આ ભાવનાઓથી પ્રભુ પ્રત્યે ભક્તિભાવ વધશે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૬, અંક-૨૮, તા. ૨૩-૩-૧૯૬૮

### ③ ભવનિર્વેદનો એક નક્કર સક્રિય ઉપાય

ધર્મનો ગ્રારંભ ભવનિર્વેદથી એટલે કે સંસાર પરના વૈરાગ્યથી થાય છે.

‘વૈરાગ્ય’ એટલે એ ભાવ કે જેમાં સંસારના સુખ અને ધન આદિ સુખસામગ્રી ભૂંડી લાગે, ભયાનક લાગે, ‘આમા મારા આત્માનું શું થશે ?’ એવો ભય ઊભો થાય. તેથી એ છોડવા જેવી લાગે, અને ન છોડાય ત્યાં સુધી મુંજવણ રહે.

આ વૈરાગ્ય આ ભવનિર્વેદ ન આવે ત્યાં સુધી વાસ્તવિક ધર્મની શરૂઆત નથી થતી. ભલે ને એ દાનાદિ ધર્માચરણ કરે પણ ભવનિર્વેદ નહિ એટલે સાંસારિક સુખ અને એની સામગ્રીનો રસ ઊભો રહેવાનો. ફળ તરીકે એ જ માગવાનો, કે જે મજ્યેથી સંસારભ્રાણ જ વધારશે. તો પછી એવા દાનાદિને ધર્મરૂપ કેમ કહેવાય ? માટે પાયામાં ભવનિર્વેદ જોઈએ. તેથી જ વીતરાગ પ્રભુની આગળ ‘જ્ય વીયરાય’ સૂત્રમાં પહેલી માગણી એની મૂડી.

સવાલ એ છે કે આ ભવનિર્વેદ લાવવો શી રીતે ?

‘અધ્યાત્મસાર’ માં ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે ‘ભવસ્વરૂપવિજ્ઞાનાદ’ એ શ્લોકથી કહું કે (૧) સંસારનું નન્ન સ્વરૂપ સમજો. (૨) એનામાં સરાસર નિર્ગુણતા છે, અસારતા છે’ એવી દસ્તિ ઊભી કરો. અને (૩) એથી આવો નિર્ગુણ

સંસાર પર દ્વેષ અરુચિ કેળવો. એટલે (૪) એની ઈચ્છાનો જે ઉચ્છેદ થાય એ વૈરાગ્ય યાને ભવનિર્વેદ થયો કહેવાય. આમ ભવનિર્વેદ માટે સંસાર યાને એના સુખો અને સુખસામગ્રીમાં નિર્ગુણતા-નિસ્સારતાની હાડોહાડ બુદ્ધિ અને એથી એના પર થતી નફરત-અરુચિ-મુંજવણ એ મુખ્ય ઉપાય થયો.

પરંતુ વાંધો એ આવે છે કે સંસારની અસારતા જાણવા છિતાં એના સુખ અને ધન-સ્ત્રી-પુત્રાદિ સામગ્રી પર એવો અભાવ નથી થતો એવી અરુચિ નફરત નથી થતી, ઊલટું એમાં મિઠાશ-હુંફ-આશાએસ લાગ્યા કરવાનું ચાલુ રહે છે. આ વાંધાભર્યું છે, પણ એ વાંધો ટાળવો શી રીતે ? ને ખરેખર અભાવ, કડવાશ, અકળામણ, અજંપો ઊભો કેમ કરવો ?

ત્યારે આ મિઠાશ-હુંફ-આશાએસના મૂળ તપાસવા જોઈએ. મૂળ આ છે, કે (૧) આપણે સુખ-સામગ્રીના ગાઠ પરીયયમાં રહીએ છીએ. (૨) વારંવાર એના સ્મરણ કર્યા કરીએ છીએ, (૩) એના પર ભરપૂર વિચારણાઓ ચલાવીએ છીએ, (૪) એની વાતો કર્યા કરીએ છીએ, (૫) એની આશાઓ સેવીએ છીએ, (૬) મનોરથો ઘડીએ, (૭) યોજનાઓ ચિંતયા કરીએ, ‘સુખ સામગ્રીમાં લેશ માત્ર પણ આધું પાછું ન થાય’ (૮) એની પૂરી તકેદારી રાખીએ...વગેરે વગેરે કાર્યો કરીએ છીએ, એટલે પછી સંસાર અને સુખ સામગ્રી પ્રત્યે કડવાશ-અભાવ-અરુચિનો હાડોહાડ અનુભવ કર્યાંથી થાય ?

હવે જો એમ કહો કે ‘તો પછી એ બધા મૂળ બંધ કરી દેવા, સંસારને અસાર સમજુ સુખ-સામગ્રીનો રસ ન રાખવો, એની બહુ વિચારણા-સ્મરણ-પલેવણ ન કરવી,’ આમ કહો તો એટલા નિષેધમાત્રથી એ નહિ અટકે એમ આપણો અનુભવ કહે છે. કેમ કે શાસ્ત્ર, ઉપદેશ, વગેરેથી નિષેધનું બહુ બહુ સાંભળવા જાણવા છિતાં એ અટકતું નથી, ને હાડોહાડ ભવનિર્વેદ જાગતો નથી એ હકીકત છે. માટે કોઈ એવો નક્કર સક્રિય ઉપાય Positive Ways Mean’s Instrument જોઈએ કે જેથી એ બધામાં મંદતા આવે, ઓદ્ધાશ થાય.

બસ ત્યારે એવો એક ઉપાય આ છે કે આપણને ભગવાન બહુ ગમવા જોઈએ. ભગવાન એવા ગમે, એવા ગમે કે મન વારેવારે ભગવાનમાં ને ભગવાનમાં જ જાય. મનને થયા કરે કે ‘વાહ મારા વીતરાગ પ્રભુ ! વાહ જગતના અને મારા ઉદ્ધારક નાથ ! તમે કેવા મારા આત્મસ્નેહી ! કેવું તમારું વૈરાગ્ય-જળકૃતું જીવન ! શું તમારા આત્મપરાક્રમો ! કેટલો અદ્ભુત ત્યાગ ! ગજબ સહિષ્ણુતા ને અનુપમ ઉપશમ ! કેવો તમારો અનંત ઉપકાર ! બસ તેમ જ મારા એક આધાર, એક શરણ, એક પિતા, એક બંધુ...’

મનમાં વારેવારે આવા ભાવ આવ્યા કરે એટલે સહેજે પ્રભુ બહુ ગમતા થાય, અને પ્રભુ બહુ ગમે એટલે સહેજે સંસારની સુખ-સામગ્રી બહુ ન ગમે.

ભલે દાવો રાખીએ કે ‘શું અમને ભગવાન બહુ નથી ગમતા? બહુ ગમ્યા વિના અમે એમને ભજુએ છીએ?’ પણ ખરેખર આ વિચારવા જેવું છે કે ભગવાન બહુ ગમતા હોય તો દિલને ચેન કર્યાં પડે? ભગવાનમાં કે બીજે? દિલ કર્યાં હરે? મન કર્યાં જઈ જઈને ચોટે?

બસ, કરવાનું આ છે કે ભગવાન બહુ ગમે અને તેથી જ બાધ્ય સુખ-સંપત્તિ-સગવડમાં મનને એમ થયા કરે કે ‘આમા શો માલ છે? મારા ભગવાને તો આને ફગાવી દીધા છે, અને અમને પણ એ જ કરવાનું કશ્યું છે.’ જીવનના પ્રસંગ-પ્રસંગમાં અને એમ ને એમ પણ ભગવાન આમ મનમાં લાવવા, લાવ્યા કરવા, જેથી સહેજે સંસાર તુચ્છ લાગે. આ સચોટ નક્કર સક્રિય ઉપાયથી ભવનિર્દેં સુલભ બનશે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૬, અંક-૨૮, તા. ૩૦-૩-૧૯૬૮

## ૪ નિશ્ચયદિનો દુરૂપયોગ

જગતમાં બહું છે, પણ એનો સદ્ગુરૂપયોગ કરતા આવડે એ કમાઈ જાય, ને દુરૂપયોગ કરનારો ગુમાવે. ઝેરનો પણ ઉપયોગ કરી જાણાર વૈદ એમાંથી દવા બનાવી એથી મહારોગ મટાડે છે. બિનઆવડતવાળો ઝેરથી મરે છે. સાપનો પણ ઉપયોગ કરી જાણાર મદારી એથી રોજ કમાય છે, ત્યારે અખુંજ મોત પામે છે. એમ આત્માને જે જોવાની દાખિ બે નિશ્ચયદિને વ્યવહારદાખિ, એનો સદ્ગુરૂપયોગ કરી જાણાર વિકાસ પામે છે. ત્યારે દુરૂપયોગ કરનારો વિનાશ પામે છે. કેવી રીતે?

નિશ્ચયદિને આત્મા શુદ્ધ-બુદ્ધ-વીતરાગ-અનંતજ્ઞાની અને અક્રિય છે. જડના સંયોગથી એના આ મૂળભૂત સ્વરૂપનો લેશમાત્ર નાશ થતો નથી, કે એનામાં કશું વધતું નથી. એ સ્વરૂપ એનામાં અકંધંધ રહેવા પર જડસંયોગ કરી વિપરીત અસર કરી શકતો નથી. આ શુદ્ધ સ્વરૂપ પર દાખિ કેળવાય તો જડસંયોગોથી થતાં રાગદ્વેષાદિ વિકારો મંદ પાડી શકાય.

હવે ભાન્ત મનુષ્ય આ દાખિનો સદ્ગુરૂપયોગ સમજતો નથી. તેથી દુરૂપયોગ એવો કરે છે કે એ એ પરથી એમ નક્કી કરી બેસે છે કે, જડ શરીરની દાનાદિ

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૭

કિયા, તપસ્યા, ત્યાગ, દેવભક્તિ, ગુરુસમાગમ-સેવા વગેરે એ શુદ્ધ આત્મા પર કશી અસર કરતા નથી. માટે એ નકામા છે. ને એની મમતા રાખવી યા ન એથી કલ્યાણ માનતું જોઈએ, કે ન એની પૂઠે પડતું જોઈએ. આમ બધું સારું આચરણ ગુમાવે છે, ત્યારે ખૂબી એ, કે એ જ પાછો વેપાર-રોજગાર, ધરસંસાર આરંભ-પરિગ્રહ અને વિષયોના ઉપભોગ, વગેરે વગેરે તો બધું ઊભું રાખે છે. એમાં શું દિલમા રાગાદિ ભાવો નથી રમતા રહેતા, રહે છે જ. ઊલટું ધર્મના નામ હેઠળ એની અને ગમ પડતી નથી, ને સારા આચરણમાં ન ફસ્યાનો આનંદ રહે છે. આમ મહા મિથ્યાત્વમાં ફસ્યો એ જીવનભર પાપાચરણો સેવી રાગાદિથી કલુષિત જ રહ્યો દુર્ગતિમાં ચાલ્યો જાય છે. પાપાચરણથી બીજું શું મળે?

પ્ર.- પણ રાગાદિ ન રાખે, વીતરાગી દશા તરફ લક્ષ રાખે, તો તો વાંધો ન આવે ને?

૩.- આ બ્રમણા છે. કેમ કે જો રાગાદિ નથી, તો તો પેલા સદ્ગુરૂપયોગ કેમ ન કરે? શું કામ એ ઉપવાસ નથી કરતો, ને ખાવા બેસે છે? શું કામ એ દાન-સુકૃત નથી કરતો, ને ધનકમાઈ કરે છે, શું કામ એ સામાયિકાદિ નથી કરતો, ને હરેકફે છે? જો રાગાદિ નથી તો પક્ષપાત શો કે ધર્મક્રિયા ન કરવી ને પાપક્રિયા કર્યે જવી? પક્ષપાત સૂચ્યવી જ રહ્યો છે કે દાનાદિ કિયા પર દ્રેષ છે ને ધનાર્જન વગેરે કિયા પર રાગ છે એટલે દ્રેષ નિવૃત્તિ કરાવે ને રાગ પ્રવૃત્તિ કરાવે, એ સહજ છે. સામાન્ય નિયમ છે કે પ્રવૃત્તિમાં રાગ કારણ ને નિવૃત્તિમાં દ્રેષ કારણ.

ખરી વાત એ છે કે, ધન-કુદુર્ભ-વિષયો-ખાનપાન વગેરેમાં રચ્યા પચ્યા રહેવાથી એના રાગ મમત્વાદિ એટલા બધા પોખાય છે કે જીવ અંતે માનવ અવતારેથી બ્રાહ્મ થઈ એ મમત્વાદિ લઈને ચિરકાળ સંસારમાં ભટકતો થઈ જાય છે. નહિતર અનંતાનંત પુદ્ગલ પરાવર્તના કાળ વહી ગયા, જીવને આ હુંખદ જન્મ-મરણાદિમય સંસારમાં ભટકતા રહેવાનું શું કારણ હતું?

કહે છે ‘અનંતી વાર ધર્મક્રિયાઓ કરી છતાં જીવ રખડતો રહ્યો ને?’ એટલે શું ધર્મક્રિયાઓથી રખડતા રહેવાનું બન્નું? કે હિંસા-જૂઠ-ચોરી-વિષય-પરિગ્રહ વગેરેની ધૂમ કિયાઓથી?

શું ધર્મક્રિયાના રાગે રખડતો રહ્યો? કે વિષયાદિના રાગે રખડતો-ભટકતો રહ્યો?

અવ્યવહાર રાશિમાં પડેલા જીવો અનંતાનંત કાળથી એમાં ને એમાં જ જન્મે-મરે છે, એને કથો ધર્મક્રિયાનો રાગ છે? જંગલના સિંહ-વાઘ-અજગર કે સમુક્રના મગરમય મરીને નરકાદિમાં ભટકતા રહે છે. એ કંઈ ધર્મક્રિયાથી કે

૮

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

એના રાગથી ? ધર્મકિયાથી રખડતો રહ્યો એમ માનવું એ નરી ભમણા છે, મિથ્યાજ્ઞાન છે.

જીવ જે આ સંસારમાં ભટકતો રહે છે એ ઈન્દ્રિય-વિષયોના રાગથી, ધન-માલ-કુટુંબ-ખાનપાનાદિના રાગથી ને આરંભ-પરિગ્રહ જૂઠ-ચોરી વગેરે કિયાઓથી. એના જ યોગે અનંતીવાર માનવપણામાંથી બ્રષ્ટ થઈ થઈ સંસારયાત્રા સલામત રાખી છે.

એટલે ખરું કરવાનું તો આ છે કે પાપકિયાઓ અને એના રાગથી બચવા માટે શુભકિયાઓમાં પલોટાવું જોઈએ, એ માટે એના પર ધરખમ રાગ ઊભો કરવો જોઈએ. તો જ પેલો રાગ અને રાગની પાપકિયાઓ ઘટે, ને તોજ ધર્મકિયા શુદ્ધ, ધર્મના રાગથી, ઉત્ત્વાસથી અને નિરાશાસભાવે સેવાય. ઉપવાસાદિ તપ વહાલો કરાય, તો ખાવાનું પાપ ઘટે. ખાવાનો રાગ ઘટે. સદાચારને પ્રેમથી દૃઢપણે વળગી રહેવાય, તો દુરાચાર અને એના રાગ છૂટે. સાધર્મિક વહાલા કરે તો સગા પરના આંધળા રાગ ઓછા થાય.

નિશ્ચયદિના સદ્ગુપ્યોગની આવડત નહિ તેથી એના દુરુપ્યોગમાં તણાયેલા નિશ્ચયમૂઢ માણસો સદ્ગ્યાચરણો, સત્કૃત્યાઓ, ને શુદ્ધ પ્રવૃત્તિઓ ગુમાવે છે, ને અસત્ત અશુદ્ધ પ્રવૃત્તિમાં જીવનભર મહાલતા રહી દુર્ગતિના પલ્લે પડી જાય છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૬, અંક-૩૦, તા. ૬-૪-૧૯૬૮

#### ④ નિશ્ચયદિનો સદ્ગુપ્યોગ

ગયા લેખમાં નિશ્ચયદિના દુરુપ્યોગની વાત થઈ. હવે એના સદ્ગુપ્યોગનો એક મહાન વિચાર આ પ્રમાણે કરી શકાય.

નિશ્ચયદિને આપણો આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, યાને વીતરાગી સ્થિરતા અને અનંત વીર્યાદિથી ભરેલો છે. એ એનો મૂળ સ્વભાવ જ છે. મૂળ સ્વભાવમાં જ એ અનંતજ્ઞાનાદિ પડેલા છે. જો એ મૂળ સ્વભાવમાં જ ન પડેલો હોય, તો એવા સ્વભાવ વિનાનો આત્મા અને એવા સ્વભાવ વિનાના જડ, એ બેઉં સરખા થાય. પછી જરૂમાં જ્ઞાનાદિ પ્રગટે નહિ, ને આત્મામાં પ્રગટ થાય એવું કેમ બની શકે ? માટે જ કહો, એ તો આત્મ-સ્વભાવમાં પડેલા પણ કર્મનાં આવરણથી દબાયેલાં, તે તેવા તેવા નિમિત્ત પામી આવરણ અંશે ખસવાથી પ્રગટ થાય છે. મૂળમાં જ ન હોય તો પ્રગટવાનું શું ? અને જ્ઞાનાદિ જો નવા ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૮

ઉત્પન્ન થતાં હોય તો તો આત્માની જેમ જડ શરીરને કે અંગોપાંગને પણ એ કેમ ઉત્પન્ન ન થાય ?

પ્ર.- ભલે આત્માના મૂળ સ્વભાવમાં જ્ઞાનાદિ ખરાં, પણ એ અનંત કેમ ?

૩.- અનંત એટલા માટે કે જો લિમિટ-મર્યાદા બાંધીએ કે આટલું જ જ્ઞાન, આટલું જ દર્શન, આટલી હદની જ વીતરાગતા...વગેરે, તો પ્રશ્ન રહે કે એટલું જ કેમ ? એથી વધુ કે ઓછું કેમ નહિ ? વળી જ્ઞાન એનું નામ કે જે જ્ઞાયને જણાવે, અને જગતમાં જ્ઞાય પદાર્થ અનંત છે, તો એને અવગાહનાર જ્ઞાન પણ અનંતું જ હોય, એમ દર્શન પણ દશ અનંત હોઈ અનંત જ હોય. એમ રાગદ્રેષ કરવાની વસ્તુ અનંતની સંખ્યામાં છે, તો એની પ્રતિપક્ષી વીતરાગતા પણ અનંત જ હોય. એમ વીર્ય પણ અનંત કર્મ વગેરે સુધી પહોંચે છે તેથી અનંત છે.

બસ્તુ, આ અનંત જ્ઞાનાદિ સ્વભાવ આત્મામાં પડેલો જ છે, અકબંધ છે, આવરણો એને ઢાંકે એટલું જ પણ એમાંથી રંચ માત્ર નાશ કરી શકે નહિ. નષ્ટ થાય તો પછી પાછું લાવવું ક્યાંથી ? નષ્ટ નહિ, ને નવું વધવાનું નહિ, પણ અકબંધ રહે છે. જો અકબંધ છે, તો શુદ્ધ આત્માનો અ-કર્તૃત્વ અ-ભોક્તૃત્વ સ્વભાવ પણ અકબંધ છે.

એટલે શુદ્ધ નિશ્ચયદિના આ આત્મસ્વરૂપને નજર સામે રાખીએ, તો લાગે કે ‘આ શરીર અને એને લગતી બધી વસ્તુ, બધી કિયા, બધી આપત્તિ-સંપત્તિ કર્મના ધરની છે, શુદ્ધ આત્માના ધરની નહિ. માટે એ બધાથી અંતરથી અલિપ્ત બનવાનું. એમ વિચારવાનું કે એને ને મારે કોઈ સંબંધ નથી. મારે સંબંધ મારા અકબંધ શુદ્ધ જ્ઞાન-દર્શન વીતરાગભાવ અને વીર્યાદિ સાથે છે. મારે એના ઉપર જ દાખિ રાખવાની.’

આ વસ્તુ બરાબર હૃદયસ્થ કરાય, સહજ બુદ્ધિને એનાથી વારંવાર ભાવિત કરાય તો, પછી જે કાંઈ પ્રતિકૂળતા આપત્તિ ઉપદ્રવ આવે એમાં મન બગાડવાનું રહે નહિ. કેમ કે ત્યાં ભાવિત કરેલી સહજ બુદ્ધિ એ જ રહ્યે કે ‘હું તો શુદ્ધ જ્ઞાનાદિમય, અકર્તા, અભોક્તા, મારે આની સાથે શો સંબંધ ? એનાથી મારા અનંત જ્ઞાનાદિ સ્વરૂપમાંથી લેશમાત્ર નષ્ટ થતું નથી, નષ્ટ કરવાની કે વધારવાની એની કોઈની તાકાત છે નહિ, પછી ભલે બહારનું ચાલતું હોય એમ ચાલે. મારે એની કોઈ અસર શા માટે લેવી ? શા માટે રાગાદિ કલુષિત ભાવ કરવા ?’

પ્ર.- એમ તો પછી ધર્મપ્રવૃત્તિથી ય ઉદાસીનભાવ નહિ આવે ?

૩.- ના, એનું કારણ એ છે કે જીવન છે ત્યાં સુધી મન-વચન-કાયા અને

૧૦

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

ઇન્દ્રિયોની કોઈ પ્રવૃત્તિ તો રહ્યા કરવાની. અરે ! ઉંઘવું એ પણ શું છે ? કાયાની આરામની પ્રવૃત્તિ. હવે જો ધર્મપ્રવૃત્તિ નથી તો સહજ છે કે પાપપ્રવૃત્તિ ચાલુ રહેવાની. ત્યારે જીવની દશા એવી છે કે એ પ્રવૃત્તિઓ મોટા ભાગે રાગ-દ્વેષ વગેરેથી મિશ્રિત જ કરે છે. એમાં કલુષિતતા વધે છે.

અહીં જો કોઈ એમ દાવો રાખતું હોય કે અમે તો ઉદાસીન ભાવે એ બધું કરીએ છીએ, તો એને પ્રશ્ન છે કે ‘ભાઈ ! તો પછી એ તો કહો કે તમારે એ પ્રવૃત્તિ કરવી જ કેમ પડે છે ? રોજ ને રોજ અનેકવાર ખાવાનું શું કામ છે ? પીવાનું શું કામ છે ? ધંધાની શી જરૂર ? પૈસા લાવવા-ગણવા-મૂકવા વગેરેની શી આવશ્યકતા ? ખાવામાં બધા રસનું શું કામ ? દસ ચીજનું શું કામ ? ચાર ટંક શા માટે ? જમતા રોટલીનો ટૂકડો દાળમાં કેમ બોળાય છે ને પાસે જ પડેલા પાણીના ગલાસમાં કેમ નથી બોળાતો ? શું પ્રામણિકતાથી એ કહી શકશે કે રાગ વિના એ બધું થાય છે ?’

હજુ કહી શકે તો ત્યાગી કહી શકે કે જેટલા પ્રમાણમાં એ પાપપ્રવૃત્તિઓ હું નથી કરતો એટલા પ્રમાણમાં રાગથી બચાય છે. ઉપવાસ કર્યો એ દિવસે ખાવા અંગેનો રાગ ઘટયો. એક ટંકથી જ પતાવ્યું, તો બાકીના ટંકની પ્રવૃત્તિ અટકીને એમાં રાગ થાત તે અટક્યો. શાસ્ત્રવાંચનમાં પરોવાયા એટલા નિદા-વિકથા-કુથલીના થતાં રાગથી બચ્યા. ત્યારે ધર્મપ્રવૃત્તિ શું છે ? આ બધી પાપપ્રવૃત્તિમાંથી તેનો તેનો ત્યાગ. એમાં રાગ-દ્વેષાદ્ધિથી બચાય છે એટલે શુદ્ધ આત્મા ઉપર દાખિલાને ધર્મપ્રવૃત્તિની ઉદાસીનતા નહિ આવે. કેમ કે એ રાગાદ્ધિથી બચાવનાર હોઈ અનુકૂળ છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૬, અંક-૩૧, તા. ૧૩-૪-૧૯૬૮

## ૬ નિશ્ચયદાસ્તિ કેવી રીતે કેળવવી ? એના શા લાભ ?

ગયા લેખમાં નિશ્ચયદાસ્તિનો સદ્ગુર્યોગ વિચાર્યો એ કેવી રીતે કેળવવી એનો હવે વિચાર કરીએ.

પહેલી વાત એ કે આપણે એટલે આ શરીર નહિ. પણ એના સંચાલક કોક છીએ અને તે એની અંદર રહેલા છીએ. માટે તો એ ‘કોક આપણે’ ધાર્યા પ્રમાણે શરીરને બેસાડીએ, ઉઠાડીએ, ચલાવીએ ને ચાલતું અધવચ્ચે જ અટકાવી દઈએ છીએ. એ જ પ્રમાણે એના અવયવો તથા ઇન્દ્રિયોને હલાવીએ ચલાવીએ અટકાવીએ. ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૧

વગેરે કરી શકીએ છીએ. યાવત્ત વાણીથી ઉચ્ચારણ અને મનથી વિચારણા કરવામાં પણ આપણે સ્વતંત્ર છીએ, ધાર્યા પ્રમાણે ચલાવી શકીએ છીએ. આ બધું સૂચવે છે કે ‘આપણો’ એટલે આ શરીર અવયવો, ઇન્દ્રિયો, વાણી અને મનથી તદ્દન જુદા એક ‘આત્મા’ છીએ. આત્મા એ એક સ્વતંત્ર દ્રવ્ય છે.

આ આત્મા ગયા લેખમાં વિચાર્ય મુજબ મૂળમાં અનંત જ્ઞાન-દર્શન વીતરાગતા અનંતવીર્ય વગેરે સ્વરૂપવાળો છે. શુદ્ધ નિશ્ચયદાસ્તિ અને સર્વ કણે એવા જ સ્વરૂપવાળો માને છે. એટલે હવે કરવાનું એ છે કે ભલે વ્યવહાર દાસ્તિથી આત્મા કર્મથી ઢંકાયેલો, અલ્પજ્ઞ, દુર્બળ, અને શરીરધારી વગેરે હોય, પરંતુ આપણે સ્વસ્થ બની આંખ મીંચીને અંદરમાં એ સ્વરૂપ જોવાનો પ્રયત્ન કરવાનો. આંખો મીંચવાનું કારણ એ, કે બહારનું દેખાતું બંધ થાય ત્યારે મન એ છોડી અંદરમાં સ્થિર થાય. હવે આમ તો અંદરમાં અંધકાર જ દેખાશો, પરંતુ કલ્પનાથી અનંત જ્ઞાનપ્રકાશમય આત્મા દેખવાનો પ્રયત્ન કરવાનો. એ જ્ઞાનપ્રકાશમાં સમગ્ર વિશ્વ પ્રતિબિંબિત દેખાય, ૧૪ રાજલોક, સ્વર્ગ-મધ્ય-પાતાલલોક દેખવાના, અને એમાં દરેક ૪૩ ચેતન દ્રવ્ય પોતપોતાના પર્યાય અનુભવતા દેખાય. આપણે તટસ્થ દષ્ટા.

એટલે આમાં ધ્યાન રાખવાનું કે કયાંય આપણને રાગ કે દ્રેષ ન થાય, એવું શુદ્ધ દર્શનમાત્ર કરવાનું. જેમ કે દા.ત. પાતાલલોકમાં પરમાધારી નરકના જીવને ફૂટ્ટો દેખાય તો ત્યાં એના પર ગુસ્સો ન ચેડે, કિન્તુ એ બિચારો પરમાધારી પણ પોતાના કર્મવશ મોહપર્યાય અને અશુભ યોગપર્યાયને અનુભવતો દેખાય, તેમ બિચારો નારક જીવ પણ પોતાના કર્મોદયના પર્યાય ભોગવતો જગ્યાય. આવી શુદ્ધ જ્ઞાનદાસ્તિ આગળ વધતા આપણાં શરીરને પણ પ્રતિબિંબિત દેખે તે પણ સુખ-દુઃખ ભોગવતાં શરીરને તટસ્થભાવે રાગ-દ્વેષ વિના જુએ એટલું જ નહિ, પણ પોતાના ભૂતકણના કોઈ દેવ-નારક, ભૂડુ-માનવ, કીટ-હાથી વગેરે ભવના શરીર વિચિત્ર ચેષ્ટાવાળા દેખે.

આ બધું દેખવાનું પ્રયોજન એ છે કે એ રીતે જગતભરનું અને પોતાના શરીરોનું સારું-નરસું યાં દીષ્ટ-અનિષ્ટ જોતા અને તે પણ રાગદ્વેષ વિના તટસ્થભાવે નિરખતા એકબાજુ શુદ્ધ જ્ઞાનદાસ્તિ પક્વ થતી જાય. રાગાદિ ઉપર કાબુ આવતો જાય, અને બીજી બાજુ અંદરમાં જ્ઞાનપ્રકાશમય સ્વતંત્ર આત્મ-વ્યક્તિની દર્શનકલ્પના દૃઢ થતી જાય.

એથી લાભ એ થાય કે બહારમાં સગવડ-અગવડ ને દીષ્ટ-અનિષ્ટ આવે એના પર એટલા બધા હર્ષ-ખેદ કે રાગ-દ્વેષ નહિ ઉણ્ણે. વારંવારના પેલા આંતરદર્શનના સંસ્કાર મજબૂત થતાં જવાથી આ પરિણામ સુલભ બને છે. શુદ્ધ ૧૨ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪) E:/Divya-Darshan(Agralekh)Final&Butter-Title/divya darshan(part-4)(yr.16-19).pmd/prf.4/Final

નિશ્ચયદેખિના સ્વરૂપવાળા આપણા આત્માને જ્ઞાણે વર્તમાન શરીર અને તત્ત્વસંબંધી પદાર્થ-પ્રસંગ-પરિસ્થિતિ સાથે કશી લેણદેણ નથી. જગતના જેમ બીજા શરીર, એમ આ પણ શરીર પોતાનું કામ કરે છે. આત્મા તો માત્ર દદ્ધા, તે બીજાને જુએ એમ આને જુએ. શરીરનું ગમે તે થાઓ, પડો-આખડો, કપાઓ-કૂટાઓ, ભૂઘ્યું થાઓ તરસ્યું થાઓ, આત્માએ તો માત્ર જોવાનું, પણ હુંખી ખિન્ન નિરાશ નહિ થવાનું. એમ શરીરની સુખસગવડમાં ય માત્ર જોવાનું, જરાય આનંદિત નહિ થવાનું. અંદરમાં ખૂબ વાર શુદ્ધ જ્ઞાનાદિમય આત્માનું કાલ્યનિક દર્શન કર્યા કરવાથી આ સરળ બને છે.

હવે બીજું એ કરવાનું છે કે આંખ મીંચીને અંદરમાં આત્માને અનંત જ્ઞાનમયની જેમ અનંત વીર્યમય અને અનંત લાભમય દેખવાનો છે. એની એવી શ્રદ્ધા કેળવવાની કુ એથી સર્વ આપત્તિ તૂટે અને સર્વ લાભ મળે. અલબંત આત્માને શુદ્ધ સ્વરૂપવાળો જ દેખોએ એટલે બાધ્ય આપત્તિની ગણના જ ન હોય, એના પર દ્વેષ-અરુચિ કાંઈ જ ન કરાય, તેમ તુચ્છ માન-પાન-સંપત્તિની રાગ-રતિ-લાલસા ય કરાય નહિ. કેમ કે આપણે વીતરાગ, આપણે વળી એ રાગદ્રેષ શા? છતાં હકીકિત એ છે કે બાધ્યની વસ્તુ આપણાને અસર કરી જાય છે, એનાથી બચવા આ અનંતવીર્યમય-લાભમય આત્મદર્શન છે. ત્યાં એ શ્રદ્ધા જોઈએ કે કંઈ ફાંઝા મારવાની જરૂર નથી. આ વીર્ય અને લાભમાં એટલી બધી ગજબ તાકાત છે કે આપત્તિઓ તૂટે ને સંપત્તિ મળે. મારું કામ માત્ર આત્મદર્શન કરવાનું. બાકી બધું એના રાહે બનતું રહેવાનું જ. કંઈ ઓદ્ધું વધતું બને એ બધું બહારનું છે, કર્મના ઘરસું છે. તો તેથી મારે શી ખોટ કે શી વૃદ્ધિ છે? હું એ બધાથી તદ્દન નિરાળો શુદ્ધ જ્ઞાનાદિમય આત્મા છું. એની સતત ભાવના કરતા કરતા એક દિવસ એ સ્વરૂપ પ્રગટ થઈ જ જવાનું છે. બસ, તો એ દર્શનમાં મારા રસ્તે છું. મારા રસ્તે મારે ચાલ્યા જવાનું.

આમ બહારની તદ્દન બેપરવાહીથી શુદ્ધ આત્મદર્શન વધુને વધુ આત્મસાત્ર કર્યે જવામાં બહારનો વિચાર નહિ કરવા છતાં બહારનું સહેજે સરખું થઈ આવે છે.

શુદ્ધ નિશ્ચય દેખિના આત્મદર્શનનો પ્રભાવ કે મહાવીર પ્રભુ દેવતાઈ ધોર ઉપસર્ગ વખતે પણ, ને ૪-હ માસના ઉપવાસના તથા સતત કલાકો ધ્યાનમાં ખડા રહેવાના કષ્ટમાં એના તરફ બેપરવા રહી શકતા અને એ શુદ્ધ આત્મચિંતનમાં આગળ જઈ ખરેખર પ્રગટ શુદ્ધ પરમાત્મા બની ગયા. સારાંશ, શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન રહો, ને બાકીનું કર્મના ઘરનું છે, તેથી મારાથી નિરાળું છે એમ માની એની અસર ન લો.

## ૬ અધ્યવસાયનું મહત્વ અને આલંબનનું મૂલ્યાંકન

(લેખાંક-૧)

જીવન ઉત્થાન અને પતનનો આધાર શુભ ને અશુભ અધ્યવસાય યાને હૃદયના ભાવ પર રહેલો છે. એકેન્દ્રિય જેવી યોનિમાંથી જીવ બહાર નીકળે છે ને બેઈન્ડ્રિયાદિ યોનિમાં આવે છે. તે પણ એના પરિણામ યાને અધ્યવસાય કંઈક પણ શુભ થવાના યોગે ઊભા થતાં પુણ્યને લીધે. કિન્તુ આમ થવામાં ખાસ, કારણભૂત છે એના પુરુષાર્થ કરતા કાળ, ભવિતવ્યતા, અકામ નિર્જરા, વગેરે પરિસ્થિતિ. ત્યારે સંઝી પંચેન્દ્રિય જીવો પોતાના પુરુષાર્થી અધ્યવસાય શુભ બનાવી શકે છે. કેમ કે એ કરવા માટે એને પ્રબળ સાધન તરીકે મન મળેલું છે.

એ તો ઉધારું જ છે કે મન જેવા શુભ યા અશુભ ભાવમાં લઈ જવું હોય તેમાં લઈ જઈ શકાય છે. જગતની વચ્ચે રહેવાનું છે એટલે ચાલુ ને નવનવા સંયોગ તો રહેવાના ને મળવાના. એના પર મન બગાડવું કે પવિત્ર રાખવું, એ આપણા હાથની વાત છે. અલબંત મન બગાડવા કે સારું રહેવામાં (૧) પૂર્વના સારા-ખરાબ સંસ્કાર, (૨) વર્તમાન સારું-નરસું ઘડતર, (૩) તત્ત્વની સમજ યા આણસમજ, (૪) પ્રબળ રાગાદિથી મૂઢદશા કે રાગાદ પર નિયંત્રણ, વગેરે કામ કરે છે. માટે તો ‘ઉપમિતિ’ શાસ્ત્રમાં આવે છે કે, (૧) સંસારી જીવ કેટલીય વાર સદ્ગુરુનો યોગ થતાં છતાં પોતાના પૂર્વના પ્રબળ કુસંસ્કારના યોગે પ્રતિબોધ પામતો નથી. શુભ અધ્યવસાય કરતો નથી. (૨) ત્યારે આજે દેખાય છે કે કેટલાય જીવો પહેલા સારા પણ પછી ખરાબ સંગે નરસા ઘડતર ને ખરાબ વિચારણામાં ચડી જવાથી ગુરુયોગ થવા છતાં ય મન સુધારી શકતા નથી. (૩) પૂર્વના સંસ્કાર અને આઈનું ઘડતર તો સારું હોય પણ તત્ત્વસમજ ન હોય તો પણ અજ્ઞાનતાથી શુભ અધ્યવસાય પામી શકતા નથી. (૪) પૂર્વ સંસ્કાર અને વર્તમાન ઘડતર તથા તત્ત્વસમજ પણ સારા મળ્યા હોવા છતાં કામ, કોધ, લોભ વગેરેની ઉત્ત્રતા હોય તો શુભ અધ્યવસાય નહિ લાવી શકે, બ્રહ્મદંત જેવા ચક્કવર્તી અને લક્ષ્મણ જેવા વાસુદેવો સમજવા છતાં પ્રબળ રાગાદિના યોગે અશુભ અધ્યવસાયમાં રમી નરકે ગયા.

આમ છતાં શુભાશુભ અધ્યવસાયમાં સંયોગો નિમિત્તો આલંબનો અગત્યનો ફાળો આપે છે. વાતોડિયાના સંયોગમાં અશુભ અધ્યવસાયની ધારા ચાલે છે, ત્યારે

ધર્મપદેશકના સંયોગમાં શુભની લહેરીઓ ઉઠે છે. સામાએ કરેલ અપમાનનું નિમિત્ત પામી મન બગડે છે, ત્યારે જોઈની અજબ તપસ્યા કે દાનાદિ સાંભળવાનું નિમિત્ત મળતાં શુભ અધ્યવસાયની લહેરી ઉઠે છે. પાપી મોહમૂઢ શિક્ષકના આલંબને વિદ્યાર્થી અશુભ ભાવોમાં સબડે છે ત્યારે ધર્મત્વા અધ્યાપકના આલંબને વિદ્યાર્થી હૈયામાં પવિત્ર ભાવોનો લાભ પામે છે.

એ ફરીથી યાદ રહે કે મનુષ્યને પશુ કે પિશાચની કોટિમાં ઉતારી દેનાર મુખ્યપણે એના હૈયાના કલુષિત ભાવો છે. ચિત્તના રાગાદિ સંકલેશ છે. જ્યારે એને માનવતા ને દિવ્યતા અપાવનાર પવિત્ર શુભ અધ્યવસાયો છે. આ ઉત્તમતા કે દુર્દ્શા સંત કે શેતાન જેવા જીવોમાં જોવા મળે છે. સંત પવિત્ર વિચારસરણીમાં રમતા હોય છે, ત્યારે શેતાનના દોસ્તો અધમ ભાવોમાં ખરડાયા રહે છે. મન બંનેને મળેલું છે. જગતની વચ્ચમાં બંને રહે છે. પરંતુ બંનેના મનોયોગ યાને મનના પુરુષાર્થ વચ્ચે આકાશ-પાતાળ જેટલું અંતર છે. એક તો મનથી શુભ ભાવના ગિરિશિખરે આરૂઢ થાય છે, ત્યારે બીજો અશુભ ભાવના ગંધાતા કૂવામાં સરે છે.

હવે જો આપણા આત્માને ઉત્તમ દશામાં ને સંતની ભૂમિકામાં લઈ જ્વો હોય ને એમાં જ રિસ્થિર કરવો હોય તો સ્પષ્ટ છે કે આપણે પવિત્ર શુભ અધ્યવસાયોમાં રમતા રહેવું જોઈએ, અને એ માટે ઉપર કહું તેમ સારા પ્રશસ્ત સંયોગ, નિમિત્ત ને આલંબનને વળગ્યા રહેવું જોઈએ. તેમજ નરસા અપ્રશસ્ત સંયોગ, નિમિત્ત ને આલંબનને બને તેટલા આધા જ રાખવા અગર આપણે એનાથી આધા રહેવું જોઈએ. અહીં ‘પ્રશ્ન’ થશે.-

પ્ર.- સંસારમાં બેઠા, મોહમ્મદ્યા સ્વી-પુત્રાદિ અને મોહક ઘર-દુકાન-માલમિલકત વગેરેના સંયોગથી આધા કયાં રહેવાવાનું હતું ?

ઉ.- અહીં આધા રહેવાનો અર્થ એ કે મનને એના પ્રત્યેનો જોક જ એવો આપવાનો કે જે મોહની દાસ્તિ કરતા જ્ઞાનની દાસ્તિથી જ એને જુએ. દા.ત. સ્વીને ભોગના પાત્ર તરીકે ન જોતાં આપણા આશ્રયે આવેલ માટે જ આપણાથી શક્ય ભાવદ્યા કરવા લાયક દેખવી, અર્થાત્ કેમ આ આત્માને હું શુભ અધ્યવસાયોમાં રમતો રાખું, વિષયોની ધેલછા છોડાવું, ગુણસંપન્ન બનાવું, દોષોથી મુક્ત કરું, વગેરે કરવા યોગ્ય સમજવી. એમ પુત્રાદિ માટે વિચારણા રાખવી. ઘરદુકાનને પાપના કારખાના તરીકે લેખવા. જે હલકા આત્માને ભારે કરનારા છે. ઘરવાસ એટલે જેલવાસ સમજવો, જેથી ‘આમાંથી ક્યારે છૂટું, ક્યારે છૂટું,’ એમ ભાવના રહ્યા કરે. માલ-મિલકત-ખાનપાનાદિ પણ મોહને પોષનારા અને એના નિમિત્તે કખાયો કરાવનારા હોઈ આત્મસ્વરૂપના અવરોધક વિટંબણારૂપ લેખવા...આવી

આવી જ્ઞાનદાસ્તિ ઊભી રખાય, જ્ઞાગતી રખાય એટલે અશુભ અધ્યવસાયથી ધણું ધણું બચાય, કેમ કે અજુગતાં વાણી-વિચાર-વર્તાવ લગભગ નામશેષ થઈ જવાના. જીવના અધ્યવસાય બગડનાર આ અનુચ્ચિત મન-વચ્ચન-કાયયોગ છે. એ અટકવાથી અધ્યવસાય બગડતા અટકે એ સહજ છે.

આમ જગતની વચ્ચમાં રહેતા, હલકાં નિમિત્ત વગેરે તો મળવાના. કેટલાક એવાને ટાળી જ નહિ શકાય છતાં દાસ્તિ વિવેકની એટલે કે જ્ઞાનદાસ્તિ રાખવાથી અશુભ અધ્યવસાયથી બચી શુભમાં રમતા રહી શકાય છે. છતાં સારું નરસું નિમિત્ત શુભાશુભ આલંબન આપી જાય છે એ ભૂલવાનું નથી. એનો વિચાર હવે પછી કરીશું.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખમૂત”

વર્ષ-૧૬, અંક-૩૩, તા. ૨૭-૪-૧૯૬૮

(લેખાંક-૨)

જો અધ્યવસાય યાને હૃદયના ભાવ સારા પવિત્ર, તો આત્મા પુણ્યનો ભાગી થાય, અને આત્માઓજસ વિકસનું આવે. એથી ઊલદું અશુભ અધ્યવસાયમાં પાપથી ખરડાવાનું થાય અને તામસભાવ પોષાતો આવે. આ અધ્યવસાયને બગડવા-સુધરવા માટે બહારના નિમિત્તો ટેકો આલંબન બની જાય છે. દા.ત.

નવા શહેરમાં ગયા ત્યાં આલીશાન ઈમારતો, બગીચા, બજારો વગેરે જોવા નીકળ્યા, તો એ જોઈને ચિત્તમાં રાગાદિના ભરપૂર અશુભ ભાવ ઊલસવાના. એના બદલે જિનમંદિર પોષધશાળાઓ વગેરે ધર્મ-પ્રતીકો જોવા નીકળ્યા તો એ જોતા સુકૃત-અનુમોદના, ભગવદ્બહુમાન, ધર્મભાવના વગેરેના શુભ અધ્યવસાયો થયા કરવાના. એમ મોહમૂઢ, અર્થલોભી કામાસકત કે કખાયી માણસના સંપર્કમાં ગયા તો એના વાણી-વર્તાવ પર અશુભ અધ્યવસાયોને મહાલવાનું થશે. એથી ઊલદું ધર્મત્વા સદ્ગુરૂની આત્મદાસ્તિવાળાના સંપર્કમાં ગયા તો શુભ ભાવોને વિકસવાનું મળશે.

હવે જોવા જેવું તો એ છે કે જગતમાં એવા સારા નિમિત્તો કેટલા કે જે શુભ અધ્યવસાયને પ્રેરે ? ત્યારે એવા નરસાં કેટલા કે જે અશુભ અધ્યવસાયને જગાડે પોષે ને વધારે ? કહેવું જ પડશે કે સારાં નિમિત્તો બહુ ઓછાં છે. દેખાય જ છે કે ગામમાં ધર્મસ્થાનો, ધર્મક્ષેત્રો અને ધર્મત્વા સંતસાધુઓ એ કર્મસ્થાનો કર્મપોષક ભાબતો તથા મોહાંદ માણસોની સંખ્યા આગળ તદ્દન માસુલી સંખ્યામાં હોય છે. એમ, શ્રવણ માટે ધર્મવાણી બહુ ઓછાં સમય માટે

મળે છે, ત્યારે રાગાદિવર્ધક શર્ખ્ટો ધોધમાર મળે છે. એમ ધર્મના અનુષ્ઠાનો સાંસારિક કિયાઓ કરતા અતિ અલ્ય પ્રમાણમાં ચાલતાં હોય છે.

એટલે, મોટા ભાગે અશુભ નિમિત્તોનો ઘેરાવો બહુ મોટો, એટલે સ્વાભાવિક છે કે એના સંપર્કમાં ચિત્તમાં મહિન રાગ દેખ મોહના અધ્યવસાયો ભરચક ચાલ્યા કરવાના. તો પછી આ જીવની દિવસ-રાતનો બહુ મોટો ભાગ દશા કઈ ? અરે ! એ નિમિત્તોથી આધા બેઠા તો પણ એના સ્મરણોએ ય અશુભ ભાવો દિલમાં ચાલ્યા કરે છે. આથી જીવન પસાર કરતાં કરતાં કમાવાનું શું ? અને એ કમાઈ ઉપર આગળનો દીર્ઘ ભવિષ્યકાળ કેવો નીવડવાનો ? અહીં જે બહું ધૂંટચું છે, સહજ છે કે પરલોકમાં એના જ સંસ્કારો જાગ્યા કરવાના, અને એના લીધે પાપ વાણી-પાપ વિચારો, પાપકિયાઓનો મારો રહ્યા કરવાનો. એટલે અહીંના ભરચક અશુભ અધ્યવસાયોથી બાંધેલા થોકબંધ અશુભ કર્મોનો ઉદ્ય આવ્યે દુઃખોનો તો વરસાદ વરસવાનો, અને સાથે સાથે વધારામાં બુદ્ધિ પણ બગડેલી રહી પાપપ્રવૃત્તિ-પાપાચરણનો પ્રવાહ ચલાવવાની. આમ અહીંના અશુભ અધ્યવસાયોનો પરલોકે દુઃખ અને પાપનો બેવડો માર ! ત્યારે અહીં પણ અશાંતિ-વિહ્લવળતા-ઉન્માદ-સંતાપ વગેરે ભરપુર રહ્યા કરવાના એ વધારામાં.

માટે જ શુભ નિમિત્તોનું આલંબન બહુ રાખવા જેવું છે. સવારે ઊઠીને છાપું જોવામાં સવારથી જ અશુભ અધ્યવસાયોની હોળી સંજો છે. એના બદલે ટેક જોઈએ કે ‘દિવસનો મંગળ પ્રારંભ તો સારાં સ્તોત્રોનો પાઠ, ભગવદ્ભનામ જપ, પ્રતિકમણાદિ કરવા દ્વારા શુભ અધ્યવસાયોની ધારાથી કરું.’ એમ નવરા પડ્યા વાતોચીતો કુથળી ટહેલટપામાં અશુભ ભાવોથી ખરડાયા રહેવું એના કરતા કોઈ ધાર્મિક આધ્યાત્મિક વાંચન, જપ, સેવા વગેરેમાં રક્ત રહી શુભ અધ્યવસાયોનો લાભ કાં ન ઉઠાવવો ? એમ, આડાઅવળા ફરવા નીકળી યા આ ને તે ભાઈને એમજ મળવા ચાલી અશુભ ભાવોમાં રમ્યા રહેવાને બદલે કોઈ સંત-સાધુનો સમાગમ સાધી ભરચક શુભ અધ્યવસાયોમાં કાં ન વિહરવું ?

દેવાધિદેવ, સાધુ, શાસ્ત્ર, ધર્મનુષ્ઠાનો, જિનવાણી અને ઉત્તમ જીવોના સુહૃતો વગેરે એવા સુંદર નિમિત્તો છે. પ્રશસ્ત આલંબનો છે કે, એના આધારે જથ્થાબંધ શુભ અધ્યવસાયોની કમાઈ થઈ શકે છે. ત્યારે આ જીવનમાં એ કમાઈથી વધીને તો શું પણ એની હરોળમાં કંઈ બીજી ઉત્તમ કમાઈ છે ?

સવાલ એ છે કે આવા મહા કલ્યાણભૂત અધ્યવસાયોની કમાઈ કરાવનારા એ પ્રશસ્ત આલંબનોનું આપણે મૂલ્ય કેટલું આંકિએ છીએ ? ધ્યાનમાં રહે કે મૂલ્યાંકન માત્ર ‘ના, હું એને બહુ ઊંચા અને ઉપકારી માનું છું’ એવા કોરા ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

સવાસલાથી કર્યું નથી ગણાતું, કિન્તુ પ્રાપ્ત થતાં લાભની પાછળ ચોકરનો ભોગ આપવો જોઈએ. તો એ શુભ અધ્યવસાયો પ્રબળ અને દીર્ઘજીવી બને. પગાર ઉપરાંત ભથ્થું-વધારો-બોનસ મળવા પર શેઠની જો વિશેષ સેવા કરાય છે તો શેઠ પ્રત્યેનો ભાવ નક્કર સારા રહે છે. નહિતર તો હરામનું પચાવવામાં દિલ નઠોર બને છે. એમ માન્યું કે ‘આજે પૂજામાં સ્નાત્રમાં, વ્યાખ્યાનમાં બહુ આનંદ આવ્યો.’ પછી એની કિંમત શી ચૂકવાય છે ? ચાલો, તો પછી આજે ધી વિગઈ ત્યાગ, કે મિષ્ટાન્ન ત્યાગ, યા ૪-૮ આના શુભ ભાતાની પેટીમાં નાખવાના’ આવો કોઈ ભોગ અપાય તો મૂલ્યાંકન કર્યું ગણાય. એમ કોઈ સુંદર યાત્રાનો લાભ મળ્યો તો એના નિમિત્તે ઉપવાસ આંબેલ જેવું થાય.

સારાંશ, શુભ અધ્યવસાયોની ભરચક કમાઈ કરાવનારા આ પ્રશસ્ત આલંબનો મળ્યાનો સાચો આનંદ મળ્યો ને કિંમત આંકી ત્યારે ગણાય કે એની પાછળ નક્કર ભોગ અપાય. એ આધ્યાથી મનમાં એની સારી સુવાસ રહે છે. ત્યાં પણ શુભ અધ્યવસાયોનો લાભ મળે છે.

અધ્યવસાય અને સદ્ગ્રાલાંબનોનું આ મહત્ત્વ સમજી સતત શુભ અધ્યવસાયમાં રહીને એ માટે સદ્ગ્રાલાંબનો ખૂબ સેવીએ, અને એનાથી જ શુભ ભાવનો મહાન લાભ થાય છે માટે એની પાછળ કાંઈ ને કાંઈ ભોગ આપીએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૬, અંક-૩૪, તા. ૪-૫-૧૯૬૮

## ૬ મહાશાંતિનો એક અદ્ભુત પ્રયોગ

જગતનું તંત્ર ચાલે છે એની પાછળ મુખ્ય કંયું તત્ત્વ કામ કરે છે ? આના પર વિચાર કરતાં આત્માના મહા વૈભવનો ખ્યાલ આવે છે, અને એ વૈભવ પર જો દસ્તિ કેન્દ્રિત થઈ જાય, તો આત્માના દેદાર ફરી જાય. એનામાં નવું જ જોમે, પ્રકાશ અને મહાશાંતિ આવી જાય. જેથી દુન્યવી સુખ-દુઃખના હિસાબ એને મન તુચ્છ બની જાય. આ બનાવથી હૃદયમાં રાગ-દ્રેષ ઓછા થઈ જઈ એવી સુંદર સૌભ્યતા આવે છે, કે જે આત્માને ઉન્તત ભાવોમાં જીવિતો કરે છે...યાવત્ત ઠેઠ વીતરાગ દશા પમારી મુક્ત બનાવે છે. આ બધાના મૂળમાં વિશ્વના સંચાલન પાછળ કામ કરતા મુખ્ય તત્ત્વોનો વિચાર કારણભૂત છે.

આ મુખ્ય તત્ત્વ છે જીવની અનંતજ્ઞાન વીર્ય અને લાભની વિશેષતા. અનંત

જ્ઞાનમાંથી પ્રગટતું થોડું પણ જ્ઞાન જીવને આહારસંક્ષા, વિષયસંક્ષા વગેરે સંક્ષાને જગાડી આહાર-વિષયાદિ તરફ પ્રેરે છે. એની પ્રવૃત્તિ થવામાં જીવની વીર્યશક્તિ કામ કરે છે. કેમકે એ આહારાદિના ગ્રહણ માટે જે પ્રવૃત્તિ થાય છે, એ મન વચન કે કાયાના યોગથી થાય છે. ને યોગરૂપ પ્રવૃત્તિ મૂળમાં જીવની વીર્યશક્તિ પર જને છે. હવે આ ગ્રહણપ્રવૃત્તિથી વસ્તુનો લાભ થાય તે પણ જીવની લાભશક્તિના અંશનો પ્રભાવ છે. જરૂમાં વીર્ય લાભશક્તિ જેવું કશું જ નથી, તેથી તેને એને પ્રવૃત્તિ કે લાભ કાંઈ થતું નથી. ત્યારે જીવને એ થાય છે એમાં વીર્યશક્તિ લાભશક્તિ કામ કરે છે.

પ્ર.- જીવને આજે અનંત જ્ઞાન, અનંતવીર્ય, અનંતલાભ પ્રગટ કેમ નથી ?

ઉ.- એનું કારણ જીવની ઉપર, ખાણમાં સોનાના આશુ આશુ પર મટોડું ચ્છી ગયેલું હોય છે. એની જેમ, આત્મપ્રદેશો-પ્રદેશો કર્માશુ જીમી ગયા છે. એ મટોડું સોનાના ચળકાટ વગેરેને ઢાંકી હે, એમ કર્મો જીવના જ્ઞાન-વીર્ય-લાભને આચ્છાદી હે છે. જેટલા અંશો એ કર્મ ખસે એટલા અંશો જીવમાં જ્ઞાનાદિ પ્રગટ થાય, એટલું એટલું જ્ઞાન થાય, વીર્ય સ્ફૂર્તે, લાભ થાય.

પ્ર.- જીવ પર કર્મ કોણે ચોટાડ્યા ?

ઉ.- જીવ પર કર્મ ચોટવામાં પણ જીવની મનોયોગ વચનયોગ કાયયોગરૂપે સ્કુરાયમાન થતી વીર્યશક્તિ કારણભૂત છે. એકેન્દ્રિય પૃથ્વીકાળિક આદિ-જીવને પણ કાયયોગના-લીધે કર્મ ચોટે છે. આ કર્મો જીવના જ્ઞાનાદિ ગુણને ઢાંકે છે, અને એ તૂટવાના પ્રમાણમાં જ્ઞાનાદિ ગુણ પ્રગટ થાય છે.

આમ વિશ્વમાં જે ઘટમાળ ચાલે છે એ મૂળમાં જીવની આ જ્ઞાન વીર્ય વગેરે શક્તિના લીધે ચાલે છે. અલબત્ત એ મલિન હોવાથી કર્મ પેદા કરી, કર્મ દ્વારા ઠેઠ પૃથ્વી પાખાણ પાણી અગ્નિ વગેરે સુધીના એક પ્રકારના શરીર પેદા કરે છે, જે જીવોથી ગૃહીત હોય છે. એટલે મૂળમાં જીવની જ્ઞાન-વીર્ય-લાભ વગેરે વિશેષતા બાધ્ય સર્જન સંચાલન કરે છે.

હવે જો આપણે આપણી એ મૌલિક અનંત વિશેષતા પર લક્ષ રાખીએ તો આપણામાં એક અનેરી સ્કૂર્તિ અને મહાશાંતિ આવે છે. આપણે એ જોવાનું છે કે,

‘હું પોતે અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત લાભશક્તિ અને નિર્વિકાર વીતરાગ દશાવાળો છું. એમાં કાંઈ જ ઘટતું કે વધતું નથી. બાકી જે બહાર ચાલે છે, દા.ત. અમુક જાતનું શરીર, શાતા-અશાતા, માનપાન, સગવડ-અગવડ, સારાનરસા પદાર્થો અને પ્રસંગો વગેરે, એ બધા તો કર્મના સર્જન છે, અને તે કર્મ પણ મારા આત્મવીર્ય-યોગથી જન્મેલા, એટલે મૂળમાં મારી વીર્યશક્તિના અંશનો

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૮

આ પ્રભાવ છે કે એ બાહ્યસર્જનો ઊભા થાય છે. એનો અર્થ એ, કે સમર્થ મારો આત્મા છે. જરૂ પુદુગલો સ્વયં અસમર્થ છે. તો શા માટે મારા વીર્યને વેડફી નાખું ? શા સારુ એને એવા મલિન મનોયોગ વચનયોગ કાયયોગમાં ખરચું ? મારે મારું અનંત વીર્ય અંતિનિષ રાખવાનું. મારા નિર્વિકાર, વીતરાગ, સર્વથા સ્વરૂપ સામે જોતા રહી કોઈજ રાગ-દ્રેષ, હર્ષ-શોક આદિ મલિન ભાવને જગા જ નહિ આપવાની, પછી ક્યાંથી મલિન મનોયોગ યાને વિચારણા જ ઊઠવાની હતી ?

વળી બાધ્ય વસ્તુના જે લાભ થાય છે એ પણ મારી અનંતી લાભલબ્ધિના અંશનો પ્રભાવ છે. તો મૂળ પ્રભાવ તો જ્યારે મારી લાભશક્તિનો છે, તો પછી એના અંશના પ્રભાવે પ્રાપ્ત તુચ્છ અને નાશવંત બાધ્ય વસ્તુમાં રાચવા કરતા પ્રભાવવંતી મારી અનંતી લાભલબ્ધિમાં જ રમવા જેવું છે. એ લાભલબ્ધિને બાધ્યમાં જોડવાને બદલે અંદરમાં જ તન્મય રહેવા દર્દી, જેથી બાધ્ય પ્રત્યે મારી નિર્વિકારતા ઉદાસીનતા અખંડિત રહે.

આમ જગતના તત્ત્વ પાછળ મુખ્યપણે કામ કરી રહેલ આત્માની જ્ઞાન-વીર્ય-લાભશક્તિઓ પર અથાગ શ્રદ્ધા કરી આત્માના એ અનંત વૈભવનું એકાગ્રતાએ વારંવાર ધ્યાન કરાય, તો પ્રારંભે કષ્ટું તેમ, ઉત્તરોત્તર અનુપમ લાભો પ્રાપ્ત થઈ શકે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૬, અંક-૩૫, તા. ૧૧-૫-૧૯૬૮

## ૧૦ દોષોની વિટંબણા ટાળવા અદ્ભુત ઉપાય

તમને દોષો પીડે છે ? કોષ સહેલાઈથી ભભૂકી ઊઠે છે ? અભિમાનનો પારો બહુ ચઢેલો રહે છે ? કામવાસના સત્તાવે છે ? ગંભીરતા ચૂકી બીજાની નિંદા ચારી ચુગલી ખોટા આક્ષેપ કરવાનું મન થઈ આવે છે ? અનેકાનેક ચીજના રાગ, લોભ જાગે છે ?

આના જવાબમાં કોઈ ને કોઈ દોષ સત્તાવ્યા કરતો હોય એવી લગભગ કબુલાત મળશે. ત્યારે સવાલ એ છે કે એ દોષની મલિનતા કેમ ઓછી થાય ?

કર્મ સિદ્ધાંતની રૂએ આ એક વિટંબણા છે કે આત્મા પર રહેલ તે તે મોહનીય કર્મના ઉદ્દે તેવા તેવા કોધાદિ દોષ સળવળતા રહ્યા કરવાના અને તે તે દોષના કારણે નવાં નવાં તેવાં તેવાં મોહનીય કર્મ બંધાતા રહેવાના. જેના ઉદ્દે પાછા તે તે દોષના સળવળાટ ચાલું ! એનાથી નવા કર્મ પુનઃ દોષ, નવા કર્મ,

૨૦

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

પુનઃ દોષ, જાલિમ પરંપરા !...કેવી વિટંબણા ?

આ વિટંબણામાં અનંતા કાળ વીત્યા ! અરે, અનંતા માનવજન્મ પણ એણે કાઢના ! આનો અંત ક્યારે ? અંત શી રીતે ? ધ્યાનમાં રહે કે વિટંબણામાં પીડાતા રહેવા માટે આ જગતમાં ભવ ઘણા, પણ વિટંબણાનો અંત લાવવા માટે એકમાત્ર માનવભવ ! કેમ કે એ માટે જરૂરી મધ્યમ સ્થિતિ આ ભવમાં છે. દેવભવમાં તો અતિ સમૃદ્ધિથી રાગાદિની વિટંબણા ભારે, નરકગતિમાં અતિશય ગ્રાસથી કોધાદિની ભારે વિટંબણા, તિર્યચગતિમાં ય પારાવાર હુંખ પરાધીનતા, અવિવેકથી વિટંબણા જ સુલભ. એનો અંત સુલભ માનવ ભવમાં. માટે કોઈ પૂછે ‘કેમ મનુષ્ય થયા છો ?...’ તો જવાબ આ જ કે ‘રાગાદિની વિટંબણાઓ ટાળવા માટે.’

આ વિટંબણાને ટાળવા માટે તો અનેકાનેક સાધનાઓ કરવી જરૂરી છે, પણ એનો અહીં વિચાર ન કરતા માત્ર એક એવી અદ્ભુત સરળ સાધનાનો વિચાર કરવામાં આવે છે, કે જે બીજી સાધનાઓને જગાડે અને બળવતી-વેગવતી બનાવે.

આ અદ્ભુત સાધના છે આત્માના પોતાના મૌલિક શુદ્ધ સ્વરૂપના આબેહુબ ચિંતનનો અભ્યાસ, વારંવાર એની ભાવના-મનન-નિરીક્ષણ, એનાથી દિલને વધુમાં વધુ ભાવિત-વાસિત-રંગાયેલું કરવાનું.

પૂર્વ લેખોમાં એ જાયું છે કે સંસારી ગમે તેવી દુર્દ્દશામાં પણ જીવની અંદર અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંતસુખ, નિર્વિકાર, વીતરાગ અવસ્થા અકંધ પડેલા છે. માત્ર એ કર્મોથી આચ્છાદિત છે એટલું જ, બહાર પ્રગટ નથી એટલું જ, બાકી અંદરખાને તો છે જ.

હવે આપણે અંદરખાને એ જોવાનું છે કે જ્ઞાણે એ બધા ગુણો જગમગ ઝણકી રહ્યા છે. જ્ઞાણ અનંતજ્ઞાનમાં અનંતકાળનું વિશ્વ દેખાઈ રહ્યું છે. અનંતા સુખમાં બાધ શાતા યાને ધનસુખ-સ્ત્રીસુખ-શાદાદિવિષયસુખ વગેરે તો સૂર્યપ્રકાશ આગળ આગિયા જેવા લાગે છે. અનંતા વીર્યમાં એ દેખાય છે કે મૂળ આ વીર્યના અંશ પર કર્મ-મશીનરી અને એ દ્વારા બાધ સર્જનો ચાલી રહ્યા છે. નિર્વિકાર વીતરાગ અવસ્થામાં રાગ-દ્રેષ્ટ્રોમ-કોથ-લોભ વગેરે તો આત્માના સીમાડા પરની વસ્તુ તરીકે દેખાય છે.

રાગાદિ એ સીમાડા પરની વસ્તુ તરીકે જોવાના એટલે મૂળ મધ્યમાં આત્મા નિર્વિકાર વીતરાગ છે. પરંતુ આત્માની ચારે તરફની સીમા પર રાગાદિ ફોજનો ધેરાવો છે એમ જોવાનું. તો જેવી રીતે કિલ્લામાં સુરક્ષિત રાજ ચારે બાજુ સીમા પર પડેલા દુશ્મનથી એમ નથી માનતો કે ‘મારું બધું લુંટાઈ ગયું, હું સુખ-સગવડ-સમૃદ્ધિની થઈ ગયો.’ પરંતુ એ તો દેખે છે કે ‘મારું મારી પાસે સલામત છે.

માત્ર સીમાડા પરના ધેરાવો હટી જાય એટલી રાહ જોવાની છે. બાકી જે કાંઈ તોફાન ચાલે છે તે એના છે, મારા વૈભવમાં નહિએ.

બસ, એવી રીતે આપણા આત્માની આસપાસ કર્મના ધેરાવાની હ્યાતીમાં પણ આપણું અંદરનું ધન સલામત છે. મુખ્ય દષ્ટિ એના પર રાખવાની કે ‘હું નિર્વિકાર વીતરાગ સ્વસ્થ પ્રશાંત, હું અનંત જ્ઞાનસંપત્તન અનંતા કાળના વિશ્વના દર્શન કરનારો, હું અનંત સુખ-શક્તિ-વીર્ય-લાભિવાળો. આમાનું કશું આ ધેરાવાવણા કર્મમાં નથી, કર્મમાં તો રાગાદિ વિકારો, અજ્ઞાનતિમિર, જડતા, વીર્યહીનતા, કૂત્રિમ સુખ, હુંખ વગેરે છે. એને ને મારે શું લાગે વળગે ? મારી પાસે સહજ વૈભવ સલામત છે. આ ધેરાવો છે, તે ટણે એટલી જ વાર ને તે તો જ ટણે કે એને હું મારો પોતાનો ન માનું.’

આમ આપણી દષ્ટિ વારંવાર આપણા આંતર અતિ નિર્મણ સ્વરૂપ પર જાય તો એને જીલ્યાના મહાન સંવેદનમાં રાગ દ્રેષ્ટ હાસ્ય હર્ષ શોક વગેરેના બેંચાણ મંદ પડે છે. જ્યાં કોઈ દોષ ભભૂકવા જાય, યા પ્રબળ થતો દેખાય કે જટ આપણે વારંવાર અભ્યાસ કરેલા આપણા મૂળભૂત શુદ્ધ સ્વરૂપ પર દષ્ટિ લઈ જવાની, ને વિચારવાનું કે આ રાગાદિ એ તો સીમાડા પર ધેરો નાખી પડેલા કર્મશત્રુના તોફાન છે, એને જરાય મારે મહત્વ આપવાનું નહિ. મારે મારા શુદ્ધ સ્વરૂપના કિલ્લામાં સુરક્ષિત રહેવાનું. આમ કરતાં કરતાં દોષોનું જોર ઓછું થતું આવે છે, દોષોની વિટંબણા ઓછી થતી ચાલે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૂત”

વર્ષ-૧૬, અંક-૩૬, તા. ૨૫-૫-૧૯૬૮

## ૧૧ મુનિશ્રી ચન્દ્રશોભરવિજયજુનો લીંબાડીમાં સોનગાઠી કાનજુભાઈ સાથે થયેલો વાતાવાપ

જાહેરમાં વાતાવાપ યોજવાની મુનિશ્રીની નિખાલસ માગણીનો કાનજુભાઈનો સ્પષ્ટ ઈન્કાર

બાર દિવસથી હું લીંબાડી મુકામે હતો અને તા. ૬-૫-૧૯૬૮ વૈ. સુ. ૮ ના દિવસે સોનગાઠી કાનજુભાઈ ભક્તમંડળના રસાલા સાથે વૈભવી મોટરમાં લીંબાડી આવ્યા. ત્યાં એમનો છ દિવસનો મુકામ નક્કી થયો હતો.

આ કાનજુભાઈ એકાન્ત નિશ્ચયવાદી છે. તપ-ત્યાગ-કિયાડાંડના વ્યવહાર ધર્મનું ખંડન કરીને ભોગપ્રેમી લોકોને ખુશ કરી દઈને પોતાના અનુયાયી બનાવી

રહ્યા છે. લોકોના અર્થકામના પોષજા માટે ભક્તોને ત્યાં પગલા કરીને નામાના ચોપડામાં ઊં નું આલેખન કરી આપે છે. આ બધી વાતોથી હું વાકેફ હતો. લીમદીમાં કાનજ્ઞભાઈ સાથે જાહેર વાર્તાલાપ ગોઠવવાની મારી ઈચ્છા તો હતી જ, ત્યાં કાનજ્ઞભાઈથી અકળાઈ ગયેલા કેટલાક સ્થાનકવાસી ભાઈઓ તરફથી જ આવો પ્રસ્તાવ મારી સામે રજૂ કરવામાં આવ્યો કે મારે આ રીતે જાહેરમાં કાનજ્ઞભાઈ સાથે વાર્તાલાપ યોજવો.

કોઈ મધ્યસ્થ સ્થળે આવો વાર્તાલાપ યોજાય તો હું તૈયાર જ હતો. સહુએ કહ્યું કે આવો વાર્તાલાપ થવાથી સાચા ખોટાની બધી માહિતી સંઘળા ય લોકોને થઈ જશે.

સાંજના પાંચ વાગે હું જાતે જ શેતાંબર સંઘના આગેવાન ભાઈઓ સાથે વાર્તાલાપનું સ્થાન અને સમય નક્કી કરવા કાનજ્ઞભાઈના મુકામે ગયો. એ ઉંચી પાટ પર ઉપર બેઠા હતા. તેમની સંમતિ મેળવી લઈને હું તેમની પાટ ઉપર બેસી ગયો. ઓળખાણ અંગેની વાતો થયા બાદ તેમણે મને પૂછ્યું કે પેલા તેરાપંથી આ. તુલસીને અમદાવાદમાં પડકારનાર તમે જ કે ? મેં હા પાડી.

પછી મેં તેમને કહ્યું કે “તમારા એકાન્ત નિશ્ચયવાદના વિધાનો ધણી ગેરસમજો ફેલાવે છે. તમે વ્યવહારમાર્ગનું ખંડન કરો છો. એ વાત જરાય શાસ્ત્રમાન્ય નથી. લોકો આવા વિધાનમાં ગુંચવાય નહિ તે માટે મારી ઈચ્છા છે કે આપણે બે જાહેરમાં આ વિષય ઉપર વિચાર કરીએ. તેમ મને આવતી કાલનો કોઈ પણ સમય આપો.”

મારા અણધાર્યા આગમનથી જ કાનજ્ઞભાઈ અકળાઈ ગયા જણાતા હતા. તેમણે મને હસતાં હસતાં કહ્યું “મને કફ બહુ થયો છે એટલે મારે વાર્તાલાપ કરવો નથી.”

મેં કહ્યું, “આવતી કાલે તમારા ગ્રાણ ગ્રાણ પ્રવચનો ગોઠવાયા છે ત્યાં કફનો પ્રશ્ન તમને કેમ મૂંજવતો નથી ?”

હસી પડતાં તે બોલ્યા, ના, ના, પણ મારે વાદ કરવો નથી.

મેં કહ્યું, “વાદથી તત્ત્વબોધ પ્રાપ્ત થાય એમ શાસ્ત્રો કહે છે, પણ જો આ વાદ વિવાદ બનીને વિતંડામાં જ પરિણમવાનો છે તો હું પણ એવો વાદ કરવા માંગતો નથી. મારે તો માત્ર તમારી સાથે જાહેરમાં વાર્તાલાપ કરવો છે.”

કાનજ્ઞભાઈ : મહારાજ ! આ તો બહુ ઝીણી વાતો છે. ન સમજાય તેવી વાતો છે હોં !

મેં કહ્યું : પણ ઝીણી વાતો તેમ અહીં ઊભા રહેલા તમારા ભક્તોને તો ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૨૩

રોજ સમજાવવા યત્ન કરો છો ? અને મારી જ સાથે તમે એનો ઈન્કાર કેમ કરો છો ? એટલું નિશ્ચિત સમજજો કે ‘હાજી હા, કરનારા તમારા ભક્તો કરતા હું ધણો વધુ સમજદાર હું.’

કાનજ્ઞભાઈ : મહારાજ ! તમે મારા પુસ્તકો વાંચી લેશો તો બધું સમજાઈ જશે.

મેં તરત જ ભારે આશર્ય વ્યક્ત કરતાં કહ્યું, “પુસ્તક તો જડ છે. જડથી તે આત્માને સમજાય ? જડની આત્મા ઉપર તમે અસર જ માનતા નથી ! તમારાથી આવી ભલામણ જ કેમ થાય ?”

હવે કાનજ્ઞભાઈ અકળાઈ ગયા. મને કહે જવા દો...તમને ખબર નથી...ઉપાધ્યાયજી યશોવિજ્યજીએ કહ્યું છે, ‘ભ્રમન્તિ ભ્રષ્ટવિજ્ઞાના ભીમે સંસારસાયરે’ વ્યવહારમાં ધર્મ માનતા લોકો ભયંકર સંસારમાં રખજ્યા કરે છે.

મેં તરત જ પ્રત્યુત્તર વાળ્યો, ‘કાનજ્ઞભાઈ ! તમે તો લોકોને ખરેખરા ભૂલાવામાં નાંખી રહ્યા છો ! ધારો કે કોઈ ધર્મશાસ્ત્રમાં લખ્યું હોય કે ‘હિસા કરવાથી સ્વર્ગ જવાય છે તેવું કહેનાર મહાપાપી છે’

હવે આમાંથી શરૂઆતનું અડધું જ વાક્ય પકડી લે તે માણસ કેવો કહેવાય ? તમે પણ એવું જ અહીં કર્યું ?

જે ‘અધ્યાત્મસાર’ ના ‘આત્મનિશ્ચય’ અધિકારનો આ અડ્ધો શ્લોક તમે મારી સામે રજૂ કર્યો છે. તે જ ‘અધ્યાત્મસાર’ ના તે જ ‘આત્મનિશ્ચય’ અધિકારમાં ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે ‘વ્યવહાર વિનિશ્ચિત્ય તત્ત્વ શુદ્ધનયાશ્રિત....પરમ સામ્યમાશ્રિયેત’

‘વ્યવહારધર્મને જીવનમાં સારી રીતે પચાવ્યા પછી જ શુદ્ધનિશ્ચયમતનું અવલંબન લેનાર મોક્ષપદ પામી શકે છે’ તમે આ વાતને ઉડાડી મૂકીને કેમ બોલો છો ?

કાનજ્ઞભાઈ મૌન થઈ ગયા. થોડીવાર પછી કહ્યું કે, ‘મારા પ્રવચનો છ દિવસ ચાલવાના છે, રોજ આવો અને સાંભળો પછી બધું સમજાઈ જશે.’

મેં કહ્યું, “એ પણ કબૂલ છે પણ તમે મને એટલી કબૂલાત આપો કે પછી છઢા દિવસે બાપોરે આપણે ગ્રાણ ગ્રાણ કલાક જાહેરમાં વાર્તાલાપ કરીશું.”

કાનજ્ઞભાઈએ સાફ ના પાડી. પછી મેં કહ્યું, ‘તમારી આવી જવાબ નહિ દેવાની અને વાર્તાલાપ દ્વારા વિચારણાને ઈન્કારી દેવાની નીતિ તમારા જ્ઞાન અંગે મોટી શંકા ઊભી કરે છે. તર્કથી સમજાવવાને બદલે ઘસીને ના પાડી દેવી એ વાત સાચા જ્ઞાનીને ન છાજે, અજ્ઞાનીને જ શોભે. ગમે તે વાત ગમે તેમ હાંક્યે

૨૪ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

રાખવાનો આ જમાનો નથી. શેતામ્બર સાધુઓ તો આજે એટલી હદ સુધી શિક્ષિત થઈને તૈયાર થયા છે કે આવી વાતો સામે તેઓ ખુલ્લો પડકાર ફેરિને જ રહે. ભગવાન વીરના નામે વીરધર્મને વિકૃત રીતે રજૂ કરનાર તમે છો એવી મારી સમજ છે. માટે તમે મારી સાથે ખુલ્લી ચર્ચા કરવા તૈયાર થાઓ એમ હું ઈચ્છા હું.”

પછી મેં કહ્યું, “તમારે જડની કોઈ અસર આત્મા ઉપર માનવી જ નથી તો પછી તમે ચશ્મા કેમ પહેર્યી છે? શું ચશ્મા જડ નથી? ચશ્મા પહેરવાથી જ તમે વાંચી શકો છો ને? ચશ્મા ઉતારી નાંખો તો આત્માને વાંચવામાં ભારે મુશ્કેલી ઉભી થાય છે તો જડ ચશ્માની ચેતન ઉપરની અસર સાબિત થઈ જતી નથી?”

આ વાત સામે ઉભેલા બધા ભાઈઓને પૂછો જેટલા ચશ્માવાળા છે એ બધાને અનુભવ સિદ્ધ છે; છતાં આત્મા ઉપર જડની અસરનો તમે એકાન્તે ઈન્કાર કરી દો તે કેમ ચાલે? “આગળ વધતા મેં કહ્યું કે, “તર્ક પ્રધાન આ યુગમાં જવાબ નહિ દેવાની તમારી આ છટકબારીઓ જરાય અજ્ઞાત રહી શકે તેમ નથી. હું મૈત્રીના દાવે તમને ફરી કહું છું કે આપણે મૈત્રીભાવ સાથે જાહેરમાં વાર્તાલાપ કરીએ. તમે કહો તો તમને માન્ય “સમયસાર ગ્રન્થથી જ હું વ્યવહારનયનું મંડન કરી આપવા પણ તૈયાર છું. ગુરુકૃપાથી મેં એ ગ્રન્થનો ઠીક ઠીક અભ્યાસ કર્યો છે.”

પણ કાનજીભાઈ તો એકના બે ન થયા તે ન જ થયા.

જુદા જુદા ફિરકાના પચાસ સાઈઠ પુરુષો આ બધું ય સત્ય બનીને જોઈ જ રહ્યા.

કાનજીભાઈ ખૂબ અકળાઈ ગયા અને એકદમ પાટ ઉપરથી નીચે ઉતરી જતા બોલવા લાગ્યા, “મને ટાઈમ નથી મારે કામ છે”

મેં કહ્યું, “કાનજીભાઈ! તમારી જાતની અને તમારી નીતિની જે કલ્પના મેં કરી હતી તે તદ્દન સાચી જ નીવડી. હવે જાઉ છું.”

પછી કાનજીભાઈના આત્માનું કલ્યાણ વાંઘતો હું ત્યાંથી નીકળીને ઉપાશ્યે આવી ગયો.

આ પ્રસંગ મેં એટલા માટે જ પ્રગટ કરવાનું મુનાસિબ માન્યું છે કે અસદ્ધર્મની સ્થાપના કરનારા એટલા કદાગ્રહી હોય છે, અને પોતે ક્યાં ફસાઈ ન જાય એ માટે અપ્રતિકારનું-મૌનનું-પોકળ શસ્ત્ર એટલી જુદ સાથે પકડી રાખીને પોતાની પોકળતાઓને ઢાંકી રાખવાનો બાલિશ પ્રયત્ન કરે છે, એની સહુને જાણ થાય.

અર્થકામના પ્રલોભનોને અને ભોગરૂચિ જીવોની તપત્યાગ-કિયાંડની અરૂચિને નજરમાં રાખીને જ કાનજીભાઈએ આ એકાન્તનિશ્ચયનો મત ઉભો કર્યો છે.

અર્થકામપ્રેમીઓ અને તપ-ત્યાગાદિની સૂગ ધરાવતા લોકો આ ધર્મના જલદી અનુયાયી બને એમા કશું જ આશ્ર્ય નથી.

આ રીતે ઉન્માર્ગથી અનુયાયીવર્ગની સંખ્યા વધી જતી જોઈને, “કાનજીમત” તરફ આકર્ષિત જઈને ભવોના ભવો બરબાદ કરી નાખવાની કોઈ પણ આત્મા ભૂલ ન કરે એ જ એકની એક કલ્યાણ કામના.

લિ.

મુનિ ચન્દ્રશેખરવિજય

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૭-૧૯, અંક-૪૩, તા. ૬-૭-૧૯૬૮

## ૧૨ આત્માની ઉન્નતિ ક્યાં અટકે છે ?

એવા એટલાય ભવ્યાત્માઓ છે કે જે પોતાના આત્માની ઉન્નતિ ચાહે છે, એ માટે પોતે પુરુષાર્થ પણ કરે છે એમ પોતાને લાગે છે, છતાં એમની ફરિયાદ રહે છે કે, ‘કેમ અમને અમારા આત્માની ઉન્નતિ થતી નથી દેખાતી?’...

આ એમની સહદ્ય ફરિયાદ છે, એટલે એને વાસ્તવિક સમજને આપણે વિચાર કરવો છે કે ઉન્નતિ ક્યાં અટકે છે? ઉન્નતિની ઈચ્છા હોય; પુરુષાર્થ થાય છતાં ઉન્નતિ અટકી ઉભી હોય ત્યારે અટકણ ક્યાં છે એ શોધવું આવશ્યક બને છે.

ઉન્નતિની અટકાયત કરનારા ઘણાં તત્ત્વ હોય છે, પણ અહીં માત્ર એક તત્ત્વનો વિચાર કરીશું, એ તત્ત્વ આ છે, કે,

જડ વસ્તુને મહત્વ અપાય છે એવું પોતાના આત્માને નથી અપાતું.

આ સ્થિતિ ઉભી હોય ત્યાં સુધી આત્મોન્નતિના પુરુષાર્થરૂપે ધર્મસાધના કરવામાં આવે એ (૧) કોઈ પરલોકની દુર્ગતિના ભયથી કરાય છે. અગર (૨) પુરુષના લોભથી અથવા (૩) કુળરિવાજ છે માટે, કે (૪) કોઈ કીર્તિ-માનપાનાદિની આકાંક્ષાથી કરાય છે. એથી આત્માને ખુદને શું? એની શી ઉન્નતિ થઈ?

આત્માની ઉન્નતિ એ, કે આત્મા પોતાનું કાંઈક વર્યસ્વ ઉભું કરે, પોતે ઈન્દ્રિયો અને સ્વચ્છંદ મનની ગુલામીમાંથી અંશે અંશે પણ મુક્ત થાય. એ મુક્ત થાય એટલે ગુણોનો વિકાસ થવા માંડે; ઔદાર્ય, દાખિઝુય, નિર્લજજતા, કુર્તતા, સ્વાર્થપદૃતા, વિષયાસક્રિયા, કખાયાવેશ, મોહમૂઢતા આદિ દોષો મંદ પડતા જાય. આવી ઉન્નતિ કાંઈ પૂર્વે કહેલ ઉદ્દેશોથી થતી ધર્મસાધનાઓમાં ન દેખાય; કેમ કે

એમાં તો જીવની ઉપર વર્યસ્વ ભયનું કે પૌદ્ગલિક સુખસામગ્રી વગેરેનું છે.

ત્યારે ખરી રીતે તો જીવનું પોતાનું વર્યસ્વ પોતાની ઈન્ડ્રિયો અને મન ઉપર જોઈએ. તો જ એને ધાર્યા ચલાવી શકે, ને ધાર્યા દબાવી શકે. આ વર્યસ્વ ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે આત્મા મહત્વ પોતાનું લેખે, પણ જડ પદાર્થનું નહિ. એ માટે આ ભાવના વારંવાર ભાવવી જોઈએ કે,-

‘હું મહાન છું, જડ વસ્તુઓ નહિ, મારા હિતાર્થે જડ વસ્તુ છે, જડના હિતાર્થે હું નહિ. જડનું સારું, મારે જોવાનું નહિ, એમા મારે ખુશી થવાનું નહિ, મારે તો મારા આત્માનું સારું થાય એ જોવાનું ને એમાંજ મારે ખુશી થવાનું’

આ ભાવનાના વારંવાર અભ્યાસવાળો પોતાના આત્માનું મહત્વ અનુભવતો જાય છે; અને ઉન્નતિના પંથે ચેતે છે. ત્યારે એ વિનાનો બિચારો જડના મહત્વ આંકી આંકીને ઉન્નતિ પામી શકતો નથી; ધર્મ-સાધના કરે તો પણ નહિ. દા.ત.કોઈ દાન, સુકૃત, સાધ્મિકવાત્સલ્ય વગેરે કરવા જરૂરી, પણ મુખ્ય એ જોશે કે પૈસા કેમ ઓછામાં ઓછાં ખરચાય. જરા વધુ ખર્ચાતા જીવ બળીને ખાખ થશે; કામ કરનાર પર ગુર્સે થશે. જડનું મહત્વ માનનારની આ દશા હોય છે, ત્યારે આત્માનું મહત્વ માનનારો તો એ જોશે કે ‘આવું રુંગ શુભ કામ લઈ બેઠો, એમાં રખે ધનની મૂર્ચા મને સત્તાવી ન જાય. કેમકે એમાં તો મારા આત્માના રાગાદિ શન્તુઓ પગભર રહે છે.’

એમ ‘જમણ જમવા મળ્યું છે, માટે જરા દાબો’ કરનાર જડના મહત્વમાં મરે છે, શરીરે ય બગડે, રસનાની ગુલામી ય ભોગવે, અને આત્માને કર્મથી ખરે પણ છે. આત્માનું મહત્વ સમજનારો ત્યાં સ્વાત્માનું સારું કરવા વિશેષ સત્ત્વ અને સંયમ કેળવે છે. વિરક્તભાવ વધારે છે, પ્રભુને યાદ કરે છે. એમ વિચારી ને કે ‘જીવ ! ધ્યાન રાખજે, મહત્વ બાધ્ય વસ્તુનું નથી, તારું છે. વસ્તુના અસત્તુ ઉપયોગથી તારા રાગાદિ પોષાઈને તારું ન બગડી જાય એ જોજે. માટે જ આવું નિમિત્ત પામીને તો’ તો ખાસ આંતરિક સત્ત્વ કેળવી અને ચીજના ઉપયોગમાં સંયમન કર. રસના (જીભ) તારી છે, એના પર તારો અંકુશ ચાલી શકે. અંકુશ ચલાવ્યાથી એ કાંઈ રોવા નથી બેસતી કે શોષાઈ જતી નથી. એ તો ‘તને ગમ્યું એ એને ગમ્યું’ એવા શિરસ્તાને અનુસરે છે. વળી બાધ્ય સારી ગણાતી ચીજ એ તો મોહ-પારધીનો કર્મફાંસલો છે, એમ એને બરાબર ઓળખજે. વીતરાગ પ્રભુએ આ અમૂલ્ય સત્ય આય્યું છે. એને ભૂલીશ નહિ. આમ સર્વત્ર મહત્વ સ્વાત્માને આપવું, જડને નહિ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૬, અંક-૪૪, તા. ૧૩-૭-૧૯૬૮

### ૧૩ આત્માના મહત્વને કેમ લાગુ કરવું ?

ગયા લેખમાં એ જોયું કે બાધ્ય જડપદાર્થોને મહત્વ આપવાથી આત્માની ઉન્નતિ અટકે છે. એના બદલે પોતાના આત્માને મહત્વ અપાય તો ઉન્નતિ સરળ બને છે. એટલે હવે આ લેખમાં એ જોયું છે કે, ‘આત્માને મહત્વ આપવાની વસ્તુ જીવનમાં કેવી રીતે લાગુ કરવી.’ એ માટે એને કેટલાક દણાન્તોથી જ વિચારીએ, જેથી સીધી રચનાત્મક પ્રક્રિયા જ હાથ લાગે.

સૌથી પહેલી રોજણી બાબત આજે ‘સીતમ’ મોંઘવારીની છે. એની પાછળ જડને મહત્વ આપીને કેટલીય હાયવોય બૂમબરાડા અને આર્થિકાનનો સતત પ્રવાહ વહેતા રહે છે. પણ આત્માને મહત્વ આપીએ તો એમ વિચારી શકાય કે ‘(૧) આવા ઉચ્ચ માનવભવમાં શું જડસામગ્રી સસ્તી અને સુલભ હોય એ આ ભવને સ્કફન કરી આપે છે ? (૨) મોંઘવારી ના હોય તો પણ મારા આત્માને શો લાભ થઈ રહ્યો છે ? ઊલદું રંગરાગ વિષયવિલાસ અને પરિગ્રહમમતા તો જોરમાં ફૂદતા રહી મારા આત્માનું નિકંદન કાઢે છે. (૩) ભલું થાજો મોંઘવારીનું કે જિનાજાથી મારા આત્માને જે ન માન્યું તે રંગરાગ-વિલાસાદિ પર કાપ મૂકવાનું આણે સુલભ કરી આય્યું ! વળી (૪) કાળબળ ઓળખાયું કે ‘મૂર્ખ ! ચીજવસ્તુની મોંઘવારીને શું રુએ ? દુઃખદ મોંઘવારી તો આજે ધર્મકિયાઓ અને સત્ય-ન્યાયનિષા-નિર્લોભિતા વગેરેની થઈ ગઈ છે, એને રો; તેમજ જીવનમાં ગમે તે ભોગે એ સત્કિયાઓ અને સદ્ગુણો કેળવ.’

એમ, પૈસા સારા કમાયા પર આત્માને મહત્વ એ રીતે અપાય કે, ‘આમા મુંઝાઈશ ના; કેમ કે (૧) આમાં તો પૂર્વની કમાઈ લાવેલી પુણ્યની હુંઠીઓ વટાવાઈ રહી છે. (૨) એટલે સનાતન આત્માની મૂડીના ભોગે નાશવંત કાયાને ધીકેળા થઈ રહ્યા છે, માટે પહેલું કામ આ કર કે, (૩) નવાં પુણ્યને પગભર કરવા માટે ખૂબ જિનભક્તિ, સાધુસેવા; સમ્યગ્નોજાનની ભક્તિ, દયા, પરોપકાર, સાધ્મિક ઉદ્ધાર વગેરે સુકૃતો વધારું. નહિતર (૪) દુન્યવી ખાતાઓ તો પાપ આપવા સાથે મૂડી સાફ કરવાના જ છે.’

પૈસા ગુમાવવા પર આત્માને મહત્વ એમ અપાય કે ‘જીવ ! ચિંતા ન કરીશ. (૧) સુખ-સગવડમાં પુણ્ય જવેરાત સાફ થાય છે, ત્યારે દુઃખ-અગવડમાં પાપકચરો સાફ થાય છે. ખુશી કયાં થવાનું ? જવેરાતના નાશમાં કે કચરાના

નિકાલમા ? એ તો સિદ્ધ હકીકત છે કે કેટલું સારું ધન વગેરે મેળવો એટલું પુણ્ય ઉદ્ય પામી રવાના થાય; ને દુઃખ ભોગવો એટલું પાપ ઉદ્યમાં આવી રવાના થાય. માટે પૈસા ગુમાવવા પર રોવાનું નહિ. બાકી (૨) માટીના કૂકા ગયા એ તો કાચના ટુકડા ગયા, જ્યારે કોઈનૂર હીરા જેવા અરિહંતદેવ અને એમનું શાસન મારી પાસે છે. પછી શી ફીકર ? (૩) આ ઉચ્ચભવમાં હું જિનેન્નદેવ અને શાસનને પરણ્યો હું, માટીની માયાને નહિ, હઠયમાં જિનેન્નદેવ અને શાસન સલામત તો સબ સલામત.’

બિમારીના પ્રસંગે જડને મહત્વ આપી રોધણાં રોવાય છે, દિવસરાત ડોક્ટર-દવા-અનુપાન વગેરેની જ હૈયાહોળી ચાલ્યા કરે છે. એના બદલે આત્માને મહત્વ આપી એમ વિચારાય કે “(૧) અણધાર્યા આવેલા આ રોગ-પ્રસંગે તો અનાયાસે આ શુભ ધ્યાન હાથ લાગે છે કે કરેલા કર્મનો કાં તપથી કે કાં ભોગવટાતી જ છુટકારો થાય. તો જેમ તપ એક સુંદર આરાધના છે, એમ રોગપરિસહ સહર્ષ સહવો એ પણ સુંદર આરાધના જ છે. વળી (૨) પૂર્વ ભવે સેવેલ દુષ્કૃત્યના પ્રાયશ્ચિત્તનું કષ્ટ ન વધાવ્યું તો અહીં કેટલા ગુણું દુઃખ વધાવવું પડે છે, તો પછી એ પરથી શિખામણ લઈ આ જન્મના દોષ-દુષ્કૃત્યોને ગુરુ પાસે પ્રગટ કરી પ્રાયશ્ચિત્ત વિધિ કરી લે. બાકી (૩) બિમારીમાં બીજી રીતે પાપઆશ્વરોની દોષધામ અટકી દ્યા રસો ખાવાના અટક્યા, નવકાર મંત્ર રટવા અવસર મળ્યો... એ બધા મહાન લાભ છે.”

અપમાન, પરાધીનતા, વગેરે વગેરે પ્રસંગે આત્માને મહત્વ એમ અપાય કે ‘(૧) પુણ્યના નાણાં જ ઓછાં, પછી સન્માન વગેરે સારા માલની શી બહુ આશા રાખે ? (૨) વળી અપમાન આદિ કોના થાય છે ? પાડેશી કાચાના, આત્માના નહિ. તો પાડેશીના દુઃખે તું શું કામ રુએ ? એમ (૩) અપમાન પરાધીનતા આ શું જુએ ? ને શું રુએ ? મોટા ખરાં અપમાન તો તારા કર્મ કરી રહ્યા છે કે એકવાર જીવને એ દેવ કે માનવ બનાવી પછી તિર્યં પણ વગેરે બનાવે છે, શ્રીમંતાઈ દેખાડી પછી રંક બનાવી દે છે. (૪) પરાધીનતા પણ કર્મની, કાળની, કાચાની વગેરે કયાં કમ છે કે બાધ્યની મામુલી પરાધીનતા જ તને ખટકે છે ? (૫) સંસારવાસ જ અનું નામ કે જ્યાં અપમાન પરાધીનતા વગેરે દુઃખોનો ભંડાર હોય, માટે તત્ત્વ વિચારણા રાખી સ્વાત્માને બચાવી લે. નહિતર બાધ્ય ભોગવવાનું થોડું, પણ સતત સળગતા આર્તિયાનથી ઊભા થતાં તિર્યં ગતિના પાપ ભોગવવાનું ભારે ઊભું થશે.’

આમ બિન્ન ક્ષેત્રે આત્માને મહત્વ આપી રાગ-દેખ-દુષ્કૃત્યનાટિથી બચવાનું.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૬, અંક-૪૫, તા. ૨૦-૭-૧૯૬૮

## ૧૪ મન એ વિકાસનું સાધન છે

કેટલું ભવ્ય આ પ્રતિપાદન ! કેવી સચોટ આ ચિમકી ! કે માનવ ! તને મળેલું મન એ તો વિકાસનું મહાન સાધન છે.

નજર સામે દેખાય છે કે, જાડ પાન વગેરે અગણિત એકેન્દ્રિય જીવો બિચારા મન વિના કેવી નિશ્ચેતનપ્રાયઃ દુર્દ્શા ભોગવી રહ્યા છે ! ત્યારે કૂમિ ક્રીડા વગેરે અસંખ્ય ઇન્દ્રિયાદિજીવો પણ પાસે મન ન હોવાને કારણે સચેતન છતાં કેટલા દુઃખ અને દુર્દ્શા અનુભવી રહ્યા છે ! આપણે પણ અનંતોકાળ આ સ્થિતિમાં ભ્રમણ કર્યું છે. એમાંથી માંડ બહાર નીકળી પણ પંખી કે માનવ પણ બનીને મન મળવા છતાં એનો ઉપયોગ વિકાસ સાધવાને બદલે અધઃપતનમાં જ કર્યો છે. એમાં તિર્યંચના અવતારોમાં તો મન મૂઢ મળેલું; પરંતુ માનવના અનંત અવતારોમાં પણ મનની સારી પ્રાપ્તિ થવા છતાં એનાથી કોઈ વિકાસ સાધવાને બદલે અધઃપતન જ નોતર્યા છે.

આજે સર્વજ્ઞના વચ્ચની ખબર પડે છે કે મન કેવા મહાન વિકાસનું ઉત્તમ સાધન છે. જો એ રીતે એનો ઉપયોગ કરતાં આવે તો આ જીવનમાં ય અનુભવ થાય છે કે ક્યાં એ પૂર્વની જડમાં ગુંગળાયેલી મારી-મૂઢ આત્મદશા ? અને ક્યાં આજની સુખદ શાંતિમય તથા સ્રુતિમય મારી જાગતી ચેતના ? ત્યારે, આગામી ભવોમાં તો ઉત્તરોત્તર ચઢિયાતો વિકાસ પ્રાપ્ત થાય છે એ નિશ્ચિત છે.

સવાલ આ છે કે અનંત પુણ્યથી પ્રાપ્ત થયેલ આ મનને વિકાસનું સાધન બનાવવું છે કે ફેર પાછાં અનંત અધઃપતનનું ?

સૌ કોઈ વિકાસ જ ઈચ્છે છે, અધઃપતન નહિ, પરંતુ એ વિકાસ એમ જ કહેવા માગવા માત્રથી પ્રાપ્ત નહિ થાય. કિન્તુ મન જે રીતે અધઃપતન કરાવે છે એ રીતોને પડતી મૂકી વિકાસના સાચા માર્ગ નિર્ધાર અને પુરુષાર્થ કરવાથી જ ખરેખરો વિકાસ પ્રાપ્ત થાય.

મન શી શી રીતે અધઃપતન કરાવે છે ? એ પ્રશ્નનો ટૂંકો ઉત્તર આટલો જ કે પહેલું તો પોતાના પ્રાણઘ્યારાં અને અનંત કાળના દુઃખી આત્માનું જ વિસ્મરણ રખાવી મન જડ કાચામાં અને ઇન્દ્રિયોના મોહક વિષયોમાં જ રાત હિ' ધુમતું રહે છે. ત્યાં નથી તો સ્વાત્માનો ઘ્યાલ કે નથી તો સ્વાત્માની ચિંતા ને દયા. ‘હું,

આત્માનું અસ્તિત્વ માનું છું.' એવી બાંગ પોકારવા છતાં વિચાર-વાણી-વર્તાવમાં એનો કોઈ ખ્યાલ કે ચિંતા જ નહિ,' એ પ્રચ્છન્ન (ધ્યુપી) નાસ્તિકતા નથી તો શું છે ? અધઃપતનની જ એ રીત છે. એમ તો ક્રીડા-મંકોડા કે પશુ-પંખીને યાવતું અનાર્થ મ્લેચ્છ માનવો પણ કયાં એ કાયા અને વિષયોમાં જ સર્વેસર્વ ધુમતા નથી રહેતા ?

બીજુ એ છે કે, 'મન ઈન્દ્રિય વિષયોને જ મહાસુખદાયી માને છે, એની આંધળી ગૃહ્ણિ ધરે છે અને એથી નીપજતા ભવભ્રમણનો એને કોઈ વિચાર કે અરેકારો નથી, એ પણ અધઃપતનની જ એ રીત છે. વધારામાં વળી 'હું બરાબર સમજું છું, બરાબર ચાલું છું, મારે તો આ જ વિષયોના આનંદ જ જોઈએ.' એવા અહંત્વ અને આપમતિ અડીખમ ઊભા રહે છે. એથી પણ મન અધઃપતન કરાવે છે.

ત્યારે વિચારવા જેવું આ છે કે જો આપણે સમજતાં હોઈએ કે મનથી વિકાસ કાયાનો નહિ પણ આત્માનો સાધવો છે, તો (૧) વારે ને ઘડીએ તેમ ડગલે ને પગલે પોતાના આત્માને કેમ ભુલાય ? (૨) આત્મા કરતા કાયાને વધુ મહત્વ કેમ અપાય ? (૩) અજ્ઞાન, મૂઢ અને કર્મથી કચરાયેલી પોતાની જાત માટે અહંત્વ શા ધરાય ? તેમજ (૪) ઈન્દ્રિયો તો આત્માની ખરેખરી શત્રુ; આત્માને દુર્ગતિમાં ભટકાવનારી; એને વિષયોથી કેમ પોખાય ? (૫) એ શત્રુપોષક મનગમતા વિષયોની ગૃહ્ણિ-આસક્તિ કેમ રખાય ?

મન એ વિકાસનું સાધન છે પરંતુ આમ મનને આત્મવિસરણ, એકંગી દેહમહત્વ-મમત્વ, અહંત્વ, આપમતિ, ઈન્દ્રિયતર્પણ અને અંધ વિષયાસક્તિમાં જ લીન રાખવામાં, એ જ મન ઘોર અધઃપતનનું કારણ બની જાય છે. બહું કર્યું આ; ને સતત પતિત રહ્યા, હવે જો મનથી ખરેખર વિકાસ સાધવો હોય તો મનને સ્વાત્મલક્ષ, દેહના અવમૂલ્યાંકન, જાલીમ કર્મ ગુલામીના ખ્યાલ, ઈન્દ્રિયોના સંયમન અને વિષયોના ધીખતા વૈરાગ્યમાં જીવતું રાખવું જોઈએ, મનથી જો આ બરાબર સધાર, તો પછી મન આને અનુકૂળ પરમાત્મભક્તિ, પરોપકાર, સત્સંગ, ગ્રતનિયમ અને શાસ્ત્ર-તત્ત્વ-સ્વાધ્યાય વગેરેમાં જીવને પ્રવૃત્તિશીલ રખાવશે; ને એ રીતે મન વિકાસનું મહાન સાધન બનશે.

"દિવ્ય-દર્શન"-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૬, અંક-૪૬, તા. ૨૭-૭-૧૯૬૮

## ૧૫ ઈન્દ્રિયોના વિજયનું તાત્ત્વિક પ્રયોજન

ઇન્દ્રિયો પર વિજય મેળવવાનું ને એ માટે એના પર નિયંત્રણ મૂકવાનું શા માટે જરૂરી છે ? આ પ્રશ્નનો ચાલુ ઉત્તર તો એ અપાય કે ઈન્દ્રિયોને એના વિષયમાં નિરંકુશ મહાલવા દેવાથી જંગી પાપકર્મ બંધાય છે, ને તેથી પરલોકમાં એના કદુ વિપાક ભોગવવા પડે છે.

પરંતુ ઈન્દ્રિયોના વિષયમાં ચક્કુર ખૂંચી ગયેલાને પરલોકમાં તેવો ભય કંપાવતો નથી; કેમ કે એ પરલોક અત્યારે તો પરોક્ષ વસ્તુ છે; તેથી ઈન્દ્રિયોના સ્વચ્છન્દ વિહારથી મળતા તુચ્છ પ્રત્યક્ષ સુખોમાં જ લયલીનતા રહે છે પછી એ ઈન્દ્રિય વિજય શું કરી શકે ? કરવાની અગત્ય પણ શી રીતે માને ? આ ભવ મીઠા પરલોક કોણો દીઠા ? માનનારને તો પ્રત્યક્ષમાં જ રાચવું છે....

અલબજ્ઞ આવા જીવોને સમજાવવા માટે ભારે દુઃખમાં રીબાતા માનવો પશુ-પંખીઓ અને અસંખ્ય ક્રીડા-મંકોડા-માછલાનું દસ્તાન્ત આપી કહી શકાય કે 'આ જીવો પોતાના ઘોર દુઃખોથી આપણને જાણો કહી રહ્યા છે કે જુઓ અમેય એકવાર તમારા જેવા માનવ હતા, પણ ઈન્દ્રિયોના યથેચું વિષયભોગથી આ દશા પામ્યા છીએ. માટે તમે અમારા સામે જોઈ ચેતી જાઓ.'

-છતાં આ કદાચ ગળે ન ઉત્તરે તો ઈન્દ્રિયોના વિજય કરવા પાછળનો એક તાત્ત્વિક હેતુ અહીં બતાવવામાં આવે છે.

જીવને મરવું તો પડે છે. મર્યા પછી ઐલ ખલાસ નથી. કિન્તુ એક યા બીજા જીવનને ધરવું પડે છે. કેમ કે જેમ ભિન્ન ભિન્ન જીવોમાં જુદી જુદી જાતના સંસ્કાર, લાગણીઓ, ગુણ-દુર્ગુણો, સુખ-દુખ, સગવડ-અગવડ વગેરે દેખાય છે એ ભૂતકાળના ભવનાં જીવનનું સૂચન કરે છે, એમ આ જીવનના કૃત્યો આગામી જીવન માટે જવાબદાર છે, એ સિદ્ધ થાય છે. અહીં કરણીના ફળ ભોગવવા માટે આગળ નવું જીવન લેવું જ પડે. પછી એમ તો જન્મ-મરણ, જન્મ-મરણ ચાલ્યા જ કરે. એમાંથી ધૂટકારો મુક્તિ કરારે ?

જૈન શાસનની ૧૪ ગુણસ્થાનકની પ્રક્રિયા બતાવે છે કે મુક્તિ મેળવવા માટે કેવળજ્ઞ મેળવવું જ પડે એ માટે અજ્ઞાનનો સાગર તરી જવો પડે. એ સારું રાગ-દ્વેષને જતવા જ જોઈએ. જીતો, તરો, બુદ્ધ બનો, મુક્ત થાઓ,-આ કેમ છે.

‘શ્રી નમુત્થુણ’ સૂત્રમાં ‘જિષાણં, તિષાણં, બુદ્ધાણં, મુત્તાણં’ પદોથી કરેલ પ્રભુસ્તુતિ એ જ સૂચવે છે.

આમાં પહેલી વાત આવી કે ‘રાગદ્વેષનો જીતો’ એટલે કે રાગદ્વેષને મૂળમાંથી ઉઝેડી નાખો. આ ઉઝેડી નાખવાનું કાર્ય પહેલા અને દબાવવાથી જ થાય. કેમ કે ગુણસ્થાનકોનું સ્વરૂપ કહે છે કે રાગદ્વેષને મૂળમાંથી ઉઝેડવાનું કામ એટલે ચારિત્રમોહનીયની ક્ષપણા, તે નવમા દશમા ગુણસ્થાનકે જ થાય. તે પૂર્વે નહિ, ત્યારે નીચેના ગુણસ્થાનકે શું ? તો કહ્યું કે છહે સાતમે આઠમે ગુણસ્થાનકે ચારિત્રમોહનીયનો એટલે કે અનંતાનુંબંધી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનાવરણ એ ત્રણ કક્ષાના રાગદ્વેષનો ક્ષયોપશમ હોય, ત્યારે પાંચમે ગુણઠાળે અનંતાનુંબંધી અને અપ્રત્યાખ્યાનીય રાગદ્વેષનો જ તથા ચોથે ગુણસ્થાનકે માત્ર અનંતાનુંબંધી રાગદ્વેષનો જ ક્ષયોપશમ હોય. હઠે-૭મે ગુણસ્થાનકે મુનિ હોય, પાંચમે વ્રતધારી શ્રાવક હોય. ૪ થે માત્ર સમ્યકૃત્વવાળા જીવો હોય. એમને તે તે કક્ષાના રાગદ્વેષનો ક્ષયોપશમ એટલે કે રાગદ્વેષને દબાવવાનું હોવું જોઈએ. આમાં સારી રીતે પાવરધા બનતા ઊંચે ચડાય, અને એમ કરતા જ્યારે ૮મે ગુણઠાળે સામર્થ્યોગ પ્રગતે ત્યારે ૯મે ગુણસ્થાનકે ચડી રાગદ્વેષની સર્વદા ક્ષપણા યાને ક્ષય થાય, મૂળમાંથી એ ઉખડી જાય.

તાત્પર્ય, રાગદ્વેષનો ક્ષય સંપૂર્ણ કરવા માટે, પહેલા અનો ક્ષયોપશમ યાને દબાવવાની ભારે જહેમત દીર્ઘકાળ કરવી પડે. એ રાગદ્વેષ ઈન્દ્રિયોના ઈષ-અનિષ ગમતા-અણગમતા વિષયો ઉપર થાય છે. તેથી મૂળમાં જો ઈન્દ્રિયો ઉપર જ એવું પાહું નિયંત્રણ મૂકી દીધું હોય જેથી એ વિષયો તરફ બહુ જાય નહિ, તો રાગદ્વેષને સહેજે દબાયેલા રહેવાનું થાય.

સામાન્ય નિયમ આ, કે ‘જગતનું જુઓ ને રુંઓ,’ એટલે કે માનસિક આધિમાં પડો. આપણો અનુભવ છે કે ચક્ષુ કાન વગેરે ઈન્દ્રિયોને પોતાના કોઈ વિષયને જોવા-સાંભળવાનું વગેરે બને છે તે દર્શન-શ્રવણ આદિમાં મોટા ભાગે સારા કે નરસાનો ભાવ આવી જ જાય છે, એટલે કે રાગ યા દ્વેષ-અસુચિનો ભાવ સાથે જ લાગે છે. પછી મનથી એ વિષય ચિંતવતાં પણ એવું જ બને છે. ભાગ્યે જ વિષયોનું કોઈ દર્શન-શ્રવણ-આસ્વાધન આદિ કે સ્મરણ એ રાગ-દ્વેષથી રંગાયેલું ન હોય. તો પછી કર્તવ્ય આ બને છે કે જો ઈન્દ્રિયોથી એ અસદ્રદ્ધર્થન આદિ કરવાનું જ માંડી વળાય તો અનાં નિભિતે ઊંઠતા કે પોખાતા રાગદ્વેષને દબાયા રહેવું પડે. એ માંડી વળવા માટે ઈન્દ્રિયો પર વ્રતનિયમ અને ત્યાગ-તત્ત્વસમજ આદિ દ્વારા નિયંત્રણ અતિ આવશ્યક છે. ઈન્દ્રિયવિજ્ય આ માટે જરૂરી છે.

સારાંશ, રાગદ્વેષને દબાવવા માટે ઈન્દ્રિયો પર વિજ્ય ખાસ જરૂરી છે. એમ કરવાથી અહીં પણ મહા તૃપ્તિ શાંતિ અને બાહોશતાનો અનુભવ થાય છે; નહિતર તો સંતાપ-અંજપો બેહોશી લમણો લખાયા રહે છે. તેમજ રાગદ્વેષ ફાલ્યાફલ્યા રહે છે. છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૂત્ર”

વર્ષ-૧૬, અંક-૪૭, તા. ૩-૮-૧૯૬૮

## ૧૬ સમ્યકૃત્વમાં વૈરાગ્યનું સ્થાન અને એનો ઉપાય (લેખાંક-૧)

સંસારમાં ખૂંચેલો માનવી સામાન્ય રીતે કાયા, કંચન અને કામિની પાછળ ભારે જહેમત ઉઠાવે છે. એમાં કદાચ કોઈ એવા મંત્ર તંત્ર યંત્ર મળી જતા હોય અને એથી એ ઈષ વસ્તુઓમાં આબાદી થવાની લાગતી હોય તો એની સાધના માટે પણ તૈયાર રહે છે. અરે ! પરમાત્માના નામના મંત્રથી પણ એ આબાદી થવાની લાગે તો તે પણ સાધવા સજાગ રહે છે. સવાલ એ છે કે મંત્ર-તંત્ર-યંત્ર ઔહિક પદાર્થની આબાદી સાધી આપતા હોય, કિન્તુ મોક્ષમાર્ગના પાયાભૂત પદાર્થને સાધી આપે ખરા ?

મોક્ષમાર્ગનો પાયો વૈરાગ્ય છે, વૈરાગ્ય વિના મોક્ષમાર્ગની સાધના આવી શકે નહિ. મોટમોટા મંત્રોમાં સોનાના મહેલ ઊભા કરવાની તાકાત હોય, પણ વૈરાગ્ય પ્રાપ્ત કરવવાની તાકાત ખરી ? તેમ એ વૈરાગ્ય વિના ચાલી શકે ખરું ?

સંસારના વારંવાર જન્મ-મરણથી જે કંટાયો છે, અને તેથી જ સંસારથી છુટી મોક્ષ પામવાની જેને તમના છે, અને મોક્ષના માર્ગને અપનાવ્યા વિના ચાલે એવું જ નથી; તેમ એ માર્ગનો મૂળભૂત ગુણ ભવવૈરાગ્ય, વિષયવૈરાગ્ય વગેરે લાવવો જ પડે. આનું કારણ એ છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી મોક્ષમાર્ગમાં પહેલો માર્ગ છે સમ્યગ્દર્શન. જૈનશાસ્ત્રો બતાવે છે કે આ સમ્યગ્દર્શન-સમ્યકૃત્વ તો જ પ્રગત થાય કે જો (૧) અનંતાનુંબંધીના અર્થાત્ અનંત સંસારને ઊભા કરનારા ચીકણા રાગદ્વેષ છોડાય. અને સાથે (૨) મિથ્યાત્વનો ત્યાગ કરાય. એટલે માત્ર મિથ્યાત્વત્યાગથી નહિ, પણ સાથે આવા ચીકણા રાગદ્વેષના ત્યાગ ઉપર જ સમ્યકૃત્વસ્વરૂપ પ્રથમ મોક્ષમાર્ગ આવે.

અનંતાનુંબંધીના રાગ દ્વેષ આંધળાં હોય છે, આવેશવાળા હોય છે. ‘આંધળા’ એટલે ભય વિનાના. ઈન્દ્રિયોના ઈષ-અનિષ વિષયો પર રાગ દ્વેષ કરવામાં કોઈ

જ ભય નહિ કે ‘પાપ લાગશે તો ? પરલોક બગડશે તો ?’ ‘આવેશ’ એટલે પકડ, હુરાગ્રહ. રાગ-દ્વેષ પકડ્યા તે પકડ્યા, છોડવાની કે મોળા પાડવાની વાત નહિ, આવા રાગદ્વેષ સલામત રાખીને સમ્યકૃત્વ ગ્રગતે જ નહિ. સમ્યકૃત્વના એ ઘાતક છે, માટે વૈરાગ્યથી અને ઉપશમથી એને દબાવવા-હટાવવા જ જોઈએ.

આ ઉપરથી સમજાશે કે એકલી માનેલી તત્ત્વશ્રદ્ધા જિનવચનશ્રદ્ધા કે સુદેવ-ગુરુ-ધર્મશ્રદ્ધાથી સમકિત (સમ્યગ્દર્શન) ન આવે; કિન્તુ સાથે ઈન્દ્રિયોના વિષયો પર અને સંસાર પર વૈરાગ્ય જોઈએ જ, આંધળા રાગ-દ્વેષ કાપવા જ જોઈએ. આમ તો રાગાદિ સર્વથા કાઢવાના છે. કિન્તુ રાગાદિના નિયંત્રણમાં પહેલી ભૂમિકામાં અતિ ઉગ્રકોટિના રાગાદિ એટલે કે અનંતાનુંધીના રાગદ્વેષ પર નિયંત્રણ આવશ્યક છે. આના માટે સાધનભૂત ગુણ છે વૈરાગ્ય.

વૈરાગ્ય એટલે કે સંસાર, સંસારના વિષયો અને વિષયસુખો પર ખેદ, ગ્લાની થાય, ધૃષ્ણા અભાવ થાય, અણગમાં અરુચિ અકળામણ થાય. એ ભયંકર લાગે. એના ઉપરથી ભય લાગીને આસ્થા ઊઠી જાય. આ વૈરાગ્ય વિના સમ્યગ્દર્શન આવે નહિ; ને વૈરાગ્યથી આવેલું સમ્યગ્દર્શન વૈરાગ્ય ઊઠી જતાં ચાલ્યું જાય. માટે કહ્યું કે વૈરાગ્ય એ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગનો પાયો છે.

વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે મંત્રતંત્રયંત્ર સમર્થ નથી; સમર્થ હોય તો જિનવાણીરૂપ મંત્ર સમર્થ છે. કેમકે તત્ત્વાર્થ આદિ શાસ્ત્ર સમ્યકૃત્વના જે પાંચ લક્ષણ શમ સંવેગ નિર્વેદ (વૈરાગ્ય) અનુકૂંપા અને આસ્તિક્ય બતાવેલ છે, એનો ઉત્પત્તિ-ક્રમ પશ્ચાનુપૂર્વીથી કહેલ છે. અર્થાત્ પહેલું આસ્તિક્ય આવે અર્થાત્ ‘જે જિણ ભાખ્યું તે નવિ અન્યથા’ એવો જિનવાણી પર ભાવ ઊભો થાય, પછી સ્વ-પર આત્મા ઉપર અનુકૂંપા આવે, પછી નિર્વેદ યાને વૈરાગ્ય આવે. એટલે વૈરાગ્ય માટે જિનવાણી જરૂરી.

પ્ર.- ભિષ્યાદિષ્ટને જિનવચન માટે ‘જે જિને ભાખ્યું તે નવિ અન્યથા’ એવો ભાવ તો છે નહિ, તો પછી એને કેમ વૈરાગ્ય થાય છે ?

૩.- એ પ્રધાન યાને વસ્તુતાવના ધરનો નથી. કેમ કે એને મળેલ ભિષ્યાદિષ્ટન સંસાર, સંસારના વિષયોનું યથાસ્થિત તત્ત્વ બતાવી શકતા નથી. પછી એના પર તાત્ત્વિક પ્રધાન વૈરાગ્ય કેમ આવી શકે ? છતાં જિનેશ્વરદેવે કહેલ તત્ત્વો, આત્મા ઈન્દ્રિયવિષયો, બંધ મોક્ષ, વગેરેને વિશેષરૂપે નહિ પણ સામાન્યરૂપે યાને શબ્દાર્થરૂપે સ્વીકારે છે. એટલે કહેવાય કે એટલા અંશમાં જિને ભાખ્યું સ્વીકાર્યું તેથી એને ગૌણ વૈરાગ્ય આવે.

પ્રધાન વૈરાગ્ય લાવવા માટે જિનવચને કહેલ પર નિઃશંક ભાવ જોઈએ, અને એ જિનવચન મધ્યાથી બને. માટે કહો, વૈરાગ્યનું સાધન જિનવાણી છે.

પરંતુ હવે, વિચારણીય તો એ બને છે કે આપણને જિનવાણી-જિનવચન તો મળેલ છે, એ ઘણીય વાર સાંભળેલ છે, છતાં એવો વૈરાગ્ય કેમ નથી દેખાતો ? સંસાર અને ઈન્દ્રિયોના વિષયો પર ધૂણા-સૂગ-ગ્લાની કેમ નથી વર્તતી ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૬, અંક-૪૮, તા. ૧૭-૮-૧૯૬૮

(૧૭) (લેખાંક-૨)

ગત લેખમાં એ જોયું કે શ્રી તત્ત્વાર્થ મહાશાસ્ત્રના કથનાનુસાર સમ્યગ્દર્શનના પાંચ લક્ષણોના ઉત્પત્તિ ક્રમમાં પહેલું આસ્તિક્ય જન્મે, એટલે કે ‘જિનેન્દ્રદેવે જે ભાખ્યું તે અન્યથા ન જ હોય’ એવી દઢ પ્રતીતિ થાય, પછી અનુકૂંપા જન્મીને ભવનિર્વેદ યાને વૈરાગ્ય થાય. ત્યાં સવાલ એ થયો કે જિનવાણી તો સાંભળવા બહુ મળી છતાં વૈરાગ્ય કેમ નથી થયો દેખાતો ? સંસારવાસ પર જેલખાનામાં રહ્યા બરાબર ગ્લાની કેમ નથી થતી ? સંસાર, વિષયો, વિષયસુખો કેમ અકારા નથી લાગતા ? એના અનંતાનુંધી રાગદ્વેષ કેમ દભાતા નથી ?

આ પ્રશ્ન આપણા અંગે છે. તેથી આપણે જવાબમાં આ માનવાનું છે કે આપણો વિષય સુખોના ત્યાગ અને ઈન્દ્રિયોના નિયંત્રણ માટે તેવો પ્રયત્ન નથી. જિનવચન સાંભળ્યા ને મનથી એ સાચાં છે એમ માન્યું, પણ પછી સ્વ-પર અનુકૂંપા ન કેળવી. અનુકૂંપા એટલે દ્રવ્ય-ભાવ-હુંખ દૂર કરવાની ઈચ્છા. એમાં ભાવ હુંખ એટલે પાપો, પાપમતિ, વિષય-કષાયનો આવેશ વગેરે. એ આપણા ઓછાં કરવાની સક્રિય ધગશ,- ‘લાવ મારા આત્માને એનાથી બચાવવા યથાશક્તિ યત્ન કરુ’ એવી ધગશ, યાને સ્વાત્માની ભાવ અનુકૂંપા નથી થતી. પછી ભવનિર્વેદ વિષય વૈરાગ્ય ક્યાંથી થાય ?

પ્ર.- અનુકૂંપા એટલે તો દ્યા-કરુણા એમાં પ્રયત્ન ધગશ ક્યાં આવ્યા ?

૩.- આ દ્યા-કરુણાને શાસ્ત્રે હુંખ દૂર કરવાની ઈચ્છારૂપ યાને ધગશરૂપ કહી છે. ‘પરહુંખ પ્રહાણેચ્છા કરુણા’ આ વ્યાખ્યા છે. આમાં શક્ય પ્રયત્ન પણ જોઈએ જ છે. માટે જ ઉપાધ્યાયજી મહારાજે અનુકૂંપાના લક્ષણમાં કહ્યું ‘નિજ શક્તે મન લાવ’ જે ઈચ્છા ખાલી મનની ભાવના રૂપ હોય, ‘નિજ શક્તે’ શું કામ કહેત ? પણ કરુણા મન પર યથાશક્તિ લાવવાનું કહ્યું એજ સૂચવે છે કે એ કરુણા સક્રિય કરવાની છે. સક્રિયતા શક્તિ પ્રમાણે જ થાય. માટે વિષયાસક્રિયા ભાવ હુંખ દૂર કરવાની યથાશક્તિ ધગશ જોઈએ, પ્રયત્ન જોઈએ; તો અનુકૂંપા આવે. એ માટે આપણો ઈન્દ્રિયો પર શક્ય નિયંત્રણ મૂકવાનું છે. અંશે

અંશે ય વિષયોનો ત્યાગ કેળવવો જરૂરી છે. ‘એ માટે પ્રત નિયમો જોઈએ.’

પ્ર.- ભરત ચક્રવર્તી, શ્રેણિકરાજ વગેરેએ કયાં એવા પ્રત-નિયમોથી અંશેય વિષય-ત્યાગ ઈન્દ્રિય નિયંત્રણ કર્યું હતા ? છતાં એમનામાં અનુકૂળા, વૈરાગ્ય, સમ્યકૃત્વ કેમ હતા ?

૩.- એવા દાખલાનો આપણો ચાળો કરવા જેવો નથી. કેમકે એમને એ વિષયો-વિષયસુખો પ્રત્યે ભારે બળાપો હતો તેથી જ જ્યાં શાસ્ત્ર એવા જીવોને મધ્યમ કહે, ત્યાં એ પોતાની જાતને અધમાધમ માનતા.

શાસ્ત્ર કહે છે ‘જે જીવો ઈન્દ્રિય વિષયોને ભાવવર્ધક અને દુઃખદાયી નથી માનતા, એ અધમ છે; ને જે માને છે ખરા, પણ એને છોડી શકતા નથી એ મધ્યમ છે. એને છોડે એ ઉત્તમ છે.’

ત્યારે ભરતચક્રી બાહુભળજ્ઞના સંસાર ત્યાગ કરવા પર એમની ઉત્તમતા ગાઈ, જાત માટે સંતાપ કરે છે કે ‘જે જીવો વિષયોને સંસાર વૃક્ષનું બીજ સમજતા નથી એ અધમ છે. અને હું એ સમજવા છતાં ય છોડતો નથી એ અધમાધમ હું.’

શાસ્ત્ર એમને મધ્યમ કોટિમાં લઈ જાય, ત્યાં એ જાતને અધમાધમ કહે, એ અંતરમાં પોતાના વિષયાસક્રિત-વિષયસંગરૂપી ભાવ દુઃખનો કેટલો સંતાપ અને એ દુઃખ દૂર કરવાની કેટલી ધગશ હોવાનું સૂચવે છે ? આપણે આવો સંતાપ, આવી ધગશ ધરાવીએ છીએ ખરા ? આપણે તો ભલે ને વિષય-ત્યાગ ન કરીએ તો ય જાત માટે માનવું છે કે વિષયોને ભવવર્ધક નહિ માનનાર કરતા અમે ધણે દરજે સારા છીએ. પછી વિષયોને ઝેર જેવા દેખી એના ત્યાગની ધગશ કયાંથી આવે ? એ તો ત્યાગ ન કરતી આપણી જાત અધમાધમ લાગે. તો એ ત્યાગની ધગશ ઊભી થાય, ને જો આ સ્થિતિ આવે તો ઝેર જેવા ઈન્દ્રિય વિષયોનો યથાશક્તિ ત્યાગ કરવાનો પ્રયત્ન કર્યા વિના રહીએ નહિ.

સારાંશ, પહેલી અનુકૂળા, પછી વૈરાગ્ય. પહેલા વિષયત્યાગ ને ઈન્દ્રિય નિયંત્રણ કર્યે જઈએ, પછી હદ્યમાં વૈરાગ્ય જળહળે, જેટલા મનગમતા વિષયો લક્ષ્મી-લારી-વારી-ગારી-ખાનપાન વગેરે મળતા રહે એ ખપે છે, એ મેળવવા દેવ-ગુરુ-ધર્મને બાજુએ રાખી પાપના ને પરલોકના ભય વિના મથવું છે, ને મળ્યા પર મસ્તાન થવું છે, ત્યાં વૈરાગ્યના ફંકા.

એટલે આપણી જાત માટે તો આ કર્ત્ય બની રહે છે કે વિષય સંગમાં જતી આપણી જાત અધમાધમ લાગે, ને આપણે વિષયોના ત્યાગ, પ્રત, નિયમનો, શક્તિ ફેરવીને અંશે અંશે પણ ખપ કરીએ, જેથી એની અંતર્ગત વૈરાગ્ય જળહળે, અને સમ્યગ્દર્શન માટે લાયક બનીએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખમૂત”

૧૮-૧૭, અંક-૨, તા. ૧૪-૮-૧૯૬૮

## ૧૮ અરિહ્ંતની ઉપાસનાનો ઉપાય

મહાન બનવા માટે મહાનની ઉપાસના આવશ્યક છે. કેમકે સામે આદર્શ જેટલો ઊંચો, એટલું સંસ્કરણ અને આત્મોત્થાનનો મનોરથ તથા પ્રયત્ન ઊંચો બન્યો રહેવાનો.

આથી સ્પષ્ટ છે કે જો આપણે કામ કોધાદિ આંતર શરૂઆથી મુક્ત તથા અજર-અમર અને શુદ્ધ બુદ્ધ થવા ચાહીએ છીએ તો આપણે સામે વીતરાગ સર્વજ્ઞ શુદ્ધ-બુદ્ધ ભગવાન અરિહ્ંતને જ રાખવા જોઈએ, અને એમની જ ઉપાસના કરવી જોઈએ. મનની સામે જો એ રહેશે, તો એમના જેવા આપણા ઢંકાયેલા ભવ્ય સ્વરૂપને પ્રગટ કરવા તરફ જ આપણી સાધનાની યાત્રા ચાલશે, પણ જો એમને છોડી કોઈ રાગ-દ્રેષ્ઠ-મોહ-અજ્ઞાનયુક્ત વ્યક્તિ આદર્શરૂપે રહેશે તો ચિત્તની વૃત્તિઓ આ દોષોથી રંગાયેલી રહેવાની.

હવે સવાલ એ છે કે એવા વીતરાગ સર્વજ્ઞભગવાનની ઉપાસના શી રીતે કરવી ? ઉપાસનાનો ઉપાય શો ?

આનો ઉત્તર આપણને આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના ‘અષ્ટક’ શાસ્ત્રમાં મળે છે. એ લખે છે કે,

યસ્ય ચારાધનોપાય: સદાજ્ઞભ્યાસ એવ હિ ।

યથાશક્તિ, વિધાનેન નિયમાત્ સ ફલપ્રદ: ॥

-અર્થાત્ (વીતરાગ સર્વજ્ઞ મહાદેવ એવા છે કે) જેમની આરાધના-ઉપાસનાનો ઉપાય આ, કે શક્તિને છુપાવ્યા વિના વિધિસર એમની આજ્ઞાનો હંમેશા અભ્યાસ કરવો; અને તે અવશ્ય સર્ફણ બને છે.

વીતરાગની આજ્ઞાનો અભ્યાસ એ જ એમની ઉપાસના, એ તાત્પર્ય છે. વીતરાગની પૂજા કરો, જાપ કરો, ધ્યાન કરો, કિન્તુ જો એમની આજ્ઞાની ઉપેક્ષા છે, અવગણના છે, તો ઉપાસના નથી થઈ શકતી. એટલા માટે જ કલિકાળ-સર્વજ્ઞ આ. શ્રી હેમયંડ્રસૂરિજી મહારાજે ઠીક જ કહ્યું છે કે,-

‘વીતરાગ । સપર્યાતસ્તવાજ્ઞ પાલનં પરમ् ।’

હે વીતરાગ ! તમારી પૂજા કરતાં તમારી આજ્ઞાનું પાલન ચંદ્રિયાતું છે.

પૂજા તો બહુ ઠાઈથી સારું ધન ખરચીને થાય, કિન્તુ સાથે પૌદ્રગલિક સુખ કીર્તિ આદિની કનિષ્ઠ કામના રાખીને જો થાય કે જે આજ્ઞાથી નિશિદ્ધ છે, તો એ પૂજાની કશી કિંમત નહિ. એથી તો લાભની જગાએ હાની થવાની. એમ વીતરાગની પૂજા તો કરે, પણ આજ્ઞાનો અપલાપ કરે, આ જ્ઞાની વિરુદ્ધ માને બોલે, તો એ પૂજા છતાં સંસારમાં દૂબે. સારાંશ વીતરાગની આજ્ઞાનો અભ્યાસ એ જ એમની સાચી ઉપાસના છે.

આ અભ્યાસ શી ચીજ છે? અભ્યાસ એટલે ગ્રહણ અને ભાવન. વીતરાગ પરમાત્માની આજ્ઞા અર્થાત્ વચનોનું ગુરુમુખે શ્રવણ કરી એને સમજવાં અને મનમાં નિશ્ચિત કરી એના પર શ્રદ્ધા કરવી એને પરમ આદરશીય માનવાં, એ ‘ગ્રહણ’ કહેવાય. તેમ એના અનુસાર આચરણ કરી હૃદયને એથી ભાવિત કરવું, હૃદયને રંગવું, એ ‘ભાવન’ કર્યું કહેવાય. ટીકાકાર મહર્ષિ આ.શ્રી જિનેશ્વરસુરિજી મહારાજે ‘અભ્યાસ’ નો ગ્રહણ ભાવન અર્થ કર્યો છે.

જેને આજ્ઞાનું આચરણ એટલું શક્ય નથી, છતાં એનું ગ્રહણ કરે છે, આજ્ઞા પ્રત્યે પરમ આદર શ્રદ્ધા બહુમાન રાખે છે એ પણ આજ્ઞાનો અભ્યાસી છે, અને વીતરાગનો આરાધક છે, ઓછામાં ઓછી ઉપાસના આ જ છે. જેને વીતરાગનાં સર્વ વચનોનો આદર-બહુમાન નહિ બલ્કે એક પણ વચનો વિરોધ કરે છે, એ બીજા ગમે તેવાં સુફૂત-સત્કાર્ય કરે એની કિંમત નથી.

વીતરાગની પહેલી આજ્ઞા આ કે ‘ઈન્દ્રિય વિષયો અને જડ કાયા-માયા આદિનો રાગ સંસારવર્ધક છે, માટે એને ઓછો કરો.’ હવે આ આજ્ઞા પર શ્રદ્ધા હોય તો આ કરવા માટે રાગાદિના અપાયોનું યાને આ લોક પરલોકના અનર્થોનું વારંવાર હૃદયથી ચિંતન જરૂરી, ધ્યાન જરૂરી. એથી રાગાદિ પ્રત્યે ઘૃણા, સૂગ, અભાવ અરુચિ થશે. અને રાગાદિના પૂર્વ સંસ્કાર ક્ષય પામતા રહેશે.

ટીકાકાર મહર્ષિએ પૂર્વના શ્લોકની ટીકામાં આ જ બતલાવ્યું છે. એ લાખે છે કે માત્ર ‘અહ્ન’ એટલું ધ્યાન કરવાથી કામ નહિ થાય; કેમકે માનો કે એવા ધ્યાનમાં તો બેઠા, પણ ઉઠ્યા પછી રાગાદિ એવા ને એવા ચાલતા રહે છે. માટે એટલું ધ્યાન રાગાદિના કુઝનમાં સમર્થ નહિ. સમર્થ તો રાગાદિથી થતા આ લોક પરલોકના અપાયોનું ચિંતન છે. એટલે વારે વારે એનું ધ્યાન-ચિંતન જરૂરી. એ માટે વીતરાગ પર અથાગ આસ્થા પ્રીતિ ભક્તિ સાથે એમની વાણીનું દરરોજ શ્રવણ, મનન અને વીતરાગની આજ્ઞાનું જીવન જીવતા મુનિઓનો સમાગમ તથા ભક્તિ બહુ ઉપયોગી બને છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૯-૧૭, અંક-૩, તા. ૨૧-૮-૧૯૬૮

## ૧૬ આસ્તિક-નાસ્તિકનું માપ શાના પર ?

આસ્તિક-નાસ્તિક શબ્દનો અર્થ સમજનાર કોઈ પણ પોતાને નાસ્તિક તરીકે ઓળખાવવા રજી નથી હોતું; એ તો આસ્તિક રૂપે ઓળખાવવામાં જ ખુશી હોય છે. આ રજીપો શું ખરેખર પોતે હૃદયથી આસ્તિક છે માટે? ના, એવો કોઈ નિયમ નથી, ડેયે આસ્તિક ન પણ હોય; કિન્તુ ‘નાસ્તિક’ શબ્દને અધમી પાપી તરીકેની ગાળ જેવું સમજે છે, તેથી એ સંબોધન ગમતું નથી, ખરેખર તો સંબોધનની બહુ કિંમત નથી; કિંમત તો અંતરમાં સાચું આસ્તિકપણું હોવાની છે.

આસ્તિક્ય હોવા માટે શું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરમાં જૈન શાસ્ત્રો ‘જિન વચન પર અથાગ શ્રદ્ધાને આસ્તિક્ય’ કહે છે, ‘જે જિન ભાષ્યું તે નવિ અન્યથા, એવો જે દઢ રંગ, તે આસ્તિક્ય લક્ષણ પાંચમું, કરે કુમતિનો ભંગ’ આવું સમ્યક્તવના પાંચ લક્ષણમાનું ‘આસ્તિક્ય’નું લક્ષણ છે.

વૈદિક દર્શનવાળા ‘વેદને માને તે આસ્તિક’ એમ વ્યાખ્યા કરે છે. એની સામે આ લક્ષણ ખરેખર આસ્તિકનું સ્વરૂપ બતાવે છે.

પ્ર.- તો શું જૈનેતર ધર્મવાળા આસ્તિક નહિ?

૩.- મુખ્યપણે નહિ; કિન્તુ ગૌણપણે આસ્તિક હોય. ગૌણ આસ્તિક્ય એટલે શરીરથી ભિન્ન સ્વતંત્ર સનાતન આત્મા હોવાની માન્યતા. સાચે જ જો આ માન્યતા હોય તો એ હૃદયથી સમજે કે શરીર તો એક ભવની ચીજ છે, ત્યારે આત્મા ભવોભવની વસ્તુ છે. શરીરે કરેલું ઘણું ય પાપકર્મ આ શરીરને ભોગવવું નથી પડતું; પણ એ શરીર દ્વારા આત્માએ કરેલું બધું જ એ કે બીજા શરીરો દ્વારા એને પોતાને જ ભોગવવું જ પડે છે. એટલા માટે મુખ્યતા આત્માની થાય છે.

હવે જો આત્માની માન્યતા હોય તો મુખ્ય દણિ શું શરીર પર રહે? કે આત્મા પર? હૃદયનો વિશેષ જોક કઈ તરફ હોય? જ્યાં એમ જોયું કે ‘શરીર-ઈન્દ્રિય-વાણી-મન આદિ દ્વારા આત્માએ કરેલું થોક પાપ પોતાને જ ભોગવવું પડે છે, અને એમ છતાં શરીરાદિનું પાપકર્મ-ઠમઠોક કરવાનું ચાલુ છે, તો પછી આત્મા પર એવી દણિ જામી જાય કે ‘આ બધું મારે જે ચાલી રહ્યું છે એનું ફળ કેવું? એ શે ભોગવ્યું જશે? જૂઠ બોલવાનો કાળ ૧-૨ મિનિટ; અને એથી ઉપાર્જલ પાપે વર્ષો સુધી જ્ઞબ સરેલી મળે! સરખું ખવાય પીવાય નહિ, ને લાયો ઉઠે!

એ કેમ સહ્ય જાય ?' તો પછી અહી જ પાપો દુષ્કૃત્યો ઓછા કાં ન કરું ? એમ મોટા ભાગે આત્માનોજ વિચાર ચાલ્યા કરે.

ખરેખર અંતરથી જો આસ્તિક છે, તો અલ્ય કાળના આ શરીર કરતા અનંતાનંતકાળ સાથે સંબંધ રાખનાર પોતાના આત્મા પર જ મુખ્ય મદાર હોય; એના જ બહુ વિચાર આવે, એનું જ હિત મુખ્ય કરે.

ત્યારે આપણે આપણા રોજંદા જીવનમાં આ તપાસવાનું છે કે 'આત્મા, આત્મહિતાહિત અને એને લગતો વસ્તુનો વિચાર કેટકેટલો કરીએ છીએ. દિનરાત્રિભરના કયા કયા વિચાર-વાણી-વર્તાવમાં આત્માનું લક્ષ હોય છે ?'

ઘણાનો અનુભવ છે કે ઢગલાબંધ વિચાર જડના જ ચાલ્યા કરે છે. 'મારી કાયાને ઠીક નથી. ગેસ રહે છે, કષ્ણ રહે છે. દવા કોની લઉં ?...ધૂમો બરાબર નથી ચાલતો. સરકારી લફરા ઘણાં...ધરાક પૈસા ચેકથી નહિ રોકડા આપે તો સારું ... ધી ચોક્કાં નહિ, શરીરને શક્તિ શી મળે ?...કેવો કાળ ? ફલાણ કેમ મળવા નથી આવ્યા ? કંઈક પેચમાં હશે...' આવું આવું કેટલું ય મગજમાં ચાલતું હોય છે. આમા આત્માનો કે એના હિતાહિતનો એક પણ વિચાર જ કયાં છે ? છતાં જાતને આસ્તિક માનવો છે ? આસ્તિક શું આત્માને યાદ કરનારો નહિ ? એની કશી ખબર જ નહિ લેનારો ? જાગતા નહિ તો સ્વભાવમાં તો હોય જ શાનું ? કાયા માયા માલમિલકત પરિવાર ખાનપાન જડ ચીજ વસ્તુ માન મોઝો સત્તા કીર્તિ વાહવાહ વગેરે વગેરેની અતિ ભરચક વિચારણાઓના કેટલા થોકબંધ કુસંસ્કારની આત્મામાં ભરતી થવાની ? એથી આગળ પણ શું યાદ આવવાનું ? શું સૂજવાનું ? ત્યારે ભવાંતરે તો ભરચક કચરામૂડી પર કયા વેપાર ચાલવાના ? આસ્તિકની આ કરુણ વિટંબણા હોય ?

વાત આ છે કે દિનભર અને રાતે એકલા જડના જ વિચારો કર્યા કરાય છે. તો છૂપી નાસ્તિકતાનું લક્ષણ છે. જો દિલથી આસ્તિક બન્યા રહેવું હોય તો એના સ્થાને સ્વાત્માના ને એના હિતાહિતના વિચાર ભરચક વહેતા રહેવા જોઈએ. જડના વિચારો સ્કુરે કે તરત એનો જોક આત્મા તરફ વાળી દઈ આત્માના હિતમાં એને ઊતારી દેવા જોઈએ. મન મજબૂત કરી એનાથી પાઢેલો આ અભ્યાસ આગળ વેગ આપે છે.

"દિવ્ય-દર્શન"-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૪, તા. ૨૮-૯-૧૯૬૮

## ૨૦ અક્ષય સુખના લવથી સર્વ ભૂખ કેમ લાગે ?

મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ પ્રભુને સત્વે છે કે,-

'તુજ અક્ષય સુખની રસવતી, તેહનો લવ દીજે મુજા;  
ભૂખ્યાની ભાંગે ભૂખી, શું અધિકું કહિયે તુજ ?'

સુષા સુગુણા સનેહી સાહિબા.'

અહી પ્રશ્ન થાય કે અરિહંત પ્રભુની અક્ષય સુખરૂપી રસોઈમાંથી એક લવમાત્ર મળતા જીવની બધી ભૂખ શી રીતે ભાગે ? તો પછી મહાન ન્યાયાર્ય આ વિધાન શા હિસાબે કરે છે ?

આનો ખુલાસો વિવિધ રીતે થઈ શકે.

(૧) જીવને કાંઈ ને કાંઈ જાણવાની આતુરતા યાને ભૂખ રહ્યા કરે છે. ત્યારે પ્રભુને અક્ષય સુખ અનંત જ્ઞાનનું લેવાનું છે. કેમકે અધુરા જ્ઞાનમાં જ જીવને દુઃખરૂપ લાગ્યા કરે છે. જો જ્ઞાન પૂર્ણ છે તો હવે આગામી અનંતાનંત કાળના શાશ્વત સુખને જોઈ લીધું છે, પછી વર્તમાન અતિઅલ્ય કાળનું દુઃખ કે જે લોગવાયે એ શાશ્વત સુખને પ્રગટ થવા અવસર દે છે. પછી એ દુઃખ દુઃખરૂપ શાનું લાગે ? દા.ત. જો કોઈ શાહુકાર દેવાદારને દેવું ભરી દે તો પછી વેપારમાં મોટો ભાગીદાર બનાવવાની ખાતરી આપી હોય તો પછી એ દેવાદાર દેવું ભરતા જરાય દુઃખ નથી માનતો. એમ અહી અનંત જ્ઞાનમાં વર્તમાન અલ્ય દુઃખ પૂર્ણ થયેથી અનંતાનંત કાળના અક્ષય સુખનું દર્શન થતું હોય ત્યાં દુઃખ દુઃખરૂપ લાગે જ શાનું ? એટલે જ જાણો અત્યારથી જ અક્ષય સુખ; પછી ભવે ખરેખર અક્ષય સુખનો અનુભવ મોક્ષપ્રાપ્તિથી શરું થાય.

હવે જો પ્રભુના આ અનંત જ્ઞાનના અક્ષય સુખનો લવલેશ મળે તો આપણી નવું જાણવાની ભૂખ આ રીતે ભાંગે;- પ્રભુનું કેવળજ્ઞાન સર્વ અનંતાનંત દ્રવ્યોના સમસ્ત પર્યાયો (ત્રિકાળની સમસ્ત અવસ્થાઓ) જાણે છે. એમાંના માત્ર એક જ દ્રવ્યનું એના સર્વ પર્યાયો સહિતનું જ્ઞાન એ પ્રભુના જ્ઞાનનો લવલેશ કહેવાય. એ મળે તો ભૂખ એટલા માટે ભાગે, કે શાસ્ત્ર કહે છે કે 'જે એં જાણાઈ, સે સત્યં જાણાઈ'. અર્થાત્ જે એક દ્રવ્યને સંપૂર્ણપણે જાણે છે તે સર્વ દ્રવ્યોને સંપૂર્ણપણે જાણે છે; કેમકે એ એક દ્રવ્યનો સ્વ-પર પર્યાયોથી અર્થાત્ અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધથી

સમस્ત દવ્યો સાથે સંબંધ છે; એટલે એક દવ્યને સંપૂર્ણપણે જાણવામાં સર્વદવ્યોની સંપૂર્ણ જાણકારીનો સમાવેશ થઈ જ જાય. આ રીતે પ્રભુએ જાણેલ અનંતાનંત દવ્યોમાંના લેશભૂત એક દવ્યનું જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન મળવાથી નવું નવું જાણવાની બધી ભૂખ મટી જાય.

(૨) જીવને ઈન્ડ્રિયોના વિષયોની ભૂખ રહે છે. એ પણ પ્રભુના અક્ષય સુખના લેશથી આ રીતે ભાગો;- પ્રભુનું અક્ષય સુખ વીતરાગતા પર છે કેમકે વીતરાગ થયાથી એમને કોઈપણ હુંખ પર દ્રેષ જ નહિ હોવાથી દેખીતું શારીરિક હુંખ હુંખરૂપ જ નથી લાગતું. એ જ જાણે અત્યારથી અક્ષય સુખ. હવે એ વીતરાગતાનો આપણને લેશ મળે, અર્થાત્ વીતરાગતા તો અનંતાનંત મોહનીય કર્મના નાશરૂપ છે. એમાંથી લેશ એટલે કે માત્ર દર્શન મોહનીય કર્મનો સર્વનાશ મળે તો ક્ષાયિક સમૃદ્ધાર્થન પ્રગટ થાય; એથી વિષયો ખરેખર વિષરૂપ લાગ્યો જવાથી એની તૃષ્ણા મટી જાય. કંધું છે,- ‘તાણી આણો રે સમકિત વિરતિને’ વિરતિ એટલે વિષયેચ્છાની નિવૃત્તિ

(૩) જીવને પોતાનું અહંત્વ ઊંચું રાખવાની આકંક્ષા અને માનાકંક્ષા બહુ રહે છે. એ પણ આકંક્ષા મોટી ભૂખ છે, ત્યારે પ્રભુનું અક્ષય સુખ અનંત નભ્રતા અને અનુત્કર્ષ (માનની નિસ્પૂણ)ના ઘરમાંથી ઊંચું થયેલું છે. કેમકે એમને તો જનમતા દિક્કુમારીઓએ હુલરાવ્યા, કોટિગમે દેવો-ઈન્દ્રોએ મેરું પર નવરાવ્યા-સન્માન્યા, અને સુરેન્દ્ર-નરેન્દ્રોએ દીક્ષા વરઘોડે પાલભીમાં ઊંચક્યા-શોભાવ્યા તથા તીર્થકરપણે પ્રતિહાર્ય નવકર્મણ સમોવસરણ આદિથી ઉત્કૃષ્ટ માન-સન્માન મળ્યા, છતાં પ્રભુએ લેશમાત્ર ન વડાઈ માની કે ન એની સ્પૃણા કરી. હવે જો આમાંથી લવલેશ જેવી નભ્રતા અને અનુત્કર્ષ મળે, એટલી જ કે પરિચિત સગા-સ્નેહી આદિ બહુ થોડા મનુષ્યો પ્રત્યે ન તો અહંત્વની કે ન સન્માનની ભૂખ અપેક્ષા રહે, તો એના પર તો વિશુદ્ધ ધર્મસાધના થઈ જીવની ઘણી ઉચ્ચતા થાય. દેખાય છે કે, જીવ ઘણાં પાપો કરે છે તેમ ધર્મ પણ સાધે છે. એ અહંત્વ અને માનાકંક્ષા ઉપર તે ય કોની આગળ ? ગણતરીના સ્વાર્થી મનુષ્યો આગળ. આ જો નીકળી જાય તો વિશુદ્ધ ધર્મ સધાઈ બધી ય ભૂખ ભાંગી જતાં શી વાર ?

(૪) જીવની એક ભૂખ આહારસંજ્ઞાની છે. પ્રભુનું અક્ષયસુખ એ અને બીજી સંજ્ઞાઓના અનંત નાશના ઘરનું છે તો એમાંથી લવલેશ મળે, તો જીવની માત્ર આહારસંજ્ઞા, દબાવા પર પણ એવા એવા તપ્ય સ્વાધ્યાયાદિ મહાન ધર્મોની સાધના થાય એવી છે કે જે એને બહુ ઊંચે ચડાવી સર્વ સંજ્ઞાનાશે પહોંચાડી દે.

(૫) જીવની એક ઈચ્છા પોતાના પૂર્વ ભવો જાણવાની રહે છે. પ્રભુનું ભુવનભાનું એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

અક્ષય સુખ પહેલાં કંધું તેમ અનંતા જીવોના ભૂતભાવી અનંતાનંત ભવોના જ્ઞાન પર ઊંચું છે. એમાંથી લવમાત્ર જો મળે અને જીવને પોતાના સંઝ્યાતા ચારે ગતિના ભવોનું સ્મરણ મળી જાય. તોય એની નરકાદિ ભવોની વેદના જાણી તથા દેવાદિ ભવોના બહુ ઊંચા સુખોના પણ અંત પછીની હુદ્દશા જાણી મહાવેરાય આવે, અને કઠોર સંયમાદિ ધર્મસાધના થઈ કામ નીકળી જાય.

આમ જીવને અનેક રીતે પ્રભુના અક્ષયસુખમાંથી લેશ પણ મળતાં જીવની વાસનાઓ શમી જાય છે, અને એના પર પાપમાત્રના ત્યાગ થઈ મહાતેજસ્વી શુદ્ધ ધર્મસાધનાઓ સધાય એવી છે કે જેથી પછી બધીય ભૂખનો સર્વથા નાશ થઈ વીતરાગ-સર્વજ્ઞતા અને મોક્ષ મળે એવો છે. માટે કવિએ માંગ્યું કે ‘તુજ અક્ષય સુખની રસવતી, તેણો લવ દીજે મુજ; ભૂખ્યાની ભાંગે ભૂખી...’

એમ અક્ષયસુખના લવથી સર્વ ભૂખ ભાંગે એ વસ્તુ સુસંભવિત છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૫, તા. ૫-૧૦-૧૯૬૮

## ૨૧ કાળલદિય લહી પંથ નિહાળશું

(લેખાંક-૧)

પરધરમાં ભૂલા પડેલા આપણે પ્રભુના ધેર પહોંચ્યા વિના પોતાના આત્મધરે પહોંચી શકીએ નહીં. પરંતુ પ્રભુના ધેર પહોંચ્યું ક્યા માર્ગ ? માટે કવિ શ્રી આનંદધનજીએ ગાયું કે ‘પંથો નિહાળું રે બીજા જિનતણો રે.’

‘પરધર’ એટલે બાધ્ય જડ કાયા શબ્દાદિ વિષયો, સત્તા-માન-પ્રતિષ્ઠા અને એનાં સાધન ભૂત ધન-મિલકત વગેરે, એમાં આપણે ભૂલા પડ્યા છીએ. એ આપણું ધર નથી કે જ્યાં દરીઠામ બેસી શાશ્વત કાળ બેસી શકીએ, કેમકે એ નાશવંત છે, એના સંયોગો નાશવંત છે. એક ભવના, એ બીજે ભવ આવે નહિ, એટલે જન્મોજન્મ જીવ એ નવનવા સંયોગ મેળવે છે, ગુમાવે છે...મેળવે છે ગુમાવે છે...એમ ઘટમાણ ચાલ્યા કરે છે. એક ભવમાં ય વળી એમાં પલ્યા ઘણા, એમા પછી કાયમી વસવાટ ક્યાંથી બની શકે ? જો તે નહિ, તો સુખશાંતિ શી ? છતાં જીવ ગાંડો એવા બાધ્ય સંયોગોમાં જ લીન બન્યો રહે છે, એ હુંખ છે. નિજ ધર ભૂલી પરધરમાં બટકતો રહે, લયલીન રહે, ત્યાં સુધી એ ખરેખર સુખશાંતિ પામી શકે જ નહિ, એકેક ભવમાં મળેલા પાછળા ન બગડવા ન ખોવાવાની ચિંતા-અંજપા, બગડવા ખોવાયા પર સંતાપ-હાયવોય, મેળવવા પાછળ આતુરતા-

૪૪

ભુવનભાનું એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

વલવલાટ, અને નિશ્ચિત અંતે જઈને મૃત્યુનું આદું ફરી વળતાં જીવનભર મહલાવેલું એ બધું, કરોળિયાના જ્ઞાની જેમ સાફ ! એકી કલમે સાફ !

ત્યારે સવાલ આ થાય કે અનંતાનંત કાળના કુસંસ્કારો જીવને એ પરધરમાં રમતો રાખે છે, પછી નિજના આત્મધરનું એવું જગન જ ક્યારે કરવાનું કે ‘એવી કોઈ સ્થિતિ છે કે જ્યાં શાશ્વત વાસ કરી શકીએ ? અને સઘળાં હુંખને સઘળી હુદ્ધશાનો અંત આવે ? તેમજ પરમ સુખશાંતિનો અનુભવ કાયમી મેળવી શકીએ ?’ જો આનું ભાન પણ નહિ, તો એના માટે ખરો પ્રયત્ન પણ ક્યાં ? અને એનો અનુભવ પણ ક્યાં ?

એટલે જ પોતાના આત્મધરનું ભાન થવું જરૂરી છે, અને એ પામવા માટે કયો માર્ગ, કઈ સાધના, એ જાણવું અને એ રસ્તે ચાલવું આવશ્યક છે.

પોતાના ઘરે પહોંચવાનું એ પ્રભુના ઘેર જવા દ્વારા થાય. પ્રભુ એટલે વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એમને ઘેર પહોંચીએ પછી તો જ્ઞાનો પોતાના ઘેર પહોંચ્યા જ સમજો. છ્ઠાં પ્રભુના ઘેર પહોંચવાનો માર્ગ કયો ? એ સવાલ છે.

કવિ આના પર વિચાર કરતા બતાવી રહ્યા છે કે ચર્મચક્ષુએ માર્ગ દેખાય એવો નથી. એમાં તો આખી દુનિયા ભૂલી પડી છે. કારણ એ છે કે ચર્મચક્ષુએ માત્ર સ્થૂલ પ્રત્યક્ષ થાય, પરંતુ અતીન્દ્રિય વસ્તુ ન દેખાય; ત્યારે માર્ગની વસ્તુ અતીન્દ્રિય છે. અર્થાત્ આત્મા-પરમાત્માનું સ્વરૂપ કેવું છે, એ પ્રગટવાની અડે નડતા કર્મનું સ્વરૂપ કેવું છે, એના બંધન કેમ લાગ્યા, એમાં કેવી કેવી પ્રક્રિયાઓ થાય છે, એનો નિકાલ શી શી રીતે બને, એ બધું કાંઈ ચર્મચક્ષુએ દેખાય નહિ. માટે જ એ અતીન્દ્રિય કહેવાય. ત્યારે એને ઓળખ્યા વિના એના નિકાલનો પ્રયત્ન શી રીતે થાય ?

કવિ આગળ વધતા કહે છે કે પૂર્વ પુરુષની પરંપરાના આધારે જોતા તો અંધ પડુંપડા થાય છે; અને શાસ્ત્ર-આગમના આધારે જોતા જગતમાં શાસ્ત્રો ઘણાં, કોને માન્ય કરવા ? એકેયમાં સ્થિર થવાય એવું નથી એટલા બધા વિરોધોભર્યા એ શાસ્ત્રો છે, સર્વજ્ઞના આગમોથી જોવા જતાં માર્ગ એટલો બધો સૂક્ષ્મ છે કે એને જોવા સમજવા જતા આ ધરતી પર પગ મૂકવા જેવું લાગતું નથી. ત્યારે જો તર્ક લડાવીને જગતના શાસ્ત્રોના માર્ગ વિચારવામા આવે તો તર્કની સામે તર્ક, એની સામે તર્ક, એમ વાદ પરંપરા ચાલે એવું છે, ત્યાં અંતિમ સત્યનો નિષ્ણય શી રીતે થાય ? હા, જો દિવ્ય નેત્ર મળે તો એનાથી અતીન્દ્રિયના વસ્તુસ્થિતિએ દર્શન થાય. પરંતુ એ કાંઈ પાસે છે નહિ, વસ્તુનો નિર્ણય કરવા માટે તો અત્યારે પોતાનો બોધ-બુદ્ધિ ઉપયોગી થાય; પરંતુ એ તો વિશ્વસનીય બને નહિ, કેમકે જ્ઞાનાવરણાદિ કર્મનો

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૪૫

ક્ષ્યોપશમ થવા ઉપર એ બોધ પ્રગટે; ને ક્ષ્યોપશમ તો અનેકાનેક પ્રકારના છે, તે ય વળી જેવા જેવા પોતાના મન-વચન-કાયાના યોગ, પ્રવૃત્તિ વ્યાપાર; તેવા તેવા પ્રકારે ક્ષ્યોપશમ યાને સંસ્કાર ઊભા થઈ, એનાથી વાસિત બોધ થાય. દા.ત. તપ કરનારો, માણસ એનાથી વાસિત થયેલી બુદ્ધિના આધારે એમ જ કહે છે કે તપથી જ સિદ્ધિ થાય. એમાં ય તપના પ્રકાર અનેક; એટલે જેવો પ્રકાર અભ્યસ્ત, તે તે પ્રમાણે બુદ્ધિ થવાની. આમાં ચોક્કસ માર્ગ શે જગ્યાય ?

અંતે કવિ કહે છે, ‘કાળલાલ્બિ લહી પંથ નિહાળશું રે.’ અહીં એ વિચારવાનું છે કે એ કાળલાલ્બિ શું ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૬, તા. ૧૨-૧૦-૧૯૬૮

(૨૨) (લેખાંક-૨)

ગયા લેખમાં એ જોયું કે પરધરમાં ભટકતો આત્મા પરમાત્માના ઘરે થઈ નિજ ધરમાં આવી શકે. પરંતુ પ્રભુના ઘરે જવાનો માર્ગ શી રીતે નક્કી કરવો ? ચર્મચક્ષુ વગેરેથી નક્કી થાય એમ નથી માટે આનંદધનજી મહારાજે ગાયું ‘કાળલાલ્બિ લહી પંથ નિહાળશું.’ આનો અર્થ વિચારીએ.

કાળલાલ્બિ એટલે વર્તમાનકાળે પ્રાપ્ત આગમલાલ્બિ. વર્તમાનમાં જે ૪૫ આગમ અને નિર્યુક્તિ-ભાષ્ય-ચુણી-ટીકા તથા સર્વજ્ઞાનુસારી અન્ય આચાર્યોના રચેલા શાસ્ત્રો મળે છે એના આધારે પ્રભુનો માર્ગ પ્રભુના ઘરે જવાનો માર્ગ નક્કી કરીશું. સર્વજ્ઞોક્ત આગમમાં અસત્યતા હોય નહિ.

આમાં પૂર્વોક્ત બાધકો નહિ નડે. કેમકે અહીં ચર્મચક્ષુએ જોઈને કે અંધ પરંપરા યા અસર્વજ્ઞકથિત માર્ગ અથવા તર્ક-પ્રતિતર્ક વગેરેથી નક્કી કરવાનું નથી.

પ્ર.- પરંતુ આગમ-શાસ્ત્રો ય ક્યાં સર્વજ્ઞ રચેલા થાય છે ? એ તો અસર્વજ્ઞ ગણધરો ને આચાર્યોએ રચ્યા છે. એના પર આધાર કેમ રખાય ?

૩.- શાસ્ત્રો ખુદ સર્વજ્ઞ રચેલા માન્ય થાય એવો જે દાવો રાખે છે એમને સર્વજ્ઞતા શી વસ્તુ છે એનું જ ભાન નથી. સર્વજ્ઞ તો વીતરાગ હોય; લેશ પણ રાગાદિ વિનાના. એટલે એ લાલ્બિ ફોરવે નહિ; પછી શાસ્ત્ર શી રીતે રચે ? શાસ્ત્ર રચવામાં આતુરતા વગેરે જોઈએ, ને એ તો પ્રશસ્ત રાગાદિ માગે છે. માટે સર્વજ્ઞ નહિ પણ અસર્વજ્ઞ ગણધર આદિ જ શાસ્ત્ર રચે છે.

પ્ર.- તો પછી સર્વજ્ઞ કપિલકેવલીનું રચેલું અધ્યયન આવે છે તેનું કેમ ?

૩.- એ કાંઈ સૂત્ર કે શાસ્ત્ર રચવા તરીકે એમણે રચ્યું જ નથી; કિન્તુ ૫૦૦

૪૬

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

ચોરોને ગદને બદલે પદમાં આપેલો ઉપદેશ છે. વ્યવસ્થિત સૂત્ર-શાસ્ત્રની રચના તો અસર્વજ્ઞ જ કરે છે.

પ્ર.- તો પછી એ અસર્વજ્ઞ-વચન માન્ય કેમ થાય ? ને જો થાય તો ઈતર દર્શનોના શાસ્ત્રો પણ કેમ માન્ય નહિ ?

૩.- ગણધરચિત આગમો માન્ય એટલા માટે છે કે (૧) એના પર સર્વજ્ઞ તીર્થકર ભગવાન મહોર છાપ મારે છે, તેમજ (૨) એ રચવા પ્રભુએ અર્થથી કહેલ વસ્તુ ઉપર જ થયેલ છે. ત્યારે અન્ય આચાર્યાંની શાસ્ત્રરચના પણ એ આગમને અનુસારે જ થઈ છે; સર્વજ્ઞવચન સર્વેસર્વ માન્ય થઈને થયેલી છે. વળી (૩) આ આગમ-શાસ્ત્રો સુવર્જની જેમ કૃષ્ણ-છેદ-તાપની પરીક્ષામાં પસાર છે.

આ ગ્રણેમાંથી એકે મુદ્રા ઈતરદર્શનના શાસ્ત્રોમાં લાગુ થતો નથી; તેથી એ માન્ય ન બને. ત્યારે ગણધરાદિના શાસ્ત્ર આ મુદ્રાઓ દ્વારા સર્વજ્ઞવચનત્વત્ત માન્ય બને છે. એના આધારે પ્રભુના માર્ગનો નિર્ણય થઈ શકે છે. આ એક અર્થ.

(૨) ‘કાળલભિ’નો બીજો અર્થ એ કે આ પંચમ કાળમાં પણ જિનાગમે કહેલ સમ્યગ્રદ્શનની ઉત્તમ કરાડીઓ, અહિસાદિ વ્રતો, પવિત્ર પંચાયારો, તપ જ્ઞાનધ્યાન વગેરે મળે છે એ અદ્ભુત પ્રાપ્તિ છે. એ કાળલભિ છે. જીવનમાં એની ખૂબ ખૂબ આરાધના કરવાથી હૃદયને પ્રતીતિ થાય છે કે પ્રભુનો માર્ગ ક્યો હોય, કેવો હોય ? જાત અનુભવ અને તેવી પ્રબળ શ્રદ્ધા વિના માત્ર મોઢે બોલાય એટલું જ કે ‘પ્રભુનો માર્ગ આ’ કિન્તુ શ્રદ્ધા અને અનુભવથી જ હૃદયને એનો ઊંડો ભાસ થાય, પ્રકાશ થાય. પ્રભુનો પંચ નિહાળવો છે એટલે કે એને દિલમાં આત્મસાત્ત હસ્તાવી ટેવો છે. અંતરમાંથી ‘અવાજ ઊઠે કે ઉદ્ઘારનો માર્ગ આ જ હોય. આમાં જ સુખ અને શાન્તિ છે,’ એ જાત-અનુભવ વિના શે બને ?

‘કાળલભિ’નો વળી એક અર્થ એ છે કે, વર્તમાનકાળે અહીં ભલે વિચરતા તીર્થકર, કેવળજ્ઞાની, અવહિજ્ઞાની કે ચૌદ પૂર્વના જ્ઞાતા નથી મળતા, ઇતાં જિનાગમ, જિનબિભ, શાંતુંજ્યાદિ સ્થાવર તીર્થ, સુવિહિત આચાર્યાદિ જંગમ તીર્થ, ધર્મના સાત ક્ષેત્ર વગેરે જે મળે છે તે પણ એક ‘લભિ’ છે. એની ઉપાસનાના આધારે પ્રભુના માર્ગનો સાક્ષાત્કાર થઈ શકે છે. અનેક રીતે અનેક સારા આલંબનોની દિલથી સાધના થાય એટલે આત્મામાં સારું સંસ્કરણ થતું આવે છે એને વિરોધી મલિન સંસ્કારોનો ઉચ્છેદ થયા કરે છે. એટલે પ્રભુના માર્ગને અનુભવથી નિહાળવાનું સામર્થ્ય ઊભું થાય છે.

વાત આટલી જ કે ઉપરોક્ત કાળલભિઓથી પ્રભુના પંથને નિહાળવો હોય તો એ લભિઓની યા લભિઓથી સારી રીતે આરાધના કરવાની જરૂર છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૭, તા. ૧૭-૧૦-૧૯૬૮

## ૨૩ મોક્ષમાં શું સુખ ? શું કરવાનું ?

કેટલાકને મન એમ થાય છે કે ‘મોક્ષ માટે મહેનત તો કરીએ, પણ ત્યા જઈને શું કરવાનું ? ત્યા સુખ શું ?’

એમને ખબર નથી કે, ‘કરવાનું શાને કહેવાય ? કરવાનું શાથી હોય ? અને એમાં ગૌરવ શું ?’ કરવાનું ખરેખર તો એ કે જેમાં કોઈની અપેક્ષા ન હોય, જે સ્વાધીન હોય અને જેમાં કોઈ જ ખતરો ન હોય. આવું ‘કરવાનું’ તો મોક્ષમાં આત્માના સ્વભાવભૂત જ્ઞાનથી જગતને જોવાનું ગણાય ને સ્વભાવભૂત સુખને ભોગવવાનું કહેવાય; કેમકે એમાં કોઈ સાધનસામગ્રીની જરૂર જ નથી, અને જેની પાછળ કશું જ નુકસાન નથી. સંસારમાં જે ખાવા-પીવાનું ધંધો-ધાપો ચલાવવાનું, હરવા-ફરવાનું વગેરે ‘કરવાનું’ ગણાય છે, એમાં તો કેટલીય સાધન-સામગ્રીની યાવત્ત સ્વસ્થ શરીર-મનની અપેક્ષા રહે છે. એની ન્યૂનતામાં જીવ દુઃખી થાય છે. તેમજ એવું કરવાનું કર્યા પછી ય કર્મબંધનો, રાગ, શોક, મૃત્યુ, વગેરે કેટલાય ખતરા ઊભા થાય છે. તો એ ‘કરવાનું’ કરવા જેવું શાનું ? એમાં જીવનું ગૌરવ શું ? આવું કરવાનું તો કશું સિદ્ધ નથી માટે મીહું લાગે છે; સિદ્ધ હોય પછી કરવાનું રહે તો એ અકારું લાગે. દા.ત. તૂપ્તિ સિદ્ધ નથી માટે ખાવાનું ગમે; પણ સિદ્ધ થયા પછી તો ખાવાનું અકારું લાગે છે. ધરમાં બેસી રહ્યો આબરૂ લાગવગ વગેરે સિદ્ધ ન હોય તેથી જ કરોડોની સંપત્તિ છતાં ધંધો મીઠો લાગે છે. પરંતુ જો કોઈ રાજીવીપણું યા સામાજિક નેતાપણું વગેરેથી એ સિદ્ધ હોય, તો પછી ધંધો અકારો લાગે છે. તાત્પર્ય સિદ્ધ થયા પછી કરવાનું રહેતું નથી. એટલે મોક્ષમાં ગયે હવે કશું અસિદ્ધ નહિ હોવાથી એ ‘કરવાનું’ માનેલું શું રહે ? અને ન રહે એમાં દુઃખ શું ?

હવે મોક્ષમાં સુખ શું એ વિચારીએ, પહેલું સુખ એ કે ત્યા જન્મ-જરા-મૃત્યુ નહિ, પૂછો; ‘એ તો દુઃખ ટથ્યું પરંતુ એમાં સુખ શું ?’ ઉત્તર આ કે જેમ કોઈ માણસને વારે ઘડીએ ભાડાના ધર વારેવારે બદલવા પડતા હોય, જીર્ણ થયે સમરાવવા પડતા હોય, એમાં જો કોઈ કાયમી અને નવું મકાન મળી જાય, તો એ છૂટકારાનો દમ ખેંચે છે કે ‘હાશ ! હવે ઠરીઠામ બેસવાનું મળ્યું.’ એ સુખાનુભવ છે, એમ વારેવારે જનમવા-મરવાનું ટળે અને મોક્ષમાં ઠરીઠામ બેસવાનું મળે, તો

એ પણ સુખ કેમ નહિ.

આત્માને પુનઃ પુનઃ જન્મ-મરણની અવસ્થા એ તો વિકૃત અવસ્થા છે. અજર અમર દશા એ સુંદર અવસ્થા છે. ‘આ વિચિત્ર વિશ્વની રંગભૂમિ પર વિદૂષક (ભવૈયા) ની જેમ નવનવી ગતિના વેશમાં જનમવું; પુદ્ગલના લોચા લેવા શરીરાદિના ઘાટ બનાવવા એને પોષવાની કારમી વેઠ કરવી, છતાં પાછા ઘસાતા જવું ઘરડા-ખોચર થવું, અને આજાધાર્યા મરી એમાંથી ડીસમીસ થવું.’ એટલે એ શરીર સાથે સંકળાયેલું બધું લુપ્ત ! ત્યાં એ માટેની જીવનભરની મહેનત અને એના ફળ સગવડ બધું જ એળે ! અને એના પાપ બધાં જ માથે ! ફેર નવો જનમ નવા પુદ્ગલના લોચા લઈ નવા શરીરની મહેનત....એ ય અંતે અવશ્ય એળે !- આ બધી વિટંબણાનો મોક્ષમાં કાયમી અંત આવે એ કેટલું મોટું સુખ ! સંસારના બીજા ગ્રાસ તો પછી પણ પરાધીનપણો માત્ર જનમવું પડે એ ય વિવેકીને શરમાવનારું લાગે છે. તો એવી પરાધીનતા અને શરમજનક જન્મનો જ અંત આવે તો મહાસુખ મનાય.

વળી સંસારમાં જે સુખ લાગે છે તે તો કર્મ અને શરીરાદિ સામગ્રીને પરાધીન છે. એટલે જ એ કર્મ ને સામગ્રી વાકાં થતાં ભારે દુઃખમાં શેકાવું પડે છે. મોક્ષમાં કર્મ નથી, શરીરાદિ નથી. તેથી એવા દુઃખમાં પરિણમનારા તકલેદી સુખ નથી. ઉલટું કર્મ અને શરીરાદિથી આત્મામાં જે અનંત અવ્યાબાધ સુખ ઢંકાઈ ગયું હતું તે હવે મોક્ષમાં કર્મ જતાં પ્રગટ થાય છે.

વળી સંસારમાં ભલે સુખનો ભાસ થાય, પરંતુ બીજી ઉંચીનીચી વિષમતાઓ એટલી બધી આવ્યા કરે છે, પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની એવી હાની રહે છે, તેમજ પરના સંબંધે એવી વિભાવદશા ચાલ્યા કરે છે કે, એથી જીવને અનેકાનેક વાર ત્રાણ ત્રાણ પોકારવી પડે છે. તો એવી ભારોભાર મિશ્રિત સુખને ‘સુખ’ કેમ કહેવાય. સુખ તો મોક્ષમાં; કે જ્યાં એવી વિષમતાઓ સ્વરૂપહાની, વિભાવદશા વગેરેનું નામનિશાન નથી, તેથી ‘પરમ આનંદ છે’ આની તુલના આ રીતે કરાય છે.-

જેવી રીતે કોઈને અનેક રોગો થયા હોય એમાંથી થોડાક નાશ પામે તો હજુ બીજા રોગ છતાં પણ એને આનંદનો અનુભવ થાય છે, તો પછી મોક્ષમાં તો સમસ્ત રોગોનો કાયમી અંત છે, એટલે પરમ આનંદ કેમ નહિ ? અથવા કોઈને અનેક શત્રુઓ હોય અને એમાંથી થોડા શત્રુ મટી જાય તો આનંદ થાય છે, તો પછી મોક્ષમાં તો સર્વ શત્રુઓ મટી ગયા, પછી પરમ આનંદ કેમ નહિ ?

અથવા કોઈને અનેક પ્રયોજનોમાંથી અમુક પ્રયોજન સિદ્ધ થતા આનંદ થાય છે, તો પછી મોક્ષ પામતા તો કોઈ પ્રયોજન જ ન રહ્યું એટલે કે સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા, પછી પરમ આનંદ કેમ નહિ ? ધ્યાનમાં રહે કે સંસારમાં ય બંગલા બગીચા માલસામાન વગેરેથી આનંદ નથી લાગતો, પરંતુ એમાંથી જેનું જેનું પ્રયોજન છે, એથી એ પ્રયોજન સરે છે માટે આનંદ લાગે છે, એટલે કે આનંદ પ્રયોજન સરવા લાગવાનો. ત્યારે મોક્ષમાં તો સર્વ પ્રયોજન સરી ગયા. પછી ઉત્કૃષ્ટ, આનંદ કેમ નહિ ?

એમ, અનેક ઈષ વસ્તુમાંથી થોડી પણ ઈષવસ્તુ મળી જતાં આનંદ થાય છે, તો મોક્ષમાં તો બધું જ ઈષ મળી ગયું પછી પરમ આનંદ હોય એમાં નવાઈ નથી. ધ્યાનમાં રહે કે માત્ર લાડી-વાડી-ગાડી મળવાથી આનંદ નથી, પરંતુ જો એ ઈષ લાગ્યા હોય ને મળે ટકે તો જ આનંદનો અનુભવ થાય છે. તેમજ જો એ ઈષ જ ન લાગ્યા હોય તો એ ન મળ્યા છતાં ય આનંદ રહે છે. તો મોક્ષમાં દુન્યવી કોઈ વસ્તુ ઈષ જ નથી, પછી એ ન મળ્યા છતાં પરમ આનંદ રહે એ સહજ છે. કહો કે ત્યાં નાશવંત કશું જ ઈષ નથી માટે જ ત્યાં પરમસુખ છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખમૂત”

વર્ષ-૧૭, અંક-૮, તા. ૨-૧૧-૧૯૬૮

## ૨૪ વીર સંવત् ર૪૮૫ ના પ્રારંભે મંગાળ ભાવના

અપમંગળભર્યા સંસારમાંથી છૂટી પરમ મંગલમય મોક્ષ પામવાની કામના દરેક આસ્તિકની હોય. એ માટે સંસાર જે કારણે ચાલ્યો આવે છે એ કારણોને નાભુદ કરવાથી જ સંસારનો અંત થઈ મોક્ષ થાય. ‘કસાયમૂલો સંસારો, કસાયા વિસયસ્સિસા.’ અર્થાત્ સંસારનું કારણ કોધ-લોભાદિ કખાયો છે, અને એ કખાયો ઈન્દ્રિયના વિષયોને બંધાયેલા છે. શ્રી યોગશાસ્ત્ર કહે છે,-

અયમાત્મૈવ સંસારો કષાયેન્દ્રિય નિર્જિતઃ ।

તમેવ તદ્વિજેતારં મોક્ષમાહુર્મનીષિણઃ ॥

અર્થાત્ કખાયો અને ઈન્દ્રિયો (ઇન્દ્રિય વિષયો) થી જિતાયેલો આ આત્મા જ સંસાર છે, ને એને જીતનાર આ આત્મા જ મોક્ષ છે, એમાંય ઈન્દ્રિયના વિષયો અંગેના રાગ લોભ કોધ વગેરે કખાય બંધ કર્યા એટલે પછી એ વિષયો અડિંચિત્કર

બની મોક્ષ થાય છે. તેથી કહેવાય છે, ‘કષાયમુક્તિ કિલ મુક્તિરેવ’ કષાયોથી છૂટકારો એ મોક્ષ જ છે. કષાયના કારણે સંસાર; કષાયત્યાગે મોક્ષ

અવિનાશી આત્માને માનનારો માણસ નાશવંત-પદાર્થોના અંગે રાગદ્રેષાદિ કષાયો કરી કરી સંસારમાં પરાધીન, નિરાધાર અને દુઃખગ્રસ્ત સ્થિતિમાં ભટક્યા કરવાનું પસંદ ન જ કરે. એ તો આ પેંધી ગયેલા કષાયોને ફગાવી દઈ મોક્ષમાં જઈ ઠરવાનું જ ચાહે. છતાં એ કષાયોને ફગાવી દેવાનું શે બને, એમ લાગે. પરંતુ જીવનમાં જો ઉદાસીનતા એક જ સિદ્ધ થઈ જાય, તો પછી એ કષાયોને ઉઠવાની જગાજ નથી રહેતી; અને એ રીતે મોક્ષ થાય છે, તેથી એમ કહેવાય કે એક ઉદાસીનતા માનાથી મોક્ષ થાય. ઉપાધ્યાયજી મહારાજે ગાયું કે,

‘દેખિયે માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે;  
તેહ આશ છોડતાં ચાલીએ, પામીએ જિમ પરમ ધામ રે.’

મોક્ષ નગરીએ જવાનો માર્ગ ‘ઉદાસીન ભાવ’ એને બરાબર પકડી રાખીને જીવન જીવાય તો પરમ ધામ મોક્ષ-આવાસે પહોંચી જીવાય.

‘ઉદાસીન ભાવ’ એટલે જગતના જડ કે ચેતન પદાર્થો અને એના પર્યાયો (અવસ્થાઓ) પ્રત્યેથી ઊકી ગયેલું મન, તટસ્થ, મધ્યસ્થ, અનાસક્ત હૃદય. આવું દિલ બનાવવા માટે એની પ્રત્યે રાગદ્રેષ વિનાનું દિલ રાખવું પડે.

જવ બહારના પદાર્થોમાં ‘આ અનુકૂળ છે; સારું છે, સુખાકારી છે.’ આ તો પ્રતિકૂળ છે, ખરાબ છે, દુઃખદાયી છે, એવી કલ્યાન કરી કરી એની અસર લે છે, એમા રાગ કે દ્રેષ કરે છે, એની ખાતર કોષ અભિમાન માયા કે લોભ સેવે છે, તેથી જ કર્મથી બંધાય છે અને સંસારમાં ભમે છે.’

આત્મા જાણે એક વસ્ત્ર, અને રાગદ્રેષ એ જાણે તેલની ચિકાશ. કપડા પર ચિકાશ હોય એટલે કુદરતી રીતે વાતાવરણની રજ એના પર ચોંટ્યા જ કરવાની. એમ આત્મા પર રાગ-દ્રેષ, કામકોષ, મોહ-મદ-માયા વગેરે ચિકાશ હોય ત્યાં સુધી આત્મા પર કર્મરજ ચોંટ્યા જ કરવાની; ને એ બંધાયેલા કર્મના ઉદ્યના પરિણામે એને સંસારની ચાર ગતિઓમાંની તે તે ગતિમાં પુરાયા રહેવું પડવાનું. મોટા ઈન્દ્રને પણ દેવગતિના કર્મ ભોગવાઈ જતાં ને બાંધી મુકેલા મનુષ્ય-ગતિયોગ્ય કર્મના ઉદ્ય થતાં, દેવપણામાંથી ચ્યાવી માનવ અવતારમાં પુરાવું પડે છે. એમ ન થવા દેવા માટે એનું કાંઈ જ ચાલતું નથી. કર્મ છે ત્યાં સુધી સંસાર છે, અને તેવા તેવા કર્મ ઉદ્ય પામતાં તેવો તેવો સંસાર સરજી આપે છે.

આ થવાનું મૂળ કારણ રાગ દ્રેષાદિભાવો છે, અને એ ઉભા થાય છે જગતના પદાર્થ પ્રત્યે કરતી ‘ઈષ-અનિષ્ટ’ ની કલ્યાનમાંથી. મન ત્યાં ચોંટે છે, તેથી એની અસર લે છે, ને રાગાદિમાં પડે છે. જો એનાથી ઉદાસીન બને, વિમુખ થઈ જાય, એની પ્રત્યે નફરત રાખે, એની ‘આ ઈષ’ ‘આ અનિષ્ટ’ એવી પરવા ચિંતા મુકી હે તો પછી એના પર રાગ દ્રેષ, કામ, કોષ વગેરે કશું કરવાનું રહે નહિ. શું મિત્ર કે શું શત્રુ, શું બંગલા કે શું શુંપણું, શું માન કે શું અપમાન. અનું લેખું જ ન માંડે, એના પ્રત્યે મનને બેપરવા બનાવે, તો પછી એની ખાતર કોષ, લોભ, મદ-માયા, રાગદ્રેષ વગેરે કોઈ કષાય કરવાની જરૂર નથી. કોઈ ઉકળાટ વિહૂળતા વ્યાકુળતા એ ન કરે.

સ્વાત્માથી ‘પર’ વસ્તુની યાને બાધની અસર લેવા જતાં, ને એમાં મન લગાડવા જતાં જવ રાગ દ્રેષ વગેરે ભાવથી પીડાય છે. જો મન ન લગાડાય, ઉદાસીન અલિખ બેપરવા બનાય, એમ વિચારાય કે ‘હું અવિનાશી શાશ્વત સનાતન, એવા મારે આ બહારના અનિત્ય સંયોગોમાં શું મુઝાવું ? શી એની અસરો લેવી ? એક દિ’ આ ઉડી જવાના છે, પાછા નવા સંયોગ નવી રામાયણ ઉભી થવાની છે, પછી એના પર વળી નવી આસક્તિ, નવા રાગ દ્રેષ મોહ... આ બધી વેઠ શી ?’ એમ કરી એમાં ભળવાનું જ ન કરાય, તો રાગાદિ કષાયો કરવાના રહે નહિ.

જગતના પદાર્થો કાળ, કર્મ, સ્વભાવ ભવિતવ્યતા વગેરે કારણોના હિસાબે ચાલે છે, ઉત્પન્ન થાય, પરિવર્તન પામે, નષ્ટ થાય છે. એ ‘પર’ વસ્તુ છે, બાધ છે, આત્માથી અલગ છે. સંસારમાં જીવને રહેવું પડે ત્યાં સુધી એના સંબંધ રહે; છતાં એમાં કેટલાય પરિવર્તન થયા કરે છે. જવ ત્યાં સમજી મૂકે કે, ‘એ એના કારણોને આધીન રહીને ચાલવાના, પરિવર્તન પામવાના, ને ઉડી ય જવાના માટે એના પ્રત્યે હૃદયથી ઉદાસીન રહેવાનું; એનાથી જરાય લહેવવાનું નહિ, પછી એની ખાતર કોઈ કષાય કોઈ રાગ દ્રેષ વગેરે ઉકળાટ કરવાના નહિ શાંત-પ્રશાંત-ઉપશાંત રહેવાનું.’

વિ.સ. ૨૪૮૫ ના નવા વર્ષ માટે આ એક ઉદાસીન ભાવની કામના રાખીએ, નિરંતર એની ભાવના કરીએ, તો વર્તમાન વિષમ ઘણાં ઘણાં આર્તધ્યાન-સંતાપ-અશાંતિથી બચીએ.

## ૨૫ દાનધર્મ પહેલો કેમ ?

ધર્મના ચાર પ્રકાર છે,-દાન, શીલ, તપ અને ભાવ. આને આદ્ય વંજનના કુમથી બોલીએ તો તપ દાન, ભાવ અને શીલ એમ બોલાવું જોઈએ; તો એમ તપને પહેલો ન મૂક્તાં દાનને કેમ પહેલું મૂક્યું ? એના આ હેતુ છે,-

(૧) દાનથી ઉદારતા વધે છે, અને ઉદાર મન કુદ્રતાને અટકાવે છે. કુદ્રતા એ ધર્મનો પહેલો અવરોધક છે. માટે શ્રાવક ધર્મની યોગ્યતાના ૨૧ ગુણોમાં અકુદ્રતાશુશ્શે પહેલો મૂક્યો છે. કુદ્રત ચિત્તમાં ધર્મ જેવી ઉચ્ચ કોટિની વસ્તુ ઊગી શકે નહિ. કુદ્રત માણસ શીલ પાળશે. વ્રત-નિયમ લેશે, તપસ્યા કરશે, પણ ચિત્તની સંકુચિતતાને લીધે પોતાના મનમાં બીજાને સમાવી શકશે નહિ, સક્રિય મૈત્રી કરુણા પ્રમોદભાવ રાખી નહિ શકે. ત્યારે ‘વચનાદવિરુદ્ધમનુષાનં યથોદિતમ् । મૈત્રાદિભાવ-સંયુક્તં તર્દ્ધર્મ ઈતિ કીર્તયે ॥’ એ વ્યાખ્યા મુજબ મૈત્રી આદિ ભાવોથી સંપન્ન અનુષ્ઠાન જ ધર્મ બને છે. તો એના વિના શીલ તપ એ ધર્મ બને જ કેવી રીતે ? મૈત્રી કરુણા ખરેખર લાવવા માટે અવસરોચિત શક્ય દાન જરૂરી છે. એ જો નથી દેવું, તો ચિત્ત પણ કૃપણ અને ધનપ્રેમી રહ્યી જીવપ્રેમી નહિ બની શકે.

(૨) સંસાર ઈમારતના બે મૂળ સંભ, તૃષ્ણા અને અહંત્વ. તૃષ્ણાને કાપવા માટે પ્રારંભમાં દાન ધર્મ છે અને આગળ ઉપર સર્વત્યાગનો ધર્મ છે.

પ્ર.- શું શીલ અને તપથી તૃષ્ણા ન કાપાય ?

૩.- કાપાય. વિષયો અને આહારની તૃષ્ણા કપાતી આવે. પરંતુ જીવને મૂળ તૃષ્ણા તો ધનમાલની રહે છે. એ કપાયા વિના એ આગળ શી રીતે વધી શકે ? દાનધર્મથી એ તૃષ્ણા કપાય છે. જો દાનની પરવા નહિ કરે, તો ધનની અને માલની મૂર્છા જોરદાર બની રહેવાની; તેથી ભલે શીલ-તપ કરશે, છતાં ધનમાલની મૂર્છા પર શીલ-તપથી સ્વર્ગાદિના વૈભવની તૃષ્ણા રહેવાની, મોક્ષની ઈચ્છા નહિ. એમ પછી સંસાર અસ્થિલિત ચાલવાનો. માટે એ કાપવા દાન ધર્મ પહેલો જરૂરી છે.

(૩) દાનથી પરોપકાર પરાર્થકરણ થાય છે. અને પરાર્થકરણ- ‘પરત્થકરણા’ ને ‘જ્યવીયરાય’ સૂત્રમાં પહેલું જરૂરી ગણ્યું, તે પછી જ ‘સુહ ગુરુ જોગો’, શુભ

ગુરુનો યોગ અને તદ્વચન સેવા કર્યા. પરાર્થવૃત્તિ પરનું ભલું કરવાની મનોવૃત્તિ વિના ગુરુની સેવા ય શું કરવાનો ? અને એમના એવા પરાર્થકરણના ઉપદેશ પણ શું પાળવાનો ? દાનના યોગે પરાર્થકરણ થાય, તો એ ગુણ ઉપર ગુરુનો યોગ ફળે, ને એમનો ઉપદેશ જીવાય.

(૪) દાનની પરવા નહિ, ઈચ્છા જ નહિ, એટલે ધન-માલ પર ગાઢ રાગ, અનંતાનુભંધી રાગ રહેવાનો; અને એ રાગ સમ્યકૃતવનો ધાતક છે. તેથી એની હ્યાતીમાં સમ્યકૃત ન આવી શકે. ‘સમકિત વિષ સંસારમાં ભમીયો કાળ અનંત’ એ શાસ્ત્રવચન અનુસાર સમ્યકૃતવના અભાવે ભવભ્રમણ શે મીટે ? ને ધનમાલના એવા રાગને લીધે સમ્યકૃત ક્યાંથી આવે ? દાન એ રાગને તોડે છે.

(૫) ‘સંસારમૂલ આરંભા, આરંભમૂલં પરિગણહો’ અર્થાત્ સંસારનું મૂળ જીવધાતમય આરંભ-સમારંભ છે, અને એના મૂળમાં પરિગ્રહ છે. ધનમાલ છે, મિયા મસાલાના જોરે ઝૂદે, એમ પૈસાના જોર પર પાપારંભો થાય છે. પૈસાની પાછળ અઠાર પાપસ્થાનક સેવાય છે. જીવનમાં દાન નથી તો પૈસાની ગાઢ મમતા રહેવાની. એ મમતામાં પછી પરમાત્મા, ગુરુ અને ધર્મ પણ નીચે રહેવાના. દહેરે જશે, દર્શન કરશે, કહેશે ‘પ્રભુ તમે અમને વહાલા છો,’ પણ દિલમાં અંકાયું રહેશે કે ‘છતાં પ્રભુ કરતા પૈસા મને વધુ વહાલા છે’ તેથી જ પૈસા ખાતર સારા દ્રવ્યોથી પ્રભુભક્તિ કરવાનું જતું કરશે, પણ પ્રભુભક્તિ ખાતર પૈસા નહિ જતા કરે. એવું ગુરુ અને ધર્મને પૈસા ખાતર જતા કરવાનો. પૈસાના આવા ગોળારા રાગમાં અંધ બનેલો પાપસ્થાનકો સેવવામાં શું બાકી રાખવાનો ? પૈસા એ પર ચીજ છે, એની ગાઢ પ્રીત રાખનારો જીવ પ્રભુ સાથે પ્રીત ક્યાંથી જોડી શકવાનો ? ‘પ્રીત અનાદિની પરથકી જે તોડે એ જોડે...’ અનાદિની પરપ્રીતિ તોડે, તેજ પ્રભુ સાથે પ્રીત જોડે. આ પરપ્રીતમાં પૈસાની પ્રીતિ પહેલી તોડવી જોઈએ છે, ને એ દાનથી તૂટે. ‘ચમડી તૂટે પણ દમડી ન છૂટે.’ કેટલાય મરતા માણસોને મરણ વખતે પણ પૈસા દાનમાં ખરચી નાખવાનું નથી સૂઝતું એટલો બધો રાગ પૈસા કરાવે છે. માટે પરમાં આગેવાન પૈસા છે. એના પરનો રાગ પહેલો તોડવો જોઈએ; માટે જ દાન પહેલું જોઈએ.

## ૨૬ વીતરાગના દર્શન ભક્તિભાવથી કેમ થાય ?

શ્રી કલ્યાણમંદિર સ્તોત્રમાં કવિ પ્રભુને સ્તવે છે.-

‘આકર્ણિતોऽપि મહિતોऽપિ નિરીક્ષિતોऽપિ નૂં ન ચેતસિ મયા વિધૃતોऽપિ ભક્ત્યા । જાતોऽસ્મિ તેન જનબાન્ધવ ! દુઃખપાત્રં, યસ્માત् ક્રિયા: પ્રતિફળન્તિ ન ભાવશૂન્યા: ॥’

અર્થાત્ ‘હે જગજીવબદું ! મેં તને સાંભળ્યા પૂજ્યા અને જોયા છતાં પણ મારા ચિત્તમાં, ભક્તિથી સ્થાપિત ન કર્યો, તેથી હું દુઃખોનું ભાજન બન્યો છું; કેમકે ભાવ વિહોણી કિયાઓ ફળતી નથી.’

અહીં આ વિચારવાનું છે કે પ્રભુને સાંભળવા-જોવા-પૂજવામાં એવું તે શું ભક્તિથી સ્થાપિત કરવાનું છે કે જેથી એ કિયા દુઃખનિવારક ભાવક્રિયા બને ?

સામાન્ય રીતે જેને એમ લાગે છે કે ‘મને ધર્મ ગમે છે, પ્રભુ ગમે છે,’ એ પ્રભુને સાંભળતા અર્થાત્ સાક્ષાત્ સમવસરણમાં યા અન્યના વ્યાખ્યાન-વિવેચનમાં જિનવાણી સાંભળતા, અથવા અરિહંત પ્રભુનું વર્ણન સાંભળતી વખતે એમ માને છે કે ‘હું ભક્તિભાવથી જ સાંભળું છું.’ એમ દર્શન-પૂજન કરતા માને છે કે ભક્તિભાવથી હું દર્શન-પૂજા કરું છું. એવો બચાવ પણ કરવામાં આવે છે કે ‘જો પ્રભુ પ્રત્યે ભક્તિભાવ ન હોત તો શું કામ દર્શન-પૂજન કરવા જાત ? શું કામ સાંભળત ?’

ત્યારે પહેલું તો આ જોવાનું છે કે એ દર્શનાદિ કિયાઓ શું ખરેખર ભક્તિભાવથી થાય છે ? કે એવા ભાવથી કે ‘મારે બાધા છે કે દર્શન વિના ખાવું-પીવું નહિ. માટે ચાલ દર્શન કરી આવું, એટલે ખાવાનું ખુલ્લું થાય, દાતણ થાય ?’ અથવા ‘દર્શનનો નિયમ પણાઈ જાય. નિયમ ભાંગે નહિ. પ્રાયશ્ચિત ન લેવું પડે !’ જો આવું હોય તો એમાં તો રોટલા પરના બહુમાનથી કે નિયમપાલનના રાગથી એ દર્શને દોડ્યાં, અને દર્શન કરી બહાર નીકળતાં છૂટકારાનો દમ બેંચ્યો, કિન્તુ ત્યાં નિર્ભેણ પ્રભુક્તિનો ભાવ ક્યાં આવ્યો ?

પ્રભુક્તિનો ભાવ તો ત્યાં ગણાય કે જો મને એમ થાય કે, ‘અરે ! મારે દિવસ અને રાત મોહંધોના દર્શનમાં ગયા ! એમ મોહ નહિ જાય. લાવ વીતરાગના દર્શન કરું.’ અથવા વીતરાગ જેવા વહાલા હિતેખી ક્યાં મળે ? વીતરાગ પ્રભુ કેવા

દયાળુ ! કેવા અનંત ગુણસંપન્ન ! તારણહાર પ્રભુ ! મારે તું જ એક શરણ છે, એક આધાર છે’....અથવા ‘સવાર પડી ને કેવી કુટિલ આહારસંજ્ઞા ! લાવ અણાહારી પદ પામેલા પ્રભુના દર્શન કરું અને અણાહારની પ્રેરણા લઉં,’ ‘યા મનને એમ થાય કે જગતમાં તારાથી વધીને તો શું પણ તારા સમાન પણ જોવા-ચિંતવવા લાયક ચીજ નહિ. બસ, આવો ભાવ લઈ પ્રભુના દર્શન-સ્મરણાદિ કરાય ત્યાં ભક્તિભાવ ગણાય, ભક્તિથી પ્રભુને ચિત્તમાં ધર્યા ગણાય.

વીતરાગ પ્રભુને સાંભળવા પૂજવા કે જોવાની કિયા ભક્તિભાવથી યુક્ત બનાવવા માટે મુખ્ય જરૂરી આ કે એમની આગળ બહારનું બીજું કાંઈ જ સાંભળવા-જોવા-ચિંતવવા લાયક લાગે નહિ, બીજાનું મહત્વ જ નહિ.

પ્ર.- પણ અનાદિના જે બાધની સાથે સંબંધ રહ્યો છે, અનંતાનંત કાળથી જે બહારનું જોતા-સાંભળતા-ચિંતવતા આવ્યા છીએ એ કેમ હવે ભૂલાય ?

૩.- એને ભૂલાવા માટે આ વસ્તુ એક ખાસ લક્ષ્યમાં રાખવા લાયક છે કે બહારનું બધું ય આપણા આત્મા સાથે કશો સંબંધ ધરાવતું નથી; ત્યારે વીતરાગ પ્રભુને અને આપણે ગાઢ સંબંધ છે, કેમકે આપણા આત્માને પરાકળાએ એમના જેવા થવાનું છે, એમના જેવી જ વીતરાગદશાએ પહોંચવાનું છે, કહો, વીતરાગ એ આપણું જ શુદ્ધ સ્વરૂપ છે.

એ સ્વરૂપ પ્રગટ કરવાનું ધ્યાન નથી, ત્યાં સુધી આપણે બહારની વિટંબણા માથે લઈ લઈને દીન હુભિયારા અને નિરાધાર થઈએ છીએ. પૈસા પરિવાર વિષયો અનુકૂળતા યાવત્તું આપણી કાયા, એ બધું બહારનું છે. એના જ કારણે દુઃખી થઈએ છીએ. એના કોઈ જ વિકાસમાં આપણા આત્માને ગુણો કે શુદ્ધ સ્વરૂપની દાણિએ વિકાસ નથી, ઉન્નતિ નથી; ઊલટું રાગ-દ્રેપ-કામકોધ વગેરે વધીને દોષ વિકાસ અને અશુદ્ધ વિકાસ થાય છે, અશુભ કર્મના લેપ વધે છે.

ત્યારે વીતરાગ પ્રભુના દર્શન-સ્મરણ-ચિંતન, પૂજન-વંદન-ભજન વગેરે દ્વારા એમનું આલંબન પકડવામાં ગુણવિકાસ અને અધિકાધિક વિશુદ્ધિ થતી આવે છે; જેથી આગળ વધીને એ આલંબનમાં સર્વેસર્વ તન્મય થઈ જતાં અનાસંગ યોગમાં ચરી જઈ સ્વયં વીતરાગ બનાય છે. આ હિસાબે આપણે સાચો સંબંધ ઘનિષ્ઠ સંબંધ વીતરાગ સાથે જ છે.

આ બધું જે ધ્યાનમાં ઊતરે તો પછી સહેજે બહારનું ભૂલાય. બહારનું સાંભળવા-જોવા-ચિંતવવા પર નફરત છૂટે, ઘૂણા થાય, અને વીતરાગને જોવા-સાંભળતા-ચિંતવવાનું એ ગોર્જારી બહારની કોઈ જ વસ્તુની મહત્ત્વા-લાલચ-લાલસા ન રાખીને કે એનું કોઈ જ ધ્યાન ન રાખીને થાય. બાધની આમ લપ છૂટીને

વીતરાગના જે શ્રવણ-દર્શન-પૂજન થાય એ ઉત્તમ કોટિના ભક્તિભાવથી થાય; સાગરમાં નદી ભળી જાય એમ વીતરાગમાં આપણો આત્મા આપણું હૃદય આપણું મન ભળી જઈને એમનું શ્રવણ વગેરે થાય.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૧૧, તા. ૨૩-૧૧-૧૯૬૮

## ૨૭ ભવપ્રવાહ કેમ સતત ચાલુ ? એ કેમ સુકાય ?

ભવસ્થિતિ એટલે સંસારમાં ભ્રમણ કરવાનો કાળ. એ અપકવ એટલે હજુ મય્યાદિત થયેલો નહિ, ઘટાડો પામતો નહિ, તેથી ભવપરંપરા ચાલ્યા જ કરે. અર્થાત્ એકેક ભવ એવો જીવાતો જાય કે જે આગળ આગળ નવા નવા ભવ અને ભવપ્રવાહ નક્કી કરતો જાય. ત્યારે ભવસ્થિતિ પાકેલી અનું નામ કે હવે નવી ભવપરંપરા ન વધે.

અહીં સવાલ બે છે કે,

(૧) ભવસ્થિતિ અપકવ, અનિયત, અમય્યાદિત ઊભી રહેવાનું શાથી બને છે ? એવા કયા તત્ત્વ છે કે જે ભવસ્થિતિને લાંબી લહેરાયા કરે છે ?

(૨) તેમ એવા કયા ઉપાય હોય કે જે આ ભવવર્ધક તત્ત્વોને નરમ પાડી હો ?

આ બે સવાલ એવા છે કે એના સમાધાન જ્ઞાનવા મળો, તો અંતરાત્મામાં એક ભાવ-પ્રકાશનો પુંજ રેલાય, હૃદયમા એક નવીન જ ઉત્સાહ ઊભો થાય. અને મન ભવવર્ધક તત્ત્વોને ડાખી ભવોચ્છેદક ઉપાયો આદરવા સુસજ્જ થઈ જાય. માટે અહીં એના પર વિચાર કરીએ.

ભવસ્થિતિને અપકવ અનિયત અમય્યાદિત રાખવાના યાને એક ભવમાંથી નવી ભવપરંપરા સર્જવાનાં કારણ ત્રણ છે,-

(૧) ‘હું’ પદ અહેતુક અને આપમતિના જોરે આત્માનો સરાસર ઝ્યાલ ભૂલી જડના જ આસંગી બન્યા રહેવું. કાયાને જ ‘હું’ માની વાણી-વિચાર-વર્તાવ.

(૨) જીવનમાં રાગદ્રોષ, તૃષ્ણા આદિ દુર્ગુણો અને આરંભ-વિષય-પરિગ્રહાદિ દુષ્કૃત્યો તરફ જરાય સૂગ ન થવો, એનો સહેજ પણ અરેકારો સંતાપ પશ્ચાત્તાપ ન થવો, તેથી એ રાગાદિનું સેવન હોંશ-હોણિયારી સાથે નિર્ભાક, નિર્વિચાર, હૃદયે થવું. એટલે જ એ ખૂબ જ સેવાયા કરે.

(૩) વેરાગ્ય, પાપભય, દયા, આદિ સદ્ગુણો અને દાનાદિ સત્કૃત્યો તરફ સહેજ પ્રેમ નહિ, આકર્ષણ નહિ, પણ અભાવ થવો, અસુચિ રહેવી. એની કોઈ વાત કરે તે ન ગમે.

ટૂંકમાં અહેતુક, વિષયતૃષ્ણા અને ગુણદ્રોષ ભવમાં રાખનારાં ભવવર્ધક તત્ત્વો છે. જગતમાં દેખાતી અગણિત જીવરાશિમાં જોઈએ તો આ સારી રીતે કામ કરતા દેખાય છે. તેથી જ એ જીવો ભવમાં ભ્રમણ કર્યા કરે છે. નહિતર એમને ભટકવાનું બીજું શું કારણ છે ? લગભગ આખું જગત એક બાજુ આ કર્યા કરે છે અને બીજી બાજુ ભવમાં ભસ્યા કરે છે, એ બતાવી રહ્યું છે કે અમય્યાદિત ભવભ્રમણ યાને નિરંતર ચાલુ ભવપ્રવાહ આના લીધે જ છે; ભવપ્રવાહ આથી જ સુકાવા આવતો નથી. પરંતુ હવે હાથમાં વિશિષ્ટ બુદ્ધિ શક્તિવાળો ઉત્તમ મનુષ્યભવ છે. તો ભવવર્ધક એ ત્રણ તત્ત્વોને સદ્ગુણોથી ડામવા જોઈએ. આ આયદિશનો માનવભવ એ માટે જ છે, અનાયદિશમાં જન્મ્યા હોત કે તિર્યંચનો અવતાર હોત તો આમાંનું શું કરી શકત ?

સદ્ગુણોમાં પ્રારંભિક ત્રણ ઉપાયો કુમશઃ આ પ્રકારે,-

(૧) અહેતુકના નાશ માટે અરિહંત-સિદ્ધ-સાધુ અને સર્વજ્ઞકથિત સંયમ-ક્ષમાદિ ધર્મનું શરણું સ્વીકારવાનું. મન એમને એમ કાહા કરે કે ‘પ્રભુ ! હું અખુલ છું. કર્મપીઠિત છું. પરલોક અંગે પરવશ છું. એમાં કોઈનું મને રક્ષણ નથી. માત્ર એક તમારું મારે શરણ છે, રક્ષણ છે. મારી કોઈ બુદ્ધિ કામ કરતી નથી. મારા હિતનું મને ભાન નથી. હું તમારે શરણે છું. તમે જ એક મારે આધાર છો.’ ‘ગદ્ગદ ભાવે આ શરણું વારે વારે યાદ કરવાથી અહેતુક, આપમતિ, સ્વોત્કર્ષ (ગર્વ ખુમારી) વગેરે મંદ પડતા આવે છે.’

(૨) વિષયતૃષ્ણા અને હિંસા-અસચ્યાદિ દુષ્કૃત્યોને ઓછા કરવા માટે પહેલા પગથિયે એની ભારોભાર નિંદા ગર્હા સંતાપ અને ઘૃણા કરતા રહેવું જરૂરી છે. મનને એમ થાય કે દુન્યવી દુશ્મન તો મારું કાંઈ જ બગાડતા નથી. પરંતુ આ અંતરના શત્રુઓ મારા આત્મહિતને બહુ બગાડે છે. લાખ રૂપિયાના માનવ ભવની રાખ એ કરે છે. કેવા ગોળારા એ દોષ-દુષ્કૃત્યો ! કેવો હું અધમ પાપી કે એને મેં સેવ્યા !’ આ તિરસ્કાર જુગુપ્સા જન્માત્તરોમાં પણ સેવેલા દોષ દુષ્કૃત્યો પ્રત્યે કરવાની ને ‘મિથ્યામિ દુક્કં’ યાને ‘મારા દુષ્કૃત્ય મિથ્યા થાઓ’ એ ભાવ પણ દિલમાં લાવવાનો. આત્માના શુદ્ધ સ્વભાવની એ વસ્તુ નથી. એ તો પરભાવ છે. એની ગર્હ નિંદા પશ્ચાત્તાપ બહુ રાખવાના. આનું પરિણામ એ આવશે કે હવે એ

દોષ-કુષ્ટ્યો સેવવા કરવાનો રસ ઉડી જશે, ને એથી એનાં આચરણ મંદ પડી જશે.

(૩) ત્યારે ગુણોની અરુચિ સૂગ બેપરવાઈ ટાળવા માટે અરિહતં આદિ મહાન પુરુષોનાં સુકૃતો સદ્ગુણોની ખૂબ ખૂબ અનુમોદના કરવાની. ચિંતવવાનું કે એ મહાપુરુષોએ પોતે સમજને જ એ સુકૃતો અને સદ્ગુણો સેવ્યા હશે. તો મારે એના પર અભાવ અરુચિ કેમ કરાય ? ધન્ય અનેમના એ સદ્ગુણો ને સુકૃતો ! ધન્ય અનું ગુણસુવાસભર્યુ જીવન ! આમ વારંવાર અનુમોદન કરવાથી સુકૃત-સદ્ગુણો પ્રત્યેનો અભાવ દૂર થઈ રુચિ આકર્ષણ પ્રશંસા અને અભિલાષા જાગે છે.

ભવસ્થિતિ પકવવાના આ ત્રણ મૌલિક ઉપાય છે. એને રોજ ત્રિકણ સેવવાના છે, અને વધારામાં જ્યારે જ્યારે ચિત્ત રાગાદિના સંકલેશમાં પડે ત્યારે વારંવાર સેવવાના છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૧૨, તા. ૩૦-૧૧-૧૯૬૮

## ૨૮ અનંતના પ્રવાસે

માનવ દિલ અતિ નાજુક અને ભાવુક છે. ‘નાજુક’ એટલે સહેજમાં ટકરાઈ જાય એવું. ‘ભાવુક’ એટલે નિમિત્તથી સહેજે ભાવિત થઈ જાય એવું.

હમણાં દિલમાં સારો કોઈ દયા, પરોપકાર વગેરેનો ભાવ ઊભો થયો, અને તરત જ પાછો સ્વાર્થ-સ્વમાન કે દ્રેષ્ણનો ભાવ જાગતા એ તૂટે દા.ત. સામે કોઈ દુઃખી આવ્યો એનું દુઃખ સાંભળી દયા ઊભી થઈ, પછી મનને એમ થાય કે આને કંઈક આપું, આપણું બહાર સારું દેખાશે. એમ સ્વાર્થ-સંમાન અથવા એ દુઃખી જીવ જરાક ઉતાવળી બોલ્યો ત્યાં તરત જ એના પર રોષ થઈ આવે. આવા તો કેટલાય શુભ ભાવ સહેજ સહેજમાં ટકરાઈ જાય છે. પ્રભુદર્શને હમણા આલદાદ અને તરત દર્શનની આડે વચ્ચમાં કોઈ આવતા દ્રેષ્ણ, આ દિલની નાજુકતા છે. એમાં ભાવોના કેટલા બધા પદ્ધતા ?

ત્યારે ભાવુકતા પણ એવી છે કે તેવા તેવા નિમિત્ત મળતા દિલ અનાથી તરત ભાવિત થઈ જાય છે. અરે ! મનમાં કશું યાદ આવતાં કે ચિંતવતા ય મન તરત એની અસર લઈ લે છે. જગતની વચ્ચમાં રહેવાનું છે. એટલે નિમિતો તો ભરચુક ભર્યી મળવાના છે, ને વિચારમાં પણ આવવાના છે, એટલે મનને એની અસરો લેવાનું કેટલું બધું ?

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૫૮

દિલની આમ નાજુકતા અને ભાવુકતાને લીધે પાછી ખૂબી તો એ છે કે એ જે ભાવો કરે છે એ બધા ક્ષાળજીવી ચંચળ અને નાશવંત. કોઈ એક ચીજ પર રાગ કર્યો તો તે ટકાવી શકતો નથી, કે દ્રેષ્ણ, અરુચિ કરી તો તે ય ટકાવી શકતો નથી. અંતે જઈને મરતા, ચીજ જ વિખૂટી પડે છે, પછી જન્માંતરમાં એનું સ્મરણે ય નથી તો એના પ્રત્યે કરેલા રાગ કે દ્રેષ્ણ ક્યાં ઊભા રહેવાના ? એમ કોષ કરે, અભિમાન કરે, લોભ કરે, એ બધાય ભાવ પલટાયા કરે છે. ત્યારે આ વિચારવાનું છે કે જો વસ્તુના સંયોગ નાશવંત છે, ને પોતાની પરિસ્થિતિ પલટાતી છે, તો એ વસ્તુઓ પ્રત્યેના કરેલા ભાવ પણ સ્થાયી નહિ રહે. વસ્તુના નાશો કે પરિસ્થિતિ પલટાયે ભાવનું પરિવર્તન થવાનું. લાહુના જમણ પર ભૂખ્યો જમવા બેસે ત્યાં પહેલા લાંઠું પર ભારે રાગ, પણ પછી પેટ ભરતા કે મોં ભાગી જતાં એના જ ઉપર અરુચિ દ્રેષ્ણ થાય છે. જીવનમાં આવા તો કેટલાય રાગાદિ ભાવો પલટાતા ચાલે છે. એવા નાશવંત યાને સાન્ત (અન્તવાળા) ભાવોમાં જીવ અનંતાનંત કાળથી પ્રવાસ કરતો આવ્યો છે, અને એથી જ સંસારની ચારે ગતિમાં જન્મ-મરણાદિ પારાવાર વિટંબણા ભોગવતો રહ્યો છે, ત્યારે આનો અંત ક્યારે ?

સ્પષ્ટ વાત છે કે ‘સાન્તના પ્રવાસ મૂકી અનંતના પ્રવાસે ચલાય તો ભવના ભ્રમણ મીટે. એમાં અનંતના પ્રવાસે એટલે જે ભાવો સ્થાયી છે, પલટાતા નથી, એવા ક્ષમાદિ ભાવોમાં વિહરવું તે.’

ક્ષમા-નમ્રતા, મૃદુતા-સરળતા-નિસ્પૃહતા, મૈત્રી-પ્રમોદ-કરુણા-માધ્યર્થ્ય, વૈરાગ્ય-ઈન્દ્રિયદમન-સમતા, અહિસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય વગેરે ભાવો એવા છે કે જો એને મજબૂત પકડ્યા, તો પછી એને નાશપામવાના કે પલટાવાને કોઈ કારણ નથી. કોઈના પર કોષ ઊભો કર્યો તો તે કાળ-સંયોગ-સ્થિતિ વગેરે પલટાતા મોળો પડી જાય છે, પરંતુ જો ક્ષમા મૈત્રી રાખી તો તેને પલટાવાની જરૂર નથી. એમ વસ્તુ પર રાગ કરેલો કાળાંતરે પલટાવાનો, પરંતુ જો વૈરાગ્ય જ રાખ્યો તો એને પલટાવાને કારણ નથી. ઈર્ધા અભિમાન વખત જતાં મૂકવા પડે છે; છેવટે અંત:કાળે એ મૂકાઈ ગરિબી સ્થિતિ બને છે; પરંતુ પ્રમોદ ગુણાનુરાગ નમ્રભાવ, વગેરેને જો પકડી રાખીએ તો મૂકી દેવાની જરૂર નથી. આ ક્ષમાદિ શુભ ભાવો વિકાસ પામતા પામતાં અનંત અક્ષય સ્વરૂપે બની જાય છે. ત્યાં આત્મા વીતરાગ થઈ કેવળજ્ઞાન પામી મોક્ષે સધાવે છે, જન્મ-મરણાદિ વિટંબણાઓને હંમેશ માટે પાર કરી જાય છે.

બસ, આ ઉત્તમ ભવમાં આ અનંતના પ્રવાસ ખેડવાના છે. સમજ રાખવાનું કે દિલ નાજુક અને ભાવુક છે. તેથી જો સાવધાની ન રાખી તો જગતના સંયોગો

૬૦

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

પર રાગાદિ ચંચળ અને ખરાબ ભાવો દિલ ઉપર ચરી બેસવાના. માટે હરેક પણે સાવધાની રાખી વેરાળ્ય, ક્ષમા મૈત્રી વગેરે સ્થાયી શુભ ભાવોને જ દિલમાં ઝગમગાવવાના, દિલને એનાથી ભાવિત કરતા રહેવાનું.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૧૩, તા. ૭-૧૨-૧૯૬૮

## ૨૬ બ્રહ્મચર્ય પાળવું કેમ સહેલુ ?

(લેખાંક-૧)

કેટલાકો કહે છે કે ‘માણસને જેમ ખાવાની ભૂખ લાગે છે એ કુદરતી હાજત છે, એમ કામભોગની ઈચ્છા થાય છે એ પણ કુદરતી હાજત છે. પછી જેમ ભૂખ શમાવવા ખાવું પડે એમાં કાંઈ ખોટું નથી. એમ કામની ઈચ્છા શમાવવા કામ સેવવા પડે એમાં શું ખોટું છે ? એટલે બ્રહ્મચર્યની વાતો વાહિયાત છે. ખોટી ઘેલાછા છે.’

આ પ્રતિપાદનની સામે પહેલો સવાલ તો એ છે કે કુદરતી હાજત એટલે શું ? મનની સહજ ઈચ્છાઓ ? ના, એમ જો કહો તો તો ચોરને ધૂતારાને લુંટારાને પણ સહેજે ચોરી-ઠગાઈ-લુંટની ઈચ્છા જાગે છે, કિન્તુ એને થોડી જ કુદરતી હાજત ગણાય ? ને એમ ગળીએ તો તો એ ગુના જ ન કહેવાય. ત્યારે કુદરતી હાજત એટલે શું ? એમ જ કહેવું પડે કે શરીરની સહજ જરૂરિયાતોથી ઊભી થતી ઈચ્છા. એમાં ભૂખ આવે તરસ આવે. લધુશંકા-વડીનીતિ આવે; કિન્તુ કામભોગની ઈચ્છા નહિ.

આનું કારણ એ છે કે એ ભૂખ તૃપ્તા વગેરે તો શરીર સાથે સંકળાયેલા અશાતાવેદનીય કર્મના લીધે ઊભી થાય છે. ત્યારે કામભોગની ઈચ્છા મોહનીય કર્મના ઉદ્યે જાગે છે; આમાં ભૂખની અશાતા તો ભોજનથી જ શમે; પણ મોહનો ઉદ્ય ભોગથી જ શમે એવું નથી. સદ્ગ્વિચારથી એ શમે છે.

વળી માનવ શરીર લઈને બેઠા એટલે આ ભૂખ-તરસની અશાતા જાગ્યા કરવાની, ને એને અન્નાદિથી ન શમાવો તો શરીર કામ કરવા તૈયાર નહિ હોય. ત્યારે ભોગેચ્છામાં એવું નથી કે એને ભોગથી ન શમાવો તો શરીર અટકીને ઊભું રહે.

ગમે તેવા ભોગલુભુ પણ મનુષ્ય જો ક્ષયરોગનો દરદી બન્યો અને ડોક્ટરવૈદ

કહે કે ‘તમે બે વરસ બ્રહ્મચર્ય પાળો નહિતર તમે ખત્મ થઈ જશો;’ પછી ત્યાં જીવનનો લોભી એ દરદી ભોગેચ્છાને ભૂમાવવાને બદલે બ્રહ્મચર્ય પાળે છે. છતાં એનું શરીર અટકીને ઊભું નથી રહેતું. ભધા કામ બજાવે છે ઊલટું દરદ નરમ પડી શરીર સશક્ત બનતું આવે છે. તો પછી ભોગેચ્છા એ કુદરતી હાજત ક્યાં રહી ? ખરી વાત એ છે કે મોહનીયના ઘરનો ચાળો હતો તે ક્ષયરોગીએ જીવન ટકાવવાની ઈચ્છાથી સમજીને દબાવ્યો.

માણસને પરસ્તીનું રૂપ જોવાની ઈચ્છા એ શું છે ? એ થોડી જ કુદરતી હાજત છે ? એ તો મોહના ઉદ્યનો નાચ છે. માણસ જો સંતના ઉપદેશથી એની પ્રત્યે પરલોકનો ભય કે ધૃષ્ણા ઊભી કરે છે, તો સહેજે એ મોહોદય શમી જાય છે. પછી ત્યાં સંયમના અભ્યાસથી પરસ્તીરૂપ-દર્શનની ઈચ્છા જ નથી થતી.

બસ, એ જ રીતે સંતવચનથી કામભોગ પ્રત્યે ધૃષ્ણા ઊભી કરવામાં આવે કે ભવભ્રમણ-દુર્ગતિગમનનો ભય ઊભો કરવામાં આવે તો ભોગની ઈચ્છા જ નહિ થાય; અને બ્રહ્મચર્ય સહજ ભાવે પળશે.

વિચારવું આ જોઈએ કે ક્ષણભર માટે ભોગના આનંદથી ભોગની ઈચ્છા શાંત થતી લાગે, પરંતુ ભોગથી કદી ભોગેચ્છા ખરેખર શાંત પડવાની નથી. અજિની જો ઈન્ધિયાથી શાંત થાય, કે સમુદ્ર જો નદીઓથી ધરાય, તો જીવની ભોગેચ્છા ભોગથી શામે. અનંતકાળ વહી ગયા ને અનંતિવાર ભોગ જોઈ નાખ્યા, છતાં જીવ હજુ એનો ભૂખારવો છે. એ સૂચવે છે કે ભોગથી જ એ ભોગનો ભૂખારવો રહે છે, ભોગેચ્છા જીવંત રહે છે; અને આ ખાંજ તત્વની સમજ, ભવભ્રમણનો ભય, પશુકિયાની ધૃષ્ણા...વગેરેથી શમાવ્યા વિના જીવની વિટંબણા મટવાની નથી.

પરમાત્મા અને એમના કલ્યાણ ઉપદેશને ભૂલાવનાર ભોગો છે.

મહામુલ્યવંતી પવિત્ર અને તારક યોગસાધના માટે યોગ્ય એકમાત્ર જે માનવજીવન તેના ફૂચા કરનાર ભોગસાધના છે.

મહાસ્વતંત્ર એવા માનવને પરતંત્ર બનાવનાર ભોગની ભૂખ છે.

આ ભધી હુદ્દશાનો વિચાર કરતાં ભોગેચ્છાને દબાવી બ્રહ્મચર્ય પાળવું એ માનવ-જીવનની લહાણ છે; અને તે કુદરતી હાજત નહિ હોવાથી દબાવી શકાય એમ છે.

(૩૦) (લેખાંક-૨)

ગ્યા લેખમાં જોયું કે ખાવાની ભૂખ એ માનવશરીર સાથે નિર્ધારિત અશાતાવેદનીય કર્મના ઉદ્યને લીધે છે, તેથી જ એ કુદરતી હાજત હોઈ ભોજનથી શમાવવી પડે છે; જ્યારે કામભોગની ઈચ્છા, પરસ્તીરૂપ-દર્શનની ઈચ્છાની જેમ મોહોદ્યના ઘરની છે અને તે ભોગ વિના જ ક્ષયરોગીની જેમ તત્ત્વસમજ, પરલોકભય પશુક્રિયાની ઘૃણા વગેરેથી શમાવી શકાય છે. માટે બ્રહ્મચર્ય સહેલું છે.

બીજુ આ વિચારવાથી પણ સરળ છે કે ‘આપણો આત્મા મૂળ સ્વરૂપે નિર્વિકાર શુદ્ધ-જ્ઞાનમય છે, શૈલેશ-મેરુ જેવો નિષ્પક્ત છે. એમાં કામ-વિકાર વગેરેના કોઈ જ અંદોલન નથી, પરંતુ આત્માને ઘેરો ઘાલીને પડેલી મોહસેના આત્માના વિકારોરૂપી તોકણાનો ઘુસાડે છે તો મારે મારા અસલી નિર્વિકાર સ્વરૂપને જ જોયા કરી અને એનું કલ્યાનાથી સંવેદન કરી પેલા વિકારોને મચક આપવાનું કામ શું છે? મનને કહી દઉં કે ખબરદાર! તં એ વિકારોને અપનાવ્યા તો? તારે મારા શુદ્ધ નિશ્ચય નિર્વિકાર સ્વરૂપને જ જોવાનું.’ આ વિચારનો વારંવાર અભ્યાસ કરવાથી બ્રહ્મચર્ય સહેલું બને છે.

એક વસ્તુ ધ્યાનમાં રહે કે જેમ આપણા હાથ-પગ, ઈન્દ્રિયો, કાયા અને વાણી પર આપણો અવિકાર છે; માટે જ એને ધાર્યા મુજબ હલાવી-ચલાવી કે રોકી યા ફેરવી શકીએ છીએ. એમ આપણાં મન પર પણ આપણું વર્ચસ્વ છે, અવિકાર છે; તેથી એને ધાર્યા મુજબના વિચાર કરવી શકીએ, રોકી શકીએ, ફેરવી શકીએ. માત્ર આપણો એને હુકમ કરવાનો છે કે તું આ રીતે વિચાર કર. મેલો વિચાર પડતો મૂકી મારી આ ઈચ્છા છે, ને તારે તે બજાવવાની.’

આત્માના શુદ્ધ નિર્વિકાર સ્વરૂપનો વિચાર કરવા માટે એક સાધન છે કે આપણે જે ચૈત્યવંદન સામાચિક-પ્રતિકમણ યા જાપ વગેરે કિયા કરીએ, એમાં કાં તો પરમાત્માના શુણગાન હોય છે, અગર એમની આગળ આપણાં પાપનો ઈકરાર-સંતાપ હોય છે, અથવા શુદ્ધિની માગણી હોય છે. પરંતુ એ બધુંય પરમાત્માને નજર સામે રાખીને કરવાનું, એ વખતે પરમાત્માનું શુદ્ધ સ્ફટિક જેવું નિર્વિકાર નિશ્ચળ સ્વરૂપ નજર સામે રાખવાનું; અને સાથે ચિંતવાનું કે માણું ય સ્વરૂપ આવું નિર્વિકાર છે; કિંતુ મોહવિકારો મેં મફતિયા ઘાલ્યા છે, એની સાથે શુદ્ધ એવા મારે કોઈ સંબંધ નથી. તેથી નવા વિકારો ઘાલવાનો મારો મોખ નથી.’

એક ‘નમો અરિહંતાઙ્ન’નો જાપ કરતી વખતે પણ વીતરાગ અરિહંતને નજર સામે શુદ્ધ નિર્વિકારરૂપે ધારવાના, અને આપણે ય એવા છીએ એમ ધારી ભુવનભાનું એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

કામભોગ કે કોધાદિ વિકારો આપણને સ્પર્શતા નથી, કિન્તુ એ બિચારા બહાર આંટા મારે છે; ‘હું તો અરિહંત જેવો નિર્વિકાર છું;’- એમ જાપ વખતે સતત ઘ્યાલ રાખ્યા કરવાનો. એથી આત્મામાં એક એવો સુંદર સંસ્કાર ઊભો થાય છે કે એ પછી કામવિકાર અને ભોગેચ્છા ઊઠવા નહિ દે. કદાચ ઊઠશે તો સહેલાઈથી એને ફગાવી દેશે. માત્ર કામવિકાર જ નહિ, કિન્તુ રાગ, દ્રેષ, હાસ્ય-અસ્યૂયા, હર્ષ-બેદ વગેરે અનેકાનેક વિકારોને દબાવવાની તાકાત આ સ્વાત્માના શુદ્ધ નિર્વિકાર સ્વરૂપના, વારંવાર કરાયેલ હાર્દિક ચિંતનમાં છે. એનાથી ઊભા થયેલ સુંદર સંસ્કારમાં છે. બ્રહ્મચર્ય-પાલન આથી સરળ બને છે, અને તે પણ માનસિક સુધી.

બાકી તો સ્થૂલબદ્ર સ્વામી, સુદર્શન શેઠ, જંબૂકમાર, પૃથ્વીચંદ્ર વગેરેના પરાકરમનું વારંવાર ચિંતન-મનન પણ બ્રહ્મચર્ય પાલન સહેલું બનાવે છે. એટલું ધ્યાનમાં રહે કે શાસ્ત્ર કહે છે તેમ બ્રહ્મચર્યના નિર્મળ પાલન માટે શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શના આકર્ષણ-મૂલ્યાંકન-વિચારવાળીથી દૂર જ રહેવું ધટે.

(૩૧) ભાદ્ય તપ કેમ જરૂરી ?

મોક્ષના અર્થી જીવને જૈનશાસન સંવર અને નિર્જરા-તત્ત્વ ઉપાદેય બતાવે છે. ‘સંવર’ થી આશ્રવ-નિરોધ થાય, અર્થાત્ કર્મબંધના કારણોની અટકાયત થઈ નવાં કર્મ બંધાતા અટકે. ‘નિર્જરા’-તત્ત્વથી જૂના કર્મોનો નિકાલ થાય, ક્ષય થાય. જૂનાનો સંપૂર્ણ ક્ષય થાય અને નવા આવતા અટકાવી દીધા હોય એટલે આત્મા સર્વથા કર્મરહિત થઈ મોક્ષ પામે. તત્ત્વાર્થશાસ્ત્ર કહે છે, ‘કૃત્યાકર્મક્ષયો મોક્ષઃ’ સંપૂર્ણ કર્મક્ષય એ મોક્ષ.

નિર્જરા-તત્ત્વમાં ભાદ્ય અને આભ્યન્તર તપ છે. ‘કર્મ ખપાવે ચિકણા, ભાવમંગળ તપ જાણ’ તપથી કઠિન કર્મો પણ નાશ પામી જાય છે. માટે તપ એ ભાવમંગળ છે. કર્મો જો ભોગવાઈને જ નાશ થતા હોય તો કદી એના સંપૂર્ણ નાશ જ ન થાય અને મોક્ષ જ નહિ; કેમકે એ આત્મા પર અસંખ્ય કાળના-પડેલા હોય છે તે એક ઢૂંક માનવજીવનમાં માત્ર ભોગવાઈને શે નાશ પામે? ત્યારે બીજું જીવન આવતા આવતા તો વળી ઢગલો નવા કર્મો આત્મા પર લાગી ચુક્યા હોય. માટે કર્મોનો વિશેષ નિકાલ તપથી થવાનું માનનું જ જોઈએ. શુદ્ધ ધર્મની સ્થાપના પણ એ જ ઉદેશથી છે કે એણે બતાવેલ તપના માર્ગે જીવો ચાલે અને કર્મક્ષય કરી મોક્ષ પામે.

તપથી કર્મક્ષય થવાની દલીલ આ છે કે મલિન ભાવોથી કર્મ બંધાયા હોય, એના કરતાં વિપરીત શુભ ભાવો કર્મનાશ કરે. ધાંચીનું કપું ધૂળ અને તેલના રજકણથી મેલું ઘાણ થયું હોય છે એ એનાથી વિપરીત દ્વયો દ્વારા અર્થાત્ ઉકળતાં પાણી અને ખારથી મેલ કપાઈ ચોક્કબું થાય છે. એ રીતે આત્માનો કર્મભળ તપથી કેમ સાફ ન થાય? તપથી જ તીર્થકર ભગવાન જેવા પણ પોતાનો કર્મ-મેલ સાફ કરે છે; તો એ તપની બીજા આત્માઓને ભારે જરૂરનું પૂછવું જ શું?

તપથી કર્મક્ષય-કર્મનિર્જરા થાય છે માટે તપને જ નિર્જરાતત્ત્વ કહે છે. એ બાધ અને આભ્યન્તર એમ બે પ્રકારે છે. બાધતપમાં અનશન-ઊનોદરિકા-વૃત્તિસંક્ષેપ-રસત્યાગ-કાયકલેશ-સંલીનતા એમ હ પ્રકારે છે.

આભ્યન્તર તપ-પ્રાયશ્વિત-વિનય-વૈયાવચ્ચ-સ્વાધ્યાય-ધ્યાન-કાયોત્સર્ગ એમ હ પ્રકારે છે. એ બાધ તપ કરતા પ્રધાન છે; કેમકે એથી વિશેષ કર્મનિર્જરા થાય છે; તેમજ એના વિના કોરો બાધ તપ સંગીન કર્મક્ષય પણ નથી કરી શકતો.

આ ઉપરથી અજ્ઞાન જીવો, એમ માની બેસે છે કે ‘અમે સ્વાધ્યાય-ધ્યાન-જ્ઞાપ કરીએ, પછી બાધ તપ ન હોય તો વાંધો નહિ, કેમકે બાધ કરતાં આભ્યન્તર તપ મુખ્ય છે.’ પરંતુ આ એમની ભ્રમણા છે. કેમકે પહેલી વાત તો એ કે જો બાધ તપ વિના ચાલતું હોય, તો તો તીર્થકર ભગવાન ચારિત્ર લઈને સ્વાધ્યાય યાને તત્ત્વચિંતન, ધ્યાન કાયોત્સર્ગ ક્યાં કમ કરે છે? તો એમણે સાથે ભરપૂર ઉગ્ર બાધ તપ શા માટે કર્યો?

બીજી મહત્વની વાત એ છે કે જીવનમાં જો ઉપરોક્ત બાધ તપ નહિ હોય, તો તો એના બદલે ખાવાની છૂટ, ખાવા-પીવા-ભોગવવાનાં દ્વયોમાં સંકોચ નહિ, રસ (વિગઈઓ) નો યથેચું ઉપયોગ, કાયાની સુખશીલતા, અને મન-વચન-કાયાની ધૂમ પ્રવૃત્તિ રહેવાની; અને આ બધા તો આશ્રવો હોઈ એનાથી ઢગલો કર્મઆવક રહેવાની. એનાથી કોણ બચાવશે? વળી જેમ હિંસાદિ પાપોની છૂટ હોય એ અવિરતિ છે. એમ ઈન્દ્રિયોને ઈષ વિષયોપભોગની છૂટ-આસક્તિ હોય એ પણ અવિરતિ છે. એ જંગી કર્મબંધનું કારણ છે, બાધ તપ વિના એને કોણ અટકાવે? એ તો અનશન-દ્રવ્યસંકોચ-રસત્યાગ-કાયકષ (પ્રતિકૂળ પરિસહોનું સહન) વગેરેથી અટકે છે.

માટે બાધ તપ, એ ઈન્દ્રિય-અવિરતિ, રાગાદિ કષાયો અશુભ યોગ ઈત્યાદિ આશ્રવોને અટકાવવા માટે અત્યંત જરૂરી છે, નહિતર માનેલા સ્વાધ્યાય-ધ્યાન-જ્ઞાપ કે જે ખરેખર દુબળા હોય છે. એનાથી કર્મક્ષય થોડો અને આ આશ્રવોથી કર્મની આવક જંગી રહેવાની. એક પ્રશ્ન છે,-

પ્ર.- બાધ તપ જો આશ્રવોને અટકાવતો હોય તો એનો નિર્જરાતત્ત્વમાં કેમ લીધો? સંવરમાં લેવો જોઈએ.

૩.- સંવરમાં ૧૦ પ્રકારના યતીધર્મમાં તપને પણ એક પ્રકાર તરીકે ગણેલો જ છે. વધારામાં એ કર્મક્ષય પણ કરે છે તેથી એ નિર્જરાતત્ત્વ પણ છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૧૬, તા. ૨૮-૧૨-૧૯૬૮

## ૩૨ ખોટા વિચારોથી બચવા અદ્ભુત ઉપાય (લેખાંક-૧)

માનવભવમાં વિશિષ્ટ શક્તિવાળું મન મળે છે. પરંતુ અજ્ઞાન મૂઢ જીવ એનો ઉપયોગ બહુધા ખોટા વિચારો, ફજુલ વિચારો ને કષાયભર્યા વિચારો કર્યા કરવામાં કરે છે. એની પાછળ આત્મામાં મલિન ભાવો અધ્યવસાયો કામ કરતા હોય છે; અને આને લીધે સીધો સંબંધ કર્મબંધ સાથે છે. કેમકે શાસ્ત્રગાથા ‘જ જ સમય જીવો...’ કહે છે કે ‘જે જે સમયે જેવા શુભ યા અશુભ ભાવ, તે તે સમયે તેવો તેવો કર્મબંધ થાય.’ એટલે મલિન ભાવ પર અશુભ કર્મબંધ પાપ-બંધ થાય. ત્યારે વિચારવા અને ચોંકી ઊંઠવા જેવું છે કે દિવસ-રત્નમાં ઢગલો ખોટા-ફજુલ-કષાયભર્યા વિચારોથી કેટલો બધો અફળક પાપકર્માનો પ્રવાહ આત્મધરમાં ચાલ્યો આવે!

માટે મોકાથરીએ આવા અશુભ વિચારો રોકવા જોઈએ. તેનો અદ્ભુત ઉપાય શાસ્ત્રતત્ત્વનું ધારાબદ્ધ ચિંતન છે, એ માટે શાસ્ત્રપદાર્થોને કરીબદ્ધ તૈયાર કરવા જોઈએ. દા.ત.

જેન શાસ્ત્રોમાં ‘ત્રણ ભાષ્ય’ તરીકે પ્રસિદ્ધ ત્રણ પ્રકરણોમાનું એક ‘ચૈત્યવંદન ભાષ્ય’, ‘પરમાત્માના મંદિરમાંની સાધનાઓ બતાવે છે.’ જો મન શાસ્ત્ર પદાર્થો વ્યવસ્થિત રીતે ‘ધારાબદ્ધ’ વિચારણું રહે તો એટલો સમય ખોટા-ફજુલ-કષાયી વિચારો ચાલવાની જગા ન રહે, મનનું લક્ષ એક વખતે એકમાં જ હોય છે. તેથી જો લક્ષ ધારાબદ્ધ શાસ્ત્રીય પદાર્થોમાં ચાલ્યું, તો ખોટી બાબતોમાં લક્ષ નહિ રહે.

શાસ્ત્ર-પદાર્થોના આ ધારાબદ્ધ ચિંતન માટે મનમાં શાસ્ત્ર-પદાર્થોના કરીબદ્ધ સંકલન તૈયાર કરવા જોઈએ. અલબત્ત, આપણા પ્રાચીન સ્તવનો અને સજગાયો પરથી ય કરીબદ્ધ પદાર્થો તૈયાર કરી શકાય; પરંતુ એમાં એક ગાથાના પદાર્થની બીજી ગાથાના પદાર્થ સાથે કરી જોડવા બુદ્ધિ લડાવવી પડે, જ્યારે પ્રકરણશાસ્ત્રોના

પદાર્થ સહેજે કરીબદ્ધ હોય છે, એટલે એને મનમાં તૈયાર કરવાનું કામ સહેલાઈથી બની શકે છે.

સ્તવનોની ગાથાના પદાર્થ કરીબદ્ધ તૈયાર કરવા પહેલી નીચેની ગાથાની વસ્તુને બીજી ઉપરની ગાથાની વસ્તુ સાથે શો સંબંધ લાગે તે શોધી કાઢવું જોઈએ. દા.ત.

માતા મરુદેવાના નંદ, દેખી તાહરી મૂરતિ મારું મન લોભાણું જી... એ સ્તવન. નજર સામે રાખો અને આ પ્રમાણે જુઓ કે હ ગાથાના પદાર્થ કેવા કરીબદ્ધ ચાલ્યા આવે છે,- ‘હે મરુદેવા માતાના પુત્ર ઋષભદેવ ભગવાન ! તમારી મૂર્તિ જોઈને મારું મન તમારા પર આકર્ષાઈ જાય છે; તમારી મૂર્તિ પરથી તમારા આકર્ષક સ્વરૂપનો ઘ્યાલ આવી મન એના પર ઓવારી જાય છે.’

(૧) ‘આવું આકર્ષક સ્વરૂપ થવાનું કારણ, તમે કરુણાના આકર (ખાણ) કરુણાના સાગર બન્યા છો’ વિશ્વના સમસ્ત જીવોને હું કર્મપિશાચની વિટંબાપામાંથી મુક્ત કરવા કેમ મોક્ષમાર્ગ ચડાવી દઉં ! એવી કરુણા તમે ચિંતવી છે. તેથી તમને પગે વૃષભના લંઘનવાળી ૫૦૦ ધનુષ્યની કંચનવર્ણી કાયા મળી છે.

(૨) આવી અતિ અનુપમ લાવણ્યકારી કાયા મેળવીને તમે શું કર્યું ? રંગારા ખેલવાનું નહિ; પણ સમોસરણના ત્રણ ગઠ પર બેસીને ધર્મ કહેવાનું. એ માટે જળધારા જેવી જોજનગામિની વાણી વરસાવી.

(૩) આ વાણીનો ચમત્કાર કેવો ? કે સ્વર્ગમાંથી આવેલી દૂપાળી ઉર્વશી અને બીજી અષ્ટરા સ્ત્રીઓ એના પર પગમાં નુપૂરના રણજણાટ સાથે નાટારંભ કરવા લાગી ગઈ.

(૪) શું એ મૌન નૃત્ય કરે છે ? ના, એ તો નાચતી જાય છે અને બોલતી જાય છે, ‘હે ઋષભદેવ ! તું જ બ્રહ્મા છે. તું જ વિધાતા છે. તું જગતનો તારણહાર છે. તારા જેવો જગતમાં કોઈ દેવ નથી. પ્રભુ ! તું જ આ ભવમાં રખુતાનો આધાર છે.’

(૫) ‘તું જ ભાતા તું જ ત્રાતા (રક્ષક,) અને તું જ વિશ્વપૂજ્ય દેવાધિદેવ પરમાત્મા છે; દેવો મનુષ્યો કિન્નરો અને વાસુદેવો તારા ચરણની સેવા કરે છે.’

(૬) ‘હે સિદ્ધાયણતીર્થના રાજી ઋષભજિણંદ ! અમારા ભવોભવના બંધન ટાળો આ માણેકમુનિ ડીર્ણ કરે છે.’ (આ પ્રમાણે ઉર્વશી ગાય છે.)

બસ, આ રીતે બીજાં સ્તવન સજાયોના ગાથા-ગાથાના પદાર્થ વચ્ચે કરી જોઈને તૈયાર કર્યા હોય, તો પછી એને વારંવાર ધારીને મનમાં તૈયાર કર્યા હોય તો પછી એને મનમાં રટ્યે જવાથી ખોટા વિચારોને અટકાવી શકાય. હવે શાસ્ત્રપદાર્થ વિચારીએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૧૭, તા. ૪-૧-૧૯૬૬

### (૩) (લેખાંક-૨)

કર્મબંધને સીધો સંબંધ આત્માના શુભ-અશુભ ભાવ સાથે છે. તેથી જ જીવ અદ્દણક અશુભ કર્મો તો ખોટા-ફ્રજુલ-ક્ષપાથી વિચારો કર્યી કરવાથી બાંધે છે. માટે એ વિચારોને અટકાવવા અદ્દભુત ઉપાય સત્પદાર્થોનું કરીબદ્ધ ચિંતન છે, એમાં સ્તવન સજાયોના પદાર્થની વાત ગયા લેખમાં કહી. હવે અહીં શાસ્ત્રપદાર્થોનો વિચાર કરીએ.

જેન શાસ્ત્રોમાં ‘જીવવિચાર’ ‘નવતત્ત્વ’ વગેરે અનેકાનેક પ્રકારણ-શાસ્ત્રો છે કે જેના ગાથા-ગાથાના પદાર્થ કરીબદ્ધ જોડાઈ એનું ધારાબદ્ધ ચિંતન ચાલી શકે. દા.ત.

‘જીવવિચાર’ ના પદાર્થોમાં,- જીવ બે પ્રકારે સંસારી અને મુક્ત. સંસારી બે પ્રકારે સ્થાવર અને ત્રસ. ‘સ્થાવર’ ૫ પ્રકારે,- પૃથ્વીકાળિક, અપ્રકાળિક, તેજસ્કાળિક, વાયુકાળિક, વનસ્પતિકાળિક. આ બધા એકેન્દ્રિય જીવો છે. ‘ત્રસ’ ૪ પ્રકારે,- બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચાન્દુરિન્દ્રિય, પંચિન્દ્રિય. ‘પંચિન્દ્રિય’ ૪ પ્રકારે-નારક, તિર્યચ મનુષ્ય અને દેવ. આ દરેકમાં અનેક જાતિના જીવો વિચારવાના આવે. પછી એ દરેકની શરીર-અવગાહના (માપ) આયુષ્ય વગેરેની વિચારણા ચાલે. જીવોની જાતિમાં ય કેવા કેવા પ્રકારના જીવો હોય એની વિચારણામાં મન સારું રોકાય. દા.ત. પૃથ્વીકાળિક જીવોમાં પાખાણની અનેક જાતિ વિચારવાની આવે, એમ માટીની, ખારની, ધાતુની, રત્નની, વગેરે જાતિમાં અનેક પ્રકારે જીવો વિચારવાના આવે. એમ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોમાં અનેક જાતિઓ, એમાં પ્રકારો, એમના શરીર-માન, આયુષ્ય વગેરે વિચારવામાં જો મન રોકી દીધું તો ફ્રજુલ ખોટા, કે ધાતક વિચારો અટકી જાય.

મગજમાં પહેલાં સંકલના બદ્ધ પદાર્થ ગોઠવી રાખ્યા હોય, તો પછી એની સંણગ વિચારધારા વહેતી રાખી શકાય. ‘જીવવિચાર,’ ‘નવતત્ત્વ,’ ‘તત્ત્વાર્થ’ વગેરેના પદાર્થ એ રીતે ઉપયોગી બને છે.

એવા ‘ત્રણ ભાષ્ય’ ના સુંદર પદાર્થ છે. દા.ત. પહેલું ચૈત્યવંદન ભાષ્ય છે. એમાં ૨૪ દ્વારથી વિચાર કરવામાં આવ્યો છે. ‘દ્વાર’ એટલે મુદ્રા, પોઈન્ટ. આમ તો એ દ્વારના ઝટ યાદ કરવા જરા કઠિન લાગે, પણ જુઓ સંકલનાથી સહેલાઈથી યાદ રહી શકે. દા.ત. પહેલું દ્વાર ‘ત્રિક’ છે. એમાં મંદિરમાં આરાધવાના તૃ-તૃ વસ્તુના ૧૦ જોડલા છે. એને ‘૧૦ ત્રિક’ કહે છે. આમાં મોટો સંગ્રહ હોઈ એ

પહેલું દ્વાર મૂક્યું. હવે એ આરાધવા, પ્રભુ પાસે જવું છે તો વિનય સાચવીને જ જવાય. માટે ર જું દ્વાર ‘અભિગમ’ અર્થાત્ વિનય એ સાચવીને પ્રભુ પાસે જવાય. ત્યારે સ્ત્રી-પુરુષે કઈ દિશામાં ચાલવું એના વિચાર માટે ર જું દ્વાર ‘દિશા’નું, એ સાચવીને પ્રભુની નજીકમાં ગયા તો ખરા, પણ ત્યાં પ્રભુની કેટલી નિકટતામાં ઉભા રહેવાય એના વિચાર માટે ૪ થું દ્વાર ‘અવગ્રહ’નું, અવગ્રહ એટલે સ્થાનની મર્યાદા. એ સાચવીને પ્રભુ આગળ જઈ ઉભા તે શું સોટા જેવા અક્કડ ઉભા રહેવાનું ? ના નમી પ્રણામ કરીને ઉભા રહેવાનું ? તો આ વંદન અંગે ર દ્વાર-પ્રણામ, નમસ્કાર, પ્રણિધાન એ પ મું, દ હું, ર મું એમ ત્રણ દ્વાર થયાં. આમાં વંદન સ્તુતિ ખમાસમણું આવે. એ પછી ચૈત્યવંદન થાય. એ અંગે પ દ્વાર-અક્ષર, પદ, સંપદા, સૂત્ર, અધિકાર, ચૈત્યવંદનના સૂત્રોમાં અક્ષર કેટલા ? પદ કેટલા ? સંપદા (ફકરા) કેટલી ? દરેક સૂત્રનું નામ શું ? અને એ દરેક સૂત્રમાં શાનો શાનો અધિકાર છે, અર્થાત્ ક્યો ક્યો વિષય છે ? આમ પૂર્વના ૭ દ્વાર ઉપર આ પ દ્વાર મળતા ૧૨ દ્વાર થયા. એ રીતે આગળ ૧૨ દ્વારની સંકલના કરવાથી એકધારાએ ૨૪ દ્વારના નામ વિચારી શકાય.

પછી એ દરેક દ્વારના પદાર્થ ઉપર પણ સંકલના બદ્ધ વિચારણ ચાલી શકે.

જો રોજ ૦૧-૦૧ કલાક સમય કાઢીને તે તે પુસ્તકમાંથી કમસર ટૂંકી ટૂંકી પદાર્થ નોંધ કરાય ને એ બધી નોંધ રોજ વાંચી જવાય તો તો જતે દહેડે એ યાદ રહી જાય. પછી એ પદાર્થોની સંખણ વિચારધારા ચાલે. આમ આ સાધનથી મન કામે લાગ્યું રહે અને તેથી ખોટા વિચાર અટકે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૯-૧૭, અંક-૧૮, તા. ૧૧-૧-૧૯૬૮

### ૩૪ પ્રભુનામની જડીબુઝીનો ઉપયોગ

જીવન ખોટી ચિંતાઓથી રહી બને છે; ખોટા વિચારોથી ધૂળધાળી થાય છે. કોઈ પણ ડાખ્યો માણસ આ ઈથે નાહિ; કેમકે ખોટી ચિંતા ખોટા વિચારો મનને જીવનજરૂરી પાપ પ્રવૃત્તિ બગાડે એના કરતાં વધારે બગાડે છે. આનું કારણ એ છે કે જીવન જીવવામાં જરૂરી ધંધો-રોજગાર રસોઈ-પાણી વગેરેની પ્રવૃત્તિમાં આરંભ પરિગ્રહ-વિષયાસક્રિયા હિસાબે પાપરૂપતા લાગે છે, મનને એનો ખટકો રહે છે, જ્લાની રહે છે કે ‘ક્યાં આ સંસારમાં ફસી રહ્યો કે મારે આ પાપ આચરવા પડે છે ?’ અને પાપનો આ ખટકો મનને બગડતું અટકાવે છે. જ્યારે ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૬૮

ખોટી ચિંતા ખોટા વિચારોમાં એવો કોઈ ખટકો નથી રહેતો. જીવ વિના-સંકોચ એ કરે જાય છે. તેથી મન બગાડે છે. આ તો હકીકત થઈ કે ખટકો લાગ્યા વિના ખોટી ચિંતાઓ ખોટા વિચારો ચાલ્યા કરે છે; પરંતુ સવાલ એ છે કે એને શી રીતે રોકવા ?

આ માટે એક સરળ ઉપાય આ છે કે જ્યાં એ ખોટી ચિંતા ખોટા વિચારો કે કોઈ ગુસ્સો અભિમાન વગેરે કષાય ઉઠવા જાય કે તરત પ્રભુનામની રટણા શરૂ કરી દેવી. તે પણ ગણતરીબદ્ધ, જેથી ચિત્ત એમાં બરાબર ચોંટ્યું રહે; કેમકે ગણતરી રાખવી છે તેથી ચિત્તને એમાં સજાગ રાખવું પડે.

આ એક એવો સરળ ઉપાય છે કે અભણ માણસ પણ એને અજમાવી શકે. અને એનો અદ્ભુત ઉપાય છે કે એથી ચિત્તમાં પ્રભુ પ્રત્યેની મમતા ગૌરવ વધતા જાય. અલબત્ત પ્રભુના નામની રટણા એમ સમજને કરવામાં આવે કે ‘પ્રભુમાં ખોટી ચિંતા ખોટા વિચારો અટકાવવાની અને એ ચિંતા-વિચારોથી બંધાયેલા પાપ તોડવાની અનુપમ અચિત્ય શક્તિ છે. માટે જ એ પ્રભુ વિના મારો ઉદ્ધાર નથી.’ આ સમજ સાથે પ્રભુના નામની રટણા જેમ જેમ કરાતી જાય તેમ તેમ પ્રભુ પ્રત્યે મમત્વ વધતું જાય; તેમજ વારે વારે પ્રભુનું નામ રટીને ખોટી ચિંતા ખોટા વિચારો અટકાવ્યાનો મહાન લાભ મળતો હોવાથી હૃદયમાં પ્રભુનું ગૌરવ દંડ થતું જાય. મનને એમ થાય કે ‘અહો ! મારા વીતરાગ ભગવાનનો કેવો પ્રભાવ કે એમનું પવિત્ર મંગળમય નામ રટવાથી મારા કેટલાય કચરાપડી વિચારો અટકાવી શકાય છે ! કેટલીય ચિંતા સંતાપ દુધ્યાનને રોકી શકાય છે !’

બસ કામ આ કે જ્યાં મફતિયો વિચાર, નિષ્ફળ વિચાર, કષાયભર્યો વિચાર સ્કુર્યો કે તરત જ ‘નમો અરિહંતાણ’ યા ‘અરિહંત’ યા ‘ઊં હ્રી અર્હ નમઃ કે’ ‘ઊં હ્રી પાર્શ્વનાથાય નમઃ’ વગેરે પ્રભુના નામની રટણા શરૂ કરવાની. તે પણ ગણતરીબંધ રટણા કરાય, એટલે મન એમાં બરાબર ચોંટી જવાથી પેલા વિચાર ચિંતા વગેરે બંધ પડી જાય. અભ્યાસથી આની મજા સમજાય છે.

આનો અભ્યાસ કરવાની બહુ જરૂર છે; કેમકે જીવ એવો સાત્ત્વિક નહિ હોવાથી મફતિયા વગેરે વિચારોના ભૂસા બહુ કૂટે છે તે તત્ત્વભાવનાની પ્રત્યે ઝેરરૂપ છે એનાથી બચાવનાર આ પ્રભુનામની રટણા છે, પણ તેનો ખૂબ અભ્યાસ હોય, તો અવસરે એ ઝટ શરૂ થઈ જાય અને પેલું રોકાય.

મફતિયા વિચાર તરીકે ‘આ કોણ આચ્યું, પેલું કોણ ગયું, બજારમાં માલ બહુ આચ્યો છે, પાડેશીને ત્યાં મેમાન આચ્યા છે,...’ વગેરે વિચારો; નિષ્ફળ વિચાર તરીકે ‘આરિસો સારો હતો કૂટી ગયો,’ ‘દીકરો નાની ઉમરમાં ગુજરી

૭૦

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

ગયો.’ ‘સરકારે ટેક્ષ બહુ વધાર્યા...’ વગેરે વિચારો કે જે કરવાથી કશું વળવાનું નથી; ખોટી ચિંતા તરીકે ‘નોકર વહેલો આવશે કે નહિ.’ ‘મોંઘવારી ઘટશે કે નહિ,’...વગેરે ચિંતાઓ; સંતાપ તરીકે ‘હાય ! શરીર બગડી ગયું,’ ‘છોકરો ઉદ્ભટ થઈ ગયો,’...ઈત્યાદિ સંતાપ એમ ગુસ્સો, અભિમાન, ઈર્ઝા વગેરે કષાયો આ બધામાં જીવનું સત્ત્વ હજાય છે, જીવન બરબાદ થાય છે. અનંતાકાળની આ કુટેવને રોકવા પ્રભુનામની જરીબુદ્ધી છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૧૮, તા. ૧૮-૧-૧૯૬૮

### ૩૫ બ્રહ્મચર્ય-પાલન માટે મનનું મૂલ્યાંકન

માણસને ધી-દૂધ ચોક્કખાં જોઈએ છે, ‘ધાન્ય-મસાલા-મિઠાઈ ચોકખી જોઈએ છે.’ કપડા સ્વચ્છ ગમે છે, મકાન વગેરે ય સ્વચ્છ ગમે છે, અને પોતાનું શરીર પણ સ્વચ્છ અને સ્વસ્થ જોઈએ છે. પરંતુ મૂઢતા એવી કે સૌથી અગત્યની વસ્તુ જે પોતાનું મન, એ સ્વચ્છ અને સ્વસ્થ જોઈએ એ તરફ દાખિ જ નથી.

એ તો સમજે છે કે ધી દૂધ વગેરે ચોક્કખાં મળે બવાય-પીવાય તો શરીર સારું રહે; કપડાં સ્વચ્છ હોય તો લોકમાં શોભીએ; મકાન સ્વચ્છ હોય તો ઘરે આવનાર પાડેશી વગેરે આપણને સારા માને; શરીર સ્વચ્છ હોય તો સારા લાગીએ, અને સ્વસ્થ હોય તો દુનિયાના કામ બજાવી શકીએ, તેમજ આનંદ-મંગળ રહે, આ સમજ છે, પણ મન સ્વચ્છ અને સ્વસ્થ હોય તો કેટલા મહાન લાભ, તેમજ મન મહિન ને અસ્વસ્થ હોય તો કેવા ભયંકર નુકસાન, એનો વિચાર જ નથી.

આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ‘અષ્ટક’ શાસ્ત્રમાં એક સ્થાને કહે છે.

#### ‘ચિત્તરલ-મસંક્રિલષ્ટ-માન્તરં ધનમુચ્યતે’

અર્થાત્ સંકલેશ વિનાનું ચિત્ત એ આંતર ધન કહેવાય છે. બાબ્ય લક્ષ્મીથી બહારની સારાસારી દેખાય પણ એ અંતરનું કાંઈ અજવાળે નહિ. ત્યારે આ સંકલેશ-રહિત મનરૂપી આંતર લક્ષ્મીથી અંતરનું બધું સારું બને, અંતરમાં અજવાળાં થાય.

પુણિયા શ્રાવકને આ આંતર ધનથી એવી ઉચ્ચ આત્મદશા પ્રાપ્ત થઈ હતી કે મગધ દેશના સમ્રાટ શ્રેણિકને એની પાસે ભીખ માંગવા આવવું પડ્યું. ભગવાન

મહાવીર પ્રભુ શ્રેણિકને આશ્વાસન આપે છે કે ‘તુ જો પુણિયા શ્રાવકના એક સામાયિકનું ફળ લઈ આવે તો તારી આગામી નરકગતિ મટે.’ રાજ ઉપદ્યો પુણિયાના ઘરે ભીખ માંગે છે, ‘તારે જોઈએ તો મગધ દેશનું રાજ્ય લે, પણ મને તારા સામાયિકનું ફળ આપ.’ પુણિયો કહે ‘મહારાજ ! લાચાર છું. મારા સામાયિકનું ફળ કેટલું એની મને ખબર નથી તો શું આપું ? જાઓ પ્રભુને પૂછી લો,’ ‘ફળ કેટલું અને શી રીતે અપાય ?’ શ્રેણિક પ્રભુને જઈને પૂછે છે ત્યારે પ્રભુ કહે છે ‘અના સામાયિકનું ફળ આંકી શકાય એવું નથી.’ શેના ઉપર આ ફળ ? સામાયિકમાં રહેલા ઉચ્ચ કોટિના સમત્વભાવ ઉપર. એ સમત્વભાવ હોવાનું કારણ પુણિયાનું મન સંકલેશ વિનાનું હતું. સ્વચ્છ અને સ્વસ્થ હતું.

‘સંકલેશ’ એટલે રાગ-દ્રેપની વ્યાકુળતા. સંસારી જીવ ઘર રાખીને બેઠો છે, એટલે પત્ની છે, પુત્ર છે, પૈસા છે, એના પર રાગ રહેવાનો; પરંતુ રાગની વ્યાકુળતા હશે, તો પત્નીને તપ નહિ કરવા દે, પુત્રને સાધુ પાસે બહુ નહિ જવા દે, પૈસાને રોજ દેવ-ગુરુભક્તિમાં નહિ વાપરે; આ રાગનો સંકલેશ છે. એમ દ્વેષના સંકલેશમાં અણગમતું આવતાં ધમધમાટ કરી મૂકશે. આ સંકલેશ હોય એ ચિત્ત મેલું ને અસ્વસ્થ રહેવાનું.

અસ્વચ્છ અને અસ્વસ્થ મનવાળો સુખી નહિ, નિષ્પાપ નહિ, એને ખોટી ચિંતા; ભય શંકા-કુશંકા, સંતાપ-વિહ્વળતા વગેરે લાગ્યા જ રહેવાના, પછી ભલે ને લાખો રૂપિયા મળ્યા હોય. રૂપાળી સુશીલ પત્ની મળી હોય, બંગલો-મોટર હોય, પણ તેથી સુખ શું ? એ ભય-સંતાપ-વિહ્વળતાના લીધે આર્તધ્યાન પણ કેટલા ને પાપપ્રવૃત્તિ કેટલી ? જીવન આંતરિક દુઃખ અને પાપવૃત્તિથી કાળું મેશ ! પછી એને દેવ-ગુરુપર શુદ્ધ પ્રેમ શા ? અને પવિત્ર વિચારસરણી કે નિર્મળ ધર્મસાધના કયાં ?

ત્યારે જો મન સંકલેશ વિનાનું હોય, સ્વચ્છ અને સ્વસ્થ હોય તો એ બધા અનર્થોથી બચી જડની બાબતમાં કર્મ પર અટલ વિશ્વાસે નિશ્ચિન્તતા-નિર્ભયતા-સ્વસ્થતા રહેવાની. આર્તધ્યાન બહુ ઓછા, હેણું નિષ્પાપ, અને શક્ય પાપપ્રવૃત્તિ-ત્યાગ સાથે ઊંઘણતો દેવ-ગુરુપ્રેમ તથા તાત્ત્વિક વિચારસરણી અને નિર્મળ ધર્મસાધના થોકબંધ રહેવાની;

આવા સ્વચ્છ અને સ્વસ્થ મન માટે ‘બ્રહ્મચર્ય’ જરૂરી છે. એ માટે વિચાર જોઈએ કે જો ‘હું વિષય-સુખમાં ને સ્ત્રીના રૂપ-રંગ-ગાત્રમાં મન લઈ જઈશ,’ તો તરત એ અસ્વચ્છ અને અસ્વસ્થ બનશે, અને તેથી ઉપરોક્ત લાભો ગુમાવી

નુકસાનોની ફોજ ઉતારવાનું થશે. માટે મનને સ્ત્રીતત્વથી આધું જ રાખવા હે, એ ત્યાં જાય જ નહિ એ માટે એને વારંવાર પરમાત્માના વિચારમાં લગાવવા હે; ‘મારા શુદ્ધ નિર્વિકાર સ્વરૂપને ચિંતવવા હે.’

સ્વચ્છ અને સ્વસ્થ મનનું ઊંચું મૂલ્ય અંકાય, તો બ્રહ્મચર્ય પાળવું સહેલું બને.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૨૦, તા. ૨૫-૧-૧૯૬૮

## ૩૬ તકલાદી આનંદ અને સંતાપ

(લેખાંક-૧)

તમે સુખી છો ? આ પ્રશ્ન આપણી સામે આવતા વિચારમાં પડી જઈએ છીએ કે જવાબમાં શું કહેવું ? જો બહારની થોડી ઘણી સગવડના લિસાબે કહેવા જઈએ કે ‘હા, અમે સુખી છીએ.’ તો પાછું એની સાથે વળગેલી એક યા બીજી અગવડ પ્રતિકૂળતા અણગમતી વાત-વસ્તુ નજર સામે આવતા મનને એમ થાય છે કે ‘આ લોથ પડી હોય ત્યાં હું સુખી શાનો ?’

ત્યારે શું જિંદગી સગવડના આનંદ સાથે અવગનના સંતાપ ભરી જ પૂરી થવાની ? અહીં એમ કહેવાનું મન થાય કે આપણું પુણ્ય ઓછું હોય એટલે શુ કરીએ ? જીવને એમ જ ચાલ્યા કરશે. પણ આ વચન દીનતાનું છે અને-સમજ વિનાનું છે.

સમજ આ નથી કે જીવનમાં માનેલા આનંદ અને સંતાપ તકલાદી છે. એવા તકલાદી આનંદથી પણ આપણે સુખી નથી, તો પછી સંતાપથી તો આપણે સુખી હોઈએ જ શાનો ? નક્કર સુખ આ આનંદ અને સંતાપ ન હોય તો જ અનુભવમાં આવે. તકલાદી આનંદ અને સંતાપ કોણ આપે છે ? બહારની સગવડ-અગવડ નહિ. ભૂખ્યા થયા અને ગરમાગરમ રોટલી-દાળ-ભાત-શાકનું ભોજન મળ્યું. ત્યાં ખુશી થયા પણ એ જ વખતે ખૂણામાં ચટણી-ફરસાણ દેખ્યા કે જે પીરસવાનું સામા માણસ ભૂલી ગયા હતા કે પીરસ્યા નહોતા ત્યારે જટ મનને સંતાપ થાય છે, આનંદ ઉડી જાય છે કેમ આમ ? ગરમાગરમ રોટલી વગેરેને આનંદનું કારણ માનેલું તે તો મળ્યું જ છે પછી આનંદ કેમ ઉડી ગયો ? કહો આનંદ એના ધરનો હતો જ નહિ; નહિતર એ છતાં આનંદ ઉડે શાનો ? ત્યારે સંતાપ પણ પેલા ચટણી-ફરસાણ ન પીરસાયાનો હતો જ નહિ; કેમકે ત્યાં જ જો સામા માણસ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

ખુલાસો કરે કે ‘શું કરું ?’ આ તમારા માટે સાલમપાક બનાવવાની ચિંતામાં આ પીરસવાનું ભૂલી જવાયું.’ અથવા ‘તમારા ચાર મેમાન આવવાના છે એમના માટે આ રાખી મૂક્યું છે,’ તો ત્યાં સંતાપ સુકાઈ જાય છે. કેમ એમ ? સંતાપના કારણભૂત એ વસ્તુ ન પીરસાયાનું તો ઉભું જ હતું, પછી સંતાપ કેમ મટી જાય ? કહો, સંતાપ એના ધરનો હતો જ નહિ.

તો સવાલ આ છે કે માનેલો આનંદ અને સંતાપ શાના લીધે છે ?

જવાબ આ છે કે જીવનમાં કામ-કોધ-લોભ, માન મદ હર્ષ એ છે, અંતરંગ શાનું તકલાદી આનંદ અને સંતાપ કરાવ્યા કરે છે; અને એથી જ જીવ ખરેખર સુખી નથી. ખરેખર સુખનો અનુભવ કરવો હોય, તો એ તકલાદી આનંદ સંતાપને હેઠા મૂકવા જોઈએ, અને એ હેઠા મૂકવા હોય તો કામ-કોધ વગેરે છ અંતરંગ શાનું પરવશતા કાઢી નાખવી જોઈએ.

જુઓ કામવાસનાની પરવશતા હશે તો ધીભર એમ લાગશે કે ‘આ પત્ની મને કેવો સરસ આનંદ આપી રહી છે !’ પરંતુ પાછું પોતાના મનમાન્યા ચાળા એ નહિ કરે તો સંતાપ થશે કે ‘આ તે કેવી બુદ્ધુ છે !’ એમ કોધની પરવશતામાં સામા પર કોધની ખાજ ઉતારતા આનંદ થશે કે ‘કેવો હું એને દબડાવી રહ્યો છું !’ પરંતુ સામેથી કોઈ જોરદાર પ્રત્યાધાતો આવતા કે પાછળથી એ ભારે રીસાઈ જતા મનને ખેદ થશે કે મેં આના પર આટલો બધો કોધ શા સારુ કર્યો ? કામ અને કોધ જ જીવને તકલાદી આનંદ સંતાપ કરાવ્યા કરે છે, વસ્તુ સાથે બહુ નિષ્બત નથી હોતી.

એમ લોભની પરશતામાં જીવ કાંક મનમાન્યું લેવા દોડે છે, અને મળવાની સંભાવનામાં આનંદિત થઈ જાય. પરંતુ પછીથી ન મળે યા ધાર્યા કરતા કાંઈક ઓછાપવાનું મળે, કે મેળવતા બહુ મહેનત, બહુખર્ય કે કાંઈક અપમાન-તિરસ્કાર સહવાનું કરાવે ત્યાં સંતાપ થાય છે.

એમ, માન મેળવવાની લાલસામાં કંઈક અનુકૂળ થવાનું દેખાતાં આનંદ અને સહેજ પ્રતિકૂળ જણાતાં સંતાપ લમાણે ચોંટે છે. અથવા માન તો મળ્યું, પરંતુ બીજું ગુમાવવું પડ્યું તો સંતાપ આવીને ઉભો રહે છે.

ત્યારે મધ્દની પરવશતામાં શું છે ? બળ આવડત વૈભવ વગેરેનો મદ કર્યો, ને ખુશી થયા, પરંતુ અચાનક રોગ વગેરેથી બળ ઘટ્યું, આવડત અટકી પડી, કે વૈભવમાં ધક્કો લાગ્યો, યા ટીપ-ટપ્પા લઈ માગનારા ઉિતરી આવ્યા, ત્યાં સંતાપ સળગી ઉઠે છે.

એમ હર્ષની પરવશતામાં ય ‘અતિ હસવું રોવા માટે થાય’ એ કહેવત

આગળ આવીને ઊભી રહેતા બીજી ન્યૂનતાને સંતાપ ખડો થઈ જાય છે.

સારાંશ આ છે કે આ કામ-કોધ-લોભ-માન-મદ-હર્ષની પરવશતા પડતી મૂકવી જોઈએ. તો જ એના ઘરના તકલાદી આનંદ-સંતાપથી બચી શાંતિ-સ્વર્થતા-સુખ અનુભવાય.

ત્યારે હવે જોઈએ કે એની પરવશતાં કેવી રીતે હટાવાય ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૨૧, તા. ૧-૨-૧૯૬૮

### (૩૭) તકલાદી આનંદ સંતાપ - અંતરંગ શત્રુ કામને દબાવવા માટે

(લેખાંક-૨)

ગયા લેખમાં એ જોયું કે માણસ અંતરંગ શત્રુની પરવશતાથી સુખી નથી, શાંત-સ્વર્થ નથી, કુદ્ર આનંદ-સંતાપમાં હિંડોળા ખાતો રહે છે. તો હવે એ વિચાર કરીએ કે આ અંતરંગ શત્રુઓ કામ-કોધ-લોભ-માન-મદ-હર્ષ કેમ દબાવાય ?

પહેલો ‘કામ’; એને દબાવવા આ વિચાર્યા કરવું કે ‘કામની વાસના’ એ મારા આત્માનો સ્વભાવ નથી કિન્તુ વિકાર છે, રોગ છે, એ કાંઈ સહજ ગુણ નથી. નહિતર તો એ વાસના ચોવીસે કલાક કેમ એક સરખી ન ચાલે ? એમ જેને એનું જોસ હોય એ વધારે ગુણિયલ થોડો જ ગણાય છે ? ખરજવાની ખણજ બહુ ખણ્યા પછી ક્ષણવાર તરત શમી જાય, એના જેવો એ વિકાર જ છે. ત્યારે ખણ્યા કરવાથી જેમ ખરજવાનો વિકાર વધે છે. એમ કામવિકાર ભોગથી વધ્યે જાય છે, શાંત થતો નથી. અન્નિમાં લાકડા હોમવાથી જો એ શાંત થાય કે સમુદ્રમાં નદીઓ ભળવાથી જો એ ધરાઈ જાય, તો ભોગથી કામ શાંત થઈ જાય. કામી તૃપ્ત થાય પણ એમ બનતું નથી. આ સંસારમાં અનંતકાળથી જીવ કામ પાછળ ઘેલો બનતો રહ્યો અને અનંતી વાર ભોગ અનુભવી લીધા છતાં આજે કામ વિકાર કામરોગ મટ્યો નથી એ હકીકિત છે. એ સૂચયે છે કે ભોગથી કામ શાંત થાય નહિ.

#### ‘ન જાતુ કામઃ કામાનામુપભોગેન શામ્યતિ’

એ કામ તો બ્રહ્મચર્યની ભાવના અને અભ્યાસથી જ શાંત થતો આવે.

આત્માનું શુદ્ધ સ્વરૂપ નિર્વિકાર છે, વિશુદ્ધ જ્ઞાન-ચારિત્રમય છે, વીતરાગ સ્વરૂપ છે. તો એનો અનુભવ કરવાને બદલે કામ આદિ વિકારોનો અનુભવ કરવાનું કામ જ શું ? ચામડાના ગિલગિલિયાં કે ઈન્દ્રિયોની ખણજ ઊભી કરી એમાં ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૭૫

અને એને બહારના વિષયોથી ઊતારવા ગયા એમાં આત્મા શું કમાયો ? એનામાં તો કુસંસ્કાર ઊલટા દઢ થયા. આ ભૂંકું છે, કેમકે એથી પરલોકમાં એવા હલકા અવતાર અને એમાં કામની ગ્રબળતા તથા અધમ જીવન ચાલે છે.

વાસનાના આવેગમાં મન આ અનર્થની બેપરવાઈ કરવા જાય છે, ત્યાં આ તત્ત્વ વિચારી કામને દબાવવો કે ‘કામ ! જાનામિ તે મૂલં સંકલ્પાત્કિલ જાયસે ન ચાહું તં કરિષ્યામિ, ન ચ ત્વં હિ ભવિષ્યસિ’ ‘હે કામ ! હું તારું મૂળ જાણું છું કે તું વિચારમાંથી જનમે છે. પરંતુ હું તારો વિચાર જ નહિ કરું, ને તુ ખરેખર જનમી શકીશ નહિ,’ આમ એના વિચારને જ ઊઠવા ન દેવો.

બીજું એક ખાસ કરવા જેવું એ છે કે સારા સારા શષ્ટ-રૂપ-ગંધ-સ્પર્શના આકર્ષણ ભર્યા તેમ નરસાના અનુચિભર્યા વિચારને પણ અટકાવવા જોઈએ; કેમકે સર્વજ્ઞના શાસ્ત્ર એવા વિચારને બ્રહ્મચર્ય પ્રતના ઉત્તંધનમાં પહેલું પગથિયું કહે છે, એવી એક જાગૃતિ રાખવી જોઈએ કે મન જડ પદાર્થોની કશી કિંમત ન આંકે અંતરથી રાગ-દેખ કર્યા વિના અલિપ્ત તટસ્થ પ્રેક્ષક રહેવા પ્રયત્ન કરે. મન કહી દે કે ‘જડ ! મારા આત્માની સમૃદ્ધિ સામે તારી કશી જ કિંમત નથી; તું તો ભારે બેડીરૂપ બને છે, અને મને ભવમાં ભટકાવે છે.’

મન પર આવો અંકુશ કેમ આવે ? એવો પ્રશ્ન થાય, ત્યાં આ ચિંતવવાનું છે કે આપણો આત્મા રાજા છે, અને એ અંદરમાં જાણે એક કિલ્વામાં બેસી કાયા-ગાત્રો-ઈન્દ્રિયો-વાણી અને મન પર હક્કમત ચલાવે છે. એના કદ્યા મુજબ એ બધા પ્રવૃત્તિ કરે છે, નિવૃત્તિ કરે છે, પદ્ધો કરે છે. દા.ત. આત્માના ધૂપા આદેશ મુજબ આંખ કંઈક જોવા જાય છે, જોવાનું બંધ કરે છે, અગર એક જોવાનું મૂકી બીજું જોવાનું કરે છે. એમ વાણી કંઈક બોલે છે, બોલતી બંધ થાય છે, યા બોલવાનું ફેરવે છે. પરંતુ બંધ જ આત્માના હુકમ મુજબ. તો એજ પ્રમાણે મન પણ એક વિચારણા ચલાવે છે, એને વચ્ચે બંધ કરે છે, બંધ કરી બીજી વિચારણામાં ચેડે છે; પણ તે આત્માના આદેશ મુજબ જ. તો હવે કરવાનું આ કે મન કામનો વિચાર કરવા જાય ત્યાં અંદરથી આત્મા એને આજ્ઞા કરે કે ‘તું આ વિચાર બંધ કર, અને પરમાત્મા યા કોઈ પૂર્વ મહાપુરુષના જીવનનો વિચાર શરૂ કરી દે. અથવા એવો કોઈ તાત્ત્વિક પવિત્ર વિચાર કરવા માંડ.’ બસ મન એ રીતે બજાવતાં વાસનાનો આવેગ અટકાવાય છે.

આત્મહિતાર્થીએ કામનું જોર દબાવવા એવા એવા વિચાર ઉપરાંત બહુ રસભર્યા કે બહુ સ્વાદિષ્ટ ખાનપાન પર અંકુશ મૂકવો. રાગભરી સ્ત્રીકથા ન કરવી, વિલાસી વાંચન ન કરવું, સ્ત્રીના અંગોપાંગ ચિત્રમાં પણ ન જોવા, સ્ત્રી-જીવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

પુરુષના ગુપ્ત અંગ તરફ દાખિ ય ન નાખવી, કામકીડા યાદ ન કરવી, પરસ્ક્રી પરિચય ન કરવો વગેરે. સાથે ઉત્તમ ચરિત્રો વગેરે વાંચતા રહેવું.

આ બધા ઉપાયોના સેવનથી અંતરંગ શત્રુ કામનું જોર ઘટતું આવે છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૨૨, તા. ૮-૨-૧૯૬૮

## ૩૮ તકલાદી આનંદ અને સંતાપ - અંતરંગ શત્રુ કોધનો નિગ્રહ

(લેખાંક-૩)

માનવ-જીવન સાથે દેવ-ગુરુ-ધર્મનો સંયોગ મળવો એ એક એવી સુંદર પ્રાપ્તિ છે કે એમાં ઊંચી કોટિની સંજ્ઞાન દશા મળો છે, અને તેથી અનંત સંસારમાં ભટકવનારા અંતરંગ શત્રુઓની ઓળખ થઈ શકે છે, તેમજ એમને દબાવવા કચરવાનો ધરખમ પ્રયત્ન ચાલુ રાખી શકાય છે. ત્યાં સુંદર પુરુષાર્થશક્તિ લેખે લાગે છે; એમાંથી ઊંચા લાભ પ્રાપ્ત થાય છે. કીડા-કીડી પશુ-પંખી વગેરેના ભવમાં આ ક્યાંથી થઈ શકે? અરે! મનુષ્ય જન્મ પણ મળ્યો કિન્તુ તે અનાર્થ કુળમાં અથવા દેવ-ગુરુ-ધર્મના સંયોગ વિનાના આર્થ કુળમાં મળ્યો તો ત્યાં ય આ ક્યાંથી થઈ શકવાનું હતું? ત્યાં તો ઉલટું અંતરંગ શત્રુઓના પોષણમાં પુરુષાર્થશક્તિ વેરફી નખાય છે! અને એથી આત્માને દોષોથી ભારેખમ કરી દેવાનું બને છે.

અંતરંગ શત્રુ કામના નિગ્રહની વિચારણા પૂર્વ લેખમાં કરી, હવે અહીં કોધના, નિગ્રહની વિચારણા કરીએ.-

કોધ એવી ભયંકર ચીજ છે કે બીજી સુખસામગ્રી ગમે તેટલી મળી હોય છતાં અંતરમાં કોધ ઉઠ્યો એટલે એ ચિત્તને સંતાપ બળતરા આપે છે. મોટી શ્રીમંતાઈનું સુખ બાજુએ ઉભું રહી જ્યા, અને નાનકડો પણ કોધ ચિત્તને બાળનારો બને છે. આ કેટલી મોટી વિટંબણા? એમાં પાછી ખૂબી એ કે જીવનું જ્ઞાણે કશું વર્ચસ્વ જ નહિ, ચલણ જ નહિ, તે દુનિયાની તુચ્છ વસ્તુ કે મામુલી પ્રસંગ પણ એના સાગર-શા ચિત્તને ડહોળી નાખે છે.

ચિત્ત સાગર જેવું છે. એમાં ક્ષેત્ર કે કાળની મર્યાદા વિનાના અપરંપાર વિષયની વિચારણા સમાય છે. સાગરમાં પાણી કેટલું? એમ ચિત્તમાં વિષયો કેટલા આવે? અવધિ જ નહિ! કેમકે અહીં બેઠા દૂર અતિદૂર સાતમી પાતાળ કે સિદ્ધશિલા યા અનંત યોજનો છેટેના ય અલોકના વિષયને અથવા અનંત કાળ પૂર્વના ય વિષયને વિચારણામાં લાવી શકે છે. જો સાથે રાગ-દ્રેષ્ણના ભાવ નથી તો

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૭૭

એવી અગાધ વિચારણાવાળો પણ ચિત્તસમુદ્ર પ્રશાંત છે, સ્વસ્થ છે. મનમાં કોઈ પણ વિષયની વિચારણા ઉઠી, કિન્તુ જો સાથે રાગ કે દ્રેષ્ણ યા હર્ષ કે ખેદ ન ઉઠવા દીધા, તો ચિત્ત જ્ઞાનો તરસ્થ પ્રેક્ષક, તે શાંતસ્વસ્થપણે નિરીક્ષણ કરશે. પરંતુ દા.ત. પાસે અઠળક લક્ષ્મી કે મોટા સામ્રાજ્યની હુંફ છે. છતાં કોઈ મામુલી બાબત પર ગુસ્સો ઉઠ્યો કે તરત ચિત્તસમુદ્ર ખળભળી ઉઠે છે! ને કેટલીક વાર તો તે કેમે ય શાંત પડતો નથી. માનો કે અતિ ઉમદા પકવાન્નાનું જમણ સામાના સ્વાગતભેર જમવા બેઠા, માપસર જ જમો છો, છતાં પણ કોઈ પાછળથી બોલ્યું કે આને ખાવાનું ભાન નથી તો ત્યાં જમણના ને સ્વાગતના આનંદ દૂર અને ચિત્ત ગુસ્સામાં બળ્યા કરે છે; કોધ આવો ભયંકર છે કે મહાન આનંદના પણ ફૂર્યા ઉરકે છે.

કોધ એથી આગળ વધીને હિંસાના વિચારમાં યા સામાનું બગડવાના કે સામાને સારી રીતે હલકો પાડવાના વિચારમાં ચરી જાય છે, રૌદ્રધ્યાનમાં ચરે છે, ને એથી નરકગતિના પાપો બાંધે જાય છે. ત્યાં પછી પેલી મહા શ્રીમંતાઈ ય બાજુએ ઉભી રહે, કે સારું સંયમ-ચારિત્ર-શાસ્ત્રબોધ પણ બાજુમાં રહી જાય. ન એની શરમ પડે કે ન એ ગુસ્સો અટકાવી બચાવ આપી શકે. ગુસ્સાની આ ભયંકરતા છે.

એટલું જ નહિ પણ ગુસ્સાની વિચારણા બીજા કાર્યને યાવત્ત સારી ધર્મસાધનાને પણ ડહોળી નાખે છે એમાં મોટા ગોટા જ વળવા માંડે.

ઉપરાંત વારંવારના એક યા બીજા નિમિત્તે ઉભા થતા ગુસ્સા જીવની લેશ્યા બગાડે છે, ને એના કુસંસ્કાર ભાવીમાં ભયંકર પીડે છે. ચંડકોશિયાના જીવ સાધુએ આમ સંયમી સાધુ છતાં ચિત્તમાં નાના સાધુની મામુલી સૂચના,- ‘મહારાજ પેલી દટકી મર્યાદાની આલોચના કરો,’- એના પર ગુસ્સામાં ચડ્યા, તો નાના સાધુને ડંકુડી લગાવવાની બગડેલી લેશ્યા પર કુસંસ્કાર લઈને મર્યાદાને એના પર તાપસ તથા સર્પના ભવમાં એને ગુસ્સાના તથા હિંસાની ભાવનાના મોટા ગુણાકાર થયા !! ત્યાં પછી આત્મા પર કેવા જંગી પાપકર્મોના ખડકલા?

કોધ ભયંકર છે. એક વખતના મોટા સંતને પણ કાળાન્તરે ચંડકોશિયા જેવો મોટો શેતાન બનાવે! એકવારના મોટા સુખીને ય પછીથી મહા દુઃખમાં રીબાવે! મહા સુખી બ્રહ્મદત્ત ચક્રવર્તી ગુસ્સામાં મરીને સાતમી નરકના અસંખ્ય વર્ષોના રૌરવ દુઃખમાં જઈ પડ્યો.

માટે આવા કોધની ભયંકરતા વિચારી એને જરાય મચક ન આપવી. સદા ગોખતા રહેવું કે સ્વસ્થ-શાંત અને સ્વચ્છ મન એ જ આપણી સાચી મહામૂડી છે.

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

એ જરાય ન વેડફાવી જોઈએ. આપણા મહાવીર ભગવાને કેટકેટલા ભયંકર ઉપસર્ગમાં ય જરા પણ ગુસ્સો નથી કર્યો; ઉપરથી સામા પર હૈયાના હેત અને દયા ઉભરાવી છે. તો એવા પ્રભુનું આલંબન કેમ નકામું કરું ?

આ વારંવાર ગોખતા રહેવા પછી પણ જો કોધ ઉઠે તો વિચારવું કે (૧) કોધ, મારા બીજા આનંદ અને સ્વસ્થતાને ડોળી નાખશે. (૨) કોધની પાછળ રૌપ્રથ્યાન ને નરકનાં ભાતાં ઊભાં થશે. (૩) કોધથી સંયમાદિ ગુણ ઘવાશે. (૪) ભવાંતરે કોધના ગુણાકાર થશે, એથી ઉગ્ર પાપાચરણ ચાલશે. (૫) કોધ કરવા જતાં વીરપ્રભુનું સુંદર આલંબન મળેલું ફોગટ જશે, તેમ અવસર પ્રાપ્ત ક્ષમા અને દયાની કમાઈ ચૂકાશે. (૬) આપણા કોધથી સામાને ય કોધમાં ઘસડવાનું ને કોધ વધારવાનું નિભિત બનાશે. એથી એ બિચારો અજ્ઞાન પાપના પોટલા બાંધી દુર્ગતિમાં જઈ રીબાશે. (૭) મારું અનિષ્ટ મારા પૂર્વ પાપે બન્યું ત્યાં કોધ કરવો વ્યર્થ છે. એથી ભાવિ અનિષ્ટ લાવનારા નવા પાપ વધશે. (૮) પાપોદયે સામાએ મારું બહારનું બગાડ્યું; પણ હાથે કરીને કોધથી હું મારા આત્માનું શા સારું બગાડું ?

વારંવાર આવી વિચારણાથી અને સત્સંગ-જિનવાણીશ્વરવાણ-સદ્ગ્રાંયનથી તથા મૈત્રી-કૃષ્ણાની ભાવના સતત વહેતી રાખીને, કોધને દબાવી શકાય.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૨૫, તા. ૧-૩-૧૯૬૮

## ૩૬ અંતરંગ શત્રુ લોભ કેમ દબાવાય

(લેખાંક-૧)

પૂર્વ લેખોમાં અંતરંગ શત્રુઓ ‘કામ’ અને ‘કોધ’ કેમ દબાવવા એના પર વિચાર કર્યો છે. હવે ત્રીજા અંતરંગ શત્રુ ‘લોભ’ ને કેમ દબાવવો, લોભની ઉપર શી રીતે અંકુશ મૂકવો, એ વિચારીએ.

એક વાત બરાબર ધ્યાનમાં રહે કે જો પરમાત્મા સાથે સાચી પ્રીતિ જોડવી છે, ને જો નિષ્કામ ધર્મરૂપિ-ધર્મપરિણાતિ ઊભી કરવી કે ઊભી રાખવી છે, તો તે કામ-કોધ-લોભ, માન-મદ-હર્ષ એ છ અંતરંગ શત્રુભૂત મલિન લાગણીઓ નિર્દુંશ વર્ત્યે નહિ બની શકે. એ મેલી લાગણીઓના આવેશમાંથી મનને છોડાવીએ તો જ એ મન પ્રભુમાં અને પ્રભુના ધર્મમાં જોડાઈ શકે.

એટલે જ જેને આ સમજ છે, કે ‘માનવ-મન પ્રભુમાં અને પ્રભુના કહેલા ધર્મમાં જોડવા માટે અને એમાં રમવા માટે જ મળેલ છે. માનવમનથી આ કાર્ય

સુંદર થઈ શકે એવું છે.’ અને આ અનુભવ છે કે “પૈસાના લોભને લીધે મન પ્રભુમાં તેવું નથી જોડાતું; તેથી જ એને બેદ રહે છે અને ચિંતા થાય છે કે ‘આ લોભ કેમ ઓછો નથી થતો ? એને દાબવા મારે શું કરવું ?’ ત્યારે આ અંગે પહેલું તો એ જોવું કે,”

‘મૂળમાં ધનનો લોભ થવાનું કારણ શું ?’

સામાન્ય રીતે (૧) કાં તો સારા સારા સુખ-વિલાસ ભોગવવાની લગની હોય તેથી એ માટે ધનનો લોભ રહ્યા કરે, (૨) અથવા તો લોકમાં હઠારા-ભપકાબંધ રહેવા માટે ધનનો લોભ રહ્યા કરે, (૩) યા તો પૈસાદાર તરીકે, બીજાઓને આંજી શકાય, એમના પર સત્તા અજ્માવી શકાય એટલા માટે ધનનો લોભ હોય, (૪) અથવા તો ધનપરિશ્રદ્ધ પ્રાણભૂત લાગતો હોય એ જ જીવન અને એ જ સર્વસ્વ લાગતું હોય એ કારણે પણ ધનનો લોભ રહ્યા કરે, (૫) યા ભવિષ્યમાં પૈસા ન હોય તો શું થાય ? એ ચિંતાથી ધનસંગ્રહનો લોભ ચાલે.

હવે આમાંથી પોતાને કયું કારણ નડે છે એ શોધી કાઢવું, પછી આ વિચારવું કે

કેમકે (૧) સુખવિલાસની લગનીમાં મોટા ચકવતીની મુખ્ય પદ્ધરાણી મરીને છદ્દી નરકમાં જાય છે. (૨) લોકમાં હઠારાબંધ રહેવાના ચડસામાં આજે કેટલાયને દુન્યવી ફુજુલ ખરચા વધી જઈ સુકૃત-પરોપકાર-પરમાર્થના ખર્ચ ધટી ગયા, ઉરી ગયા, (૩) ધનવાનપણાથી બીજાઓ પર સત્તા અજ્માવવા જતા રાવણને વાલી રાજાથી પછાડ ખાવી પડી અને રામ-લક્ષ્મણાથી વિનાશ વહોરવો પડ્યો. (૪) ધનને પ્રાણ-જીવન-સર્વસ્વ માનવા જતાં મમ્મણ શેઠ સાતમી નરકે ગયો. (૫) ભાવીની ધનની અનુચિત ચિંતાથી ધનનો જ લોભ કર્યે જતાં જીવન આખું ય અધમમાં વેડફાય છે.’

‘માટે મૂળભૂત આ વિલાસ-વટ-સત્તાની લગની અને જાલિમ કૃપણતા ય ભાવિ-ચિંતા પર જ અંકુશ મૂક એટલે પછી ધનનો લોભ બહુ નહિ રહે.’

(૧) એ જ વિચારવાનું કે ‘વિલાસપ્રિયતામાં તો ઈન્દ્રિયો અને મનની પાકી ગુલામી અને સત્તવહીનતા આવે છે. તો હાથે કરીને શા સારું મારે એવા ગુલામ અને સત્તવહીન બનવું ? એવા બનવામાં તો પછી દાન-શીલ-તપધર્મના સત્ત્વ નથી જગતા. ત્યારે સુખવિલાસ ઓછા કર્યા એમાં જીવન કયું અટકી પડે છે ? યા કયું બહુઃખે જીવનું પડે છે ? આ તો થોડો પુણ્યોદય છે એટલે સાધન મળી રહેવા પર વિલાસ સૂઝે છે.’ પણ પછી પુણ્ય ખૂટ્યા પર શું કરીશ ? પછી એ વખતે, પૂર્વની વિલાસની કુટેવને લીધે, સોસાંનું પડ્યો, હાય ને વોય થશે. માટે ‘પાણી

પહેલા બાંધો પાળ’ એ ન્યાયે પહેલેથી જ સુખવિલાસ ઓછા કરવા શું ખોતા ? એની કુટેવને તો પોષવાની નહિ, સોસવાની. એટલે પછી સહેજે સુખવિલાસ ખાતર ધનનો બહુ લોભ કરવાની જરૂર નહિ રહે.

(૨) ત્યારે ઠારા-ભપકાની લગની રોકવા એ વિચારવાનું કે ‘ઠારો રાખીને લોકમાં સારાં દેખાવાની લગની રાખી; પણ તેમાં શું લોકનો ખરેખર જશ મળે છે ? કે લોકમાં જશ તો સારાં સુકૃતોથી મળે છે ? વળી ઠારા લોકવાહવાહ મળવાનું માની લીધું તો પણ એ લોકો આપણું શું ભલું કરવાના હતા ? ઊલંઘની વાહવાહને જ જંખવા જતાં દેવ-ગુરુ-ધર્મની ખરેખરી સેવા અને સુકૃતો ભૂલાય છે, તથા પોતાના આત્માનો માનકષાય દઢ કરવાનું થાય, જે પરલોકમાં ભયંકરતા સર્જ છે માટે લોકવાહવાહની ભૂખ છોડ, ઠારો-ભપકો રહેવા દે, અને એ ખાતર ધનનો લોભ ન કર.’ આમ વિચારી ધનનો લોભ રોકાય.

(૩) ધનના જોર પર સત્તા જમાવવાની લગની રોકવા એમ વિચારવું કે સત્તાની ભૂખમાં તો જંગલી સિંહ-વાધ જેવી કૂરતા અને મદીન્મતતા આવે છે. ત્યાં પોતાના આત્માની હિતચિંતા અને પરલોકનો વિચાર કશો રહેતો નથી; માનવભવે એવું બને એમાં જંગલી પણું કરતા શી વડાઈ ? અને સત્તાની અજમાયશથી અહીં કેટલાની આંતરડી કકળે ? પાપનો બંધ કેવો ? આત્માનું ભાવી કેવું ? અને અહીં શ્રીમંતાઈ તથા સત્તાનું પુણ્ય ખૂટ્યે અહીં પણ કેવો હડ્ધૂત થવાનું ? માટે સત્તાની ભૂખ અને સત્તા માટેનો ધનનો લોભ પડતો મૂકું.’

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૨૬, તા. ૮-૩-૧૯૬૮

૪૦ (લેખાંક-૨)

(૪) ધનનો લોભ જે ધનને પ્રાણ-જીવન-સર્વસ્વ માનવાથી થાય છે, એ માનવાનું અટકાવવા માટે આ વિચાર જોઈએ કે ‘ધન અંતે તો નાશવંત છે, ને તું પોતે અવિનાશી છે, પરલોકગામી છે, ધન છોડીને જનારો છે, તો અવિનાશીએ મમ્મણ શેઠની જેમ નાશવંતને પ્રાણ માનવાની મૂખ્યાઈ શા સારું કરવી ? પ્રાણ તો ધર્મને જ માનવાના હોય કે જે જીવની સાથે લાગીને અક્ષયલક્ષ્મી બને છે. ધન પુણ્યને આધીન હોવાથી પુણ્ય ખૂટ્યાં ધન પર આકમણ ધણાં ! ત્યારે ધર્મને પ્રાણ જેવો માન્યા પછી ગમે તે પરિસ્થિતિમાં ય એને ગુંટવી શકવાની કોઈની ય તાકાત નહિ,’ આમ વિચારી ધનનો લોભ અટકાવાય.

(૫) ધન બચાવ્યું ન હોય તો ભાવીમાં શું થાય ? એજ ચિંતા અને ભય

રહેતો હોય ત્યાં એ વિચારવું કે ‘ધનની રક્ષા પણ પુણ્યને આધીન છે. ધન ભેગું ગમે તેટલું કર્યું છતાં આગળ પુણ્ય ખૂટ્યું તો એ ઊરી જવાનું અને સંગ્રહબુદ્ધિમાં ધનથી સુકૃતો કરવાનું તો પહેલાં જ ઊરી ગયું છે. આમ બે લપદાક ખાવાનું શા સારું કરવું ?’ એમ વિચારી ધનનો લોભ ઓછો કરી નખાય.

સારાંશ, ધનનાં ઉપાર્જન-સંગ્રહ-રક્ષણમાં અઢળક પાપબુદ્ધિ કષાયો અને પાપાચરણ કરવા પડે છે. તથા ભાવી માટે હુંબદ પાપકર્મનો ફેર ખડો થાય છે. ધનને સર્વસ્વ માનવા જતાં ‘દેવ-ગુરુ-ધર્મ એ જ મારી ખરી ચીજ’ એ માનવાનું ભૂલાય છે, માનવભવનું આ ખરું કર્તવ્ય ચૂકાય છે. પછી પરલોકમાં ધન જ વહાલું રહેશે, ધર્મ નહિ; ને ધર્મ વિનાનો પરલોક કેવો ભૂંડો ? આ બધું વિચારીએ તો ધનનો લોભ જતો કરાય.

ધનનો લોભ અટકાવવા પૂર્વ અને આ લેખમાં વિવિધ વિચારણાઓ બતાવી. ત્યારે સવાલ એ થાય કે ‘પણ ધનની આકંશા જ એવી જોરદાર ઊઠે છે કે ત્યાં આ વિચારણાઓ જ સ્ફુરતી નથી; ને અગર વિચાર આવે છે તો તે બહુ નબળા-દૂબળા પછી ધનલોભ કેમ દબાય ?’

આ સવાલનું નિરાકરણ એ છે કે પૂર્વોક્ત વિચારણાઓ મનમાં જગમગતી રહે અને સબળ બની ધન-લોભને દબાવે, એ માટે એ વિચારણાઓ વારંવાર મનમાં લાચ્યા કરવાની ને ભાવ્યા કરવાની છે. વારંવાર એવી વિચારણાઓથી મનને ભાવિત કરવામાં આવે તો જ મન પર એની અસર પડે, મન ધનના લોભથી ઉરનારું બને, અને એથી લોભ કરવા જતાં મન અટકે. નહિતર તો અનાદિના કુસંસ્કારવાણું મન સુખવિલાસ સત્તા આદિ અને ધન તરફ જ કૂદવાનું. શુભ વિચારણાના પ્રવાહથી જ એ કુસંસ્કારો મટી મન શુદ્ધ બને.

બીજું, સત્સંગ, જિનવાણીનું શ્રવણ, અધ્યાત્મનું તથા આધ્યાત્મિક પુરુષોના ચરિત્રોનું વાંચન વગેરે પણ કરવું જરૂરી છે. સાધુ પુરુષોનો સંગ-સમાગમ કરતા રહેવાથી એમના ત્યાગી જીવન અને એના નિર્મણ આનંદની આપણા મન પર છાયા પડે છે. એથી મનને એમ થાય કે ‘અરે ! જો આ સર્વત્યાગથી આટલા મસ્ત રહે છે અને પાપોથી બચે છે. તો પછી હું ધનના લોભમાં એ સ્થિતિએ પહોંચવાનો જ ક્યાંથી ?’ એ તો ધનનો વધુ પડતો લોભ અને સુખ-સત્તાદિના અભખરા ઓદા કરતો જાઉં તો જ એમાં કંઈક આત્માનંદ અનુભવાય, અને એકદિ’ સર્વત્યાગના વીર્યોલ્લાસ જાગો, બહુ સત્સંગથી આમ ધનના લોભને દબાવાનું બને.

મહાપુરુષોના ચરિત્રો વાંચતા રહેવાથી એમણે કરેલા ધનત્યાગના પરાક્રમ નજર સામે આવ્યા કરે, એમણે આદરેલા સર્વત્યાગ પર આકર્ષણ રહે. મનને થાય

કે આવા બુદ્ધિશાળી મહાભાગ્યવંતાઓએ છતાં પુણ્યે પણ ધનના લોભને ફગાવી દીધો. લક્ષ્મીને સાપના ભારા લેખ્યા, તો મારા જેવા પામરે બીજો વિચાર જ શો કરવાનો હોય ? વળી ચરિત્રવાંચનથી એમાં વર્ણવિલી ધનલોભથી થતી પાયમાલીઓ વાંચી વાંચીને ધનની પ્રત્યે ઘૃણા થાય, ધન માટેની કાર્યવાહીઓમાં સેવાતા રકમબંધ દોષ અને પાપોની ભડક લાગે. એથી ધનનો લોભ દબાતો આવે.

એમ ગુરુઓના ઉપદેશનું શ્રવણ અને આધ્યાત્મિક વાંચન કરતાં રહેવાથી (૧) આત્માનું ભાન થાય. જીવ-અજીવ આશ્રવ-સંવર વગેરે તત્ત્વોનો પરિચય રહ્યા કરે; (૨) અદળક પાપબંધ અને ભરપૂર દોષપોષણ કરાવનારા ધનલોભ વિષયતૃણા વગેરે પર ઘૃણા થાય; (૩) નજર સામે માત્ર આ જીવન નહિ પણ એ પછીનો અનંતકાળ આવ્યા કરે અને મનને લાગે કે ‘ધન તો આ એક જીવનને ય સર્વ વાતે સુખી નહિ કરી શકે, ને પરલોકને તો અહીંના થોક પાપો અને પાપી દોષસંસ્કારોથી ભયંકર પાપમય અને દુઃખમય કરી મૂકે છે.’ ત્યારે ધનલોભ છોડી ધર્મસાધના કરાય એ આ અને આગામી અનંતકાળને સર્વ વાતે ઊજજવળ સુખમય કરી દે છે.’

એમ, ધનનો લોભ દબાવવા એવા લોભિયાના ને ધનમાં અંધ બનેલાના સંસારથી દૂર રહેવાનું. એમની વાતો નહિ સાંભળવાની. સંસર્ગ તો નિર્લોભી ધર્મત્માઓનો જ રાખવાનો. વળી દુનિયાના લોભિયા ગાડર-પ્રવાહ સામે નહિ જોવાનું, સમજવાનું કે ‘એ તો અજ્ઞાન અને મૂઢ છે, આત્મભાન વિનાના છે. હું જ્ઞાનીના વચન પામેલો સંજ્ઞાન છું. મારે મહત્વ આત્માને દેવાનું, જડ ધનને નહિ, આ રીતે ધનનો લોભ દબે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૨૩, તા. ૧૫-૨-૧૯૬૮

## ૪૧ પ્રતિકમણ એ મહાયોગ

(લેખાંક-૧)

સાધુ અને શ્રાવકે સવાર-સાંજ અવશ્ય કરવા યોગ્ય પ્રતિકમણની કિયા એક મહાયોગ છે; કેમકે ‘યોગ’ એટલે મોક્ષની સાથે આત્માને યોજ આપે તે. એવા યોગમાં બાધ અને અભ્યન્તર તપ ગણાય. તેમાં આભ્યન્તર તપ ચિદ્યાતો છે; અને આભ્યન્તરમાં પણ ‘પ્રાયશ્રિત’ ને પહેલો નંબર આપ્યો છે. પ્રતિકમણમાં પાપોનું પ્રાયશ્રિત થાય છે; એટલે યોગોમાં તેનો ઊંચો નંબર હોવાથી પ્રતિકમણને મહાયોગ કહી શકાય.

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૮૩

બીજું પણ એક કારણ આ છે કે પ્રતિકમણમાં વિનય, ધ્યાન, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય પણ આવે છે. તેથી પણ એ મહાયોગ છે.

આવા પ્રતિકમણની સાધના શ્રાવક શ્રાવિકાએ પણ રોજ ઉભય ટંક કરવી જોઈએ; જેથી પાપોના પ્રાયશ્રિત થાય.

કેટલાક સમજે છે કે પ્રતિકમણ તો પ્રતધારીશ્રાવક-શ્રાવિકાએ જ કરવાનું હોય; કેમકે એમણે લીધેલા વ્રતમાં અતિચાર લાગ્યા હોય તેની શુદ્ધિ પ્રતિકમણથી થાય.

પરંતુ આ અધુરી સમજ છે. શાસ્ત્રે ‘પરિસિદ્ધાં કરણે...’ એ ગાથાથી ચાર સ્થાન માટે પ્રતિકમણ કરવાનું કહ્યું છે; (૧) પ્રતિષિદ્ધ યાને નિષિદ્ધેલ અર્થાત્ ‘પ્રતિજ્ઞાથી કે જિનવચનથી ત્યાગ થ્યેલાનું કરણ; (૨) કૃત્ય કર્તવ્યોનું અ-કરણ; (૩) તત્ત્વ-માર્ગ-સિદ્ધાન્ત વગેરેનું અ-શ્રદ્ધાન; અને (૪) જિનવચનથી તેમજ જિનોકત માર્ગ તત્ત્વ વગેરેથી વિપરીત પ્રરૂપણા.’ જ્યારે આ ચારે સ્થાને પ્રતિકમણ કરવાનું છે, તો પછી ત્રત નહિ લીધેલ ગૃહસ્થને પણ વર્તવિમાં વાણીમાં યા વિચારોમાં જિનવચનને નિષેધલું આચરણ આવી જવા સંભવ છે; તેમજ જિનાજ્ઞાને ફરમાવેલ કેટલાય કર્તવ્યનું પાલન નથી પણ થતું. ત્યારે રાગ-દ્રેષ, જડવાદ, વિલાસવાદ, આધુનિક વિજ્ઞાનવાદ, ચમત્કારદર્શન વગેરેના જોરમાં આત્માની અંદર ક્યારેક જિનવચન પર અ-શ્રદ્ધા ભલે ક્ષાણવાર પણ થઈ આવવી સુસંભવિત છે, ત્યારે મફતિયા વાતોમાં વિકથામાં કે હોશિયારીના બોલમાં ક્યારેક જિનાજ્ઞાથી વિપરીત બોલાઈ જવાનો પણ અસંભવ નથી. આ જાણ્યે-અજાણ્યે ચારે પ્રકારના પાપ સેવાયે જાય અને પ્રતિકમણ ન થાય તો એ રોજનાં પાપોના ગંજ આત્મા પર ખડકાયે જ ગયે, આત્માની પરભવે દશા કઈ ?

શાસ્ત્ર કહે છે કે જીવને એક દિવસમાં પણ એટલા બધા પાપ લાગે છે કે મોટા મેરુ વગેરે પર્વતો જેટલા સોનાનું દાન કરવાથી પણ એ છૂટે નહિ, એ પાપોનો છૂટકારો પ્રતિકમણથી થાય છે.

રોજ ને રોજ પ્રતિકમણ નહિ કરનારો ગૃહસ્થ ‘આપણો કયાં રોજ પ્રતિકમણ કરીએ છીએ.’ એમ માનીને એવા ભુલાવામાં પડે છે કે પછી અવરનવરેય પ્રતિકમણ કરવાનું રાખતો નથી; ને વિના સંકોચ વાતોમાં હરવા-ફરવા કે આરામમાં સમય વેડફી નાખે છે. ત્યાં પ્રતિકમણ પ્રત્યે ઉપેક્ષા થાય, ‘એ ન કરીએ તો ચાલે’ એમ લાગે, બિનજરૂરી લાગે, એ બનવા જોગ છે ત્યાં પછી સમ્યક્તવ પણ ઊભું ન રહે કે પ્રાપ્ત થાય નહિ.

૮૪

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

પ્રતિકમણ અવશ્ય કરવું જોઈએ. રોજ સવાર સાંજ ન જ બની શકે તો પણ રોજ એક વાર યા રોજ નહિ તો અવરનવર પણ સમય કાઢીને પ્રતિકમણ કરવા યોગ્ય છે. જેથી એની ઉપેક્ષાના ને અવગણનાના પાપથી બચી જવાય, મિથ્યાત્ત્વ લાગવાથી પણ બચી જવાય.

પ્રતિકમણ પાપોના પ્રાયશ્વિત ઉપરાંત દેવવંદન, ગુરુવંદન, વિનય, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, ધ્યાન વગેરેનાં પણ મહાન લાભ મળે છે. પ્રતિકમણમાં પહેલું સામાયિક આવશ્યક કરવાનું હોય છે. એમાં વળી સમભાવ અને અનંતા જીવને અભયદાનનો મહાન લાભ મળે છે. આટલા બધા જંગી મહાલાભો આપનાર પ્રતિકમણમાં આપણસ ઉપેક્ષા કેમ થાય ?

પ્રતિકમણમાં એક વિશિષ્ટ લાભનો હવે વિચાર કરીએ ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૨૪, તા. ૨૨-૨-૧૯૬૮

(૪૨) (લેખાંક-૨)

પ્રતિકમણ એ મહાયોગ કેમ, અને એની આવશ્યકતા કેટલી બધી અગત્યની, એનો વિચાર ગયા લેખમાં કર્યો. હવે એમાં એક વિશિષ્ટ લાભનો વિચાર કરીએ; જેથી આ વિશિષ્ટ લાભ કરવનારા પ્રતિકમણ-મહાયોગને હથવેંતમાં છતાં ન ચૂકીએ.

આ એક હકીકત છે કે ઉચ્ચ માનવ-જીવનમાં આવ્યા છતાં હથયમાં મલિન ભાવો સારી રીતે રમતા અનુભવીએ છીએ; જીવને ભાન નથી કે ‘આ ભાવો ભૂતકળની કાળી કારકિર્દી સૂચ્યવી રહેલ છે, અને ભવિષ્યકળ માટે દુઃખદ દુર્દ્શાની આગાહી કરે છે.’ ત્યારે મલિન ભાવોથી વર્તમાન આત્મદશા તો ભૂંડી જ રહી. આમ શું ત્રણેય ભવો હારી જ જવાના ! કવિ પ્રભુને સ્તવતાં કહે છે.-

‘ધર્મતણે દંભે કરીજ પૂર્યા અર્થ ને કામ;  
તેહથી ત્રણ ભવ હારિયોજ બોધ હોવે વળી વામ  
કૃપાનિધિ ! સુણ મોરી અરદાસ.’

પરંતુ આમ માત્ર રોદણાં રોધે જીવનની બાજુ જીતાય એમ નથી. મલિન ભાવોને હટાવવાનો ભગીરથ પુરુષાર્થ કરવાની અત્યંત આવશ્યકતા છે. એ માટે કાંઈ દિલ બંધ કરી દઈએ એ શક્ય નથી, કેમકે દિલમાં ચૈતન્ય છે, એટલે એ ભાવ વિનાનું બની શકે એમ નથી.

સામાન્યતઃ સંસારી જીવ સાથે મુખ્યત્વા ‘ઔદ્યિક અને ક્ષાયોપશમિક ભાવ ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત’ (ભાગ-૪)

૮૫

સંકળાયેલા જ રહે છે.’ ‘ઔદ્યિક’ એટલે કર્મના ઉદ્યથી થતો આત્મપરિણામ. ‘ક્ષાયોપશમિક’ એ કર્મના ક્ષયોપશમનો આત્મપરિણામ. હવે ૧૦ મું ગુણસ્થાનક ન પામીએ અને એથી પણ ઉપર ન ચીયે ત્યાંસુધી મોહનીય કર્મનો ઉદ્ય ચાલુ જ રહે છે. મોહનીય કર્મના ઉદ્યને લીધે આત્મામાં કોધ-માન-રાગદ્વેષ વગેરે ભાવ જાગતા હોય છે, એ ઔદ્યિક ભાવ છે.’ હવે જો તે તે કોધમોહનીય માનમોહનીય વગેરે કર્મનો ક્ષયોપશમ અર્થાત્ ક્ષય કરીએ તો એથી ક્ષમા વગેરે ભાવ જાગતા થાય અને આ ક્ષમાદિ ભાવ પેલા કોધાદિ ભાવને અટકાવી હે. આમ ભાવ તો આત્મામાં રહે જ પરંતુ સારા શુભ ભાવથી નરસા અશુભ ભાવને દબાવી રોકી શકાય.

એટલે આમ મલિન ભાવોને અટકાવવા માટે શુભ ભાવો જગાવવાનો પુરુષાર્થ કરવો જરૂરી બન્યો. હવે શુભ ભાવ શુભ આલંબને જાગી શકે એટલા માટે જિનમંદિર, ઉપાશ્રય, સાધુસેવા, તીર્થ, શાસ્ત્ર વગેરેનું બહુ આલંબન પકડવાનું છે. અનુભવાય છે કે ઘર, બજાર, બાગ, સિનેમા વગેરે કરતા મંદિર-ઉપાશ્રય વગેરેનો આશ્રય કરવામાં શુભ ભાવો જાગે છે. એવું જ ભૌતિક છાપાં નોવેલ આદિને બદલે ધાર્મિક સાહિત્યનું વાંચન તથા દુન્યવી પ્રવૃત્તિ મૂકી દેવદર્શનાદિ ધાર્મિક કિયામાં જોડાવાથી શુભ ભાવનો અનુભવ થાય છે. એટલે શુભ ભાવો માટે આ બધા આલંબન ખૂબ પકડવા જરૂરી હરે છે.

પ્ર.- ‘હવે મુશીબત આ છે કે આ આલંબનો સેવવા છતાં મલિન ભાવો ભસુક્યાં કરવાનું ચાલુ છે, એવો અનુભવ છે. તો પ્રશ્ન છે કે આને કેમ અટકાવવા ?’

૩.- આ મુશીબતનું કારણ એ છે તે એક બાજુ દુન્યવી પ્રવૃત્તિઓ બહુ થાય છે, બહુ હોંશથી થાય છે. અને બીજી બાજુ શુભ ભાવ જે કરવામાં આવે છે પોંચલા-માંદલા જેવા કરાય છે. માટે અશુભ ભાવોને અટકાવવા મંદ કરવાનો ઉપાય આ, કે દુન્યવી પ્રવૃત્તિઓ ઓછી કરી નાખવી અને એમાંય હોંશ ઘટાડી નાખવા માટે બીજી બાજુ શુભ ભાવોમાં ખૂબ ઉલ્લાસ અને વેગ લાવવો.

આ શુભ ભાવોલ્લાસ માટે પ્રતિકમણની કિયા એ જબરદસ્ત સાધન છે. પ્રતિકમણમાં જિનભક્તિ, ગુરુવિનય, સમભાવ, પાપોનો પશ્ચાત્તાપ, જીવદ્યા, ક્ષમાપના, ઉપશમ, સ્થિર શુભ ધ્યાન, સંલીનતા વગેરે શુભ ભાવોને અવકાશ મળે છે, અને તેમાં ધાર્યા પ્રમાણે વેગ અને ઉલ્લાસ જગાવી શકાય છે. આ લક્ષ્ય જો રાખવામાં આવે તો પ્રતિકમણ શુન્ય કે માંદલા જેવું ન થતાં પ્રબળ ચૈતન્યવંતુ થાય. બાકી હકીકત આ છે કે પ્રતિકમણ એ વિવિધ સૂત્રો અને કિયાભર્યુ હોવાથી

૮૬

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત’ (ભાગ-૪)

એ ઉપરોક્ત અનેકવિધ શુભ ભાવોલ્લાસને જગાવવા માટે ઉત્તમ સાધન છે. માટે જ એ મહાયોગ છે. જિનશાસન સાથે મળેલા માનવજીવનમાં જ આ સુશક્ય છે, તો એ કરવાનું શુભ ભાવોલ્લાસનો અર્થી કોણ ચૂકે ?

સાવધાની આ જોઈએ કે પ્રતિકમણ કરતી વખતે દરેક સૂત્ર-ઉચ્ચારણ અને દરેક કિયા તે તે શુભ ભાવમાં ઉછાળો લાવીને કરવી. એ કરવા માટે એમાં બહુ સરળતા છે. પ્રતિકમણમાં બેઠા એટલે સામાયિકની પ્રતિજ્ઞા કરીને બેઠેલા હોવાથી અશુભને અટકાવી શુભમાં બંધાયેલા છીએ. માત્ર કરવાનું આ કે દા.ત. ‘કરેમિભંતે’ બોલતાં મહાવીર પ્રભુ જેવો મોહને પડકાર અને સમભાવને ઉદ્ઘણતો કરવા પ્રયત્ન રાખવાનો. એમ ‘લોગરસ’ ‘નમુથ્યુણ’ બોલતા જ્ઞાને જીવંત તીર્થકર ભગવાન સામે છે એ રીતે ખૂબ જ ભક્તિભાવ અને ગદ્યગદ પ્રાર્થના-ભાવ ઉદ્ઘણતો કરવાનો, એમ કાયોત્સર્ગમાં મહાવીર પ્રભુના જેવી અડગ તન્મયતા લાવવા ભારે સજાગ બનવાનું. પ્રતિકમણમાં આ રીતના ઉદ્ઘણતા ભાવોલ્લાસ કરાય એથી દુન્યવી પ્રવૃત્તિમાં પણ અશુભ ભાવ મંદ પડતા જાય છે. બસ, આ સધાવી આપનાર પ્રતિકમણ એ મહાયોગ છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૨૭, તા. ૧૫-૩-૧૯૬૮

### ૪૩ આત્મા અને મોક્ષ માટે પ્રમાણ....વિકારોની વિટંબણા (લેખાંક-૧)

કેટલાકને મોક્ષતત્ત્વની શ્રદ્ધા જ નથી થતી. એ કહે છે કે ‘જો સંસાર અનાદિ અનંત કાળથી ચાલ્યો આવે છે, તો પછી એનો અંત જ કેમ થાય ? એ તો જેમ કણ અનાદિનો ચાલ્યો આવ્યો અને ભવિષ્યમાં પણ અખંડ ચાલવાનો, એમ જીવ પર સંસાર પણ શાશ્વત ચાલવાનો.’

ત્યારે કેટલાક વળી કહે છે, ‘મૂળમાં કાયાથી જુદી આત્મા જેવી ચીજ જ નથી, પછી મોક્ષની વાતે ય શી ?’

આ બંનેનો ઉત્તર વિકારોની વિટંબણાને સમજવાથી મળી રહે છે.

જીવને કામ-કોધ-લોભ, માન-મદ, મત્સર-તૃષ્ણા-માયા-મમતા વગેરે અનેક પ્રકારની લાગણીઓ થાય છે એ અનુભવ સિદ્ધ વસ્તુ છે. તો વિચારણીય છે કે આ કામ-કોધાદિ ભાવો કોના ? એ જડ પૌદ્યગલિક કાયાના હોય નહિ, કેમકે કાયા એની એ ઊભી છતાં એ ભાવોમાં પરિવર્તન થયા કરે છે. દા.ત. હમણાં કોઈ

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૮૭

ખાનપાનપર રાગ થયો પણ ત્યાં જો કોઈ વેપારની વાત આવી તો તરત પેલો રાગ હટી જઈ એ નફાદાયી વેપારનો રાગ ઊભો થાય છે. અહીં કાયાના હડા-માંસ-લોહી વગેરે તો એના એજ ઊભા છે. તો આ રાગનું પરિવર્તન કોનામાં થયું ? એમ રાગ મટીને અહંત્વ આવે કે મમતા આવે, તો એ અનુભવનાર કોણ ? એ ભાવ કોના ધર્મ ? કોની ખાસિયત ? કહેવું જ પડે કે આત્માના. એક રાગ છુટી જઈ બીજો રાગ જાગે, યા રાગને બદલે અહંત્વ કે દ્વેષ વગેરે જાગે, એ કાયામાંની ઘડભાંગ નથી. લોહી અને ધાતુઓના ફેરફાર એ તો કાયામાંની ઘડભાંગ ખરી; પણ આ ફરતા ફરતી લાગણીઓ એ કાયામાંની ઘડભાંગ નહિ; કેમકે કાયામાં એ વખતે કશો ફેરફાર નથી. તેમજ આ ભાવો ચૈતન્યમય છે. ચૈતનારૂપ છે. એ જડ માટી જેવી કાયાના કેમ હોઈ શકે ? કાયાના નથી તેથી તો મૃત કાયામાં લેશ પણ એ હેખાતા નથી.

માટે સિદ્ધ થાય છે કે એ ભાવો ને એ લાગણીઓ આત્માની છે. અને આત્મામાં એના ફેરફાર થયા કરે છે. ફેરફાર થવાનું કારણ આત્માના તેવા કર્મના ઉદ્ઘોમાં ફેરફાર થાય છે. અને આત્માનો તેવો તેવો સત્ત-અસત્ત પુરુષાર્થ રહે છે એ છે.

હવે પ્રશ્ન એ રહે છે કે કામ-કોધ-રાગ આદિ ભાવો ભલે આત્માના હો, પરંતુ એ તો અનાદિના ચાલ્યા આવે છે તો એનો અંત જ કેવી રીતે શક્ય હોય ? એ નહિ તો મોક્ષ પણ થાય જ કેમ ?

આનો ઉત્તર સરળ છે, આપણો અનુભવ છે કે કામ કોધ વગેરે ભાવમાં આપણો ફેરફાર કરી શકીએ છીએ. દા.ત. હમણાં કશું લેવાનો લોભ જાગ્યો, પણ એમાં ભય દેખાતાં એ લોભ શમી જાય છે. હસવાનો ભાવ જાગ્યો પણ તાત્ત્વિક વિચાર આવતા એ અટકીને ગાંભીર્યનો ભાવ ઊભો થાય છે.

આમ રાગ-દ્વેષ, કામ-કોધ-લોભ વગેરે ભાવોને ઓછા કરવા હોય, મંદ બનાવવા હોય, કે સતેજ કરવા હોય, તો કરી શકીએ છીએ, એવો આપણો અનુભવ છે. વળી કેટલીકવાર એને તદ્દન અટકાવી પણ શકીએ છીએ. દા.ત. કોઈ માણસની ઉપર ભિત્ર તરીકે રાગ ઊભો થયો, પણ પછીથી એનામાં નીતરતી સ્વાર્થસાધુતા અને કપટ વૃત્તિ દેખાઈ, તો પછી એના પરથી રાગ તદ્દન ઊઠી જાય છે. રસ્તે જતી સ્ત્રી પ્રત્યે કોઈને કામની વાસના જાગ્યી અને ચાળો કર્યો, પણ ત્યાં જો પેલી ચંપલ કાઢીને આને ઢોકે છે તો આ અપમાનનો ભાવ જાગતા કામની લાગણી ઊતરી જાય છે. શેઠ પર ગુસ્સો જાગ્યો, પણ શેઠ ન ધાર્યું સારું બોનસ પરખાવતાં એ ઊતરી જાય છે.

૮૮

ભુવનભાનુ અન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

તात्पर्य જો આ કામ-કોધાદિ ભાવો અમુક કાળ માટે પણ ઓછા વધતા થાય છે, યા અટકી ય જાય છે, તો પછી ઉત્તમ વિચારણા, ઉત્તમ ભાવના અને સત્તસંગ તથા વીતરાગ પરમાત્માના વીતરાગ નિર્વિકાર સ્વરૂપનો જ્યાલ ચિંતન વગેરેથી એ કામ-કોધાદિ ભાવો સંદર્ભ અટકી જાય નાચ થઈ જાય, એમાં નવાઈ નથી. એમ થતાં મોક્ષ પ્રાપ્ત થાય એ યુક્તિયુક્ત છે.

માત્ર સમજવું જોઈએ કે ‘રાગ દ્વેષ વગેરે એ આત્માના વિકારો છે, અને એમાં આત્માની વિટંબણા છે. શા સારુ મારે આ વિટંબણા ભોગવવી ? સારું-નરસું તો ભાગ્યાનુસાર બને છે. ત્યાં રાગ દ્વેષ કરવાથી નથી તો સારું ટક્કું, નથી નરસું ખસતું. પછી ફોગટિયા રાગ-દ્વેષની વિટંબણા શા માટે ? મૂકો એ લપ, અને ઉદાસીન નજર રાખવા દો.’

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૨૮, તા. ૨૨-૩-૧૯૬૮

(૪૪) (લેખાંક-૨)

ગયા લેખમાં એ જોયું કે રાગ દ્વેષાદિ લાગણીઓ પર આત્મા અને મોક્ષ સાબિત થાય છે. તેમજ રાગાદિને વિકારો સમજી તથા આત્માની એમાં વિટંબણા દેખી એ વિટંબણા હવે ચલાવી લેવાનો નિર્ધાર થાય તો મોક્ષ થવો સુસંભવિત છે. સરળ છે, શક્ય છે.

જીવ અહીં ભૂલો પડે છે કે એ રાગ મમતા કામ આસક્તિ વગેરેને પોતાના વિકાર તરીકે જ સમજતો નથી એટલે જ એ વિકારો અનુભવવામાં પોતે વિટંબણા ભોગવી રહ્યો છે, એ તો સમજે જ શાનો ?

ત્યારે વસ્તુ સ્થિતિ આ છે કે જેમ શરીરે સોજા ચેતે તો શરીર જાંદું, પુષ્ટ દેખાય છે. લાલબુંબ દેખાય છે. પરંતુ તેથી સારું માની રાજ થવાનું નથી કે એના આધારે બડાઈ કરાતી નથી. કિન્તુ એને શરીરનો વિકાર સમજી તેમજ એમાં લોહીનું પાણી થતું સમજી એ હટાવવા વૈદું કરાય છે, ઔષધ-ઉપયાર લેવાય છે, એમ રાગ-મમતા-કામ-આસક્તિ વગેરે એ આત્માના વિકાર છે. એનાથી આત્માનું સ્વાસ્થ્ય અને મનની સ્વસ્થતા હણાય છે. એમાં કાંઈ વડાઈ નથી. બલ્કે નાનમ છે. હલકાઈ છે.

બ્યવહારમાં દેખાય છે કે દા.ત. મેમાન કે જમાઈને ભોજનમાં ઉમદા ચીજો પીરસી ને એ જમે છે, પણ એ વખતે જો એ એના પર બહુ રાગનું પ્રદર્શન કરે તો એ ભૂંડો લાગે છે. જ્યારે એમ ન કરતાં વિવેક અને ગાંભીર્ય રાખી જમી લે.

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૮૮

તો એ સારામાં ડાખ્યામાં ખપે છે; બસ એ રીતે જગતની ચીજવસ્તુ કે બનાવ પર રાગ ન કરીએ અને વિવેક-ગાંભીરતાથી એને પસાર થઈ જવા દઈએ તો શો વાંધો આવે ? ભોગવટામાં કાંઈ ખામી આવતી નથી. રાગ કરો કે ન કરો, એ મીઠી તો લાગવાની જ છે, અને પેટ પણ ભરાવાનું તથા એ પચવાની ય ખરી. ઊલંઘ રાગ-આસક્તિ કરવામાં પછી જ્યારે એ ન મળે કે ઉત્તરતી મળે ત્યારે મનને ખેદ થાય છે. દિલના ભાવ બગડે છે. તો શું આ આત્માની વિટંબણા નથી ?

કોઈને ત્યાં બાર વાગે ગયા, પેલાએ આગ્રહ કરીને જમવા બેસાડ્યા, ભાષામાં તરતનો કરેલો શીરો આવ્યો, ખાતા ખુશી થયા; પણ એટલામાં અંદર નજર પડતા કોઈને શીખંડ-પૂરી જમતો જોયો, તો ઝટ મન બગડે છે. કે ‘હે ? આ આવો દંબી ? પેલાને શીખંડ અને મને પેટિસ જમાડે છે ?’ આ કેમ મન બગડ્યું ? કહો શીરા પર રાગ કર્યો માટે. અધિક રાગની વસ્તુ શીખંડ નજર સામે આવતા મન બગડ્યું, રાગ ન કર્યો હોત, મળ્યું તે જમી લીધું હોત, તો મન ન બગડત; અને શીરો મીઠો તો લાગત જ, તેમજ શરીરને પુષ્ટ ય કરત. મફતિયો રાગ વચ્ચે લાવવાથી ટકાવારી કરતા વિટંબણા ભોગવવી પડે છે.

ત્યારે રાગ મમતા આસક્તિ કામ વગેરેના વિષયોમાં ટકાવારી તો રહેવાની. વિષમ સંસારમાં સમતા સરખાઈ ક્યાંથી મળવાની ? કોઈ વિષય ઊંચો, કોઈ નીચો; કોઈ સામાન્ય સારો તો બીજો એથી અધિક સારો; તો ગ્રીજો વળી એથી ય વધુ સુંદર એમ તરતમતા રહેવાની. હવે જો ક્યાંય રાગ આસક્તિ કરવા ગયો તો બીજા ઉત્તરતા પર અરુચિ અને ચચિયાતા વિષયને જોઈ આ પ્રાપ્ત પર ખેદ થવાનો. આ શું વિટંબણા નથી ? જગત અને ભાગ્ય તો એના રાહે કામ કર્યે જાય છે. પણ જીવરામ પટેલ ફોગટિયા રાગાદિ કરી કરીને મફતનો ઝૂટાય છે, વિંબાય છે. પત્ની પર કામની દણિએ નજર નાખ્યા કરે તો એના છણકવા પર ખેદ થશે અને બીજી સ્ત્રીઓના ચડતા-ઉત્તરતા રૂપ-રંગ જોવા પર તુલના કરી મન બગાડશે. આ ભારે વિટંબણા જ છે.

માટે સમજવું જોઈએ કે જીવન તો ભાગ્યાનુસાર જ મળતી સારી નરસી વસ્તુ પર નભવાનું છે; તો એમ નભાવી લેવું એ ઠીક છે; પરંતુ એમાં મફતિયા રાગ-દ્વેષ કામ-કોધ મમતા-તૃષ્ણા મદ-ઈઞ્ચર્ય વગેરે કરવા એ તો વિકારો છે. રોગો છે, અને એથી આત્માની વિટંબણા છે. શા સારુ હાથે કરીને આ વિટંબણા વહોરવી ? ઉહાપણ એ છે કે મન બળ્યું અને વિવેકી બનાવી એ વિકારો અને વિટંબણાથી બચ્યું. એમ બચી જતા આત્મધ્યાન અટકે છે, અને ધર્મધ્યાન ખૂલે છે, તથા પરમાત્મા સાથે મિલન શરૂ થાય છે.

૮૦

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

## ૪૫ આજના માનસમાં ભૂત : સર્વ ધર્મ સમાન ?

કાળ પડતો આવ્યો છે, એટલે સન્માર્ગની મતિમાં પણ ભંશ થતો આવતો દેખાય છે. એના લીધે આજના માનસમાં કેટલીય અજ્ઞાન માન્યતાઓનાં ભૂત ધૂસી ગયા છે. જેવા કે ‘ધર્મ બધા સરખા છે, માટે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખો.’ ‘કોઈપણ ધર્મને બૂરો કહેવાય નહિ, બૂરો કહેવો એ અધમતા છે.’ ભગવાને નિશ્ચય-વ્યવહાર બે કહ્યા છે તેથી ધર્મ પણ ખરો અને સંસાર વ્યવહાર પણ ખરો.’ ‘છોકરાને કે કોઈને બળાત્કારે ધર્મ ન કરાવાય.’

હવે આ માન્યતાઓમાં કેવું અજ્ઞાન છે, તે જોઈએ.

‘સર્વ ધર્મ પર સમભાવ રાખો.’-આ કહેવાનો અર્થ તો એ થાય કે ‘ધર્મ ગમે તે હોય,-ઈદના દહાડે ધર્મના નામે લાખો બકરા કાપી નાખનારાનો ધર્મ હો, કે યજ્ઞ-યાગાદિમાં બકરા-અશ્વ વગેરેની આહુતિનું વિધાન કરનારો વૈદિક ધર્મ હો, અથવા ધર્મના નામ હેઠળ મરધા-બકરાના બલીદાન દેનારો દેવીધર્મ હોય, યા વ્યલિયારાદિને પાપરૂપ ન કહેનારો પાશ્વાત્ય ધર્મ હો-પરંતુ એવા બધા ધર્મ અને સૂક્ષ્મ અહિસા-સત્ય-બ્રહ્મચર્ય વગેરે સુધીના વિધાન કરનાર સમ્યગ્ ધર્મ.’ એ સર્વ પ્રત્યે સમભાવ સમદાચિ રાખો અર્થાત્ એ હિંસાદિવાદી ધર્મ અને અહિસાદિવાદી ધર્મ બધા સમાન છે એ દૃષ્ટિથી જુઓ.’

હવે વિચારવા જેવું છે કે શું આ બધાને સમાન ગણવાનું વ્યાજબી છે ? શું ગોળ અને ખોળ સરખા ? કાચ અને રત્ન સરખા ? કથીર અને કંચન સરખા ? હજુ આ વસ્તુઓ પ્રત્યે તો વૈરાગ્યભાવે સમબુદ્ધ રખાય. પરંતુ શું ધર્મ પ્રત્યે વૈરાગ્યભાવ રખાય ? તો તો પછી જેમ હિંસા-અસત્ય પ્રત્યે રાગ રખાય નહિ, એમ અહિસા-સત્ય પ્રત્યે રાગ રાખી શકાય નહિ ! અથવા અહિસાદિ પર દ્રેષ અરુચિ નહિ, એમ હિંસાદિ પ્રત્યે પણ દ્રેષ ન રાખી શકાય ! ‘સમભાવનો’ અર્થ જ આ કે રાગ નહિ, દ્રેષ નહિ. ત્યારે આવેશથી પ્રશ્ન કરે છે,-

પ્ર.- પણ શું કોઈ પણ ધર્મ પ્રત્યે દ્રેષ રખાય ? ધર્મને બૂરો કહેવાય ?

ઉ.- આ આવેશ ખોટો છે. ધર્મ એ કોઈ જીવ્યક્તિ નથી કે એના પ્રત્યે દ્રેષ-અરુચિ રાખવી એ ખરાબ કહેવાય. ખરી રીતે તો જેમ હિંસા-અસત્ય-વૈરાગ્યા આદિ દુર્ગુણો પ્રત્યે અરુચિ નફરત હોય તો જ અહિસા સત્ય-મૈત્રી વગેરે

સદ્ગુણો ઉપર સહેજે સાચી રુચિ પક્ષપાત રહેવાનો; એમ હિંસાદિવાળા ધર્મ ઉપર અરુચિ અનાસ્થા હોય તો જ સહેજે અહિસાદિવાળા ધર્મ પ્રત્યે રાગ પક્ષપાત રહે.

વીતરાગ બનેલા આત્માઓ રત્ન અને કાચ પ્રત્યે સમભાવ રાખવા છીતાં એના ગુણ દોષ તો સમજે છે ! એમ હિંસા-અહિસાના ય ગુણ-દોષ પણ સમજે જ છે. સમભાવથી એ રાગ-દ્રેષ ન કરે, કિન્તુ ગુણ-દોષ ન સમજે એવું નહિ. ઊલટું કાચને અલ્ય રાગનું નિમિત્ત સમજી એને ઓછો મારક સમજે છે. તો શું આપણે સર્વધર્મ-સમભાવ રાખી હિંસાદિ ધર્મને ઓછા મારક સમજવા ?

કોઈ વક્તિને આપણે બૂરી ન કહીએ; પણ એનામાં રહેલ ગુંડાગીરી બદમાશી વગેરેને બૂરી માનવામાં કોઈ વાંધો જોતા નથી, તો પછી ધર્મ એ કોઈ જીવ્યક્તિ નથી તો હિંસાદિવાળા ધર્મને બૂરા અર્થાત્ મારક માનવા-કહેવામાં શો વાંધો ?

માટે જ જેમ ધાસ પ્રત્યે દ્રેષ ન હોય છીતાં ધાસને સોનાની અપેક્ષાએ અકિમતી તરીકે કે અજિની સામે ન ટકી શકનાર તરીકે ઓળખવા કહેવામાં અધમતા નથી. એમ હિંસાદિવાળા ધર્મને અકિમતી કે તર્કની અજિની પરીક્ષામાં ન ટકી શકનાર તરીકે માનવા-કહેવામાં અધમતા નથી.

ખરી રીતે અહિસા-સત્ય આદિનો જો રાગ-પક્ષપાત હોય તો સહેજે હિંસાદિ પ્રત્યે નફરત-અનાસ્થા આવી જ જાય. અથવા અહિસાદિનો રાગ ઊભો કરવા માટે હિંસાદિની નફરત કેળવવી જ જોઈએ, તેમ હિંસાદિને કહેનારા ધર્મ પ્રત્યે પણ નફરત કેળવવી જ પડે. નિશાળનો કોક માસ્તર જો માબાપ સામે સ્વચ્છંદતા ઉદ્ઘાટિ શીખવતો હોય તો એ દુર્ગુણની જેમ એ શીખવનાર માસ્તરની પ્રત્યે પણ નફરત થાય છે, તો પછી હિંસાદિ શીખવનારા ધર્મ પ્રત્યે પણ નફરત કેમ ન થાય ?

આ જો બરાબર સમજાય તો સમજાશે કે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખવાનું કથન અજ્ઞાનતાભર્યું છે.

## ૪૬ (લેખાંક-૨)

આજના અજ્ઞાનતાભર્યી માનસનું એક ભૂત ‘સર્વ ધર્મ સમાન;’ એ કેમ ખોટું જોયું. હવે એવું એક બીજું ભૂત છે. ‘ભગવાને નિશ્ચય અને વ્યવહાર બે ય કહ્યા છે. માટે નિશ્ચયથી ધર્મ ખોટો નહિ અને વ્યવહારથી સંસાર ખોટો નહિ’ એ કેમ ખોટું છે એ જોઈએ.

ભગવાને નિશ્ચય વ્યવહાર બે ય કહ્યા છે એ વાત સાચી. પરંતુ પહેલાં તો એ સમજવું જોઈએ કે નિશ્ચય અને વ્યવહાર શી ચીજ છે ?

નિશ્ચય અને વ્યવહાર એ વસ્તુની બે બાજુ છે, બે અંશ છે, બે દણિ છે. એ દરેક વસ્તુને લાગુ પડે. અને વસ્તુ-વસ્તુએ એ અલગ-અલગ હોય. દા.ત. નિશ્ચય ધર્મ અને વ્યવહાર ધર્મ. નિશ્ચયપાપ અને વ્યવહાર પાપ; નિશ્ચયજીવ ને વ્યવહારજીવ; નિશ્ચયથી ગુણસ્થાનક અને વ્યવહારથી ગુણસ્થાનક, નિશ્ચય સંસાર ને વ્યવહાર સંસાર.

‘નિશ્ચય’ એટલે વસ્તુનું આંતરિક સ્વરૂપ, અને ‘વ્યવહાર એટલે એનું બાધ્ય સ્વરૂપ, વ્યવહાર યોગ્ય સ્વરૂપ. આ હિસાબે જોતાં જીવમાં નિશ્ચયથી ધર્મ એટલે એનું પ્રગટતું આવતું શુદ્ધ આંતરિક અહિસકભાવ-ઉપશમ-ઉદાસીનતાદિ સ્વરૂપ. ત્યારે વ્યવહારથી ધર્મ એટલે તે તે ધર્મ તરીકે વ્યવહાર કરવા યોગ્ય બાધ્ય ત્યાગ ક્રમા, અહિસા વગેરેની પ્રવૃત્તિ. હવે અહીં એવું બને કે નિશ્ચયથી અહિસા હોય ને વ્યવહારથી ન હોય.’

જેમકે કેવળજ્ઞાની વીતરાગને અંતરમાં મુદ્દલ હિંસાનો ભાવ નથી; અહિસકભાવ છે, પરંતુ ચાલતાં ક્યારેક એમના પગ નીચે અવશ્ય ભાવી કોઈ જીવ કુદ્દો આવે અને જીવમરણ થઈ જાય ત્યાં બાધ્ય વ્યવહારથી હિંસા છે, છતાં અંતરમાં અહિસાનું સ્વરૂપ છે. એથી ઉલ્લંઘ સામાન્ય જીવને ચાલતા બાધ્ય કોઈ જીવની હિંસા ન ય થઈ તો બાધ્યથી અહિસા છે, પરંતુ ચાલતા જો ડાફોળિયા મારતો અગર બીજા-ત્રીજા ઈન્દ્રિય વિષયોના વિચાર કરતો ચાલે છે તો અંતરથી અહિસક પરિણામ નથી. એટલે ત્યાં નિશ્ચયથી હિંસા અને વ્યવહારથી અહિસા કહેવાય.

એમ વ્યવહારથી હું સાધુનું ગુણસ્થાનક ત્યાં ગણાય. જ્યાં સાધુયર્થ બરાબર પળાતી હોય, તપ-પરીસહ-સહન વગેરે કરતા હોય; ત્યારે નિશ્ચયથી ત્યાં ગણાય કે જ્યાં અંતરમાં ત્રાણ કષાય-ચોકડીનો ક્ષયોપશમ હોય, જીવ રાગોપશમ દ્વ્યોપશમ વગેરે નિજ ગુણમાં ઢરતો હોય.

શેઠ સામાયિકમાં બેઠા જોડા સામે જોતા હતા, તે જોઈ પુત્રવધુએ બહારના આગન્તુકને કહ્યું ‘શેઠ મોચીવાડે ગયા છે.’ સામાયિક પૂરું થયે ‘શેઠ પૂછતાં વહુએ કહ્યું તમે વ્યવહારથી ધર્મકિયામાં છતાં નિશ્ચયથી પાપમાં હતા, કેમકે મનમાં જોડો સંધાવવા મોચી સાથે રક્જકના વિચારમાં હતા.’

ગુણસાગરને લઘનની ચોરીમાં કેવળજ્ઞાન થયું, ત્યાં વ્યવહારથી પાણિગ્રહણની પાપકિયા હતી, પરંતુ નિશ્ચયથી તો ઊંચા ઊંચા ગુણસ્થાનકે ચડવાનો ધર્મ હતો.

એમ વ્યવહારથી મોક્ષમાર્ગ જ્ઞાનાચાર આદિ પંચાચારનાં પાલનને કહેવાય, અને પરમ નિશ્ચયથી મોક્ષમાર્ગ અંતિમ ૧૪ મા ગુણસ્થાનકની શૈલેશી દર્શાને કહેવાય, તથા અશુદ્ધ નિશ્ચયથી મોક્ષમાર્ગ તે તરફ લઈ જનારી આંતરિક જ્ઞાનાદિ-સાધનાની પરિણતિને કહેવાય.

નિશ્ચય અને વ્યવહાર એ વસ્તુને જોવાની દણિ છે. તેથી ધર્મ વસ્તુને નિશ્ચય-દણિએ જોતા આંતરિક ધર્મ પરિણતિ લેવી પડે; એ જ નિશ્ચય ધર્મ; અને વ્યવહાર દણિથી જોતાં બાધ્ય ધર્મ-આચાર લેવો પડે; એ જ વ્યવહાર ધર્મ. આ રીતે વિચારતા સાંસારિક આરંભ સમારંભ-વિષયો-પરિગ્રહ-કુટુંબમમત્ત્વ વગેરેની પ્રવૃત્તિને વ્યવહારધર્મ શી રીતે કહેવાય ? એ તો સરાસર પાપપ્રવૃત્તિ જ છે, ધર્મપ્રવૃત્તિ નહિ.

હજી વ્યવહારથી પાપ અને નિશ્ચયથી પાપનો વિચાર કરીએ તો કહેવાય કે એ આરંભ-સમારંભાદિ સાંસારિક પ્રવૃત્તિઓ એ વ્યવહારથી પાપ છે, અને બાધ્યથી સામાયિકાદિ ધર્મ પ્રવૃત્તિમાં છતાં અંતરમાં એ આરંભાદિના પરિણામ છે તો એ નિશ્ચયથી પાપ છે. પરંતુ ધર્મપ્રવૃત્તિ અને પાપપ્રવૃત્તિના બે વિભાગ તો અલગ જ નિશ્ચિત છે માટે ‘ધર્મ એ નિશ્ચય અને સંસાર એ વ્યવહાર’ આ માન્યતા ખોટી છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૩૧, તા. ૧૨-૪-૧૯૬૬

(૪૭) (લેખાંક-૩)

પૂર્વે કહ્યું તેમ વર્તમાન કાળના જડવાદે જીવને એવા પ્રભાવિત કરી દીધા છે કે એમના માનસમાં આ પણ એક માન્યતા બેસી ગઈ છે કે ‘કોઈને ધર્મ પરાણે ન કરાવાય,’ અથવા આ માન્યતા કે ‘સંતાનને ધર્મ પરાણે ન કરાવાય.’

ખૂબી તો પાછી એ છે કે સંતાનના જીવનમાં દુન્યવી તો કેટલીય વસ્તુઓ સહેજે નહિ તો પરાણે દાખલ કરવામાં આવે છે. દા.ત. નાનું બાળક કદાચ રોકવા છતાં પૂર્વના તેવા સંસ્કારવશ હાઠિલું થઈ પોતાની અશુદ્ધિમાં હાથ ઘાલતું હોય, નાકનાં ગૂગા મોંમા મૂકી દેતું હોય, કે ગાદી પર જ પેશાબ કરતું હોય, તો એને તમાચા મારીને પણ પરાણે એ અટકાવી સારી ટેવ પાડવામાં આવે છે. શા માટે ભાઈ ! આ પરાણે કરાવવું ? તો કહે છે, ‘ન કરાવીએ તો મોટો થયે એ કુટેવથી ઓનું જીવન બગડે.’ તો પછી પાપની કુટેવ પરાણે પણ ન કઢાવી, અને ધર્મ પરાણે પણ દાખલ ન કર્યો, તો એના ભવોભવ નહિ બગડે ?

બાળક નિશાળે ન જતું હોય, તો એને પરાણે પણ ત્યાં ધકેલાય છે; છોકરો

નિશાળેથી ફરવા ભાગી જતો હોય; ને સમજાવ્યો ન સમજતો હોય તો એને પરાણે પણ તેમ કરતો અટકાવીને નિશાળમાં બેસતો કરાય છે.

એમ છોકરો ધરમાંથી પૈસા ચોરી જતો હોય, વાસણ વગેરે ચોરી જઈ વેચી ખાતો હોય, તો એને પરાણે સજા કરીને પણ તેમ કરતાં અટકાવવામાં આવે છે.

એમ છોકરો એદી ને હરામહાડકાનો હોય તો એને પરાણે પણ કામ કરતો કરવામાં આવે છે. છોકરી જ્યાં ત્યાં ભટકવા જતી હોય તો એને પરાણે પણ રોકવામાં આવે છે. છોકરા-છોકરી માતાની સામે ઉદ્ઘતાઈ કરતા હોય તો બાપ પરાણે પણ એની એ કુટેવ ભૂલાવે છે. એ ઘરની વાતની બહાર ચાડી ખાતા હોય તો પરાણે શિક્ષા કરીને પણ એ અટકાવવાનું કરાય છે; માણસ મનગમતી નવી સ્ત્રી પરણ્યો હોય ને એ ગમે તેવી મિજાસી હોય તો ય જુનીના છોકરાને પરાણે પણ એના આશાંકિત કરાય છે.

આવા તો નાના મોટા કેટલાય પ્રસંગ પરાણે કરાવાય છે. તો પછી શું ધર્મ જ ગુનો કર્યો તે એને પરાણે ન કરાવાય ?

સમજવા જેવું છે કે ધર્મ એ અતિશય મહત્વની ચીજ છે. પૂર્વના ધર્મના પ્રભાવે જ આવો ઊંચો માનવભવ અને બીજી પુણ્યાઈસ-સગવડ-સન્માન મળ્યા છે. પરંતુ એ તો ભોગવાઈને ખત્મ થઈ જશે. પછી આગળ શું ? ધર્મ વિના ક્યાં જઈને ઊભા રહેવાનું ?

ધર્મ માટે માનવ-જીવન જ શ્રેષ્ઠ ભૂમિ છે. એમાંય આર્થ માનવભવ ધર્મ માટે બહુ યોગ્ય છે. ધર્મથી જ આ માનવ જીવન પણ (૧) સુંદર બને છે. (૨) સુખશાંતિ ભર્યું લાગે છે, અને (૩) ગુણિયલ બનતું આવે છે.

(૧) ધર્મના પાયામાં જે મૈત્રીભાવ-કરુણા-પરગ્રમોદ વગેરે, અને માગાનુસારિતા-ગુરુજનપુજા-પરાર્થકરણ વગેરે જરૂરી છે. તેથી જીવનમાં સુંદરતા આવે છે. (૨) ધર્મ જે વૈરાગ્ય ઈન્દ્રિયસંયમ, કામકોધાદિનિગ્રહ, તથા પરમાત્મભક્તિ દ્યા-દાન-તપસ્યા વગેરે શીખવે છે, તેથી જીવનમાં આંતરિક સુખશાંતિનો અનુભવ થાય છે. તેમજ (૩) એ ઈન્દ્રિયદમન આદિ અને સાધુસેવા ઉપદેશશ્રવણ વગેરે ધર્મદ્વારા જીવન ગુણિયલ બને છે.

આમ જીવનને સુંદર શાંતિભર્યું અને ગુણિયલ બનાવનાર ધર્મ વિના ચાલે જ કેમ ? એ પણ ધર્મ મોટા ભાગે બાલપણાના ઘડતર દ્વારા આવે છે. પહેલેથી અધર્મી હોય અને મોટી વયે આપમેળે સુધરનાર બને એવા દાખલા તો બહુ ઓછા.

માટે ધર્મના સંસ્કાર છોકરાઓને તો ખાસ આપવા જ જોઈએ. જો એ ન

આપાય તો આજના વાતાવરણમાં છોકરા વડિલનો અવિનય, ઈન્દ્રિયોની ઉચ્છ્રંખલતા, અભિમાન, સ્વાર્થમાયા, વિલાસ વગેરેમાં ફસાવાના ટેવાઈ જવાના; પછી એનામા મોટી વયે એમાં સુધારાની આશા શી ?

એટલે જ પહેલા નંબરમાં એને સમજાવી ફોસલાવીને અને બીજા નંબરે શરમ-બીક-કળ અને બળથી પણ એ વિનયાદિ ધર્મમાં એને જોડવા જોઈએ. શું બચ્ચાને બીજું ઘણુંય પરાણે કરાવાય અને કલ્યાણકારી ધર્મ જ પરાણે ન કરાવાય ?

મૂળમાં ધર્મના ઊંચા મૂલ્ય અને ધર્મથી ઊંચા કલ્યાણ નથી સમજતા; તેથી એ પરાણે આપવાનું ખૂંચે છે. નહિતર ધંધાની કોઈ લાઈન બહુ કમાઈવાળી દેખાય પછી છોકરો ન ઈંચે તો ય કેવો અને એમાં પરાણે પણ જોડવામાં આવે છે ? માટે આજની નવી પ્રજાને કોઈ પણ ઉપાયે ધર્મ દ્વારો જરૂરી છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૩૨, તા. ૧૮-૪-૧૯૬૮

## ૪૮ સંતાપ-ઉદ્ઘેગ ટાળવાનો અદ્ભુત ઉપાય

આજનો માનવસમાજ માનસિક દુઃખોથી બહુ રીબાઈ રહ્યો છે. જાતનું નિરીક્ષણ કરવામાં આવે તો દેખાશે કે દિનભરમાં કેટલીય બાબતોની ચિંતા વિચારણા આવીને મનને સત્તાવી જાય છે. ભલે એ પાયાદાર હશે, પરંતુ એમ તો નબળી પુણ્યાઈના યોગે તેવી તેવી બાબતો ય બનતી તો રહેવાની જ, અને તેવા તેવા અનિષ્ટ પદાર્થો તથા પ્રસંગો આવ્યા ય કરવાના. તો શું જીવનમાં આ બધાના હંદ્યબળાપા સંતાપ અને નિરાશાઓ જ જોયા કરવાની ?

ત્યારે દિલ કેટલીય વાર અરતિ-ઉદ્ઘેગ અને ચિંતા-સંતાપ અનુભવ્યા કરે એમાં શું વળે છે ?

(૧) પહેલું તો લોહી જ ગરમ થાય, અને એ (i) શરીરના ઘણું વીર્યને પાતળું પાડી શક્તિને હશે. વળી (ii) લોહી ઊકળવાથી બળી ઓદ્ધું થતું જાય. એમ (iii) શાનતંતુઓને ઉશ્કેરી ઉશ્કેરી નબળા પાડતું જાય, તામસ ભાવવાળા કરતું જાય. આ તો શારીરિક નુકસાન.

(૨) એનાથી આત્માનું સત્ત્વ હણાતું જાય. બહુ બળતરાવાળા માણસો સારું પરાકર કરવામાં પાછા પડે છે; કેઠ સુધી નિશ્ચયપણે એ પાર ઉતારવા માટે એમની પાસે પૂર્સું સત્ત્વ જ નથી હોતું.

(૩) વળી મન વાતવાતમાં ઉદ્ઘેગ-સંતાપ કરવાની ટેવવાણું હોય તો એ ક્ષુદ્ર બને છે પછી એની પાસે ખમવા યોગ્ય ખમી લેવાની ઉદારતા જ નથી રહેતી; તેમજ ભવ્ય દિલના વિચાર કરવા માટે વિશાળતા જ નથી હોતી.

(૪) વળી ઉદ્ઘેગ-સંતાપની કુટેવથી દણ્ણ દોષવાળી બને છે. જ્યાં ને ત્યાં ન્યૂનતા જ જુએ છે. એથી સામી વસ્તુમાંથી બીજી દણ્ણને સારું લઈ શકાય એવું હોય, પરંતુ એ આના ભાગ્યમાં કયાંથી?

ત્યારે સવાલ છે કે આટલા બધા ખતરનાક નુકસાનો લાવનારી આ ખેદ-સંતાપ-ચિંતા-નિરાશા કરવાનારી આદત સુધારવાનો ઉપાય છે કે નહિ?

હા, અનેક ઉપાય છે. એમાં એક ઉત્તમ ઉપાય આ છે કે આપણા આત્માને પરમાત્મામાં શાતા પરમ શાતા અનુભવતો બનાવવો.

અર્થાત્ પરમાત્માના દર્શન-પૂજન-સ્મરણ-ગુણગાન વગેરે કરતી વખતે અંતરમાં પરમ આલહાદ ઊભો કરવો. દિલ ગદ્દગદ કરવું. અને કલેજે જાણો અમૃત યા ચંદનની શીતલતાનો શેરડો પડે. મનને એમ થાય કે ‘અહા! બસ આ દર્શનમાં આ સ્મરણમાં કેવી મજા આવે છે! કેવી ટાઢક લાગે છે! બીજે કયાં આ પરમ શાતા છે? પરમ શાંતિ છે?’ આમ ચાહીને જીવને એમાં પરમ શાતાનો અનુભવ કરાવવાનો.

આ અનુભવનો વારંવાર અભ્યાસ થવાથી એના એવા સંસ્કાર ઊભા થાય છે કે પછી મનમાં એની સુરક્ષા ચાલે છે. એટલે પછી મામુલી મામુલી વાતવસ્તુના ખેદ સંતાપ નહિ ઊઠે. દિલમાં પેલી પરમ શાતાનો શેરડો પડતો હોય પછી આ ખેદના કારણો વિસાત વિનાના લાગે છે, તેથી એના કારણે ખેદ શું કામ થાય?

પરમાત્મામાં પરમ શાતાનો અનુભવ કરતા રહેવાથી દિલ ઉમદા અને ફોરું બનતું જાય છે. ફોરું થવાથી પછી મોટી આફિતના પણ ભારથી ભારે નથી બનતું. એ તો વિચારી લે છે કે ‘મારી પાસે પરમાત્માની હુંફ એવી છે કે મારે અંદરમાં પરમ શાંતિ છે. આ જે આફિત છે તે તો બહારની કર્મલીલા છે.’

એટલા માટે જ બહારના બહુ માનપાન ને વૈભવ વિષયો મળે તો ય મન ફોરું રહે છે. એ જુએ છે કે ‘આ બહારની ચીજના કશા આનંદ નહિ; કેમકે એ તો ભાડુતી છે, કર્મની ચિંઠાએ ચાલનારા છે. ખરી શાંતિ શાતા તો મારે અંદરમાં વસેલા પરમાત્માની છે. એમના નામસ્મરણની છે. એમના ગુણસ્મરણની છે.’

વાત આટલી કે અંતરમાં આ શાન્તિનો શાતાનો અનુભવ-સ્વાદ ઊભો કરવો જોઈએ. વર્ષો સુધી ગુપ્ત રહ્યા પછી ધંશી એકાએક પ્રગટ થાય તો બાઈને એનામાં કેટલી બધી શાંતિ લાગે છે! એને એમ થાય છે કે ‘હાશ! મારે હવે

મનવિશ્રામ મળી ગયા; મારા અંતરના સગા મળી ગયા.’ એવી આપણે અહીં અનંતકણે પરમાત્મા મળી ગયામાં શાંતિ ઊભી કરવાની છે. પરમાત્માને જ આપણા સાચા મનવિશ્રામ અને અંતરના સગા તરીકે દિલમાં દસાવવાના છે, અને શાતા-શાન્તિનો અનુભવ કરતા રહેવાનું છે.

બસ પછી વીતરાગ પ્રભુમાં આપણા મનને ભારે આલહાદ શાંતિશાતા ઊભી કરી હોવાથી મન એટલું બધુ મસ્ત રહેશે કે બહારના વાંકાચૂકામાં સંતાપ ઉદ્ઘેગ કશું કરવાનું નહિ રહે; તેમ બીજા રોષ-રોફ માયા-કપટ, ઈર્ધા-અસૂયા વગેરે કષાયો સેવવાનું પણ નહિ રહે; કેમકે પેલી શાંતિ-શાતા આગળ આની કશી શાંતિ-શાતા જ નહિ દેખાય.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૩૩, તા. ૨૬-૪-૧૯૬૮

## ૪૬ દિવ્યભૂમિમાં પ્રવેશ કેમ ?

માનવસામાન્યની સ્થિતિ આજે ચિત્તકલેશ અને ધનેષણા-વિષયેષણા-લોકેષણા વગેરે અધમ એષણાઓ ભરી દેખાય છે. તેથી જ મદ-માયા-મત્સરાહિ દોષો ખદબદ્ધતા નજરે ચેડે છે. આ દોષોભરી ભૂમિકા પશુસુલભ છે, એટલે એ પાશવી જ કહેવાય; પરંતુ આજના કાળે જ્યારે બહુધા મનુષ્યોમાં ય આ દોષો વિલસતા દેખાય ત્યારે માનવીય ભૂમિકા પણ આજે પાશવીની સમકક્ષ જેવી લાગે છે. આ હિસાબે વિચારવાનું છે કે તો પછી શું આ જીવનમાં એથી ઉચ્ચ દિવ્યભૂમિકામાં દિવ્યભૂમિમાં પ્રવેશ જ નહિ થાય?

દિવ્યભૂમિ આ હિસાબે મદ-માયા-મત્સરાહિ દોષોથી રહિત હોય ને વૈરાગ્ય-લઘુતા-નિખાલસતા-ગુણાનુરાગ પ્રમોદ મૈત્રી-કરુણા-સેવાભાવ-ગુણોભરી હોય એ માટે ઉપરોક્ત ધનેષણાહિ અને ચિત્તકલેશને દૂર કરાય તો દિવ્યભૂમિમાં પ્રવેશ થયો ગણાય. ત્યારે સવાલ આ છે કે ધનેષણા-વિષયેષણાહિ તથા ચિત્તકલેશ દૂર કેમ થાય?

અહીં પહેલું આ વિચારવા જેવું છે કે આપણને પાશવી ભૂમિકામાંથી બહાર નીકળી દિવ્યભૂમિમાં જવું વિહરવું ગમે છે? ગમે છે, તો એમાં જવું છે ખરું? જો જીવનમાં આનો કોઈ વિચાર જ નથી તો દિવ્યભૂમિમાં જવાના ઉપાયની વાતો ગમે તેટલી મળે, છતાં આપણા માટે નિરૂપયોગી થશે.

પરંતુ એટલું સમજ રાખવાનું છે કે હુનિયાના કેટલાય સ્થાન સ્થિતિ-વેપાર-વહેવાર વગેરે સાચવવાનો વિચાર તો અનાર્ય મનુષ્યો પણ કરીને બેસી રહે છે, પરંતુ એથી નથી તો એમના જીવનમાં સુખશાન્તિ, કે નથી કોઈ આત્મિક ઉન્નતિ. એ તો ધનસંપત્તિ સન્માન છ્ટતાં અનેક એષણાઓ અને અનેક મદ-મૂળ્યાદિ દોષોથી ચિંતા-સંતાપ-આતુરતા-નિરાશા વગેરે માનસિક હુખમાં જ સબડ્યા કરે છે. ત્યાં સંપત્તિ-સન્માન અંકિચિત્કર બને છે.

ત્યારે દિવ્યભૂમિના જીવનની વાત ઓર છે. એમાં એ એષણાઓ અને મદ-મૂળ્યાદિની પીડાઓ નથી, તેથી વૈરાગ્ય-નિર્લોભતા-નિરહંકાર વગેરે ઝગમગતા છે, અને તેથી સુખ-શાન્તિનો પાર નથી. સુખશાન્તિ બાબ્ય પદાર્થોની નથી, કે હુખ-અશાંતિ ય બાબ્યથી નથી. મન એને કેવા નવાજે છે એ પર સુખ-હુખ છે. દિવ્યભૂમિમાં વૈરાગ્યાદિથી મનની ખતવણી જુદી, તેથી મહા સુખશાન્તિ. આ દિવ્યભૂમિ કેમ મળે? એનો એક આવશ્યક ઉપાય આ છે કે ‘મન મોકણું રાખો.’

મન બહારની સારી નરસી વસ્તુના બહુ ભાર ઊંચકે છે, ને એમાં જ ગુંથાયેલું-રોકાયેલું રહે છે, તેથી એ કલેશ અને ભોગેષણા-ધનેષણાદિમાં લીન રહી પશુસુલભ ભૂમિકામાં પડ્યું રહે એમાં નવાઈ નથી. એમાંથી ધૂટ્યા વિના દિવ્ય ભૂમિમાં ક્યાંથી પ્રવેશ કરી શકે? કે એ ભાર કાઢી નાખ્યા વિના મનમાં દિવ્ય ભૂમિકાની વસ્તુ ક્યાંથી પેસી શકે? એ ભાર કાઢી નાખવા મનને મોકણું કરવું ઘટે.

પ્ર.- સંસારમાં બેઠા એટલે સંસારની વસ્તુમાં મન તો ગુંથાયેલું રહે જ ને?

૩.- ના, એવો નિયમ નથી, યા કોઈની બળજબરી નથી કે મન એમાં પકડાયેલું જ રાખવું પડે.

(૧) મોટી કંપનીની દુકાનમાં ચોપડા લખનારો નોકર લે વેચ બધું લખે છે, પરંતુ એનો ને એના નફા-નુકસાનનો કશો ભાર એના મન પર નથી. એને તો પોતાના પગાર સાથે નિસ્બત રહે છે. બાકી દુકાનમાં ચાલતી બધી વસ્તુની નોંધ ભલે કરશો, પણ એનું મન એનાથી મોકણું રહે છે.

એમ અહીં સમજ રાખે કે ‘સંસારમાં મારે તો કર્મકંપનીની નોકરી છે, શેઠપણું નહિ; મને તો મારા પુણ્ય-પાપ પ્રમાણે મળવાનું. બાકીનું મારે પેલા ચોપડા લખનારની જેમ નોંધમાં આવે એટલું જ; પણ મન પર એના ભાર શા માટે રાખું?’ તો મન મોકણું રહી શકે.

(૨) ન્યાયાધીશ આગળ અનેક ફરિયાદોની વસ્તુ આવે છે; એ બધું સાંભળી તોલી ફેસલો આપે એટલું જ, પરંતુ એનો કશો ભાર મન પર નહિ રાખે. તેથી જે કેસ ચાલુ, એનું જ સાંભળો-વિચારે છે. પણ બીજા ચાલેલા કે ચાલવાના કેસોનું નહિ. યાવત્ત ઘરે ગયા પછી એકેય કેસોની વસ્તુઓ મન પર ભાર નહિ. એમ અહીં પણ સમજ રખાય કે સંસારમાં કાળ સ્વભાવ વગેરે પાંચ કારણોના હિસાબે તંત્ર ચાલવાનું. મારે માત્ર નિરીક્ષણ કરવાનું, પણ મનથી અના ભાર શા સારું ઉંચકવા?

(૩) દુશ્મનના ઘરે રહેવું પડ્યું હોય, અને એનું બજાવવું ય પડતું હોય, પરંતુ વેઠ સમજને; તેથી મન પર એનો ભાર કશો નહિ. એમ અહીં સંસારને કર્મદુશ્મનનું ઘર સમજ રહેવાય ને એનું બજાવાય, પરંતુ મન પર એના ભાર નહિ રાખવાના.

સારાંશ, સંસારમાં નોકરી, ન્યાયાધીશપણું કે શત્રુઘરવાસ સમજ રહેવાય, તો મન પર સંસારની વસ્તુના ભાર નહિ રહે, મન મોકણું રહેશે. મનને એમ મોકણું રખાય, તો આપિતમાં કશી વ્યકૃપતા નહિ, એષણાઓના ભાર નહિ, લાભમાં હરાખ નહિ. પછી મદ-માન-મૂળ્યા કશું નહિ એટલે વૈરાગ્ય, મૈત્રી આદિ ભાવ, દેવ-ગુરુ-ધર્મસેવાના રંગ વગેરેની દિવ્યભૂમિમાં પ્રવેશ અને નિવાસ સુલભ બનશે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૮૮-૧૭, અંક-૩૪, તા. ૩-૫-૧૯૬૮

## ૫૦ જિનવાણી-શ્રવણનું મહિત્વ : આજનું મહિનાન કર્ત્વ્ય

આજે દેવદર્શન-દયા-દાનાદિ ધર્મ હજ પ્રવર્તતા દેખાય છે. પરંતુ રોજ જિનવાણી શ્રવણની ઘણી ઉપેક્ષા જોવામાં આવે છે. ત્યારે શ્રી ‘પંચસૂત્ર’ શાસ્ત્રમાં શ્રાવકના અહિસાદિ આણુવતો સ્વીકાર્ય પછી પણ જિનવાણનું સદા શ્રવણ-શ્રાવણ-ભાવન કરવાનું અને એનું પારંત્રય સ્વીકારવાનું કહ્યું છે. આ એટલા માટે જરૂરી છે કે જો હંમેશા જિનવાણી સાંભળતો રહે, સમજતો રહે, હદ્યને એનાથી ભાવિત રંગાયેલું કરતો રહે, પરિણત કરતો રહે અને એનો સ્વીકાર કરી હંમેશા એનું પારતન્ય માથે ધરતો રહે. તો અહિસાદિ પ્રતોના વધુ ને વધુ રહસ્ય વિશેષ વિશેષ પ્રભાવ, અને અધિકાધિક ગુણવત્તા હેઠે ઠસ્તી જાય. એથી અહિસાદિના ભાવ સવિશેષ નિર્મળ, વિકસ્વર સહજ અને આત્મસાતુ બનતા જાય.

બીજું એ પણ લાભ થતા જાય કે જિનવાણીના નિરંતર ‘શ્રવણ-ગ્રહણ ભાવનથી અંતરાત્મામાં ભરાઈ પડેલા કેઈ દોષ-હુગુણોની પિછાણ થાય, કેટલાય ખોટી રીતે ગુણરૂપ માની લીધેલાને ખરેખર દોષરૂપ ઓળખવાનું બને. એથી જીવનમાં ઘણો ઘણો સુધારો થતો આવે. વળી જિનવચનમાં નિરંતર શ્રવણાદિથી નવનવા સુકૃત નવી નવી સાધનાઓ અને ઊંચા ઊંચા ગુણોની જાણકારી અને પ્રેરણા-પ્રોત્સાહન મળવા પર અનો પુરુષાર્થ વિકસતો જાય; તેથી જીવન ઉન્નતિના માર્ગે પ્રયાણ કરતું રહે.

આ તો અહિસાદિ અણુવ્રતો લીધા બાદની વાત થઈ, પરંતુ વ્રતોને પણ લીધા હોય તો ય જિનવચનના નિરંતર-શ્રવણ-ગ્રહણભાવનથી ઉપરોક્ત મહાન લાભો થતા આવે છે, ઘણી ઘણી ભ્રમણાઓ દૂર થાય છે, અજ્ઞાન મટતું જાય છે. નિત્ય નવો તત્ત્વપ્રકાશ, દોષ-નિરાકરણ અને ગુણવિકાસના માર્ગદર્શન પ્રેરણા-ઉત્સાહ મળ્યા કરે છે. નિત્ય જિનવાણી-પરિચયથી મૂળભૂત વિષયવિરાગ, ધનવૈરાગ્ય, કષાયોપશમ દઢ અને વૃદ્ધિગત થતા રહે છે.

ત્યારે, જો જિનવાણીના નિત્ય શ્રવણ-ગ્રહણ-ભાવન નથી તો કદાચ અણુવ્રત પણ લીધા હશે છતાં દા.ત. બીજા અણુવ્રતથી વેપારમાં જું તો નહિ બોલે પણ સાચું બોલીને ભળેલા લાભમાં મહાલતાં અયકાશે નહિ, અથવા કયારેક દયા છોડીને સાચું પકડી રાખશે. હુમેશા જિનવચન પરિચય રાખ્યા કરતો હશે તો ધનને અસાર સમજું એમાં મહાલશે નહિ, અતાવને ટાળી તત્ત્વને પકડશે. દયા-મૈત્રીભાવને આગળ કરશે.

એમ પાંચમાં વ્રતથી ભલે પરિગ્રહનું પરિમાણ નહિ ઓળંઘે પરંતુ જિનવાણીના એ પરિચયે મર્યાદાની અંદરના પરિગ્રહને કિંમતી સમજ હર્ષ અને મદ સારી રીતે કરશે. ત્યારે જો પરિગ્રહને સારું મહાત્વ આપવાનું ઊભું છે, તો વિરતિનો શો અર્થ રહેવાનો?

એમ પહેલા વ્રતથી નૃસજીવની તો હિંસા નહિ કરે. પણ જો સ્થાવર જીવોની હિંસામાં નિર્ભયતા નિઝુરતા છે, તો હૈયામાં કોમળતા ક્યાં? જિનવાણીનો રોજ પરિચય નહિ એટલે આજે દેખાય છે કે ઘરકામ અને બીજા કેટલાય સ્થાવર જીવસંહારક આરંભસમારંભોમાં નિર્ભય અને નિર્દ્ય હદ્યે પ્રવૃત્તિ ચાલી રહી છે!

એવું જ પોતાના પુણ્યયોગે ન્યાયનીતિથી ય મળતી સગવડ-સામગ્રીમાં કોઈ આડે આવતો હશે તો એના પર દ્વેષ-ગુસ્સો નિર્ભયપણે થવાનો. કેમકે રોજના જિનવાણીના સ્નાન નથી તેથી ‘પરલોકમાં કષાયોથી મારું શું થશે?’ એવો ભય ચાલું નથી રહેતો.

જિનવચન એ તો અનાદિના ખંધા આત્મરોગોનું ચિકિત્સાશાસ્ત્ર છે. એના નિત્ય પ્રયોગથી મિથ્યાત્વ, મોહ, અવિરતિ, વિષયાસક્તિ, આહારાદિ સંજ્ઞાઓ, કામ-કોધ-લોભ મદ-માન-ઈચ્છા વગેરે રોગો મિતાવી શક્ય છે. એ મિતાવવા માટે જીવ-અજીવ-કર્મ આદિ તત્ત્વો, સમ્યગ્ આચારો, હેય-ઉપાદેય...વગેરેનો વિવેક આપે છે, દાન, ત્યાગ, વ્રત-નિયમ, તપસ્યા વગેરે ઔષધો બતાવી એનો નિત્ય નવો ઉત્સાહ જગાડે છે.

આવી તારક જિનવાણી નિત્ય સાંભળવી નથી, હૈયામાં પજળાવ્યાં કરવી નથી. પછી મન એવું બને છે કે દેવ-ગુરુને પોતાના તરીકે સારી રીતે નહિ સેવે. એવું કાયા-કુટુંબને પોતાના તરીકે સારી રીતે સેવશે! ઘરદુકાન પૂર્ણ સંભાળશે અને મંદિર-ઉપાશ્રીનું સંઘના માથે રાખશે! છતાં સંયોગે ય ધર્મ ખાતર કાંઈ નહિ કરે, સંસાર ખાતર સંયોગ બનાવીને બધું કરી છૂટશે! વહાલા-વાલેસરી ખાતર ધાણુંય ધસાશે, પણ અનંત ઉપકારી માનવજન્મ આદિ પુણ્ય દેનાર પરમાત્મા અને એમના શાસ્ત્ર ખાતર કશું ધસાવાનું નહિ રાખે. પરમાર્થ માટે નયો પૈસો ય નહિ, વ્યવહાર પાછળ અથળક ધનનો ધુમાડો કરશે! જડની વાતમાં વગર કહ્યે તૈયાર; પોતાના આત્માની વાતમાં અખાડા! આજ આવું ધાણું દેખાય છે.

આના બીજા કારણો હશે, પણ જિનવચન સાંભળવા-સમજવા-ચિંતવવા પ્રત્યે સરિયામ બેદરકારી એ એક મોટું કારણ છે. દેવદર્શન-પૂજા વરસોથી કરવા છતાં ઉપર કહેલી જાલિમ ખામીઓ ઊભી રહે છે. એ નિત્ય જિનવાણીશ્રવણ-મનન નથી એના લીધે છે. માટે સાધુસંયોગ હોય ત્યાં એમના શ્રીમુજે જિનવાણી રોજ સાંભળવાનું અને એ સંયોગ ન હોય ત્યાં જિનવાણીને રોજ વાંચન કરવાનું રાખવું જરૂરી છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૂત”

વર્ષ-૧૭, અંક-૩૬, તા. ૧૭-૫-૧૯૬૮

## ૫૧ અકલ્યાણમિત્રી દૂર રહો

જીવન પર સહયોગની મોટી અસર છે. સહયોગ-સંગ-સમાગમ હોય તો સારી અસર અને નરસો હોય તો નરસી અસર પડે છે. નવા જન્મેલા બે પોપટના બચ્ચામાંથી એકને પદિતને ત્યાં અને બીજાને વાધરીને ત્યાં મૂક્યાની અસરનું દસ્તાન્ત પ્રસિદ્ધ છે.

એટલા જ માટે શ્રી ‘પંચસૂત્ર’ શાસ્ત્રમાં પ્રગતિના અભિલાષી ગૃહસ્થને અહિંસાદિ ધર્મ સ્વીકાર્ય પછી અકલ્યાણમિત્રનો યોગ ટાળી કલ્યાણમિત્રનો યોગ સાધવાનું કર્તવ્ય બતાવ્યું છે. તો શું અહિંસાદિ પાભ્યા પહેલા આ જરૂરી નથી? છે, પરંતુ અહીં પછી જરૂરી કહીને એ સૂચવ્યું કે ગુણ યા ધર્મ પાભ્યા પછી ય નિરાંતે નથી બેસવાનું કિન્તુ આ અસત્ર મિત્રયોગ ટાળી સત્ર મિત્રયોગ સેવવાનો છે. નહિંતર નવા પ્રાપ્ત કરેલા ગુણ કે ધર્મને ખરાબ સંગતે ધક્કો લાગતા વાર નહિં લાગે.

યાદ રહે કે અહિંસાદિ ધર્મ શું કે ક્ષમાદિ ગુણો શું, યા દાન-શીલ-તપ આદિની સાધના શું, એ બધુ નવું પ્રાપ્ત છે, પણ અનાદિ કાળથી સાથે નથી આવ્યું; એમ જો હોત તો એના પર સારું મમત્વ હોત, અને એ ધર્મ-ગુણ-સાધના ભૂલાય છે તે ન ભૂલાત, ઊલંઘ હિંસાદિ અધર્મ, કોધાદિ દુર્ગુણ, અને આહાર-વિષયાદિના દુષ્કૃત્ય અનાદિથી ચાલતા આવતા હોઈ એના પર મમત્વ ગાઢ છે. એટલે જ એ ભૂલ્યા ભૂલાતા નથી. માટે જ નવા ઊભા કરેલા અહિંસાદિ ધર્મને દબાવી દેવા એ તૈયાર જેવા જ રહે છે. માત્ર જીવની અહિંસાદિને સાચવવાની સાવધાની ચૂકાય એટલી જ વાર હિંસાદિ પાપ જાણો ટપકી જ પડ્યા છે; કાયાથી નહિં, તો મનમાં એ સુધી ઉઠે છે.

અહિંસાદિની આ સાવધાની-જાગૃતિને ભુલાવનારી એક ચીજ અધર્મ મિત્રનો યોગ છે. અકલ્યાણમિત્રનો યોગ છે. એવા અધર્મ-મિત્ર ખુદ સગાં ય બને, પાડોશી ય બને, અને સેહીઓ, મિત્રો, યા બીજાઓ પણ બને, એમાં મોટા અધર્મમિત્રો તો ખૂન-લૂંટ-ચોરી, દુરાચાર વગેરેની પ્રેરણા કરનારા હોય છે. ત્યારે એથી ઉત્તરતી કોટિના અધર્મમિત્ર જુઠ ઝફાણ-નિદા-કુથલી-દ્રોહ-આરંભસમારંભ-રસમિજબાની વગેરેમાં પ્રેરનારા હોય છે. એમ કોધાદિ કષાય અભક્ષ્યભક્ષણ અનુચિત ભાષણ બનાવતો વગેરેમાં પ્રેરનારા અધર્મ મિત્ર પણ હોય છે.

ટૂંકમાં પરલોક બગડે એવા દોષ-દુષ્કૃત્યોમાં જડના રંગરાગમાં અને આહાર-વિષય-પરિગ્રહાદિની સંજ્ઞાઓની ગુલામીમાં જે ફસાવનારા છે એ અધર્મમિત્ર છે; પછી ચાચ્ય તે મવાલી મિત્રના રૂપમાં હોય, યા સગા-સનેહી-પાડોશી કે યાવતું ઉપદેશક ગુરુના લેબાશમાં હોય; અરે! માબાપ, પતિપત્ની કે પુત્રના રૂપમાં હોય, પરંતુ જો એ નીતરતી મોહ પરિણતિ જ વધારતા હોય, બાધ્યભાવનો નશો જ ખીલવતા હોય, અને સંસારરસિકતા જ પોષતા હોય; તેમજ વૈભવવિલાસમાં અંધ બનાવતા હોય, તો એ અધર્મમિત્રો છે.

સારાંશ, મન-વચન-કાયાના કોઈપણ અશુભ વ્યાપારમાં જોડનાર એ અધર્મમિત્ર છે. આનો સમાગમ અને આની સલાહ-ઉપદેશનું શ્રવણ આપણાને અનાદિના પરિચિત હિંસા-જુઠ આદિ પાપો દુર્ગુણો અને દુષ્કૃત્યોમાં આકર્ષ છે. તેથી અહિંસા સત્ય વગેરે ધર્મ-ગુણ-સુકૃતો ભૂલાય છે. આવા અધર્મમિત્રનો ત્યાગ કરવો જોઈએ.

અહીં એક પ્રશ્ન થાય કે ‘તો પછી બીજા તો ઠીક પણ માતા-પિતા પતિ-પત્ની પુત્ર વગેરે જો અધર્મમિત્રનું કામ કરતા હોય તો શું અમનો ત્યાગ કરવો? એનો ઉત્તર એ છે કે ઉત્તમ માર્ગ તો એ છે કે જે કોઈ અકલ્યાણમિત્રની ગરજ સારતા હોય, અમનો ત્યાગ કરવો. પરંતુ એક માર્ગ આ છે કે એવા માતાપિતા વગેરેને કલ્યામિત્ર બનાવવા. એ માટે એમને સમજાવવું કે ‘જુઓ, મોહભર્યા જીવનમાં અંતે રોવાનું થાય છે. બાધ્યભાવમાં જ રમતા રહેવામાં ભગવાન હૈયામાં ઉત્તરતા નથી; સંસારનો રસ રાખવામાં જન્મ-મરણ-હુંઅ-વિટંબણામય સંસાર જ વધે છે. કષાયો-ભોગતૃષ્ણા-વૈભવાંધતાં વગેરેથી સાચી સુખશાન્તિનો લોપ થઈ જાય છે.’ અંતર્મુખતા-જીવાનદંદિ ઉપશમ-સમાધિ ત્યાગ-વૈરાગ્ય-દ્યા-દાન-શીલ-તપ અહિંસા-સત્ય વગેરેના મૂલ્ય અગ્રાય છે. ત્યારે આપણા આત્માના સાચા ઉપકારી એ છે. એથી જ ભાવી અનંતો કાળ ઉજજવળ બને છે....’ આમ સમજાવે. સાથે પોતાનો વર્તાવ પણ એવો રખાય અને એમને એ ઠસાવાય તો એ લોકો પણ ધર્મમિત્ર બને.

આજે ચારે કોર જોતા દેખાય છે કે લગભગ સૌ કોઈ અકલ્યાણમિત્ર તરીકેની જ વાત કરનારા મળે છે. કાં પેસાની, વેપારની, યા વહેવારની, કે બાધ્યભાવની જ વાતચીત કરનારા મળે છે. બીજાબાજુ છાપા-રેણ્યો-સિનેમા વગેરે પણ એનું જ સમર્થન કરનારા હોય છે. એટલે મન પર ચોવીસે કલાક એ પાપચીજોનો કેફ રહે છે. પછી ત્યાં થોડી ધર્મસાધના કે ધર્મશ્રવણ પણ હોય, તો ય એની દિલ પર અસર નથી પડતી.

માટે આ ઊંચા ભવમાં ઊંચી ધર્મ-અસર લેવી હોય તો અકલ્યાણમિત્રના યોગથી દૂર રહેવું જોઈએ.

## ૪૮ મંત્રી તેતલીપુત્ર દુઃખી કેમ ?

(લેખાંક-૧)

શ્રી ‘જ્ઞાતાચ્છયન’ નામના આગમમાં મંત્રી તેતલીપુત્રનો અધિકાર આવે છે. એમાં એઝો પોતાની પત્ની પોહિલાને એ શરતે ચારિત્રમાર્ગ જવાની રજા આપી છે કે ‘પોહિલા ચારિત્રપાળીને દેવ થઈને મંત્રીને પ્રતિબોધ કરવો.’ પોહિલા દેવ થઈને મંત્રીને પ્રતિબોધ કરવા ઉપાય કરે છે.’

એમાં એક ઉપાય એ એવો કરે છે કે એકવાર મંત્રી તેતલીપુત્ર રાજસભામાં આવે છે, ત્યારે રાજા એકાએક એના તરફથી મોહું ફેરવી નાખે છે ! આ રાજા તે છે કે જેને મંત્રીએ પોતે ગુપ્તપણે જન્મથી ઉછેરેલ અને પછી રાજ્યગાદીએ બેસાડેલ; તથા રાજા એને પિતાવત્ત માનનાર હતો. એ રાજા હવે મોહું ફેરવી નાખે છે; મંત્રી ચોંકી ઉઠે છે કે ‘અરે ! રાજા મારા પર નાખુશ ?’ એ ત્યાંથી ઉઠીને ચાલી જતાં સભાસદોને તથા દરવાનને પણ પરાડમુખ જુઓ છે; અને પોતાના ઘરે નોકરો વગેરેને પણ પરાડમુખ દેખે છે ! એના મનને ભારે બેદ થાય છે કે ‘અરે ! મારું કોઈ નહિ ? બધા જ મારા પર અભાવવાળા ?’

મંત્રીને દુઃખ ભારે થયું, પરંતુ દુઃખનું સાચું કારણ ન સમજ્યો. તેથી વિચારે છે કે ‘હવે જીવનું નકારું છે, કેમકે જીવનમાં બીજાનો સદ્ગુરૂ ન હોય, પ્રેમ ન હોય તો દુઃખનો પાર નહિ, માટે આપધાત કરું જેથી પછી અપ્રીતિવાળા મૌખિકોવાનું દુઃખ નહિ.’

સામાન્ય રીતે જોતા મંત્રી-જીવાની સામે રાજા અને આખી સભા મોંવાંકું કરી દે, સિપાઈઓ અને ઘરના કુટુંબીઓ નોકરો પણ એમ કરે, એ મંત્રી કેમ સહી શકે ? અલબંત આના પર મંત્રીને વૈરાગ્ય થવો જોઈતો હતો કે ‘હેં શું ત્યારે સંસાર અંતે આવો જ છે ?’ ‘વહાલા વૈરી થાય ? તો પછી કોનો ભરોસો ?’ એમાં તો આત્માને ઠગાવાનું થાય. માટે સંસાર ખોટો. એ જોઈએ નહિ,-આમ વૈરાગ્ય થવો જોઈતો હતો, પરંતુ એ ન થતાં મનને દુઃખ થયું કે, ‘અરેરે ! મારું કોઈ નહિ ? મને કોઈ બોલાવે આવકારે નહિ ? બસ તો તો જીવનું નકારું. આપધાત કરું.’

આના પર વિચારવાનું છે કે શું આપણા પર કોઈનો સ્નેહ સદ્ગુરૂ ન હોય અગર કોઈ આપણને માન ન આપે, આવકારે નહિ, એ દુઃખ છે ? ના ‘કેમકે

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૦૫

એને દુઃખ માનવાથી તો જીવન અકારું લાગશે. કદાચ આપધાત કરવાનું થશે; પરંતુ શું મરી ગયા પછી દુઃખનો અંત આવ્યો ? ના ઉલટું પછીની દુર્ગતિના ઘોર દુઃખ વહેલા નોતરવાનું થાય.’

ખરી રીતે, દુઃખનું કારણ આ છે કે મનને બીજાના સ્નેહ અને માનની અપેક્ષા રહે, આકાશા રહે. મારા પર બીજાઓ પ્રેમ રાખે સદ્ગુરૂ રાખે, મને આવકારે, આવી આશાસા-સ્પૃહા-અપેક્ષા રહેવાથી, પછી જ્યાં કોઈનો પોતાના પર દ્વેષ અણગમો અવજ્ઞા જુઓ છે એટલે દુઃખ લાગે છે, મન દુઃખી થાય છે.

જો પોતાને આ અપેક્ષા જ ન હોય, ‘મારા તરફ બીજાઓ સ્નેહ આવકાર બતાવો યા ન બતાવો તેથી મારે શું ? મારે તો સન્માર્ગ પર ચાલ્યા જવાનું હાં, બીજાઓ મારા વાંકે દ્વેષમાં ન પડે, અને સ્વાત્માનું ન બગાડે, એટલા માટે મારે ગુનામાં નહિ આવવાનું. મારે નિમિત્ત નહિ આપવાનું; જેથી એ બિચારા પાપમાં ન પડે. બાકી બીજાઓ આપમેળે દ્વેષ અવગણના કરતા હોય અને મારા પર સ્નેહ આવકાર ન દાખવે તો તેથી મારે શું ? તો કોઈ દુઃખ ન લાગે. તેતલીપુત્ર મંત્રીએ જો આ હિસાબ રાખ્યો હોત તો એને દુઃખી થવાની જરૂર રહેત નહિ.’

જેટલા અધિક જણ તરફથી સ્નેહ-આવકારની અપેક્ષા રહે, એટલી વધારે દુઃખની સગવડ-સુલભતા રહેવાની. પછી મુશીબત આ કે સોમાંથી ૮૮ નો સ્નેહ આવકાર હોય, પરંતુ માત્ર એક જણ સ્નેહ આવકાર ન બતાવે તો ય દુઃખ લાગવાનું. બીજાના સ્નેહ-આવકારની અપેક્ષા છે માટે છે, ઉપેક્ષા બેપરવાઈ કરો કે દુઃખ ‘ભલે ને કોઈ મને ન આવકારે સ્નેહ ન રાખે મારે શું ?’ તો દુઃખ નહિ લાગે.

આજે ઘણા માણસ આ અપેક્ષા રાખી દુઃખી થાય છે. કુટુંબીઓને છોડી શકતા નથી, જીવનભર સાથે રહેવું તો પડે જ છે. અને એમનો સ્નેહ-આવકાર ન હોય એ સહી શકતું નથી. દુઃખ કરીને ય પાછો સ્નેહ ઊભો તો કરી શકતો નથી, છતાં હૈયું બાળ્યા કરે છે. જીવની આ કેટલી બધી મૂર્ખાઈ છે ? એમાં વળી આર્તધ્યાન પ્રબળ ચાલે છે ને તેથી ભવિષ્ય માટે અશુભ કર્મ અને અશુભ સંસ્કાર ઊભા થાય છે.

આનાથી બચવા માટે આ વિચાર જોઈએ કે ‘બીજા મારા પર સ્નેહ રાખે, મને માન આપે, તેથી મારા આત્માનું શું ભલું થવાનું ? એના કરતાં હું મારા સન્માર્ગના પ્રયત્ન અને સદ્ગનિષ્ઠાનો વિશ્વાસ રાખ્યું એથી જ મારું ભલું થશે. અને એ સદ્ગનિષ્ઠા તથા સત્ત પ્રયત્નથી હું અનંત જ્ઞાનીની દૃષ્ટિમાં સારો લેખાઈશ. આપણા ભલાનું સારું પ્રમાણપત્ર એ કે જ્ઞાનીની નજરમાં આપણે સારા હોઈએ.’

૧૦૬

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

(૫૩) (લેખાંક-૨)

મંત્રી તેતલીપુત્રને પ્રતિબોધ કરવા માટે પત્ની પોહિલાદેવ આવેલ છે. એણે રાજથી માંડી દરવાન સુધીના બધાને મંત્રીથી પરાડમૂખ કરી દીધા છે; કોઈ જ મંત્રીને આવકારે નહિ, મંત્રીને દુઃખ લાગ્યું; પરંતુ એથી વૈરાગ્ય ન જાગતા કંટાળીને આપધાત કરવાનું કરે છે. દેવતાએ એમાં ફાવટ આવવા દીધી નહિ, તારે જંગલમાં જઈ ચિતા સળગાવી બળી મરવાનું કરે છે, એ પણ દેવે નિષ્ફળ કર્યું, હવે પર્વત પર ચી મંત્રી શૂનમૂન ઊભો છે.

ત્યાં પોહિલાદેવ જુએ છે કે હજુ ય મંત્રીનું મન વૈરાગ્ય તરફ નથી. તેથી દેવ ત્યાં એક મુસાફર અને હાથીનું રૂપ દેખાડે છે.

પછી એ પ્રવાસી ત્યાં દૂર ઊભેલા શૂનમૂન મંત્રીને પૂછે છે,-‘હે તેતલીપુત્ર ! મારે એક બાજુ મદોન્મત હાથીના આકમણનો ભય છે. બીજી બાજુ પર્વતના કિનારેથી ખીણમાં પડવાનો ભય છે. હું ક્યાં જાઉ ?’

દેવનો આ સવાલ મંત્રીની અંદરની વિવેક-બુદ્ધિ માપવા માટે છે કે ભલે પોતાના દુઃખ પર નહિ સહી, કિન્તુ બીજાના દુઃખ અંગે બીજાને સાચી સલાહ મંત્રીને સૂઝે છે ખરી ?

મંત્રી કહે છે. ‘ચારિત્રવાળાને ક્યાંયથી ય ભય નથી, દુઃખ નથી.’

આ જવાબ સાંભળીને પોહિલાદેવ જુએ છે કે મંત્રીના અંતરમાં પ્રકાશ તો છે જ, હવે એ પ્રકાશની પોતાના પર અસર થાય એ માટે ફરીથી બે વાર એ જ પ્રશ્ન પૂછે છે અને એ જ ઉત્તર મેળવે છે કે ‘ચારિત્રને ભય નથી.’ ત્યાં એનો એ જ ઉત્તર ગ્રણ વાર કહેતાં મંત્રીને હવે એની અસર થતાં આપધાત કે દુઃખનો વિચાર માંડી વાળી ચારિત્ર લે છે.

અહીં આ સવાલ છે કે, ‘ચારિત્રવાળાને કેમ કોઈ ભય નહિ ? કોઈ દુઃખ નહિ ? શું ચારિત્ર સ્વીકાર્યું તો હાથીનું આકમણ ટળી ગયું ?’

ઉત્તર આ છે કે, સંયમ લેતાં આત્મમહત્વ આવે, જડશરીરનું મમત્વ જ્ઞય; પછી શરીર પર આકમણ એ દુઃખ જ નહિ. દુઃખનું કારણ અસંયમ છે, અચારિત્ર છે અવિરતિ છે. દા.ત. બીજાને ત્યાં જમવા બેઠા અગર ઘરમાં જ તહેવારના દહાડે જમવા બેઠા અને રોટલી જ પીરસાઈં, તો મનને દુઃખ થાય છે કે ‘અરે ! મિઠાઈ જમાડવા નથી મળતી ? તે આ રોટલી પીરસી ?’ પણ આ દુઃખ કોને ?

જેને મિઠાઈનો ત્યાગ નથી, વિરતિ નથી, સંયમ નથી એને. બાકી જેને ત્યાગ છે એને કશું દુઃખ નહિ લાગે.

આજે સિનેમા વગેરે મનોરંજનના સાધન પર ટેક્ષ વધે તો, દુઃખ થાય છે પણ એ કોને દુઃખ થવાનું ? જેને એવાં સાધનના ઉપયોગ પર સંયમ નથી, અસંયમ છે એને.

દુઃખનું કારણ અસંયમ છે. કોઈ અપમાન કરે તો દુઃખ લાગે છે, શાથી ? પોતાની જાતનું અહંત્વ છે, જાતનું મહત્વ લાગે છે. તેથી એ ટકરાતા, દુઃખ થાય છે. પરંતુ જો અહંત્વ-મહત્વબુદ્ધિનો નિગ્રહ હોય, એ ન કરવા મન પર સંયમ હોય તો પછી જાતના અહંત્વ-મહત્વ અટકતા પેલા અપમાન પર દુઃખ ન થાય.

એમ બજારમાં ભારે ઉથલપાથલ થઈ ભાવ ઊંચા ચડચા કે નીચા ગગડચા, ત્યાં દુઃખ કોને થવાનું ? જેને વેચાણ કે ખરીદીનો વેપાર માથે છે એને. પરંતુ જેને વેપાર નથી, એનો સંયમ છે. એવાને શું દુઃખ ? શો ભય ?

બસ, સંયમ છે, ચારિત્ર છે, એને ભય નથી દુઃખ નથી. પેલા પ્રવાસીને તેતલીપુત્ર જે કહે છે કે ‘ચારિત્રને કોઈ ભય કોઈ દુઃખ નહિ.’ તે એ સમજુને જ કહે છે કે ‘ચારિત્ર લીધું એટલે સંયમ કર્યો, એ સંયમમાં પોતાના શરીર પ્રત્યેની મૂઢ્યા પર પણ સંયમન આવી જાય. મનને એમ નક્કી થઈ ગયું કે મારે ચેતનને ને આ જડ શરીરને શું લાગેવળગે ? શરીર મારું છે જ નહિ, મારું તો જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે એને વાંધો આવે તો મારે વાંધો. બાકી જો શરીર મારું નથી તો પછી શરીરને વાંધો આવે એમાં મારું શું જાય ?’ એટલે જ પારકા એવા આ શરીરનું ખીણમાં પતન થાઓ કે હાથીથી કયરામણ થાઓ, એમા મારે ‘કશું દુઃખ નથી’ આમ સંયમવાળાને નહિ દુઃખ નહિ ભય.

દુઃખનું કારણ અસંયમ છે. જીવન જીવવામાં જેટલી વધુ સગવડો જરૂરી માની અને વધાવી, એટલો અસંયમ વધ્યો કહેવાય, અને એથી જ પછી એ સગવડોમાં આધુપાછું થતાં દુઃખ થાય છે. એ દુઃખ બાબ્ય વસ્તુ બગડવાને લીધે નથી. પરંતુ મૂળમાં અસંયમ રાખ્યો છે, એના લીધે છે; માટે અસંયમને અટકાવી અધિક અધિક સંયમ કેળવવો.

ઇન્દ્રિયોના વિષયો, કોધાંડ કખાયો, હિંસાંડ દુષ્કૃત્યો અને આહારાદિસંજ્ઞાઓ,- એ બધું કરવાની જેટલી છૂટ, એટલો અસંયમ કહેવાય; અને એજ દુઃખનું કારણ છે.

## ૫૪ ધર્મવૃક્ષની ભૂમિ : ત્રિવિધ યોગ્ય પ્રવર્તન

જીવનમાં ધર્મસાધના-કરનાર ભવ્યાત્માએ મન-વચન કાયાને યોગ્ય રીતે પ્રવર્તવવા જોઈએ. - એમ શ્રી પંચસૂત્ર શાસ્ત્ર ફરમાવે છે.

અનાદિ અનંત કાળથી તામસભાવના ગતિમાં પહેલા પોતાના આત્માનું ઉત્થાન કરવું હોય તો તે ધર્મથી થાય, આવું સમજને જીવ ધર્મમાર્ગ પુરુષાર્થ આદરે છે; ને એ પુરુષાર્થમાં દયા-દાન-દેવદર્શનાદિ-પૂજન-સાહુસેવા-ગ્રત-નિયમ-તપસ્યા વગેરેનું આસેવન કરે છે. આમ ઇતાં કેટલાયની ફરિયાદ છે કે ‘હજ અમારું ચિત્ત કેમ તામસ-ભાવમાં તણાય છે ? જેને અંતરની આ સૂર્જ ન પડતી હોય એવા કદાચ આ ફરિયાદ ન કરે, ઇતાં એમના ય જીવનમાં કેમ તામસભાવના તાંડવ ખેલાતા દેખાય છે ? ધર્મમાર્ગનું શરણું લીધા પછી તો હૃદય સાત્ત્વિક ભાવથી મધ્મઘટું જોઈએ’ ને જીવન સાત્ત્વિક રાહે ચાલવું જોઈએ. એના બદલે હૃદયમાં તામસભાવ અને જીવનમાં તામસી વર્તાવ શા માટે રહેવો જોઈએ ?

આ પ્રશ્નનું સમાધાન એ છે કે ધર્મને જીવનનો એક અંશ તો બનાવ્યો પણ બાકીના અંશનો ધર્મથી તદ્દન જુદો ન પડાય. અર્થાત્ અમુક ધર્મ પ્રવૃત્તિ કરી લીધી અને બાકીના જીવન-ભાગ પર ધર્મની કોઈ અસર નહિ, એ ન ચાલે. જીવન સમગ્ર પર ધર્મની અસર જોઈએ. બીજા શબ્દમાં કહીએ તો ધર્મ મહેલ યોગ્ય મન-વચન-કાયપ્રવૃત્તિના પાયા પર ઉભેલો જોઈએ. જો આ પાયો સલામત ન હોય, અર્થાત્ એ ત્રિવિધ વર્તાવ અયોગ્ય હોય તો ધર્મમહેલ જમીન દોસ્ત અને કકડભૂસ થઈ જતાં વાર નહિ લાગે.

ધર્મ તો જીવનરૂપી ભૂમિ પર અમૃતવૃક્ષ છે, પરંતુ જો ભૂમિ વિષમય હોય તો ધર્મવૃક્ષ અમૃતમય કયાંથી બની શકે ? મન-વચન-કાયાના વર્તાવ જો અયોગ્ય હોય તો એવું જીવન વિષભૂમિ છે. એમાં ઊગેલું ધર્મવૃક્ષ પણ વિષમય બનવાનું; એ તો મન-વચન-કાયાના યોગ્ય વર્તાવથી જે જીવનભૂમિ અમૃતમય બને, અને એના પર ઊગેલ ધર્મવૃક્ષ અમૃતવૃક્ષ બની મીઠાં અમૃતફળ નીપજાવી શકે ને આત્માનું તમોભાવમાંથી ઉત્થાન થાય.

આ ત્રિવિધ યોગ્ય વર્તાવમાં પણ પહેલા નંબરે મનનો યોગ્ય વર્તાવ જોઈએ, યોગ્ય મન પ્રવર્તન જોઈએ; કેમકે મનની વાણી અને કાયિક વર્તાવ પર મોટી અસર

પડે છે. અલબત્ત વાણી વર્તાવની ય મન પર અસર પડે છે. વાણી જો અનુચિત બોલાયા કરતી હોય કે કાયવત્તાવ કરતી જો અયોગ્ય થયા કરે, તો માનસિક વિચાર-લાગણી-મનોભાવ અયોગ્ય બને છે; એ હિસાબે પહેલા નંબરે વાણી અને કાયાનું પ્રવર્તન યોગ્ય જોઈએ; કિન્તુ એ પણ વચન-કાયાના પ્રવર્તનમાં મૂળમાં મન કામ કરતું હોય છે. પછી ભલે એ અલ્યાંશે યોગ્ય યા અયોગ્ય હોય અને તેવી તેવી વાણી યા વર્તાવથી એમાં વધારો થાય, ઇતાં મૂળ પાયામાં મનનું થોડું પણ યોગ્ય યા અયોગ્ય પ્રવર્તન રહેવા પર યોગ્ય યા અયોગ્ય વાણી યા વર્તાવ ઉભા થાય છે. માટે પહેલા નંબરે મનઃપ્રવર્તન યોગ્ય જોઈએ. અયોગ્ય ન ચાલે સાથે જ વાણી-વર્તાવ પણ અનુચિત ન રાખતા ઉચિત રાખવા જોઈએ.

એટલે દરેક ધર્મ જીવની આ ફરજ છે કે ધર્મ તો અવશ્ય કરવો, ધર્મપ્રવૃત્તિ જરૂર કરવી કિન્તુ સાથે તપાસતા રહેવું જોઈએ કે મારા જીવન આખાયમાં કયાંય અનુચિત મનઃપ્રવૃત્તિ યા અનુચિત વચન-કાયાની પ્રવૃત્તિ તો નથી પેસી જતી ને ?

## ૫૫ મનનું યોગ્ય પ્રવર્તન

ગયા લેખમાં એ જોયું કે ધર્મસાધનાની જેટલી જ જરૂરી મન-વચન-કાયાની યોગ્ય પ્રવૃત્તિ છે, જેથી આત્મામાં એવા પાપબંધ અને વિપરીત સંસ્કરણ ન થાય. ભગવાન મુનિસુત્રત સ્વામીએ જે ધોડાને પ્રતિબોધ કર્યો એને પૂર્વ ભવમાં એવું થયેલું કે એણે ભાવપૂર્વક વિધિસહિત જિનેશ્વર ભગવાનની મૂર્તિ ભરાવી પ્રતિષ્ઠિત કરાવેલી; તેથી આગળ પર બોધિ યાને જૈન ધર્મપ્રાપ્તિ થવાનું નક્કી ય થયેલું. પરંતુ એ વેપાર ધંધામાં ખૂબ રંગાઈ ગયેલો, મન આર્તથાનમાં ભારે લાગેલું. તેથી એણે તિર્યંગતિનું આયુષ્ય ઉપાર્જિલું તેથી અહીં એ ધોડો થયો.

માટે જીવનમાં મનનું યોગ્ય પ્રવર્તન બહુ જરૂરી છે. મનને જો બહુ આર્તથાનમાં પ્રવર્તાવાય, ‘ઈછ પૈસા કેમ મળો, વેપાર મોટો કેમ થાય, થયો છે તો કેમ ચાલ્યા કરે, ને પૈસા બહુ મળ્યા કરે,’ એમ ચિંતયા કરતું એ મનનું અયોગ્ય પ્રવર્તન છે. વેપાર ચાલવા-કરવાનું કે પૈસા મળવા કરવાનું તો ભાગ્યને આધીન છે, મનના દુધ્યાનને આધીન નહિ. દુધ્યાન બહુ કરવાથી મોટા સોઢા ને બહુ કમાણી થાય એવું નથી હોતું. મનને એમ બહુ રગડ્યા વિના ઝોરા મનથી વેપાર કરનારને મોટા

સોદા ને મોટી કમાઈ થતી જોવામાં આવે છે. ત્યારે મનને એમાં બહુ રગડનારા બહુ ધન નથી પામતા એવા પણ દાખલા જોવા મળે છે. એ ભાગ્યની જ બળવતા સૂચવે છે, તો પછી મનને એવું ફોગર આર્તધ્યાનમાં રગડવાની શી જરૂર છે કે ‘કેમ બહુ વેપાર થાય ? કયાં જાઉ ? શું શું કરું ? પૈસા કેમ બહુ મળે ? શો ઈલમ લડાવું ? શા શા ઉપાય કરું ?...’ આ બધું મનનું અયોગ્ય પ્રવર્તન છે.

જેવું વેપાર અને કમાણી અંગે, એવું બીજી પણ સંસારિક મનગમતી વાતો બની આવવા કે ટકવા અંગેના ચિંતન, અને અણગમતી વાત-વસ્તુ ટળવા તથા ન બની આવવા અંગેના બહુ ચિંતન મનનું એમાં ને એમાં રમ્યા કરવું, એ પણ અયોગ્ય પ્રવર્તન છે. વળવાનું તો ભાગ્યાનુસાર; પણ આ આર્તધ્યાન માથે પડવાનું એ તિર્યંગતિના પાપો બંધાવે.

પ્રશ્ન થાય કે ‘આ ચિંતન તો સહજ છે, આ કેમ છૂટે ? પરંતુ મનને ચિંતવવાના અનેક સારા પ્રકારો છે એ આગળ જોઈશું.’

મનના બીજા અયોગ્ય પ્રવર્તનમાં,-પરને પીડા આપવાનું, પરપીડામાં ખુશી થવાનું, આરંભ-સમારંભનું, દીનતા કે હરખનું અથવા ખોટા દુરાગ્રહનું...વગેરે વગેરે ચિંતન આવે. એ પણ ખતરનાક છે. દા.ત.

તંદુલિયો મચ્છ તંદુણ જેવી કાયાનો સંશી પંચેન્દ્રિય જીવ, મસ્ત પડેલા મોટા મગરમચ્છના મોંમાથી ઢગલો માછલાં ખેમકુશળ બહાર નીકળી જતા જોઈ, ‘આ મૂર્ખ છે. આની જગાએ હું હોઉં તો હું આ બધા ગળી જાઉં. આમાંથી એક પણ ન છોકું.’ આ પરપીડાના ચિંતનમાં મરીને નરકમાં જાય છે. જીભ અને પેટની લાલસા આ કરાવે છે. આ અયોગ્ય મન:પ્રવર્તન છે.

આ ન હોય તો ય દુશ્મનાવટને લઈને ય પરને કનડવાનું ફટકારવાનું ચિંતન અથવા એ સ્વય કે બીજાથી પીડાતો હોય એમાં ખુશી થવાનું ચિંતન થયા કરે એ પણ અયોગ્ય પ્રવર્તન છે. અગ્નિશર્માનો જીવ ભવે ભવે સમરાદિત્યના જીવને એવા પીડવાના ચિંતનમાં મરીને નરકે જતો ગયો અને પરિણામે અનંત સંસારી થયો. કેટલીક વાર કુટુંબના વડેરાપણાના ખોટા ઘમંડમાં પણ, આશ્રિતો માનતા-કરતા ન હોય તો,-અને ફટકારવાના ખોટા ચિંતન થયા કરે છે.

દીનતાનું ચિંતન પણ અયોગ્ય મન:પ્રવર્તન છે. વાતવાતમાં મનને ઓછું આવ્યા કરે. ભાગ્ય દુબળું હોય એટલું બધું ટીપ-ટોપ પૂરું રૂંક-રૂપાળું મળે નહિ, તેથી મનને થયા કરે કે ‘આ તો મળ્યું, પણ પેલું કયાં મળ્યું ? મળ્યું પણ બહુ સારું કયાં છે ?...’ આ દીનતા છે. એમ માગણશીલતા, કંઈ ને કંઈ બીજા પાસેથી માગી લેવાનું ચિંતન પણ દીનતા છે. એમાં મન નિઃસત્ત્વ બને છે એ મોટું નુકસાન છે.

બહુ હરખમાં આવી જવું એ પણ મનનું અયોગ્ય પ્રવર્તન છે; કેમકે એમાં જે હુન્યવી બાબત બની આવવા પર ચિત્ત બહુ મલક્યું, એને બહુ માનવાનું થાય છે. અને એથી એને બહુ મહત્ત્વ આપવા જતાં આત્મહિતની વસ્તુ દા.ત. ત્યાગ વગેરે પર મમતા જામતી નથી. તેમજ પછી પેલાના વિયોગમાં કે સડી-બગડી જવામાં ભારે બેદ-અસમાધિ થાય છે.

ત્યારે હુન્યવી બાબત અંગે, સ્વમાન અંગે ને અતત્ત્વ અંગે ખોટી પકડ દુરાગ્રહ રાખવો એ પણ અયોગ્ય મન:પ્રવર્તન છે. એની પાછળ સંસારના પાયાભૂત અહંકારનું ભારે પોષણ થાય છે. કલેશ-ઝડા-હુદ્ધાન વગેરે સુલભ બને છે; સામા પાસેથી બીજું સારું પામવાનું ચૂકાય છે.

માટે મન આવી આવી રીતે અયોગ્ય ન પ્રવર્તે એ સારુ કિંમતી ગણાતા પણ સંસારવૈભવ-માનપાનાદિની અંતે અસારતા; કર્મવિપાકની બળવતા, ત્યાં આત્માનું કાંઈ ચલાણ નહિ, એમ જીવની કરુણાપાત્રતા, હિંસાદિના દારુણ વિપાક, જીવનનો ખરો આધાર બાબ્ય પર નહિ...વગેરે વગેરે ચિંતયા કરવું. શ્રીપાળ વગેરે મહાપુરુષોના ઉત્તમ દિલ ઉત્તમ વિચારસણી અને ઊંચા જીવપરાક્રમ વિચારવા.

‘દિવ્ય-દર્શન’-“અગ્રલેખમૂત”

વર્ષ-૧૭, અંક-૪૨, તા. ૧૨-૭-૧૯૬૮

## ૫૬ અદ્ભુત દ્વારા યોગભર્યુ પ્રભુદર્શન

(લખાંક-૧)

અનેકાનેક ઈન્દ્રિયવિષયોમાં અને કોધાદિક્ષાયોમાં રખડતું મન ઊકળતું ને ઊછળતું રહે છે, અને તત્ત્વમાં સહેજ પણ સ્થિર અને શાંત-સ્વસ્થ બનતું નથી, ત્યાં સુધી એ મન અંતિમ આત્મ-સ્થૈર્યના માર્ગ કયાંથી ચાલી શકે ?

ત્યારે ગૃહસ્થના ભોગી અને જંજાળી જીવનમાં એવી સચોટ ધ્યાનક્રિયા કયાંથી લાવવી કે જે મનને સહેજ પણ શાંતતા અને કષાય-ઉકળાટની સ્થિરતાનો અભ્યાસ આપી પેલી વિષયવ્યાકુળતા અને દશાને અંશે પણ શાંત કરતી આવે ? આ એક મનોવ્યથા રહે છે.

અલબત નમસ્કાર મહામંત્રનો જાપ આ દિશામાં ઉપયોગી બની શકે; પરંતુ જાપની આરાધના કરનારા કહે છે કે કેટલાય વરસથી જાપ કરીએ છીએ છતાં એમાં ય મન કયાંનું કયાં ય ભાગે છે, તેમજ જીવનમાં ધનાર્જનપ્રીતિ, આરંભસમારંભ-રસ, અહંત્વ, વિષયોના આકર્ષણ વગેરે એમ જ ચાલ્યા કરે છે.

તો પછી પ્રશ્ન થાય કે બીજો કોઈ ઉપાય છે ? હા.

શ્રી જિનેશ્વર ભગવાનના દર્શનનો યોગ એવો અદ્ભુત છે કે એમાં અંશે અંશે મનને સ્થિર-શાંત-સ્વસ્થ થવાનો અભ્યાસ મળી શકે. માત્ર એ દર્શન ઠંગસર થવા જોઈએ. જો એ શાસ્ત્રીય વિધિસર થાય તો એમાં અનેક તત્ત્વ એવાં છે કે જે જીવના અનાદિના વિષયાકર્ષણ, વિષયોન્માદ, કષાય-ઉકળાટ અને માનસિક ચંચળતાને ઓછી કરતા આવે. વિધિસરની જિનદર્શનની પ્રક્રિયામાં એવો અદ્ભુત ધ્યાનયોગ સધાય છે કે જેમાં એવા મસાલા ભરેલા છે કે જે મનની સ્થિરતા શાંતતા સ્વસ્થતાને પ્રેરનારા બને.

અહીં એટલું સમજું રાખવાનું છે કે આ ‘ધ્યાન’ એટલે મોટા યોગીઓ જ કરી શકે એવી કોઈ ગહન વસ્તુ નથી. કિન્તુ કોઈ શુભ વિષયમાં મન વિશુદ્ધ ભાવોલ્લાસ સાથે સ્થિર વહેંતું રહે એ ધ્યાન છે. એનો સારો અભ્યાસ થતાં વિશિષ્ટ ધ્યાનમાં જઈ શકાય છે. તો હવે આ દર્શનની પ્રક્રિયા શી છે તે જોઈએ. શાસ્ત્રો કહે છે, ‘દહેરે, જાવા મન કરે, ચારુથતણું ફળ હોય.’ ‘ચારુથ’ એટલે કે ચતુર્થઅભક્ત (અભોજન) અર્થાત્ ઉપવાસ. ઘરમાંથી દોરાસરે જવાનું મન કર્યું ત્યાં ઉપવાસથી જે પાપક્ષય અને પુણ્યાર્જનનો લાભ થાય, એ લાભ મળે. ત્યારે બીજું બાજુ શાસ્ત્રો કહ્યું છે કે, એક નારકીનો જીવ ૧૦૦૦ કરોડ વરસ સુધી નરકની કારમી વેદનાઓ વેઠીને જેટલા કર્મ ખપાવે, એટલા કર્મનો નાશ એક ઉપવાસથી થાય.

ત્યારે એ જોવાનું છે કે આવા જંગી કર્મક્ષયનો લાભ આપનાર ઉપવાસ કેવા ભાવથી થવો જોઈએ ? અને એટલો બધો મહાલાભ કરાવનારું દહેરે જવાનું મન પણ કેટલા બધા ઉદ્ઘટા અને વિશુદ્ધ ભાવોલ્લાસથી થવું જોઈએ ? તો પ્રશ્ન થાય,-

પ્ર.- ઉપવાસ અને દર્શનચ્છામાં શો ભાવોલ્લાસ લાવવાનો ?

૩.- ઉપવાસમાં એ ભાવોલ્લાસ લાવી શકાય કે (૧) અહો ! ખાઉં-ખાઉંની સંજ્ઞાએ મારો એવો કેડો પકડ્યો છે કે રોજ બીજું બધું પડતું મૂકાવીને એક વાર બે વાર ચારવાર એ સંજ્ઞા આવીને ઊભી જ રહે છે. વળી થોડું પણ ચાટવા-ચગરવાનું આઈ વાર મળે તો ય જીવને એ ખપે છે, માટે તો આઈ વાર નહિ મળે તો નહિ ખાય, પરંતુ દિવસમાં ૪ કે ૫ ટંકથી અધિક ટંક ન ખાવું એવો નિયમ કરવા મન તૈયાર નથી; કેમકે અંદરમાં અનાદિની આહારસંજ્ઞા પીડે છે. ત્યારે આજે મને આ ઉપવાસનો લાભ સરસ મળ્યો કે જેથી પચ્ચાખાણના લીધે પેલી આહારસંજ્ઞાને દબાવાનું થશે. આમ ભાવોલ્લાસ વધે. ઉપવાસમાં જ્યાં ખાવાનું

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૧૩

યાદ આવે કે તરત મનને થાય કે ‘વાહ ઠીક થયું, આજે ઉપવાસનું પચ્ચાખાણ હોવાથી ખાવાનું પાપ ટખ્યું છે ! આહારસંજ્ઞા ઉપર વિજય મળ્યો છે !’

આમ બીજું બીજું રીતે પણ ભાવોલ્લાસ એમ વધારી શકાય કે (૨) ઉપવાસના હિસાબે ખાવાકરવાનો સમય બચવાથી શાસ્ત્ર-સ્વાધ્યાય આદિમાં વિશેષ પ્રવૃત્તિ થાય. વળી (૩) ‘જિનની તપની આજ્ઞાનું સુંદર પાલન કરવાનો મહાન લાભ મળ્યો’ એ ભાવના કરાય. એમ, (૪) ‘સ્વેચ્છાએ સહન કરવાનું અપૂર્વ કર્મનિર્જરા થવા સાથે સત્ત્વવિકાસનો મહાન લાભ મળે છે; એ સહવાનું આ ઉપવાસમાં સહેજે મળી જાય છે.’ વળી, (૫) ‘ઉપ=સમીપ,’ અને ‘વાસ’=વસવું. ‘ઉપવાસ’ એટલે આત્માની સમીપમાં વસવું; કંઈક આત્મભાવમાં આવવું. એ આવવાનું તો જ બને કે જીવ પરભાવમાંથી બહાર નીકળે. ઉપવાસમાં પરવસ્તુ જે આહાર તેનાથી દૂર રહેવાય છે. તેથી આત્મભાવમાં કંઈક વસવાનું બને છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૪૩, તા. ૧૯-૭-૧૯૬૮

(૫૭) (લેખાંક-૨)

આમ, જે એક ઉપવાસના ફળમાં ૧૦૦૦ કરોડ વરસની નરકની વેદનાનાં પાપ તૂટે છે, અને બીજા અઢળક પુષ્યનું ઉપાર્જન થાય છે. દા.ત. સ્થૂલમદ્રજણો ભાઈ શ્રીયક એક ઉપવાસ કરી દેવલોકમાં જન્મ પામ્યો. એ ઉપવાસનું ફળ જિનેન્દ્ર ભગવાનનાં દર્શન કરવા જવાનું મન થતાં મળે છે. તો પછી એ મન કેટલા બધા વિશુદ્ધ ભાવોલ્લાસવાનું થવું જોઈએ ? એ બનાવવા (૧) એમાં અત્યંત કર્તવ્યબુદ્ધિ થાય, (૨) આહારાદિ તથા કોષ લોભાદિ પાપસંજ્ઞાઓની અટકાયત થાય, અને (૩) દુન્યવી કોઈ ફળની એમાં આશંકા ન હોય, એ રીતે જિનદર્શનમાં ચિત્ત લાગી જાય એ અદ્ભુત ધ્યાનયોગ બને.

એટલે જ અહીં ઝ્યાલમાં રહે કે જો એમ વિચારવામાં આવે કે ‘લાવ પ્રભુદર્શન કરી આવું એટલે દાતણ કરાય,’ તો એમાં તો આહારસંજ્ઞા જોરમાં આવી. તેમજ અત્યંત કર્તવ્ય તેણું કરવાનું લાગ્યું અને દર્શન તો માત્ર એમાં એક સાધન તરીકે જરૂરી લાગ્યું. ત્યાં મહાન ધ્યાનયોગ ક્યાંથી લાઘે ?

“તો મનને એમ થાય કે” અહો ! દિવસ-રાત મોહમૂર્તિઓ અને મોહસાધનોના દર્શનમાં વેડફી નાખ્યા ! હવે વીતરાગ પ્રભુના દર્શને જઈ જીવનસમય સફળ કરું. મોહદર્શનોથી લાગેલા પાપભારને ઉતારું. ‘દર્શન પાપનાશનમ્’ એમ જ્ઞાનીઓ કહે છે. સંસારનું મૂળ કારણ રાગ પાપ, તે જિનદર્શનથી હઠે વીતરાગના

૧૧૪

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

દર્શનથી કંઈક મંદ પડે, માટે દર્શન કરવા જાઉં.’

આવી હૃદયવેધી ભાવનાથી દર્શન કરવા જવાનું મન કરે ત્યાં ઉપવાસનું ફળ મળે એ તો સામાન્ય વાત છે. પછી દર્શનાર્થે ઉઠે, ચાલે, મંદિર પાસે આવી બહારથી જ પ્રભુના દર્શન થતાં અંજલિ લલાટે લગાડી ‘નમો જિણાણં’ કહે ત્યાં કમશા: ફળનો આંક વધતા માસખમણના ફળ સુધી પહોંચે છે; કેમકે ભાવોલ્લાસ પ્રભુની જેમ નજીક આવે તેમ વધતો જાય છે. આમાં ચિત્તની તન્મયતા યાને ધ્યાનયોગ ખરેખરો જામે છે.

હવે મંદિરમાં નિસીહિ કહીને પેસે ત્યાં પણ એથી સંસારના વ્યાપારો બંધ કરવામાં આવે છે. એથી ચિત્ત શુદ્ધ દર્શનનું અભિલાષી બને છે.

પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દે, એ વખતે મનમાં લાવે કે ‘ભવભ્રમણને મિટાવનારી આ પ્રદક્ષિણા છે. એમાં અનંત જ્ઞાનદર્શન-ચારિત્ર સંપન્ન પ્રભુની આસપાસ ભમવાનું થાય છે એથી ઈલિકા-ભ્રમર ન્યાયે મનમાં જ્ઞાનાદિ ત્રણનો ગુંજારવ જાગે છે,’ ફરક એટલો કે ત્યાં ઈયળની આસપાસ ભમરી ગુંજારવ કરતી ભમે છે. અહીં અનંત જ્ઞાનાદિમય પ્રભુની આસપાસ આપણે ગુંજારવ કરતાં ભમીએ છીએ. આ ગુંજારવથી હૃદયમાં જ્ઞાનાદિત્રયનું બીજ પડે છે. જે ઊગીને કાળાન્તરે રત્નત્રયીનો પાક આપે છે. ત્યારે દર્શનની આ પૂર્વ ભૂમિકામાં ય મનની કેવી સુંદર તન્મયતા થાય છે, એ અદ્ભુત ધ્યાનયોગ છે.

પછી પ્રભુની સામે આવી કેડમાંથી નમીને હાથ જોડી ‘નમો જિણાણં’ કહેવું; અને પછી દર્શન કરતાં સુતિઓ બોલવી. આ સુતિઓના આલંબને ચિત્ત પ્રભુની આગળ પ્રાર્થનામાં તન્મય બને છે. એટલું ધ્યાનમાં રહે કે સુતિ બોલતાં આપણે પ્રભુને આપણા દિલની વાત કહી રહ્યા હોઈએ એ સ્થિતિ બનવી જોઈએ. દા.ત. ‘દર્શનં દેવદેવસ્ય, દર્શનં પાપનાશનં...’ બોલીએ ત્યાં દિલ પ્રભુને કહે ‘દેવાધિદેવ ! આપનું દર્શન એ પાપનું નાશક સમ્યગદર્શન છે. વાહ કેવું અદ્ભુત દર્શન ! એ સ્વર્ગનું સોપાન અને મોક્ષનું સાધન છે. આપનો આ કેવો અચિત્ય પ્રભાવ કે આપના દર્શને આ મળે !’

બસ, આ રીતે પ્રભુને સંબોધન કરવા જતા એક તો મન તન્મય થાય. અને બીજી બાજુ એટલી સુતિ પર નવી સ્હુરણા થાય, જેના વડે આપણે પ્રભુને સંબોધી શકીએ.

એમ દર્શન વખતે બીજ પણ વ્યવસ્થિત સંબોધન છે. એ અવસરે વિચારીશું. બાકી એટલું ચોક્કસ છે કે આમ દર્શનમાં અદ્ભુત ધ્યાનયોગ સધાય છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૪૪, તા. ૨૬-૭-૧૯૬૬

## ૪૮ આત્મરોગ હૃતાવવા બે જડીબુઝી

વિવેકી માણસને બાધ્ય શારીરિક રોગો કરતાં આંતરિક આત્મરોગો વધુ ખરાબ દેખાય છે, વધુ તુંબે છે. એ ચાહે છે કે આ આંતરિક રોગો કેમ ટણે.

આંતરિક રોગોમાં પહેલા નંબરે જડ વિષયોનો તીવ્ર રાગ છે, પછી એના પર અહંત્વ માયા વેરારે દ્રેગ ઈચ્છા વગરે અનેકાનેક આંતરિક રોગો પગભર રહે છે. એ બધા વિકારો છે. એના સળવળાટમાં જીવને ચિત્તા, સંતાપ, અશાંતિ, સંકલ્પ-વિકલ્પો વગેરેની પીડા-વિટંબણા રહ્યા કરે છે. અનતાનાં કણથી આનો જ અભ્યાસ હોઈ આ જીવનમાં ય જનમથી મંડીને આ બધા સહજભાવે મહાલ્યા કરે છે.

ત્યારે જેને વિવેક પ્રગટ્યો છે એને સહેજે આનું દિલદર્દ રહ્યા કરે કે, ‘અરે ! આવા ઊંચા માનવભવમાંય આ વિટંબણા ભોગવવાની ? આમાં જ જીવન પૂરું ? ને અહીં જો આ નહિ દબાવાય, તો પછી બીજા કેવા જનમમાં દબાવાશે ? નજર સામે બીજા જીવોનાં જીવન દેખાય છે એમાં તો એ રાગ વગરે રોગોમાં વિકારોમાં સર્જા કરવાનું જ દેખાય છે. ત્યાં એ રોગોની ઓળખ સરર્ખી નથી. પછી એના નિવારણની તો વાતે ય શી ? એ તો અહીં જ એનું વૈદું કરવું પડે.’ પણ એ કેમ કરવું એ જ મોટો પ્રશ્ન છે.

આવા મોટા કાર્યનો એક સરળ ઉપાય આ છે કે આપણા આત્માના અરૂપિપણાનું અને અવિકારીપણાનું મમત્વ આકર્ષણ કેળવવું, એને મહત્વ આપવું, અને એ પ્રાપ્ત કરવાની તીવ્ર કામના તથા સતત જાગૃતિ રાખવી.

આની વારંવાર ભાવના કરવી જોઈએ,- હું અરૂપી છું; ત્યારે કાયા અને બહારના પદાર્થો રૂપી છે. તે ય પાછા નાશવંત છે; જ્યારે હું અરૂપી અને શાશ્વત છું તો પછી મારે રૂપી પદાર્થોનો મોહ શા માટે ? રૂપીમાં તો ફેરફારી થયા કરે છે. તેથી રૂપી પદાર્થોના મોહમાં એમાં ફેરફાર થયે ચિત્તા સંતાપ વગરે કેટલીય આપદા આવ્યા કરે છે. અરૂપી એવા મારે શા સારું આ આપદાઓ વહોરવી ? જો હું એનો મોહ જ ન કરું. એ રૂપી પદાર્થોને હિતકારી સુખકારી જ ન લેખું, ને એમજ સમજું કે ‘મારા અરૂપી આત્માને રૂપીના ગમનાગમનથી શો વિશેષ ? તો પછી રૂપી જાય કે આવે, યા એમાં બગાડો-સુધારો થાય, એને ગણતરીમાં જ લેવાનું કામ નથી. એમ કરી ક્યારે રૂપીથી તદ્દન અલિપ બની મારું અરૂપીપણું પ્રગટ કરું !’

૧૧૬

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

બસ ! આ ભાવના કરતા રહેવાથી મન જાગતું રહેવાનું, અને ઈન્દ્રિય વિષયો અનુકૂળ પ્રતિકૂળ આવે ત્યાં એ રૂપી હોઈ એની ગણતરી નહિ, તેથી એમાં રાગ-દ્રેષ હરખ-શોક કરતાં સંકોચ રહેવાનો, તથા એની પાછળ હિસા જૂઠ ચોરી વગેરે કરવાનું મન જ નહિ હોય. આમ અરૂપીપણું પ્રગટ કરવાની દિશામાં પ્રયાણ રહેશે. આ આત્માના અરૂપીપણાનું મમત્વ કેળવવાથી થતા લાભની વાત થઈ.

એમ આત્માના નિર્વિકાર સ્વરૂપની મમતા થવાથી હૈયે જાગૃતિ રહેવાની કે, ‘અહો ! મારું સ્વરૂપ તો સ્વચ્છ સ્ફટિક જેવું નિર્મણ જ્યોતિસ્વરૂપ અને કોઈ પણ જાતના વિકાર વિનાનું છે તો પછી મારે કામ-કોષ્ઠ-લોભ મદ-ઈર્ધ્વ વગેરે વિકારોને પોષવાનું શું કામ છે ? જ્યાં હું એ મલિન લાગણી ઊભી કરું ત્યાં એનો નવો કુસંસ્કાર વધે છે તેમજ મૂળભૂત નિર્વિકાર સ્વરૂપથી આધા પડાય છે. માટે ગમે તે પદાર્થ, પ્રસંગ કે સંયોગ આવો, મારે એથી આત્મઘરે રાગ દ્રેષાદિ વિકાર ધાલવાના નહિ, પણ માત્ર તટસ્થ દર્શન કરવાનું. વિકાર સેવવાનું કોઈ મારા પર દબાણ કરતું નથી. તેમ વિકાર સેવવાથી બાધ્ય કોઈ લાભ પણ મળતો નથી. તો શી જરૂર મફિતિયા વિકાર સેવવાની ?’

આ ભાવનાનો વારંવાર અભ્યાસ કરતાં કરતાં મન સ્વસ્થ બનતું જાય છે, મલિન લાગણીઓ ઊઠવા જાય એને દબાવતું ચાલે છે. એમ નિર્વિકાર દશા તરફ પ્રયાણ ચાલે છે.

ત્યારે, સંસાર શું છે ? વિષયો અને કષાયો. આત્માના અરૂપીપણાનું મમત્વ રૂપી વિષયોને અકિંચિત્કર કરે છે, અવિકારીપણાનું મમત્વ કષાય વિકારોને દબાવતું આવે છે.

આ બે મમત્વ ચ્યાતકારી છે, આત્માના રોગોને દબાવવા જરીબુઝી સમાન છે. દા.ત. ક્યાંય સાંભળ્યું કે, ‘અમુક ધંધામાં નફો બહુ મળે છે,’ ત્યાં લાલચ નહિ લાગે મનને થશે કે ‘હું અરૂપીપણાને પ્રગટવવા જંખનારો, મારે વળી રૂપીના શા મહત્વ આંકવા ?’ એમ, કોઈએ આપણું કાંઈક બગાડ્યું, ત્યાં દ્રેષ નહિ થાય; જટ વિચાર આવશે કે ‘કર્મસંજ્ઞો એક તો બગાડ્યું, પણ હવે નવો દ્રેષવિકાર ધાલીને વળી બીજું ક્યાં બગાડું ? ઈર્ધ્વ થવા જાય ત્યાં વિચાર આવશે કે (૧) સામો જો જ્ઞાન ધર્મ કે ગુણમાં વધી રહ્યો છે તો એ અરૂપીપણાની દિશામાં છે; એટલે અરૂપી અવસ્થાના પ્રેમી મારે એના તરફ દ્રેષ કેમ જ કરાય ? ત્યારે (૨) જો બાધ્ય સંપત્તિ-સંન્માનમાં વધતો છે, તો એ સંપત્તિ કાંઈ અરૂપીપણામાં ઉપકારી નથી, તુચ્છ છે, એ અંગે ઈર્ધ્વ શી ?’ આમ બીજા પણ અહીંત્વાદિ દોષો દબાતા આવે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૪૫, તા. ૨-૮-૧૯૬૬

## ૪૬ ‘પ્રેરક અવસર જિનવરુ’

માનવ-જીવનમાં મળેલા મનનાં અલૌકિક મૂલ્ય છે. જો શરીર-સંધ્યાણ બળ અનુકૂળ હોય તો એ મનને શુકલધ્યાન-ક્ષપકક્ષેપી પર ચાદી શકાય છે. જેથી પછી આત્મા વીતરાગ સર્વજ્ઞ બને છે. આજના દુબળા સંધ્યાણમાં પણ મનને સાતમાં અપ્રમત્ત સર્વવિરતિ શુણુસ્થાનક સુધી ચાદી શકાય છે. આ વસ્તુ સ્વર્ગના મોટા ઈન્દ્રના મનથી પણ થઈ શકતી નથી.

ત્યારે માન્યતાથી એવી ઊંચી સિદ્ધિ થઈ શકવાનું પણ તો જ બને કે મન જો નિર્મણ અને સત્ત વીર્યોલ્લાસવાળું હોય. મનની નિર્મણતા યાને ચિત્તની વિશુદ્ધિ કરવા માટે ઉત્તમ સાધન શ્રી જિનેશ્વરદેવ છે. શ્રી આનંદધનજ મહારાજ શ્રી ચંદ્રપ્રમસ્વામીના સ્તવનમાં લખે છે.

### ‘પ્રેરક અવસર જિનવરુ, મોહનીયક્ષય જાય’

અર્થાત્ આપણે શ્રી જિનેશ્વર ભગવાનની પ્રાપ્તિ એ પ્રેરક અવસર છે અને એથી મોહનીય કર્મ ક્ષય પામે છે.

હવે અહીં એ જેવું છે કે શ્રી જિનેન્દ્રપ્રભુ પ્રેરક અવસર કેવી રીતે ?

જેવી રીતે માણસને ક્યાંકથી મૂડી પ્રાપ્ત થઈ જાય તો પછી એનો વેપારમાં વિનિયોગ કરવાનો યાને વેપારમાં લગાવી દેવાનો એને પ્રેરક અવસર બને છે. એવી રીતે અનંતાનંત કાળથી જન્મ-મરણની કેદમાં પકડી રાખનારું જે મોહનીય કર્મ છે. એના ક્ષયનો ધંધો કરવામાં જિનેન્દ્ર પ્રભુની પ્રાપ્તિ પ્રેરક અવસર બને છે.

મોહનીયનો ધંધો દાન-શીલ-તપ-ભાવના બને છે; કેમકે દાનથી પરિગ્રહનો મોહ તૂટે, શીલથી વિષયોનો મોહ તૂટે; તપથી ખાઉં-ખાઉંનો મોહ અને ભાવ-ભાવનાથી કષાયો તૂટે.

હવે આમાં જો જિનેશ્વર ભગવાનને આદર્શ તરીકે બરાબર નજર સામે રાખ્યા કરાય અને એ દાનાદિના વિચાર-વાણી-વર્તાવ રખાય, તો એ દાનાદિ ધર્મનો પાવર યાને જોમ-જોસ વધી જાય છે. એનું કારણ, ભગવાને પોતે સાયેલ દાનાદિ ઉત્કૃષ્ટ કોટિના છે. તેમજ એ સેવતા પ્રભુના ચિત્તનો આશય અત્યંત નિર્મણ અને નિરાશંસ રહે છે. એટલે આ રીતે વિચારવું કે,-

પ્રભુનો દાનધર્મ કેવો ! ભગવાને જે રોજ સવારે ૧ કરોડ ૮ લાખ સોનેયાનું

દાન સળંગ એક વરસ સુધી દીધું, અને ચારિત્ર લઈને અનંતાનંત જીવોને અભયદાન દીધું. ને ગરમીમાં એક અનુકૂળ પવનની જગા પણ નહિ હિંચવાની એટલે સુધીનું એકેન્દ્રિય વાયુકાય જેવા જીવોને ય અભયદાન દીધું, એવું કોણ દઈ શકે ? તો હું કેવા દાન પર અભિમાન કરું ? અર્થાત્ પ્રભુએ આટલું મોટું દાન દીધું તો હું થોડું તો દઉ ?

એમ ભગવાને સાધેલો શીલ ધર્મ પણ ઉત્કૃષ્ટ; કેમકે એમાં મોટી ઈન્જ્રાણીઓ ય વદનાર્થે આવે, છતાં એની સામે જોવાની લેશમાત્ર પણ વૃત્તિ નહિ. વળી શીલમાં મહાત્રતો, અભિગ્રહો, સમિતિ ગુપ્તિ વગેરેનાં પાલન અતિ અદ્ભુત !

ત્યારે તપ ધર્મ પ્રભુનો કેવો ! કે ઋષભદેવ ભગવાને દીક્ષા લેતા પહેલા લોકોને નિર્દોષ આહારના દાનની વિધિ ન સમજાવી અને દીક્ષા પછી પોતાને ગોચરી ફરવામાં લોક તરફથી અજ્ઞાશપણાને કારણે એક વરસથી વધુ એવું આહારદાન ન મળ્યું; તો કાંઈ નહિ; એક વરસથી વધુ યાને લગભગ ૪૦૦ દિવસ સુધી તપ ચલાવ્યે રાખ્યો. ત્યારે મહાવીર પ્રભુએ એકવાર સંગમ દેવતાના દોષવાહી અને પછી બિભત્તસ ઉપસર્ગમાં છ માસ સુધી તથા બીજ્ઞવાર ચંદનબાળાએ પૂરેલ અભિગ્રહના પાલનમાં પાંચ દિન ન્યૂન છ મહિના સુધી તપ કર્યે ગયા ! ઉપરાંત જઘન્ય તપ છંક (બે ઉપવાસ) નો અને ઉપરના તપમાં અહુમ માસખમણ, દોઢમાસી, દો માસી અઢી માસી તથા ચાનુમાસી તપ કરતા ૧૨॥ વર્ષમાં ૧૧॥ વર્ષથી પણ અધિક ઉપવાસ કર્યા. આવાં તપ પણ ચાલુ વિહાર, રાતદિવસ કાયોત્સર્ગ ધ્યાન અને ધોર ઉપસર્ગ-પરીસહીના સહન સાથે ! એટલે પ્રભુનો તપધર્મ પણ ઉત્કૃષ્ટ.

ત્યારે પ્રભુનો ભાવ-ભાવના ધર્મ પણ કેવો ! કે જગતના જીવમાત્રનો ઉદ્ધાર કરવાની કરુણા; ધોર ઉપદ્રવ કરનારા પ્રત્યે પણ ઊંચો મૈત્રીભાવ, ક્ષમાભાવ; અવધિ-મનઃપર્યાય જ્ઞાનથી લોકોના ગુણ દોષો છિદ્રો ઘણું જાણી શકે. પરંતુ ના, એની પ્રત્યે ઉપેક્ષાભાવ; સુખ-દુઃખના પ્રસગોમાં મધ્યસ્થભાવ ‘અનંતબલી અરિહંતજી’ છતાં પોતાને કચ્છનાર હાલી-મવાલી સામેય નિરભિમાનતા; એવો નિષ્કપ્ત ભાવ, નિલોભતા વગેરે પ્રશસ્ત પવિત્ર ભાવો અને રાત દિવસ તાત્વચિંતનાં-તત્વભાવના...આ બધું સર્વોત્કૃષ્ટ.

બસ, આ બધું આપણને દાનાદિ ધર્મની સાધના માટે પ્રેરક છે. મહાન પ્રેરણાદાયી છે. જો આપણને એનો પ્રમાદ થતો હોય તો ભગવાન જાણે કહે છે મૂર્ખ ! પુણ્યોદયે મળેલા વૈભવ-વિલાસમાં તું રાચે છે. પરંતુ અમારી સામે જો, કે અમને તારા કરતાં કેટલા ગણા ઊંચા અને નિર્ભેણ વૈભવ વિલાસ મળેલા, છતાં

અમે એ છોડી દાનાદિ ધર્મમાં લાગ્યા, તે પણ ઉત્કૃષ્ટ દાનાદિ ધર્મમાં, તો પછી તું એ તારા તુચ્છ વૈભવવિલાસ છોડી દાનાદિ ધર્મ સાધવામાં કેમ પાછો પડે ?

ત્યારે જો આપણને દાનાદિ સેવીને તુચ્છ આકંશાઓ થતી હોય અથવા અભિમાન થતું હોય કે ધર્મનો સંતોષ વાળી લેવાનું કરાતું હોય, તો તો પ્રભુને સિદ્ધ આકંશા રહિતતા, નિરભિમાન, અને ધર્મની ઉત્તરોત્તર ઉત્કટ ભૂખ, એ બધું નિત્ય નજર સામે રાખવાથી નિર્ભેણ જોસીલી ધર્મસાધનાની પ્રેરણા મળે. આમ જિનવર પ્રેરક અવસર બને.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૭-૧૭, અંક-૪૬, તા. ૮-૮-૧૯૬૬

## ૬૦ પરના ખેલ ઉપર લહેવાઈ ન જવાય

એ તો નિશ્ચિત વાત છે કે આ જગતમાં જે જીવન મળ્યું છે એમાં સુખ-દુઃખ સગવડ-અગવડ પોતાના પૂર્વકૃત કર્મના આધારે જ મળવાના. અલબત્તું એ મળવામાં પોતાનો સવળો-અવળો પુરુષાર્થ યાને ઉદ્ઘમ કંઈક કામ કરતો દેખાશે, પરંતુ એનું મહત્વ દર્હી વલોવી કાઢવા માખણ કાઢવા માટે એમાં ઉમેરાતા પાણી જેટલું છે.

ગોળીમાં જામી પડેલું શિયાળાનું દર્હી બરફી જેવું કઠણ હોય છે. એમાં વટલોઈ ગરમ પાણી નાખી પછી એને વલોવામાં આવે છે, એટલે એમાંથી માખણ ઉપર તરી આવે છે. શું આ માખણ પાણીના ધરનું ? કે દર્હીના ધરનું ? કહેવું જ પડે કે દર્હીના ધરનું. કેમકે દર્હી જેટલું સન્ચવાળું, એટલું માખણ વધારે નીકળે છે, ને દર્હી જો મલાઈ કાઢી લીધેલા દૂધનું, તો એમાંથી એવું માખણ ન નીકળે. આ સૂચ્યે છે કે માખણ દર્હીના ધરનું છે; ને એમાં ઉમેરાતું પાણી નિમિત્તરૂપ છે.

બસ, એ પ્રમાણે અહીં જીવનમાં મળતી સગવડ-અગવડ સુખ-દુઃખ પૂર્વકૃત ધરના છે, અને ઉદ્ઘમ માત્ર નિમિત્તરૂપ છે. શાસ્ત્રો કહે છે,-

### સચ્ચ પુલ્વકયાણ કમ્માણ પાવએ ફલવિવાગં

જી અહીં જે કાંઈ સાદું નરસું મેળવે છે એ પોતાના પૂર્વે કરેલ કર્મનો ફળવિપાક છે, મૂળમાં જો કર્મ દુબાળાં તો ધંધામાં ધણો ય ઉદ્ઘમ કરે છતાં મળવામાં શિગોડા, હોશિયારીથી ધંધો કર્યો ને સારા પૈસા મળ્યા, એટલે લાગે કે ‘આ હોશિયારીભર્યો ઉદ્ઘમથી મળ્યા’ પરંતુ મળવામાં એ ખરું કારણ નથી; નહિતર તો

પોતાના સેલ્વમેનમાં ય એ હોશિયારી-ઉદ્યમ છે, તો એ જ કાં લાખોપતિ ન થઈ જાય ? પરંતુ ત્યાં મૂડી, લાગવગ, યશ વગેરે કામ કરે છે, અને એ પૂર્વકૃત ઉચ્ચ ગોત્ર કર્મ, યશનામકર્મ, લાભાંતરાય ક્ષયોપશમ વગેરેનો પ્રત્યાવ છે. ઉદ્યમ તો પેલું પાણી ઉમેરવા જેવું નિભિત્તમાત્ર છે.

હવે જ્યારે આ હક્કિકત છે કે કર્મવશ જગતની વચમાં રહેતાં કંઈ ને કંઈ અગવડ-પ્રતિકૂળતા-આપત્તિ વગેરે તો આવ્યા કરવાની; તો શું જીવે દુઃખ માન્યા જ કરવાનું ? બેદ-સંતાપ કર્યા જ કરવાના ? બીજાનો વાંક કાઢી એના પર ગુસ્સે થવાનું ? એમ સુખ-સગવડ મળવા પર જાતવડાઈ અતિ હર્ષ અભિમાન વગેરે કર્યા જ કરવાના ? અને જિંદગી જો આમ જ પૂરી થાય તો આત્મ-ઘડતરની દૃષ્ટિએ સારું શું કમાયા ?

ખરી રીતે માનવ મનની આ કમજોરી છે કે દુનિયાનું સારું નરસું મળવા પર ‘આ ઠીક થયું’ ‘આ ઠીક ન થયું’ વગેરે રાગ-દ્રેષ અને હર્ષ-બેદની તુચ્છ લાગણીઓ ઊભી કરે છે. મૂળ પાયાની આ કમજોરી પર પછી પૂર્વના શુભાશુભ કર્મ તરફ તો દૃષ્ટિ જ જતી નથી, ને ઊલટું દુનિયાનું મનગમતું મળી કે બની આવવા પર એ ગમે તેવા અધમ ઉપાયે મળ્યું કે બન્યું હોય છતાં એ ઉપાયમાં કશ્યું ખોટું નહિ લાગે, ને ઉપરથી વ્યાજબીપણું લાગે, એવી બીજી કમજોરી ઊભી થાય છે, પછી એના વધુ લોભની ત્રીજી કમજોરી જાગે છે.

એમ અણગમતું બનવા પર બેદ થયા પછી એમાં બાધ નિભિત્તભૂત જીવો પર ગુસ્સો-દ્રેષ-ઈઞ્ચર્સ વગેરે બીજી માનસિક કમજોરી ઊભી થાય છે. આગળ વધીને એક યા બીજા પ્રકારે વેર વાળવાની, કે એની નિંદા કરવાની, યા છેવટે એનું બગડવા પર રાજ થવાની ત્રીજી કમજોરી ઊભી થાય છે, ઉપરાંત એ અણગમતું સુધારવા માટે ભારે ધમપદ્ધતા દોડધામ અને ગમે તેવા અધમ ઉપાય પણ કરવાની ચોથી કમજોરી ઊભી થાય છે.

ગમતું-અણગમતું થવા પર જો ઝટ પૂર્વના શુભાશુભ કર્મને ભળાવ્યું હોત, તો મન વાળત કે આ તો કર્મના ખેલ છે. કોઈના ખેલ પર આપણે લહેવાઈ જવાનું હોય નહિ, તેમ કર્મ સિવાય બહાર કોઈને ગુણ-દોષ દેવાની જરૂર નહિ. વળી ગમતું બન્યું એ તો પુણ્યે બન્યું કિન્તુ આપણે પાપ ઉપાય સેવ્યા એ માથે પડ્યા. અણગમતું ય પોતાના જ અશુભોદ્યથી બને છે એમાં બીજા પર ગુસ્સો દ્રેષ શા માટે ? એથી તો ઊલટું નવા અશુભ કર્મ ઊભી થાય છે....ઇત્યાદિ સાવધાની રહેવાથી મનની કેટલીય કમજોરીથી બચી જવાત.

આત્મ-નિરીક્ષણ કરીએ તો માલુમ પડે કે દિવસ અને રાતમાં એવી તુચ્છ લાગણીઓ, નિષ્ફળ સંકલ્પ-વિકલ્પો આર્તધ્યાન અને અસત્ર ચિંતા-સંતાપ-મનોરથો વગેરે કેટલીય મનની કમજોરીઓ ઊભી કરીએ છીએ; પણ ખરી રીતે તો કર્મના નીતરતા ખેલ સમજીને એને અટકાવી શકીએ; અને એ અટકે તો મન સુદૃઢ સશક્ત અને શુભસર્જક બની શકે.

મનની કમજોરી પર પ્રેરક ભવ્ય વિચાર હવે પછી.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૪૭, તા. ૨૩-૮-૧૯૬૮

## ૬૧ મનની કમજોરી

માણસને શારીરિક કમજોરી થાય તો ઝટ દિલને ખૂંચે છે, કાં તો વૈદ ડાક્ટર પાસે દોડે છે, નિદાન કરાવે છે. જરૂર પડ્યે સ્કીનિંગ, બલ્ડટેસ્ટ કફ્ટેસ્ટ, યુરીનટેસ્ટ વગેરે કેટલીય જતની તપાસ કરાવે છે, અથવા જાતે સમજીને દવાઓ ખાય છે. રસાયણ-વસાયણ અને પૌષ્ટિક પદાર્થ વાપરે છે. કમજોરી હટતાં પારાવાર આનંદ અનુભવે છે.

પરંતુ મનની કમજોરી માટે કોઈ જ્યાલ ખરો ? આવા ઊંચા માનવભવમાં શરીર કમજોર રહ્યે એવું નુકસાન નથી જેવું મન કમજોર બની રહેવામાં છે. શરીરે સશક્ત પણ મન કમજોર હોઈ રાગ-દ્રેષ-કલહ-મદ વગેરે સેવતાં સ્નેહી સાથે જીવનવૈર પણ ઊભા થાય છે. તેમ સદ્ગુણ-સદાચારો મોંઘા બને છે. ત્યારે આજે દુબળા દેખાતા પણ મનોભળિયા કેટલાય ભાઈઓ અને બહેનો સદ્ગુણ સદ્ગુર્તન અને સુફૂત-સદાચારોની આરાધના કરી શકે છે. એમાં એ શરીરની કમજોરી એમને અટકાવતી નથી.

ત્યારે મનના જે કમજોર છે એમને સદ્ગુણોનો અભ્યાસ અને સદ્ગુર્તન, સુફૂત-સદાચારોનું પાલન મુશ્કેલ બની જાય છે.

આનું કારણ એ બને છે કે મનની પહેલી કમજોરી એ કે જીવમાં સત્ત્વ નથી, Resisting power નથી. એટલે સામે આવતા પ્રલોભનમાં લલચાઈ જવાય છે, અથવા સહેજ સહેજ આપત્તિમાં પણ ઊકળતા, વ્યકૃતિ, ને ભયભીત થઈ જવાય છે; અથવા જરા રસ-ત્રાદ્વિ-શાતા સારા મજ્યા કે મદ આસક્તિ થઈ આવે છે, ત્યારે બીજાને એ વિશેષ મજ્યાનું જોઈ ઈઞ્ચ-અસૂયા (અસહિષ્ણુતા) થઈ

આવે છે. આ બધું સત્ત્વહીનતા, લુભ્યપણું, વ્યાકુળતા, ભય, મદ, આસક્તિ, ઈર્ઝા વગેરે શું છે ? એ બધી ય મનની કમજોરી છે. બીજો કોઈ જરાક આપણું અણગમતું કરે, આપત્તિ આપે, પ્રતિકૂળ બોલે-કરે, કે તરત ગુસ્સો આવે છે, દ્વેષ થાય છે. એ પણ મનની કમજોરી છે.

દા.ત. મોટી કંપનીનો માલિક જો કોઈ એક મજૂર જરા વાંડો ઉભો, જાહુવાળીએ જરું આંદું પકડજું, વગેરે વગેરે બાબતો પર ગાટકી પડે, ઉકળી પડે, તો એ સત્ત્વહીન ગણાય, પોતાના જ માણસોમાં ઈજજત ગુમાવે લોકપ્રિયતા ગુમાવે એવી રીતે પૂર્વ કર્મને અનુસારે બનતી આ જગતની બાબતો પર વ્યાકુળતા કરવી સંતાપ કરવા, ગુસ્સો-ઉકળાટ દ્વેષ જગાવવા એ ય નિઃસત્ત્વતા છે. કમજોર મનના જ એ ભાવો છે.

એવી રીતે જેમ કોઈ બે પૈસા કમાયો પછી એના પરના રાગથી બહાર બહુ એને ગાયા કરે અથવા અભિમાન બતાવે તો લોકમાં ભૂંડો દેખાય છે, અથવા જેમ કોઈને ત્યાં મેમાન બનેલો માણસ સારા પકવાન્નને જમતાં જો બહુ હરખ હરખ દેખાડે, જલદી જલદી અને અકરાંતિયાની જેમ ખાય, માગી માગીને ભાણામાં ચીજ મુકાવે, ઈત્યાદિ કરે તો અવિવેકીમાં ખપે છે. આબુરુ ગુમાવે છે, એનું મન નિર્માલ્ય ગણાય છે, તેમ જગતનાં ઈશ વિષયોમાં રાગ કરે, હરખાઈ જાય, માગણિયો બને, ઘેલો થઈને ભોગવે, તો એનું મન પણ નિર્માલ્ય જ ગણાય. કમજોર ગણાય.

બસ મનની આ બધી કમજોરી છે કે મનમાં રાગ ઉઠે, દ્વેષ ઉઠે, હર્ષ થાય, ખેદ થાય, ઈર્ઝા અસૂયા થાય, જડના આકર્ષણ-મૂલ્યાંકન થાય, ઈત્યાદિ. - અગર મનને સાત્ત્વિક બનાવાય તો આ બધી કમજોરીને ઓછી ઓછી કરી શકાય.

સત્ત્વ ખીલવવા માટે આ વિચાર કરવો જોઈએ કે ‘આમ વ્યવહારમાં પણ જે રાગ હરખ મદ વગેરે કરવાનું ભુંકું દેખાય છે, એ તાત્ત્વિક દાખિએ જોતા તો મનની બુરાઈઓ જ છે, કમજોરી છે, શું હું મનનો એવો કમજોર છું કે એ મન પર આ તુચ્છ રાગ હર્ષ મદ વગેરે લાગણીઓ ચીડી બેસે ? અગર અહીં એને હટાવવા યત્ન નહિ કરું, તો તો એ કમજોરી વહીની ચાલવાની; અને એનો પહેલો પ્રત્યાધાત એ પડે છે કે કમજોર મન રાગવશ જેવું પત્તી વગેરેમાં ગદ્દગદ થઈ ભણે છે, એવું પરમાત્મામાં ભળી શકતું નથી, સ્થિર રહી શકતું નથી. ત્યારે આવા તુડા મનુષ્યભવમાં આવ્યા અને ભગવાનમાં દિલ ન ભળે એ કેટલી મોટી ખોટ ? કેવી કમનસીબી ? એવું જ આહાર, રૂપરસાદિ વિષયો, અને ધનમાલ વગેરેના પરિશ્રહમાં કમજોર મન રાગ-મમતા-તુષ્ણાવશ ભળે અને તપ-શીલ-દાનમાં ન ભળે, મન તપ આદિને પોતાના ન કરી શકે, પોતે એમાં આનંદ અને આહારદિભાં કંટાળો ન અનુભવી શકે, એ પણ ભવ માનવનો છતાં આત્માની કઈ ઉન્નતિ ?’

આ જ વાત છે કે મનની કમજોરી દૂર કરી એને એવું સશક્ત બનાવવું જોઈએ કે ખાનપાન પહેરવેશ મોજશોખ વગેરેની પ્રલોભક વસ્તુ સામે આવીને ઊભી રહે કે દિલ એમ બોલે કે ‘આમાં છે શું ? હું કાંઈ નબળો દૂબળો નથી કે આ બધામાં ઘેલો-મેલો થઈ જાઉં, મદાન્ય બની જાઉં, આ બધા નાશવંત, હું અવિનાશી આ વિકારક, ને હું અવિકારી. આ તો જડ, ને હું અનંતશક્તિ-ચૈતન્યનો માલિક. હું શાંતો તુચ્છ રાગ-દ્વેષ કામ-કોષ હર્ષ-ખેદ મદ-ઈર્ઝા વગેરે નબળાઈ સેવું ?’ એમ કરી મનની એ કમજોરી અટકાવવાની છે, એનો દીર્ઘકાળ અભ્યાસ ચાલુ રાખવાનો છે, જેથી મનોભળ વધતાં ઉચ્ચ ગુણસ્થાનક પ્રાપ્ત થાય.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૭, અંક-૪૮, તા. ૩૦-૮-૧૯૬૬

## ૬૨ કામ-કોધાદિ રોકવા એક નક્કર ઉપાય

જીવ સંસારમાં અનંતા કણથી દુઃખમાં ભટકે છે, ને આ જીવનમાં પણ દુઃખી થાય છે, તે પોતાના કામ-કોષ-લોભ મદ-માયા-હર્ષ વગેરે કખાયોના કારણે. શુદ્ધ બનેલા આત્માને ક્યાં-સંસારભ્રમણ રહે છે ? તેમ બાબ્ય કાયા પણ સણગી ઉઠે છતાં જો એના પર રાગ નથી, મમત્વ નથી તો દુઃખ શાનું લાગે ? ગજસુકુમાળ મુનિના માથે સણગી સણગી છતાં એમણે ‘જે સણગે છે તે મારું નહિ ને મારું છે તે સણગે નહિ,’ એમ કાયાની મમતા મૂકી દીધી તો જરાય દુઃખ લગાડ્યું નહિ, ને એથી જ ઉચ્ચ ધ્યાનમાં ચઢીને કર્મ ખપાવી મોક્ષે સિધાવી ગયા, બસ દુઃખ અને ભવભ્રમણ આ કખાયોના કારણે છે.

એ કખાયોને અટકાવવા માટે અનેક ઉપાયો છે. એમાં એક નક્કર ઉપાય આ છે કે જગતના બાબ્ય પદાર્થોમાં અને આત્માની અંદરના મલિન ભાવોમાં અત્યન્ત અસારતાની બુદ્ધિ ઊભી કરવી અને ટકાવવી. મન વારંવાર કદ્યા કરે કે આ ધન-માલ-મહેલાત, કુટુંબ-પરિવાર કે સન્માન-પ્રતિષ્ઠામાં કશો સાર નથી. અંતે એમાંનું કશું હાથમાં નહિ, એમ અંતરના કામ-કોષ-લોભ મદ-ઈર્ઝા વગેરે મલિન ભાવોમાં ય કશો દમ નહિ આત્માને કશો લાભ ન કરે, ઊલંઘું નિઃસત્ત્વ અને ચિંતાતપ્ત બનાવે એ બધા ય મલિન ભાવો અસાર નિસ્સાર છે.

આ અસારતાની બુદ્ધિ દર્શાવી કરવા માટે દેવાધિદેવ શ્રી મહાવીર ભગવાનનું અનુપમ દર્શાન્તા છે.

પ્રશ્ન છે કે એમણે જ્યારે ધર છોડી ચારિત્ર લીધું ત્યારે એમાં એટલું બધું જોમ ને જોશ કયાંથી આવ્યું કે તરત ત્યાં મનઃપર્યાય જ્ઞાન પ્રગટ થયું અને ઠેઠ કેવળજ્ઞાન પ્રગટવા સુધી ધોર તપ, ભયંકર ઉપસર્ગ-પરિસહ-સહન તથા રાતદિવસના ખડા ખડા કાયોત્સર્ગ-ધ્યાન કરી શક્યા ?

આનો જવાબ એ જ, કે પ્રભુએ ચારિત્ર લેતી વખતે બાધ્ય પદાર્થો યાવત્તુ પોતાની કાયા તથા અંતરના મલિન ભાવોમાં અતિ ઉત્કૃષ્ટ અસારતાની બુદ્ધિ ઊભી કરી;- ‘બધું જ અત્યંત અસાર, મારી કાયા પણ અસાર, ને અંતરના કામ-કોધાદિ ય અસાર, મારો શુદ્ધ આત્મા જ સારભૂત-’ આ બુદ્ધિનો એવો પડધો પડચો કે એ મહાન અપ્રમત્તભાવ, જાગરિકા ને અલિપ્તભાવ પર ચડ્યા ને એથી જ ત્યાં મનઃપર્યાય-જ્ઞાન પામ્યા; તેમજ પછીથી અતિ ઉચ્ચ કઠોર સાધના કરી.

એમણે ધોર તપ કર્યા, પરિસહ-ઉપસર્ગ સંખ્યા ! કેમ ન કરે ! કેમ ન સહે ! નજર સામે કાયા અત્યંત અસાર તરીકે તરવરતી હોય, પછી એના ભૂખે મરવા કે ફૂટાવામાં પોતે શું કામ લહેવાઈ જાય ? મુસાફરીમાં કોઈ મહા મવાલી ધારો કે સાથે લાગી ગયો હોય તો એ એવો અસાર લાગે છે કે પછી જો એ રસ્તામાં ભૂખે મરતો હોય કે બીજાથી એ ફૂટાતો હોય તો એથી કાંઈ લહેવાઈ જવાનું નથી. ઊલદું સંતોષ રહે છે કે આમ જ એ એકવાર આપણાથી ધૂઠી જશે બસ એ મહામવાલી એટલે શરીર, પ્રભુએ એને અસાર માન્યું.

પ્રભુને મોટી રાજરાણીઓ અને ઈન્દ્રાણીઓ નમવા આવી પ્રભુ કેમ ન આકર્ષાય ? કારણ એ જ કે પ્રભુ એમને અસાર દેખે છે; એમ મોટા ચમરબંધી રાજાઓ દેવો અને ઈન્દ્રો આવી આવી પ્રભુને નમે છે; પ્રભુ કેમ પોતાનું આત્મધ્યાન મૂકી એમના તરફ ન ખેંચાયા ? આટલા જ માટે કે પોતાના આત્માની દસ્તિએ આવા મોટા ભક્તોની ભક્તિ-સન્માનને પણ અસાર માને છે.

ત્યારે ભારેમાં ભારે પરીસહ ઉપસર્ગોમાં ય પ્રભુએ લેશ પણ ઉદ્દેગ અરતિ ન કરી એ પણ એ બધાને અસાર શરીરની તકલીફો લેખી હતી માટે. આપણું જ બહુ જીર્ણ અને મેલું દાટ થઈ ગયેલું કપડું અસાર ફેંકી દેવાનું માની લીધા પછી એ કપડા પર ગંદવાડ કે ઉજરડા આવે તો આપણા મનને કાંઈ દુઃખ લાગતું નથી. તો પ્રભુએ સંયમ લેતા શરીર પર પણ એવી અસારતાબુદ્ધિ ઊભી કર્યા પછી હવે એના પર પરીસહ ઉપસર્ગ આવે તો તેથી શું કામ મનને દુઃખ લગાડે ? ઊલદું એ અસાર શરીરની તકલીફોથી સારભૂત પોતાના આત્મા પરના કર્મકચરા નીકળી જતા જુએ છે. તેથી શરીરની તકલીફો વધાવી લે છે.

વાત આ છે કે જડમાત્રમાં ભારોભાર અસારતાની બુદ્ધિ જવલંત જાગતી જોઈએ પછી એ મોટા દુશ્મનના શરીર હો તો ય એને અસાર લેખ્યા પછી એના પર કોઈ નહિ થાય, તેમ મોટી અસરાના શરીર હો તો ય એના પ્રત્યે કામ રાગ નહિ જાગે, એવી રીતે અંતરના કામકોધાદિ મેલા ભાવોને અત્યંત અસાર લેખ્યા પછી એને પાળવા-પોષવાનું મન નહિ થાય. મનને થશે કે ‘શા હું આવા તુચ્છ અસાર ભાવોને ઊભા રાખું ?’ એમાં વારંવાર જોરદાર અસારતાની બુદ્ધિ કેળવવી એ એને હટાવવાનો મહાન ઉપાય છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૨, તા. ૧૩-૮-૧૯૬૮

### (૬૩) નિષ્ફળ-નકામા વિચારોનો અતિ ભયંકર રોગ : એનું ઓષ્ઠદ

જીવનમાં તપાસ કરો કે એક દિનભર શું પણ એક કલાકભરમાં નિષ્ફળ અને નકામા વિચારો કેટલા આવે છે ?

વિચાર નિષ્ફળ એટલે જે વિચારનું કાંઈ સાંદું ફળ આવવાનું નથી, યા આપણે વિચારમાંથી કશું સાંદું નિપાજાવી શકવાના નથી. વિચાર ‘નકામો’ એટલે જેનું કોઈ પ્રયોજન નથી.

દા.ત. ધરમાં પેઠા, એના એક ભાગમાં કચરો ઢીઠો, જો જતે દૂર કર્યો, યા માણસ પાસે દૂર કરાયો, તો તો ઢીક, પરંતુ મનમાં બબજુચા કે ‘આ ધરના માણસ કેવા કે અહીં હજુ કચરા પડ્યા છે ? કશું ભાન નથી. એદીપણું છે, બેપરવાઈ છે...’ ચાલી વિચારમાળા. શું વળવાનું એથી ? કચરો ઉપડી જવાનો ? માણસ સુધરી જવાના ? ના કશું સાંદું નહિ. કદાચ આમ વ્યાકુળ થઈને કહેવા જશે તો સામાને કચરાના ખ્યાલ સાથે પોતાની ઉગ્રતા કોણિતાનો પણ ખ્યાલ આવશે, માટે આ વિચાર નિષ્ફળ વિચાર છે.

એમ ચીજવસ્તુ ખોવાઈ ગઈ બગડી ગઈ એના પર પણ શોક-ઉદ્દેગભર્યા વિચાર એ બધા નિષ્ફળ વિચાર છે.

એમ ‘હું આમ કરીશ તેમ કરીશ; આવું આવું બને તો કેવું સાંદું ?’ પેલો આમ કેમ કરે છે ?...’ ઈત્યાદિ વિચારો પણ જો પુણ્યના અભાવે કે સ્થિતિ-સંયોગ-સામગ્રીના અભાવે અમલમાં આવી શકવાના નથી તો એ નિષ્ફળ વિચારો છે.

એમ જ્યાં પોતાને કોઈ લાગતું વળગતું નથી એના વિચારો, દા.ત. ‘પેરિસમાં સૌંદર્ય ધણું ! અમેરિકામાં જહોજલાલી ધણી ! ભાકરાબંધ અવ્યલ બાંધો, ફલાણાનો બંગલો આલીશાન !...’ આવા વિચારોનું કોઈ પ્રયોજન નથી, એટલે એ નકામા વિચારો છે.

દિવસ-રાતમાં આવા આવા નકામા અને નિષ્ફળ વિચારો કેટલા આવતા હશે ? લોટબંધ ! આજના માનસશાસ્ત્રીઓ પણ કહે છે કે એવા વિચારોથી મનની શક્તિ ઘટતી આવે છે. અને કમજોર બનેલું મન સુંદર ભવ્ય વિચાર કરવા માટે, અવસરે ધીરતા અને સ્થિરતા રાખવા માટે, તથા મહાન સદ્ગુણો કેળવવા માટે નિઃસત્ત્વ મુડદાલ અયોગ્ય બની જાય છે.

(૧) ત્યારે જૈન શાસ્ત્રો બતાવે છે કે એવા વિચારોમાંથી સહેજે આર્તધાન થયા કરે છે અને મનની ઉગ્રતા વધતાં રૌદ્રધ્યાન પણ લાગી જવા મોટો સંભવ છે. આર્તધાન તિર્યંગતિનાં અને રૌદ્રધ્યાન નરકગતિનાં પાપકર્મ ભેગાં કરી આપે છે.

(૨) આટલું જ નહિ પણ નિષ્ફળ કે નકામા વિચારમાં રાગ-દ્રેષ્ટ હરખ-ખેદ, ઈર્ધ્યા-મદ વગેરે મિશ્રિત રહેવાથી એના કુસંસ્કારોનો થોક આત્મા પર વધતો જાય છે. ‘પેરિસ સુંદર...’ વગેરે વિચારવા ગયા ત્યાં રાગ, ‘અહીં એવું નહિ’ એનો ખેદ, ચીજ ખોવાવા પરના હાયવોયના વિચારમાં શોક-ઉદ્ઘેગ; ‘હું આમ કરીશ તેમ કરીશ...’ વગેરે વિચારોમાં મદ લાલસા; ‘ફલાણો માણો બહુ ફાયો, અભિમાની થયો છે,’ એમાં ઈર્ધ્યા... ઈત્યાદિ ઈત્યાદિ દુર્ગુણોના કુસંસ્કાર જમતા જ જાય છે. એની આગળના ભવોમાં કેટલી બધી ખરાબ અસરો નીપજવાની ?

(૩) એટલું જ નહિ પણ એવા નિષ્ફળ-નકામા વિચારોમાં મન ઝૂબ્યું રહેવાથી સુંદર ભાવનાઓ, તત્ત્વચિંતન, સ્વાત્મચિંતન કે પરમાત્મ ધ્યાન કરવા માટે જગા જ નથી રહેતી. કદાચ એ લઈ બેસે તો પણ પેલા બહુ અભ્યાસી વિચારો એમાં તરત ધુસી જઈ એને હટાવી મૂકવાના. ખલાસ ! માનવજીવન એમ જ ઝૂચામાં પૂરું.

આમ, નિષ્ફળ-નકામા વિચારો એ અનન્ય અને અતિભયંકર રોગ છે.

આ તો હકીકિત થઈ, ત્યારે એને નિવારવાનો કોઈ ઉપાય છે ? હા, પહેલા નંબરનો ઉપાય એ, કે શાસ્ત્રોનાં ખૂબ ખૂબ અધ્યયન વાંચન-મનન-પરાવર્તનમાં ચિત્તને લગાડી દેવું. બધું મોંઢે થઈ એનું મનમાં વારંવાર પરાવર્તન શક્ય ન હોય, તો ય વાંચનમાંથી ડાયરીમાં ટૂંકી ટૂંકી નોંધ કરી લેવી, અને એને વારંવાર વાંચીને મોંઢે કરવા પ્રયત્ન કરવો, ને પછી એનું પરાવર્તન કરવું. બસ ચિત્ત એમાં રોકાઈ રહેવાથી નિષ્ફળ અને નકામા વિચારો ઘણા ઓછા થઈ જશે.

બીજો એક ઉપાય આ છે કે એ વિચારવું કે શું જગતના મોટા મોટા પદાર્થ

કે નાની નાની ચીજો, એમાંનું કોઈ એક પણ દુનિયાનું જોવાનું કે આસપાસનું જોવાનું કે વિચારવાનું કરે છે ? ના, તો આપણે શા માટે એ જોવા-વિચારવાનું લઈ બેસી નાહકના દુઃખી થઈએ છીએ ? અહીં પ્રશ્ન થાય,-

પ્ર.- તો આપણે શું કશું જોવું વિચારવું નહિ એટલે જડ સંમૂહીંમ થઈ બેસવું ? ઇન્દ્રિયો છે મન છે એટલે જોવા વિચારવાનું તો સહેજે થાય. એમ તો કેવળજ્ઞાની સર્વજ્ઞ ક્યાં આખા જગતને નથી જોતા ?

૩.- સર્વજ્ઞ જે બધું જુએ છે એ રાગદ્રેષ અને હર્ષ-ખેદ વિના, તેથી એમને કોઈ દુઃખ નથી.

આપણને હજુ એવું રાગાદિના લપ વિનાનું દર્શન કે વિચારણા આવડતી નથી; તેથી ડહાપણ આ છે કે જેમ જડ એ બહારનું વિચારતું નથી તો દુઃખી થતું નથી, તેમ મારે બહારનું વિચારી વિચારી શા માટે દુઃખી થબું ? શા માટે સુકાવું ? અલભત જડ કરતાં એ વિશેષતા રાખવી કે પોતાના આત્માનો પૂરો વિચાર, ને તે પણ સફળ વિચાર કરતા રહેવું.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩, તા. ૨૦-૯૯૬૬

## ૪૪ ગૃહસ્થ બહારથી સુખી, અંદરથી દુઃખી સાધુ બહારથી દુઃખી, અંદરથી સુખી.

‘માનવ-જીવન કેવા ઉદેશથી તથા કેવા આદર્શોથી અને કેવા ભાવ સાથે જવવું,’ એ વિચારવાની બહુ મહત્વની વસ્તુ છે, કેમ કે ઊંચા ઉદેશ-આદર્શ અને ભાવ વિનાનું જવન તો પશુજીવન છે. એ ઊંચા ઉદેશ-આદર્શ-ભાવ કેવા હોય એનો વિચાર આ એક પંક્તિ પરથી કરી શકાય,-

‘સાધુ સદા સુખ્યિયા કહ્યાં, દુખ્યિયા નહિ લવલેશ.’

-અર્થાત્ સાધુ મહારાજ સહેજ પણ દુઃખી નહિ, કિન્તુ હંમેશના સુખી તરીકે શાસ્ત્રો ઓળખાવ્યા છે. કહ્યું છે કે અવિરતિ સાખ્યાદિષ્ટ ગૃહસ્થ શ્રાવક બહારથી સુખી, પણ અંદરથી દુઃખી હોય છે, ત્યારે સાધુમહર્ષિ બહારથી દુઃખી, છતાં અંદરથી સુખી હોય છે. તે એ રીતે, કે

શ્રાવક બહારથી સુખી અંદરથી દુઃખી :-

ગૃહસ્થને બહારના વેલ્બવ પરિવાર આદિ અનુકૂળ સંયોગો હોય એટલે દુનિયાની

દાસ્તિમાં સુખી દેખાય, પરંતુ અંદરથી એનું દિલ દાઝતું હોય છે કે ‘આ રોજના ઘટકાય જીવ-સમારંભ અને સતર પાપસ્થાનક ભર્યા સાંસારિક જીવનમાં કેટલાં બધાં કર્મ બાંધવાના. કેવા બિચારા નિર્દોષ સ્થાવરકાય અસંખ્ય જીવોનાં સાક્ષાત્ સંહાર ? અને કેટલાય ત્રસ જીવોના અજ્ઞાણે સંહાર ! પાપસ્થાનકોનાં સેવનમાં કેવું અનાદિના કુસંસ્કારોનું પોષણ-દફીકરણ ? અને કેવું માનવજીવનમાં જ લભ્ય સંયમજીવનથી વંચિત રહેવાનું ?’... આમ અંદરથી કકળાટ હોય એટલે સમકિતી ગૃહસ્થ બહારથી સુખી અનુકૂળ સંયોગોવાળો દેખાતો છતાં અંદરખાને દુઃખી હોય છે.

તેથી જ સમ્યકૃતવનાં લક્ષણમાં ‘સુરનર-સુખ જે દુઃખ કરી લેખવે...નારક-ચારક-સમ ભવ ઉભયો...’ વગેરે કહ્યું છે. એટલે જ અને બહારના મોટા દેવતાઈ જેવા સુખની પણ કિંમત નથી. તેથી જ કર્મસંયોગે ગરીબી મળી હોય તો ય એમાં સંતોષ રાખી અને બહુ માને છે, એટલે જ પુણિયા શ્રાવકની જેમ પોતાને બહારથી દુઃખી નહિ પણ સુખી સમજે છે. ત્યારે અંદરથી અવિરતિનું, પાપસ્થાનકોના ભારનું, કર્મબંધનવૃદ્ધિનું અને સંયમની તક વેડફાઈ જવાનું અને ભારે દુઃખ હોય છે.

આત્માની ત્રાણ અવસ્થા ૧. બહિરાત્મ, ૨. અંતરાત્મ, અને ૩. પરમાત્મ-અવસ્થા. એમાંથી કાયાને જ આત્મા માની નાસ્તિક જીવન જીવવાની બહિરાત્મદશાનો સમકિતી જીવે ત્યાગ કરેલ હોય છે, અને કાયામાં કેદ પૂરાયેલ અંદરના આત્માને પોતાની જાત માની આસ્તિક જીવન જીવવાની અંતરાત્મદશા ઊભી કરી છે. એટલે એ સહેજે કાયાને બદલે અંદરના પોતાના આત્માને મહત્વ આપે એમાં નવાઈ નથી.

એથી જ એ ગૃહસ્થજીવનમાં (૧) ઘટકાયજીવસંહાર, ૧૮ પાપસ્થાનક, અવિરતિ રાગાદિ કષાયો, આહારાદિ સંજ્ઞાઓ, કર્મરોગવૃદ્ધિ વગેરેમાં આત્માની એટલે કે જાતની બરબાદી જુએ છે; ને (૨) સંયમ-જીવન, આગમસ્વાધ્યાય, જિનાજ્ઞાનું સંપૂર્ણ પાલન, પાપસંજ્ઞાઓ અને અનાદિ કુસંસ્કારોનો અત્યંત ઉચ્છેદ, અપૂર્વ કર્મ-નિર્જરા, ઈત્યાદિની માનવજીવનમાં જ લભ્ય સોનેરી તક વેડફાઈ જતી નિહાળે છે, પોતાની કાયા લક્ષ્મી કુટુંબ વગેરેને નહિ પણ પોતાના આત્માને મહત્વ આધ્યાથી આ બરબાદી અને તકનાશ જોઈ સમ્યગદાસ્ત ગૃહસ્થનું દિલ કક્ખા કરે એમાં નવાઈ નથી. એટલે જ ભરત ચક્કવર્તી જેવા બહારથી છ ખંડ-સામાજ્યના સુખ છતાં અંદરથી એ દુઃખી હોય છે. ‘મનમે હી વૈરાગી ભરતજી.’ ‘વૈરાગી’ એટલે બાધ્ય વૈભવવિવિસ પર વિરક્તતા અર્થાત્ એમાં હુંફ નહિ પણ અકળામણ. આ અકળામણ એ જ અંદરનું દુઃખ.

ત્યારે સાધુમહર્ષિએ ચારિત્રજીવન લીધું એમ ધન નહિ, માલ નહિ, ધર નહિ, કુટુંબ નહિ, પગે ચાલવાનું, માગીને ખાવાનું, માગીને રહેવાનું, માથાના કેશ પણ ખેંચી નાખવાના,... વગેરે જે પરિસ્થિતિ છે એ લોકદિનિએ કાષમય હોવાથી સાધુ બહારથી દુઃખી દેખાય છે. પરંતુ સાધુ અંદરખાને પોતે આને દુઃખરૂપ માનતા નથી.

એ તો આવા કાષમય જીવનમાં (૧) વિશ્વના અનંત જીવોને અભયદાન. (૨) ૧૮ પાપસ્થાનકના ત્યાગથી નિષ્પાપતા, (૩) કૃત્રિમ અને દુઃખદાયી સાંસારિક સંબંધોના અને અર્થ-કામના ત્યાગથી પરમાત્મા સાથે સીધો સંબંધ. (૪) ‘મારી ચીજ કંચન-કુટુંબ નહિ, પણ જિન જિનની આજ્ઞા’ એવા મમતવનું સક્રિય સ્થાપન, એથી જ (૫) અમૃતરસ ભર્યા આગમશાસ્ત્રમાં એકાન્તે સુખ મળતા,... વગેરેનો મહાલાભ મળતો જોઈ મહાપ્રસન્ન રહે છે.

એ અંદરખાને જુએ છે કે બાધ્ય કાષ એ તો કર્મરોગ કાઠવાની Treatment છે, ચિકિત્સા-ઔષધસેવન છે. ગુમંડું કપાવતાં કાષ છતાં અને આનંદથી વધાવાય છે ને ? એમ સાધુ બહારથી કાષ છતાં અંદરથી સુખી છે.

આ પરથી જીવનના ઊંચા ઉદેશ-આદર્શ અને ભાવનો જ્યાલ આવે છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૪, તા. ૨૭-૮-૧૯૬૮

## ૫૪ નિત્ય પ્રસન્નતાનો એક ઉપાય

શાસ્ત્રોમાં ‘મુનિ શબ્દની વ્યાખ્યા કરતાં કહ્યું કે ‘મન્યતે જગતસ્ત્રિ-કાલાવસ્થામિતિ મુનિઃ’ અર્થાત્ જગતની ત્રાણો કાળની અવસ્થાનું મનન કરે છે એટલા માટે મુનિ કહેવાય છે. આ વ્યાખ્યાથી મુનિપણાની એક વિશેષતા આ બતાવી કે એ ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ સંયોગોમાં જગતની વસ્તુ ત્રાણ કાળની અવસ્થા તરફ દાસ્તાવાળા હોય. આનું ફળ આ કે જે ગત લેખમાં જોયું કે ‘સાધુ અંદરખાને મહાસુખી હોય.’ તો એના પર પ્રશ્ન થાય કે ‘શું સાધુને કોઈ એવા અપમાન તિરસ્કાર-રોગ વગેરેના પરીસહ યા મોટા ઉપદ્રવ આવે ત્યારે મનમાં દુઃખ ન લાગે ?’ તો આ પ્રશ્નનો ખુલાસો એ, કે મુનિ જગતની ત્રિકાળ-અવસ્થાને વિચારતા હોય છે, તેથી એના બણે મનને દુઃખ ન લગાડતાં સ્વસ્થ અને પ્રસન્ન રાખી શકે છે. તો શું ગૃહસ્થ એ રીતે ન રાખી શકે ? રાખી શકે. એટલા માટે

અહીં જગતની ત્રિકાળઅવસ્થાનાં ચિંતનથી સઢા સ્વસ્થતા અને નિત્ય પ્રસન્નતા કેમ રહી શકે એની વિચારણા પ્રસ્તુત છે.

દા.ત. ઠંડી વધારે પડી, યા ઉનાળમાં ગરમી વધી ગઈ. તો મુનિ એમ વિચારશે કે ‘મારા જીવે ભૂતકાળમાં નરકની ભયંકર ઠંડી-ગરમી યા તિર્યંચના અવતારે પરવશપણે જે ઠંડી-ગરમી સહન કરી છે, એની આગળ અથવા ભાવી છંડા આરામાં આવવાની છે એની આગળ આ કોઈ વિસાતમાં નથી. ઊલટા અહીં, “આ ઠંડી-ગરમીને ‘ઠંડી ! તું ઠાર ઠાર, તું ઠારે એમ મારાં કર્મ ઠરે,’ ‘ગરમી ! બાળ બાળ, તું બાળે એમ મારા કર્મ બળે,’ એ રીતે શાંતિથી વધાવી લેવામાં તો કર્મ કટવાથી, ને સત્ત્વ વધાવાથી ભાવિ આત્મદશા ઉજજવળ બને છે.” આમ જીવની ભૂત-ભાવિ અવસ્થા વિચારતાં મન સ્વસ્થ અને પ્રસન્ન રહે છે.

એમ, દા.ત. શરીર પર કોઈ રોગ-ઉપદ્રવ આવ્યો તો વિચારશે કે ‘આ કાંઈ અક્સમાત બનતી નિષ્કારણ ઘટના નથી. આ સૂચયે છે કે જીવે પૂર્વભવે કોઈ દુષ્કૃત કરેલ, તેથી કર્મરોગ લાગુ થઈ ગયો. એ કર્મગુમું પાક્યાની આ પીડા છે. પરંતુ ગુમું પાકીને હવે જવાનું છે એ નિરાંત છે.’ એમ વિચારવાથી પ્રસન્નતા રહેશે.

એમ કોઈ બહુ ભયંકર ઉપદ્રવ આવ્યો તો વિચારશે કે ‘આવું ગમે તે આવો, તો પણ મારા જીવના મૂળ શુદ્ધ સ્વરૂપમાંથી કશું ઓછું થતું નથી. જીવનો એક પ્રદેશ ખેરવાતો નથી, કે જીવના સત્તાગત અનંત જ્ઞાન-દર્શન-સુખ-વીર્યમાંથી લેશ પણ ઘટતું નથી. ઊલટું આવા ઉપદ્રવે એના પરનાં આવરણ ખૂબ હટવાથી જીવની ભાવિ પ્રગટ શુદ્ધજ્ઞાનાદિ મય અવસ્થા નજીક આવે છે;’-આ વિચારથી મન સ્વસ્થ અને પ્રસન્ન રહે છે.

એવી રીતે દા.ત. બાધ્ય ચીજ-વસ્તુની પ્રતિકૂળતા યા અનુકૂળતા આવવા પર વિચારશે કે,-‘બહારનાં જડ પુદ્ગલ તો પૂરણ-ગલન-પરિવર્તન સ્વભાવવાળા જ છે. એના પર ખેદ શા ? કે હરખ શા ? આજે દેખાતો બરફીનો ટૂકડો કાલે વિષાડુપ થવાનો છે, યા પહેલાં એ ભેંસના પેટમાં ગંદા આહારલાળપિતાદિના મિશ્રણરૂપ હતો. તો એના પર શા બહુ પ્રેમ અને કોઈ બેસ્વાદ પદાર્થ પર શા અભાવ કરવા ? એમ, આજના ઉકરડાના અણુ એક વાર હીરાના અણુ હતા, ને હીરાના અણુ કયરાના અણુ હતા; તો એમાં શા ખેદ-હરખ કરવા ?’ એમ પુદ્ગલની ત્રિકાળની અવસ્થા ચિંતવવા પર સ્વસ્થતા પ્રસન્નતા રહેશે.

એવી રીતે દા.ત. અપમાન અનાદર-તિરસ્કાર જોવાના આવ્યા, તો વિચારશે કે, ‘જગતના અનાદિ કાળથી પલટાતા રહેતા ભાવોમાં આજે બહુમાન કાલે ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

અપમાન, આજ ખતા કાલે ખુરશી, આજ શેઠાઈ કાલે ગુલામી,... એની કોઈ નવાઈ નથી. પરંતુ મને જે જિનેન્ડ્ર પ્રભુ અને પ્રભુનું શાસન મળ્યા છે, સંયમ મળ્યું છે, એ અલૌકિક નિધાનપ્રાપ્તિ તુલ્ય છે, તો કોહિનૂર હીરા મળ્યા પછી કાચના બે ટુકડા ખરાબ મળવા પર ખેદ શાના જ કરવાના હોય ?’ ચરમાર્વાર્ત કાળમાં આવીને મોક્ષદાસ્તિ ખુલ્યા પછી તો મારા આત્માના વિશુદ્ધિકરણ-ઉર્ધ્વર્કરણની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, એ અહીં પણ ચાલુ છે, ને તે મારા મનને સ્વાધીન છે. એમાં કોઈ બહારનાં અપમાનાદિનું ચાલી શકે એમ નથી. એ તો ભાવિ ઉન્નત વિશુદ્ધ અવસ્થા તરફ આરાધનાની ગાડી ચાલી છે તે ચાલતી જ છે. પછી ઓછું શું માનવું ?’ એમ ચિંતવી ચિંતને સ્વસ્થ પ્રસન્ન રાખશે.

આમ, જીવનના ઊંચા-નીચા અને અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગોમાં જગતની એટલે કે જડ પદાર્થો, જીવો અને પોતાના આત્માની ત્રિકાળ અવસ્થાની વારંવાર વિચારણા એ મનને નિત્ય પ્રસન્ન રાખવામાં બહુ ઉપયોગી બને છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૫, તા. ૪-૧૦-૧૯૬૮

## ૬૬ મનુષ્ય જેવો હીનભાગી કોણ ?

જ્ઞાનીઓ જેને રત્નચિતામણિ કરતાં ય બહુ કિંમતી કહે છે એવો માનવભવ જેને મળ્યો એવો મનુષ્ય તો મહા ભાગ્યવાન ગણાય. છતાં પણ એ જગતના સમસ્ત જીવો કરતાં વધુ હીનભાગી કેવી રીતે બને છે એની વિચારણા અહીં પ્રસ્તુત છે.

જ્યાં મશ્છરોનો બહુ ત્રાસ રહે છે, ત્યાં માણસ ઓઢીને બેસે છે, મશ્છરદાનીમાં સુઅ છે. છતાં ય શરીરના જરા ખુલ્લા ભાગમાં જો એકાદ પણ ડાંસ મશ્છર કરે છે, તો ત્રાસ ઉઠે છે. રૂપિયા ગણી લેવાનું ય કરતો હોય છતાં અટકીને પહેલાં મશ્છર ઉરાડવાનું કરાય છે. વળી પાછો મશ્છર કરડવા માંડે ત્યારે વિશેષ ત્રાસ છૂટે છે.

આના પરથી વિચારવા જેવું છે કે રાતભર ધોડાશાળમાં ધોડા કે ગમાણમાં ગાય-ભેંસને ડાંસ મશ્છરો કરડ્યા કરતા હોય ત્યાં એ જીવોને કેટલો ત્રાસ ? ભલે રાજાના માનીતા ધોડા હોય, તો ય એને પગથી માથા સુધી થોડું જ ઓઢવાનું મળે છે ? એટલે એને ય ડાંસ મશ્છર જીવાત રાતભર કરડ્યા કરે છે. એનો એ ભારે ત્રાસ અનુભવે એમાં નવાઈ નથી. મૂંગું પ્રાણી આ દુઃખ કોને કહે ? અને કોણ ૧૩૨ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

એને આ હુંબ અટકાવવાની દ્યા ખાય ? ત્યારે માણસ તો પગથી માથા સુધી ઓફીને બેઠો એટલે પત્સુ; મચ્છર વા ખાય.

આ તો એક સામાન્ય દાખલો થયો. બાકી પશુ બિચારા ગરમીના, હંડીના, ભૂખ-તરસના, પરાધીનતાના, તથા ચાબૂકો ખાતાં માઈલોભર ભાર ઉપાડીને ચાલવાના, વગેરે અનેકનેક ત્રાસ ભોગવે છે. દિવસે ત્રાસ, રાતે ત્રાસ, વર્ષભર ત્રાસ, જીવનભર ત્રાસ, આવા ત્રાસમાં હવે એને કહો કે ‘તું ધર્મની આરાધના કર, દાન કર, શીલ પ્રતો લે, તપસ્યા કર, ક્ષમા રાખ, પરમાત્માચિંતન ભક્તિ કર, મૈત્રી આદિ શુભ ભાવ કેળવ; ‘તો એ શું કરી શકે ?’ આપણને માત્ર એક જ મચ્છર વારેવારે આવીને કરડતો હોય તો ય જપ ધ્યાન વાંચન વગેરેમાં ચિત્ત બરાબર લાગતું નથી. તો પેલાને બિચારાને તો ઢગલો મછરાના અને બીજા અનેક ત્રાસ ! એની પીડામાં એનું મન ધર્મમાં શે લાગે ?

બસ, આ પરથી સાર લેવાનો એ છે કે આપણને જ્યાં સુધી શરીર, આરોગ્ય, પૈસા, પરિવાર પ્રતિષ્ઠા આદિની સારાસારી છે ત્યાં સુધી વિવિધ ધર્મસાધના પૂરબહારમાં કરી લેવી જોઈએ, તે પણ બરાબર મન લગાવીને અને ઊછળતા ભાવોલ્લાસ સાથે કરવાની. આ રીતે ઉત્તમ ધર્મસાધના ઉત્તમ ભાવથી કરવા માટે આ વિચાર એક આલંબન છે કે જીવ સારાસારીમાં સાધ, સાધ, તારાં આત્મહિત સારામાં સારા અને સારી રીતે સાધી લે, કેમ કે હમણાં ચિત્તને ઘણી વાતની શાંતિ છે. બાકી તો તેવી પ્રતિકૂળતાઓ ઊભી થઈને ચિત્ત અસ્વસ્થ રહ્યા કરશે ત્યારે ક્યાં આ સાધી શકવાનો હતો ?

આ વિચાર જાગતો રાખવાથી મનને પ્રોત્સાહન મળે છે. પછી તો દાનધર્મ માટે એ જોશે કે જ્યારે આવકમાં ધક્કો પહોંચશે, યા બીજી ગીજી રીતના કોઈ એવા જરૂરી ખર્ચ ઊભા થઈ જશે, એ વખતે પરમાત્મભક્તિ-ધર્મક્ષેત્રો-સાધર્મિક ઉદ્ધાર વગેરેમાં પૈસા દેવાના ઉલ્લાસ ક્યાં બનવાના હતા ? માટે અત્યારે જાતના ને કુટુંબના મોજવિલાસમાં ઓછું કરીને ધર્મ ખાતે ભરપૂર સદ્ગ્રસ્ય કરી લઉં.’

એમ પ્રતનિયમ તપસ્યા માટે જોશે કે ‘જ્યારે શરીર જ રોગોભર્યુ થયું, યા તદ્દન નખાઈ ગયા જેવું અશક્ત પડી ગયું, ત્યારે સારાં પ્રતો સારી તપસ્યા સારા ત્યાગ ક્ષાંથી કરી શકવાનો ? એમ જીવનમાં બીજી કોઈ હડમારી ઊભી થઈ ત્યારે એ શી રીતે કરી શકવાનો ? ત્યારે એવા વિલક્ષણ સંયોગ થાય ત્યારે ય શું કરી શકશે ? ન તો પ્રતનિયમ કરી શકાશે કે ન મનમાન્યું ભોગવી શકાશે માટે અત્યારે સારાસારીમાં સાધી લઉં.’

ખાસ કરીને મનની ચંચળતા અને મલિનતા ટાળવા માટે આ આલંબન સુંદર છે, કે દા.ત. પ્રભુના નામનો જાપ કરવા બેઠા ને મન બીજા વિચારમાં જતું હોય ત્યાં જીવને આ સમજ કરાય કે ‘મૂરખ ! જ્યાં ભયંકર પાપોદયે અનેક રોગ ઘેરી વણ્ણા, યા સમાજ કુટુંબમાં હડ્ધૂત જેવો થવા માંડ્યો કે બીજી ભારે આપત્તિઓ માથે વરસી, ત્યારે આવી કલ્યાણસાધનામાં મન ક્યાંથી દફ ચોંટાડી શકવાનો ? જરા માખી-મચ્છરનો ઉપદ્રવ હોય ત્યાં ય મન સાધનામાંથી ઉગમગ થાય છે, પછી વિશેષ આપત્તિ-ઉપદ્રવમાં શું પૂછવાનું ? માટે અત્યારે સારાસારીમાં તો મનને સાધનામાં સ્થિર કરી દે.’

એમ મન મલિન ભાવમાં ચડતું અટકાવવા પણ આ વિચારાય કે કોઈ નરકગતિ જેવા અતિ ભયંકર ત્રાસ યા તરીખચાતુરીની ભારે પીડાઓ વરસતી હશે ત્યાં ક્ષમા સમતા મૈત્રીભાવ કરુણાભાવ વગેરે શે રાખી શકવાનો ? એમ સ્વર્ગનાં સુખમાં પડ્યો વૈરાગ્ય ક્યાં કેળવી શકવાનો ? માટે અત્યારે મધ્યમ સંયોગમાં ક્ષમા-સમતા, મૈત્રી-કરુણા, વૈરાગ્ય, ગુણાનુરાગ વગેરેની સુંદર તક સમજુ એનો જ ખપ કર, અને કોથાડિથી મનના ભાવ ન બગાડ.

મનુષ્યને જ આ રીતે ઉત્તમ સાધનાઓ કરવાના ઉત્તમ ભાવો કેળવવાના અવસર છે, બીજાને નહિ. તેથી એ જો આ ન કરી લે, તો એના જેવો હીનભાગી બીજો કોણ ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૬, તા. ૪-૧૦-૧૯૬૮

## ૬૭ શું પૈસા ખર્ચા વિના પ્રભુભક્તિ ન થાય ?

ઉપરોક્ત પ્રશ્ન આ કળિકાળમાં બહુ જણ ઉઠાવે છે. એ લોક કહે છે; “પ્રભુ તો વીતરાગ છે. એમને વળી પૈસા ખરચીને કરાતી આંગી આભૂષણ ને આસપાસ શોભા-શાણગાર શા માટે ? (૧) એક તો એમને પોતાને એની જરૂર નથી કેમ કે એ તો કૃતકૃત્ય થઈ ગયા છે. વળી (૨) એ વીતરાગ હોવાથી એમને એથી કાંઈ રીજું નથી. તેમજ (૩) ગીજું એ કે આંગી વગેરે મોહક શોભા વીતરાગતા સાથે બંધ બેસતી નથી. પછી પૈસા ખરચી એમની આગળ ઠઠારો કરવાની શી જરૂર ? એ પ્રભુની ભક્તિ તો દર્શન ધ્યાન અને ગુણસ્તુતિ-સ્મરણથી જ કરવી જોઈએ.”

આ પ્રશ્ન અને દલીલો ‘ભક્તિ કેમ થાય’ અને ‘ભક્તિ-વસ્તુ શું,’ એ

સમજ્યા વિનાની છે. ભોગ આચ્ચા વિના ભક્તિ નથી થતી. અપરિણિત યુવક કોઈ કન્યા સાથે યા પરિણિત યુવાન નવી પત્ની સાથે પ્રેમ બાંધવા વધારવા એને પોતાની શક્તિ અનુસાર કિંમતી કિંમતી વસ્તુ કે ખાનપાન આપે છે. તો પછી શું પ્રભુ સાથે પ્રીત બાંધવા કશો ખર્ચ ન કરવો પડે ?

પ્ર.- પણ ત્યાં તો કન્યા કે નવોઢા સરાગી છે, એને ખુશ થવાનું છે, તેથી એની ખુશી માટે યુવાનને પૈસા ખરચાય એ લેખે લાગે છે. ત્યારે અહીં તો પ્રભુ વીતરાગ છે. એમને ક્યાં ખુશ થવું છે તે એ માટે ખર્ચ કરાય ? ખર્ચ કર્યો લેખે લાગે ?

૩.- જો વીતરાગને ખુશ થવાનું નથી, પ્રેમ પાથરવાનો નથી, તો પછી વિના ખર્ચે ય એમની ભક્તિ કરવાનું શું કામ છે ? પ્રભુની ભક્તિ કરતાં પ્રભુ સાથે પ્રેમ ક્યાં બંધવાનો ? ત્યારે અહીં કહેવું પડે કે ‘પ્રભુ વીતરાગ ભલે આપણા પર ખુશ ન થાય, રાગ પ્રેમ ન કરે, કિન્તુ આપણે એમના પર એવો રાગ કરવો છે કે જેથી આપણને વીતરાગની અને વીતરાગતાની માયા લાગી જાય; ને એ લાગ્યાથી એમણે કહેલ મોક્ષમાર્ગની સાધનામાં સારો જુકાવ થાય, એ માટે પ્રભુભક્તિ કરવાની છે.’

હવે જો આ જ ઉદેશ છે, તો આમાં સ્પષ્ટ છે કે આ ભક્તિથી વીતરાગને કોઈ લાભ નથી, પરંતુ આપણને લાભ છે. જ્યારે વીતરાગને લાભ કરવાનો કોઈ ઉદેશ જ નથી, તો પછી ‘આંગી-આભૂષણની એમને શી જરૂર છે ? કેમ કે એ તો કૃતકૃત્ય છે. વળી એમને કાંઈ રીજવું નથી,’ એ સવાલ નકારો છે. કેમ કે ભક્તિથી આપણે એમને કશું પમાડવું નથી કે એમને રીજવવા નથી. આપણે તો આપણો પ્રભુ પર પ્રેમ વધારવો છે.

હવે સવાલ રહ્યો,-‘આંગી આભૂષણ વીતરાગતાની સાથે સંગત નથી,’ એ. પરંતુ એ સવાલ પણ બરાબર નથી, કેમ કે આંગી-આભૂષણની ભક્તિને વીતરાગની સાથે નહિં, કિન્તુ આપણા લાભની સાથે સંબંધ છે. તો સવાલ એ થઈ શકે કે એવી ઠાઈ-ઠારાની ભક્તિ આપણા લાભની સાથે સંગત છે ?

આનો ઉત્તર છે,- ‘હા.’ કેમ કે ઉપર જોયું તેમ આપણે વીતરાગની ભક્તિના લાભમાં વીતરાગ સાથે આપણી માયા જામે, પછી વીતરાગતાની માયા લાગે, એ ઈચ્છાએ છીએ. હવે વિચારવાનું આ છે કે જો પૈસાની બહુ માયા હોય તો ભગવાનની માયા જામે ? ના, ભગવાન જે પૈસા વગેરેનો રાગ સંદર્ભ છોડીને તો વીતરાગ બન્યા છે, ને માટે જ એ આપણે પૂજ્ય, માન્ય છે, એ પૈસા પર ભગવાન

કરતાં વધુ રાગ રાખીએ તો ભગવાની માયા ન લાગે. ‘ભગવાન ! તમે મને વહાલા, પણ તમારા કરતાં મારા પૈસા મને વધુ વહાલા. એટલે તમારી પાછળ પૈસા ન તોડી નાખું. પૈસા સાચવવા ખાતર તમને જતા કરું, પરંતુ તમને સાચવવા ખાતર પૈસા જતા ન કરું; આવી મનોવૃત્તિ હોય ત્યાં ભગવાન પર શી માયા જામે ? દિલમાં ચોરી છે કે પૈસા ન ખરચવા પડે તો સારું. તેથી બોલાય છે કે વીતરાગને આંગીની શી જરૂર ?

એ તો મનને એમ લાગી જાય કે ‘પૈસા ખોટા છે, ભગવાન ખરા છે માટે ભગવાન પર તો એટલો બધો પ્રેમ ઊંઘાણું કે એમની આગળ પૈસા કૂચા લાગે. એ પૈસાને કુપાત્રોમાં હોમવાને બદલે સામાન્ય પાત્ર કે સુપાત્ર કરતાં ય વિશેષ આ પરમ પાત્રની ભક્તિમાં જેમ બને તેમ વધુ યોજી દઉં.’ એવી મનોવૃત્તિથી જેમ જેમ વધુ પૈસા પ્રભુની ભક્તિમાં લગાવતા જવાય, તેમ તેમ દિલમાં પ્રભુની માયા વધતી આવે. શ્રીણિક મહાવીરપ્રભુની સુખશાતાના સમાચાર લાવનારને હીરા-માણેકથી વધાવતા ને પ્રભુભક્તિમાં રોજ સોનાના જવલાનો સાથ્યો કરતા, તેથી પ્રભુ પ્રત્યેનો રાગ વધતો જતો હતો; ને એમ પૈસા ખોટા કર્યા તેથી વીતરાગતા જલદી પામવાના. વીતરાગની ભક્તિમાં બહુ ખરચાય એ વીતરાગતા સાથે સંગત છે.

ગુરુ તો ત્યાગી છે, એટલે એ આપણી બે રોટલી બે ચીથરા કે બે પાત્રાથી વધુ લે એમ નથી, તો પછી લાખોનો ય સદ્ગ્રદ્ધ કરવાનું ઉચ્ચ સ્થાન કયું ? કહો, વીતરાગ પરમાત્મા એ જ ઉત્તમ સ્થાન. એમનાં દેવવિમાન શા મંદિર, રતની મૂર્તિ, આંગી આભૂષણ, મહાપૂજા, વગેરેમાં લખલૂટ પૈસા રેલાવી શકાય. એથી વીતરાગની માયા વધે. આબુ પરના મંદિરમાં ઝીણી કોરણીમાં કરોડો રૂપિયા કેમ ઘાટ્યા ? આટલા માટે કે પૈસા કાંકરા લાગે, ભગવાન હીરા જેવા લાગે, વીતરાગની માયા થાય, એમની શોભા વધે ને બીજાઓ પણ એ જોઈ વીતરાગની પ્રત્યે આકર્ષયે.

સારાંશ, છીઠી શક્તિએ પૈસા ખરચ્યા વિના પ્રભુભક્તિ ન થાય. ભોગ આચ્ચા વિના ભક્તિ-પ્રેમ-રાગ નહિં.

## ૬૮ બીજની પુણ્યાઈનાં અંજમણમાં શા માટે મરવું ? પુણ્યાઈનાં અંજમણ ધોરાં હોય છે.

(લેખાંક-૧)

કણિકાળના ઘણા મનુષ્યો અને તેમાં ય આજના યુગના મોટા ભાગના મનુષ્યો બીજાની લક્ષ્મીની પુણ્યાઈ, સત્તા યુક્ત હોદાની પુણ્યાઈ, સન્માનની પુણ્યાઈ, તથા શરીર સૌંદર્ય, કિંમતી વેશ, ઊંચા ખાનપાન-મોટર-બંગલો વગેરેની પુણ્યાઈ, દેખી દેખીને અંજાઈ જાય છે; એ પુણ્યાઈ પામેલાને મહાન ભાગ્યશાળી સમજે છે; અને પોતાને ન મણ્યાથી કમનસીબ સમજી એ પામવાની આછી-વેરી ઝંખના સેવે છે. જાતને કમભાગ્યવાળી સમજવાથી પેલાની આગળ ઉભવાનો કે વાત કરવાનો પ્રસંગ આવે તો જાણો ગરીબડાની જેમ ઉભો રહે છે, પોતે લઘુતા ગ્રંથિથી પીડાઈ નીચી પાયરીવાળા તરીકે વાત કરે છે. આ બધું પુણ્યાઈનું ઘેરું અંજમણ છે.

ત્યારે શું આવું અંજમણ ધર્યથી પોતાને કાંઈ મળે છે ? કશો લાભ છે ? ના, મૂળ વાત તો એ છે કે પોતાને પોતાના ભાગ્ય જેટલું જ મળવાનું છે એટલે અભરખા કરે એ ખોટા છે, ને એમાં ભારે આર્તધાનના પ્રવાહ મનમાં વહેતા રહે છે, જેનું ફળ, તિર્યંગતિ-યોગ્ય અશુભ કર્મોના આત્મામાં ખડકલા થતા જાય છે. ત્યારે પોતાની જાતને કમભાગ્યવાળી સમજવાથી પોતાની પાસે બીજાં એનાથી સારા અઢળક પુણ્ય હોવા છતાં એની હુંક ગુમાવે છે અને અશાંતિ કલેશમાં પડે છે. દા.ત. સ્રી સુશીલ સેવાકારી હોય, છતાં કદાચ એમ સમજશે કે ‘આના આવવાથી ભાગ્ય બંધ થઈ ગયું તે પૈસા નથી મળતા.’ એમ સમજને અથવા પૈસાની પુણ્યાઈ તરફ જ લક્ષ હોવાથી કલેશ કંકાશ કરશે.

વળી લઘુતા ગ્રંથિથી પીડાતો હોઈ, માનેલી પુણ્યાઈવાળાની ખોટી ચસમપોશી કરશે. તેમજ પોતાની પાસેની દેવ-ગુરુ-ધર્મપ્રાપ્તિની આરોગ્યની સાધનાની અનુકૂળતાની વગેરે બીજી સત્પુણ્યાઈની કદર અનુમોદના જ ભૂલી જશે, પ્રાપ્ત દેવ-ગુરુ-ધર્મનું ગૌરવ લેવાનું જ વિસરી જશે. પછી એવો માણસ એમની જોરદાર આરાધના ક્યાંથી કરી શકે. જેની જોરદાર સહદય આરાધના કરવી હોય એના તરફ ઉદ્ઘણતું ગૌરવ ને અત્યંત પ્રેમ-બહુમાન તો પહેલું જોઈએ. પણ પેલી બીજાઓની લક્ષ્મી-સત્તાદિની પુણ્યાઈના અંજમણમાં આ દેવ-ગુરુ-ધર્મ ઉપર અનિશ્ચય પ્રીતિ-બહુમાન-ગૌરવ ક્યાંથી લાવી શકે ?

સારાંશ એ આર્તધાન તથા કલેશ લાવનાર, ને અન્ય પુણ્યાઈની હુંક તથા દેવ-ગુરુ-ધર્મનું ગૌરવ-સાધનાને ખોવરાવનાર બીજાઓની પુણ્યાઈનાં અંજમણ ભૂંડા છે.

પ્ર.- છતાં એ અંજમણ આવી જાય છે ત્યાં શું કરવું ?

ઉ.- પોતાને મળેલી બીજી પુણ્યાઈનું સારું મૂલ્યાંકન કરવું, સારું મહત્વ આંકવું, અને એનો સદૃપ્યોગ કરતા રહી એમાં જીવનની ધન્યતા માનવી તથા એ અપેક્ષાએ સામાની દરિદ્રતા વિચારવી. એથી પેલા અંજમણ ઉઠરી જશે.

દા.ત. પોતાની પાસે પૈસા નથી, પણ સારા આરોગ્યની પુણ્યાઈ છે, તો સમજવું કે ‘આ મહાન ચીજ છે, કેમ કે પૈસાના અભાવે જે દુર્ધર્યનિ થાય છે એના કરતાં આરોગ્યના અભાવે બિમારીમાં દુર્ધર્યનિ વધુ થાય છે. એનાથી બચવાનું મળ્યું. વળી આરોગ્ય છતે જો ધર્મ પુણ્યાઈ મળી છે તો સેવા-પરોપકાર, ધર્મક્રિયાઓ ત્રણનિયમ, ત્યાગ, તપસ્યા જ્ઞાનધાન સારાં થઈ શકે છે. માટે ધર્મપ્રાપ્તિ અને આરોગ્ય બહુ મહત્વનાં મળ્યાં છે,’ એમ એનું મૂલ્યાંકન કરી મહત્વ આંકી, એ સેવા-પરોપકાર-ધર્મક્રિયાઓ વગેરે સાધવામાં સારો ઉદ્ઘમ રાખવો અને એ સાધવા મળ્યાનો અતિશય આનંદ માનવો; જે સાધવાનું પેલી પુણ્યાઈવાળાને નથી તેથી એનાં અંજમણ સહેજે ઉઠરી જવાના.

એમ પોતાને સારા સ્વભાવનું કુટુંબ મળ્યું છે, સારા સ્વભાવવાળી માતા, પિતા, ભાઈ, પત્ની, પુત્ર વગેરે મળ્યા છે, તો એની કદરમાં એ સમજવું કે ‘આનાથી વારંવારના કલેશ, કે જે ખરાબ સ્વભાવવાળું કુટુંબ મળેલાને થયા કરે છે એ, પોતાને નથી. એથી શાંતિનો લાભ છે તથા ઘણા કષાય અને કર્મબંધથી બચવાનું મળે છે,’ આમ એ સારા સ્વભાવવાળું કુટુંબ મળ્યાનું મહત્વ સમજી એનો સદૃપ્યોગ દિલમાં સારા સારી મૈત્રીભાવ કરુણા-પ્રમોદ-માધ્યર્થ ભાવ તથા દેવ-ગુરુ-ધર્મ-સંધ-શાસ્ત્ર-તીર્થ વગેરે પ્રત્યે ઊંચા બહુમાન ભાવ વિકસાવવામાં કરવો, તેમજ મહાન તત્ત્વચિંતન બારભાવનાઓ વગેરેમાં સારી રીતે મનને લગાડ્યા કરવું, એ બધું પણ પેલી પુણ્યાઈવાળાને નહિ હોવાથી એનાં અંજમણ નહિ લાગે.

એમ બીજી પુણ્યાઈમાં પોતાની પાસે બુદ્ધિબળ, જ્ઞાનશક્તિ, લેખનશક્તિ, લોકમાં આદેય વચ્ચનશક્તિ મળી હોય, અરિહંતદેવની પ્રાપ્તિ, શુદ્ધ સંયમી ગુરુની પ્રાપ્તિ વગેરે થઈ હોય. એનાં ઊંચાં મહત્વ આંકી એનો એનો સ્વ-પરના કલ્યાણ સાધવામાં સદૃપ્યોગ કરવો અને એથી મન મસ્ત રાખવું. એટલે પણ બીજાઓની પુણ્યાઈનાં અંજમણ નહિ લાગે.

ગત લેખમાં એ જોયું કે બીજાની લક્ષ્મી-સત્તાવૈભવ વગેરેની પુણ્યાઈથી અંજાવામાં સોસાવાનું દુધનિમાં પડવાનું તથા હાથવેંતમાં રહેલા શક્ય સુકૃત ગુમાવવાનું થાય છે. તો એ અંજામણ મિટાવવા પોતાની પાસેની બીજી પુણ્યાઈનું મહત્વ આંકી એનો સદુપયોગ કરવો; અને એમ અંજામણને ઉતારી નાખવું.

હવે એ એક મહાન વિચાર કરવો છે કે ખરેખર તો શું એકબીજાની લક્ષ્મી વગેરેની પુણ્યાઈઓ આકર્ષિવા-વખાણવા જેવી છે? જો એમ લાગી જાય કે ‘ના એ ખરેખર તો દૂરથી હાથ જોડવા જેવી છે, આપણાને એ ન મળી તે સારું થયું,’ તો પછી એનાં અંજામણ નહિ લાગે; મનને થશે કે ‘હું શા માટે એનાં અંજામણમાં મરું?’

ત્યારે વર્તમાન પુણ્યાઈવાળાની મોટા ભાગની દશા એ દેખાય છે કે એ પુણ્યાઈ ઉપર જ એ લોકો કોઈ મદ-અહંકારમાં, કોઈ ગુસ્સામાં, કોઈ માયા-પ્રપંચમાં, યા મહાલોભ મહા આરંભસમારંભમાં, ધર્મની બેપરવાઈમાં દેવાવિદેવ અને ગુરુ સામે પણ શેઠાઈમાં, તથા આગળ વધીને અસદ્ આચારોમાં વગેરે વગેરે કેટલાય કષાયોનાં વિષયોનાં અને હિંસાદિ દુષ્કૃત્યોનાં પાપોમાં રક્ત રહે છે, કે જેનાથી એ અઢળક પાપ બાંધે છે. આ બધું એ પુણ્યાઈની અનુકૂળતા થવા ઉપર થાય છે, એટલે એ પુણ્યાઈ પાપાનુંધી કહેવાય.

પાપાનુંધી પુણ્યાઈ એટલે જેણો લાલુ. એ ખાવામાં મીઠી લાગે એટલું જ, પણ પછી પ્રાણનો નાશ કરે. એમ પુણ્યાઈ ભોગવવામાં મીઠી લાગે, પરંતુ એમાં એકનિત થયેલ પાપના બંધ જન્મોજન્મ મારે.

આજની મોટા ભાગની પુણ્યાઈની આ દુર્દશા દેખાય છે. પૈસા બહુ મળ્યા છે, એટલે જ પંચેન્દ્રય જીવોની હત્યાવાળી વસ્તુના ઉપયોગ સુધીનાં મીલ-કારખાનાં ચલાવાય છે, યા બીજાં પણ મહા કર્માદનના ધંધા કરાય છે. વળી પૈસા-બંગલો-મોટર વગેરે મળવા પર અભિમાન અને પ્રપંચનો પાર નથી! અભિમાનમાં સાધર્મિકને જોતાં તો જાણો જે વરસે છે, સાધુ નવરા લાગે છે, યાવત્ મોટા આચાર્ય મહારાજને પણ ખીસામાં રાખે છે! એ પૈસા વૈભવ મળવા પરના અભિમાનમાં જ પોતાની આપમતિએ ધર્મના ધર્મખાતાઓનાં કાનૂન તથા વ્યવસ્થા-વહીવટ કરે છે, જે શાસ્ત્રથી વિરુદ્ધ હોય.

એમ પૈસા-વૈભવના અભિમાનમાં આચાર્ય-જૈન-સંસ્કૃતિથી વિરુદ્ધ વેશ ‘રીતભાત

રહેણીકરણી વગેરેમાં દોડી બીજા કમ પૈસાવાળાને ય ખોટાં દણાંત પૂરા પાડે છે. એમ અભિમાનમાં નોકરો વગેરે પર ધમધમાટ, ગાલીપ્રદાન, યાવત્ મારજુડ પણ કરે છે.

ત્યારે પૈસા-વૈભવની પુણ્યાઈ મળી છે તેથી માયા-પ્રપંચ દાવપેચ વિશ્વાસધાત વચ્ચનભંગ વગેરે કેટલાંય પાપો આચરે છે. સરકારમાં ચોપડા તો સાચા શાના બતાવવાના હોય જ? પણ મોકો મળ્યે ભાગીદારથી ય ખાનગી કમાઈ લેવાનું, કે દલાલ-આડતિયા-ધરાકને ઠગવાનું સુલભ હોય છે. દા.ત. બે વાગે ધરાકનો ફોન આવ્યો કે ૧૦૦ ગાંસડી વેચ્યો, એ વખતે રૂ. ૨૫૦)ના ભાવથી વેચી પણ કલાક પછી ભાવ ઉત્તરીને ૨૪૦) થયો, તો એ ભાવે સો ગાંસડી વેચી પેલાના નામ પર કરશે, ને પૂર્વનું વેચાણ પોતાનું કરી હવે ઉત્તરતા ભાવમાં ખરીદી કરીને નફો ખાઈ જશે. આવાં આવાં તો કેઈ કબાડા પૈસાની પુણ્યાઈ મળવા પર થાય છે.

એટલું જ નહિ પૈસા-વૈભવ મળવા પર ઈન્ડ્રિય-વિષયસુખોમાં ચક્ક્યૂર રહેવાય છે, ત્યાં એક બાજુ તો મહારંભનાં અને ચીકણી વિષયાસક્રિયાનાં પાપ, અને બીજી બાજુ ધર્મની પરવા નહિ. એક રેઝિયો મળ્યો હોય છે તો ય એમાં લટ્ટુ અને જિનવાણીશ્રવણનું નામ નહિ.

એથી પણ આગળ વધીને પૈસાની અનુકૂળતા પર કેટલીય જાતના અસદ્ આચારો, જેવાં કે રાત્રિ ભોજન, અભક્ષયભક્ષણ, સિનેમા, કલબો વગેરેમાં જુગાર, માટિરાપાન, અને કદાચ વેશ્યાગમન, પરસ્સીગમન સુધીનાં ઘોર પાપે પણ ચરી જાય છે.

એવું સત્તાની પુણ્યાઈમાં પણ પાપોનો પાર નથી. આજે સત્તાધારીઓના લાંચરુશવત લેવા વગેરેનાં દણાંત મોજુદ છે. ત્યારે મોટા ઓફિસરો જે ઓફિસમાં રૂપવાન સ્ત્રીઓને જ નોકરીમાં રાખે છે, તેનું શું કારણ? કયા હાથ નીચેના કલાકને સારી સગવડ આપે છે?

ટૂકમાં આજની પુણ્યાઈ ભયંકર પાપાનુંધી હોઈ એને દૂરથી હાથ જોડી એ આપણને ન મળ્યા પર આનંદ માનવા જેવો છે. એથી પણ એનું અંજામણ નહિ લાગે.

## (૭૦) વિચાર-વાણી-વર્તાવ પર અંકુશ કેમ આવે ?

જીવન તો જીવીએ છીએ. પરંતુ શા માટે જીવનું ? જીવન જીવવાનો ઉદેશ શો ? એનો વિચાર કરીએ છીએ ખરા ? જો એ વિચાર કરતા હોઈએ તો તો વિચાર, વાણી અને વર્તાવ ઉપર અંકુશ આવી જાય. પછી ગમે તે ગમે તે વિચારવાનું, ગમે તે બોલવાનું, ને મહિન્દ્રિયું કે નુકસાનકારી ખાવા-પીવાનું, હરવા-ફરવાનું, જોવા-સાંભળવાનું ને બીજું બધું આચરવાનું ન કરાય.

જીવન જીવવાનો ઉદેશ જો નક્કી કર્યો હોય અને પછી તે નજર સામે રહેતો હોય તો તો કંઈ પણ વિચારતાં-બોલતાં કે વર્તતાં જટ આ ઘ્યાલ આવે કે ‘ભાઈ ! જોવા દે, આ વિચારવામાં, આ બોલવામાં કે આ આચરવામાં ધારેલો ઉદેશ બર આવે એમ છે ? ઉદેશની સિદ્ધિની દિશામાં પગરણ થાય એવું છે ? કે વિરુદ્ધ દિશામાં ? આ તપાસ પછી જો એમ લાગે કે ના, આ વિચાર કે બોલચાલમાં ઉદેશ સરે એમ નથી, તો તરત એના પર અંકુશ મૂકાય.

પરંતુ અફ્સોસ કે કોઈ સારા ઉદેશનો વિચાર જ નથી. બહુ બહુ તો કદાચ ઉદેશ હોય તો એટલો જ કે મનને બને તેટલી મોજ કરાવવી. પછી એ માટે વાતોચીતોમાં હસા-મશકરી-જૂઠ-ડફાણ વગેરે ચાલે છે. માનવજીભની આ કેવી બરબાદી ? એવું હરતા-ફરતાં ખાવાનું, વાતવાતમાં ચા પીવાનું, અમથા અમથા ય બજારમાં ટહેલવાનું, જે તે જે તે જોવાનું સાંભળવાનું વગેરે વગેરે કરાય છે, યાવત્ત અભક્ષ્ય ભક્ષણ, અસદાચારની પ્રવૃત્તિઓ ઉચ્છૃંખલ વિલાસ વગેરે કરાય છે તે તુચ્છ મનની મોજના ઉદેશથી.

ત્યારે કોઈને વળી ઉદેશ માન મેળવવાનો સારા દેખાવાનો ને બીજાને સારું મનાવવાનો ઉદેશ હોય છે. તો એમની પણ શી દશા છે ? માનવભવમાં મળેલા મહાકિમતી તન-મન-વચન અને ઈન્દ્રિયોને એ જ લક્ષ્યથી ગમે તે રીતે પ્રવર્તાવે છે. બોલશે એવું મીઠું મીઠું, અંતરમાં સ્નેહનો છાંટો નહિ હોય પરંતુ શબ્દો પીરસશે સાકર જેવા મધુર. શા માટે ? હું બીજાને સારો મનાનું. ગામમાં ધર્મ-શિક્ષણ-સંસ્કારની એક નાની પાઠશાળાનાં ઠેકાણાં નથી હોતા, પણ સારા દેખાવા માટે હાઈસ્કૂલ-કોલેજમાં હજારો લાખો રૂપિયા દઈ દે છે. કન્યાના લજનમાં હજારોના ખર્ચ મંડપ વગેરે કરશે. કેમ ? સારા દેખાવા. પરમાર્થ-પરોપકારમાં પાંચ રૂપિયા ય નહિ

દે. એમ બીજાને સારું લગાડવા ખોટા સવાસલાં કરશે, નિંદા-ચુગલી કરશે, પાપસલાહ આપશે. આવા તુચ્છ ઉદેશમાં નિરંકુશ વાણી-વિચાર-વર્તાવ ચાલે છે.

ત્યારે પૈસા જ ભેગા કરવાના ઉદેશવાળાને તો તામસી વિચાર-વાણી-વર્તાવમાં હદ જ નથી રહેતી. ભાન નથી કે એ બધાં કાળાં કરીને પૈસા મનમાન્યા ભેગા કર્યા, પણ પછી એ પૈસાથી શું કરીશ ? ક્યાં સુધી પૈસા ભેગા કરી સાચવીશ ? જીવન પૂરું થતાં શું ?

ત્યારે નિરંકુશ અને હલકા વિચાર-વાણી વર્તાવથી જીવન જ્યા, પછી અંતકાળ કેવો, અને આગળ ક્યાં પટકાવાનું ? કીડા-મંકોડા પશુ-પંખી વગેરેનાં જીવન કરતાં માનવજીવન જીવીએ એમાં કશું સારું કમાવાનું નહિ ? અનંત અનંત કાળથી ચાલી આવતી આહાર-વિષય-પરિગ્રહ-આરામી, અહંત્વ-માનાકંદ્ધા, પરપંચાત વગેરેની સંજ્ઞાઓનાં જ પોષણ કરવાનાં ? જીવન એમ જ પૂરું કર્યે ગયા પછી આત્મોત્થાનની તક ક્યાં ?

માટે, જીવને માનવજીવનનો આ ઉદેશ લાગી જવો જોઈએ કે ‘હું મારા આત્મામાં સુધારો કરતો ચાલુ. એના રાગ-દ્વાષ, વૈર-ઈર્ધ્યો, અનું અહંત્વ-દીનત્વ, એની માનાકંદ્ધા-પરપંચાત, તથા આહાર વિષય-પરિગ્રહ-આરામીની સંજ્ઞાઓ પર જબરદસ્ત કાપ પડે, કાયા-કંચન કુંટુંબને મહત્વ દેવાને બદલે જિન-જિનમત-જિનસંધને મહત્વ દેવાનું વધે, પરપંચાતને બદલે આત્મચિંતા જ સદા જાગ્રત રહે.’

આ આત્મ-સુધારનો ઉદેશ પળે પળે નજર સામે રહ્યા કરે તો તો પછી વિચાર-વાણી-વર્તાવ પર ઘણો અંકુશ આવી જાય; અને એ જે પ્રવર્તે એમાંથી લક્ષ એક યા બીજા આત્મ-સુધારને નીપજાવી લેવાનું રહે. કશું બોલતાં કે વિચારતાં, હાલતાં કે ચાલતાં યા કંઈ પણ પ્રવૃત્તિ કરતાં આ વિચારવાનું કે, ‘પરિણામે આ આત્મ-સુધારમાં ઉત્તરશે ને ? ના, આત્મબિગાડ થાય એવું છે, તો બંધ કરો આ બોલચાલને કે વિચારને.’ આત્મબિગાડમાં ઉપરોક્ત રાગાદિ દોષો ન પોષાય, અને આત્મસુધારમાં વૈરાગ્ય-ઉપશમ, મૈત્રી આદિભાવ, ક્ષમાદિ ધર્મ, આત્મચિંતા, ત્યાગ-તપની વૃત્તિ આદિ પોષાય એ જોતા રહેવાનું. આમ જીવન જીવતાં એ ધ્યાન રહ્યા કરે કે મારો આ આત્મસુધારનો ઉદેશ સરે છે ને ? સારા જીવન-ઉદેશનાં જાગતા લક્ષ્યી આત્મબિગાડના વિચાર-વાણી-વર્તાવ પર અંકુશ આવે અને જરૂરી વિચાર-વાણી-વર્તાવમાં ઝોક આત્મસુધાર તરફ લઈ જવાય.

## ૭૧ શુક્લધ્યાનની પ્રક્રિયા પરથી એક દિશાસૂચન

આત્માને કેવળજ્ઞાન પામવા માટે શુક્લધ્યાનના પહેલા બે પ્રકાર ધ્યાવવા પડે છે અને એ શુક્લધ્યાન માટે મનને ત્રિભુવનના વિષયો પરથી સંકોચાતાં પરમાણું પર કેન્દ્રિત સ્થિર સુનિશ્ચલ કરવું પડે છે. એમ કરતાં શુક્લધ્યાનનો પહેલો પ્રકાર લાગે, અને એમાં ય અનેક પર્યાયો પરથી મનને એક પર્યાય પર સંકોચી સ્થિર કરતાં બીજો પ્રકાર લાગે. પછી કેવળજ્ઞાન થાય છે.

આ કેવી રીતે બને છે એનું એક દણ્ણાત્મ શાસ્ત્ર એ બતાવે છે કે જેવી રીતે કોઈને જે ચાહું હોય તો માંત્રિક મંત્રબળે એ જેરને ઉત્તારવા માટે પહેલાં તો આખા શરીરમાં વ્યાપી ગયેલા જેરને કમશા: સંકોચાતાં સંકોચાતાં ઠેઠ ઊંખના ભાગમાં જ રહ્યું કરી મૂકે છે; એવી રીતે શુક્લધ્યાનરૂપી મંત્ર મનરૂપી જેરને સંકોચી આણું પર સ્થિર કરે છે.

શું મન એ જેર છે ? હા, જેર તો ખરું, પણ ચાલુ જેર કરતાં ય ભયંકર; કેમ કે ચાલુ જેરથી એક મરણ થાય; પરંતુ મનરૂપી જેરથી અનેક જન્મ-મરણ થાય છે. ‘મનને પાપે રે મત્સ્ય તંદુળિયો, જુઓ મરી સાતમી જાય...’ વાણી અને કાયાના બગડવા કરતાં મનના બગડવા પર એ ભયંકર નુકસાનો ખડા કરે છે, ભવોમાં ભટકાવે છે, અનેકાનેક જન્મ અનેકાનેક મૃત્યુ પકડાવે છે. માટે એ વિશિષ્ટ જેર છે.

આનો અર્થ એ કે જો આપણે આપણું મન બગાડીએ છીએ, મનને કોધાદિ કષાયમાં ચડાવીએ, આર્ત-રૌક્ર ધ્યાનમાં પાપીએ, કે ઇન્દ્રિયના વિષયોમાં રગદોળીએ છીએ તો આપણે જ મનરૂપી જેરને ઊભું કરી ઉગ્ર બનાવીએ છીએ; હાથે કરીને એ જેરને ખાઈએ છીએ.

ત્યારે સવાલ થાય કે એને કેવી રીતે રોકવું ?

આનો જવાબ શુક્લધ્યાનની પ્રક્રિયામાંથી મળી રહે છે. આત્મા શુક્લધ્યાનની ધારામાં ચડવા માટે એ મનરૂપી વિષ જે ત્રિભુવનમાં વ્યાપ્ત છે, અર્થાત્ જો ભુવનમાં મન રખતું છે, એને હવે એ સંકોચાતાં આવે છે, અર્થાત્ બીજા-ગીજા વિષયોનો વિચાર નિશ્ચિતપણે બંધ કરતા આવે છે, અને એમ કરતાં કરતાં એક અમુક ચોક્કસ નાના વિષય પર મનને લઈ જતાં, એમાં ય સૂક્ષ્મ સૂક્ષ્મ ભાગ પર

મનને ઉતારે છે. આમ કરતાં કરતાં અંતે પરમાણું યાને પરમ સૂક્ષ્મ અંશ પર મનને સ્થાપિત કરી દે છે; તો જેવી રીતે માંત્રિક પુરુષ કોઈનું જેર ઉતારતાં અને આખા શરીર પરથી સંકોચાતાં સંકોચાતાં છેવટે જ્યાં ઊંખ લાગ્યો હતો તે ભાગમાં લાવી મૂકે છે, અને પછી એમાંથી ય નાખૂંદ કરે છે. એ રીતે શુક્લધ્યાન મનને ત્રિભુવન પરથી બેંચી લઈ કમશા: અંતે પરમાણું યાને પરમ સૂક્ષ્મ અંશ પર લાવી સ્થિર કરે છે. પછી અને ત્યાંથી ય ખસેડી લઈ એના એક પર્યાય પર સ્થિર કરતાં અંતે ત્યાંથી ય હટાવી દે છે, એમ તદ્દન નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થતાં સર્વથા મનવિષ નાખૂંદ થવાથી કેવળજ્ઞાન જળહળી ઉઠે છે.

આમાંથી એ દિશાસૂચન મળે છે કે મનને બહારમાં બહુ રખડાવવાથી એ જેરનું કામ કરે છે. માટે મનનો એ રખડપાટ ઓછો કરવો જોઈએ. ત્યારે પ્રશ્ન થાય કે,

પ.- એમ તો ધર્માસ્તિકાયાદિ ખડક્રવ્યનું ચિંતન કરવામાં તો આખા વિશનું ચિંતન આવે, તો શું મનનો એ રખડપાટ છે ? શું એ જેરનું કામ કરે છે ? તો તો પછી એ ચિંતન કરનારા અનુત્તર વિમાનવાસી દેવતાઓ જેર પોષે છે ?

૩.- મનના રખડપાટ અને ચિંતનમાં ફરક છે, ‘રખડપાટ’ એટલે તો રાગ-દ્વેષને આધીન બની ગમે તે ગમે તે વિષયમાં મનને રખડાવવું. ત્યારે ચિંતનમાં તો કોઈ જાતના રાગદ્વેષ વિના પદ્ધતિસર તત્ત્વનો વિચાર કરતા ચાલવાનું છે.

દા.ત. લોકસંસ્થાન-તત્ત્વ પર ચિંતન કરતાં મન એ જુએ છે કે લોકમાં ઊર્ધ્વ-અધો-મધ્ય એમ જ્ઞાન લોક છે. એમાં ઊર્ધ્વ લોકમાં લગભગ શુભ પુદ્ગળો હોઈ ત્યાં જન્મ પામનારા દેવતાઓ એમાં આસક્ત બની રાગથી એવા ગળિયા બને છે કે એમને બિચારાને એક ઘડીની પણ વિરતિ (પ્રતિ-નિયમ) લેવાની હામ નથી જાગતી. આ વિચારમાં રાગદ્વેષ નથી. તેથી એ નુકસાનકારી નહિ.

ત્યારે દા.ત. જો એમ વિચારે કે ‘અહીં આપણે બહુ દુઃખી. આપણા કરતાં દેવો ભાગ્યશાળી કે એમને ભારે અનુકૂળતાઓ. કેવાં એ ત્યાં ગીતગાન કીડા-મોજમાં લીન રહે છે !’ તો આ વિચાર અહીંની પરિસ્થિતિ પ્રત્યે દ્વેષભર્યો તથા દેવતાઈ સુખના રાગભર્યો થયો. એ મનનો રખડપાટ છે, અને ભારી નુકસાન કરનારો છે.

સારાંશ, રાગદ્વેષભર્યા મનના ઈધર-ઉધરના વિચાર એ જેરી રખડપાટ છે. એવા વિચારો કરતું મન એ જેર છે. એને જેટલું અટકાવવામાં આવે એટલું જેર ઓછું પ્રસરે, જેર ચડવાનું ઓછું થાય. એ માટે, પહેલાં તો જ્યાં મન એમ

બહારમાં ઝૂદવા જાય, રાગ યા દેખથી તણાઈ વિચારવા જાય, ત્યાં ચોકામણ થવી જોઈએ, કે ‘અરે હું આ ક્યાં ગબડ્યો ? મનવિષને ક્યાં ફેલાવવા માંડ્યું ? લાવ મનને કોઈ તત્ત્વમાં દાખલ કરવા હે.’ એમ કરીને કોઈ મહાપુરુષના ચરિત્રમાં, યા કોઈ દેખેલા-અનુભવેલા શુભ પ્રસંગ પર, અથવા કોઈ અત્યાસ કરેલા નવતત્ત્વ-કર્મસિદ્ધાંત-તત્ત્વાર્થ-યોગદાસ્તિ-ઉપ ગુણ-સમ્યકત્વ હજ વ્યવહાર-ભાવશ્રાવકનાં લક્ષણ વગેરે તત્ત્વના કમસર પદાર્થો પર મનને ઉતારી દેવું જોઈએ. છેવટે ગણતરીબંધ નવકાર પર. આ રીતે મનના રખડપાટને વારેવારે રોકવાનું એક જીવન-કર્તવ્ય બનાવી દેવું અતિ જરૂરી છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૧૧, તા. ૬-૧૨-૧૯૬૮

## ૭૨ અનંતા દેહ ખાતર આત્માને ચૂસ્યો

કવિએ ગાયું ‘મારે તો સુષ્પમાથી દૂધમો અવસર પુણ્ય નિધાન.’ અર્થાત્ આ દુઃખમ પંચમ કાળ પાંચમો આરો, એ મારે તો સુષ્પમ કાળ પહેલા-બીજા આરાથી વધુ પુણ્યનિધિનો અવસર મળ્યો છે. આ શાના ઉપર કહ્યું ?

અહીં માત્ર એટલું જ કહીએ કે ‘આ કણિયુગમાં પણ જિનાગમ જિનબિંબ મળ્યા, જિનાગમના વક્તા અને શ્રોતા સ્યાદ્વાદથી અંકિત પવિત્ર બોધવાળા મળ્યા, જે સુષ્પમકાળમાં નહિ મળેલા, તેથી આ યુગનો અવસર એક પુણ્ય નિધાન સ્વરૂપ છે;’ તો સવાલ એ થાય કે શ્રી મહાવીર પ્રભુએ પાંચમા આરાના ભાવ બતાવતાં જે ભાષ્યું છે કે હજારો લાખો આચાર્ય-ઉપાધ્યાય સાધુ નરકે જવાના છે તેનું કેમ ? એમને ય જિનાગમ-જિનબિંબ-ચારિત્રનો આ પુણ્યનિધાન અવસર તો મળ્યો કહેવાય; પછી એથી તો એ સ્વર્ગ જાય કે નરકે ? જો નરકે જાય છે કે જેશે તો સુષ્પમા કરતાં દૂધમ કાળ એમને ભલો ક્યાં રહ્યો ?

આના ઉત્તરમાં કહેવું પડે કે જિનાગમ જૈનશાસ્ત્ર અને જિનબિંબ દેખાડનારો કલિયુગ ભલો તો છે જ, પુણ્યનિધાન અવસર છે, કિંતુ એને પુણ્યનું નિધાન બનાવાય તો જ. એ બનાવવા માટે જિનાગમ અને જિનબિંબની શુદ્ધ ઉપાસના જીવનકર્તવ્ય બની જવી જોઈએ. તો શું નરકે જનાર આચાર્ય આદિ સંસાર છોડી સાધુજીવન અંગીકાર કરે એમાં એ જિનાગમ-જિનબિંબની ઉપાસના નહીં કરે ? અહીં કહેવું પડે કે કરે તો ખરા, પરંતુ એવી મહિન ભાવવાળી અને દેખાવમાત્રની

ઉપાસના, તે ય દેહ હિતના જ ઉદેશથી કરવાના કે જેથી બચાવ ન મળે. શુદ્ધ આંતરિક ઉપાસના જ તારણહાર બની શકે.

શુદ્ધ ઉપાસના સંપન્ન કરવા માટે સૌથી મુખ્ય જરૂરી તત્ત્વ આ છે, કે એ આત્મહિતના ઉદેશથી થવી જોઈએ. જિનાગમ સાંભળીને, ભણીને, ચિંતન-મનન કરીને, એ બધું શ્રવણ આદિ આત્માના હિતમાં ઉતારવું જોઈએ, એમ જિનબિંબના આલબને જિનની બાધ્ય ભક્તિ ઉત્સવાદિને ય આત્મહિતાર્થ બનાવવા જોઈએ. આત્મહિત આદિ-ક્ષમાદિ-સ્વભાવ, અહિસાદિર્ઘમ, સંયમ સહિષ્ણુતા-સમાધિ આદિ. એના બદલે કેવળ દેહના હિતમાં, દેહ સાથે સંબંધિત માનપાન-સુખસગવડમાં ઉતારાય, તો ત્યાં તો ધર્મ સમજવા છતાં ય એમ કરાય છે તે હદ્ય ધિહું બનાવીને કરવામાં આવે છે. પછી એ નરકનાં ભાતાં બાંધે એમાં શી નવાઈ ? હદ્યની ધિંઢાઈ અનંતાનુંબંધી કષાયને પોષે છે, અને એ કષાય નરકગમનનું કારણ છે.

શા સારુ આત્મહિતને અવગણી દેહનાં હિત જ સાધવાની આટલી બધી લત ? જીવની મૂઠતા કેવી કે એ સવારથી જાગ્યો તે રાતે સુવા સુધી જે કાંઈ કરે, તે અને રાતના ઊંઘવાનું કરે તે પણ બધું જ દેહના લાભમાં જ ઉતારે છે ! એ જ જોયા કરે છે કે ‘મને સારું સારું ખાવા-જોવા-સાંભળવા વગેરે કેમ મળે ? મને શરીરે શાતા સગવડ રહે છે ? મને માન મળે છે ? મારો મોખ્યો સચવાય છે ? હું બીજાને સારો કેમ લાગું ? મારું બધા કેમ માને ?...’ આ શું જોયું ? બધું જ દેહનું ભલું જોયું. વેપાર કરે, વહેવાર કરે, ઘરમાં બેસે, બહાર જાય, કોઈ કામ કરે, આરામ કરે કે રાતના ઊંઘી જાય, એ બધું ય દેહની જ સુખ-સરભરા માટે જ. એવી મૂઠતામાં બિચારા આત્માનું બધું પુણ્ય ખત્મ કરે છે.

રાંક જીવને ખબર નથી કે આવું તો અનંતા દેહની ખાતર આત્માને ચૂસ્યે રાખ્યો શોષ્યે ગયો, પણ આજે પચિશામમાં શું ? એ જ પાછી દેહ માટેની વેઠ ઊભી ને ઊભી જ છે. અને અહીં પણ પૂર્વની જેમ જ દેહની ખાતર આત્માને ચૂસ્યે જ રાખવાનું જ કરવું છે, એનું પુણ્ય ધન એની સંસ્કાર મૂડી, અને એની મહા કિમતી શાન-વીર્યશક્તિઓને દેહની જ ખાતર ચૂસ્યે જવી છે, તો પચિશામ સ્પષ્ટ છે કે જેમ પૂર્વની એ મૂર્ખતા પર પરિભ્રમણ અને આજે વેઠ છે, એમ અહીંની એવી જ મૂર્ખતા ઉપર ભવિષ્યમાં પરિભ્રમણ અને વેઠ પોષાવાના.

માટે હવે રાહ પલટવાની જરૂર છે. જીવને સમજાવી દેવું જોઈએ કે ‘અનંતા દેહ ખાતર આત્માને ને આત્મધનને ચૂસ્યે રાખ્યા, હવે થોખ, હવે તો આત્માની ખાતર દેહને ને દેહની શક્તિઓને ચૂસ્યે રાખ.

આ માટે બે સાવધાની રાખવી પડે,

(૧) દેહ અને દેહની સાથે સંબંધ રાખનારી વસ્તુઓને આત્મા માટે ઉપયોગી બને એવી રીતે શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલ પવિત્ર દાન-શીલ તપ-ભાવના તથા અરિહંતદેવ સુસાધુ તથા સામાયિક-પ્રતિકમણ-શાસ્ત્ર સ્વાધ્યાયની ઉપાસનામાં એને બને તેટલી વધુમાં વધુ યોજતા રહેવું.

(૨) વળી એ સિવાય પણ જે ધર-કુકાન-પરિવાર ખાનપાન-વહેવારની પ્રવૃત્તિઓ થાય એ બધી દેહાર્થ દેહહિતાર્થ નહિ, પણ આત્માર્થ આત્મહિતાર્થ થવી જોઈએ; એમાં ઉદેશ આત્મહિત ઉપજાવનાનો રહે, ને એ જ ઉપજાવાય. આ આત્મહિત એટલે (૧) આત્માના ક્ષમા-મૂહુતા-સરળતા-નિર્લોભતા સ્વભાવ ખીલતા આવે, (૨) અહિસા-સત્ય-નીતિ-બ્રહ્મચર્ય-અપરિગ્રહ વિકસતા આવે; (૩) દેહનફરત-ઈન્દ્રિયસંયમ-સહિષ્ણુતા-ચિત્તસમાધિ વગેરે આત્મગુણો ખીલતા જાય.

આ રીતે દાનાદિ ધર્મના તે તે ખાસ ઉદેશ બરાબર લક્ષ્યમાં રહેવા જોઈએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૧૨, તા. ૧૩-૧૨-૧૯૬૮

### ૬૩ ધર્મ શું મોક્ષની જ ઈચ્છાથી કરવાનો ?

જૈન શાસ્ત્રો કહે છે ‘જીવે અનંતી વાર ચારિત્ર લીધા’ છતાં એ ભવમાં ભટકે છે એ સૂચ્યાએ છે કે એ ચારિત્ર નિષ્ફળ ગયાં. જો ચારિત્ર અનંતી વાર લીધાં, તો શું દાન-શીલ-તપ વગેરે સાધનાઓ અનંતી વાર નહિ આચયરી હોય ? આચયરી જ હશે. તો તે પણ નિષ્ફળ ગઈ, એમ જીવમાં હજ પણ ઊભેલી કર્મગુલામી અને મોહંગુલામી સૂચવી રહી છે - એ ચારિત્રાદિ બધું નિષ્ફળ જવાનું કારણ કે શક્ત ભાવની ખામી હતી. દાન શીલ-તપ-ભાવના એ બધા ય તારક છે, ધર્મ છે, પરંતુ ભાવ વિના એ બધા નિષ્ફળ જાય છે,

ત્યારે અહીં સવાલ એ થાય છે કે દાનાદિ સાથે ભાવ જોઈએ તે કેવા પ્રકારનો ? એમ તો પૂર્વેય દાન આદિ ધર્મ કર્યા તે ગતાનુગતિક સિવાયના તો કોઈને કોઈ ભાવથી તો કરેલા, પરંતુ એ ભાવ મહિન હતા, પૌદ્રગલિક આશંસા યા ઈર્ઝ્ય દ્વેષ વગેરે મેલા ભાવથી એ દાનાદિ કરેલા; ને કરતાં માન્યું ‘મને સ્વર્ગાદિ સુખ મળે,’ ‘હું લોકમાં સારો દેખાઉં,’ ‘મારી કીર્તિ ફેલાય, નામ પ્રસિદ્ધ બની જાય,’ અથવા ‘અમુકે દાનાદિ કર્યા પણ હું બતાવી આપું કે દાનાદિ આમ થાય.’ અથવા રીસમાં તપ કર્યો, વ્રત લીધું, વગેરે. આ બધા મહિન ભાવ છે. ત્યારે આવશ્યક છે શુદ્ધભાવ, નિર્મળભાવ, એ કેવો હોય ?

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૪૭

અહીં કહીએ છીએ કે ‘દાનાદિ માત્ર મોક્ષની ઈચ્છાથી કરાય. માત્ર કર્મ-નિર્જરા અર્થે કરાય, તો એ શુદ્ધભાવથી દાનાદિ થયા.’ હકીકતે આ સાચું છે, છતાં એવું કેમ દેખાય છે કે થોડા દાનમાં-શીલમાં-તપમાં તો હજ મન રહે છે, પરંતુ પછી એ જરા વધુ કરવાની વાત આવે તો કંટાળો આવે છે ? એક માળા ગાણી, કે સામાયિક એક કર્યું, પછી જીવ કેમ ધરાઈ જાય છે ? અને જો બીજી માળા કે સામાયિક કરવાની વાત આવે તો કંટાળો એદ ઉદાસતા કેમ આવે છે ? એક બે ટીપમાં પૈસા આપ્યા, પછી ત્રીજી-ચોથી ટીપમાં આપવાની વાત આવે તો કેમ કંટાળો ? કદાચ ગુસ્સો ય આવી જાય છે ! શાથી ? મોક્ષ યા કર્મક્ષયની ઈચ્છા જ છે, તો એ જલદી થવાનો સંયોગ મળે છે; પછી કંટાળો કેમ ? થોડો ધર્મ કરીને પછી ધર્મનો રસ ખૂટી કેમ જાય છે ?

બીજું એક એ દેખાય છે કે દાનાદિમાં કર્મક્ષય યા મોક્ષની ઈચ્છાનો ભાવ રાખવાનો દાવો કરે, છતાં બીજી બાજુ વેપાર રંગરાગ-ખાનપાન વગેરેમાં દાનાદિ કરતાંય કેટલા ગુણા વધુ રસ રાખે છે, એનું શું કારણ ? સામાયિક કે માળા પૂરી થતાં હાશનો અનુભવ કરે છે. રૂ. ૧૦૦ને બદલે ૮૧ દેવાથી પત્યું તો હાશ માને છે. શેમાં હાશ ? સામાયિકમાંથી અવિરતિમાં જવાનું થયું, માળા પૂરી કરી કાપાને પાપખાતામાં મોકળી કરી, દાનમાંથી રૂપિયા ૧૮ બચાવ્યા,... વગેરેમાં હાશ ! એટલે હવે જ્યારે ફરીથી એક સામાયિકાદિ કરવાનું આવશે ત્યારે માથે જાણે એક ભાર હતો તે ઉતારવાનું સમજશે. તો પછી ધર્મ કરતાં હોંશ ને રસ ક્યાં રહ્યા ? શું મોક્ષ યા કર્મક્ષયની ઈચ્છા નથી ? ત્યાં ના કહેવાતી નથી. છતાં દાનાદિ કરતાં વેપારાદિમાં રસ વધુ છે કેમ વારું ?

આ (૧) ધર્મરસ જલદી ખૂટી જવો, અને (૨) વેપારાદિનો રસ ભારે રહેવો,-એમ બે જાતના દરદ છે. એ મિટાવવા માટે કોઈ એવા નિર્મળ અને નક્કર તથા પ્રત્યક્ષ અનુભવાય એવા શુભ ભાવની શુભ આશયની જરૂર છે. મોક્ષની નિકટતા અને કર્મક્ષય તો અતીન્દ્રિય છે, પ્રત્યક્ષ નથી અનુભવાતા. માટે એકલા એ ઉદેશી નહિ ચાલે, પ્રત્યક્ષ અનુભવમાં આવે એવા નિર્મળ અને નક્કરભાવ રાખવા જોઈએ કે જે એ બે દરદ મિટાવે. એ ભાવ આ રાખી શકાય કે,-

દાન દેતાં મૂચ્છ કાપવાનો ભાવ, શીલ-પ્રત-નિયમ આચરતાં સંયમની મમતા તથા વૈરાગ્ય વધારવાનો ભાવ, તપ કરતાં કાયા અને આહારાદિની મમતા કાપવાનો ભાવ, તથા ભાવના ભાવતા કષાયનો ઉપશમ તથા આત્મ-મમત્વ વધારવાનો ભાવ જોઈએ...ઈત્યાદિ.

દાન દેતાં એમ થાય કે ‘હાશ ! આટલી ધનની મૂચ્છ કાપાય છે એ ઠીક ૧૪૮ ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

છે.' ગ્રતનિયમ પાળતાં થાય કે 'હાશ ! આટલું સંયમમાં અવાયું.' તપ કરતાં થાય કે હાશ આટલો કાયા કસવાનો અને આહારની ગુલામી આટલી દબાવવાનો લાભ મળ્યો !' અનિત્ય-અશરણ-સંસાર આદિ ભાવના ભાવતાં મનને એમ રહે કે 'જો જગતના સંયોગો અનિત્ય છે, જગતથી જીવને શરણ નથી, સગા-સ્નેહીનો સંસાર વિચિત્ર છે;...વગેરે, તો એનો અર્થ એક જ છે કે પોતાનો ગુલામીરહિત આત્મા જ સારરૂપ છે.' માટે ભાવના ભાવતાં આ ઉદ્દેશ રહે કે 'હાશ ! બાધ્ય સંયોગ અને આંતર કષાયોની ગુલામી ઓછી થઈ આત્મમમતા વધશે...'

આમ દાનાદિ ધર્મ કરતાં આ પ્રત્યક્ષ અનુભવાય એવા ધનમૂર્ખર્થત્યાગ, વૈરાગ્ય, સંયમ, કાયમમત્વ પર કાપ, આહારસંશોદ દબાયાનો આનંદ, કષાયોપશમ, આત્મમમત્વ, વગેરેનો પાકો ઉદ્દેશ રખાય, તો ધર્મમાં રસ ખૂટે નહિ, અને વ્યાપાર વગેરે સાંસારિક બાબતોમાં રસ કપાતો આવે; એમાં મોકશની સાચી ઈચ્છા પોષાય.

"દિવ્ય-દર્શન"-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૧૩, તા. ૨૦-૧૨-૧૯૬૮

## ૭૪ દુઃખ શાથી ? પૈસા દાબી રાખીને ધર્મમમતા ન વધે

'દુઃખ હુણ યા નાલાયક માણસોના લીધે આવે છે' એમ નાસ્તિક કહે છે. ત્યારે આસ્તિક માને છે કે 'દુઃખ દુદર્ભિયના લીધે આવે છે' પરંતુ જૈન કહે છે કે 'દુઃખ અહંત્વ-મમત્વના લીધે છે.'

આથી બને છે એવું કે જીવને ભરતાં સુધી કોઈ ને કોઈ પુણ્યની કચાશના લીધે અનુકૂળતામાં કાંઈ ને કાંઈ ખામી રહેવાની. હવે નાસ્તિકને એમાં દુઃખ લાગશે તે પર કોઈ ને કોઈને દોષ દેશે કે આ આની નાલાયકીએ મારે દુઃખ આયું. દા.ત. પોતે ધારેલું દીકરાએ ન કર્યું તો માનશે કે 'આ દીકરો બરાબર નહિ, એટલે મારું ધાર્યું ન થયું.' આમ માનીને દુઃખી થશે. ત્યારે આસ્તિક માણસ ત્યાં પોતાના કમ ભાગને દોષ દેશે કે શું કરું ? આ મારાં કર્મ જ એવા છે કે દીકરો મારું ધાર્યું ન કરે. બનેને ભરતાં સુધી દુઃખ માનવાનું રહેશે. છેવટે ઘણા પૈસા ખાવા છતાં ડોક્ટર રોગ મટાડી નહિ શકે, મોત રોકી નહિ શકે, ત્યાં નાસ્તિકને એ ડોક્ટર અયોગ્ય લાગી દુઃખ થશે, અને આસ્તિકને પોતાના વાંકા કર્મ જોઈ દુઃખ થશે; દીનતા કરશે, 'શું કરીએ ? આ મારાં કર્મ જ એવાં !' બીજાને દોષ નહિ દે બીજા પર દ્રેષ નહિ કરે એટલા પ્રમાણમાં આસ્તિક જો કે નાસ્તિક કરતાં સારો; પરંતુ કર્મ તો રોકી શકતાં નથી તેથી દીનતા અનુભવ્યા કરશે.

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૪૮

ત્યારે જૈન તત્ત્વ સમજનારો તો જુઓ છે કે દુઃખ બહારની કોઈ વ્યક્તિથી ય નથી આવતું યા કર્મના લીધે પણ નહિ. દુઃખ તો જીતના અહંત્વ-મમત્વને લીધે લાગે છે. મહાત્માઓ પર જીવલેશ ઉપસર્ગ આવ્યા, ખંધક મુનિની જીવના ચામડી ઊતરી, છતાં 'મુનિવર મનમાંઠી આંશંદા, પરીસહ આવ્યો જાણી રે.' ગજસુકુમાળના માથે સોમિલ સસરે સગડી સળગાવી, છતાં એમણે જરાય દુઃખ ન માન્યું. એમણે તો માન્યું કે 'જે બળે છે તે મારું નથી, ને મારું છે તે બળતું નથી. શરીર બળતું છે પણ તે મારું નથી, ને મારાં તો જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. એ કાંઈ બળતા નથી.' આમાં ક્યાં દુઃખ માનવાનું રહે ? 'હેં ? હું એક નિર્દોષ નિરપરાધી સાધુ, ને મને આવું કરે ?' એવું અહંત્વ જ ન રાયું, તેમજ શરીર પર મમત્વ પણ ન રાયું, અને પારકું જ લેખ્યું, એટલે અહંત્વ-મમત્વ બંને મૂકાઈ ગયા પછી દુઃખ માનવાનો વિષય જ ન રહ્યો.

સામાન્ય માણસને આટલી ઊંચી કક્ષા ન હોય તેથી અહંત્વ-મમત્વવશ દુઃખ લાગ્યા કરતું હોય, પરંતુ જો એ સાવધાન હોય તો દુઃખમાં બીજા પર દ્રેષ નહિ કરે, તેમ 'મારાં કર્મ એવાં ! શું કરું ?' એમ દીન નહિ બને; પરંતુ સમજી રાખશે કે 'આ અહંત્વ અને કાયા વગેરે પર મમત્વ રાયું છે એનાં જ કારણો આ પ્રસંગે દુઃખ લાગે છે. તેથી બને તેમ એ અહંત્વ-મમત્વને કાપતો ચાલુ.'

અહંત્વ-મમત્વને ઘસારો પડે, એ કપાતા આવે એટલા જ માટે જ્ઞાનીઓએ દાનાદિ ધર્મ સેવવાનાં કચ્ચાં છે. એમાંય દાનધર્મથી, માણસને પ્રાણભૂત લાગતા જ પૈસા, એનું મમત્વ કપાતું આવે છે. અહીં એક પ્રશ્ન થાય,

પ્ર.- એમ તો જેમ દાનમાં એટલા પૈસા ખરચાવાથી એટલાની મૂર્ખ્ય કપાઈ, તેમ જાત કે કુટુંબના ભોગમાં ખરચાવા એટલાની ય મૂર્ખ્ય કપાઈ ગણાય ને ?

૩.- નાં, એમાં તો માત્ર મૂર્ખ્ય ધન પરથી ભોગસુખ પર ઉતારી એટલું થયું; તેથી ભોગ પર મૂર્ખ્ય વધી. હવે એનાં સાધન તરીકે પાછું ધન મેળવવા દોડશે ! તેથી ધનની મૂર્ખ્ય અકબંધ રહે છે, ને ભોગની મમતાનું પોષણ થાય છે. આમાં મમતા ઘટવાની વાત ક્યાં રહી ?

ત્યારે દાનમાં તો એવું છે કે દાન એટલે દેવ-ગુરુ-ધર્મની ભક્તિમાં ખરચ કરતાં અલખતા મમતા-મૂર્ખ્ય ધન પરથી ઊતરીને દેવ-ગુરુ-ધર્મ પર જાય, કિન્તુ એ તો એક સારું તત્ત્વ ઊભું થયું; કેમ કે જેમ જેમ દેવ-ગુરુ-ધર્મની મમતા વધે તેમ તેમ સંસારની ને સંસારના અર્થ-કામની યાને સંસારસુખ અને એનાં સાધનાની મમતા ઘટતી આવે.

પ્ર.- પરંતુ તે પછી ય પેલાની જેમ દાન-ભક્તિ કરવા માટે પાછી ધન

૧૫૦

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

કમાવાની મૂર્ચ્છી તો ઊભી થાય ને ?

૩.- ના, એને દેવ-ગુરુ-ધર્મની મમતા વધી છે, તેથી દેવ-ગુરુ-ધર્મ એમ જે શીજવે છે કે ‘ધન એ અનર્થનું મૂળ હોઈ ત્યાજ્ય છે,’ એ શિખામાણ પર આસ્થા વધતી જાય છે; પછી ધન પર મૂર્ચ્છી વધારવાનું ને એ માટે બહુ દોડવાનું એ શાનો કરે ?

આ પરથી એ પણ સૂચિત થાય છે કે દાન કરો એટલે મૂર્ચ્છી ધન પરથી ઉત્તરી પાત્ર પર વધુ જામે. બેરી પર સારો ખર્ચ કરનારને એના પર મમતા વધે છે. તો પછી, જો દેવ-ગુરુ-ધર્મ ઉપર મમતા વધારવી હોય, ને પાસે પૈસા છે, તો એમની ભક્તિમાં ધનખર્ચ કરતા જ રહેવું જોઈએ. જેટલો જેટલો એ ખર્ચ કરતો રહે એટલી એટલી દેવ-ગુરુ-ધર્મની મમતા વધતી આવે. ખર્ચવામાં અખાડા કરનારને દેવ-ગુરુ-ધર્મ પર મમતાના વાંધા.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૧૪, તા. ૨૭-૧૨-૧૯૬૮

## ૭૫ મદ-ઈષ્ટા-નિંદા-વિકથા એ ભયંકર પાપ કેમ ?

સામાન્ય રીતે માણસને એમ લાગે છે કે જીવની હિંસા થઈ, જૂંહ બોલાયું, અનીતિ કરી કે દુરાચારમાં ગયા, તો એ બહુ ખોટું થયું.

અલબંત આ પણ ધર્મ હદ્યને લાગે. બાકી પાપિષ જીવને તો એમાં ય કશું ખોટું લાગતું જ નથી. દા.ત. અનીતિ કરીને એમ માને છે કે ‘આમાં ચોરી શાની ? સરકાર એવા કાયદા કરે, ઇન્કમટેક્ષ વગેરેમાં અમને નિયોવવાનું રાખે, તો શું કમાઈ કમાઈને એના ઘરમાં ભરી આવીએ ? એ તો ઊંટે કાઢ્યા ફેકા, તો માણસે કર્યા કાઠાં. આજના કાળે ડબલ ચોપડા વગેરે કાંઈ અનીતિ-ચોરી ન ગણાય.’ આ પાપમાં નિર્ભય જીવને લાગે છે, પરંતુ ધર્મિષ જીવને તો એમ થાય છે કે ‘અરેરે ! આ કેવો પાપયુગ આવ્યો કે મારે આ ડબલ ચોપડા વગેરે ખોટું કરવું ને ખોટું બતાવવું પડે છે ! જૂઠાં બોલવા પડે ! માયા કરવી પડે છે ! એમ, કેવો આ પાપયુગ કે હિંસાજન્ય કપડાં પહેરવા પડે ? હિંસાજન્ય દવાઓ ખાવી પડે છે !...’ તાત્પર્ય, ધર્મત્વાને હિંસા-જૂઠ-અનીતિ વગેરે પાપ ભૂંડા લાગે છે, એ કરવા પડે એમાં દિલ દુખાય છે.

ઇતાં ખૂબી એ છે કે આવા પણ કેટલાય જીવને મનમાં ઈષ્ટા આવે. વળી

બહાર અભિમાન આવે, અભિમાનનું કે ઈષ્ટાનું બોલાઈ જાય, કોઈનો તિરસ્કાર થઈ જાય,... તો એમ નથી લાગતું કે ‘આ મેં ખોટું કર્યું.’ એમ કોઈની નિંદા કરવી યા સાંભળી અથવા વિકથા-કુથલી કરી યા સાંભળી, તો એમ નથી થતું કે ‘આ મારાથી ખોટું થઈ ગયું.’ એ તો જાણે સહેજ વાત લાગે છે. કેટલીય વાર તો ભાન જ નથી રહેતું કે આ મારા વિચાર યા બોલમાં અભિમાન-અહંત્વનું ઝેર મિશ્રિત છે, કે ઈષ્ટાની આગ છે. અથવા નિંદા કે કુથલીરૂપતા છે.’ પછી જો એ ભાન જ નહિ, તો એ ખોટું કર્યું માનવાનું તો આવે જ ક્યાં ?

નિંદા-કુથલી-મદ-ઈષ્ટા-દિલને ખોટું નહિ લાગવાને લીધે જ એનો સંતાપ નથી, તેમ એ વારંવાર અને હોંશે હોંશે થતા રહે છે. સાધુ પણ જો જાગ્રત ન હોય, સાવધાન ન રહે, તો આમાં ભૂલા પડી જાય. એક વાર બેવાર સહેજ પણ વિકથા-કુથલી થઈ, કોઈ રાજકથા, સ્રીકથા, ભોજનકથા કે દેશકથા, યા કોઈ ફજુલ વાતો થઈ, ને જો લાગે કે આ ખોટું થયું, ‘અરરર ! આ મેં ધર્મત્વા થઈને આ શું કર્યું?’-એમ સંતાપ થયો. તો તો પછી મન પર બરાબર અંકુશ રાખીને ફરી એવાં પાપની આવૃત્તિ ન થાય એની કાળજી રખાય. પરંતુ મૂળમાં આ અહંત્વ-ઈષ્ટા-કુથલી કે નિંદા કર્યાનું ખોટું લાગે, ને એનો દિલને બાળતો સંતાપ થાય તો ફરીથી એ પાપથી દૂર રહે ને ? ખોટું કર્યું લાગવાનું ન હોય, ને સંતાપ થવાનો ન હોય, તો એ પાપથી પાછા હટવાનું શું ? પાપ બંધ કરવાનું શાનું હોય ? એટલે પછી કેમ ? તો કે જ્યાં જ્યાં મોકો મળ્યો કે જીવ જટ હોંશે હોંશે એ પાપમાં જોડવાનો. બસ, આટલા માટે હિંસાદિ પાપ કરતાં આ મદ-ઈષ્ટા-દિલને પાપ ભયંકર છે કે એ હોંશે હોંશે ને વારંવાર થાય છે, તથા એમાં કોઈ ઘેદ-સંતાપ નથી.

ત્યારે મોહ રાજાની આ ખૂબી છે કે એ જાણે જીવને કહે છે કે ‘ભલે, તું હિંસાદિ પાપોને ખોટાં માનજે, એ ઓછાં પણ કરતો રહેજે, કિંતુ આ મદ-ઈષ્ટા-નિંદા-વિકથાને ખોટાં માનતો નહિ; ને એમાં હોંશે હોંશે તથા વારંવાર પ્રવર્તતો રહેજે.’ અહંત્વ ઈષ્ટા-દિલને પાપ ખોટાં ન લાગે, એનો સંતાપ ન હોય, ત્યાં મિથ્યાત્વ મોહનીયને વિકસવાનું બને છે. ‘ભવભાવના’ શાસ્ત્રમાંનું ભુવનભાનું કેવલીનું ચરિત્ર આ બતાવે છે કે ચૌદ પૂર્વપર મહિષ પણ આ નિંદા-વિકથાદિ પાપના લીધે મરીને નિગોદમાં ચાલી ગયા, ને અનંત કાળ સંસારમાં ભટક્યા. ચૌદપૂર્વી જેવાને પણ આવાં પાપ નીચે પટકે અને ભવમાં ભટકાવે એ મદ-ઈષ્ટા-નિંદા-કુથલીનાં પાપ કેટલા બધાં ભયંકર ?

મદ-ઈઝર્ડિટ પાપો ભયંકર હોવાનું એક કારણ એ પણ છે કે એ પાપોને સેવતાં હદ્યને કોઈ ક્ષોભ-સંકોચ-સંતાપ નથી, તો એનાથી જે કર્મ બંધાય છે તે સાનુંબંધ અશુભ કર્મો બંધાય છે. ‘સાનુંબંધ’ એટલે બીજશક્તિવાળાં, અર્થાતું એ બંધાયેલાં કર્મ જ્યારે ઉદ્યમાં આવે ત્યારે એનાં કટુ ફળ તો ભોગવવાં પડે, પરંતુ સાથે એવી ચીકણી મદ આદિની દુર્ભુદ્ધિ પણ થાય કે જેથી એ પાપોની આગળ પરંપરા ચાલે. એનો અર્થ એ કે અધમ ભવોની પરંપરા ચાલે.

બાકી મદ તો અવસરે દેવ-ગુરુ-ગુણિયલ કરતાં પણ જાતને ઊંચી મનાવે છે. ઈર્ઝા પ્રભુએ કહેલા સુકૃત અને ગુણવાનના ગુણ પ્રત્યે દ્રેષ ઊભો કરે છે. નિંદા ભદ્રક જીવોના દિલમાં સારા માણસો પ્રત્યે દુર્ભર્વા ઊભો કરે છે. વિકથા મહાન ઊંચી સાધનાઓને બદલે તુચ્છ જડ વસ્તુનાં મહત્વ મનાવે છે, રાગ વધારે છે.

વળી મદ-ઈઝર્ડિન્-નિંદાથી નીચગોત્ર બંધાય છે. વિકથા-કુથલીથી અશુભ નામકર્મો દા.ત. અપશય-દુર્ભર્વા-અનાદેય વગેરે બંધાય છે.

આવાં બધાં કારણે મદ-અહંત્વ-ઈઝર્ડિ, તથા નિંદા-વિકથા કુથલી એ ભયંકર પાપો છે. ધર્મી જીવે એનાથી સંદર્ભ દૂર રહેવું ધટે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૧૫, તા. ૩-૧-૧૯૭૦

## ૭૬ વિકાસ શો ? ધર્મ કરાય, પણ વિકાસ કચારે ?

(લેખાંક-૧)

વિકાસ કોણ નથી ઈચ્છતું ? પ્રાણીમાત્ર ઈચ્છે છે કે હું આગળ વધુ પણ શામાં ? ભૌતિક સુખમાં, સુખના સાધનોમાં. ધન-માલ-પરિવાર-પ્રતિજ્ઞા કેમ બહુ મળે, સારા મળતા જાય, માન-સન્માન-સત્કાર અધિકાર્થિક મળતા જાય, શરીર તગું લાલબુંબ સશક્ત બનતું જાય, વગેરે વગેરે ભૌતિક વિકાસની ઝંખના તો સૌ કોઈને હોય છે.

પરંતુ આ વિકાસ મહત્વનો નથી; કેમ કે મોટા ભાગે આ ભૌતિક વિકાસ વધતાં આત્મિક વિકાસ રુંધાય છે, આત્મામાં અહંત્વ-આસક્તિ વગેરેની ઝેરી લાગણીઓ વધતી જાય છે. તેથી વાસ્તવમાં ચિત્ત પ્રશાન્ત-પ્રસન્ન-સ્વર્ઘ, સ્વસ્થ બનવાને બદલે અશાન્ત અસ્વસ્થ અને રતિ-અરતિ આદિના મેલથી મહિન બનતું રહે છે. ભૌતિક વિકાસથી જો જીવને આ જ કચરાખાતું મળતું હોય તો એ વિકાસનું શું મૂલ્ય ?

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૫૩

બીજું એ પણ છે કે ગમે તેટલો એ વિકાસ સધાતો આવે છતાં સરવાળે મૃત્યુ વખતે જીવને એ શું આશ્વાસન આપી શકે ? કશું જ નહિ. અને મૃત્યુ બાદ એમાંની રજ પણ શી જીવની સાથે જઈ શકે ? લેશ નહિ. નાશવંતના ભરોસા ભગ્ન જ થવાના. તો જ્યાં અંતે શુન્યતાના હાઉ સામે ડોકિયાં કરતાં હોય એવા આવા ભૌતિક વિકાસની કેટલી કિંમત ?

નિર્ભળ જીવ ભૌતિક વિકાસ વિના ચલાવી શકતો ન હોય એ એક વસ્તુ છે, અને એનાં બહુ મૂલ્ય આંકી એમાં સર્વસ્વ તથા સર્વે સર્વા કલ્યાણ અને જાતને ભાગ્યશાળી માની બેસવું એ બીજી વસ્તુ છે. જીવનભરના વિકાસ કેમ નહિ ? ધર્મ કરાય છે તે અંતરમાં ધર્મ પરિજ્ઞમાવવા નહિ. ધર્મથી કશા શુભ ભાવ વધારવા નહિ. અશુભ ટાળવાં નહિ. રોગીને દવા વિના ચાલતું ન હોય, છતાં એ રોજ દવા જે ખાવી પડે એને આનંદથી વધાવી લેતો નથી, એના પર જાતને ભાગ્યશાળી માનતો નથી. એના હદ્યને ઉંઘે છે કે ‘હાય ! આ કેવા પાપના ઉદ્ય કે રોજ દવાની ગુલામી કરવી પડે છે ! કેવી કડવી બેસ્વાદ દવા ! ખાવાપીવા પર કેવા અંકુશ ! શરીર કેવું અશક્ત !! ઈત્યાદિ બળતરા ચાલુ રહે છે.

બસ, એ રીતે ભૌતિક વિકાસ આત્માર્થી જીવને બળતરા કરાવનારો હોય, એ મળવામાં જાત ભાગ્યશાળી ન લાગે, પણ આત્માના રોગ તરીકે એમાં કમનસીબી દેખાય, મનને એમ થયા કરે કે ‘કેવો હું કમનસીબ કે મારે આના વિના ચાલતું નથી. ધન્ય છે તે મહાત્મા મુનિઓને કે જેમણે આ ભૌતિક વિકાસની બલા વિના જ જીવવાનું રાખ્યું છે ! હું આનો ગુલામ, રોજ મારે આના કડવા અનુભવ કરવા પડે ? આમાં મારા આત્માની અશક્તિ કેવી ચાલ્યા કરે છે કે એ સ્થિર દેવદર્શનાદિ કર્મકિયાઓ અને બીજી તપ વગેરે સાધનાઓ માટે હું મુદ્દાલ અને અશક્ત ! ત્યારે શું જીવનભર આ વેઠ કરવી પડશે ? કચારે આ ભૌતિક વિકાસની ગુલામીના કારમા બંધનમાંથી છૂટીશ ?

માનવ જીવની કિંમત દસ્તિની નિર્મળતા પર મપાય. દસ્તિ જેટલી સ્વર્ઘ બનતી જાય એટલું જીવન ઊંચું, અને દસ્તિ જેટલી મહિન એટલું જીવન નીચા દરજજાનું. દસ્તિ મહિન ક્યાં ? (i) ભૌતિક વિકાસનાં બહુમૂલ્ય આંકવા જતાં, (ii) એમાં જાત ભાગ્યશાળી લાગવા જતાં, અને (iii) એમાં સર્વસ્વ માનવા જતાં દસ્તિ મહિન અતિ મહિન બને છે; કેમ કે એમાં આત્મા સરાસર વીસરાય છે; આત્માના ડિતનો વિચાર નથી રહેતો, આત્માની પુણ્યમૂડી સફાચટ થતી ચાલ્યાનો કશો ખ્યાલ જ નહિ, પછી ખેદ થવાની તો વાતેય શી ? ત્યારે ઉપરથી આત્મામાં અહંત્વ-આસક્તિ, માયા-ઈઝર્ડિ, લોભ-તૃષ્ણા વગેરેનો ઉકરડો વધતો જાય છે !

૧૫૪

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

જાલિમ પાપમૂરી ભરાતી જાય છે ! એકેન્દ્રિયપણામાંથી માંડ છૂટીને અનંતાકાળે ઠેઠ ઉંચા માનવભવના થાળે આવ્યાની મહેનત ધૂળધારી કરાય છે. એટલું જ નહિ પણ મળેલા ઉંચામાં ઉંચા અને ડિમતીમાં ડિમતી અરિહંતદેવ-ત્યાગી સાધુ-શાસ્ત્રતીર્થ-સંધ વગેરે આલંબનો, કે જેના આધારે ટૂંક સમયમાં ભવ પાર કરી શકાય, અને આ ભૌતિક વિકાસ પરની અંધ આસક્તિની મોંકાણ તદ્દન નિષ્ફળ બનાવી દે છે, જાત માટે અત્યંત નિરૂપયોગી કરી દે છે; કદાચ એ આલંબનોની ય સામે અરુચિ અહંકાર ઉભા કરે છે.

માટે ભૌતિક વિકાસની લાલસા અને અંધ આસ્થાને પગે લાગવા જેવું છે. જનમના રોગીને રોગ પર બળતરાની જેમ એની હૃદયવેધી બળતરા ઉભી કરી આત્મિક વિકાસની માયા લગાડી દેવા જેવી છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૧૬, તા. ૧૦-૧-૧૯૭૦

(૭૭) (લેખાંક-૨)

ગત લેખમાં જોયું કે ભૌતિક વિકાસ મહત્વનો નથી, મહત્વનો છે આત્મવિકાસ, કેમ કે એથી જ સાચી શાંતિ, સાચી પ્રસન્નતા અને પવિત્રતા મળે છે. માટે પ્રયત્ન આત્મવિકાસ માટે જોરદાર થવો જોઈએ.

ત્યારે સવાલ થાય કે આત્માનો વિકાસ શો ?

જવાબ સરળ છે. જેમ ભૌતિક વિકાસમાં, ‘કાયા સુંદર સુખી ઉજળી બને, એનાં સાધનો સારાં વધે, દા.ત. માલ-મિલકત, પ્રતિષ્ઠા-પરિવાર, સંભાન-સત્કાર વગેરે વધતા જાય અને સારા બનતા જાય,’-એ બધું આવે, એવી રીતે આત્મવિકાસમાં,-‘આત્મા સુંદર, સુખી અને પવિત્ર બનતો જાય, તેમ એનાં સાધનભૂત દેવ-ગુરુ ઉંચા મળે, ધર્મ-માર્ગ ઉંચો મળે, એથી આત્મામાં જ્ઞાન-વૈરાગ્ય-શક્તા, ક્ષમા-તૃપ્તિ-સમાધિ ત્યાગ-અગ્લાનિ-અનાસક્તિ, વગેરે ભાવો વિકસતા ચાલે,’- એ બધું આવે એથી જ આત્માનું સૌંદર્ય-સ્વસ્થતા-સ્વચ્છતા-પ્રસન્નતા વધતી જાય. આપણે વિકાસ પામી રહ્યા છીએ કે નહિ, એ આના આધારે મપાય, પણ નહિ કે ભૌતિક વિકાસના આધારે.

આજે વિકાસની વાતો ચાલે છે, પરંતુ એમાં નાર્યી જડવિકાસનો કોલાહલ ચાલી પડ્યો છે. “જડવાદી બનાવનાર કેળવણી વધારો, એની શાળા-મહાશાળાઓ વિકસાવો; બહુ હિસા-આરંભસમારંભમય દવા-ઉપચારો ભરી તથા ગર્ભમાં આવેલા માનવ જીવનો નાશ કરે એવા સંતતિનિયમનને કરી આપનારી હોસ્પિટલો વધારો;

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૫૫

સિનેમાછિ મનોરંજનો વધારો,”-વગેરે કોલાહલ કેટલો બધો ચાલ્યો છે ? ભારોભાર રાગદ્રોષ અને આર્તધ્યાનની પરંપરા યાવત્ રૌદ્રધ્યાનને પણ જગાવી આપે એવાં છાપા-રેઝિયો-પિક્ચર-ટેલીવિઝન વગેરે ધૂમ વધી ગયા, આંતર રાષ્ટ્રીય જબરો કાણમાં સુલભ થઈ ગઈ, વગેરે વગેરેને વિકાસ મનાવી એમાં ખુશી થવાય છે.

આ કોલાહલમાં આત્મવિકાસની યાદ કોણ કરે ? વાત કોણ સાંભળે ? જ્યાં આત્મમાં (૧) જડવાદ-વિલાસપ્રિયતા વધે, (૨) માનવહત્યા થાય, (૩) હિસા સસ્તી બને, (૪) રાગદ્રોષ અને આર્ત-રૌદ્રધ્યાન વધે, એમાં વિકાસ મનાય ? નવી તૈયાર થયેલી અને થતી પ્રજાના દેદાર પરથી માપી શકાય છે કે જડવિકાસે એમના આત્મવિકાસને કેવો ગુંગળાવી ખત્મ કરી નાખ્યો છે !

માનવજીવન આત્મવિકાસ માટે છે. એનું સાધન છે ધર્મ. ધર્મની આરાધના કરતા ચાલો એટલે આત્માનો વિકાસ થતો આવે, એની સુંદરતા-સ્વસ્થતા-સ્વચ્છતા વધતી આવે.

ત્યારે અહીં સવાલ આ થાય છે કે ધર્મની આરાધના તો વર્ષોથી કરાતી દેખાય છે, પણ આત્મવિકાસ કેમ નથી દેખાતો ?

આનો જવાબ એટલો જ કે ધર્મ તો કરાય, પણ એથી આત્મવિકાસ ત્યારે થાય કે વિકાસ માટે ધર્મ કરવામાં આવે, અને ધર્મ કરતાં કરતાં વિકાસનું પાંકું લક્ષ રાખી વિકાસ સાધતા જવાય. નહિતર તો વિકાસની સાધના વિના વિકાસ ક્યાંથી સિદ્ધ થાય ? સાધના વિના સિદ્ધ નહિ.

એટલે હવે જીતમાં એ તપાસતા રહેવા જેવું છે, કે ‘આ હું ધર્મ કરું દું તે વિકાસ માટે ન ? વિકાસ આમાંથી સિદ્ધ થતો આવે છે ન ?

દા.ત. વીતરાગ પ્રભુનાં દર્શન કર્યા, પૂજા કરી, સુન્તિ સત્વન ગાયાં, તે વીતરાગતાની મમતા વધારવા માટે ન ? એ દર્શનાછિ કરતી વખતે એ મમતા વધી રહી છે ન ? તેથી પોતાની રાગ-દ્રેષ્ટ-કામ-કોષ-લોભાદિભરી દશાની ઘૃણા થાય છે ન ? જાત પર નફરત થાય છે ને કે ‘ક્યાં આ ઉત્તમ વીતરાગ ભગવાન, ને ક્યાં મારી રાગદ્રોષાદિ કચરાભરી દશા ? આવા ભગવાન મળ્યા પછી શા સારુ પૈસા-પરિવાર પર મમતા કરું ?’

એમ સામાચિકાદિ કરતી વખતે નિષ્પાપ અવસ્થાની મમતા વધારાય, પાપ ખુલ્લાવાળી દશા પર ઘૃણા વધારાય. એમ શીલ-પ્રત-નિયમ આચરતાં અબ્રહ્મ-અપ્રત-અનિયમ પર ઘૃણા વધારાય.

એવી રીતે તપસ્યા કરતાં તપની મમતા અને ખાનપાનની ઘૃણા વધારતા જવાય.

૧૫૬

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

સમस્ત પ્રકારની ધર્મસાધનાને સેવતાં સેવતાં ધર્મનું વહાલ-મમત્વ-મહત્વાંકન વધતું ચાલે, ને સાથે પાપો-દોષો-હૃગુણો અને જડાસક્તિ-વિષયાસક્તિ પર ઘૂણા-ગ્લાનિ ભય વધતા જાય. જો આ ચાલુ હોય, તો પછી ધર્મ કરતી વખતે કોઈની સાથે લડી પડાય? ગુસ્સો અભિમાન કરાય? આત્માના લાભને બાજુએ મૂકી જડ લક્ષ્મી-માન-કીર્તિ વગેરેની લાલસા કરાય?

અફસોસી આ છે, કે ધર્મ કરાય છે, પણ સાથે આત્મ-વિકાસનું આત્માને સ્વસ્થ-સ્વચ્છ-સુંદર બનાવવાનું લક્ષ જાગ્રત રહેતું નથી, ને તેથી જ ધર્મ કરતી વખતે ઉપરોક્ત શુભ ભાવો જગાવવાતા નથી એટલે વિકાસ થતો નથી.

ધર્મથી આત્મવિકાસ કરવો હોય તો પહેલું લક્ષ આ જગતું રહેવું જોઈએ કે ‘મારે આ ધર્મ કરતાં કરતાં મુખ્ય તો મારા અંતરાત્માના ભલિન ભાવો કખાયો વગેરેની ઘૂણા ઊભી કરી એને હટાવવાના છે અને વીતરાગભક્તિ આદિ શુભ ભાવો જગાવવાના છે.’ આ લક્ષ આ જગૃતિ અને પુરુષાર્થ હોય તો ધર્મથી સુંદર આત્મવિકાસ થાય.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૧૭, તા. ૧૭-૧-૧૯૭૦

## ૬૮ આપણે આત્માર્થી છીએ ?

જીવ બે જીતના, આત્માર્થી અને દેહાર્થી. દેહાર્થી જીવો અપરંપાર અને આત્માર્થી જીવો થોડા. દેહના અર્થને લગન દેહનાં સુખ-સગવડ-સન્માનની, આત્માના અર્થને લગન આત્માનાં હિતની. જેની લગન હોય એની ચિંતા થાય એ સહજ છે. તેથી દેહાર્થી રાતદિવસ દેહને અને ઈન્દ્રિયોને કેમ સુખ મળે, અનુકૂળતા મળે, માન મળે, આદર-સત્કાર મળે, એ જ જેતો હોય છે, એની જ ચિંતા કર્યા કરે છે; ત્યારે આત્માર્થી જીવને આ જ ચિંતા રહ્યા કરે છે કે ‘પોતાના આત્માનું કેમ ન બગડે, આત્માનું હિત કેમ સધાય, કેમ પરલોક બગડી ન જાય.’

આત્માનું અસ્તિત્વ જ નહિ માનનારા નાસ્તિકને તો આત્માની આત્મહિતની કે પરલોકની શી પડી હોય? એને તો દેહને એશાઓરામી અને સ્વાગત-સન્માન કેમ મળે એનાં સાધન કેમ મળે, ઈન્દ્રિયોને મનગમતું કેમ મળે; એની જ લગન એની જ ચિંતા અને કાળજી હોય છે. એને માત્ર આ જીવનની ચિંતા. હવે જીતને આસ્તિક માનનાર પણ જો આ સ્થિતિમાં જ હોય, જો દેહ ઈન્દ્રિયોનાં જ તર્પણ

કેમ થાય, એની સાધન-સામગ્રી-સગવડ કેમ મળે, એની જ ચિંતા કર્યા કરતો હોય, પરલોકનો વિચાર જ ન હોય તો એ આસ્તિક શાનો? એનામાં આસ્તિકતા શી?

અરે! સંસારના વિષયસુખો અને માન-મર્ત્યા કેમ મળે એની ચિંતાવાળા અભવી દુર્ભવી જીવો પણ ક્યારેક કોઈ દેવતા, કોઈનાં પૂર્વજન્મનાં સ્મરણ વગેરે જોઈને પોતાના આત્માની એ ચિંતાવાળો બને છે કે ‘હું, કેમ પરલોકમાં દેવ-દેવેન્દ્ર-ચક્રવર્તાની પદવી પામું,’ અને એ ચિંતામાં અહીંના સુખ છોડી તપસ્યા ચારિત્ર વગેરેની એ કદક સાધના કરે છે, એટલા અર્થમાં એ આસ્તિક યાને આત્માનું અસ્તિત્વ માનનારો છતાં આત્માર્થી નથી, કેમ કે એને આત્માના હિતની પરી નથી, એને તો પરલોકમાં ય દેહના સુખસન્માન જોઈએ છે. તો પછી માત્ર આ જીવનને સંસારનો સુખસન્માનાદિથી ભરવાની ચિંતાવાળો અને કહેવાતો આસ્તિક જીવ પણ શાનો આત્માર્થી ગણાય?

જાત માટે આ જ વિચારવાનું છે કે, ‘હું આત્માર્થી છું? જો આત્માર્થી છું, તો આત્માના કયા હિતને ચાહું છું? કયા હિતની ચિંતા કાળજી કરું છું? એ માટે શી સાધના, શો પ્રયત્ન કરું છું?’

સમજવાનું છે કે આત્માનું પહેલા નંબરનું હિત આત્માને આ ભવભ્રમણની ચુંગાલમાંથી છોડાવવાનું છે; અને બીજા નંબરનું હિત એ ભવમુક્તિને સાધી આપનારી વિષયકાયથી મુક્તિ છે. જ્યાં સુધી વિષયકાયનાં બંધન છે ત્યાં સુધી જીવનો મોક્ષ નથી, કિન્તુ સંસારમાં જકડામણ છે. એટલે તો અનંતાનંત જીવો વિષય-કાયની જકડામણમાં ભવમાં કેદ પૂરાયા રહે છે, ભવમાં પારાવાર જન્મ-મરણ કર્યા કરે છે. વિષય-કાયના બંધન ન હોય તો જીવને ભવમાં ભ્રમણ શાનાં?

માટે આત્માનું પાયાનું હિત અહીંથી શરૂ થાય છે કે એને આ વિષય-કાયનાં બંધન પ્રત્યે નફરત ઊભી થાય, વૈરાગ્ય-વૈમનસ્ય-વિરોધ રહ્યા કરે. વિષય-કાયના એકદમ ત્યાગ કરવાની શક્તિ-સામર્થ્ય-વીર્યોલ્લાસ ન હોય એનું એને ભારે દુઃખ હોય. એથી જ ઈન્દ્રિયોના વિષયો શર્બદ રૂપ-રસ-ગંધ-સ્પર્શ તથા એના આધારભૂત કે સાધનભૂત પૈસાટકા-માલભિલક્ત કુટુંબ-પરિવાર વગેરે બધું જ અકારું લાગે, ઝેરરૂપ આગરૂપ બેડીરૂપ લાગ્યા કરે. એવું જ કષાયો અંગે થાય, કોધ-માન-માયા-લોભ ઈચ્છા-મદ-માયાકંશા અને અનેક જીતની દુન્યવી એષણાઓ, તથા રતિ-અરતિ (હર્ષ-ઉદ્ઘેગ) ભય શોક કામ કંદર્પ વગેરે બધું ય અકારું આગ-વિષ-બેડીરૂપ લાગ્યા કરે; આ વિષયો અને કષાયોમાં આત્માની વિટંબણા, વેઠ, મશકરી

અને નાલેશી લાગે એથી એ એનાથી વિરક્ત રહે.

આત્મહિત મોક્ષમાં અને મોક્ષના હેતુભૂત ધર્મમાં છે. એ ધર્મના પાયામાં આ વિષયવૈરાગ્ય અને કષાયવૈરાગ્યની જરૂર છે. આત્માર્થિપણું પહેલા નંબરમાં આ માગે છે. એ વિના શી રીતે માની શકીએ કે આપણે આત્માર્થી છીએ? પાયામાં મૂળમાં જો આ વિષય-કષાયનો વૈરાગ્ય જ નથી, અનાં પ્રત્યે નફરત-વૈમનસ્ય-વિરોધ જ નથી, પછી દાનાદિ ધર્મ પણ અને તારણહાર ક્યાંથી બની શકે? અને જો એ મૂળમાં છે તો પછી દાનાદિ ધર્મરૂપ આત્મહિતને જ કેમ ન જંબે? કેમ અને વહાલા ને મુખ્ય ન કરે?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૧૮, તા. ૨૪-૧-૧૯૭૦

## ૭૮ સંયમનાં સૌંદર્ય : બ્રહ્મચર્યની ટાઈક

ગયા લેખમાં એ જોયું કે આત્માર્થી જીવને આત્મહિતની તમન્ના હોય, અને પાયારૂપ આત્મહિતમાં વિષય-કષાયના કારમાં બંધન પ્રત્યે વૈરાગ્ય-વૈમનસ્ય-વિરોધ હોય. હવે એ જોવું છે કે આમાંથી આત્મામાં સંયમનાં સૌંદર્ય અને બ્રહ્મચર્યની ટાઈક કેવી રીતે જન્મે?

આત્માને જો વિષયોનાં આકર્ષણ અને કામ-કોધાદિ કષાયના વિકારો વેઠ-વિટ્ટબણા-નાલેશી અને બેડીરૂપ લાગે છે, તો એ વિષય-કષાયની ખણાજો ભારે રોગરૂપ લાગીને અકળાવતી હોય. મનને એમ થાય કે,-

‘અરે! આ સારું જોઉં, આ સંગીત કે સન્માન-પ્રશંસાના શબ્દ સાંભળું, આ રસ સારો લાગે છે,’ વગેરે વગેરે તો ખરજવાની ખણાજોની જેમ ઈન્દ્રિયોની ખણાજો છે. હું અને ક્યાં સુધી પોથીશ? એમ કામ-કોધ-લોભ, મદ-માયા-માનાકંકા તથા અનેકાનેક પ્રકારની દુન્યવી એષણાઓ જાગે એ કષાયની માનસિક ખણાજો છે. ખરજવાની ખણાજોની જેમ અને હું ક્યાં સુધી પોથ્યા કરીશ. શું એ ખણાજોની ચળ ઉત્તારવા માટે એ વિષય-કષાયનાં સેવન કરી લઈ સુખ-ગર્વ-તોષ માની લીધાં, શું પછી એ ખણાજો શાંત પડી ગઈ? એની વિટ્ટબણામાંથી છૂટકારો મળી ગયો? ના, રોજ નવી પ્રભાતે નવી ખણાજો ઉભી થઈ જ જાય છે, અને મૂર્ખ જીવ અને તોષવા પોથવા દોડધામ કર્યા જ કરે છે, આકુળ વ્યાકુળ બન્યો રહે છે, ફાંઝા મારે છે, અને એ બધી લપમાં આત્માનું હિત સાધવાનું બાજુએ મૂકે છે. આત્માનાં

સૌંદર્ય અને બ્રહ્મચર્યાદિની ઠંડક અનુભવવા તરફ દણ્ણ જ નથી જતી. તો લાવ, હવે તો આ ખણાજો-વિકારો-રોગોથી બચવા છે, આ વિષયોનાં આકર્ષણ ને કષાયોના વિકારોને પડતા મૂકવા છે.’

આત્મા આ આકર્ષણની ખણાજો, અને વિષયોના વિકારો પોથવામાં અસુંદર બને છે? ગરમ ઊકળતો બને છે? હા, અવશ્ય, કોઈનો કે પોતાનો બંગલો સ્ત્રી વગેરે જોવાની ઉત્કંઠા કરી એને પોથવા આંખ લગાવી ત્યાં જીવ એ પહેલાં જે સારા સદ્ગુરીઓ કરતો હશે, મંદિરમાં વીતરાગ પરમાત્માને જોતો હશે, તે વખતે સારો ડાઢ્યો સુંદર હતો, તે હવે આ ખણાજ ઊઠાડવા-પોથવામાં અસ્વસ્થ પાગલ અસુંદર જ બન્યો કહેવાય. એમ સાદું ભોજન જમતાં સ્વસ્થ હતો તે હવે મિઠાઈ લેતાં-ખાતાં અંદરમાં મન ફૂદાકૂદ અસ્વસ્થ પાગલ-શું બને છે, એ જીવની અસુંદરતા જ છે. એવી રીતે દિલમાં કંદું હતી, નમતાલધૂતા હતી, રાગ-લોભ-તૃષ્ણા ભભુક્તિ નહોતી, ત્યાં સુધી જીવ શાંતો-સ્વસ્થ-સુંદર હતો. પરંતુ જ્યાં કામ-કોધ-અભિમાન-લોભ-રાગાદિના વિકાર જાગ્યા, ત્યાં જીવની સુંદરતા ગઈ, સ્વસ્થતા ગઈ.

ત્યારે, કામના વિકારમાં જીવમાં ઠંડક શાની? ઠંડક શાંતિ તો જ્યાં સુધી મનમાં એનો વિચાર જ નથી ત્યાં સુધી જ રહે છે. બાકી, રાગથી કામનો વિચાર જાગતાં તપારો ઊભો થાય છે, ઉકળાટ જાગે છે, પછી વિકાર જાગતાં તો પૂછવાનું જ શું?

અહીં ‘કામનો રાગથી વિચાર’ એટલે કામની વસ્તુ પર મન લઈ જવું તે. દા.ત. સ્ત્રીનાં રૂપ ઉપર એના અંગોપાંગ પર કે એના કોમળ શર્દદ યા મોહક વર્તાવ કે સ્વભાવ ઉપર રાગથી મન લઈ જવાય એ મન લઈ જતાં દિલમાં જીણી પણ અણજણાઈ ઊભી થાય વિદ્ધવળતા ઊભી થાય એ કામનો વિકાર છે.

ધ્યાનમાં રાખવાનું છે કે કામનો વસ્તુનો વિચાર કેટલીક વાર રાગ વિના સહેજે થતો દેખાય, પરંતુ જીવને એનું અનંત અનંત કાળનું આકર્ષણ એવું છે કે એમાંથી રાગ જાગતાં વાર નથી લાગતી, અને એ રાગમાંથી વિકાર પ્રગતાં ય વિલંબ થતો નથી. માટે મૂળમાં એનો વિચાર જ ખોટો;

કામની વસ્તુના રૂપ જોવાની, શબ્દ સાંભળવાની કે એના સ્વભાવ વર્તાવ પર મન લઈ જવાની જિજ્ઞાસાને જ દબાવી દેવી જોઈએ. કદાચ આંખ-કાન-મન સામે એ આવી ગયા, તો તરત મનને બેંચી લઈ બીજા નવકાર વગેરે શુભ વિષયમાં લગાવી દેવું જોઈએ. ઈન્દ્રિયોના બીજા વિષયો પર મન જતાં આ જ પ્રયોગ કે મનને શુભમાં જોડી દેવું. પછી આગળ વિકારમાં પડવાની વાત નહિ.

એવી જિજ્ઞાસા વિચાર અને વિકારને રોકવા માટે ડગલે ને પગલે આ સાવધાની જોઈએ કે ‘મારે આ ઈન્ડિયવિષયની જિજ્ઞાસા આકર્ષણ જેટલી પણ ખણજ શા માટે પોષવા-કરવી ? એમ અંદરમાં એની જાગુજ્ઞાટી વિહુળળતાના વિકાર પણ શા સારુ પોષવા-કરવા ? જીવે અનંતાકાળ આ ખણજે અને વિકારો જગાવી કરીને આત્મ-બિમારી જ ઊભી કરી છે, દુઃખ જ નોતર્યા છે; આત્મ-હિત અટકાવ્યા છે. હવે બસ થયું, મારે આ મૂળમાં વિષયાકર્ષણની ખણજ જ ન જોઈએ, તેમ વિષયો પ્રત્યેની મનની વિહુળળતા જણગુજ્ઞાટીના વિકાર પણ ન જોઈએ.’

આમ એને અટકાવાય તો ઈન્ડિય-મન પર સંયમનું સૌંદર્ય અને બ્રહ્મચર્યની ટાઢક ઠંડક સુલભ બને. મૂળ મંત્ર આ, કે ‘મારે આ ખણજ વિકાર શા માટે જોઈએ ? ક્યાં સુધી હવે ખણજ જગાવ્યા-પોષ્યા કરવાની ?’

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૧૮, તા. ૭-૨-૧૯૭૦

## (૮૦) નિર્મળ દિલ માટે એક સુંદર ચાવી

માનવ જીવનની સફળતા દિલ નિર્મળ વિશુદ્ધ પવિત્ર બનાવવામાં છે. આ જીવન જીવતાં જીવતાં જો એ બનાવતા રહીએ તો જીવન જીવાનું સુંદર ફળ પાચ્યા ગણાય. એના બદલે બીજું ગમે તેટલું કરીએ, દા.ત. લાખો રૂપિયા બેગા કર્યે જઈએ, મોટી સત્તા-હક્કમત-અધિકાર અજમાવ્યે જઈએ, ખૂબ સારાં ખાનપાન-વેશ-મોજમજાહ ભોગવ્યે રાખીએ, યા મોટી તપસ્યા મોટી વિદ્વતા કે લોકો પર મોટો પ્રભાવ પાડ્યે જઈએ, પરંતુ જો દિલ મેલું-અશુદ્ધ-કાળું રાખ્યે જવાય, તો ભવની સરાસર નિષ્ફળતા છે.

દિલ મલિન રાખવામાં જીવનની નિષ્ફળતા એટલા માટે છે કે,-(૧) જીવનનું ફળ તો અહીંથી કંઈ સારું સાથે આવે એ. અહીં જે મૂકીને જ મરવાનું, એ મળે એ ફળ શાનું ? અથવા પાપકર્મો અને પાપસંસ્કારો લઈ જવા પડે એને સારું ફળ શી રીતે કહેવાય ? શાસ્ત્ર કહે છે ‘સારા ભાવથી શુભ કર્મ અને ખરાબ ભાવથી અશુભ કર્મ બંધાય છે’ દિલ મેલું એટલે અશુભભાવવાળું; એમાં તો પાપકર્મોના જ ભાર લઈ જવા પડે. સાથે એ અશુભ ભાવના પડેલા કુસંસ્કારોનો બોજ ઊંચકી જવો પડે. આમાં તો અપીલ નહિ, સારી કિયા બાજુએ રહી જાય, અને આ મેલા ભાવના કુસંસ્કાર લમણે લખાઈ સાથે આવે. મેલા દિલને સારી કિયાના પુણ્યસંચયની ભુવનભાનું એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૬૧

કોઈ શરમ ન પડે. ભવાંતરે એ પુણ્યના ઉદ્યે લક્ષ્મી આદિનો એક લોચો મળે ખરો, પરંતુ સાથે મેલા ભાવ કરતા રહેવાના. એટલે પછી લક્ષ્મી આદિ સાથે મદ, માયા ફૂરતા, લંપટતા, વગેરે પાપો ચાલુ. આ નિપાત્રવનારા અહીંના મલિન ભાવ એ ઉત્તમ માનવભવની નિષ્ફળતા છે.

(૨) વળી જીવનની સફળતા અહીં ચિત્ત શાંતિ, સ્વસ્થતા, નિર્દોષ અમર પ્રસન્નતા રહે એમાં છે. એના બદલે અશાંતિ-અંધુરો-સંતાપ-આકુળતા-વ્યાકુળતા વગેરે હોય ત્યાં જીવન સફળ શાનું ? ત્યારે મનની મદ-ઈર્ષા-તૃષ્ણાદિ મલિનતાઓ એ ચિત્તશાંતિ વગેરેને જનમવા દેતી નથી. તેથી પણ મલિન દિલમાં જીવન સફળ નથી બનતું.

(૩) વળી એ પણ હકીકિત છે કે માનવભવ એ કીડા-પશુ-પંખી વગેરેના ભવ કરતાં ઘણો ઊંચો ભવ છે; તો એની વિશેષતા કીડા-પશુ-પંખીથી કરતા મલિન ભાવો કરવામાં ન હોય. એમાં તો માનવ તરીકેના જીવનની નિષ્ફળતા જ ગણાય.

માટે માનવભવને સફળ બનાવવા નિર્મળ ભાવ નિર્મળ દિલ જ રાખવું જોઈએ; ત્યારે ઘણાની આ ફરિયાદ છે કે ધર્મ કરીએ છીએ છતાં અમારાં દિલમાં કેમ મલિન ભાવો ઊઠે છે ? દિલને નિર્મળ પવિત્ર શુદ્ધ રાખવાનો શો ઉપાય ?

એક ચાવીરૂપ ઉપાય આ છે કે વારંવાર આ વિચાર રાખવો કે ‘મારે અંતે શું થવું છે ? ભવથી મુક્ત કે ભવમાં ભટકતા ? જો ભવથી મુક્ત થવું હોય તો તે વીતરાગ બન્યા વિના નહિ થવાય; અને વીતરાગ દશા એટલે તો રાગાદિ મલિનતાઓથી રહિત સંપૂર્ણ નિર્મળ આત્મદશા. ત્યાં સહેજ પણ મલિન દિલ નહિ, લેશ પણ મલિન ભાવ નહિ. હવે જો એવી સર્વથા શુદ્ધ દશા લાવવી હોય તો એની તૈયારી અત્યારથી જ કરું. એ તૈયારી એ, કે ધીરે ધીરે દિલને નિર્મળ બનાવતો જાઉં. દીર્ઘ કાળ એવી નિર્મળતા રખાતી જશે ત્યારે એનો સરવાળો સંપૂર્ણ નિર્મળ દશારૂપ બનશે; ને જો દિલ મલિન કર્યું તો એ લક્ષ્મી આધું પડશે.’

બસ આ વિચાર જાગતો રહે એટલે જ્યાં ક્યાંય દિલ મદ-માયા, ઈર્ષા-દીનતા, લોભ-મમતા, રોષ-રીસ વગેરેથી બગડવા જાય કે તરત મનને થશે કે ‘મારે તો સમસ્ત મલિનતાઓનો અંત લાવવો છે, તો તે અત્યારથી જ મલિનતાઓ રોક્યા વિના કેમ સિદ્ધ થશે ? મદ-માયાદિ કરતા રહેવામાં તો ઊલટું મલિનતાનો દગ વધતો જાય છે. મારે હવે એ ન ખપે.’

મારે અત્યંત નિર્મળ વીતરાગ દશાએ પહોંચવું છે, માટે દિલની મલિનતા હવે જરાય નથી વધારવી; અને આ કામ-કોધ, મદ-માયા-તૃષ્ણાદિની ખણજો પોષતા

૧૬૨

ભુવનભાનું એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

રહેવાથી ક્યાં મટવાની છે ? તો હવે ક્યાં સુધી એ પોષવી ?' આ ચાવી પાસે જ રાખવાથી ઘણા ઘણા પ્રસંગોમાં નિર્મળ ભાવનાં તાળાં ખોલી શકાય છે.

દા.ત. કામવાસના ઊર્ડવા જાય છે ત્યાં આ ચાવી લગાડતાં 'અરે ? હવે પાછી આ મલિનતા વધારું ? આ ખણજ ક્યાં પોષું ?' આ વિચારથી વાસના મોળી પડે છે. એમ કોઈએ આપણું કશું પ્રતિકૂળ કર્યું કે બોલ્યો, ત્યાં ગુસ્સો આવતો રોકાશે. એમ અહંત્વ-પ્રપંચ-લાલસા-લંપટતા વગેરે પણ ઊર્ડતા દબાશે. એમ કોઈની પ્રત્યે ઈર્ધ્યા, ખાર, વિરોધ જાગતાં અટકશે. બસ, એક જ લક્ષ કે 'આ મલિનતા આ ખણજ હવે ક્યાં પોષું ?'

એ મલિનતાની અટકાયત સ્થિર ટકાવવા માટે સામે પ્રતિ-સ્પર્ધી ક્ષમા-નિરહંકાર-બ્રહ્મચર્ય સરળતા-નિર્લોભતા, મૈત્રી-કરુણા-પ્રમોદ વગેરે શુભ ભાવોનો મધમધાટ દિલમાં પ્રસરાવી દેવો અને સ્થાયી વહેતો કરી દેવો જરૂરી છે.

"દિવ્ય-દર્શન"-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૨૦, તા. ૧૪-૨-૧૯૭૦

## ૮૧ ‘સેવાધર્મ : પરમગણન :’ કેમ ?

(લેખાંક-૧)

આત્માર્થી જીવને ધર્મ ગમે છે, એટલે જ એ દેવદર્શન પ્રભુપૂજા, સાધુવંદના, સુપાત્રાદાન, જીવદ્યા, પ્રતિ નિયમ વગેરે વગેરે ધર્મ આચરે છે. એ સમજે છે કે દુઃખ જન્મ-મરણાદિ વિટંબણાભર્યા સંસારમાં આ જ સારભૂત છે, અને આનાથી જ તરવાનું છે. માટે તો 'ધર્મ કરો' એવો ઉપદેશ સાંભળતાં એના મનમાં આ ખ્યાલ આવે છે કે દેવદર્શનાદિ ધર્મ કરો. બીજાને સલાહ આપશે તો ય તે આ ધર્મો કરવાની સલાહ આપશે.

અફસોસી એટલી જ છે કે એવા પણ કેટલાય જીવને સેવાધર્મનો ખ્યાલ નથી આવતો; 'સેવા એક મહાન ધર્મ છે,' એ વસ્તુ પર નજર જ નથી જતી. કોઈ ધ્યાન ખેંચે તો ય ત્યાં એટલું જ સમજે છે કે 'જેની સેવા કરવાની હોય તેનાં બેચાર કામ કરી દેવાનાં એ જ સેવા.'

પરંતુ જો સેવા આટલી જ હોય, તો આનંદધનજી મહારાજ જે કહે છે, 'ધાર પર નાચતા દેખ બાળગરા, સેવના ધાર પર રહે ન દેવા,' એ શું ? તલવારની ધાર પર ચાલવું સહેલું; એ તો જાહુગરો ય ચાલી બતાવે કિન્તુ જિનતણી ચરણસેવા દોહિલી, કે જેની ધાર પર મોટા દેવ જેવા ય ન ટકી શકે. તો સવાલ

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૬૩

એ છે કે સેવાધર્મ આટલો કઠણ કેમ ? ને કેમ એ આત્માર્થી જીવનાં પણ ખ્યાલમાં નથી આવતો ?

આનું સમાધાન એ છે કે ગ્રલુ અને ગુરુની સેવામાં પહેલું તો એવું આત્મ-સમર્પણ કરવું પડે છે કે જેમાં એ દિલ બન્યું રહે કે આ મારે જીવનભર સેવ્ય. એમની આગળ હું અને મારો સ્વાર્થ કુછ નહિ, મારા દેવ અને મારા ગુરુ એ જ હું; અને એમની સુખ-સગવડ-શોભા એ જ મારો સ્વાર્થ.' પછી આમાં તો પોતાનો મત-ધોરણ-માન્યતાઓ ય મૂકી દેવી પડે, અને પોતાની શોભા તથા સુખ-સગવડ-અનુકૂળતાઓ દેખવાનું ય મૂકી દેવું પડે.

એક પતિભક્તા સુશીલ નારી પતિની કેવી સેવા બજાવે છે ? પતિમાં કેવું આત્મ-વિલોપન આત્મ-સમર્પણ કરે છે ? એને પતિનો મત એ જ પોતાનો મત, પતિની ગણતરી ધોરણ એ જ પોતાની ગણતરી-ધોરણ. એમ, રાત ને દિવસ એ પતિની સુખ-સગવડ-અનુકૂળતા તરફ ધ્યાન રાખે છે, પોતાની સગવડ-અનુકૂળતા તરફ નહિ. એ તો જુએ છે કે 'એ શું માને છે ? એમને શું ફાવે ? શું ભાવે ? હાલ એમને શી જરૂર છે ?' એ ખાય ખરી, પીએ ખરી, પતિ જરિયાન સાડી અને હીરાનો હાર લાવી આપે તો પહેરે ય ખરી, પરંતુ બધું જ પતિની સુખ-સગવડ-સન્માન સાચવવાના પેટામાં, રાખીને કરે છે. મુખ્ય તો એને એક જ પતિભક્તિ પતિની સર્વાંગીણ આરાધના હોય છે, હરતી ને ફરતી એ જ વિચાર્યા કરે છે. એમની સુખ સગવડ શોભામાં જ પોતાનો સ્વાર્થ જુએ છે.

બસ, દેવ-ગુરુની સેવા એટલે આ કરવાનું છે; ત્યાં બધી જ આપમતિ 'ગુરુ આમ કહે છે, પરંતુ મને આમ લાગે છે,' વગેરે સ્વકલ્પના હેઠી મૂકાઈ જાય. એમ જાતની સગવડ અનુકૂળતાને આગળ કરવાનું પડતું મૂકાય. દેવગુરુનો મત અને એમની સુખ-સગવડ-શોભા જ આગળ કરે, મુખ્ય કરે, રાત દિવસ અનું જ ધ્યાન રાખ્યા કરે. પોતે ખાય-પીએ વગેરેમાં ય ધ્યાન તો દેવ-ગુરુની સુખ-સગવડનું જ રાખે. ગુરુની જ શોભા-કીર્તિ વધારવાનું લક્ષ રાખે.

આવા સેવાધર્મ કઠણ છે. કેમ કે (૧) એમાં અનાદિસિદ્ધ, અહંત્વ અને જાતની સુખતૃષ્ણા છોડવી પડે છે, ને એ જ મહાકઠિન છે; વળી (૨) આત્માર્થી જીવને ય એમ લાગે છે કે 'હું તપ કરું તો પાપ તૂટે પુણ્ય મળે; શાસ્ત્રભણું તો વિદ્ધતા મળે; દેવદર્શનાદિ કરું તો પુણ્ય વધે, દાનથી ય પુણ્ય મળે, શીલ-પ્રતિ-નિયમથી પણ કર્મનિર્જરા થાય. પરંતુ સેવામાં લાગ્યા રહેવાથી આપણું શું સધે ?' આમ લાગવાથી ય સેવાધર્મ આવવો કઠિન બને છે. પછી 'સેવાધર્મ: પરમગણન: યોગિનામખ્યગ્રભ્ય:' સાધુને પણ ખ્યાલમાં ક્યાંથી આવે ?

૧૬૪

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

ગ્યા લેખમાં એ જોયું કે આત્માર્થી જીવને દેવદર્શન-પૂજન દાન-શીલ-તપ વગેરે ધર્મ ગમે છે ને એ આચરે છે, પરંતુ સેવાધર્મ પર એનું આકર્ષણ થતું નથી; કેમ કે એમાં તો જેમ એક સુશીલ પતિત્રતા નારી પોતાના પતિની સેવા ઉદાવવામાં પોતાની જાત અને સ્વાર્થ સુખ-સગવડ ભૂલી પતિમાં પોતાનું આત્મવિલોપન કરે, એમ જાતનું અહંત્વ જાતની માન્યતા અને જાતનાં સ્વાર્થ-સુખ-સગવડ ભૂલી સેવ્ય દેવ-ગુરુ આદિમાં આત્મવિલોપન-આત્મસર્પણ કરવા પડે છે; અને તે પોતાને પોખાતું નથી. ‘સેવ્ય તો ગમે તે માને અને કહે પરંતુ મને જે લાગે છે તે બરાબર છે,’-એવું અહંત્વ છોડી શકતું નથી; તેમજ દેવદર્શનાદિ ગુરુવંદનાદિ તથા દાન-શીલ-તપથી પુણ્ય મળે, જ્ઞાનાર્જનથી વિદ્વત્તા વધે, પરંતુ સેવામાં લાગ્યા રહેવાથી શું સધે ?’ એમ એને લાગે છે.

એટલે ખરી વાત આ છે કે ‘જીવનમાં કોઈ સેવ્ય છે, અને સેવ્યની ઉપાસના સેવ્યમાં એકાકાર થઈને તથા સાંગોપાંગ બજ્ઞાવવી જોઈએ,’ એ વસ્તુ દિલમાં જયતી નથી. પછી સેવાધર્મ પરમ ગહન પરમ ગહન કેમ ન બને ?

તો શું જીવનમાં કોઈ એવા સેવ્ય રાખવાની જરૂર છે ? હા, દુનિયામાં જોઈએ તો દેખાય છે કે જો બાળક માતાને સેવ્ય માને છે, પત્ની પતિને અને પતિ શેઠને સેવ્ય માને છે તો એ બધાનાં જીવન વ્યવસ્થિત નિશ્ચિન્ત અને સેવ્યની સાથે સલાહ સંપીભર્ય ચાલે છે. ત્યારે આત્મહિતની સાધનામાં જો એવી સેવ્યની આરાધના-ઉપાસના ન હોય તો ધર્મજીવન ક્યાંથી વ્યવસ્થિત નિશ્ચિન્ત, અને સેવ્યની સાથે સલાહ-સંપીભર્ય ચાલે ?

સેવને ભૂલવામાં, સેવ્યમાં સ્વાત્માને એકાકાર કરીને સેવ્યની સાંગોપાંગ સેવા ચૂકવામાં અહંત્વ અને સ્વાર્થવૃત્તિ તથા હરામહાડકાના મહાદોષ જે અનાદિથી ચાલ્યા આવે છે એ એમ જ ઊભા રહે છે. પછી એ ભગવાનની અને ગુરુની અમુક આજ્ઞાઓ પાણી આવશે તો ય અહંત્વ ઊભું રહેશે; એમની સેવાનાં બે-ચાર કામ કરી આવશે તો ય ‘એમાં પોતાને કશું મળે છે ? એવો સ્વાર્થનો જ ખ્યાલ રાખીને કરી આવશે એટલે ભગવાન અને ગુરુ મારું કંઈક કરે,’ એ જ લેશ્યા રહે છે, પણ ‘હું નિઃસ્વાર્થભાવે ભગવાનનું કંઈક કરું ગુરુનું કંઈક કરું’ એવો ખ્યાલ નથી આવતો. એને કોણ કહે કે ‘અલ્યા ! ભગવાને અને ગુરુએ તો તારું ધાણું કર્યું છે.

કેઠ એકેન્દ્રિયપણામાંથી ઉંચકાઈ આટલો ઉંચો માનવ અવતાર અને બીજી અનેક જાતની પુણ્યાઈ પાખ્યો તેમજ ધર્મની સમજથી માર્ગને આટઆટલી સાધના પાખ્યો, એ બધું દેવ-ગુરુના ગ્રભાવે છે. એટલે એમણે આ બધું તારું ક્યાં ઓછું કર્યું છે ? તે હજુ પણ ભિભારી ! મને આપો, મને આપો, મારું કરો ? મારું કરો.’ એમ રહ્યા કરે છે ? ‘એમણે તો મારું ધાણું કર્યું, હવે એમનું હું કરું. સુશીલ નારી પતિમાં મળી જાય એમ હું દેવ-ગુરુમાં મળી જાઉ અને એમને જ સેવ્ય બનાવી એમની સેવા સાંગોપાંગ કરું,’ આવું મનમાં કેમ નથી આવતું ?

એક ગરીબની પતિત્રતા પત્નીને પતિ તરફથી માત્ર સાદું ભોજન અને અલ્ય સાદાં જ કપડાં મળે છે; છતાં એ બીજી કોઈ આશા-અપેક્ષા વિના પતિને અનન્ય સેવ્ય માને છે, અને એની સાંગોપાંગ સેવામાં લયલીન રહે છે તો શું એ મનથી દુઃખી છે ? અને એકલા ઉંચાં સુખ-સ્વાર્થ જ દેખનારી પતિથી બેપરવા સ્ત્રી મનથી સુખી છે ?

શું એક ગરીબની સ્ત્રીને પણ પતિ સેવ્ય હોય અને એક ભક્તને દેવ-ગુરુ એવા સેવ્ય ન હોય ? જો નહિ હોય, તો અહંત્વ કેટલું પોખાવાનું ? સ્વાર્થિંતા કેવી રમાયા કરવાની ? હાડકાં કેવા હરામ રહેવાના ? પછી નિરભિમાનતા, પરમાર્થ અને આખાં પરગજુ હાડકાં ક્યારે આવવાનાં ?

અહંત્વ-મમત્વ તો સંસારની જડ છે; એથી સંસાર વધે છે. એ તોઝ્યા વિના સંસાર ક્યાંથી હટવાનો ? અને સેવાધર્મ વિના એ જડ શી રીતે ઘટ્ટી આવે ? ‘મારે આ સેવ્ય છે; હવે આમની મતિ, આમનો મત, આમનાં ધોરણ, એ જ મારી મતિ, મારો મત, મારાં ધોરણ,’ એમ સ્વીકારે તો અહંત્વ તૂટું આવે; તેમજ એમની સાંગોપાંગ નિષ્કામ સેવા ઉદાવવામાં લાગી પડે તો મમતા-તૃષ્ણા-રાગાદિ તૂટતા આવે. સારાંશ, ‘દેવગુરુની સેવાની મજૂરીમાં મને શું મળે ?’ એ ભાવ ભૂલવાનો છે, અને ‘એ સેવા જ આ ઉચ્ચ જીવનની લ્હાણ છે, ઉપકારીની કૃતજ્ઞતા છે,’ એ ભાવ લાવવાનો છે. સેવાધર્મ પરમ ગહન છે, પણ જેણે નક્કી કર્યું, ‘મારે અનાદિના જટિલ દોષરૂપ આપમતિ, સ્વાર્થિંતા અને હરામ-હાડકાને તોડવા છે, એ તોડીને આ ઉચ્ચ જીવનને સાચું સફળ કરવું છે,’ એને માટે સેવાધર્મ સરળ છે.

## (૧૩) દિલ ઉમદા રાખવા ચાર પ્રશ્ન : (૧) આપણું અનુકૂળ શું ? (લેખાંક-૧)

જગતની વચ્ચે રહેતાં બીજાઓ સાથેના વ્યવહારમાં આવવું પડે છે. એમાં આપણી સામે બીજાઓ માયા રમતા, કે મદ કરતા, યા ગુસ્સો વગેરે બતાવતા દેખાય છે. ત્યાં ‘થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ’ એ સૂત્ર અપનાવી આપણે પણ સામે માયા-મદ-ગુસ્સો વગેરે કરવા જઈએ હીએ. પરંતુ એમ કરવામાં દુર્જનની સામે દુર્જનતા કરી સજજનતા ગુમાવવાનું થાય છે, દિલ ઉમદાને બદલે કુદ્ર કરાય છે, એ કેટલું વ્યાજભી છે, એને અંગે આ ચાર પ્રશ્ન વિચારણીય છે,-

(૧) જીવનમાં આપણને બધું અનુકૂળ રહ્યું, ને પ્રતિકૂળ કાંઈ ન આવ્યું, શું એથી ઉચ્ચ માનવભવની સફળતા છે ? કે સજજનતા ઉત્તમતા કેળવી જઈએ તો માનવભવની સફળતા છે ?

(૨) શું સામો કે આપણે માયા-મદ-ગુસ્સો કરીએ એથી ફાવટ જ આવી જાય, ને સામો એ કરે એથી એ ફાવી જઈ આપણું બગડી જ જાય એ નક્કી છે ? યા આપણે એ કરીએ એથી આપણે ફાવી જ જઈ એનું બગડી જ જાય ?

(૩) જેવાની સામે તેવા જ થવાનું હોય તો જગતમાં સજજનતા ઉત્તમતાનો પ્રવાહ કોણ અખંડ ચાલુ રાખશે ? શું આપણા માથે એ કર્તવ્ય નથી ?

(૪) જગતમાં ચંદન સોનું વગેરે જડ પદાર્થો પણ ભારે આપત્તિમાં ય પોતાનો ઉચ્ચ સ્વભાવ છોડતા નથી, તો ઉત્તમતા અંકાય છે. ત્યારે ચેતન આપણે ઉમદા સ્વભાવ છોડાએ એમાં ઉત્તમતા રહે ? ને એમાં શોભા છે ?

કેમ આ ચાર પ્રશ્ન નજીર સામે રાખવાથી દિલ ઉમદા રહી શકે એ જોઈએ.

(૧) કોઈએ આપણા પર ગુસ્સો કર્યો કે આપણી સામે રોફ માર્યો એમાં આપણને આપણું અપમાન થયું લાગે છે, યા સામાની શિરજોરી દબામણી લાગી. આપણી પરવશતા થઈ દેખાય છે. એટલે આપણે એ હટાવવા સામા પ્રત્યે ગુસ્સો અભિમાન બતાવીએ હીએ, યા દિલમાં ઊંખ રાખી, કોક બીજો જ દાવ અજમાવીએ હીએ. એમ સામો માયા રમતો આવે તો એની સામે માયા ખેલવાનું યા એને ખુલ્લો પાડી ધમધમાવવાનું કે એની હલકાઈ નિદા કરવાનું કરીએ હીએ. એમ ઈર્ઝા કરનારની સામે ઈર્ઝા, મશકરી સામે મશકરી અથવા ગુસ્સો, અને દિલમાં શલ્ય-સ્થાપન કરવાનું બને છે. પરંતુ આ બધે એ જોવાનું છે કે જીવનની સફળતા-

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૬૭

સાર્થકતા શું આ અધમ ભાવો કરવાથી છે ? કે એના બદલે ક્ષમા-સમતા-સહિષ્ણુતા ને દયા તથા ઉપકાર બુદ્ધિ કેળવવાથી છે ?

ભૂલવા જેવું નથી કે જીવન જીવતાં લક્ષ્ય નીચું બાંધવાથી પછી જીવન માનવનું નહિ પણ પશુનું જીવાય છે. લક્ષ્ય નીચું આ કે ‘બીજાની સામે ફાવે તેટલો ગુસ્સો-રોફ-માયા કરીને કેમ આપણું ઊંચું રાખવું, સામાને દબાવવા, અને આપણો સ્વાર્થ કેમ સાધી લેવો, કેમ આપણો સારામાં ખપવું, ને માન મેળવી લેવું,’-આટલું જ જોયા કરાય.

જીવન જીવીને જો આ જ ખાટી જવાનું હોય, જો આપણી શિરજોરી અને સામાની પરવશતા, તથા આપણાને સ્વાર્થ, માન કે યશની સિદ્ધિ જ કમાઈ જવાની હોય, તો એ તો પશુને ય આવે છે. એક કૂતુરું ય બીજા કૂતરા સામે ભસતાં શિરજોરી રાખવા અને સામાને દબાવવા મથે છે. એ ય ટૂકડો રોટલો અને સારું સ્થાન તથા માન યશ મેળવવા તત્પર હોય છે. માનવ તરીકે જન્મીને ઊંચી બુદ્ધિ મેળવવા પર શું આપણે આ જ કરવાનું હોય ? જો આ જ લક્ષ્ય હોય તો એમાં તો જીવન પશુજીવનની હરોળમાં રહેવાનું. માનવબુદ્ધિ તો વિશિષ્ટ છે; એનાથી કોક વિશિષ્ટ લક્ષ્ય બંધાય, કિન્તુ આવા અધમ નીચા લક્ષ્ય ન બંધાય. એ બાંધવામાં આપણાને સરવાળે યા છેવટે જીવનના અંતે એ બધું ખોવાઈ જવાનું રહે છે.

ટૂકડા જીવનને અંતે ખોવાઈ જવાની વસ્તુ જ ટૂકડા-શા વિશિષ્ટ જીવનમાં સાધવા મથાય, એ તો નરી મૂર્ખતા છે. એમ એ સાધવામાં પછી ગુસ્સો રોફ પ્રપંચ ઈર્ઝા વગેરે અધમ ભાવો ભરાય એમાં પણ બુદ્ધિહીનતા છે; પશુબુદ્ધિનું કાર્ય છે, માનવબુદ્ધિ તરીકેનું કશું સારું સર્જન નથી. પશુને ય સુલભ એવાં અધમ લક્ષ્ય અને અધમ ભાવ કરવા જતાં માનવજીવન સફળ નથી થતું, સાર્થક નથી બનતું. ઉત્તમ માનવબુદ્ધિ છતાં એ લક્ષ્ય સાધવામાં અને એ અધમભાવો કર્યે જવામાં તો એના ઘેરા સંસ્કાર જોરદાર જામે છે અને પછીના ભવોમાં એનાં ફળ ગુણાકારથી આવે છે. એથી જ દેખાય છે કે એવું જીવન જીવીને અહીંથી મરી પશુ કે કીડા-કીડીના અવતારમાં ગયેલા જીવો રાત દિવસ એવા તુચ્છ સ્વાર્થ સાધવામાં અને એ માટે એવા અધમ ભાવ કેળવતા રહે છે. દા.ત. અહીં તો અમુક જ સમય ખાવા-ભોગવવાની લેશ્યા, અને ત્યાં સમયના માપ વિના જ એવી લેશ્યા !

માટે માનવ-જીવનની સાર્થકતા ઊંચા લક્ષ્ય રાખવામાં અને ઉમદાભાવ કેળવવામાં છે. જેથી આપણે માનેલું તુચ્છ અનુકૂળ જ બની આવવામાં ને પ્રતિકૂળ ન જ બનવામાં મન ન રહ્યા કરે.

(૧) ઊંચા લક્ષ્ય તરીકે શું સાધવું ? સારાં ખાનપાન અને સારા વિષયો-

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

માન સંમાન-અહંત્વ સાધવાના નહિ, પરંતુ ત્યાગ-તપસ્યા સંયમ તત્ત્વજ્ઞાન-તત્ત્વભાવના અને દેવગુરુ ભક્તિ તથા પરોપકાર-પરહિતકરણ સાધી જવા જોઈએ.

(૨) એમ ઉમદા ભાવ તરીકે કોધ-માન-માયા-લોભ કર્યે જવાના નહિ, પણ ક્ષમા સમતા-સહિષ્ણુતા, નમૃતા-નિર્લોભતા, દયા અને કૃતજ્ઞતા-પરોપકાર બુદ્ધિ કેળવ્યે જવી જોઈએ. જીવનની સફળતા જો આ ઊંચા લક્ષ્ય અને ઉમદા ભાવ રાખવામાં મનાય તો સહેજે અધમ ભાવ બંધ કરી દિલ ઉમદા બનાવાય. આપણું અનુકૂળ આ જ.,-ઊંચા લક્ષ્યની સિદ્ધ અને ઉમદા ભાવ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૨૩, તા. ૭-૩-૧૯૭૦

## ૮૪ (લેખાંક-૨)

ગયા લેખમાં એ જોયું કે જગતની વચ્ચે રહેતાં કેટલાયના પ્રસંગમાં આવવું પડે છે, કે ત્યાં દિલ રોષ-રોઝ-પ્રપંચ-ઈઞ્ચ વગેરેથી અધમ બનતું અટકાવવા ચાર પ્રશ્નમાં પહેલો પ્રશ્ન નજર સામે આ રાખ્યા કરવાનો કે ‘શું અનુકૂળ તરીકે તુચ્છ લક્ષ્ય અને તુચ્છ ભાવો રાખવા એ છે?’ હવે બીજો પ્રશ્ન આ રાખવાનો છે કે ‘શું અધમ ભાવ કરવામાં ફાવટ જ આવી જાય છે?’

ટૂંકી બુદ્ધિએ જોતાં એમ લાગે છે કે જો સામો આપણા પર ગુસ્સો રોઝ કે પ્રપંચ કરે તો અને ફાવટ આવી જાય, અને આપણે જો એ ગુસ્સો વગેરે કરીએ તો આપણને ફાવટ આવે.

પરંતુ આ ખોટી ગણતરી છે. દુનિયામાં જોઈએ તો દેખાશે કે ઘણા ય જીવો રોષ-રોઝ-પ્રપંચ કરવા છતાં ફાવતા નથી, એમનું અનુકૂળ સિદ્ધ નથી થતું. આજના જુલ્દુમ અને લાંઘખાઉ તથા તફંડચિયા સરકારી તંત્ર સામે જનતાનો રોષ કેટલો બધો રહે છે? છતાં જનતાને ક્યાં ફાવત મળે છે? એમ કેટલાય અભિમાની (૧) શેઠિયાનાં અભિમાન ઓફિસરોની સામે કશી ફાવટ લાવતા નથી; (૨) નોકરોનાં અભિમાન શેઠિયાની સામે ફાવટ નથી અપાવતાં. (૩) કેટલાય પતિ કે પત્નીઓના અભિમાન નિષ્ફળ નીવડે છે. એમ, દાવ-પેચ માયાપ્રપંચ પણ કરેલા કેટલાયને માથે પડે છે. સારાંશ, રોષ-રોઝ-માયાથી ફાવટ આવે એ ગણતરી ખોટી છે.

દુનિયાની વાત-વસ્તુમાં ફાવટ અનુકૂળતા આવવાનો આધાર પોતાના પૂર્વ પુણ્યની સબળતા ઉપર છે. પુણ્ય જો બળવાન, તો ઊંધું કરવા જતાં ય સીધું ઊતરે, ગુસ્સો કરે, અભિમાન કરે, માયા-પ્રપંચ કરે અને એથી ફાવટ આવતી દેખાય. પણ એ ફાવટ ખરી રીતે તો પુણ્ય બળવાન હોય ત્યાં સુધી જ. બાકી તો

પુણ્ય નબળું પડતાં ફાવટ કશી નહિ, અને પેલો ગુસ્સો, અભિમાન, પ્રપંચ પોતાના કપાળે લાગે. રાવણનું પુણ્ય ખૂટતાં અભિમાને એને લક્ષ્મણના હાથે મોત અપાવ્યું. રાવણ ચોથી નરકમાં જઈ પડ્યો. એમ અભિમાન એવું કપાળે લાગ્યું કે મોત અને નરક આવી મળ્યા. એવું લોભમાં ય બને છે. સુભૂમની પાસે ચકવતીપણાંની સામગ્રી-સજાવટ હતી, એથી જ આ જંબૂદ્ધીપણા ભરતક્ષેત્રના છ ખંડ એણે જીત્યા હતા. પરંતુ લોભમથી હવે ધાતકીખંડના ભરતના છ ખંડ જીતવા ચાલ્યો, ત્યાં માનેલી અનુકૂળતા સિદ્ધ ન થઈ અને લોભ કપાળે લાગ્યો, જે વિમાનમાં લ્હાવ-લશ્કર લઈને જતો હતો એ વિમાનને ખભેથી ઉચ્કનાર સોળહજાર યક્ષોએ એકી સાથે ખભા જેંચી લીધા, ને બધું સમદ્રના તળળિયે ગયું, સુભૂમ ત્યાં ડૂબી મરીને સાતમી નરકે ગયો.

(૧) બસ, આ જોવાનું છે કે ‘શું દુર્જનતાની દુર્જનતાની સામે આપણે સજજનતા ગુમાવીએ તેથી ફાવટ જ આવે છે? અનુકૂળ જ સિદ્ધ થાય છે? ના, એથી કાંઈ નહિ; એ તો પુણ્ય પહોંચે તો જ બની આવે. બાકી ગુમાવેલી સજજનતા માથે પડે.’

(૨) બીજું પૂર્વ વિચાર્યુ એ જોવાનું કે ‘જીવનમાં ફાવટ અને અનુકૂળ કોને કહેવાય? બહારનું બધું મનગમતું બની આવે એ છે? ‘ના, ખરી ફાવટ ખરી અનુકૂળતા તો અંતરાત્માના રાગ-દ્વેષાદિ કષાય મોળા પડી વૈરાગ્ય-ઉપશમ-ક્ષમાદિ ભાવો સિદ્ધ થતા આવે એ છે; તેમજ અનાદિની ભૂખારવી અને વિષયગૂદ્ધ ઈન્દ્રિયો પર સંયમ-અંકુશ સિદ્ધ થતો આવે, ને એથી ઈન્દ્રિયોની ભૂખ-ગૂદ્ધ ઓછી થતી આવે, એ ખરેખરી ફાવટ છે, સાચી અનુકૂળતા છે, એવું ઉમદા દિલ બનતું આવે એ જ ખરી ફાવટ અને એમાં જ જીવનની સફળતા છે.

(૩) ત્રીજ વાત આ, કે પૂર્વ પુરુષો સજજનતાને જીવતા આવ્યા અને આપણા સુધી એ આદર્શ પહોંચાડ્યો એ આપણા ઉપર મહાન ઉપકાર છે. એની કૃતજ્ઞતા બજાવી ઉપકારનો બદલો વાળવાનું પણ આમાં છે કે આપણે સજજનતાને જીવી બતાવીએ. એથી જ આગળ નવી પ્રજામાં એ જોઈને સજજનતા જીવવાનું થશે, એથી એનો પોતાનો ઉપકાર થશે અને સજજનતાનો માર્ગ આગળ ચાલુ રહેશે. આમ કૃતજ્ઞતાપાલન, નવી પ્રજા પર ઉપકાર અને ભવિષ્યમાં સજજનતાનો અખંડ પ્રવાહ વહેતો રાખવો, એ આપણું પરમ કર્તવ્ય છે.

(૪) વળી ચોથી વાત આ, કે જડ જેવા વૃક્ષ ચંદ્ર નદી વગેરે પોતાના ઉમદા કાર્ય ઉમદા સ્વભાવ ન છોડે એમાં એની શોભા છે, એમ ચેતન આપણે દુર્જનતાની દુર્જનતાની સામે પણ આપણો સજજન-સ્વભાવ અને સજજનતાના ઉમદા

કાર્ય ન છોડીએ એમાં આપણી શોભા છે. એમાં જ જીવનની સફળતા છે.

સારાંશ, (૧) બહારની ફાવટ પુષ્ય પર આધારિત છે; (૨) ખરી ફાવટ અંદરમાં સજજનતા અંડ રહે એ છે; (૩) એ જ જીવનકર્તવ્ય છે અને (૪) ચંદનાદિના દિલ્લાન્તે સજજનતાનો સ્વભાવ અંડ જળવાય એમાં જ શોભા છે;- આ ચાર વસ્તુ બરાબર હૈયામાં કોતરાઈ જાય, અને સતત નજર સામે રહ્યા કરે, તો સ્વભાવ ટિલ ઉમદા બન્યું રાખવાનું અને ઉમદા જ વિચાર-વાણી-વર્તાવ કેળવ્યે જવાનું સરળ છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૨૫, તા. ૨૧-૩-૧૯૭૦

## (૮૫) શુદ્ધ અવસ્થા શુભ અવસ્થાની પ્રવૃત્તિથી આવે

જગતમાં વસ્તુના બે પ્રકારનાં સ્વરૂપ હોય છે. દા.ત. પુરુષાલો અશુચિ પણ હોય છે, શુચિ પણ હોય છે, રત્નાદિ શુચિ-પવિત્ર છે, વિજાહિ અશુચિ-અપવિત્ર હોય છે. આકાશ પણ એ અશુચિનું અવગાહનાનું હોય છે, તેમ શુચિ પુરુષાલોનું પણ અવગાહક છે. પાયખાનાનું સ્થાન અર્થત્તુ આકાશભાગ, ભલે એ ઘસી એસિડપાણીથી તદ્દન સાફ ચોખ્યું કરી નખાયું, ઇતાં હજ જ્યાં સુધી પાયખાના માટેનું સ્થાન છે ત્યાં સુધી એ, અશુચિ જ ગણવામાં આવે છે. ત્યાં કાંઈ ભાષું માંડીને જમવા બેસાનું નથી. આ ‘સ્થાન’ એટલે આકાશભાગ એમાં ય બે પ્રકાર.

એવી રીતે સંસારી આત્મા અંગે પણ બે ભેદ પડે છે, કેટલાક ચોર-લુંટારા-વેશ્યા-ખૂની વગેરેના ધંધા કરનારા એ ખરાબ ગણવાય છે, ત્યારે દયાળું-દાની-સત્યવાદી સંતમહાત્મા વગેરે સારા ગણવાય છે. એમ એનો એ જ આત્મા કોધમાં-મદમાં ધમધમતો હોય કે માયા-દ્રોહમાં રમતો હોય ત્યારે પિશાચ-વરુ જેવો ભયાનક લાગે છે, અને એ જ જ્યારે એવો મટી દયાળું-ક્ષમાશીલ-સહિષ્ણુ-ભદ્રક-દાનશીલ-સંયમી-તપસ્વી વગેરે હોય ત્યારે સુંદર દેખાય છે.

જીવની આ બે જાતની અવસ્થા છબસ્થ સંસારીપણામાં હોય છે. પછી જ્યારે એ વીતરાગ બને છે, ત્યારે એ રાગ-દ્વેષ, કોધાહિ કરાવનારાં કર્મથી સર્વથા રહિત હોઈ એમને એ મલિન ભાવો નથી હોતા. તેમ એનાં કર્મને દબાવનારી વૈરાગ્ય-દયા-તપસ્યા-ક્ષમાહિ સાધના પણ એમને ચાહીને કરવાની નથી હોતી; કેમ કે એનાં કર્મને એવી એવી સાધનાથી એમણે હવે સર્વથા નષ્ટ કરી દીધાં છે. હવે

તો એ જગતના પદાર્થ-પ્રસંગો પ્રત્યે સર્વથા અલિપ્ત અનાસકત-ઉદાસીન-વીતરાગ બનેલા છે. તો શું એ ક્ષમાહિ સાધના ન કરે તો કોધ વગેરે કરે? ના, કોધ આહિનાં કર્મ જ એમને નથી તેથી કોધાહિ થાય જ નહિ. તેમ એવાં કર્મ અને એના ઉદ્ય જ નહિ તેથી એને દબાવવા ક્ષમાહિ કરવાના ય ન હોય. એ તો તદ્દન શુદ્ધ સ્ફટિકવત્તુ વીતરાગ ભાવમાં જ હોય. પછી ભલે ત્યાં લેશમાત્ર પણ કોધાહિ નહિ તેથી એને સહજ સિદ્ધ ક્ષમાહિ કહીએ; બાકી વીતરાગને એ ચાહીને કરવાના ન હોય. ક્ષમાહિ ધર્મ ચાહીને કરવાના તેમને કે જેમને હજ કોધાહિ કર્મ મોજુદ છે, અને એ પોતાનો ઉદ્ય દેખાડી જીવને કોધી વગેરે બનાવવાની શક્યતા છે.

આ સૂચવે છે કે વીતરાગ બનતા પહેલાં જીવમાં જે બે જાતની અવસ્થા,-કોધી-ક્ષમાશીલ, અભિમાની-નમ્ર, ખાવકલી-તપસ્વી, કૃપણ-દાનવીર, રાગાંધ-વિરાગી, ખૂની-અહિસંક વગેરે, -દ્વિવિધ અવસ્થા હોઈ શકે છે, એમાં કોધ-માન આહારલુભ્યતા કૃપણતા વિષયાંધતા વગેરે અવસ્થા તો કોધાહિ મોહનીયકર્મને છૂટો દોર આપવાથી થાય છે, ત્યારે ક્ષમાહિ અવસ્થા એ કર્મને તત્ત્વવિચારણાદિ દ્વારા દબાવતા રહેવાથી યાને એના ઉદ્યને નિષ્ફળ કરતા રહેવાથી બને છે. દા.ત. મિલિટરી પોલિસ લઈને ફરનારો માણસ ડાકૂના દાવને નિષ્ફળ કરે છે. ફલુની હવા વખતે આહાર-વિહારમાં નિયમિત-સંયમી-નિગ્રહી એ હવાને નિષ્ફળ કરે છે. એમ ક્ષમાહિની વિવિધ સાધનાથી કોધાહિ-કર્મ નિષ્ફળ જાય છે. તે જેમ પેલો ડાકૂ કે પેલી હવા નષ્ટ થઈ ગયે પછી માર કે રોગનો સંભવ નહિ, એમ અહીં ક્ષમાહિ સાધનાઓ સાધતાં, પેલાં કર્મ સર્વથા નષ્ટ થઈ ગયે પછી ભય નહિ, કોધાહિનું નામ નહિ. ત્યાં સર્વથા વીતરાગદશા આવીને ઊભી રહી પછી પેલી સાધના કરવાની રહે નહિ.

આ ઉપરથી એ ફલિત થાય છે કે વીતરાગભાવ નથી આવ્યો ત્યાં સુધી કોધાહિની મલિન અવસ્થાને ક્ષમાહિની સાધના દ્વારા દબાવતા જ રહેવું પડે, નામરોષ કરતાં રહેવું પડે. જ્યાં સુધી એનાં કર્મ સર્વથા નષ્ટ નથી થયા ત્યાં સુધી એને પગભર ન થવા દેવા માટે, એના ઉદ્યને નિષ્ફળ કરવા માટે સાધના અખંડ ચાલુ રાખવી પડે. ભરોસે ન બેસી રહેવાય કે ‘પ્રવૃત્તિ ભલે ગમે તે ચાલુ હોય, કર્મ ભોગવાઈને ખલાસ થઈ ગયે વીતરાગ બની જવાશે.’ કેમ કે કોધાહિની યા રસદાર નિરૂક્ષા ખાનપાનાદિની કે મનોહર રૂપસ્પર્શ આદિ વિષયોના ભોગવટાની પ્રવૃત્તિથી તો નવા લોટબંધ કોધાહિકર્મ ઊભાં થઈ જાય છે, જેના ભોગવાઈને નિકાલ માટે જન્મો જોઈએ, અને એ વખતે પાછી એવી પ્રવૃત્તિથી વળી નવા પારાવાર કર્મજીથા ઊભા થઈ ગયા હોય છે એમ એનો કદી અંત ન આવે.

એ તો કોધાદિ કરાવનારાં કર્મને ક્ષમાદિની સાધનાપ્રવૃત્તિ દ્વારા નિષ્ફળ જ કરતા ચાલવું પડે. ‘ખાઉં-ખાઉં’ની લત કરાવનાર કર્મને ત્યાગ-તપસ્યાની સાધના દ્વારા દબાવવા જ પડે. વિષયસંજ્ઞા કરાવનારાં કર્મને જિનભક્તિ-દાન-સાધુસેવા-પ્રતનિયમ-સામાયિક વગેરેની પ્રવૃત્તિ દ્વારા નિષ્ફળ કરતા જ રહેવું પડે. એમ કરતાં કરતાં કર્મની આવક ઘટે, નિકાલ વધે, ને અંતે મોહનીયનાં સર્વકર્મ ક્ષય થઈ વીતરાગ થવાય.

એટલે હવે નિશ્ચયધર્મની બોગસ વાતો કરીને એ ત્યાગ-તપ-જિનભક્તિ-દાન-પ્રતનિયમાદિના વ્યવહારધર્મને ઉડાવનાર કેટલા ખોટા છે એ સમજ શકાય એવું છે. ‘કાયા, વાણી અને ઈન્દ્રિયોથી પ્રવૃત્તિ ગમે તે ચાલુ હોય, એની કોઈ અસર આત્મા પર કે એ કર્મના ઉદ્ય પર નથી, અસર તો માત્ર અંતરાત્માની ભાવની છે; માટે ભાવ શુદ્ધ રાખો,’ આવો ઉપદેશ, આત્મા અને કર્મનાં વિજ્ઞાનને તદ્દન નહિ સમજવાથી થતો હોઈ, પાપઉપદેશ છે. શુદ્ધ વીતરાગ અવસ્થા આવતા પહેલાં કર્મજન્ય અશુભ અવસ્થાને રોકવા માટે ક્ષમાદિ શુભ અવસ્થાની પ્રવૃત્તિ કરતાં જ રહેવું પડે. શુભથી શુદ્ધ આવે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૨૬, તા. ૨૮-૩-૧૯૭૦

## ૮૬ અતિજીવી દિલ્લિની નિર્મિતા અને શાસ્ત્રશ્વાણ

આત્માની શુદ્ધિ કરવા માટે પહેલી જરૂર દિલ્લિના સંશોધનની છે. એટલા માટે જ જૈનશાસન મોક્ષમાર્ગનો પ્રારંભ સમ્યગ્દર્શનથી બતાવે છે. ‘સમ્યગ્દર્શનન્દીનાન્યાન્યાની મોક્ષમાર્ગઃ’ એ શ્રી તત્ત્વાર્થાધિગમ મહાશાસ્ત્રનું પહેલું સૂત્ર છે; અને એમાં જ સમ્યગ્દર્શનને તત્ત્વાર્થશ્રદ્ધાન-સ્વરૂપ કહું છે. તત્ત્વની યથાર્થ શ્રદ્ધા થાય એ સમ્યગ્દર્શન.

જીવન અનેક પ્રસંગો અને ઘટનાઓ પર પસાર થાય છે. વળી એમાં અનેક પદાર્થના સંપર્ક અને અનેક કાયિક-વાચિક-માનસિક પ્રવૃત્તિઓ બનતી રહે છે; આ બધામાં સમ્યગ્દર્શન જાગતું રાખવાનું છે, એટલે યથાર્થ તત્ત્વશ્રદ્ધા તત્ત્વદિલ્લિ જીવંત-જાગ્રત રાખવાની છે. માત્ર કોઈ ધાર્મિક પ્રવૃત્તિ વખતે કે મંદિર ઉપાશ્રયાદિ ધાર્મિક સ્થાનમાં જ સમ્યગ્દર્શન જાળવવાનું યાને તત્ત્વદિલ્લિ ઊભી રાખવાની અને બાકીના સ્થળો કે સમયે એ નહિ, એવું નથી; સમ્યગ્દર્શન તો આત્મા સાથે ચોવીસે કલાક વણવાનો ગુણ છે.

ભુવનભાનુ એન્સાઈસ્ટ્રીક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૭૩

સમ્યગ્દર્શનને જીવન સાથે વણી લેવા માટે કહો, કે જીવન જીવતાં દિલ્લિ સર્વત્ર સાફ-સ્વચ્છ રાખવા માટે કહો, તત્ત્વપરિણાતિ એ અમોઘ ઉપાય કેળવવાની જરૂર છે. સર્વજ્ઞ ભગવાને જીવ અજીવ વગેરે તત્ત્વને જેવાં સ્વરૂપે ઓળખાવ્યા છે, એ સ્વરૂપોનું દિલ્લિમાં ઉંઠું ઘડતર કર્યે જવાની જરૂર છે. દા.ત. સર્વજ્ઞપ્રભુએ જીવ-અજીવને જ્ઞેય સ્વરૂપવાળા કણાં, તો આપણી દિલ્લિમાં એ તત્ત્વો પ્રત્યે એ સ્વરૂપ ઘડાતું યાને ઓતપ્રોત બનતું રહેવું જોઈએ. પછી જ્યાં આપણા સ્વાર્થના પૂરક સેહીઓ પ્રત્યે રાગ અને સ્વાર્થની આડે આવનારા પ્રત્યે દ્રેષ જાગવા જાય ત્યાં અંતરમાં એ દિલ્લિ જાગ્રત હોય કે આ બંને ય માત્ર જ્ઞેય છે, પણ રાગ કે દ્રેષનાં પાત્ર નહિ, એમના પર કશો રાગ કે દ્રેષ કરવા જેવો નહિ. હું રાગ-દ્રેષમાં તણાઉં છું એ મારી મૂર્ખતા છે; એમાં અનાર્થ મનુષ્યની જ રીતભાત આચરાય છે. એમાં ભવનાં ફેરા વધે છે, ને માનવજન્મ એળે જાય છે.’ આ અંતરદિલ્લિ જાગતી હોય તો બાધ્ય જડ-ચેતન પર રાગ-દ્રેષમાં તીવ્રતા ન આવે. એમ પાપ-આશ્રવ-બંધ તત્ત્વને હેય (ત્યાજ્ય) સ્વરૂપવાળા અને પુણ્ય-સંવર-નિર્જરો-મોક્ષ તત્ત્વને ઉપાદેય (ગ્રાધ્ય) સ્વરૂપવાળાં તરીકે દિલ્લિમાં ખૂબ ઓતપ્રોત કર્યો હોય, તો પછી હેયમાં પ્રવૃત્તિ કંપવાળી ભયવાળી બને; અને ઉપાદેય તરફ ભારે આકર્ષણ-પ્રેમ-અભિલાષા બની રહે.

જીવનમાં ખાન-પાનના, બોલવા-ચાલવાના, ધંધા વેપારના, કમાવા-ખોવાના, બીજાઓ સાથેના વ્યવહારના અને જોવા-સાંભળવા વગેરેના અનેક પ્રસંગ બને છે. આ દરેક પ્રસંગમાં આંતર દિલ્લિ તે તે તત્ત્વનાં સ્વરૂપને અનુરૂપ રહેવી જોઈએ; (૧) જીવ કે અજીવની વાત આવી તો એનાં જ્ઞેય સ્વરૂપને અનુસારે ઉદાસીન ભાવના, લક્ષવાળી દિલ્લિ જોઈએ. તેથી મનને એમ થાય કે આમાં રાજ્ઞિ-નારાજ થવા જેવું કાંઈ નથી.’ એમ સમજ રાગ-દ્રેષને નિરથક ગણે. એમ (૨) પૈસા ટકા, ઈન્દ્રિયવિષયો આરંભસમારંભ જૂઠ અનીતિ વગેરે આશ્રવ પ્રત્યે હેયદિલ્લિ રહે, તેથી એમાં કંપ ભય અરુચિ અનુભવે એમ, (૩) દાનાદિ ધર્મ જિનભક્તિ, સાધુસેવા શ્રાવકના આચાર-વિચાર, સાધ્ર્મિક પ્રેમ વાતસંલય અને ક્ષમાદિ ગુણો તરફ સદા ઉપાદેયદિલ્લિ આકર્ષણ, અભિલાષા જાગતી રહે.

આની વારંવાર ભાવના કરતા રહીને આંતર દિલ્લિમાં આ બધું એવું વણી લેવું જોઈએ કે જીવનના પ્રસંગ પર એની છાયા પડે; આત્મા જાગતો રહે; એને બરાબર ઝાલમાં હોય કે ‘કર્તવ્ય શું છે અને હું શું કરી રહ્યો છું?’ ઊલટ વર્તાવ તરફ નફરત જલાનિ રહે; ને કરણીય વર્તાવમાં ભારે આનંદ હોય, આને નિર્મળ દિલ્લિ કહેવાય.

૧૭૪

ભુવનભાનુ એન્સાઈસ્ટ્રીક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

દેખ્યિની નિર્મળતા એ પાયાનો વિકાસ છે, મૂળભૂત ઉત્થાન છે, અને એ સર્વજ્ઞનાં વચન પરની અથાગ શ્રદ્ધાથી અને સર્વજ્ઞોકૃત તત્ત્વના શ્રદ્ધામય બોધથી બની આવે છે. માટે રોકિંદા જીવનમાં સર્વજ્ઞ-વચન યાને જિનવાણીનું શ્રવણ-વાંચન મુખ્યપણે રહેવું જોઈએ જેથી તત્ત્વબોધ તત્ત્વપરિણિતિ વધતા રહે, અને એથી દેખ્યું ને વધુ નિર્મળ થતી ચાલે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૨૭, તા. ૪-૪-૧૯૭૦

## (૮૭) જિનવચનની વિશેષતાઓ કઈ ? કયા જ્ઞાન-વીર્ય-સુખથી અનંત જ્ઞાન-વીર્ય-સુખ ?

સંસાર-પરિભ્રમણથી થાકેલા અને જલદી મોક્ષ પામવાની ઈચ્છાવાળા ભવ્યાત્માને એકમાત્ર સહારો છે શ્રી જિનવચનનો. કેમ કે વીતરાગ અને સર્વ પ્રત્યક્ષદ્રષ્ટા સર્વ શ્રી જિનેશ્વર ભગવંતનાં વચન (૧) યથાર્થ તત્ત્વનિરૂપણ કરે છે, (૨) વાસ્તવિક વિશ્વ-સંચાલનની સ્થિતિ બતાવે છે, તથા (૩) સચોટ મોક્ષમાર્ગનું ઉત્સર્જ-અપવાદ સાથે પ્રતિપાદન કરે છે. જિનવચન-જિનાજ્ઞા ત્રિકાલ-સત્ય છે; (૪) એકેન્દ્રિય સૂક્ષ્મ જીવો સુધીનો વિસ્તૃત ઘ્યાલ એ આપે છે; (૫) જ્ઞાનાવરણીયાદિ ૮ કર્મનો વિસ્તાર, (૬) એના બંધ-ઉદ્ય-સંક્રમણ વગેરે, તથા (૭) ૧૪ ગુણસ્થાનકનું વિશેષ સ્વરૂપ એ બતાવે છે; (૮) નયવાદ-અનેકાંતવાદ-સત્પ ભંગી-નિક્ષેપ આદિ એની અનન્ય બેટ છે. (૯) ચૌદ રાજલોકનું વિસ્તૃત યથાર્થ સ્વરૂપ. (૧૦) વિરતિ માર્ગ, (૧૧) બ્રહ્મયર્થની નવ વાડ, વગેરે વગેરેનું નિરૂપણ જિનવચનની અનન્ય વિશેષતાઓ છે. તેથી એના જ આધારે મોક્ષ થાય.

તાત્પર્ય, તાત્ત્વિક, ધાર્મિક અને આધ્યાત્મિક દેખ્યિએ જિનવચનની અનેરી વિશેષતાઓ છે.

આનો મહાન ઉપયોગ આત્માનો મોક્ષ સિદ્ધ કરવામાં છે; અને એ આ રીતે શક્ય છે, કે જીવને મોક્ષમાં જે અનંત જ્ઞાન, અનંત વીર્ય અને અનંત સુખ પ્રગટ રહે છે, એ એનો સહજ સ્વભાવ જ છે, ને તે જીવ પરનાં કર્માવરણ દૂર થયેથી પ્રગટ થાય છે. એ પ્રગટ કરાવવાની તાકાત જિનવચનમાં એટલા માટે છે કે

જિનવચનના જ્ઞાનથી અનંતજ્ઞાન પ્રગટે, જિનવચનના પાલનના જ વીર્યથી અનંત વીર્ય પ્રગટે. તથા જિનવચનના પાલનમાં જ સુખ માનવાથી અનંતું સુખ પ્રગટ થાય.

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૭૫

જ્ઞાનથી જ્ઞાન, વીર્યથી વીર્ય, ને સુખથી સુખ-પરંતુ તે જિનવચનના જ્ઞાન-વીર્ય-સુખથી જ. આનું કારણ એ છે કે

(૧) જિનવચનનું જેમ જેમ જ્ઞાન વધારતા જવાય, તેમ તેમ જીવાદિ યથાર્થ તત્ત્વ, સમ્યગ્ મોક્ષમાર્ગ, વાસ્તવિક સિદ્ધાંતો, અને સમ્યગ્ હેય-ઉપાદેયની બૃદ્ધિ અધિકાધિક ખૂલતી જાય છે. એથી સમ્યગ્જ્ઞાનના સંસ્કારોની વૃદ્ધિ થતી આવે; તેથી સરવાળે અનંત જ્ઞાન પ્રગટ થાય એ સહજ છે; કેમ કે, એથી મોહનીય કર્મ અને જ્ઞાનાવરણકર્મ તૂટતા આવે એટલે એના સર્વનાશના અંતે અનંત જ્ઞાન પ્રગટ થાય એ સ્વાભાવિક છે.

(૨) ત્યારે, જિનાજ્ઞાના પાલનમાં વીર્ય ફોરવાથી અનંત વીર્ય પ્રગટ થાય એ પણ સહજ છે; કેમ કે આત્માનું અનંતું વીર્ય વીર્યાત્રાય-કર્મથી દબાયું છે, અને એ વીર્યાત્રાય-કર્મ અસદ્ વીર્યપ્રયોગથી ઊભા થયેલા છે. હવે જો સદ્ વીર્ય-પ્રયોગ થાય તો તે કર્મ તૂટે એ સહજ છે. જિનવચન સદ્ વીર્યપ્રયોગના માર્ગ બતાવે છે. અસત્થી નિવૃત્તિ અને સત્તમાં પ્રવૃત્તિના યથાર્થ પ્રકાર જગતમાં જિનવચન જ બતાવે છે. એવાં જિનવચનના પાલનમાં ફોરવેલું વીર્ય કમશા: વીર્યાત્રાયને તોડતું આવે એ યુક્તિયુક્ત છે.

વળી શુદ્ધ આશયથી જિનવચનના પાલનમાં પ્રયત્ન કરવા દ્વારા ‘ઉદ્યોગ રસ વધારે’ એ ન્યાયે જિનાજ્ઞાપાલનનો રસ વધે છે; તેથી અધિકાધિક વીર્ય એમાં ફોરવાતું જાય છે, તો એ અંતે અનંત વીર્ય પ્રગટ કરે એમાં નવાઈ નથી. દેખાય છે કે શ્રાવક ગ્રસ જીવોની દિલથી દયા અને સ્થાવર-જીવહિસામાં યતના-જ્યણાશક્ય રક્ષણબૃદ્ધિ જાળવવામાં પ્રયત્નશીલ રહેવાથી આગળ વધતાં એનામાં સર્વ જીવોની અહિસાનું વીર્ય પ્રગટ થાય છે. એ સૂચવે છે કે જિનાજ્ઞાપાલનના વીર્ય પ્રયોગથી વિશેષ વીર્ય સ્કૂરે, અને એથી અંતે અનંત વીર્ય પ્રગટ થાય.

(૩) જિનાજ્ઞાપાલનમાં સુખ માનવાથી અનંત સુખ પ્રગટ થાય એનું કારણ એ છે કે સંસારના દુઃખ જિનાજ્ઞાથી વિરુદ્ધ જઈને વિષયસુખ-આહારસુખ-આરામી પ્રમોદસુખ તથા કષાયસુખ માનવાથી ઊભા થયેલા છે. હવે જો જિનાજ્ઞાપાલનમાં સુખ માનવાનું ઊભું કરાય, તો જિનાજ્ઞા તો વિષયત્યાગ આહારસંયમ, કષાયનિગ્રહ, ક્ષમાદિ ધર્મ અને આવશ્યક-પ્રતિલેખના (પદિલેહણા) સ્વાધ્યાયાદિ તથા પરિસહિતસહનમાં જ પ્રવર્તતવાનું કરે છે; એટલે એ જ આનંદ પૂર્વક કરવું જોઈએ. એથી અશાતાવેદનીય કર્મ ભારે તૂટતા આવે, અને શાતાવેદનીય પણ અંતે આયુષ્યસમાપ્તિએ ખત્મ થઈ જાય; તેથી અચ્યાબાધ અનંત સુખ પ્રગટે એ સહજ છે. વળી આ જિનાજ્ઞાઓ પાળવામાં સુખ માનવાથી ભાન્ત સુખોમાં સુખની કલ્પના

૧૭૬

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

નાટ થઈ જતાં અંતે અભ્રાન્ત સાચું આત્મસુખ અનંતુ પ્રગટ થાય એ સહજ છે.

આમ, જિનવચનના જ્ઞાનથી અનંત જ્ઞાન, એનાં પાલનના વીર્યથી અનંતવીર્ય, અને એ પાલનમાં સુખ અનુભવવાથી અનંત સુખ પ્રગટ થાય છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૮-૧૮, અંક-૨૮, તા. ૧૧-૪-૧૯૭૦

## ૬૬ ધર્મચૈતન્ય કેમ વિકસે ?

આજની ધાંધલિયા જીવન-પદ્ધતિમાં ભૌતિક બાબતો મુખ્ય બની ગઈ છે અને ધર્મને જીવનમાં ગૌણ સ્થાન અપાય છે. ધર્મ આત્મા પણ પોતાના જીવનમાં તપાસે કે ‘મારા જીવનમાં ધર્મ મુખ્ય છે ? કે સાંસારિક બાબતો ?’ તો ઘણે ભાગે ધર્મની ગૌણતા દેખાશે. ત્યારે જેના જીવનમાં ધર્મ નથી એને તો આ તપાસવાનું ય શું હોય ? પરંતુ એથી કાંઈ એ સાચું સુખ કે શાંતિ અનુભવી શકતો નથી. કેમ કે ધર્મની બેપરવાઈએ જીવનમાં દ્ધર્મ-અનિષ્ટ વિષયોની ચિંતા અને કોધાદિ કષાયોનો ઉકળાટ ચાટ્યા જ કરે છે. ત્યાં શાંતિ ક્યાંથી હોય ? એવું ભૌતિક બાબતોને મુખ્ય કરનાર ધર્મ જીવને પણ અનુભવાય છે. એટલે જીવનમાં સાચી શાંતિ અને ઉન્નતિ તો જ આવે કે જીવનમાં ધર્મને મુખ્ય કરાય, ધર્મચૈતન્ય વિકસાવાય, વધારાય.

ધર્મ કેટલા પ્રમાણમાં કરાય છે, એના કરતાં ધર્મચૈતન્ય કેટલું જાગું રખાય છે અને વિકસ્વર કરાય છે એના પર શાંતિ-ઉન્નતિનો આધાર છે. એ ચૈતન્ય જાગું-વિકસતું કરવા માટે જીવનમાં નવો નવો સંવેગ જગાવતા રહેવાની જરૂર છે.

‘સંવેગ’ એટલે મોક્ષનો રંગ અને મોક્ષ માટે ધર્મનો રંગ, પરમાત્મ મીતિ, સાધુભક્તિ, સત્સંગ, જીવદ્યા, વ્રત-નિયમ, દાનાદિ, અહિસાદિ, સર્વજ્ઞાસ્ત્રશ્રવણ વગેરે વગેરેનો દિલમાં રંગ ઉછળે એનું નામ સંવેગ. એ વધતો ચાલે તેમ તેમ ધર્મચૈતન્ય વિશેષ વિશેષ વિકસ્વરપણે ધબકતું રહે. પોતાની ચેતનામાં ધર્મનો વધતો મધ્યમાટ અનુભવાય.

એ વધતો સંવેગ યાને ધર્મરંગ એક એવી ચીજ છે કે જેવી રીતે એના એ સૂર્યને હજારોવાર જોયો છતાં નવી સવારે એને જોતાં જુદો જ ચમકારો અનુભવાય છે, એમ દેવદર્શનાદિ આરાધના એની એ છતાં પ્રતિદિન ધર્મરંગનો જુદો જ ચમકારો અનુભવમાં આવે.

સંવેગની વૃદ્ધિ માટે આ ઉપાયો છે,

(૧) નવું નવું કિયારહસ્ય જોતા રહેવાનું. (૨) પર પદાર્થ-તરફ દસ્તિ ને આકર્ષણ ઘટાડતા રહેવું, ને એથી વિમુખતા વધતી રાખવી. (૩) નવું નવું સમ્યગ્જ્ઞાનાદિ પ્રાપ્ત કરતા રહેવું. (૪) દ્ધર્મ-અનિષ્ટ પ્રતેના રાગ-દ્વેષ ઘટતા આવે એમ કરવું. (૫) સમ્યગ્દર્શનના આઠ આચાર અધિકાધિક સેવવા. (૬) દેવદર્શનાદિ તથા વ્રત-નિયમ-અનુષ્ઠાન આરાધવાના તે શાસ્ત્ર કહે છે માટે, કે પુણ્ય મળે માટે એમ નહિ, પરંતુ જીવનમાં આ જ કરવા યોગ્ય કરણી છે એમ સહજરૂપે આરાધવા, અને એનું મમત્વ વધારતા જવા પ્રયત્ન કરવો. (૭) સંસાર સમગ્રને પર ધર રૂપે યાને દુષ્મનના ધર તરીકે જોવામાં વેગ વધારવો, યાને સંસારવાસ તરફ નફરત વધારવી.

આ પ્રયત્નોમાં પ્રમાદ ન આવે એ માટે આ વિચારવું કે,-

(૧) ‘અરે ! શાસન મળ્યા પછી ય હજ મારા હૃદયમાં મોહનું ઘેરું અંધારું છે ? (૨) મને કેવી ઉત્તમોત્તમ મોક્ષમાર્ગની સગવડ મળી છે ? (૩) એ મળ્યા પછી મેં એની કદર કેટલી વધારી ? તેમજ (૪) રાગાદિ કષાયો કેટકેટલા ઓછા કર્યો ? તથા (૫) ધર્મ કેટલો વધાર્યો ? શરીરશક્તિ વધારવા, પૈસા વધારવા, માનસસ્ન્માન વધારવા, સતત ધગશ અને કાળજી રહે, તો ધર્મ વધારવા નહિ ? શું મારે થોડા ધર્મમાં સંતોષ માની બેસવાનું ? (૬) હું મોક્ષ ક્યારે પામીશ ? (૭) અહીંની એકેક આહારાદિ-સંજ્ઞાપ્રવૃત્તિ તથા રાગાદિલાગણી એના સંસ્કાર વધાર્યે જાય છે; એ પછી કયા ભવમાં ઓછા કરી શકીશ ?... આમ વિચાર્યા કરવાથી પ્રમાદ ઓછો થશે, સંવેગના ઉપાયો સેવતા રહેવાશે, ને તેથી ધર્મમાં નવું જોમ, નવો નવો સંવેગ અનુભવાશે.

આ બંને જાતના મુદ્દાઓ માત્ર નામથી કહ્યા છે; પરંતુ એ દરેક પર વિસ્તારથી વિચારવા જેવું છે; જેથી એના પ્રયત્નોમાં દિલ સદા ઉજમાળ રહે. એવા પ્રયત્નથી સંવેગ વધતો આવે છે ધર્મચૈતન્ય ખીલતું રહે છે. રોજિંદા સાંસારિક જીવનમાં શું, કે સાધુજીવનમાં શું, ધર્મકિયાઓ તો અમુક જ કરાતી હોય છે, પરંતુ એમાં ને એમાં ધર્મચૈતન્ય વધતું કરી શકાય છે.

એથી જે લોકો એમ કહે છે, કે ‘અમો આટલો ધર્મ તો કરીએ જ છીએ. હવે વિશેષ શું થઈ શકે ?’ એમને ખબર નથી કે વિશેષ તો, ઉપર કહ્યું તેમ, તે તે ઉપાયો આદરી સંવેગ અને ધર્મચૈતન્ય વધારતા જવાનું છે. વીતરાગ ન બનીએ ત્યાં સુધી એ ઉપાયોમાં લાગ્યા રહેવાનું છે; ને એ કાર્ય કાંઈ ઓછું નથી. ધર્મ જીવોએ આ ખાસ ધ્યાનમાં રાખી આગળ વધવાનું છે, જેથી ધર્મચૈતન્ય વધ્યે પાપ ઓછા થતા આવે; જીવન અધિકાધિક નિષ્યાપ પવિત્ર બનતું રહે.

## ૮૮ પ્રતિકૂળ વેઠવાં એ પણ એક અનિવાર્ય સાધના

તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ થયે તીર્થકર નામકર્મનું પુણ્ય ઉદ્યમાં આવે છે, અને સાથે અછ પ્રાતિહાર્યની શોભાની જેમ પ્રભુને છાએ ઋતુની અનુકૂળતા થાય છે. તેથી શું શિયાળાની કડકડતી ઠંડી, કે શું ઉનાળાની ધમધોખ ગરમી, એ એમને પીડવાની નહિ. જગતને એ પ્રતિકૂળ બને, પરંતુ ભગવાનને નહિ. પ્રભુનો એ અતિશય છે.

અહીં સવાલ થાય કે એ અતિશય પ્રભુને કેવળજ્ઞાન પછી કેમ ? દીક્ષા પછી કેમ નહિ ?

આનો ચાલુ જવાબ તો એ દેવાય કે તીર્થકર નામકર્મની સાથે જ એવા શાતા વેદનીય આદિ કર્મ ઉદ્યમાં આવતા હોવાથી એ સહેજે તીર્થકર બન્યા પછી છાએ ઋતુ અનુકૂળ વગેરે વિશેષતા બતાવે.

આમ છતાં જોવાની ખૂબી એ છે કે એમ તો તીર્થકર નામકર્મ ઉદ્યમાં આવતા પહેલાં જનમથી ઉત્કૃષ્ટ સુંદર રૂપ, સુગંધિત શાસોચ્છવાસ, સર્કેદ લોહી, અદ્ય આહાર-નિહારકિયા વગેરે હોય છે, તેમ દીક્ષા બાદ નખ કેશ વધે નહિ એવો અતિશય હોય છે; પણ ત્યાં છ ઋતુ અનુકૂળ નહિ.

કુદરતનો કહો કે કર્મનો, આ કેવો હિસાબ છે કે સાધનાકાળમાં એ નહિ, તેથી ત્યાં પ્રતિકૂળ કડકડતી ઠંડી ય લાગે, ને ધમધોખ ગરમી ય લાગે. ત્યારે સાધનાકાળ પૂર્ણ થયે સિદ્ધ યાને વીતરાગ સર્વજ્ઞ તીર્થકર બન્યા પછી એ નહિ. ત્યાં પછી ઋતુઓ અનુકૂળ વર્તે.

આ સૂચવે છે કે કુદરત જાણે તીર્થકર દેવને કહી રહી છે કે “તમારે સાધના કરવી છે ? અને ઘાતીકર્મ ખપાવવા છે ? તો ભારે પ્રતિકૂળ સહો; સારી રીતે સમતા-સમાધિભાવથી નિર્બિપ ચિંતે સહન કરો, તો જ તમારાં ઘાતી કર્મ નાશ પામી જઈ તમે વીતરાગ સર્વજ્ઞ બની શકશો. અને એ બન્યા પછી તમને પ્રતિકૂળ ઋતુ નહિ નહે, કોઈ ઉપસર્જ-ઉપદ્રવ પણ નહિ નહે.

વીતરાગ સર્વજ્ઞ તીર્થકર બન્યા પછી કદાચ પ્રતિકૂળતા નડતી હોય તો એ એમને ક્યાં રાગ-દેખ હર્ષ-બેદ થવાના છે ? પરંતુ ના, હવે એ તીર્થકરપણાનો પ્રભાવ પડે છે કે પ્રતિકૂળતા નહિ કિન્તુ એ વીતરાગતાદિ સિદ્ધ કરવા માટે તો

પહેલાં ભારે પણ પ્રતિકૂળતા નહે, અને તે સારી રીતે સહન કરવી જ પડે. કોને ? તીર્થકરને પણ.

આ ઉપરથી આપણે બોધપાઠ લેવાનો છે કે જેમ પાલિસ-માલિસથી નહિ કિન્તુ અભિમાં જીકાઈને સોનું શુદ્ધ થાય છે, એમ આત્મા અનુકૂળ અનુકૂળ ભોગવીને નહિ, કિન્તુ પ્રતિકૂળ સારી રીતે વેઠીને શુદ્ધ થાય છે. ઋતુઓની કુદરત જો તીર્થકરદેવ જેવા ઉત્કૃષ્ટ માતબર પુણ્યવાળા અને સુરેન્દ્ર-નરેન્દ્ર-પૂજય પુરુષની પ્રત્યે એવા વલશવાળી છે કે બીજી સાધનાઓની સાથે પ્રતિકૂળ વેઠવાની ય સાધના કર્યે જાઓ અને સિદ્ધ થાઓ, વીતરાગ સર્વજ્ઞ બનો, પછી જીવશો ત્યાં સુધી હું સર્વ વાતે અનુકૂળ રહીશ,’ તો પછી આપણા જેવા મુફ્લીસ પુણ્યવાળા જીવ માટે કુદરતનું જૂદું વલશ હોય ?

બસ, સંસારભ્રમશથી કંટાળો આવ્યો છે ? ‘આ વારે વારે જનમવું-મરવું શું ? કર્મની ભારે પરાધીનતા વેઠ અને વિટંબાણ શી ?’ એવો બેદ કંટાળો ગ્લાનિ થાય છે ? અને એથી છૂટવાની ને મોક્ષ પામવાની તાલાવેલી-તમન્ના-તત્પરતા છે ? તો સમ્યગદર્શન દેવ-ગુરુભક્તિ, જ્ઞાનધ્યાન, વ્રતનિયમ-તત્પરસ્યા વગેરેની સાધનાની જેમ ભૂખ-તરસ, ટાઢ-તાપ, આકોશ-અપમાન, જરૂરી વસ્તુની અછત-અવળાઈ વગેરે પ્રતિકૂળ વેઠવાનીય સાધના જોરદાર કરવી જોઈએ. ‘વેઠવાની એટલે સારી રીતે પ્રસન્નતાથી સહન કરવાની’ પણ એક સાધના, એમાં લેશ પણ અરુચિ નહિ, બેદ નહિ, દ્વેષ ગ્લાનિ નહિ. ‘હાય ! આ કેટલું અને ક્યાં સુધી સહન કરવાનું ?’ એવું લેશમાત્ર મનને લાવવાનું નહિ. ‘અરે ! હવે આ ક્યારે મટે ? જલદી મટે તો સારું’ એવું જરા પણ જંખવાનું નહિ બલ્કે આનંદ માનવાનો કે ‘હાશ ! ચાલો આમાં કર્મક્ષય થતો આવે છે, બહુ સરસ ! પરીસહ-ઉપસર્જની પીડાઓ તો કર્મગૂમડાના નસ્તરની પીડા છે; એ તો વધાવી લેવાની જ હોય; કેમ કે તો જ કર્મગૂમડાં નષ્ટ થઈ જાય.’

આમ ભૂખ-તરસ, ટાઢ-તાપ, અપમાન-અનાદર વગેરે પ્રતિકૂળ બાબત સહષ્ર વેઠવી એ પણ એક મહાન સાધના છે, જેથી કર્મગૂમડાં કપાતા આવવાનો અનન્ય લાભ મળે છે, અને સિદ્ધ તરફ પ્રયાણ ચાલુ રહે છે. તીર્થકરદેવો માટે પણ એ જ કાયદો, તો આપણા માટે પણ એ જ હોય. સતત એમને નજર સામે રાખ્યાથી આ સરળ બને.

## (૬) પરચિતા અધમાધમ કેમ ?

ઉત્તમા સ્વાત્મચિન્તા સ્યાત્ કામચિન્તા તુ મધ્યમા ।  
અધમા ત્વર્થચિન્તા સ્યાત્ પરચિન્તાઽધમાધમા ॥

મહર્ષિએ કહ્યું કે ‘સ્વાત્માની ચિંતા ઉત્તમ કોટિની છે. તો વિષયસુખની ચિંતા મધ્યમ છે. ત્યારે પૈસા ટકાની ચિંતા અધમ છે. (પણ) પરચિતા અધમાધમ છે.’

આનું કારણ એ છે કે સ્વાત્માની ચિંતા રાખવાથી (૧) પરલોક ન બગડે, (૨) જરૂરી પણ પાપ તીવ્ર ભાવે નિષ્ઠુરપણે ન સેવાઈ જાય, અને (૩) આત્મહિતકારી દેવ-ગુરુ-ધર્મ ન ભૂલાય, એની કાળજી રહે છે. એથી જીવ આ લોક પરલોકમાં સુખી થાય છે. એવું બીજી ચિંતાથી નથી બનતું, માટે આત્મચિત્તા ઉત્તમ છે.

વિષયચિત્તા અને અર્થચિત્તા એના કરતાં નીચી કોટિની છે, પરંતુ એ બંનેમાં પરસ્પર તુલના કરતાં દેખાય છે કે અર્થચિત્તા એ વિષયચિત્તા કરતાં વધારે ખરાબ છે. કારણ, એમાં મનના પરિણામ જે કૂર નિષ્ઠુર બને છે, કાળી લેશ્યા અને તામસભાવ જે આવે છે, એવા વિષયચિત્તામાં નહિ. વિષયચિત્તામાં તો સારા સારા વિષયોનાં સુખ ભોગવું એ લાલસા રહે છે. અલબત્ત એમાં આત્માનું ભાન નથી, તેથી એ ઉત્તમ તો નથી; કિન્તુ અર્થચિત્તા કરતાં મધ્યમ છે. ત્યારે અર્થચિત્તા અધમ છે. એમાં કેદી દાવપેચ-ગ્રંચના ભાવ, મહા આરંભ સમારંભના ભાવ, મહાતૃષ્ણાના ભાવ વગેરે અધમ ભાવો સ્કુરે છે. ‘એ બધું કરીને પૈસા લાવું, પૈસા બચાવું, પૈસા સંધરી સુરક્ષિત રાખું,’ આ વૃત્તિ રહે છે. માટે આ અર્થચિત્તા અધમ ચિંતા છે.

પરંતુ પરચિતા એથી ય નાપાક નપાવટ છે. ‘પરચિતા’ એટલે (૧) પરની ફજુલ વિચારણા, (૨) પરના દોષ જોવાની દસ્તિ, (૩) પરની ઈર્ઘાદિની વિચારણા.

(૧) દા.ત. ‘છગનભાઈ કેમ મોડા ઉઠે છે?... છોકરી મોટી થઈ તોય કેમ એને દેતા નથી?... ફલાણો દુકાન ક્યારે ખોલશે? મોટા રાવસાહેબ છે બાપના પૈસા તાગડિના કરે છે... મોરારજી, બિચારા ઉત્તરી ગયા... વગેરે વગેરે ચિંતા ફજુલ છે. પોતાને લેવાએવા નથી, પોતાને કાંઈ મળવાનું નથી. કેવળ નવરું મન આહંકદોહંક વિચાર્ય કરે એટલું જ. એ નિષ્ફળ પરચિતા છે. એ અધમાધમ છે.

(૨) એમ, પરના દોષની દસ્તિ એ પણ પરચિતા છે. એમાં વળી પરની હલકાઈની ખણખોટ છે. દા.ત. ‘લલ્લુભાઈનો સ્વભાવ તીખો. જરાકમાં ભડભી ઉઠે... શકરીબેન બહુ બોલકણા, ઘણી બોલ્યા વિના જપે નહિ, ઉઠ્યા ત્યારથી વાજું ચાલુ... ભાઈનો રોફ બહુ... મહારાજ આમ તપસ્વી, પણ કોધી છે...’ બસ, આનો ને તેનો એક યા બીજો દોષ જોયા કરે, ગાયા કરે, એ પણ અધમાધમ પરચિતા છે.

ત્રણેય જાતની પરચિતા અધમાધમ; કેમકે (૧) વિષયચિત્તા-અર્થચિત્તામાં તો કંઈક સ્વાર્થ સરે છે, આમાં કશું સરવાનું નહિ. ઉલદું ચિત્ત ખોટા સંતાપ-અજંપા-ઉકળાટથી પકડાયેલું રહે છે. પરની પીડા મફતની પોતાના ઘેર લાવે એવી ચિંતા અધમાધમ નહિ તો બીજું શું? છગનભાઈએ છોકરી મોટી થઈ છતાં ન પરણાવી, મણિભાઈ ટાઈમ થયો છતાં હજુ શાક લેવા નથી નીકલ્યા;... વગેરે વગેરે ચિંતામાં ફોગટ પરપીડા પોતાના શાંત મગજમાં ઘાલવાનું થાય છે; એમ ‘ફલાણો સારું કમાયો... પેલાને કન્યા સારી મળી;... સૌરાષ્ટ્રનો વિદ્યાર્થી પહેલો નંબર લાવ્યો. માળા કાઠિયાવાડી બહુ જબરા...’ આ ચિંતા વિચારણા પણ ફજુલ. બંને પ્રકારની ચિત્તામાં વગર જોઈતા રાગ-દ્રેષ્ણનાં ઝેર પીવાનું થાય છે.

(૨) ત્યારે પરદોષ દસ્તિની ચિત્તામાં પરદોષો મનમાં ઘાલવાથી દિલને દ્રેષ્ય થયા કરે છે. સામાનો ગુણ જોવાતો નથી. આવી દસ્તિની આદત પડી ગયાથી, જેમ ગીધડાં ગંધાતું માંસ કે વિજા ક્યાં પડેલી છે એ જ તાકયા કરે, એમ બીજામાં નરસું શું છે, એ ક્યાં બૂલે છે, એવું હલકું જ જોયા કરાય છે, ઉત્તમ માનવમન આ ગંદવાડ-કચરાપડી ફેંદ્યા કરે એ કેવું અધમાધમ! જેવા વિચાર તેવું મન; કાળા વિચારથી મન કાજું અને ઊજણા વિચારથી ઊજજવલ.

(૩) એમ, પરની ઈર્ઘાથી થતી વિચારણારૂપી પરચિતામાં વળતું કાંઈ નથી. સામો એના પુણ્યથી સારું પામે છે, કે સ્વપરાકમથી ગુણમાં ધર્મમાં આગળ વધે છે. ત્યાં ઈર્ઘાથી પ્રમોદભાવના ગુમાવાય છે, ફોગટ બળવાનું થાય છે, અને એની ચિંતા કર્યા કરવામાં દ્રેષ્ય સંખગતો રહે છે. પોતાને ખાવાનું-લેવાનું પોતાના ભાગ્ય મુજબ જ, પણ આ પરચિતાથી નાહક સંગ્રહ્યા કરવાનું થાય. પોતાના મનનધરને પોતે જ આગ લગાવે છે.

બધી ય પરચિતામાં પરોવાયા રહેવાથી સ્વાત્મચિત્તા ભૂલાય છે, પરમાત્મચિત્તન વિસરાય છે, તત્ત્વચિત્તન ગુમાવાય છે. વિષયચિત્તા-અર્થચિત્તામાં ય એ ગુમાવવાનું ભૂલાવાનું થાય છે, પરંતુ તે કામચલાઉ; જ્યારે અહીં પરચિતામાં તો આદત જ પડી ગઈ એટલે સતત ચાલ્યા કરે છે. માટે એ અધમાધમ છે.

વળી વિષય-અર્થચિત્તમાં તો હજુ ય મનને એમ લાગે કે આ ખોદું થઈ રહ્યું છે; ત્યારે આમાં તો એ લાગતું જ નથી, એટલે કદાચ સમ્યક્તવ પણ ગુમાવવાનું થાય. માટે પણ પરચિતા અધમાધમ છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૧, તા. ૨-૫-૧૯૭૦

## ૬૧ ક્ષમા-બ્રહ્મચર્ય આદિની બે સુંદર ચાવી

(લેખાંક-૧)

સમરાદિત્ય રાજકુમારને પિતાએ પરાણે પરણાવેલી બે રાજકન્યા પરણીને આ કુમારની પહેલી મુલાકાત પામે છે, ત્યારે ત્યાં એની સખી કુમારને પાનનું બીંદું આપતાં કહે છે, ‘ત્યો કુમારસાહેબ ! આ મારી સખીઓએ આપના ઉપરના અથગ પ્રેમથી તૈયાર કરેલું આ પાનનું બીંદું સ્વીકારી એને ધન્ય કરો.’

કુમાર ત્યાં અવસર જોઈ પૂછે છે, ‘શું તમારી સખીઓને મારા પર પ્રેમ છે?’

સખીઓ કહે ‘અરે કુમારસાહેબ ! પ્રેમનું શું પૂછો છો ? જ્યારથી આપના અદ્ભુત ગુણોનું વર્ણન સાંભળ્યું છે ત્યારથી અમારી સખીઓ આપના નામ પાછળ ઝૂરી રહી છે !’

ત્યારે કુમાર એમ કહે છે, ‘તો પછી તમારી સખીઓને એટલું પૂછી જુઓ કે જે વ્યક્તિ પર પ્રેમ હોય, તે વ્યક્તિની પાસે શું એવું કરાવાય કે જેથી એનું નિકંદન નીકળે ?’ કહેવાનું તાત્પર્ય આ છે કે નવી પત્નીઓને કુમાર ઉપર પ્રેમ છે, તો કુમારની પાસે એ શું કરાવવા આવી છે ? કુમારને ભવમાં ભટકવું પડે એવું તો નહિ ને ?’ કુમારના પ્રશ્નો આ ભાવ છે. સમરાદિત્યકુમારની નવી પત્નીઓ ચતુર શિક્ષિત રાજકુમારીઓ છે; એ કુમારના પ્રશ્નો ગુદ્ધાર્થ સમજી ગઈ. એમના મનને લાગ્યું કે ‘ખરેખર ! અમે તો પતિ કુમાર પાસે સંસારસુખના રંગરાગ જેલાવવા આવી છીએ, અને એથી કાંઈ એમનું ભવમાં ભટકવાનું અટકે નહિ. તો પછી એમની પાસે એવું કરાવવા આવેલી અમો એમના પર સાચા પ્રેમવાળી શાની ?’

તરત ઊઠીને કુમારના પગમાં પડી પત્નીઓ કહે છે, ‘સ્વામી ! ક્ષમા કરજો, અમો તો ભૂલી પડેલી; અમે તો પ્રેમીનું નામ ધારણ કરી આપની પાસેથી એવી આશાએ આવેલી કે જેથી આપનું કશું ભલું ન થાય. પણ હવે

આપની ઉપર સાચો પ્રેમ ધરવો છે. તો આપ ફરમાવો આપનું ભલું થાય એવું અમારે શું કરવું ?

સમરાદિત્ય રાજકુમારે કહું ‘જીવનભરનું પહેલું તો બ્રહ્મચર્ય નક્કી કરી લો. એમાં મારું તમારું બંનેનું મહાન કલ્યાણ છે.’

કુમારીઓ સમજી ગઈ કે ‘સ્વામીનો પોતાનો જીવનરાહ તો બ્રહ્મચર્યનો પહેલેથી નક્કી થઈ ગયો દેખાય છે, જેથી આપણાને પણ એમાં અનુસરવા કહે છે.’ તરત એમણે ખૂબ હર્ષાલ્વાસથી એ સ્વીકારી લેતાં કહું ‘આપે અમારા પર મહાન ઉપકાર કર્યો. આવા આપશ્રી જેવા સોભાગી પતિ, લાગે છે કે, કદાચ પૂર્વે અનંત કાળમાં નહિ મળ્યા હોય. નહિતર આજ સુધી અમારે રખડવાનું શાનું હોય ?’

શું કર્યું કુમારીઓએ ? સ્વામી પરના પ્રેમને સાચો બનાવવા માટે સ્વામીનું જેથી ભલું થાય એવા બ્રહ્મચર્યને સ્વામીના આદેશથી જીલી લીધું.

બસ, શું બ્રહ્મચર્ય, કે શું ક્ષમા-મૈત્રી-કરુણા વગેરે, એને જો આપણા જીવનમાં સુલભ બનાવવા હોય તો એ માટે આપણે આ વિચારવાનું છે કે ‘સામાનું ભલું થાય, યા મારા નિમિત્તે કમમાં કમ અનું બૂરું ન થાય, એ ખાસ લક્ષ રાખવા દે.’

વિશિષ્ટ માનવબુદ્ધિ જો આ વિચારે કે ‘મારે એવું ન વર્તવું કે જેથી સામાનું બૂરું થાય,’ તો એ બુદ્ધિ સ્વ-પરને આશીર્વાદરૂપ નીવડે; નહિતર આ વિચાર વિનાની બુદ્ધિ એ પોતાને અને પરને શ્રાપરૂપ નીવડે. જીવનસંચાલન પહેલું તો બુદ્ધિ પર આધારિત છે. જેવી બુદ્ધિ એવું જીવન જીવશે. બુદ્ધિ જ જો આ, કે ‘મારે તો મારો સ્વાર્થ જોવાનો. સામાનું હું ક્યાં જોતો બેસું ?’ તો પછી આ બુદ્ધિ પર એનું જીવન એવું જ ચાલવાનું કે એના વિચાર-વાણી-વર્ત્વ બીજાના અહિતમાં ઊતરતા હશે તો ય એની એને પરવા નહિ રહેવાની.

એટલે જ દેખાય છે કે ગમે તે કારણે ગુસ્સો કરનારો એથી સામાના દિલ ભાગે, સામાને કષાય થાય, અસમાધિ-હુર્ઘાન થાય, એની પરવા નથી કરતો. ‘સામાનું આ બૂરું આપણા નિમિત્તે ન થાઓ’ એવી જો દિલની નિર્મણતા હોય તો સહેજે કોથ પર કાબૂ કરી ક્ષમા રખાય.

એમ ઈધર-ઉધરની વાતો કે બીજાની નિંદા કરનારને એ જોવાની પરવા રહેતી નથી કે ‘એ સાંભળનારને કેટલા રાગ-દેખાદિ કષાયો થશે.’ ત્યારે જો સામાનું એ બૂરું ન કરવું હોય તો પોતે વાતોડિયા કે નિંદક મટી ગંભીર મૌનધારી બનવું ધટે, યા ધર્મકથા કરનાર અને ગુણ-પ્રશંસક બનવું જોઈએ.

એમ, પોતાના પતિ કે પત્ની બહુ વિષયલુભ્ય ન બને અને શક્ય

બ્રહ્મચર્યપાલક બને એ એનું ભલું કરવું હોય તો પોતાના જીવનમાં સારો સંયમ કેળવવો. સાથે મોહ અને કામરાગ વધારનારી વાતો જરાય ન કરતાં સુદર્શન શેઠ, વિજય શેઠ-વિજયા શેઠાણી, સ્થૂલભડ્રસ્વામી વગેરેની વાર્તા તથા સંયમના મહાન પ્રભાવની સુંદર વિચારણા બતાવતા રહેવું જોઈએ.

એમ, સંતાનનું ભલું કરવાની કામના હોય, તો એમની આગળ પોતાના જીવન ત્યાગ, ક્ષમા, સહિષ્ણુતા સંયમ ઉદારતા વગેરે ગુણોથી ભર્યાભર્યા અને ધર્મના આચાર-અનુષ્ઠાનથી શોભતા રાખવા જોઈએ, તેમજ સંતાનને રોજ એવાં શિક્ષણ સંસ્કરણ કરવાં જોઈએ.

મૂળમાં, ‘સામાના અહિતમાં નિમિત્ત નથી થવું,’ આ લક્ષ પાછું હોય તો ઉપર કંધું તેમ સહેજે ક્ષમા, સંયમ, ગંભીરતા વગેરે અનેક સદ્ગુણો અને સહૃદાચારો સુલભ બને. મનને રહે કે ‘આ ઉત્તમ જીવનની સુવાસ આ છે કે યથાશક્તિ સામાના ભલામાં નિમિત્ત બનતા રહેવું, પણ જરાય બૂરામાં નહિ; ને એ જીવન-સુવાસ મારે જોઈએ છે.’

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૨, તા. ૧૬-૫-૧૯૭૦

(૮૨) (લેખાંક-૨)

ઉત્તમ માનવ જીવનમાં બ્રહ્મચર્ય ક્ષમા ઉદારતા આદિ ગુણોનો જેટલો અભ્યાસ થાય એટલી આ જીવનની મહાન સફળતા છે; અને એ અભ્યાસ કરવા માટે ગયા લેખમાં સમરાદિત્ય રાજકુમાર અને એની બે નવોઢા પત્નીઓનું દાખાંત જોઈ એમાંથી એક ચાવી રૂપે એ તારવ્યું કે કુમારના કહેવાથી એનું બૂરું ન થાય એ માટે જેમ પ્રેમી પત્નીઓએ બ્રહ્મચર્ય નક્કી કર્યું, એમ આપણે બીજાઓ સાથેના વ્યવહારમાં એનું બૂરું ન થાય, અર્થાત્ એ આપણાથી રાગ-દ્વેષાદિ કષાયમાં ન પડે કે વિષયલોલુપ ન થાય એ હેતુએ ક્ષમા ગંભીરતા સંયમ વગેરેનું પાલન કરવું. સામાનું વિશેષ ભલું ન કરી શકતા હોઈએ તો ય કમમાં કમ આપણે એનું બગડવામાં નિમિત્ત તો ન જ થઈએ, એ વિચારથી આપણે ક્ષમાદિનો અભ્યાસ રાખવો. એ માટે આ વિચાર એ એક ચાવી.

હવે આ માટે બીજો વિચાર યાને બીજી ચાવી આ છે,-

સમરાદિત્યની પત્નીઓએ એ જોયું કે ‘જો આપણાને પતિ ઉપર પ્રેમ છે તો આપણે પતિના આદર્શને અનુસરવું જોઈએ. એમનો જે જીવન-આદર્શ તે જ આપણો જીવન-આદર્શ. કુમારને આપણો પ્રેમથી સ્વામી તરીકે માથે ધર્યા પછી એમના આદર્શને આપણો આદર્શ બનાવવો જ જોઈએ, એ પ્રેમી સુશીલ નારીનું કર્તવ્ય છે.’

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૮૫

આર્થ દેશનો ઈતિહાસ આ જ બતાવે છે કે સતીઓએ પતિના આદર્શને કષ્ટ વેઠીને પણ અપનાવ્યા. રામચંદ્રજીએ વનવાસ જવાનું નક્કી કર્યું તો સીતાજીએ પણ એ જ અપનાવ્યું. ત્યાં, ભલે પિતાના ઘેર ઢાઢથી રહેવાનો અભ્યાસ હતો, પણ એ બાજુએ મૂક્યો. દમયંતીને રાજ્યપાટ હારી ગયેલા પતિ નળરાજાએ પિયેર જવા કંધું, પરંતુ દમયંતીએ ‘પતિનો એ જ પોતાનો માર્ગ,’ એ સૂત્ર રાખી પતિની સાથે એ વનમાં ચાલી.

‘માથે જેને સ્વામી તરીકે ધર્યા અને એના પર આપણો પ્રેમ હોવાનો દાવો છે, તો પછી એના આદર્શથી વિપરીત આદર્શ કેમ રખાય ?’ આ સતીઓનું જીવનસૂત્ર; એટલે જ સુશીલ પત્નીઓ પતિ જો તપસ્વી તો પોતે પણ તપસ્વી બને છે; પતિ જો સંયમી, તો પોતે ય સંયમી અને પતિ જો ઉદાર દાની, તો પોતે પણ ઉદાર અને દાની બને છે.

બસ, આપણે પણ પરમાત્માને જો સ્વામી તરીકે માથે ધર્યા છે, અને એમના પર પ્રેમ હોવાનો દાવો રાખીએ છીએ, તો પછી આ જીવનસૂત્ર બનાવવા જેવું છે કે ‘પ્રભુનો આદર્શ એ આપણો આદર્શ’ - એમના આદર્શથી વિપરીત આદર્શ જ જો રાખવા હોય તો આપણો એમને સ્વામી શા માન્યા ? અને એમના પર આપણો પ્રેમ શો ? જો આપણો પ્રભુના સેવક, તો શું સેવક એટલે સ્વચ્છંદ વર્તવાનો અધિકારી ? આપણે જો પ્રભુના પ્રેમી, તો શું પ્રેમી એટલે એમનાં દર્શન-પૂજન-જાપ કરવા દ્વારા એમની પાસેથી પુણ્ય આંચકી લેવા પૂરતા જ પ્રેમી ? પ્રભુ આપણું ભલું કરે, આપણને પ્રભુ ભરપૂર સુખ આપે, પણ આપણો પ્રભુનું કશું કરવાનું નહિ ? આપણે પ્રભુનું ધર્મ-શાસન જ્યવંતુ રહે અને આગળ ધપે એ માટે કશો ભોગ આપવાનો ખરો ?

દુનિયામાં આ ક્યાંય નથી ચાલતું કે ‘પ્રેમી સેવક એટલે સ્વામી એનું બધું કરે, ને એ સ્વામીનું કશું ન કરે.’ રાજાના વફાદાર પ્રેમી સેવક, શેઠના એવા નોકર, માતાનો સુપુત્ર, પતિની વફાદાર પ્રેમી પત્ની, ગુરુનો પ્રેમી સુશિષ્ય,... વગેરે બધા તો સ્વામીનું કરી છૂટવા ભારે ભોગ આપે છે. સ્વામીના આદર્શને પોતાનો આદર્શ બનાવે છે, તો એ જ રીતે પ્રભુના વફાદાર પ્રેમી સેવક તરીકે આપણો પ્રભુનું કરવા ભારે ભોગ આપવાનો છે, પ્રભુના આદર્શને અપનાવવા જરૂરી છે. આપણને ઉત્તમ માનવભવ અને બીજી અનેક પુણ્યાઈ મળ્યા એ પ્રભુના પ્રતાપે; એટલે પ્રભુએ તો આપણું ધણું કર્યું. હવે આપણે પ્રભુનું કરવાનું છે, ને એમના આદર્શને એક સાચા પ્રેમી સેવક તરીકે અપનાવવાના છે.

બસ, આ સૂત્ર રાખીએ તો જીવનમાં ક્ષમા બ્રહ્મચર્ય, ગંભીરતા ઉદારતા

૧૮૬

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

વગેરે પાળવા સહેલા થઈ પડે. આપણા શાસનપત્રિ મહાત્માર પ્રભુએ ૨૮ વર્ષની વયથી બ્રહ્મચર્ય અને જીવનમાં ઘોર તપ, મહાસંયમ, મહાક્ષમા, શત્રુ પર અસીમ કરુણા, વગેરે ખૂબ સાચ્યું, તો આપણે પણ જો એમના ગ્રેમી સેવક હોઈએ, તો જીવનમાં એ જ બધાને આદર્શ તરીકે રાખવાના હોય. એક અભણા સત્તી પતિને અનુસરે, તો શું મરદ આપણે, પ્રભુને ન અનુસરીએ? મારા પ્રભુને ગમ્યું એ મને ગમ્યું- આ વિચારથી જીવનમાં ક્ષમા બ્રહ્મચર્ય આદિનો અભ્યાસ સરળ બને.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૩, તા. ૨૩-૫-૧૯૭૦

### (૬૩) વીતરાગની સાચી ઉપાસના માટે જરૂરી તત્ત્વ

રાગ-દ્રેષના ભયંકર કોલાહલભર્યા આ સંસારમાં જે ભવ્યાત્માને વીતરાગ ભગવાન જોવા મળે, સાંભળવા મળે, જ્ઞાનવા મળે, એનાં શુભ ભાગ્યની અવધિ નથી. જગતમાં જોઈએ તો ચારે બાજુ દેખાય છે કે જીવો રાગ યા દ્રેષવશ મનવચન-કાયા અને ઈન્દ્રિયોથી કેટકેટલી દોડધામ કરી રહ્યા છે! એવા કોઈને શાંતિ નથી, જંપ નથી, સ્વસ્થતા નથી. આ શું છે? જગતનાં જીવોમાં વિચારોથી, વાણીથી, યા કાયાથી કે ઈન્દ્રિયોથી એક પ્રકારનો કોલાહલ ચાલી રહ્યો છે.

જીતે ય એવો કોલાહલ કરીને રાચનાર જીવને જગતના કોલાહલની વચ્ચે રહેતાં કોઈ બેચેની નથી, મુંજુલા યા વ્યાકુળતા નથી કે ‘હું આ જંગી કોલાહલની વચ્ચે ક્યા આવી ભરાણો?’ દેખાય છે કે કોઈ જાહેર ભિંટિગમાં જો કોલાહલ થઈ ઊભો, તો એમાં ભેગો કોલાહલ મચાવનારને બીજા કોલાહલની વચ્ચે બેસતાં બેચેની લાગતી નથી. બેચેની તો તેને લાગે કે જેને પોતાને ખુદને કોલાહલ ન ગમતો હોય. એમ રાગ-દ્રેષના કોલાહલભર્યા જગતની વચ્ચે રહેતાં, સ્વયં હોંશથી એવા કોલાહલમાં પડેલા જીવને શાની બેચેની લાગે? મનને ક્યાંથી એમ થાય કે ‘હું અહીં ક્યાં ફસાઈ પડ્યો છું?’

એ તો જેમ પેલી ભિંટિગમાં શાંતતાપ્રિય માણસને બેચેની લાગે, એમ અહીં પણ શાંતતાપ્રિય ભવી જીવને જગતના રાગદ્રેષભર્યા કોલાહલની વચ્ચમાં રહેતાં મુંજુલા-બેચેનીનો અનુભવ થાય. દુનિયામાં કોઈ પૈસાના રાગથી, તો કોઈ ધંધાના રાગથી, કોઈ વળી ખાનપાનના, ત્યારે બીજા વળી વિષયોના રાગથી, તો કોઈ વળી સ્ત્રી-પરિવારના, ને કોઈ સત્તા-સંભાનના, ત્યારે બીજા વળી લોકને સાંસું મનાવવાના યા લોકમાં સારા દેખાવાના, એમ અનેક પ્રકારના રાગથી ધમાધમ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૮૭

પ્રવૃત્તિ કરી રહ્યા છે. એ બધું કોલાહલ જેવું લાગે. પણ ક્યારે? જ્યારે પોતાને પણ એ કોલાહલ ન ગમે તેથી મનને એમ થાય કે આ કોલાહલ-ધમાધમ-દોડાડોમાં મૂળ કારણ રાગ અને દ્રેષ છે. એના જ ઉપર જીવનમાં અનંતકાળથી સંસારભાવ ઊભો છે. તેથી એ રાગ-દ્રેષનો જ ડ્રાસ કરતા રહેવાથી એક દિન એનો સર્વનાશ થતાં, સંસારભાવનો પણ અંત આવશે.

આ રાગદ્રેષનો ડ્રાસ એ માનવજીવનનું મુખ્ય લક્ષ્ય હોવું જરૂરી છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે ‘ઉપદેશ રહસ્ય’ શાસ્ત્રના અંતે સમસ્ત ઉપદેશનો સાર બતાવતાં કહ્યું કે ‘તહ તહ પયદ્વિયવ્ચ જહ જહ રાગદ્વોસા વિલિજ્જંતિ ॥’ અર્થાત્, તેવા તેવા વિચાર-વાણી-વર્તાવ પ્રવર્તાવવા કે જેથી જેથી રાગદ્રેષ વિલય પામતા જાય.

આચાર્ય પુંગવ શ્રી હરિભક્તસૂરીશ્વરજી મહારાજે ‘યોગદાસ્થિ-સમુચ્ચય’ નામના શાસ્ત્રમાં કહ્યું, ‘જીવમાં રાગ-દ્રેષની ગાઢ ગાંઠ એ અનાદિ સહજમળ છે, અને એનો નોંધપાત્ર ડ્રાસ-મંદતા થયા વિના મોક્ષ પામવાના અંતિમ પુદ્ગલપરાવર્તકાળમાં આવી શકાતું નથી.’

આગમશાસ્ત્રો કહે છે કે ‘અનંતાનુભંધી રાગ તૂટ્યા વિના સમ્યગદર્શન પ્રાપ્ત થાય નહિ; તેમ એ વિના દાનાદિ ધર્મ પણ નિષ્ફળ નીવડે.’

આ ગ્રમાણો સૂચ્યવે છે કે ‘જીવનને અજવાળવા રાગ-દ્રેષનો ડ્રાસ કરતા ચાલો, એ કર્યા વિના તો જીવન, આમ ગમે તેટલા વૈભવ વિલાસ મળ્યા છિતાં, અંધકારમય રહેશે. રાગ-દ્રેષભરી બધી ય ચેષ્ટાઓ અંધકાર-નૃત્ય જેવી છે. આ રાગ-દ્રેષના અંધારામાં જીવને વીતરાગ પ્રભુની ઓળખ જ નથી થતી, પછી ઉપાસનાની તો વાતે ય શી? કદાચ દેખાવમાં ઉપાસના જણાય, તો ય તે વસ્તુતા: જરૂરાગના ઘરની હોય.

રાજા ઉદાયન પહૃતરાણી પ્રભાવતીમાં એટલો બધો મુંઘ હતો કે પ્રભાવતી જ્યારે વીતરાગ જિનેશ્વર ભગવંતની પૂજામાં નૃત્યપૂજા કરતી, ત્યારે એમાં સંગીતનો મધુરો સૂર મિલાવવા રાજા ઉદાયન વીજા બજાવતો. તો શું ઉદાયનની આ વીતરાગની ઉપાસના નહોતી? ના, એ તો પ્રભાવતીના મોહને લીધે વીજાવાદન હતું. ખૂબી કેવી કે જ્યારે પ્રભાવતીને ઉદાયન પર એવો આંધળો રાગ નહિ. તેથી વીતરાગની સાચી ઓળખ હતી અને વીતરાગની ઉપાસના માટે એમની આગળ નૃત્યપૂજા કરતી, ત્યારે ઉદાયનને પ્રભાવતી પર અત્યંત રાગ હતો એથી એ પ્રભાવતીની ઉપાસના-પ્રસાન્તા માટે વીજા બજાવતો, એને વીતરાગ પ્રભુની ઓળખ નહોતી. એ તો જ્યારે પ્રભાવતીએ ચારિત્ર લઈ દેવ થઈને એને પ્રતિબોધ કર્યો ત્યારે રાગ

૧૮૮

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

મંદ પરી વીતરાગ પ્રભુની ઓળખ થઈ અને ઉપાસનામાં અવાયું. રાગ ઘટાડચા વિના વીતરાગ પ્રભુ નહિ ઓળખાય.

બસ, વાત આ છે કે (૧) વીતરાગ અરિહંત પ્રભુની ઉપાસનામાં અત્યંત જરૂરી તત્ત્વ - રાગ-દ્રેષ્ણની મંદતા છે; એટલું જ નહિ પણ (૨) વીતરાગની ઉપાસના રાગ દ્રેષ્ણપી સૌથી મોટા આંતર શત્રુનો નાશ કરવા માટે કરવાની છે. એટલે વીતરાગ પ્રભુની પૂજા-આરાધનામાં કારણભૂત પણ રાગાદિની મંદતા, અને એ આરાધનાનું ફળ પણ રાગાદિનો હ્રાસ યાવત્તુ સર્વનાશ.

આ બે વસ્તુ બરાબર જેના ધ્યાનમાં રહે એ (૧) વીતરાગને ભજવા-સ્મરવા જતાં પહેલાં ય આ જુએ કે જગતમાં કોઈ પણ ચીજ પર આંધળો રાગ રાખીને તો આ કરવા જતો નથી ને ? અને વીતરાગને ભજતાં-સ્મરતાં તેમજ એના અંતે આ જ ઈંચું કે મારા રાગાદિ નબળા પડે. મૂળ, રાગાદિનો કોલાહલ મંદ પડે તો ઉપરના બીજા કોલાહલ ધીમા પડે.

આ લક્ષ નથી હોતું એટલે પૂજા વીતરાગની કરીને સાંસારિક ધન-પુત્ર-સત્તા-સન્માન આદિ ઈંચું છે, અર્થાત્ એ ધનાદિના રાગને મજબૂત કરે છે. આ કેવું અજ્ઞાન ? જ્યાંથી તરવાનું, ત્યાં જ દૂબવાનું માગી લેવાય, તો પછી તરવાનું બીજું કોઈ સ્થાન રહ્યું જ ક્યાં ? અનંત કાળે પણ હુલ્લબ એવા વીતરાગ પ્રભુ જો મળ્યા છે, તો પછી નાશવંત માનપાન પૈસા-પરિવાર આદિના રાગ ઓછા કરી એ પ્રભુને સાચા ઓળખવા, અને એમની ઉપાસનામાં લાગવું.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૪, તા. ૩૦-૫-૧૯૭૦

## (૪) ધર્મશ્રદ્ધાનાં ૩ મહાન સૂત્ર

આપણે ધર્મશ્રદ્ધા ધરાવવાનો દાવો રાખીએ છીએ. પરંતુ ખાસ તપાસવા જેવું છે કે આપણામાં ખરેખર ધર્મશ્રદ્ધા છે ? અને જો ન હોય તો એ ઊભી કરવા શું કરવું એ વિચારવા જેવું છે.

ધર્મશ્રદ્ધાનું માપ કાઢવા આ ત્રણ સૂત્ર છે, (૧) ‘કેવલિપન્નતો ધર્મો મંગલં,’ (૨) કેવલિપન્નતો ધર્મો લોગુતમો.’ (૩) ‘કેવલિ-પન્નતં ધર્મં સરણં પવજજામિ. કેવલી એટલે કે સર્વજ્ઞ જિનેશ્વર-ભગવંતોએ કહેલો ધર્મ મંગળરૂપ છે, એ જ લોકોત્તમ છે, અને એનું હું શરણ સ્વીકારું છું. સર્વજ્ઞ કથિત ધર્મ પ્રત્યે આ રીતના ભાવ હોય તો ધર્મશ્રદ્ધા ગણાય.

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૮૮

સવાલ થાય કે સર્વજ્ઞ તીર્થકર ભગવાને કહેલો ધર્મ ક્યો ? ત્યાં જૈન આગમ કહે છે કે ભગવાને મુખ્યપણે ધર્મ ૧૦ પ્રકારનો કહ્યો છે,-ક્ષમા મૂહુતા, સરળતા, નિર્લોભતા એ ૪, તપ અને સંયમ એ ૨, તથા સત્ય-શૌચ-અપરિગ્રહ ને બ્રહ્મચર્ય એ ૪,  $4+2+4=10$  પ્રકારે ધર્મ છે. આમાં અહિસાનું નામ ન આવ્યું, તો શું અહિસા એ ધર્મ નહિ ? ખરો, પરંતુ ક્ષમા નિર્લોભતા અને સંયમ ધર્મ એવા છે કે એ બરાબર પાળનારો હિંસા કરી શકે નહિ; તેથી અહિસા એમાં સમાવિષ્ટ છે. એમાં સંયમમાં બને છે,-૧. જીવોની હિંસા થાય એવી પ્રવૃત્તિ પર અંકુશ, અને ૨. ઈન્દ્રિયોની રાગાદિપ્રવૃત્તિનો નિગ્રહ. આમ સંયમથી હિંસક આરંભ-સમારંભ અને વિષયાસક્તિ-અનિષ્ટદ્રેષ્ણનો ત્યાગ થઈ જાય છે.

તો શું ઉપરોક્ત દશમાં નહિ ગણેલ અસ્તેય-અચૌર્ય એ ધર્મ નહિ ? એ ય ધર્મ ખરો, પરંતુ શૌચ એટલે મનની પવિત્રતા લીધો એમાં અ-ચૌર્ય સમાઈ જાય છે. પવિત્ર દિલવાળાં ચોરી કરે જ નહિ. ચોરી કરનારનું દિલ મલિન બને છે, પવિત્ર નથી રહેતું. તો શું સત્ય અને બ્રહ્મચર્ય પણ શૌચમાં નહિ સમાય ? અને દશમાં જુદા કેમ ગણ્યા ? અનેનું કારણ એ છે કે મન પવિત્ર હોય છતાં અજાણે જૂઠ બોલાવા સંભવ છે. તો એનો ય ત્યાગ કરાવવા સત્યધર્મ જુદો લીધો. ત્યારે ચોરી કાંઈ અજાણે નથી થતી, એ તો મન મેલું કરીને જાણીને થાય છે. માટે મનની પવિત્રતામાં અચૌર્ય સમાઈ ગયું. વળી ગૃહસ્થ સદાચારની મર્યાદામાં રહીને અબ્રહ્મસેવી હોય તેથી કાંઈ એ મેલા હંદયનો નથી ગણાતો. તેથી આ અબ્રહ્મ પાપનો ય ત્યાગ કરાવવા બ્રહ્મચર્યધર્મ જુદો લીધો.

આમ ધર્મમાં કોધાદિ ચાર કષાયોના ત્યાગવાળા ક્ષમાદિ ૪, હિંસાદિ પાંચ પાપોના ત્યાગયુક્ત અહિસાદિ પાંચ મહાપ્રત, પ્રમાદ તથા વિષયાકર્ષણાના ત્યાગવાળો જતના ધર્મ તથા ઈન્દ્રિયસંયમ, મનની પવિત્રતા અને બાર પ્રકારનો બાધ્ય-આભ્યન્તર તપ આવે.

હવે જીતમાં આ તપાસવાનું છે કે આપણે ખરેખર આ ધર્મને મંગળ અને લોકોત્તમ માનીએ છીએ ? ને અનું શરણ સ્વીકારીએ છીએ ? આ માનવાનું એટલે ‘ધર્મો મંગલં’ બોલતાં નજર સામે એ ક્ષમાદિ ધર્મ આવીને મનને એમ થાય કે ‘વાદ ! સર્વ સુખકર કેવા આ સુંદર ધર્મ !’ ‘લોકોત્તમ’ બોલતાં એ ધર્મ જગતની પ્રાપ્તિઓમાં શ્રેષ્ઠપ્રાપ્તિ હોઈ એના પર ભારે આદર થાય; અને ‘સરળં પવજજામિ’ બોલતાં મનને નિર્ધાર થાય કે કોધાદિ કોઈ શરણરૂપ નથી, રક્ષક નથી, પરંતુ આ ક્ષમાદિ જ જ્યારે ને ત્યારે મારા રક્ષક છે, મારા તારણહાર છે; એમ હું હંદયથી સ્વીકારું છું. રોખ-રોઝ-માનથી ક્ષણભર બોલબાલા દેખાય, પરંતુ એથી અંતે

૧૯૦

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

રક્ષણ નથી. એ તો ક્ષમાદિ જ રક્ષણહાર છે.

બસ, ક્ષમાદિ ધર્મ માટે પરમ આલ્ફાદ, પરમ આદર-બહુમાન, અને એ જ શરદ્ય તરીકે સ્વીકાર આપણું હૃદય કરતું હોય, તો સાચી ધર્મશ્રદ્ધા હોવાનો દાવો રાખી શકીએ. આ પરથી એ પણ ફિલિત થાય છે કે ધર્મશ્રદ્ધા ખરેખર જમાવવા માટે આ ‘કેવલિપન્નતો ધર્મો મંગલં...’ વગેરે ત્રણ સૂત્ર વારંવાર યાદ કરવા જોઈએ, અને એના ઉપરોક્ત ભાવનું હૃદયમાં સંવેદન કરતા રહેવું જોઈએ.

અર્થાત્ હુન્યવી ધન-માલ-પરિવાર કે ખાનપાન-સન્માન વગેરેમાં આનંદ લાગવા જતાં મનને થાય કે ‘મૂર્ખ ! આમાં શું, મોહે ? મોહવાની ચીજ તો ધર્મો મંગલ છે. એમ હુન્યાની વાત વસ્તુ પર હૈયું ઓવારી જતું હોય ત્યાં થાય કે ‘મૂર્ખ ! આમાં શા હૈયા ઓવારવા’તા ? મહાન ચીજ તો ધર્મો લોગુજમો છે.’ એમ હુન્યવી વસ્તુ પર હુંફ રહેતી હોય તો એ ઉઠાઈ મૂર્કી ક્ષમાદિ ધર્મ પર હુંફ જમાવાય. મનને એમ થાય કે ‘જ્યારે ને ત્યારે ખરું સુખશાન્તિ-રક્ષણ આ ક્ષમાદિથી જ મળશે. માટે બીજી આળપંપાળ-હુંફ-સવાસલાં ખોટા છે.’

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૫, તા. ૬-૬-૧૯૭૦

## (૬૫) વર્તમાન હાડમારીઓ : એમાં હુંફનું સાધન

પંચમ કાળના જીવોનાં પુણ્ય દુબળાં, એટલે સંપદાઓ થોડી, ને વિપદાઓ વધારે; સરખાઈ ઓછી, અને વિષમતાઓ વિશેષ. મોટા ભાગના જીવોની આ દશા હોય છે; એટલે એક વાતની અનુકૂળતા થઈ હોય, પણ બીજી કેટલીય પ્રતિકૂળતા દેખાય.

દા.ત. સંસારસુખ માટે પત્ની તો મળી; પરંતુ પુણ્ય દુબળું એટલે એનો વિશિત્ર સ્વભાવ, એના રૂપ-રંગ, એના ભારે બોલ, એનો ચડતી વયમાં જ અનેક પુત્રપુત્રીઓનો કાફલો,... વગેરે એવી ઉપાધિઓ મળે કે જે સહ્યવી કઠિન પડે. એમ આજીવિકા માટે નોકરી તો મળી, પરંતુ દુબળા પુણ્યે શેઠની કડકાઈ, નોકરીમાં હાડમારી સમયનો વિશેષ ભોગ, જરૂરી રજા મળવાની મુશ્કેલી, વગેરે અગવડો વેઢવી પડતી હોય. ત્યારે નોકરી તો નહિ, પણ વેપારી બની દુકાનની શેઠાઈ મળી હોય, છતાં ય દુબળાં પુણ્યે નોકરોની કામચોરી ને અવળયંડાઈ, લાગ મળ્યે ચાંઝુગીરી, સરકારી લફરાં, ટેક્ષ, ટેક્ષથી બચવા જોખમભરી અનેક ચોરી છૂપકીઓ, વળી

મોભાના મોટા ખરચા, વગેરે વગેરે બાબતો એવી ચિંતા સંતાપ ઊભા કરતા હોય કે મન જાણે. ત્યારે સ્ત્રીઓનાં જીવનમાં ધણીના તુંડમિજાજ, કુદ્ર સ્વભાવ, કૃપણતા, એના લાગતાવળગતાની સરભરાની લોથ, એના આડાયવળા ધંધામાં છાશવારે ને છાશવારે પૈસાની પોક,... વગેરે વગેરે કષ અપરંપાર. એમ માતાપિતા બનવાની પુણ્યાઈ તો જાગી, પરંતુ પછી ટૂંકી આવકમાં સંતાનના લંગર અને ખરચા, સંતાનની ઉદ્ઘતાઈ, એને વરાવવાની ચિંતા, છોકરાને વરાવ્યા પછી એની વહુના જગડા, છોકરીને વરાવ્યા પછી જમાઈ કે સાસરિયા અંગે છોકરીની આવતી ફરિયાદો;... વગેરે વગેરે કેટકેટલી કઠિનાઈઓ ?

પંચમ કાળમાં ક્યાં સુખની સરખાઈ છે ? વિચારવાને હૃદય હોય તો જ્ઞાનીઓ કહે છે તે મુજબ સંસાર અસાર હોવાનું આબેહૂબ દર્શન થાય. પછી જીવ મનને મનાવી લે કે ‘હોય ભાઈ ? કઠણાઈ તો હોય; ગુલાબ લેવા જઈએ તો કાંટા તો વાગે, પણ ગુલાબ તો સારાં મળે ને ? એમ અહીં પત્ની-પરિવાર-ધંધાનું સુખ તો મળે છે ને ?’ આમ મન મનાવાય, પરંતુ એકેકની પાછળ પારાવાર મુશ્કેલીઓ જોતાં અને એમાં જીવનની ધણી ધડીઓ સંતાપની જોતાં, એ મન મનાવવું એમાં હૃદયની ધિક્કાઈ છે. સંસારના તુચ્છ અલ્ય સુખ ચાટવાની લાલચમાં હૈયું એવું ધિહું બનાવાય છે. ખાવાનો લાલચું ક્યાંક ગોલ્લાઈયામાં જમવા ધૂસી જાય અને ત્યાં અપમાન પામે, છતાં સારું ચાટવા મળ્યું એના પર જો મન મનાવી લે તો એની ધિક્કાઈ છે.

એટલે ત્રણ સાંખ્યતાં તેર તૂટે જેવી પંચમ કાળની સ્થિતિ તો વિચારકને વૈરાગ્ય પેદા કરે એવી છે. એવા વૈરાગ્યથી જાગેલ પરાકમી ભવ્યાત્માઓ તો દુબળા પુણ્ય ભોગવવાની અજ્ઞાનતાભરી લહેર જતી કરી ચારિત્રમાર્ગ અપનાવે છે.

પરંતુ જેનામાં એ પરાકમ શક્તિ નથી, એણે શું કરવું ? શું આજની પારાવાર હાડમારીઓમાં મુશ્કેલીઓમાં સંતાપ કર્યા કરવા ? શું વર્તમાન કાળે પણ ચિતને શાંતિ મળવાની નહિ ?

અહીં ‘ચાતારિ મંગલં’નું સૂત્ર સારું ઉપયોગી થાય એવું છે. ‘અરિહંતા મંગલ સિદ્ધા મંગલં...’ વગેરે સૂત્રનું સ્મરણ મનને બળ આપે છે, કહે છે કે ‘તને અરિહંત, સિદ્ધ, સાધ, અને સર્વજ્ઞનો ધર્મ એ મહામંગળરૂપ મળ્યા છે, પછી તારે શી ફિકર છે ? શી ઓછાશ છે ? અગર જો તારી શ્રદ્ધા છે કે અરિહંત સિદ્ધ વગેરે ખરેખર સાચા મંગળરૂપ છે, અને એથી મહા વિદ્ધો-અંતરાયો તૂટી અચિત્ય સિદ્ધિઓ મળે છે, આપદાઓ ભાગી જઈ વાંછિત મળી આવે છે, તો આ મંગળરૂપ અરિહંત

સિદ્ધ વગેરે મળ્યા એ જબરદસ્ત પુષ્યોદય છે; મહાનિધાન મળ્યા રૂપ છે પછી તુચ્છ સગવડ ઓછી મળ્યાનું કોઈ હુંખ કરવા જેવું નથી.'

આ શ્રદ્ધા સાથે, 'ચત્તારિ મંગલં અરિહંતા મંગલ...' વગેરે સૂત્ર વાર્ણવાર યાદ કરાય, મનને ભાવિત કરતા રહેવાય કે 'અહો ! આ, નિધાન મળ્યા પછી મારે શી કમી છે ?' એવી ભાવના કર્યા કરાય, વાર્ણવાર આશ્વાસન લેવાય, તો ભારે હુંફ અનુભવાય, તો વર્તમાન કાળની સંકડામણોનો મન પરથી ભાર ઘણો ઓછો થઈ જાય, અને ચિંતા-સંતાપ-આર્તધ્યાનથી ઘણું બચી જવાય.

"દિવ્ય-દર્શન"-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૬, તા. ૧૩-૬-૧૯૭૦

## ૬૬ વાસનાઓ મોળી પાડવા એક વિચારણા

આત્માર્થી જીવ ફાંઝા મારે છે કે 'મારે આ વારેવારે ખાઉં-ખાઉં ને ભોગવું-ભોગવુંની વાસના કેમ ભિત્તાવવી ? પૈસાની લગન કેમ ઓછી કરવી ? આરામી-સુખશીલતાનો રસ શી રીતે ઘટાડવો ? એને મુંજવણ રહે છે કે 'હું એ બધું ખરાબ હોવાનું સમજું છું, છતાં કેમ એ મારાથી છોડતા કે ઘટાડતા નથી ? આ ઊંચા ભવમાં જો એમાં ઘટાડો ન કરું તો પછી મારી કઈ દશા ?...'

આ મુંજવણ ટાળવા અને એ વાસના-લગની-રસ ઘટાડવા-ભિત્તાવવા જૈનશાસ્ત્રો અનેક ઉપાય બતાવે છે; જેવા કે,- (૧) સત્તાંગ બહુ સેવવો, (૨) જિનવાણી નિયમિત સાંભળવી, (૩) મહાપુરુષોનાં ચરિત્ર તથા ઉપમિતિ-ભવપ્રપંચ કથા વગેરે પુસ્તક સારી રીતે વાંચવા-વિચારવા, (૪) મન મારીને પણ શક્ય લાંબા-ટૂંકા ત્યાગ અને તપ કરતા રહેવું, (૫) સ્વદ્રવ્યનો ભોગ આપીને નિત્ય જિનપૂજા કરવી, જેથી પ્રભુની સાચી મમતા કેળવાતી જાય, (૬) કલ્યાણમિત્રોનો સંસર્ગ રાખવો, (૭) તત્ત્વનો અભ્યાસ કરવો,... વગેરે વગેરે. એ ઉપાય કરવા જેવા છે. એથી એ આહાર-વિષયની વાસના, લક્ષ્મીની લગની, અને આરામીનો રસ ઓછા થતા આવે છે.

અહીં એક મૌલિક દાસ્તિનો વિચાર કરવો છે, કે જે દાસ્તિ આ વાસનાદિનું જોર નબળું પાડી દે. આ મૌલિક દાસ્તિ આ છે કે,-

આત્માને વાસના પોષવામાં જે સુખ લાગે છે તે ઈન્દ્રિયો મન અને કાયાને લઈને છે, પોતાના સહજ આત્મસ્વભાવને લઈને નહિ. કશું જોઈને જો આંખ રાજી, તો જીવને સુખ; આંખ નારાજ, જીભ સુસ્ત, તો જીવને સુખ નહિ લાગે. બહુ વાર ખાઈને જો કાયાને ચેન રહે છે તો જ અંદરમાં સુખનો અનુભવ થવાનો.

એમ આરામી કરીને જો મનને ઠીક લાગે છે, તો જ જીવને સુખનો અનુભવ થાય. જ્યાં આંખ કાન કાયા વગેરેને ચેન નહિ, રાજ્ઞીપો નહિ, ત્યાં જીવને સુખનો અનુભવ નહિ લાગે, પછી ભલે વિષય સારો હોય કે નરરસો. દા.ત. પોતાનું ઝુંપદિયું ઘર આંખને રાજી નથી કરતું તો જીવને એથી સુખ નથી લાગતું. એમ દુષ્મનનો બંગલો જોઈ જો આંખને જેર વરસે છે તો ત્યાં પણ જીવને સુખનો અનુભવ નહિ. એમ સંગીત લંબાયે મોહું થવાથી જો કાનને હવે જેર વરસે છે તો જીવને સુખ નહિ. આ સૂચયે છે કે વાસનાના પોષણમાં જો ઈન્દ્રિયો-મન-કાયાને ચેન લાગે, તો જ જીવને સુખનો અનુભવ થાય.

બસ, આના પર આટલું જ વિચારવા જેવું છે કે 'મારે આ ઈન્દ્રિયો વગેરેના રાજ્ઞીપાની ગુલામી શા સારું ભોગવવી કે જો એ હોય તો જ મને સુખ લાગે ? આ તો અનાડી સ્ત્રીના કામાંખ ધણી જેવું છે કે બેરી પ્રસન્ન તો જ એને બિચારાને સુખ લાગે, અને જો એ નારાજ થઈ બેઠી તો આને જાણે બધું સુખ લુંટાઈ ગયું ! ત્યારે પેલી અનાડી બેરીને નારાજ-રીસ-અપ્રસન્નતા દેખાડતાં કેટલી વાર ? એ વાતવાતમાં એવું કરે એટલે ધણી બિચારો પણ વાતવાતમાં દુઃખી થવાનો. એમ ઈન્દ્રિયો-મન-કાયા પણ અનાડી બેરી જેવો છે અને જીવ કામાંખ ધણી જેવો છે. આ અનાડીઓને નારાજ થતાં કેટલી વાર ! દિનમાં કેટલી વાર એ અપ્રસન્ન બનતા હશે ? બસ, એટલી એટલી વાર ગુલામ જીવે દુઃખી થવું જ રહ્યું.

માટે, આ ખોટી ગુલામી છે. એમાં જીવના ખરેખર સુખનો તો કોઈ અનુભવ જ નથી. નહિતર ઈન્દ્રિયો-મન-કાયાની નારાજ-બેચેની થવા છતાં જીવના પોતાના સહજ સુખને શો વાંધો આવે ? પરંતુ ઈન્દ્રિયાદિના રાજ્ઞીપાએ થતો સુખનો અનુભવ એ ખરેખરું જીવનું સુખ જ નથી. તો પછી શા સારું મારે એ ઈન્દ્રિયો-મન-કાયાના રાજ્ઞીપા અર્થે તણાયા કરવું ? પેટપૂર જીમિને ઊક્યા પઢી ગરમાગરમ ચાર ભજિયાં આવ્યાં ત્યાં આંખ નાચે છે, અને જીભ કાયાને એ મળે તો ચેન લાગે છે. માટે જ એમ કરીને ગુલામ જીવ સુખ લગાડવાનું ને ? ના, એવું અને ચેન લગાડવાની ગુલામી મારે ન જોઈએ. એવા એના રાજ્ઞીપાએ મારે સુખ નથી અનુભવવું.' આમ વિચારણા રહે તો એની વાસના મોળી પડે.

એવું કામની વાસનાને પણ દબાવવા આ જ વિચારવાનું કે કામભોગથી ચામડાને ચેન પડવા પર જ મને સુખ લાગવાનું ને ? શા સારું એવી ગુલામી ભોગવું ? એવી ગુલામી તો અનંતા કાળ ભોગવી, પરંતુ એમ એનો અંત ક્યાં છે ? ચામડાને ચેન ઉપડી એને ખણ એટલે એને ચેન; પણ એ તો રોજનું લફ્ઝરું પેહું. શા સારું મારે એવા એક પણ ઈન્દ્રિયના ચેન પર સુખ લેવા જવું ? એને ચેન પડો કે ન

પડો, મારે અહીં અંજેરી ગંજેરી જેવી આવી પડેલી એની ગુલામી નથી કરવી. એના ચેન સુખનો ખપ નથી. મારે એવી એને ચેન આપવાની જરૂર નથી.

બસ, આ વિચાર વારંવાર મમરાવાય, તો વિષયોની, ખાનપાનના રસની, કામની અને બીજી કેટલીય વાસનાઓ પોખવાનું મન નહિ થાય, અને એમ એ ન પોષાતાં મોળી પડતી જશે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૭, તા. ૨૦-૬-૧૯૭૦

## ૬૭ કુવાદો કુદ્ધર્મો કેમ ભયંકર ? : સુફૂત ભાવનાનો નાશ એ મહાપાપ

(લેખાંક-૧)

કોઈની સુફૂતની ભાવનાને ધક્કો પહોંચાડવો એ એક મહા પાપ છે. આપણાથી બીજામાં સુફૂતભાવના જગાવી તો શકતી ન હોય, પરંતુ ઉલટું એનામાં સ્વતઃ કે બીજી ગમે તે રીતે જાગેલી સુફૂતભાવનાનો નાશ કરવો એ કેટલું બધું રાક્ષસી કૃત્ય ગાણાય ?

બીજાના પ્રાણ હરનારો તો એના એક જીવનનો નાશ કરે છે, પરંતુ બીજાની સુફૂતભાવનાનો નાશ કરનારો એનાં ભાવી અનેક સત્તું જીવનનો નાશ કરે છે. કેમ કે,

જો સુફૂત-ભાવના પ્રવર્તતી હોય તો (૧) દિલ કોમળ-ઉમદા-ઉદાર રહે, (૨) શુભ અધ્યવસાય (ભાવ) ચાલુ રહે, અને (૩) સુફૂતના પુરુષાર્થ પ્રવર્તતા રહે; ને એ બધાથી (૪) વિપુલ પુણ્યાનુબંધી પુણ્ય ઊભાં થાય, જેના પ્રતાપે (૫) ભાવિ ઉત્તમ સદ્ગતિનાં જન્મોની ધારા ચાલે, અને (૬) આત્મા ઉચ્ચા-ઉચ્ચતર સુફૂત-સાધનામાં લાગ્યો રહી મોક્ષની વધુ ને વધુ નિકટ થતો જાય. ત્યારે,

જ્યાં સુફૂતની ભાવના જ નથી એવા જીવને તો (૧) આહાર-વિષય-પરિછહના નીતરતા સ્વાર્થરસ અને (૨) આરંભસમારંભોની જ લગની રહેવાની, તથા (૩) એની ખાતર હિંસાદિ તથા કોધાદિ દુષ્કૃત્યોની જ ભાવના ચાલ્યા કરવાની; (૪) એમાં દિલ કઠોર-કુદ્ર-સંકુચિત રહ્યા કરવાનું, (૫) અધ્યવસાય (ભાવ) મલિન ચાલ્યા કરવાના, તથા (૬) દુષ્કૃત્યોના જ પુરુષાર્થ પ્રવર્તતા રહેવાના, (૭) આથી આત્મા પર સરિયામ પાપાનુબંધી પાપોના ગંજ ખડકવાના; (૮) જેના પરિણામે દુર્ગતિના ભવોની પરંપરા અને એમાં પાપાચરણની ધારા ચાલ્યા કરવાની; મોક્ષ ઘણો ઘણો દૂર રહેવાનો.

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૧૮૫

આ તો પરલોકદિને અનર્થોની વાત થઈ. પરંતુ વર્તમાન જીવનમાં પણ અનેક અનર્થો નીપજે છે, કેમ કે સુફૂતભાવનાનો નાશ થયો, એટલે તો અનેક પ્રકારનાં દાનનાં સુફૂત, તથા શીલ-પ્રતિ-સદાચારોનાં, ત્યાગ-તપસ્યાનાં, મૈત્રી આદિ ભાવનાઓનાં, દયા-અહિંસા-સત્ય આદિનાં, ક્ષમા-સમતા-નન્દાદિનાં સુફૂતની ભાવના જ નાશ થઈ. પછી એનામાં સહેજે અટ્ય પુણ્યોદય પર મોટા સ્વાર્થ સાધવાની જ ચિંતા-સંતાપ-નિરશા સણગતી રહેવાની; કથાયોના ઉકળાટ ચાલ્યા કરવાના; અનેકવિધ ભયની લાગણીઓ પ્રવર્તતી રહેવાની. આ તો એને પોતાને વિટંબળા; ઉપરાંત સમાજને પણ એ સુફૂતભાવનાના અભાવે આશીર્વાદરૂપ નહિ કિન્તુ શ્રાપરૂપ બનવાનો.

આજે આનું દર્શન થાય છે. ભારતમાં સુફૂતભાવના અને સુફૂતોનો ધુમ પ્રવાહ વહેતો હતો ત્યારે વ્યક્તિગત જીવનમાં કેટલી બધી શાંતિ પ્રસન્નતા-નિશ્ચિન્તતા-તૃપ્તિ ચાલ્યા કરતી; તેમજ સમાજને પણ એવા માણસો કેવા આશીર્વાદ રૂપ બન્યા રહેતા. આજે મોટા ભાગમાં સુફૂતભાવના જ નાશ જેવી થઈ ગઈ અને સુફૂતો સુકાઈ ગયાં, તેથી સ્વકીય જીવનમાં ઉકળાટ-ઉન્માદ અતૃપ્તિ અને મૂર્ખી વ્યાપક થઈ ગઈ, તથા સમાજમાં એવાઓથી ભય-રોઝ-શોષણ-વિંબળ ફાલ્યા ફૂલ્યા. ત્યારે મોટા ભાગના લોકોનાં એવાં વ્યક્તિગત સુફૂતહીન જીવનથી એમના પરલોકની ખરાબી તો કેવી ય ઉભી થવાની ?

લાંચરિશવત-દગ્ગોપ્રાંય-હલકોમાલ-ભેણસેળ-ખોટા લેખ વગેરે આજે કેટલું ? સત્તા-ખુરશી-હોદ્દાની ભૂખ, સન્માન લાલસા, ધનલોભ, ને એ બધા પાછળ કેટલા ય ભયાનક કૃત્ય કેવાં ? દુરાચારના સોદા, દુરાચારની સગવડો, અને દુરાચાર કેટલા ? બેઈમાની ચોરી અનીત કેટલી ? ડી.ડી.ટી. વગેરે ઘરગાંથું ચીજો અને યાંત્રિક કલ્યાણાના, તેમજ ચામડાનાં ભયંકર ઉત્પાદન, તથા મત્સ્ય ઉદ્યોગ-મરધા ઉદ્યોગ વગેરેથાં બેસુમાર નિધૂણ હિંસાઓ કેટલી ? છાપા-પિકચરો-નોવેલ-નવલિકાઓ વગેરેથી રૌદ્રઘાનાના વિચારો કેટલા ? અભક્ષ્ય-અપેયનાં ખાનપાન કેટલાં ? નિરુક્ષુ ભોગવૃત્તિ, બિમસ્ત વેશ, જુગાર વગેરે પાપો કેટલાં ?...

સારાંશ, દુષ્કૃતો ધુમ બધી ગયાં; એટલા જ એની સામે સુફૂતોનો અભાવ થઈ ગયો; જેમ કે ન્યાયસંપન્નતા, સત્ય-સરળતા-પ્રામાણિકતા, મૈત્રી બંધુભાવ-સહાનુભૂતિ, નિર્લોભતા તૃપ્તિ, સદાચારો, વિશ્વાસપાલન, દયા-અહિંસા, અલ્યારેભ-અલ્યપરિશ્રદ્ધ, અભક્ષ્યત્યાગ, જુગારાદિ વ્યસન ત્યાગ, રસત્યાગ, બ્રહ્મચર્ય, વિષયસંકોચ, ઈન્દ્રિયનિયાદ, લજજા-મર્યાદાપાલન, ક્ષમા-સમતા-નન્દતા, ધર્મશાસ્ત્રવાંચન-મનન, તત્ત્વચિંતન, પરમાત્મભક્તિ, પ્રતનિયમ... ઈત્યાદિ ઈત્યાદિ

૧૮૬

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

સુકૃતો અદ્દશ્ય જેવા થઈ ગયા.

આવી પરિસ્થિતિ છેલ્લા ૩૦-૪૦ વરસમાં ખૂબ વધતી ચાલી. આનું શું કારણ? આ જ, કે જડવાદ-વિલાસવાદ-સામ્યવાદ વગેરે વાદો ફાલ્યા ફૂલ્યા. આમ તો છેલ્લા કેટલાક સૈકાથી કુધર્મોના ફાલવા-ફૂલવાએ પણ સુકૃતોના નાશમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. મૂર્તિપૂજા વિરોધ, દયા-દાન વિરોધ, ધર્મક્રિયા વિરોધ, વગેરેએ પણ સુકૃતોના નાશમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. મૂર્તિપૂજા વિરોધ, દયા-દાન વિરોધ, ધર્મક્રિયા વિરોધ, વગેરેએ પણ સુકૃતોને ધક્કો પહોંચાડ્યો છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૮, તા. ૨૭-૬-૧૯૭૦

(૮૮) (લેખાંક-૨)

ભારત ભૂમિમાં માણસ પરલોક ભાવના અને પાપભયના લીધે સત્સંગ સાધતો, અને પ્રેરણા મેળવી પરલોક હિતકારી દયા, દાન, તપ, ભગવત્પૂજા વગેરે સુકૃતોમાં લાગ્યો રહેતો, જૂઠ અનીતિ વગેરે આચરતાં ખ્યકાતો. એથી અનું પોતાનું ય જીવન સુંદર શાંતિ, ઉન્નતિ અને પ્રસન્નતાભર્યું રહેતું, અને સમાજને પણ એ આશીર્વાદરૂપ બનતો. પરંતુ પાશ્ચાત્ય લોકો અહો ધૂસ્યા, એમની પદ્ધતિની શિક્ષા ચાલુ થઈ, એમનું રાજ્ય થયું, લોકોને શિક્ષાની ડિગ્રીઓનો મોહ જાગ્યો, એના પરિણામે ભૌતિકતા ફેલાઈ, લોક જડવાદથી મોહિત થતા ગયા. તે આજે જડવાદ વિલાસવાદ વગેરે એટલા બધા વધી ગયા કે મોટા ભાગે પરલોક દણ્ણ ઊરી ગઈ, સુકૃતબુદ્ધિ અને સુકૃતો નાચ પ્રાય થઈ ગયા.

આમ આ વાદોએ શું નિપાજાયું? સુકૃતબુદ્ધિનો કષ્ય અને સુકૃતોનો અભાવ. આ એક ભયંકર પરિણામ છે; કેમ કે સુકૃત ઊરાતાં દુષ્કૃત્યો ફાલ્યા-ફૂલ્યાં; પૈસા અને વિષયો દુષ્કૃત સર્જન કરી નરકાદિનાં દુઃખ ઊભા કરે છે માટે એ અસાર છે,’- એવો એના તરફ વૈરાગ્ય ભાવ એ પણ એક સુકૃત છે. પણ પરલોક દણ્ણ જ નહિ, તેથી એ ક્યાં રહે? વૈરાગ્ય નહિ એટલે ગાઢ રાગ ખીલે એ સહજ છે. લક્ષ્મી અને વિષયો સારભૂત મનાય, પછી એની ખાતર હિંસા જૂઠ અનીતિ આદિ કયાં કયાં પાપ ન ચાલે? મદ પ્રપંચ લોભ વગેરે કેવા કષાય ન આવે?

આજ કોર્ટોમાં ઝગડાના કેસ વધી ગયા. કલ્યાણા-મત્સ્યઉદ્યોગ-મરધાપાલન વગેરે દ્વારા હિંસા ખૂબ વધી, હિંસાથી બનતી ચીજોનો વપરાશ ભારે વધ્યો. માલમાં ભેળસેળ આદિ અનીતિ ધૂમ વધી. નવી મજામાં દુરાચાર વધી ગયા. ચોરીઓની રીતો વધી ગઈ. રેડિયો-પિકચર-છાપાં વધવાથી સત્સંગ-ધર્મ શ્રવણ-

વાંચન-પરમાત્મભજન વગેરે ખૂબ ઘટી ગયા, આમ સુકૃત ભૂલવાનું આ બધું જડવાદ-વિલાસવાદ-નાસ્તિકવાદ ફેલાવાના લીધે થયું.

એમ સમાજવાદ-સામ્યવાદ વગેરેએ વાત તો લોકના ભલાની રાખી, પણ ભલું છે ક્યાં? એ વાદોના વિકસવા પછી દેખાય છે કે લાંચરિશવત જુલ્મ ગ્રાસ વગેરે બેફામ વધી ગયા છે. મર્યાદિત લૂંટ ચલાવનાર અમુક રાજાઓના બદલે અમર્યાદિત લૂંટ ચલાવનાર પ્રધાનો ઓફિસરો કારકૂનો અને પટાવાળા સુધી વધી ગયા. આજના વાદોએ આમ સુકૃતક્ષય કરાવી ભયાનકતા સરજ છે.

કુધર્મો પણ એ જ કરી રહ્યા છે. મૂર્તિપૂજા ઉડાવનારે શું કર્યું? માણસ મૂર્તિના આલંબને પરમાત્માની શ્રદ્ધા-ભક્તિ-સ્તવના, દાન વગેરે જે આદરતો, તે મૂર્તિ ઉડાવાથી બંધ પડ્યું. પછી માનસ વિજ્ઞાનના નિયમ મુજબ, જો એ સમયની સાર્થકતા નહિ, એ શુલ્ભ ભાવ અને એ આચરણ નહિ તો નવરો પડેલો સમય અને નવરી આંખ-વાળી-દિલ-પૈસા ક્યાં જાય? રૂપાદિ વિષયોમાં, દુષ્કૃત્યોના તાંડવમાં.

વળી મૂર્તિ ઉડાવવા જતાં એને લગતા શાસ્ત્રો ઉડાવ્યા તો એમાં રહેલી કલ્યાણકર ભક્ષયભક્ષય વ્યવસ્થા, દુષ્કૃત્ય-દુષ્કૃત્ય વ્યવહાર તથા અનેક સદ્ગ વિધાનો પણ ઉડ્યા. તેથી અભક્ષયભક્ષય અદુષ્કૃત્યસેવન વધી ગયા.

એમ, દયા-દાન ઉડાવનાર કુધર્મે કેવાં કેવાં મહાન સુકૃત ઉડાવી અને દુષ્કૃત્યોને જગા કરી આપી, એ પણ સમજાય એવું છે.

ત્યારે બનાવટી અધ્યાત્મવાદ અને બનાવટી નિશ્ચય પંથે તો પવિત્ર ધર્મક્રિયા અને સદ્ગ આચાર-વિચારોનાં સુકૃતો લોપી મહા અનર્થ ઊભા કર્યા, બસ, ‘આત્માને ઓળખો, નિશ્ચયથી વસ્તુ સ્વરૂપ વિચારો, જડકિયામાં ન લોભાઓ,’ આટલો જ ધર્મ માન્યો એટલે પછી યથેચુ વર્તાવ ધંધા ધાપા અને વિષય ગુલામીને છૂટો દોર મળી ગયો;

ત્યારે ‘અંતરનો અવાજ એ ધર્મ’ એવા કુધર્મે વળી છડેયોક અનાચારને જ અભાધિત બનાવ્યા, પછી શું બાકી રહે?

એમ ‘માનવતા માનવબંધુ-પ્રેમ એ જ ધર્મ’ કહેનાર કુધર્મે માનવેતર બીજા જીવોની દયા જ ભૂલાવી; તેમજ વિષયાસક્તિને પાપ જ ન લેખવાથી એને બેફામ વધારી દીધી, જેના પરિણામે આજે કેટલાય અનર્થો ફાલ્યા ફૂલ્યા દેખાય છે.

સારાંશ, કુવાદો-કુધર્મો મજામાંથી સુકૃતની ભાવના, સુકૃતબુદ્ધિ અને એક યા બીજા સુકૃતાચરણનો લોપ કરે છે, અને દુષ્કૃત્યોને બેફામ વધવાનો માર્ગ કરી આપે છે, માટે એ ભયંકર છે.

## ૬૬ જીવનમાં પરલોક માટે કાંઈ જોગવાઈ કરો છો ?

જગતમાં મનુષ્યો બે જીતના, ધર્મ કરનારા, અને ધર્મ નહિ કરનારા. ધર્મમાં નહિ માનનારને તો પરલોક સાથે નિષ્ઠત નથી હોતી. એને વિચાર નથી કે ધર્મ નહિ કરું તો મારું પરલોકમાં શું થશે એટલે એ ધર્મ કરે જ શાના ? ત્યારે પરલોકમાં માનનારા પણ અર્થ-કામની ગાઢ લગન, મોજમજાહ, સુખશીલતા, એશારામી વગેરે કારણે ધર્મ કરવામાં સુસ્ત રહે છે, ને એ ય ધર્મનું આચરણ નથી કરતા.

પરંતુ પરલોકમાં જે માને છે, અને ધર્મનું આચરણ કરે છે એમણે આ વિચારવા જેવું છે કે ‘હું ધર્મ પરલોક સુધારવા માટે કરું છું ખરો ? ધર્મ કરીને એના ફળરૂપે મારે અહીં કશી નામના કે સારાપણાની ઘ્યાતિ અથવા ધર્મી તરીકેનો ઈલ્કાબ, યા અહીં પૈસાટકા-સુખસગવડ નથી જોઈતી, પરંતુ મારે તો પરલોક માટે સુસ્કત અનામત રાખવું છે, મારે સદ્ગતિ જોઈએ છે, પુણ્ય વધીને પરલોકમાં વિશેષ ધર્મસામગ્રી ધર્મબળ અને વિશેષ ધર્મસાહના જોઈએ છે.’ ધર્મ કરતાં આ જ ભાવના રહે છે ખરી ? કે ના, ધર્મનાં ફળરૂપે અહીં જ કીર્તિ-જશ-માન-પૈસા-સુખ સગવડ જોઈએ છે ? પરલોક માટે કશી જોગવાઈ રાખવાની ચોકસાઈ ખરી ?

ધર્મ કરનારે આ જીત-તપાસ કરવા જેવી છે, આભ-નિરીક્ષણ કરવા જેવું છે. નહિતર ગાય દોહીને કૂતરીને પાઈ દેવા જેવું થાય. કરેલા ધર્મસુસ્કતનો અહીં જ બદલો માગી લેવાથી પરલોક ખાતે કશું પુણ્ય ક્યાંથી ઊભું રહે ? અથવા કહો અહીના સુખ-સન્માન-યશની વિશેષ તાલાવેલી અને પરલોક સુધારની સામાન્ય ઈચ્છા છે, તો પણ આચરેલ એ ધર્મસુસ્કત જોરદાર પુણ્ય અને શુદ્ધ ધર્મસંસ્કાર દેવાને બદલે માત્ર મામુલી પુઝ્યાઈ આપે. અહીના માગેલા વિષયસુખો, લક્ષ્મી કે નામનાને સારભૂત સમજવાથી ધર્મસુસ્કતમાંથી શુદ્ધ ધર્મસંસ્કાર ન જને. એટલા જ માટે પરલોક ખાતે પણ એ જ વિષયસુખાઈ ઈચ્છાને નિયાણું કરનારા જીવો ધર્મસુસ્કતના પુણ્યના બળે એ સુખ-સમૃદ્ધિ તો પામે છે, પણ ધર્મસંસ્કાર નહિ, તેથી ત્યાં જીવન પાપભર્યું જીવી નરકાદિમાં રવાના થાય છે.

ઉધારો હિસાબ છે કે વિષયસુખો-પૈસા-બળ-ઘ્યાતિ વગેરે પર મન જોરદાર રહ્યું તો મનને એ જ સારભૂત લાગ્યા, તેથી ધર્મ સારભૂત નહિ લાગે, તો પછી

ધર્મ કરે છે શા માટે ? એનો ખુલાસો એ, કે ધર્મને એક સાધન (medium) ગણી ધર્મ કરે છે. વેપારને પૈસાનું સાધન માનનારો ધાર્યા પૈસા મળ્યેથી વેપાર છોડી દે છે, યા બીજેથી પૈસા સારા મળવાનું દેખી આ વેપારને ત્યજ દે છે, પણ આ વેપારને પકડી નથી રાખતો. એમ, પત્નીને માત્ર વિષયસુખનું સાધન સમજનારો, બીજેથી એ સુખ મળતું દેખી પત્ની પર આદરવાળો નથી રહેતો. એમ ધર્મને માત્ર વિષયસુખો આદિનું સાધન ગણનારો એ ધાર્યા સુખાદિ મળી જતા ધર્મને છોડી દે છે, ધર્મને વળગી નથી રહેતો પછી પરલોકમાં ધર્મ શી રીતે પામે ?

દેવદર્શનાદિ કે દાનાદિ ધર્મ પૈસા માટે યા લોકમાં સારા ધર્મ દેખાવા સારુ નહિ, કિન્તુ પરભવે દેવાધિદેવ અને એમનો ધર્મ પમાડે એવી સદ્ગતિ મળે અને ત્યાં વિશેષ ધર્મ સધાય એ માટે કરવાની બુદ્ધિ હોય તો તો એ પરલોક સુધારે, એ ધર્મને સારભૂત લેખ્યો ગણાય, ને તેથી પરભવે એ સૂજે. પરંતુ ધર્મને માત્ર સાધન બનાવી સુખ-સમૃદ્ધિ સન્માન જ જોઈતા હોય, ત્યાં ધર્મ એ જ સારભૂત એવું ન રહ્યું તેથી પરલોકે એ ન મળે.

એટલે જ ધર્મ કરનારે આ વિચારવાનું છે કે ધર્મ તો હું કરું છું. પરંતુ પરલોક માટે એથી કશી જોગવાઈ કરું છું ખરો ? ધર્મભાતામાં પૈસા દઈને નામની તકતી ચોડાવી, તો પરલોક માટે શું રાખ્યું ? દાનને તો કીર્તિ માટે વેચી દીધું. એમ દર્શન પૂજા કરી સારા ધર્મી તરીકે જશ લઈ ખુશી થયા, તો પરલોક માટે શું રાખ્યું ? તપ કરીને પ્રત કરીને જશ ઈચ્છયો, તો પરલોક ખાતે કશી જોગવાઈ રહી ?

સાજનમંત્રીએ સિદ્ધરાજ જ્યસિંહનાં ખંડણીનાં નાણાં ગીરનાર મંદિરોમાં ખરચી દીધા, પછી સિદ્ધરાજને કહે ‘તમારે આ મંદિરોનું સુસ્કત જોઈએ તો તે લો, યા પૈસા જોઈએ તો એની મેં સગવડ કરી રાખી છે તે લઈ લો.’ ત્યાં સિદ્ધરાજ કહે ‘મારે સુસ્કત ખપે. પૈસા તો માટીના, મૂકીને મરવું પડશે.’ આનું નામ પરલોક માટે જોગવાઈ કરી.

જીવનમાં શુદ્ધ ધર્મ માટે તથા દાન-શીલ-તપ, દયા-અહિસા-સત્ય, ક્ષમા-નિર્લોભતા-બ્રહ્મચર્ય, દર્શન-શાન ચારિત્ર, વગેરે ધર્મ વધારવા માટે આ સૂત્ર વારંવાર રટવા જેવું છે કે ‘હું પરલોક માટે શી જોગવાઈ કરી રહ્યો છું ? એ જ કરતો રહેવા દે. ખાંધું પીધું, ભેણું કર્યું વગેરે તો ખોવાઈ જવાનું.’

## ૧૦૦ આચાર પહેલો ? કે વિચાર ?

આજે એવું પ્રતિપાદન કરવામાં આવે છે કે ‘વિચારશુદ્ધિ જગવો, આચાર ઓછોવતો ચાવે.’ આમ દલીલ એ આપવામાં આવે છે કે ‘અભવી જેવા જગવો પણ ચારિત્ર લઈને આચાર શુદ્ધ પાળનારા છતાં વિચારની શુદ્ધિ નહિ હોવાના કારણે સંસારમાં ભટકે છે. ત્યારે શ્રેષ્ઠિક ફૂષણ મહારાજ જેવા આચારમાં એવા યુસ્ત નહિ છતાં વિચારની શુદ્ધિથી તીર્થકર નામકર્મ કર્માઈ ગયા. વળી આચારમાં ઢીલા પણ સાધુ જો મહાવ્રત અંદર હતા તો સંધમાં રહ્યા; અને જમાલિ જેવા આચાર શુદ્ધ સાધુ વિચારમાં બગડતા સંધની બહાર મૂકાઈ ગયા. માટે વિચાર શુદ્ધ મુખ્ય છે, આચાર શુદ્ધિ નહિ.’

આ પ્રતિપાદન એક પક્ષીય અને ઉંઘે રસ્તે લઈ જનારું છે, અને એથી જ એને બચાવમાં આગળ ધરીને આચારમાં અણાજતી શિથિલતાઓ સેવવામાં આવે છે. એનું પરિણામ એ આવે છે કે ત્યાં માની લીધેલી વિચારશુદ્ધિ પણ ખરેખર વિચારશુદ્ધિ હોતી નથી. જરૂરી આચારનું દેવાણું કાઢીને વિચાર શુદ્ધિ શી રીતે રહી શકે ? દા.ત. મંદિરમાં પ્રભુના વિનય બહુમાનના બાબ્ય આચારની પરવા ન રાખે અને કહે કે ‘મને અરિહંત માટે માન છે, એમના પર પ્રેમ છે, શ્રદ્ધા છે, મારામાં સમક્રિત છે’ એ ક્યાંથી સાચું હોય ? ત્યાં વિચાર શુદ્ધિ શી રીતે હોઈ શકે ?

જે જૈન શાસ્ત્રો સમૃદ્ધશન-જ્ઞાન-ચારિત્રને મોકષમાર્ગ કહે છે, એ જ શાસ્ત્રો જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર પર ખૂબ ભાર મૂકી અને ખાસ આચરવાનાં બતાવે છે. એમાં વીર્યાચારમાં તો કોઈ અલગ આચારો નથી, કિન્તુ જ્ઞાનાચારાદ્ય ચારના જ પ્રકારો ગણાવ્યા છે; છતાં એને ફરીથી વીર્યાચાર તરીકે લેવાનો હેતુ એ આચારોમાં વિશેષ વીર્ય-પરાક્રમ-ઉત્સાહ ફોરવવાનો છે. આ સૂચયે છે કે આચાર એ પાયો છે, આચાર પહેલો છે.

‘ઉપદેશમાળા’ વગેરે શાસ્ત્ર કહે છે ‘જેમ ગધેડો ચંદનના બોજનો ભાગી, પણ ચંદનનો નહિ; એમ ચારિત્ર વિનાનો જ્ઞાની માત્ર જ્ઞાનબોજનો ભાગી, કિન્તુ જ્ઞાનનો નહિ’ અર્થાત્ ચારિત્રાચારના પાલનનો બેપરવા સાધુ જ્ઞાન યાને વિચારશુદ્ધિ ન જગવી શકે.

‘ઉપદેશમાળા’માં એમ પણ કહું કે ‘જો ચયદી ઉત્તરગુણે, મૂળગુણે વિ

અચિરેણ સો ચયદી;’ અર્થાત્ જે ઉત્તરગુણનો ત્યાગ કરે છે, એ થોડા વખતમાં મૂળ ગુણોનો પણ ત્યાગ કરે છે. ઉત્તરગુણો એટલે અવાન્તર આચારો, પેટા આચારો; એની પરવા મૂકી દેનારો એ મૂળગુણરૂપ મહાવ્રત-અણુવ્રતાદિને સાચવી ન શકે. એ ન સાચવનારાના દિલમાં ત્રત ભાવ ઉડે એટલે વિચારશુદ્ધિ ગઈ.

‘ઉપમિતિ’ ‘અષ્ટકજી’ ટીકા શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહું કે સાધુ અને શ્રાવકને ધ્યાનની આરાધના કરવાની તે પોતાના કર્તવ્ય આચારો બજીવ્યા પછી. આ સૂચયે છે કે આચારનું કેટલું બધું મહત્વ છે.

અલબત્ત અનાદિના ચાલી આવતા અશુદ્ધ ભાવમાં સુધારો થઈ સહેજ શુદ્ધ વિચાર આવે ત્યારે જીવને સદ્ગ આચાર સૂઝે. એ હિસાબે વિચાર શુદ્ધ પહેલી ગણાય. પરંતુ એ તો પ્રાથમિક અવસ્થા. બાકી ત્યાં જો આચાર થોડા ય શુદ્ધ ન કરે તો વિચાર શુદ્ધ કેટાડો પડે, શ્રેષ્ઠ રાજ પ્રતાદિના આચાર ન પાળી શક્યા, કિન્તુ સોનાથી રોજ જિનભક્તિ, જિનવાણીશ્રવણ, પ્રભુની સુખશાતાના સમાચાર લાવનારને મોટાં બક્ષીસદાન વગેરે આચાર સુંદર પાળતા. ત્યારે જ ક્ષાયિક સમ્યક્તવાદિની ઊંચી વિચાર શુદ્ધિ પાય્યા.

શુદ્ધ આચારથી પોતાની વિચાર શુદ્ધ વધતી આવે છે, અને બીજાઓને સદ્ગ આચારની પ્રેરણા મળે છે. બીજાઓને અંદરના વિચાર દેખાતા નથી, આચાર દેખાય છે. હતરોને સારા આચાર જોવા મળવા પર જ સારી છાયા પડે છે. આજે પણ જૈન સાધુની સારી છાયા એમના કડક સદ્ગાચારોને લીધે પડે છે. એમ શ્રાવકોના સારા જૈન-આચાર જોઈ એમના સંતાનો સંસ્કારી સદ્ગાચારી બને છે. સારા આર્ય આચાર પર ભારતીય સંસ્કૃતિ વિશ્વશ્રેષ્ઠ મનાતી હતી. ધર્મનો ટકાવ સંધમાં સારા આચાર પળતા આવ્યા પર થયેલો છે.

માટે, જીવનમાં આચાર પર ભારે મહત્વ દેવા જેવું છે. સારા ભાષણની અસર તો જ પડે કે જો એની પાછળ ભાષણ કર્તાના જીવનમાં સારા આચાર જોવા મળે. તેથી તો અકબર બાદશાહને આચાર્યદિવ શ્રી વિજય હીરસૂરીશ્વરજી મહારાજને મળવા-સાંભળવાની ઘણી ઝંખના હતી; અને એણો એઓશ્રીને દિલ્હી જલદી પધારવા જ્યાના-પાલખી-ઘોડા વગેરેની સગવડ કરી હતી, છતાં આચાર્ય મહારાજે એનો લેશ પણ ઉપયોગ ન કરતાં પાદવિહારથી જ સાધ્વાચારમાં રહી દિલ્હી જવાનું કેરેલું, અને ત્યાં ગયા પછી ય એમના કેટલીય બાબતમાં કડક સાધ્વાચાર બાદશાહને જોવા મળેલા, તેથી એ ફૂર-ધાતકી-હિંસક મટી કોમળ અને દયાળું બન્યો. આની સામે આજે સાધ્વાચાર ભાગી વિમાનમાં પરદેશ જનાર કોઈને શું પમાડી શકે ? ઊંલટું જૈન ધર્મનું અવમૂલ્યાંકન કરાવે.

વ्यवहारना ઉચ्छेदમાં શાસન-તીર્થનો ઉચ્છેદ થાય. શ્રી મહાવીર પરમાત્માએ સ્થાપેલ શાસન સંધમાં આજ સુધી સતત ચાલ્યું આવ્યું છે તે સંધ વ्यવહાર-આચાર-અનુષ્ઠાનોને વળગી રહેતો આવ્યો છે એના આધારે જ. ત્યારે જે ધર્મમાં આચારબદ્ધતા નથી રહી એના માનનારની માત્ર સંખ્યા જ ગણાય છે; એમના જીવનને ધર્મપાલન સાથે કશો સંબંધ નથી. જૈન ધર્મને સ્વ-પરમાં ટકાવવો હોય તો આચાર ચુસ્તતા રાખવા-રખાવવાની અતિ આવશ્યકતા છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૪૧, તા. ૧૮-૭-૧૯૭૦

## ૧૦૧ ‘દિલ અટકો તોરા ચરણ કમળમે’

(લેખાંક-૧)

કવિએ પાર્શ્વનાથ પ્રભુના સતવનમાં ગાયું કે ‘ઉદ્યરતન કી યેહી અરજ હૈ દિલ અટકો તોરા ચરણ કમળ મેં... પાસ શામલિયા વસો મેરે દિલમે.’

આમાં વિરોધાભાસ દેખાય છે. કેમ કે પહેલાં માયું કે ‘મારું દિલ પ્રભુના ચરણમાં અટકી જાઓ યાને સ્થિર થઈ જાઓ.’ એમાં તો દિલ પ્રભુચરણે સ્થિર થવાનો અર્થ એ કે દિલ ત્યાં જઈ સ્થિર થવામાં આત્મામાંથી નીકળી ગયું. તો હવે, પછી કહેવું કે ‘પ્રભુ ! વસો મેરે દિલમે’ એ કેમ બને ? દિલ તો પ્રભુ ચરણે સ્થિર થયું છે, એ દિલમાં પ્રભુ કેમ વસાવી શકાય ? આ વિરોધાભાસ દેખાય છે. અથવા પ્રભુચરણે દિલ અટક્યું એટલે બીજા પદાર્થોમાં જતું રોકાયું, અને પ્રભુના ચરણમાં સ્થિર થયું તો હવે દિલમાં પ્રભુને શી રીતે વસાવવા ?

કિન્તુ અહીં વિરોધનો આભાસમાત્ર છે, ખરેખર વિરોધ નથી. કેમ કે ‘દિલ’ શર્જના બે અર્થ લેવાના,-(૧) મનનો ઝોક વલણ, (Trend of mind), અને (૨) મનથી થતું ચિંતન. હવે ‘દિલ અટકો તોરા ચરણકમળમે’ એટલે કે ‘મારા મનનું ચિંતન પ્રભુના ચરણ અંગે થાઓ;’ અને તે માટે ‘પ્રભુ ! વસો મેરે દિલમે’ અર્થાત્ મારા મનના વલણમાં પ્રભુ વસી જાઓ; વલણમાં જે અહંત્વ વસે છે. તેથી આપમતિનું વલણ ધોરણ રહે છે, એના બદલે પ્રભુ વસો, જેથી પ્રભુના ધોરણ-સિદ્ધાંતના હિસાબે મનનું વલણ રહે, મતિ ચાલે. પછી ચિંતન જે ચાલો, તે પ્રભુચરણ અંગે ચાલો. આ બે માગણીમાં કોઈ વિરોધ નથી. એકમાં ચિંતનની પદ્ધતિ માણી, બીજામાં ચિંતનનો વિષય માણ્યો.

દિલમાંથી અહંત્વ નીકળી જાય અને પ્રભુ વસે એટલે આપમતિની પદ્ધતિનું ચિંતન બંધ થઈ પ્રભુના ધોરણ સિદ્ધાંતની પદ્ધતિએ ચિંતન થાય. અહંત્વ-આપમતિમાં ‘મને આમ લાગે છે, હું આમ ધારું છું,’ એવા ભાવ રહે છે; ત્યારે અહંત્વ નીકળી જઈ દિલમાં પ્રભુ વસાવથી દિલનો કબજો હવે પ્રભુએ લીધો. તેથી જ્ઞાનો પ્રભુ વિચારતા હોય એ પદ્ધતિએ આપણું દિલ વિચારે; જ્ઞાનો પ્રભુ જ આપણા દિલને ચલાવે.

દિલ આપમતિથી આશ્રવ થાય એ રીતે વસ્તુને વિચારે છે. દા.ત. હીરો સામે આવ્યો તો ‘આ બહુ સરસ, ભારે કિંમતી, શોભા આપે એવો...’ હિતાદિ રીતે વિચારે છે, અને એમાં રાગ વગેરે પોખાવથી પાપકર્મનો આશ્રવ થાય છે, બંધ થાય છે. પરંતુ જો દિલ પ્રભુના સિદ્ધાંતથી વિચારે, ‘અરે ! આ હીરો તો એના એક જીવનકાળમાં માણસની કેટલીય પેટીઓના સત્યોને મહા રાગ દુર્ઘાન કરાવી તિર્યં-નરકગતિનાં ભાતાં બંધવનારો ! સોનું ચાંદી જે રાગ-દુર્ઘાન કરાવે એના કરતાં હીરો જાલિમ રાગ અને ભયંકર દુર્ઘાન કરાવે છે. હીરો આધો પાછો થતાં ચિંતને ભારે કલેશ-આર્તથાન અને વધીને કદાચ રૌદ્રથાન થાય છે. વળી હીરો પ્રભુને ય ભુલાવે છે કેવો ભયંકર એ હીરો ? ગિરિરાજ પર આદીશર દાદા જોવા-પૂજવા મળ્યા હોય, પરંતુ જો ત્યાં પોતાના ગળામાંનો હીરાનો નેકલેસ ભીડમાં જરા બેંચાતો હોય એમ લાયું તો તરત આદીશર દાદાને પડતા મૂકી એની સંભાળ કરાય છે. અને જો બેંચાઈ ગયો એમ દેખાયું તો તો મહા ધાંધલ શરૂ થઈ જાય છે, ‘કોણ હરામખોર હાર બેંચી ગયો ? હાથમાં આવે તો એને પીઠી નાખું’ એવા રૌદ્રથાનના વિચારમાં પણ ચિત્ત ચડી જવા સંભવ. ત્યારે હીરો કેવો ગોળારો ?’ આમ ‘મહાલક્ષ્મી મહા અનર્થનું મૂળ’ એવા પ્રભુના સિદ્ધાંતને અનુસારે જો દિલ વિચાર પદ્ધતિ રાખે તો એ આશ્રવના બદલે સંવરમાં ઊતરે, કેમ કે એમાં રાગ દુર્ઘાન વગેરેની અટકાયત થાય, વૈરાગ્ય અને શુભ વિચારણા ચાલે.

આ તો એક દાખલો જોયો. જીવનમાં તો અનેકાનેક જડ ચેતન પદાર્થોના સંપર્ક આવે છે એ બધામાં આશ્રવને બદલે સંવર પદ્ધતિથી વિચારણા થાય, લેખા મંડાય, મહાત્વ-બિનમહાત્વ અપાય, તો દિલમાં પ્રભુને વસાવ્યા ગણાય.

‘દિલમાં પ્રભુ વસો’ એટલે પ્રભુએ ઈન્દ્રિય-ધન-વિષયો-રાગી પરિવાર, ડિસાદિ પ્રવૃત્તિ, કોધાદિ કખાયો વગેરે આશ્રવને હેય-ત્યાજ્ય કહ્યા તો દિલ એના પ્રત્યે જ્વાનિ-ભડક-અનાસ્થાવાળું બનો. અને ત્યાગ-તપ-સંયમ-જિનભક્તિ-સાધુસેવા-દ્યાદિ સંવરને પ્રભુએ ઉપાદેય-આદરણીય કહ્યા, તો દિલ એના પ્રત્યે રૂચિ-આસ્થા-નિરાંત-પ્રહૃલિતતાવાળું બનો.

ગ્યા લેખમાં એ જોયું કે ‘પ્રભુ ! વસો મેરે દિલમે’ એટલે કે મારું દિલ, મારી વિચારસરણી મારી મતિ સ્વેચ્છાએ નહિ પણ પ્રભુ ! આપનાથી પ્રેરિત હો, જ્ઞાન આપ પ્રવર્તિઓ છો એ રીતની અર્થાત્ આપનાં તત્ત્વ-સિદ્ધાંતના અનુસારે પ્રવર્તનારી હો.

હવે સવાલ થાય કે ‘જિનોકિ તત્ત્વ-સિદ્ધાંતના અનુસારે પણ કેવું દિલ કયા વિષયની વિચારસરણી પ્રવર્તિઓ ઉત્તમ છે ?’ તો કહ્યું કે ‘દિલ અટકો તોરા ચરણ કમળમે.’ અર્થાત્ મારું દિલ મારી વિચારસરણી પ્રભુ ! તારા ચરણમાં જ પ્રવર્તો, બીજા વિષયો પરથી ખસીને આમાં જ સ્થિર થાઓ.’

‘પ્રભુચરણમાં દિલ લાગવું, દિલની વિચારસરણી પ્રવર્ત્યા કરવી,’ એનો અર્થ એ, કે વીતરાગ પરમાત્માનાં ચરણે દિલ સ્થાપી એમનાં સ્વરૂપ, જીવનસાધના, ગુણો અને ઉપકારો અંગેની વિચારસરણી ચાલ્યા કરવી.

પ્ર.- અહીં પ્રભુના મુખ ઉપર કે પ્રભુની ચક્ષુ વગેરેમાં દિલ સ્થાપવાનું, દિલ અટકવાનું ન કહેતાં પ્રભુનાં ચરણે અટકવાનું કેમ કહ્યું ?

૩.- પ્રભુચરણ એવી ચીજ છે કે એમાં દિલ અટકાવવાથી યાને દિલ સ્થાપવાથી આપણા આત્મામાં વિનય, સેવકભાવ અને શરણ સ્વીકારભાવ ઊભો થાય છે. એ ભાવથી પછી જે ચિંતન થવાનું તે ખૂબ જ ગદ્દગદ અને સંવેગ રંગભર્યું થવાનું. એવા સંવેગ-ઉછળતા ગદ્દગદ ચિંતનનો મહિમા અનેરો છે. એમાં ય ચરણમાં મનથી બે હાથ જોડી માથું નમાવીને ચિંતન-પ્રાર્થના-સુતિ થાય એનો દિલ પર મોટો પ્રભાવ પડે છે, ભાવ બહુ ભીના બને છે.

દા.ત. પ્રભુને પ્રાર્થના કરવી છે કે ‘હે પ્રભુ ! મારે તમારું શરણ છે; હું મોહ અને કર્મને પરાધીન બની મારે આ ઘોર સંસારમાં ભટકતું રહેવાનું થયું છે; હવે તમારા પ્રભાવે મને આ સંસાર પર જ્વાનિ વરસો. સંસારી વસ્તુ પાછળ થતા મોહના વિકારો રાગ-દ્રેષ, કામ-કોષ-લોભ વગેરે પર ઘૂણા થાઓ, ફિટકાર વરસો. પ્રભુ ! આપના પ્રભાવથી મારામાં સદ્ગુરૂજી આવો.’ આવી પ્રાર્થના કરવી હોય, એ પ્રભુના મુખ સામે કે પ્રભુની ચક્ષુ સામે જોઈને ય થઈ શકે; તેમ પ્રભુના ચરણની પર દિલ રાખીને, અથવા મનથી પ્રભુના ચરણમાં બે હાથની અંજલિ અને માથું અડાઈને ય થઈ શકે. એમાં અનુભવાય છે કે મુખ કરતાં ચક્ષુ ઉપર દિલ, અને એના કરતાં ચરણ પર દિલ અધિક ભાવભર્યું બને છે;

અને એ કરતાં ચરણમાં અંજલિ માથું ઢાળીને પ્રાર્થના કરવામાં આવે એમાં તો વળી દિલ વધુ ગદ્દગદ અને શરણભાવ સ્વીકારતું બને છે.

સુતિમાં ય એવું છે. પ્રભુના ચરણમાં મનથી અંજલિ દિલ અને માથું અડાઈને જો સુતિ થાય, દા.ત. બોલાય કે ‘પ્રભુ ! તમે અરિહંત છો, ભગવંત છો,... ધર્મના દાતા છો, ધર્મના ઉપદેશક છો, ધર્મના નાયક-સારથિ-ચક્વર્તી છો...’ તો એ બોલતાં દિલ ખૂબ ગદ્દગદતા અનુભવે છે, હૈયું પ્રભુનું શરણ સ્વીકારે છે; અને એથી પ્રભુની વિશેષતાઓ જેવી કે અરિહંતપણું, ભગવંતપણું, ધર્મદાતાપણું, ધર્મદિશકપણું... વગેરેનું ઊંચું મૂલ્યાંકન કરે છે.

‘દિલ અટકો તોરા ચરણ-કમળમે’નો ભાવ આ છે કે પ્રભુના ચરણકમળમાં મનથી અંજલિ, દિલ, અને માથું સ્થાપીને કહીએ છીએ કે પ્રભુ ! તારા ચરણમાં મારું દિલ, મારી વિચારધારા, મારી સુતિ-પ્રાર્થના ચાલો.

પ્રભુચરણમાં દિલ-ચિંતન-વિચારધારાનો અર્થ એ કે પરમાત્મસ્વરૂપ, પરમાત્માની જીવનસાધના, પરમાત્માના ગુણો, અને પરમાત્માના ઉપકાર સંબંધી ચિંતન. (૧) પરમાત્મસ્વરૂપ એ ચિંતવવાનું કે ‘પ્રભુ ! તું વીતરાગ સર્વજ્ઞ, ચોત્રીસ અતિશયુક્ત, સુરાસુરેન્દ્ર પૂજ્ય અને પરમ આપું પુરુષ યાને ત્રિકલાબાધ્ય ત્રિલોકતત્ત્વનો યથાર્થ વક્તા છે.’ (૨) જીવનસાધનામાં ચિંતવવાનું કે ‘પ્રભુ ! તારી કઠોર અપ્રમતા તપ-સંયમસાધના, પરીસહ-ઉપસર્ગ-સહન, સતતત કાયોત્સર્ગધ્યાન અને આંતર ઉપશમ, શત્રુ પર પણ કરુણા, અને અનાસકત જીગૃતિ અદ્ભુત છે.’ (૩) ગુણોમાં એ ચિંતવવાનું કે ‘પ્રભુ ! તમે બાળપણે પણ કેવા અદ્ભુત જ્ઞાની, વૈરાગી, ગંભીર અને ઉદાર ! મોટા થયે કેવા ભોગો પ્રત્યે નિષ્પૃહ ને વૈભવ પ્રત્યે અનાસકત ! ચારિત્રજીવનમાં મહા ઉપસર્ગો વખતે પણ કેવા ધીર, વીર, સહિષ્ણુ, સમતાધારી! કેવા મહા અહિસક, દયાળુ, નિર્માય !...’

(૪) ઉપકારમાં પ્રભુનો ત્રિવિધ ઉપકાર, માર્ગદાન, તત્ત્વજ્ઞાનદાન, અને અનન્ય આલંબનદાનનો,- વિચારવાનો. (i) માર્ગમાં મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાર્ગ પ્રભુ કેવો આપે છે ! (ii) તત્ત્વજ્ઞાનમાં જીવ-અજીવ આદિ તત્ત્વો ને સ્યાદ્વાદ આદિ સિદ્ધાંત કેવા આપે છે ! તેમજ (iii) આલંબનમાં દર્શન-સુતિ-પ્રાર્થના-જ્ઞાપ-ધ્યાન-સ્મરણ-ગુણગાનમાં પ્રભુ કેવું અનન્ય આલંબન બને છે. એમનાં જ એ દર્શનાદિ ફળે છે, પ્રભુને આદર્શરૂપે નજર સામે રાખવાથી કેવી આરાધના સ્ફુરે છે, આરાધનામાં કેવું જોમ ચેડે છે, અને ઠેઠ વીતરાગ બનવા સુધી આરાધનામાં કેવી સ્થિર અને ચડતા વેગવાળા બનાય છે, એ વિચારવાનું. આમ, ત્રણ રીતે પ્રભુ કેવા અનુપ્રમ ઉપકારી છે એ ચિંતવવાનું. એમાં માર્ગ અને તત્ત્વનો ઘણો ઘણો

વિસ્તાર વિચારી શકાય. ‘દિલ અટકો તોરા ચરણ કમળમે’થી પ્રભુ પાસે આ ચિંતન માગીએ છીએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૪૩, તા. ૧-૮-૧૯૭૦

### ૧૦૩ ભવસ્થિતિ-પરિપાક : ચાર શરણનો ચમત્કાર કેમ સર્જય ?

‘શ્રી પંચસૂત્ર’ શાસ્ત્ર કહે છે કે,-

(૧) અનાદિથી ચાલી આવતા પણ સંસાર અને કર્મસંયોગ-પરંપરાનો ઉચ્છેદ શુદ્ધ ધર્મથી થાય;

(૨) શુદ્ધ ધર્મ પાપકર્મ (સાનુબંધ મિથ્યાત્વકર્મ)ના નાશથી પ્રાપ્ત થાય;

(૩) એ પાપનાશ તથા ભવસ્થિતિ ભાવોથી થાય યાને ભવસ્થિતિના પરિપાકથી થાય, કાચી ભવસ્થિતિ પાડી જવાથી થાય; અને

(૪) એ પકવવાનાં સાધન ગ્રાણ-૧. ચાર શરણનો સ્વીકાર, ૨. દુર્જ્ઞતગછી, અને ૩. સુકૃતાનુમોદન.

‘ભવસ્થિતિ’ એટલે અમર્યાદિત સંસારકેદ; અર્થાત્ સાનુબંધ ભવ-સંસાર; ભવમાંથી ભવ, ભવમાંથી ભવ, ભવમાંથી ભવ,... એમ ભવપરંપરા ચાલ્યા જ કરે એવી માત્ર બંધન વધારનારી આત્મદશા. આ ભવસ્થિતિનો ‘પરિપાક થાય’ એટલે એ ભવપરંપરા મર્યાદિત બની જાય. તાત્પર્ય ભવ ભવોને વધારનાર ન બને એવી આત્મદશા એ ભવસ્થિતિનો પરિપાક થયો, ભવસ્થિતિ પાડી ગણાય; ત્યારે ભવમાંથી ભવોની વૃદ્ધિ થાય એવી આત્મદશા એ અપકવ ભવસ્થિતિ ગણાય.

અપકવ એટલે કે અકંધ ભવસ્થિતિની આત્મદશા ભવાભિનંદીપણા ઉપર નભે છે; ભવાભિનંદીપણું એટલે એવી મનોદશા કે જેથી સંસાર નિર્ભયપણે આનંદ મંગળરૂપ લાગ્યા કરે. સંસારમાં અનુકૂળ લાડી-વાડી-ગાડી, મેવાભિષાન, માનસ-ન્માન-ઠકુરાઈ, મોજમજાહ-એશારામ વગેરેમાં મહાસુખ અને નિશ્ચિન્તતા લાગે, એ ભવાભિનંદિતા. એના પર ભવવૃદ્ધિ સરજાય. ત્યાં અપકવ ભવસ્થિતિ ગણાય. એમાં મહામિથ્યાત્વ પાપ પોષાયા કરે.

એ તો ભવસ્થિતિ પાકે અને ભવાભિનંદિતા ટળે, તો એ પાપનું પોષણ મટી શોષણ થાય. પણ ત્યાં એ પાપ નાણ થતાં જીવને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય; ને એથી જ સંસારનો ઉચ્છેદ થઈ મુક્તિ થાય. આ ભવસ્થિતિ-પરિપાક અને

ભવાભિનંદિતા-નાશના અહીં ચતુઃશરણાદિ ત્રણ સાધન બતાવ્યાં.

તો સવાલ એ છે કે એ સાધન પૈકી ચતુઃશરણ-સ્વીકાર આદિનો એવો તે શો પ્રભાવ છે કે એનાથી ભવસ્થિતિ પાડી જાય, ભવાભિનંદિતા ટળે, ને ભવપરંપરા વધતી અટકી જાય ?

આનું સમાધાન એ છે કે આ ત્રણ સાધન સાધવામાં આત્માની દશા ભવથી ઊભગેલી બને છે, ને એ સહેજે ભવાભિનંદીપણાને તોડી નાબે. એમાં પહેલું સાધન ચાર શરણ સ્વીકાર કેવા રૂપે થાય તો એ અનાદિની ચાલી આવતી પણ ભવસ્થિતિને પકવી નાખવાનો ચમત્કાર સરજે, એ વિચારવાનું છે. ચાર શરણ એટલે અરિહ્ંત સિદ્ધ સાધુ અને સર્વજ્ઞકથિત ધર્મનું શરણ. એ શરણ આપેણ વારંવાર સ્વીકારવાનાં છે; ‘(૧) હે અરિહ્ંત ! મારે તમારું શરણ છે. (૨) હે સિદ્ધ ભગવાન ! હું તમારે શરણ છું. (૩) હે સાધુ મહારાજ ! મારે તમારું શરણ છે. (૪) હે સર્વજ્ઞ કહેલ ક્ષમાદિ ધર્મ ! મારે તારું શરણ છે.’ દિલના કેવા ભાવ સાથે આ શરણાં સ્વીકારાય તો એ ભવસ્થિતિને ભવકેદની મુદ્દતને પકવી નાબે એ વિચારવા જેવું છે.

અહીં દણાંતથી આના ઘ્યાલ આવી શકે છે. દા.ત. માણસ જંગલમાંથી ૫૦ લાખ રૂપિયાના ઝવેરાત સાથે પસાર થતો હોય, એમાં અચાનક દૂર લૂંટારાઓ ‘પકડો, મારો, પડાઓ’ના અવાજ સાથે દોડતા આવતા દેખાય, તો એ વખતે એ પ્રવાસીને ગભરામણનો પાર ન રહે. હવે જો ત્યાં કોઈ મીલિટરી પોલિસ ટૂકડી પસાર થતી દેખાય, તો આ પ્રવાસી એનું કેવું શરણ સ્વીકારી રક્ષણ માગે ? એ કહે ‘અરે ભાઈ ! આ પેલા લૂંટારા મને લૂંટી મારી નાખશે. તો ભાઈસાહેબ ! મને બચાવો મને રક્ષણ આપો. મારે બીજો કોઈ આધાર નથી. મારે તમારો જ આધાર છે...’ આ બોલતી કરગરતી વખતે દિલ પેલા ભયથી ફફડતું હોય અને રક્ષણનો આધાર એકમાત્ર આ પોલિસ જ લાગે.

એમ, પોતાનું દસ માણસનું કુટુંબ ગરીબીમાં દિવસોથી ભૂખે મરતું હોય, પોતાને ક્રયાંથી રેશનાના પેસાની ય પ્રાપ્તિ ન થતી હોય, એમાં કોઈ દાતાર શ્રીમંત જરી જાય, તો એની પાસે જઈ કેવા ભાવથી રક્ષણ માગે ? એના પર કેટલો વિશ્વાસ ધરીને એને સહાય માટે કરગરે ?

એવી રીતે, અસાધ્ય જેવા કોઈ દરદમાં અનેક ઉપચાર નિષ્ફળ ગયા હોય, હવે અકાળે મરવાનું આવવાનો ભય હોય, એમાં બહારથી કોઈ નામી વૈદ આવી ચેદે, એ કેવો કીમિયાગર અને વળી મંત્રાદિનો જાળકાર તથા એવા કેટલાય દરદવાળાને સુધાર્યાના પ્રમાણપત્રોવાળો હોય, તો એની પાસે જઈને આ દરદી કેવા ભાવથી અને કેવો એને આધાર માની એનું શરણું લે ?

બસ, આ રીતે (૧) રાગાદિ અને કર્મ મહા લૂંટારાનો ભય પામી, (૨) જ્ઞાન-ચારિત્રાદિ મહાધન વિનાની અજ્ઞાનાદિ મહાગરીભીથી ગ્રાસી, તથા (૩) દુર્ગિતિઓની પરંપરાના મહાદુઃખ અને મહાપાચચરણરૂપી અસાધ્ય જેવા ભયંકર રોગથી ઊભગી જઈ, અરિહંતાદિ ચારને મીલીટરી, શ્રીમંત અને મહાવૈદ જેવા એકમાત્ર આધારભૂત રક્ષક તારક સમજે ને એમને કરગરવા સાથે એમનું શરણ યાચે, શરણ સ્વીકારે. એવો શરણ-સ્વીકાર વારંવાર કરાય, તો એમાં સંસારસુખો-વિષયો વગેરેનો ભય દઢ થાય, ને એથી સંસારરસ ભવાભિનંદિતા તૂટે, ભવસ્થિતિનો પાક થવા માંડે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૪૪, તા. ૮-૮-૧૯૭૦

## ૧૦૪ જીવન પર મનોદશાની અસર

જીવન પર મનોદશા બહુ મોટી અસર કરે છે. જીવન સુખમય કે દુઃખમય, ગુણોથી મધ્યમધ્યનું કે દોષોએ ખદબદ્ધનું, સુકૃત અને પરછિત સાધ્યનું યા દુષ્ટ્યો અને સ્વાર્થની રમત રમતું વગેરે બનવાનો આધાર મનોદશા પર છે. જેવી મનોદશા તેવું જીવન. સારી મનોદશા પર જીવન સુખ-સદ્ગુણ-સુકૃત ભર્યું બને છે. અને અધમ મનોદશા પર એ દુઃખ-દોષ-દુષ્ટ્યો ભર્યું બને છે. તેથી જ મનોદશા પર ખાસ લક્ષ રાખી એને ઉદાર ઉત્તમ પવિત્ર રાખવાનો ચાલુ પ્રયત્ન જરૂરી છે.

સહેજ ઊડાણથી ન જોવાના હિસાબે મનને એમ થાય છે કે ‘સુખ તો સારા વિષયો તથા પૈસા-પરિવાર-પ્રતિષ્ઠાદિથી મળે, એમ મનોદશાથી શી રીતે મળે?’ પરંતુ આ તો ઉપલક્ષ્યા દાણિનો નિયમ બાધ્યો, પણ તે ખોટો છે. કેમ કે આજે દુનિયામાં દેખાય છે કે વિષયો-પૈસા વગેરે પામેલા ઘણા માણસ દુઃખની પોક મૂકે છે; તેમ જ પોતાના જીવનમાં પણ અનુભવાય છે કે વિષયો-પૈસા બધું છતાં કઈ વાર ચિંતા-દુઃખ-સંતાપની આગ સળ્યો છે. તેથી વિષયો-પૈસા વગેરેથી સુખ મળે એવો નિયમ ખોટો હરે છે.

સંયોગ-પરિસ્થિતિ ફરતાં સુખ ઊડે છે. રસ્તે ચાલ્યા જતાં કોઈની પાસેથી બહુ સસ્તામાં હીરાનો હાર ખરીદી સુખ લાગ્યું; પરંતુ પછીથી આગળ વધતાં એ ચોરીનો માલ હોવાનું અને ત્યાંથી આગળ જતાં ઝડતી લેવાઈ પકડતાં સાત વરસની જેલ ધોકાવાનું જો સાંભળ્યું, તો એ જ હાર દુઃખરૂપ લાગે છે. પદ્ધતાની ભાતા સુખ લાગ્યું પરંતુ પછીથી પેટ પૂરું ભરાઈ ગયે સામેથી અતિ આગ્રહ થતાં ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૨૦૮

એ જ પદ્ધતાની ખાવામાં દુઃખ લાગે છે. અથવા ખાવા બેઠા ત્યાં જ મોકાણના સમાચાર આવતાં એ જ પદ્ધતાની દુઃખરૂપ લાગે છે. રૂપાળી અને હજારો રૂપિયા લઈ આવેલી કન્યા પરણી સુખ લાગ્યું, પરંતુ પછીથી એ અભિમાની અને ચારની વચ્ચે વારંવાર અપમાન કરનારી દેખતાં દુઃખરૂપ લાગે છે. આમ જો સંયોગ-પરિસ્થિતિ ફરતાં એની એ જ પૈસાદિ વસ્તુમાંથી સુખ ઊડ્યું, તો પૈસા-પરિવાર-પદ્ધતાનથી સુખ જ થાય એવો નિયમ કર્યાં રહ્યો?

સુખ-દુઃખનો નિયમ મનોદશા ઉપર છે. મનોદશા સારી હોય તો સુખ, નરસી હોય તો દુઃખ. હીરાનો હાર બહુ સસ્તામાં મળતો હોય ત્યાં અનીતિનું નહિ લેવાની મનોદશા હોય તો ઝટ વિચાર આવે કે ‘સામો આટલો સસ્તો કેમ આપે છે? સંભવ છે અનીતિનો હોય, યા બોગસ બનાવટી હોય. માટે એની સામે ય નહિ જોવાનું.’ આમ કરી એ ન લે, તો પછી બનાવટી સુખ પણ નહિ અને પાછળનો ભારે સંતાપ પણ નહિ. એમ સારી મનોદશાથી પદ્ધતાનને અંતે માટી થનારું, અને એ મહારાગથી ખાતાં ઘોર કર્મબંધ તથા ભારે કુસંસ્કાર કરાવનારું સમજે તો એમાં સુખ જ નહિ લાગવાથી પછીથી દુઃખ થવાને જગા નહિ રહે. એવું, વૈરાગ્યની મનોદશા પર, હજારો રૂપિયા લઈને આવનારી રૂપાળી કન્યામાં ય જો સુખનો આભાસ નહિ, તો એના અપમાન પર દુઃખ પણ નહિ.

પ્ર.- તો પછી સારી મનોદશામાં દુઃખ નહિ, એમ સુખ પણ ન રહ્યું ને?

૩.- ના, સારી મનોદશા પર ચિંતને મહા સ્વસ્થતા હોય છે, અને એ જ ખરેખરું સુખ છે. કોઈ માણસ પાસે પૈસા બહુ હોય, પરિવાર હોય, સત્તા-હોદ્દો હોય, પરંતુ જો મનોદશા એવી હોય કે ‘આપણે તો બધે જ માન મેળવું, સારાપણું લેવું, જશ લેવો,’ તો એમાં ચિંત અસ્વસ્થ રહેવાનું; કેમ કે ચિંત બિચારું એ જ શોધા કરવાનું; એ માન-જશ ઊભો કરવાની વિટંબણામાં પડવાનું. એમાં બધે સફળતા ન મળવાથી હતાશ થવાની. આમાં ચિંત કર્યાં સ્વસ્થ શાંત ખુશનુમા રહ્યું?

મનોદશા કુદ્ર અધમ અપવિત્ર રહેવાથી ચિંત ગુણને બદલે દોષમાં અને સુકૃતને બદલે સ્વાર્થમાયાની રમતમાં રાયે છે, રચ્યુંપચ્યું રહે છે. દા.ત. ‘દુનિયામાં ઠગ ઘણા, તેથી શર્દ પ્રતિ શાઠય્યું, થાય તેવાં થઈએ તો ગામ વચ્ચે રહીએ,’- આવી જો મનોદશા હશે, તો પછી એ સરળતા, સત્ય, શાંતતા વગેરે ગુણોનો ખપ શા સારું કરે? ‘પસીનો ઉતારી પૈસા કમાયા છીએ, એ પૈસા કાંઈ મફતિયા ફેંકી ન દેવાય’-આવી મનોદશા પર શી રીતે એ દાનાદિ સુકૃત કરે?

મનોદશા એટલે મનનાં ગણિત-ધોરણ-લેખાં એ ઊંધા હોય તો સુખ-સુકૃત-ગુણો વા ખાય. ‘ખાંધું એટલું બાપનું,’ ‘દુનિયા દંડાની ઘરાક,’ ‘મળે એટલું છોડવું

૨૧૦ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

નહિ,' 'પૈસાને સૌ નમે,' 'શરીર છે તો બધું છે,'... આવા આવા હિસાબ-ધોરણ-દેખાં માંડી રાખ્યા હોય એ ત્યાગ, નપ્રતા, સંયમ, સંતોષ, આત્મચિંતા ક્યાંથી કરી શકે ? એ તો તો જ બને કે જો હિસાબ એવા માંડી રાખ્યા હોય કે, 'ત્યજ્યું એટલા પાપથી બચ્યા,' 'નમે એ સૌને ગમે,' 'લોભ એ પાપનો બાપ,' 'પૈસો પ્રભુને ભુલાવે,' 'શરીર સાધના માટે છે,'

ટૂંકમાં, જડ માયાના વિકાસમાં આબાદી માનવાની મનોદશા પડતી ભૂકી, એમાં બરબાદી દેખવાની અને પ્રભુએ કહેલા માર્ગમાં આબાદી જોયા કરવાની તથા એને જ મહત્વ આપવાની મનોદશા ખૂબ કેળવવા જેવી છે. સુખ-સુકૃત-ગુણોની એ ખાણ છે. એવી મનોદશા પર જીવન સુખ-સુકૃત-ગુણોભર્યું સરજાય.

"દિવ્ય-દર્શન"-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૪૫, તા. ૧૫-૮-૧૯૭૦

## ૧૦૫ શીલ'ની વિરુદ્ધમાં વર્તમાન દલીલોના રદિયા

આર્થસંસ્કૃતિના શીલ અંગેના સર્વોચ્ચ સિદ્ધાંતની સામે આજે પરદેશી બટ્રન્ડ રસેલ, ક્રીડર વગેરેએ ફેલાવેલાં જેરથી, તથા સિનેમાઓ, સ્ત્રીચિત્રો અને સ્ત્રીઓની આધુનિક વેષભૂષાએ સળગાવેલી આગોથી આર્થ નવી પ્રજાનાં પવિત્ર દિલ ડગમગી ગયા છે. આજના જમાનાવાદમાં તાશાઈને એવી દલીલો કરાય છે કે

(૧) શીલ એ તો પૂર્વના અવિકસિત સંકુચિત યુગની વાતો.

(૨) આજના વિકસિત યુગમાં તો એ સંશોધન થયેલું છે કે વિષયની હાજત એ કુદરતી હાજત છે.

(૩) વળી જેમ બીજી ઈન્ડિયો ગમે ત્યાં આનંદ માણી શકે, એમ ગુપ્તેન્દ્રિય પણ માણી શકે.

(૪) ન દોષ: ચર્મધર્ષણે; કેમ કે એમાં ક્યાં જીવહિસા છે ?'

પરંતુ આજના જમાના સામે સમજી રાખવું જોઈએ કે

(૧) યુગ વિકાસની માન્યતા એ ભૂત છે, મહા મોહિની છે, અંધાપો છે. કેમ કે પહેલું તો પૂર્વનો યુગ જ ખરેખરો વિકસિત હતો અને દીર્ઘ વિચારણાવાળો હતો. તેથી જ એમાં જ મહાન મહર્ષિઓ અને મહાન સત્તા-સતીઓ થઈ ગયા. વળી આજે પણ ભારતની સંસ્કૃતિ પરદેશમાં પંકતી હોય તો એ પૂર્વના યુગની વાતો પર. આજના યુગની વાતો ઉપર તો આજે ભારત અમેરિકા-રશિયાથી પછાત મનાય છે, અને ભારત પોતાનો અસલી માલ ભૂલીને પરદેશનો ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૨૧૧

ભંગાર આયાત કરે છે, એમાં વિકાસ ક્યાં આવ્યો ? દીર્ઘ દસ્તિ ક્યાં રહી ? આજના યુગે તો આત્મતત્ત્વને અને પરલોકને સાવ ભૂલાવ્યા. એને અંધાપો કહેવાય કે દેખવાપણું ?

**વિષયની હાજત કુદરતી કેમ નહિ ? :-**

(૨) વિષયની હાજત કુદરતી કહે છે એ ખોટું છે; (i) ભૂખની હાજત કુદરતી ખરી, કેમ કે એ અશાતા વેદનીયના લિધે પ્રગટે છે. પરંતુ વિષયની હાજત કુદરતી નહિ, કેમ કે એ વિચારસરણી બગાડવાથી મોહને ચકાવીને જનમે છે. જો કામનો વિચાર જ ન કરાય, તો હાજત ન ઊંઠે. વળી (ii) ભૂખને ભોજનથી શમાવ્યા વિના જીવન ન ચાલે; પરંતુ એવું વિષયની હાજતમાં નથી કે એને વિષયસેવનથી શમાવ્યા વિના જીવન અટકી પડે. શુભ વિચારોથી એને શમાવી શકાય છે. વળી (iii) ભૂખ તો ગમે ત્યાં ફરવા જાઓ તો ય નિયમિત જાગે જ છે. ત્યારે વિષયની હાજતમાં એવું નથી, કેમ કે માણસ એકલો ૪-૮ દિન માટે પરગામ કે યાત્રાએ ગયો તો ત્યાં એ હાજત નથી જાગતી. માટે એ કુદરતી નથી.

(૩) ત્યારે 'બીજી ઈન્ડિયો ગમે તે વિષયમાં જઈ શકે તો ગુપ્તેન્દ્રિય કેમ નહિ ?' એ જે વાત કરી તે પણ ખોટી છે. અહીં પવિત્ર અને સુશિક્ષિત ભારત દેશમાં તો આંખ પરસ્તી તરફ જાય તો એ ગુનો છે, કાન રંદીના ગીતમાં લલચાય તો તો એમાં બરબાદી છે, જુબ માંસ-મહિરાના સ્વાદ લે તો એ અનાચાર છે; તાત્પર્ય, ભારતમાં ઈન્ડિયોને ગમે તે વિષયમાં આનંદ માણવાની છૂટ નથી. તો પછી ગુપ્તેન્દ્રિયને શાની એવી છૂટ હોય ? નહિતર તો ફૂતરા વગેરે જનાવર કરતાં માણસ તરીકેની વિશેષતા જ શી રહે ? આજે બધી છૂટ માણનારા પણ કેમ સ્વસ્ત્રીને પરપુરુષનો સંબંધ સહન નથી કરતા ? કેમ ઊંચા કુળની સ્ત્રીઓના ખુલ્લા બજાર નથી ખોલતા ? માટે એ છૂટની માન્યતા જ ખોટી છે.

(૪) એમ, 'ચામડાની રમતમાં જીવહિસા નથી માટે દોષ નથી.' એ કહેવું પણ ખોટું છે; કેમ કે જ્ઞાનીઓએ કહું છે કે એક વખતના સ્ત્રીસંયોગમાં બેથી નવ લાખ સુધી ગર્ભ જ મનુષ્ય જીવોનો નાશ થાય છે, અને બીજા અસંખ્ય જીવો મરે છે. તો આ ઓછી હિસા થઈ ? એથી વિશેષ હિસા પોતાના જીવની ભાવમૃત્યુરૂપ થાય છે. જીવમાં રહેલી શુદ્ધ જ્ઞાનાદિમય ચેતનાનો એવો નાશ થાય છે કે ત્યાં ચેતનામાં ચિકણો રાગ અને મોહમૃહતા છવાઈ જતાં કશી શુધ્યબુધ નથી રહેતી. આ રાગ અને મૂહતા એક એવા નશા છે કે એમાં, મૂર્છિત ચેતના પરમાત્મા સાથે ભળી શકતી નથી. ત્યારે જે લોકો સ્ત્રીસંયોગમાં જીવોની હિસા જોઈ એને બદલે બીજી ખોટી ચેષ્ટા યા સજાતીય સાથેના દુર્વ્યવહારમાં પડી એમ સંતોષ લે છે કે 'ચાલો

૨૧૨

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

આમાં તો હિંસા નથી, એટલે વાંધો નહિ,' એ વળી વિશેષ ભૂલા પડ્યા છે, કેમ કે આમાં તો સ્વહિંસા ભયંકર થાય છે, કારણ કે અનુચિત વિષયમાં તીવ્ર રાગ અને મૂઢતા થવાથી ત્યાં એને તૃપ્તિ જ નહિ, તેમજ ચેતના તદ્દન મૂર્ખિત બને છે. આ તીવ્ર રાગ, મૂઢતા, મૂર્ખા, એ ભયંકર ભાવમૂત્ય છે.

સારાંશ, જમાનાવાદની દલીલો પોકળ છે, એમાં જરાય ન લોભાતાં શીલ-સદ્ગાર-બ્રહ્મચર્યના ભારે ખપી બનવા જેવું છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૪૬, તા. ૨૨-૮-૧૯૭૦

## ૧૦૬ પ્રભુના દર્શને રોમાંચ ખડા કેમ થાય ?

જિનેશ્વર ભગવાનનાં દર્શન-વંદને રોમાંચ ખડા થવાનું શાસ્ત્રવિધાન બહુ ધ્યાન પર લેવા જેવું છે. પરદેશ ગયેલો સગો ૫-૧૦ વરસે આવી અચાનક મળે તો એને જોતાં રુંવાડા ખડા થઈ આંખમાં આંસુ આવી જાય છે, તો પછી શું અનંતકાળે મળેલા આ મહાન સ્નેહી અરિંદત ભગવાનને જોતાં રોમાંચ વિકસ્વર ન થાય ? આંખમાં હરખના આંસુ ન આવે ? પણ એ માટે લાગવું જોઈએ, કે

પ્રભુને જોતાં શું લાગે ? :-

(૧) ‘અહો ! આ જગતમાં વીતરાગ પ્રભુ જેવા કોઈ સ્નેહી નથી. અને એ અનંત કાળ જોવા-ઓળખવા મળ્યા નથી, તે હે ? શું અહીં મળ્યા ? અહોહોહો ! મારા ભાગ્યની અવધિ નથી. આવા સ્નેહી ક્યાં મળે ? શે મળે ? મારા જેવા અધમાધમને આવા ઉત્તમોત્તમ પ્રભુએ દર્શન આપ્યું ? વાહ મારા નાથ ! કેટલી તમારી કરુણા ?’

-જો આવું મનને લાગે તો પ્રભુદર્શને રુંવાડા ખડા થાય. પરંતુ એ માટે પ્રભુની આગળ જીત અધમાધમ લાગવી જોઈએ, પ્રભુની આજાની બેપરવા છે, પ્રભુના પરાયા છીએ એવું દેખાય. ભડકશો નહિ કે ‘હે આપણે જિનાજાના બેપરવા ? આપણે પ્રભુના પરાયા ?’ હા, પ્રભુના પરાયા આ રીતે,-

આપણે જૈન કુળમાં જન્મ્યા તે પ્રભુનું શાસન આગળ ચાલુ રહે એવું જીવન જીવવા બંધાયેલા છીએ.

હવે વિચારો આપણે એવું જીવન જીવીએ છીએ ખરા ? કે એથી ઊલટું ? મૂળ પાયામાં પહેલી તો જિનાજાનુસાર આપણી જીવનદર્શિ શું એવી રહે છે ખરી કે ‘સુખવૈભવભર્યો પણ સંસાર મૂકી દેવા જેવો ભયંકર છે ? ઈન્દ્રિયના મનોરમ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૨૧૩

વિષયોનું સ્મરણ પણ જેર છે ? કોધાઈ કખાય એ કાતિલ ખંજરો છે ?’ ‘જીવનદર્શિ’ એટલે જીવનભર માટે હૃદયમાં ઘડાઈ ગયેલું ધોરણ. એ ધોરણ આ પ્રકારનું ઘડાઈ ગયું છે ખરું ? કે એથી ઊલટું ધોરણ છે કે ‘વૈભવી સંસાર તો સુખે ભોગવવા લાયક છે ? રૂપાળી પ્રેમાળ પત્ની, પૈસા, મીઠાં ખાનપાનાદિ વિષયો વગેરે બહુ મજેના ? કખાય યાને જરૂર પડે ત્યાં રોષ રોફ વગેરે તો કરવા જ જોઈએ. ઝેર વિનાના સાપે પણ ફણાનો ફિટાટોપ તો રાખવો જ પડે; નહિતર લોક પીંખી નાખે. ઉંમર થઈ ગઈ હોય, યા પૈસા સારા મળી ગયા હોય, તો ય બજાર તો કરવો જ જોઈએ, નહિતર નવરાની કશી કિંમત નહિ,...’ આવાં આવાં ધોરણ દિલમાં જીવનભર માટે ‘સજજ બેસાડેલા હોય, તો આપણે પ્રભુના પરાયા નહિ ? આજાનાં બેપરવા નહિ ? નહિતર દીકરા-દીકરીને જનમથી શું શીખવ્યા કરત ? એ શીખવાય છે ખરું ? જાતને માટે એ ભયાનક સંસારવાસ, વિષયવિષભક્ષણ અને કખાયપરવશતા કરવાનું થતાં કેવા લોહીના આંસુ પડત ? પણ મૂળમાં આ જીવનધોરણ જીવનદર્શિ હોય તો ને ? ઊલટી જ દર્શિ હોય ત્યાં આંસુ શાના ? સુખ-વૈભવ અને મનોરમ વિષયો મળતાં તો હરખના ઊભરા આવે છે; કેમ કે ત્યાં દર્શિ આદરની બાંધી દીધી. એવી ઊલટી દર્શિ પર વિચાર-વાણી-વર્તાવ કેવા ઊલટા ચાલે ? એવા ઊલટા વાણી-વર્તાવ ઉપર પ્રભુનું શાસન આગળ ચાલે ? કે શાસન આપણા બાપાજુએ છેલ્યું પાળ્યું અને આપણામાં એ ખત્મ થયું ? જૈન કુળમાં જનમવા છતાં આ દશા હોય એ આપણે પ્રભુના પરાયા નહિ ?

વિચારજો, મનને લાગે છે ખરું કે ‘જૈન કુળમાં જનમીને પ્રભુનું મીશન પ્રભુનું શાસન આગળ ચાલે એવું જીવવા આપણે બંધાયા છીએ ?’ અને એવું જીવવું છે તો પાયામાં પહેલી તો આ જીવનદર્શિ છે ખરી કે ‘સંસાર ભયંકર માટે જ ત્યાજ્ય; વિષયોનું સ્મરણ પણ વિષ; કખાયો એ કાતિલ ખંજર.’ ‘ના, અમે કાંઈ એવું જીવવા બંધાયેલા નથી, ને સંસારમાં રહ્યે આવી દર્શિ કાંઈ રખાય નહિ,’-જો દિલમાં આવું બેહું હોય તો પછી પ્રભુના સેવકનું કામ ચાલે ? કે પ્રભુના પરાયાનું ?

આપણાં જીવનના ઢંગ જોતાં એમ થાય કે ‘હું તો પ્રભુનો પરાયો છું, અધમાધમ છું, ને આવા પણ મને પ્રભુએ દર્શન આપ્યું ? અહો ! પ્રભુની કેવી કરુણા ! એમ પ્રભુદર્શને દિલ ભરાઈ આવતાં રોમાંચ ખડા થાય, આંખમાં આંસુ ઉભરાય.

(૨) પ્રભુને જોતાં બીજું એ લાગે કે ‘અહો ! પ્રભુ તમારો કેટલો અવર્ણનીય ઉપકાર ! હું આ ઊંચા પંચેન્દ્રિય આર્ય માનવ જનમમાં આવ્યો એ કાંઈ મારી ૨૧૪ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

હોશિયારી મરજી અને મહેનતથી ચાલીને નથી આવ્યો. અહીં તો તમારા અચિંત્ય પ્રભાવે આવ્યો ધૂં. આવ્યો એટલું જ નહિ કિંતુ તમારા અચિંત્ય પ્રભાવે જ દીર્ઘ આયુષ્ય આરોગ્ય, રૂડાં ખાનપાન-સગવડ-સેહી વગેરે પુષ્યાર્થ પણ પામ્યો ધૂં. એક ભિખારીમાંથી કરોડપતિ. અહાલા ! કેટલા ભરચક આપ ઉપકારી ?' આવું મનને લાગે તો પ્રભુનાં દર્શને રોમાંચ ખડા થાય, આંખ ભીની થાય.

(૩) વળી જેમ ભયંકર સત્તર જ્ઞાતના રોગવાળો ‘ત્રાહિ ત્રાહિ’ પોકારતો હોય ને એને ધન્વંતરી વૈદ મળી જાય અને એની દવા રોજ ફાયદો બતાવતી હોય, તો રોજ એ વૈદને મળતાં રોમાંચ અનુભવે, એને આંખમાં આંસુ આવે, એમ આપણને વિંબિ રહેલા રાગ-દ્રેષ કામ-કોધ-લોભ ઈર્ઝિ-અહેત્વ વગેરે, એ જો દિલને કોચતા હોય, એ રાગાદિનું અતિ ભારે દિલદર્દ હોય, તો વીતરાગ પ્રભુનાં દર્શને એ ધન્વંતરી મળ્યા લાગે, ને રોમાંચ ખડા થાય, આંખમાં આંસુ ઉભરાય.

(૪) વળી અરિહંતપ્રભુ અનંતકાળમાં નહિ મળેલો અનંત કલ્યાણકર તત્ત્વપ્રકાશ અને મોક્ષમાર્ગ આપે છે માટે એવા પ્રભુનાં દર્શન-વંદન એ સંસારનાં સર્વ કાર્યો, સર્વ સંપત્તિઓ, ને સર્વ સગાઓના મિલન કરતાં અતિ ઊંચાં લાગે, તો પણ દર્શન-વંદને રોમાંચ અનુભવાય.

ગૃહસ્થજીવનમાં પ્રથમ અને સરળ ધર્મસાધના દેવદર્શન; એ જો આમ રોમાંચ અને આંસુ સાથે થાય, તો એ પાયા પર સહેલાઈથી બીજ સુંદર ધર્મસાધનાઓની ઈમારત મંડાય.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૪૭/૪૮, તા. ૨૯-૮-૧૯૭૦

## ૧૦૭ આજના કાળને શ્રાપ : વાસનાથી રક્ષાનો ઉપાય

આજના વધી ગયેલા વિકારસાધનોમાં જીવોની કેવી ભયાનક ખરાબી સરજાઈ રહી છે એનો વિચાર કરવામાં આવે તો આજના કાળને શ્રાપ દેવાનું મન થાય.

હાલતાં ને ચાલતાં ઉદ્ભૂત વેશવાળી સ્ત્રીઓ-બાળાઓનાં અંગોનાં થતાં દર્શન, સિનેમાચિત્રો, છાપાઓમાંના આકર્ષક સ્ત્રીચિત્રો, તથા જાહેરતમાંનાં સ્ત્રીચિત્રોનાં થતાં દર્શન, તેમજ શ્રુત્ગારી નોવેલ-નવલિકાના વાંચન, વળી ચાનાસ્તા-પીણાં વગેરેના વધી ગયેલા ખાનપાનટક, તેમજ ભૂતની જેમ ઊભરાઈ પડેલી મોહ-વિલાસની વાતો, સ્ત્રીપરિચિયો, માદક ખોરાક અને વિટામીનભરપૂર

દવાઓ ઈત્યાદિ મહાવિકારસાધનો છે, વિકારનાં ઉતેજક છે. એથી જીવોની કામવાસના ભભૂકૃતી રહે છે. પછી ઉત્તમ કુળ, સમાજ વ્યવહાર વગેરેનાં બંધન માથે ધર્યા હોય તો કાયિક દુરાચારના માર્ગ જવાનું કદાચ ન થાય, કિન્તુ દાખિના અને વિચારના દુરાચાર ચાલી પડે છે, તેમજ સ્વસ્ત્રીમાં અનહેઠ અસંયમ પ્રવર્ત્યા કરે છે. ત્યારે જો પેલાં બંધનની પરવા ન હોય તો ગુપ્ત વ્યબિચાર પણ ચાલ્યા કરે છે. એમાં વળી આજના સંતતિ-નિયમનનાં સાધનોએ દાટ વાય્યો છે.

આ સ્વસ્ત્રીમાં અનહેઠ-અસંયમ, પરસ્ત્રીદર્શનની લત કે આગળ વધીને દુરાચારથી બચવા માટે અલબત્ત દાખિ પર કાબૂ સિનેમા ત્યાગ, ખાનપાન પર સંયમ, મોહની વાતોનો ત્યાગ, સ્ત્રીચિત્રો જોવાનો ત્યાગ, શ્રુત્ગારી વાંચનનો ત્યાગ, સ્ત્રીપરિચિય અને વીર્યોતેજક દવાઓનો ત્યાગ વગેરે જરૂરી છે; ઉપરાંત આ એક વિચારવા જેવું છે કે

મનમાં ઊઠેલી કામવાસનાને તૃપ્ત કર્યે જવાનું કેટલું બધું જોખમી અને વચ્ચગાળે ખંડિત થનારું છે ? જોખમમાં આબદુ જાય, તિરસ્કાર મળે, અંતર સળગતું રહે, આયુષ્ય કપાય, છેવટે મૃત્યુ તો આવવાનું જ. મૃત્યુ થતાં જીવને પડકાર થાય છે કે ‘લે, કર હવે વાસનાની તૃપ્તિ, જોઈએ છીએ કેવી તૃપ્તિ તું કરી શકે છે ?’ આ પડકાર જીલવાની અને ડારવાની શક્તિ મૃત્યુ પામતા જીવમાં રહેતી નથી; કેમ કે વધ થતાં જીવને એ શરીર તથા એના અંગોનો સંબંધ જ છૂટી ગયો, પછી એના દ્વારા શી રીતે વાસના તૃપ્તિનું કાર્ય કરી શકે ? ત્યારે જો કે નવા શરીર અને એના અંગોથી પાછું વાસનાર્પણજું કામ ચાલી શકે ખરું, પણ ત્યાં ય પુષ્ય વિના એની સામગ્રી ક્યાં મળે ? તેમજ અહીંના વાસના પોષણથી ઊભા કરેલાં જાલિમ પાપો ત્યાં કેવી દુઃખ પીડાઓ અને મોત લાવવાના ?

વાસનાની તૃપ્તિ કરવાનાં સાધન પણ પુષ્ય ઉદ્યમાં હોય તો જ મળે; પાપના ઉદ્યથી ન મળે. અહીં અયોગ્ય માર્ગ વાસના તર્પણમાં તો જાલિમ પાપો ઊભા કર્યા, ને એ જ કરવા પર પુષ્ય ક્યાંથી ઉપાર્જય ? અને એ નહિ, તો પરભવે સાધન-સામગ્રી ક્યાંથી મળે ? તો એના વિના વાસનાની તૃપ્તિ શે કરી શકે ? એટલે અહીં અયોગ્ય માર્ગ દુરાચારના માર્ગ વાસનાની તૃપ્તિ કર્યે જવામાં વચ્ચમાં જ મોત આવતાં અહીં તો હવે એ તૃપ્તિ કરવાનું અટક્યું, પણ પછીથી ય સાધનના અભાવે એ તર્પણ થઈ શકવાનું નહિ; ને વધારામાં અહીં પુષ્ય કરેલી વાસનાની આગ ત્યાં જોરદાર સળગતી રહેવાની.

પાછું એવા દુર્ગતિના ભવમાં વળી સમજ તો હોય નહિ, ઉપદેશ પણ મળે

નહિ, એટલે વાસનાને શુભ ભાવનાથી શમાવવાનું ય થઈ શકે નહિ. એટલે નિરંતર જલતી રહેતી વાસનાની આગ જીવને કેવી અને કેટલી પીડ્યા કરે ? કેવી બેચેની અને ભાનભૂલાપણું રાખે ! વળી પરભવે વાસનાની આગ પીડ્યા હોય, અને એની તૃપ્તિ કરવાનું મળતું ન હોય, તેથી કેવાં દુઃખદ દુર્ધર્ણન ચાલે ? તેથી કેવાં કારમા પાપકર્મ સરજાતા રહે ! એનું પરિણામ, આગળ પણ અધિક દુઃખ દુર્ગતિના ભવ સ્થિવાય બીજું શું આવે ?

તાત્પર્ય, વાસનાને મહેકાવવામાં અને સંયમભહાર પોષ્યે જવામાં અંતે હાથ ઘસતા થવું પડે છે, ને પરભવે દુઃખ-દુર્ધર્ણના પાર નથી રહેતા. તેમજ અહીં પણ દિલથી દેવદર્શન, સાધુપ્રેમ, અન્ય ધર્મસાધના તથા શુભ ચિંતન-વિચારણા ગુમાવવી પડે છે; વિકારી વિચારો ચાલ્યા કરે છે, એના ગુરુ આગળ આલોચન પ્રાયશ્ચિત ન થવાથી દિલમાં શાલ્ય પડે છે, કુસંસ્કાર જામે છે, તેથી અનેક ભવોમાં બેફામ વાસનાનાં તોફાન ચાલે છે. ઉંચા આર્ય માનવભવમાં તો પાપ ઘણાં ખાલી કરીને આવવાનું થયું, પણ હવે અહીંથી પાપના ભંડાર ભરીને જવાનું થાય છે. સારા કુળમાં સંસ્કારી જીવન મળ્યું એની પાછળ પૂર્વના કેટલાય ભવોમાં વાસના-વિકારના નિયંત્રણની તપસ્યા કામ કરતી હતી; તે તપસ્યા ઉપર અહીંના યથેચું વાસના-તર્પણથી ધૂળ વળી જાય છે, તપસ્યાને આગળ વધારવાનું થતું નથી... ઈત્યાદિ જાલિમ નુકસાનો વિચારી વાસના-વિકારોને પ્રતિપળ દબાવતા જવું જોઈએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૧, તા. ૧૨-૮-૧૯૭૦

## ૧૦૮ મુનિશ્રી વિશ્વધનવિજયજીની સમાધિ

સિદ્ધાન્તમહોદ્ધિ સ્વ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં શિષ્યરત્ન મુનિરાજ શ્રી મતિધનવિજયજી મ. એટલે સંસારીપણે ભાઈ શ્રી છોટાભાઈ મુંબઈમાં ૧૫ રૂપૈઠી પગારે નોકરીએ જઈ કર્મશઃ ભાણજી લવજી ધી કંપનીના સોલ એજન્ટ બનીને ઠરીઠામ બેસવાના અવસરે સાધુ બનેલ. એમના ત્રીજા પુત્ર કુમારપણ મેટ્રિક પાસ થઈ સંસારનું ધોર સ્વરૂપ જોઈ વિરક્ત બનીને ચારિત્ર માટે તૈયાર થયા, ત્યારે મોટાભાઈ બાબુભાઈ, તે જથ્થાબંધ ધીના વેપારી, એમને કહે તું ઉતાવળ શું કામ કરે ? હું તને અમેરિકા મોકલું. ભલે હજારો રૂપિયા ખર્ચ થાય. ત્યાં તું સારી ડીગ્રી મેળવી આવ;’ પરંતુ પૂ. આચાર્ય દેવશ્રીના સંયમાદ્ધિ લલચાયેલા આ વિરાગી ભવ્યાત્મા શાને-લોભાય ? ત્યારે એમની માતા સમરથબેન ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૨૧૭

અને બાબુભાઈએ રૂ. ૪૦,૦૦૦) ખર્ચ વિ.સં. ૨૦૧૮માં એમને તથા બેન મંજુલાને દીક્ષા અપાવી. કુમારી મંજુલા સાધ્વીજીશ્રી હંસકિર્તિશ્રીજીના શિષ્યા શ્રી મૃગાવતીશ્રીજી બન્યા; અને શ્રી કુમારપણ પિતામુનિશ્રીના શિષ્ય મુનિ શ્રી વિશ્વધનવિજયજી બન્યા, આવશ્યક-સૂત્રો, સંસ્કૃતભાષા-કાચ્યો તથા જૈનશાસ્ત્રો ભણ્યા, ભજાવા સાથે જેને સાધુજીવન કહેવાય એ જીવવા રોજ એકાશન, ત્યાગવૃત્તિ, જીવરક્ષાર્થે પૂજવા પ્રમાર્જવાનો ખ્યાલ, ભાષાસામિતિ, ગોચરીમાં ક્યાંય દોષ ન લાગે એની ચીવટ, મંદિરમાં અવસર મળતાં કલાક પ્રભુભક્તિ, અને કેટલીક વાર તો પ્રભુને રૂદ્ધભરી પ્રાર્થના, પાપનો જાગતો ભય, વગેરે ચાલુ રહેતું. એમની પિતાગુરુની સેવા અદ્ભુત હતી; સાથે વર્ધમાન આંબેલ તપની ૧૫-૧૭ ઓણીઓ પણ કરી.

ભવિષ્યમાં શ્રી સંઘ માટે એક પ્રભાવક રત્ન બને એવા આ ખખડધખ યુવાન પૂ. મુનિરાજ શ્રી વિશ્વધનવિજયજી મ.ને મોં પર હમણાં જરાક ખીલ નીકુણે, જોતાજોતામાં એ વકરી ચેપી બને, અને હમણાં શ્રા.વદ ત ના ૨૬ વર્ષની ઉમરે એ સમાધિપૂર્વક જીવનબાળ સંકેલી લે, એની કલ્પના કોણે આવે ? જાણે એક મજબૂત પાટડો અચાનક તુટી પડ્યો ! આ દુઃખ પ્રસંગ એક એવો બની ગયો કે જે જીવનની ક્ષણભંગુરતા બતાવી, આપણાને જાગતા કરી દે છે કે ‘ભરોસે શા બેઠા છો કે હજ મારે ઘણું જીવવાનું છે ?’ આ ભરોસામાં પ્રમાદ જીવ પર સારી રીતે ઘેરો ઘાલ્યો છે, અને ધર્મઆરાધના ચ્યૂકાઈ રહી છે.

વિશેષ નોંધપાત્ર એ બન્યું કે આવા ગુણિયલ પુત્રમુનિની ખોટ હાર્ટના દરદી વૃદ્ધ અશક્ત પિતામુનિને કેટલી બધી લાગે ? છતાં જુઓ એ પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભાનુવિજયજી મ. ઉપરના પત્રમાં શું લખે છે ? એ લખે છે કે,- સેવક મતિધનની કોટીસહ વંદના સ્વીકારશોશ્ચ. પંન્યાસજી મહારાજ સાહેબને માલુમ થાય કે મુનિ વિશ્વધનવિજયજી તો એક અઠવાડીયાની માંદગી ભોગવી કાલધર્મ પામ્યાનું દુઃખ તો થાય છે, પણ એ આઈ વરસનો દીક્ષા પર્યાય પાળીને સાહેબજી ! ઘણી ઘણી સારી એવી આરાધના કરી ગયાનો પણ બહુ જ આનંદ થાય છે તે માટે તો સાહેબ ! મારે આપને શું લખવું ? એને પણ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની કૃપાથી શું અનું સમિતિ પાલન ? શું અનું જ્ઞાન-ધ્યાન ? વિનય-વૈયાવચ્ચ આદિ દરેક કામો પૂરતી કાળજી અને ખંથી કરવાની શી એની ભાવના ? દહેરાસરમાં દર્શન કરવા જાય તો પણ એને સમય મલે તો કલાક સહેજે થઈ જાય, અને આવીને વાત કરે કે વાણ વાણ ! આજે તો બહુ જ આનંદ આવી ગયો !’ આપની માફિક જ એ મને પણ એવું એવું સમજાવે કે મને પણ આનંદ થાય.

૨૧૮

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

એ થોડા જ વરસમાં ધણું ધણું સારું પામી ગયાનો સંતોષ માની મારા મનને સમજાવું છું કે આનું જ નામ ભવિતવ્યતા, નહીં તો આજે તેને ૨૮મા વરસે મરવાનું જ ક્યાંથી હોય ?' મને- ડોકરાને મૂકીને પણ એ તો એનું સાધી ગયાનો આનંદ માનું છું. બાકી તો એ કાળધર્મ પામી ગયાનું દુઃખ તો થાય, પણ અહો ! ૮ વરસના પર્યાયમાં આપના સહવાસથી અને આપની કૃપાથી એ ધણું ધણું પામી ગયાનો આનંદ માની એમના આત્માને ઉત્તરોત્તર આરાધના કરવાની સારી સામગ્રે મળે, અને એ પરમસુખના ભોક્તા બને એ જ એક અભિલાષા રાખું છું.

મને મારા જોગ પ્રેરણા કરતા રહેવા કૃપા કરશો. મારા માટે શું એની કાળજી ? હમણા છેલ્લા બે વરસમાં તો એણે મારી ભૂબભૂબ ભક્તિ કરી છે. હું કહું વિશ્વધન ! મારાથી બનતું તો હું બધું કરી શકું, તું શા માટે તારો ભણવા ગણવાનો ટાઈમ બગડે છે ?' તો કહે 'આમા તે મારે ટાઈમ બગડે છે એમ કહેવાય ?' હું ક્યાંય ભૂલ કરી જાઉં તો મને પણ સમજાવીને બધું કહે- 'આપણે તો આરાધના કરવા આવ્યા છીએ. તમારે પણ કાળજી રાખવી જોઈએ...'

"દિવ્ય-દર્શન"-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૨, તા. ૧૮-૮-૧૯૭૦

## ૧૦૮ કાયાને સુખ એ વિટંબણા છે ?

આજે વિજ્ઞાનની નવનવી શોધોથી કાયા-ઈન્ડ્રિયોને જ્યારે સુખ મોજ વધી ગઈ છે, ત્યારે મહર્ષિઓના ત્યાગ-સંયમ-નિયમના ઉપદેશ પર દિલ લાગતું નથી અને સગવડ-સાધનોમાં કાયાને બોલબાલા લાગે છે, પરંતુ એના બદલે એમાં જો કાયાની વિટંબણા લાગે તો દિલ ત્યાંથી ઊભગી મહર્ષિઓના વચનમાં ઠરે. આ માટે વિચારવા જેવું છે કે-

જીવન એટલે શું માત્ર શરીર સંભાળવાનું અને એના લાલનપાલન કરી લેવા તથા માન સન્માન મેળવી લેવાના ? જો એટલી જ દણ્ણ હોય અને આત્માની સંભાળની કોઈ દણ્ણ ન હોય, જો આત્માનો કોઈ વિચાર જ નહિ, તો આમાં પછી એ વિચારવાનું ક્યાં રહે કે 'દેહનાં જ સુખ-સભાન જોવાનું અને વાસનાવશ કામથી દેહને વિંબણાનું તો પશુય કરે છે, એનાથી ઊચી કોટિના માનવદેહે પણ એ જ જોવા-વિંબણાનું હોય તો મનુષ્ય બનીને શી વિશેષતા થઈ ?'

ખરી રીતે દેહનાં બદલે આત્મા પર ખાસ દણ્ણ રાખવાની છે. એના હિસાબે

જોવા જેવું છે કે (૧) પોતાના આત્માએ કાયાઓ તો ક્યાં મેળવી નથી ? (૨) એ કાયાઓને વાસનાઓ-ખાંઝો-વિષયસંપર્કોથી ક્યાં વિંબણી નથી ? (૩) છતાં આજે જીવ એનો એજ ભૂખારવો કેમ ? (૪) જીવને એ વિષય-ભૂખ સંતોષવા ખાતર કેટકેટલું કરવું પડે છે ? (૫) એ કરીને ય સરવાળે પાછી નવી ભૂખ ને નવી લોથ; આ વિટંબણા શા સારું ?

### વિષયોમાં કાયાની વિટંબણા શી ?

(૧) પહેલું તો આ લાગવું જોઈએ કે સારા મનગમતા રૂપ, રસ, વગેરેની ઝંખના જાગે એ કાયાની વિટંબણા ઝંખના છે. એમ એ શોધતા જવાય, એ આવી મળવા પર આંખ જીભ વગેરેમાં ટાઢક લાગે, એ કાયાની વિટંબણા છે. મનને થશે કે એમાં વિટંબણા શી ? પણ જુઓ,

(i) દારૂદિયાને દારૂની ઝંખના થાય, એ શોધતો ફરે, એ મળવા પર આંખ જીભ વગેરેમાં ટાઢક લાગે એ બધું શું કહેવાય ? વિટંબણા કે સ્વસ્થતા ?

(૨) જાતનું ભાન ભૂલાવે માટે વિટંબણા જ.

બસ, રૂપ-રસાઈની ભૂખ અને સંપર્ક તથા મસ્તી લાગવી એ દારૂની જેમ વિટંબણા જ છે. એમા જીવ પોતાના અસલી ઉત્તમ નિર્વિકારસ્વરૂપને ભૂલે છે.

(i) કુવલયમાળા કથામાં આવે છે કે કુવલયાનંદના પિતા રાજા દફવર્મા પાસે દુશ્મનનો પાંચ વરસનો બાળક લાવવામાં આવે છે, અને પોતાના દીકરા તુલ્ય ગણવાનું આશ્વાસન આપે છે; છતાં એ બાળકને એ વહાલ વગેરે વિટંબણારૂપ લાગે છે; અને એ રૂએ છે, રાજા પૂછે છે, - કેમ રૂએ?" એ કહે છે કે ' મારે પરાક્રમી પિતાનો પુત્ર થઈ શત્રુને ત્યાં દ્યાપાત્ર બનવું પડે છે. આ કેવી વિટંબણા ?' રાજાને ત્યાં રુંકરૂપાણું મળવાનું છે, છતાં એ દુશ્મનની દ્યાનું માટે વિટંબણા લાગે છે. બસ ત્યારે, કાયાને મનગમતા વિષયો ભલે મળ્યા અને એમા ટાઢક લાગી, કિંતુ એ વિષયો દુશ્મન કર્મના ઘરના છે, માટે વિટંબણારૂપ લાગે.

(ii) અરિહંત પરમાત્માના સેવકને દુશ્મન કર્મના દ્યાપાત્ર બનવું પડે છે; માટે કર્મના ઘરના ગમે તેવા સારા વિષયો મળે છતાં એ વિષયો વિટંબણારૂપ જ લાગે.

(iii) વળી ભયંકર દરદમાં કુપથ્ય ખાય તો આનંદ તો આવે, પરંતુ પરિણામમાં દરદનું જાલિમ જોર વધી જાય, તેથી ડાહ્યા દરદીને એ કુપથ્યનું આનંદદાયી પણ સેવન વિટંબણારૂપ લાગે છે. એવું કાયાને આનંદદાયી વિષયના સંપર્કમાં છે; એથી વાસના-વિકારો અને કર્મનો રોગ જાલિમ વધી જાય છે;

(૩) ડાહ્યા માણસને આવા રોગવર્ધક વિષયસંપર્કો વિટંબણારૂપ ન લાગે ?

બસ આ ગ્રણ વાત જો બરાબર લક્ષમાં લેવાય કે ‘મનગમતા રૂપ-રસ-શબ્દ-ગંધ સ્પર્શની લહેજતમાં (૧) જીવ ભાનભૂલો બને છે, (૨) દુશ્મનભૂત કર્મનો દ્યાપાત્ર બને છે, અને (૩) પરિણામે વાસના-વિકાર-કર્મરોગ જીવિમ વર્ધે છે,’ તો એની ખણજ, ખોજ, સંપર્ક, અને લહેજત બધું વિટંબણારૂપ જ લાગશે. મન કહેશે કે આ બધું તો કાયાને મોજમજાહ નહિ પણ વિટંબણા છે.

ત્યારે હવે જાતમાં તપાસીએ કે સારાં ખાનપાન મળ્યાં ને જીબ ખુશ થઈ, સારાં ગીતશ્રવણ મળ્યા ને કાનને આનંદ થયો, સ્ત્રીસંપર્ક મળ્યા ને કાયાને મસ્તી લાગી, વગેરે વગેરે વખતે શું મનને એમ થાય છે ખરુ કે ‘અરે ! આ મારી કાયાની વિટંબણા છે ? ભગવાનના સેવક છીએ ને ? તો દુશ્મનના દ્યામણા બની એના ઘરનો માલ ભોગવવામાં વિટંબણા ન લાગે ? વિટંબણાને બદલે મોજમજાહ લાગે તો આપણે અરિહંતના અનુયાયી છીએ ? આપણાને સમ્યકૃત્વનો હક ખરો ? સમકિત લેવા લાંબે જવું પડે એવું નથી. ઘરમાંથી મળે એમ છે; પણ એ માટે વિષયોની બોલબાલામાં વિટંબણા દસ્તિ જોઈએ, કાયાની એ વિટંબણારૂપ લાગવી જોઈએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩, તા. ૨૬-૮-૧૯૭૦

## ૧૧૦ કર્મની ભ્રમણામાં પુરુષાર્થનો નાશ ન કરો

ઉત્તમ માનવ-જીવનમાં મહાકિર્મતી પુરુષાર્થશક્તિ મળેલી છે. પરંતુ અજ્ઞાન જીવ એ શક્તિથી સારા કામ કરવાને બદલે ખોટા કામ કરે છે, અને પાછો માને છે કે આ ખોટા કામ તો મારા કર્મ કરાવે છે. ત્યાં હું શું કરું ?

પ્ર.- તો શું મોહનીય કર્મના લીધે ખોટાં કામ નથી થતાં ?

૩.- સવાલ મજેનો અને સમજવા જેવો છે. બધું કર્મ કરાવે છે એ હિસાબ માંડતા પહેલા ચેતન તત્ત્વની વિશેષતા વિચારવા જેવી છે. મહંદું કાંઈ કરતું નથી, ચેતનયુક્ત શરીર, બોલવા-ચાલવાની પ્રવૃત્તિ કરે, એ સૂચવે છે કે પ્રવૃત્તિ-પુરુષાર્થ ચેતનનો ધર્મ છે; કરવાનું ચેતનને છે. એ જો માત્ર પૂર્વ-પૂર્વના કર્મનો પ્રેર્યો જ કરતો હોય, અને નવાં નવાં કર્મ ઉભા કર્યે જતો હોય, તો તો પછી કર્મથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી કર્મ, એમ ચાલ્યા કરવાનું. ત્યાં જીવના પોતાના ચૈતન્યની શી વિશેષતા રહી ? જો ચૈતન્યની વિશેષતા ન હોય, તો પછી કર્મજૂથ શરીર વગેરે જડ પાસે ય અવળી પ્રવૃત્તિ કરાવે એવું કાં ન બને ? ત્યાં અગર કહો કે ‘જડમાં ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત’ (ભાગ-૪)

૨૨૧

ચેતના નથી એટલે એ કર્મપ્રેરી કશું ન કરી શકે;’ તો ‘કરવાનું’ એટલે શું એ બોલો, પ્રવૃત્તિ-હીલચાલ જ ને ? એ તો જડમાં થાય છે. કાયા જડ છે, ને એમાં હીલચાલ થાય જ છે. તો પછી કર્મ મરેલા શરીરમાં પ્રવૃત્તિ કેમ ન નીપજાવે ?

ત્યારે એ જ કહેવું પડે કે માત્ર બાધ્ય કિયા એ પ્રવૃત્તિ નથી. પ્રવૃત્તિ તો પ્રયત્ન દ્વારા કિયા છે, ને એ પ્રયત્ન તો ચેતનનો ધર્મ છે, ચેતનની વિશેષતા છે. હવે જુઓ કે મોહનીય કર્મ શું કરે છે ? એ ચેતન આત્મામાં મિથ્યાત્વનો ભાવ, રાગાદિનો ભાવ પેદા કરે છે. શું સમજ્યા ? મોહનીય કર્મ માત્ર ભાવ પેદા કરે; પરંતુ ‘પ્રયત્ન’ યાને વીર્યસ્કુરણ જે થાય છે, તે તો ચેતનનો ધર્મ, ચેતનની વિશેષતા છે; પછી એ પ્રયત્ન ચાધ્ય વિચારણાનો હોય, વાણીનો હોય કે વર્તાવનો હોય, પરંતુ એનો પ્રયત્ન થાય, અનું વીર્યસ્કુરણ થાય, એ ધર્મ ચેતનનો છે.

ચેતનનું ચૈતન્ય એટલે શું ? જ્ઞાન અને વીર્ય. એ જડમાં ન હોય; તેમ કર્મ આ ન કરાવી શકે. કર્મ તો ઊલટું અને રોકે. જ્ઞાનાવરણ કર્મ વીર્યાન્તરાય કર્મ જ્ઞાન અને વીર્યને રોકે છે; પ્રગટ નહિ થવા દે. એટલે જેટલા પ્રમાણમાં જ્ઞાન અને વીર્ય પ્રગટ થાય, એટલા પ્રમાણમાં એ કર્મ તૂટ્યા માનવું પડે. આમ, સમજાશે કે વીર્યસ્કુરણ યાને પ્રયત્ન કર્મ નથી કરાવતું. એ તો આત્મા પોતે કરે છે. હવે સમજવું સહેલું છે કે પૂર્વના મોહનીય કર્મ ઉદ્યમાં આવે એ તો અંદરમાં રાગાદિનો ભાવ પેદા કરે એટલું જ, પરંતુ એના પર જે રાગાદિભરી વિચારણ ચાલે, એની વાણી બોલવાય, કે એવો રાગાદિ ભર્યો કાયિક વર્તાવ થાય, એ તો આત્માની પોતાની વિશેષતા છે.

અલબત એવી પ્રવૃત્તિમાં રાગાદિ સહાયક ખરા, પરંતુ પ્રવૃત્તિ તો જીવની પોતાની દા.ત. પરસ્ની પર દસ્તિ પડતા રાગ મોહનીય કર્મ ઉદ્યમાં આવ્યું તો ત્યાં અંતરમાં રાગનો ભાવ જાગ્યો. હવે જો જીવ એવી વિચારણ કરે કે ‘આ કેવી સુંદર સ્ત્રી !’ અગર બીજાને કહે કે આ કેટલી મનોહર સ્ત્રી છે !’ યા પોતે એ સ્ત્રીના ઉપર આંખ ચોંટાડી રાખે કે આંખથી કટાક્ષ કરે, ઈસારો કરે, તો એ બધી માનસિક-વાચિક-કાયિક પ્રવૃત્તિ રાગભરી થઈ; એટલો કર્મ જગાવેલો રાગ એમાં સહાયક થયો ખરો; પરંતુ રાગ જ પ્રવૃત્તિનું કારણ નહિ. પ્રવૃત્તિ તો ચેતનની વિશેષતા. એટલે એવી રાગભરી પ્રવૃત્તિ કરવી કે ન કરવી યા ઓછી-વધુ કે તીવ્ર-મન્દ કરવી, એમાં ચેતન આત્માનું સ્વાતંત્ર્ય છે.

માટે તો દેખાય છે કે કેટલાય સારા માણસો પરસ્ની પર અચાનક દસ્તિ પડી ગયા પછી તરત દસ્તિ ખસેડી લે છે, એની સુંદરતાનો રાગભર્યો વિચાર પણ કરતા નથી, કે એવો બોલ બોલતા નથી. શું એમને અંતરમાં રાગ નહિ જ ઊઠતો

૨૨૨

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત’ (ભાગ-૪)

હોય ? શું એ વીતરાગ છે ? ના, રાગ ઉઠવા સંભવ છે, પરંતુ એના પર એવા વિચાર વાણી કે વર્તાવની પ્રવૃત્તિ કરવા એ તૈયાર નથી. કદાચ વિચાર આવવા જતો હોય, તો તે તરત જ મનને કોઈ મહાપુરુષનાં ચિન્તિતમાં, યા તત્ત્વો કે મોટી સિદ્ધગિરિ યાત્રા વિચારવામાં લગાડી હે છે, અથવા ગણતરીબંધ અને દરેક પદના લક્ષ સાથે નવકાર મંત્ર ગણવામાં ચિત્તને લગાડી હે છે. એટલે પેલો રાગ નિષ્ફળ જાય છે, કેમકે માનસિક પ્રવૃત્તિ પેલા રાગથી ભરી નહિ, પણ બીજી જ પ્રભુ ભક્તિ આદિથી ભરેલી એણે કરી. જો પ્રવૃત્તિ રાગભરી કરી તો ત્યાં રાગ સફળ થયો ગણાય.

આ સૂચયે છે કે પ્રવૃત્તિ માટે આત્મા સ્વતંત્ર છે. ખોટાં કામ યાને ખોટી વાણી-વિચારણા કે ખોટી પ્રવૃત્તિને કર્મ નથી કરાવતું; એ તો આત્મા કરે છે. આત્માએ મૂર્ખ ગુલામ બની રાગાદિ કોધાદિ ભાવને પોતાની એવી પ્રવૃત્તિ દ્વારા સફળ કરવા કે પોતાનું સ્વાતંત્ર્ય સમજુ એવી પ્રવૃત્તિ ન કરી એ રાગાદિને નિષ્ફળ કરવા, એ પોતાની મરજની વાત છે, એમાં પોતે સ્વતંત્ર છે.

આ પરથી, ‘ખોટા કામ ખોટા વિચાર-ભાષણ કર્મ નથી કરાવતું, પણ પોતે કરવા હોય તો થાય છે’ એ સમજુ, પોતાના સ્વાતંત્ર્યનો ઉપયોગ સારા વિચાર-વાણી વર્તનના પ્રયત્નમાં કરવા જેવો છે. એથી પેલા કર્મ જગાવેલાં રાગ-દ્વેષ-કોધાદિ-માનાદિ ભાવ નિષ્ફળ જાય છે, ને તેથી એવો જોરદાર નવો કર્મ બંધ નથી ઉભો થતો. એમ વારે વારે અને નિષ્ફળ કરતાં કરતાં મોહનીય કર્મનું જોર ઘટતું જાય, ને અંતે વીતરાગતા આવે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૪, તા. ૩-૧૦-૧૯૭૦

## ૧૧૧ ગુપ્ત ભંડાર અને એની ચાવી

પ્રવાસે નીકળેલા માણસને કોઈ યોગી ખૂશ થવાથી યોગી એને કહે છે ‘જ રાયણની પૂર્વ દિશાની છાયામાં નિધાન મળશે, કયા ગામમાં કઈ જગાએ એ ન કહું. એટલે પેલો માણસ વિચારે છે કે ફિકર નહિ, ગામે ગામ ફસું ને એ પ્રમાણે ખોદું મહેનત તો પડશે, પણ આ ગરીબીથી ત્રાસી ગયો છું, એમાં સંભવ છે યોગીના કહેવા મુજબ ખોદવાથી લાખોનો ભંડાર મળી જશે.’

ભાઈ હવે ઉપડ્યા ગામે ગામ, જ્યાં રાયણનું વૃદ્ધ જુએ છે ત્યાં પૂર્વ દિશાની

છાયામાં ખોટે છે; પરંતુ નિધાન મળતું નથી. એ ખૂબ ફર્યો, ખૂબ ફર્યો, અંતે થાકીને નિરાશ થઈ ધેર આવ્યો. ઘરના માણસને વાત કરે છે ‘યોગી મળેલા, એમની મેં સેવા કરેલી એમણે આ પ્રમાણે કહેલું, મેં એ રીતે કર્યું, પણ કાઈ મળ્યું નહિ.’ બધી વાત કરી. ત્યારે એ બાઈ કહે, ‘બધે ખોદું, પરંતુ આ આપણા ઘરની પાછળ રાયણનું ઝાડ છે ત્યાં ખોદું ?’

ભાઈ કહે ‘ના, એ તો હું ભૂલી જ ગયો. લાવ એ તો હમણા જ ખોદું’ એમ કહીને ત્યાં ખોટી નાખ્યું, અને નિધાન મળી ગયું.

એ મળવા પર મનને થયું કે ‘અરે ! હું કેવો મૂર્ખ કે નિધાન તો ઘર આંગણે પડ્યું હતું તે હું એ માટે બહાર ભટકી મર્યો ?

બસ, માણસો કોઈ ધનની ખોટ, કોઈ પુત્રની ખોટ, તંદુરસ્તીની ખોટ, માનપાનની ખોટ, વગેરે ખોટથી પીડાતા એને દૂર કરવા બહાર ફાંફાં મારે છે, કિંદગી પૂરી કરે છે ! પરંતુ ખરેખર અંદર પડેલા ગુપ્ત ભંડાર સામે તો જોતા જ નથી. એ ગુપ્ત ભંડાર એવા, કે પ્રગટ થયે પેલી બધીય ખોટને ભૂલાવી દે.

એ ગુપ્ત ભંડાર છે ચિત્ત શાન્તિનો સુકૃત-ઉલ્લાસનો, અને અહૃતુશ્રદ્ધાનો.

(૧) ચિત્ત જો શાંત-દુઃખ સ્વસ્થ હોય તો એ બહારની કોઈ ખોટમાં ઊંચુ-નીચું ન થાય, અરે ! એને ખોટરૂપ ગણે જ નહિ. એ તો જીવ સમજે કે ‘ખોટ ખરી તો માનવ-જીવનમાં નિષ્યાપતાની છે; સુકૃતસંચયની અને પ્રભુશ્રદ્ધાની ખોટ છે. આ ખોટને રોવાને બદલે પેલી ભજતી પોકળ ખોટોને શું રોડું ? બહારની ઓછાશમાં ચિત્ત શું કામ અશાંત કરું ? શાંત ચિત્તે નિષ્યાપતા અને સુકૃતોપાર્જન કર્યે જાડું.’

(૨) એમ, જો સુકૃતના ઉલ્લાસ અંદરમાંથી પ્રગટ કર્યા હોય, તો જીવ તન-મન-ધન-ઈન્ડ્રિયોના એટલા બધા સુકૃતોમાં લીન બની જાય, કે પેલી બહારની ખોટને યાદ કરવા કુરુસદ જ ન મળે. સુકૃતના વિચારો-ઉદ્ગારો તથા એક યા બીજા પ્રકારની સુકૃત-પ્રવૃત્તિઓ અને સારાં દર્શન-શ્રવણના ઉલ્લાસ બહારની ઓછાશમાં મનને જવા જ ન દે. ઉલ્લાસ ચીજ જ એવી છે.

(૩) એમ, અરિહંત દેવ પર અથાગ શ્રદ્ધા હોય, સીતાને મન એક રામ, એમ આપણે મન એક અરિહંત હોય, ને તેથી અરિહંત પ્રભુની આગળ દુન્યવી બધી સંપત્તિ-સમૃદ્ધિ-સન્માન, તુચ્છ નગણ્ય લાગતા હોય, તો બહારની કોઈ પણ ઓછાશ પર રોવાનું શું ?

ત્યારે સવાલ એ થાય કે ‘ખાટલે મોટી ખોડ, પાયો જ નથી’ એમ પહેલાં તો આ ત્રણ ગુપ્ત ભંડાર ખોલવા જ કેવી રીતે ?

ગુપ્ત ભંડાર ખોલવાની બે ચાવી છે, -(૧) એક તો એ સચોટ વિવેક જ્યાલ કે ‘સુખ-સન્માનાદિ મારા શુભોદયને બંધાયેલા છે, મને કે મારી હોશિયારીને નહિઃ’ આ ચાવી અર્થાત્ વિવેક જાગતો હોય પછી સુખ-સન્માન મળતાં મન છકી ન જતા શાન્ત રહે, સમજે કે ‘આ સુખસન્માન કાંઈ મારી હોશિયારીના ય નથી, તેમ મારી ઈચ્છા મુજબ રહેનારા ય નહિઃ; તો એમાં શું છકી જવું તું ? ત્યારે એ જતાં આપત્તિ-અપમાન આવે તો પણ મનને એમ થાય કે ‘શુભોદયને બંધાયેલા એ શુભોદયના ખૂટવાથી જાય એમાં મારે શું રોવાનું ? દીકરો કોઈ શ્રીમંતનો જમાઈ હોય તેથી એ શ્રીમંત તરફથી વેપાર મળતો હોય, પરંતુ દિકરો મરી જતાં એ વેપાર મળવાનું બંધ થાય, ત્યાં રોવાનું શું ? રોવું આવે તો દિકરાના જવા પર આવે; વેપારના જવા પર શું વેવાઈ સાથે લડવા જવાય ? એમ અહીં શુભોદય માંદો પડ્યો એના પર ખેદ થાય, પણ બાધ્ય સુખ-સન્માન જવા ઉપર ખેદ શો ? એમ ચિત્ત શાન્ત રહે.

ગુપ્ત ભંડારની બીજી ચાવી એ કે આપત્તિ-અગવડ એ તો થર્માભિટ છે. થર્માભિટ ૧૦૫ ડિગ્રી દેખાડે એથી શરીરમાં એટલો તાવ સૂચિત થાય છે; એમ આપત્તિ-અગવડથી અંદરમાં શુભોદયની કમી સૂચિત થાય છે. ત્યારે જેમ તાવમાં થર્માભિટ પર રોષ કે ખેદ નથી કરાતો, પરંતુ તાવ પર એ થાય છે, અને તાવને જ હટાવવાની દવા હોંશે હોંશે લેવાય છે, એમ અહીં પણ આપત્તિ પર ખેદ ન કરતાં શુભોદયની કમી હટાવવા સુકૃતસેવન જ હોંશે કરાય.’ આ વિવેક હોય, તો શું સંપત્તિમાં કે શું વિપત્તિમાં, શુભસંચય પુષ્ટ કરવા માટે સુકૃતના ઉલ્લાસ જાગતા રહે, શુભ વિચાર-વાણી-વર્તાવ અને શુભ દર્શન-શ્રવણની જાગતી અભિવાધા રહે.

(૩) એમ, અરિહંતદેવ પર અનન્ય શ્રદ્ધા પ્રગટ કરવામાં આવે તો એના ઉપર મનને એમ થાય કે મને જે આ પરમમંગળરૂપ પરમાત્મા મળ્યા છે એ જ અનન્ય નિધાન છે. એની એટલી બધી હુંક કેળવું કે બાધ્ય એની આગળ ‘કૂદ્ય નહિ’ લાગે. પછી બાધ્યની ખોટમાં કશી દુખામણ નહિ.

ગુપ્ત ભંડારની આ ગ્રણ ચાવીને સક્રિય બનાવવી જોઈએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૫, તા. ૧૦-૧૦-૧૯૭૦

## ૧૧૨ દરેક સાધનામાં જરૂરી તત્ત્વ

દરેક તીર્થકર ભગવાનની ચારિત્ર-સાધના ઉત્કૃષ્ટ કોટિની હોય છે. બીજ જીવોનું ચારિત્ર લઈને તરત એવી સાધનાનું ગણ્યું નહિ. ભગવાન તો છેલ્લાની પૂર્વ ભવથી મહા વિરાગી હોય છે; અને છેલ્લા ભવમાં આબ્યા પછી તો પૂછવાનું જ શું ? જનમતાં દિક્કુમારીઓ અને ઈંગ્રેજી જન્મોત્સવના મહાસન્માન કરે છે છતાં પ્રભુનો વૈરાગ્ય જવલંત ત્યાં લેશ પણ અભિમાન નહિ કે આસક્તિ નહિ. એમ રાજ્યપાટ પામતાં પણ એવો જ જવલંત વૈરાગ્ય, અનાસક્તિ; નિરહંકાર. ત્યારે ચારિત્ર લીધા પછી તો લગભગ ખડાખડા ધ્યાન, અને મહા અનાસક્તિ એવી કે કોઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના મમત્વ નહિ; ચાદ્ય મોટા વેતાલ ઉપદ્રવ કરવા આવે યા અનાર્થના ક્ષેત્ર હોય, યા ધોર શ્રીષ્ટ કે કડક ઠંડીનો કાળ આવે, યા સામે દુષ્ટોના ભયાનક ભાવ યાને બીવરાવવાનો, કે ફેઝેટ કરવાનો, અથવા પ્રહારનો યા કોઈ વેદના જગાવવાનો ભાવ આવે, તોય પ્રભુને એની પરવા નહિ; સારા દ્રવ્યાદિ પર રાગ નહિ, અને નરસા પર દ્વેષ નહિ.

બધા જ તીર્થકર ભગવાનોની એવી એકસરખી ઉત્કૃષ્ટ આરાધના છતાં કેવળજ્ઞાન વહેલુ-મોહું કેમ ? એવું કેમ કે કેવળજ્ઞાન કોઈને દીક્ષાના જ દિવસે, તો કોઈને ૫૪ દિવસે, ને કોઈને ૮૪ દિવસે, ત્યારે ઋષભદેવ પ્રભુને વળી ૧૦૦૦ વર્ષ કેવળજ્ઞાન ?

આનો સામાન્ય ખુલાસો એ છે કે તે તે ભગવાનના સિલિકે રહેલાં બાધક કર્મમાં તફાવત, તેથી એનો નાશ થવાના સમયમાં બિન્ન-બિન્નતા. પરંતુ સવાલ એ થાય કે એમને અતિ ઉચ્ચ કોટિના ધ્યાનની પ્રબળતા થઈ શુક્લધ્યાન આવીને એ બધા બાધક કર્માનો ક્ષણમાં ધ્વંસ કેમ ન થાય ? જ્યારે અનેક મહાપાપી જીવોએ એ રીતે ક્ષણવારમાં કર્મધ્વંસ કર્યા છે, તો તીર્થકર ભગવાનને શી વાર લાગે ? છતાં કેમ એમ નથી બનતું ?

આનું કારણ એ છે કે એવી સ્થિતિ ઊભી થવા માટે અપૂર્વકરણનો સામર્થ્યોગ આવવો જોઈએ; અને એ લાવવા માટે તેવી ઉચ્ચ અનાસંગ અનુષ્ઠાન-સાધના જોઈએ.

‘અનાસંગ સાધના’ એટલે જગતના પદાર્થ યાવતું કાયા પ્રત્યે તો અનાસક્ત

ભાવ ખરો, ઉપરાંત પોતાની સાધના પ્રત્યે પણ ઉચ્ચ અનાસંગ દશા જોઈએ; અર્થાત્ લેશમાત્ર આસક્તિ, ઊર્મિ, આતુરતા નહિ. સાધના, ચંદનમાં ગંધની જેમ, આત્મામાં સહજ સ્વાભાવિક બની ગઈ હોય. ચંદનને કાઈ એ ગંધ મધ્યમધાવવાના ઉમળકા-હોશ-ઉત્સાહ નથી સેવવા પડતા; ગંધ સહજ મધ્યમધતી બની ગઈ હોય છે. એમ ઉત્કૃષ્ટ અનાસંગ દશામાં સાધનાનો ઉમળકો નહિ; સાધના સહજ થઈ ગઈ હોય છે.

તીર્થકર ભગવાનને પણ આ ઉચ્ચકોટિનો અનાસક્ત ભાવ આવવામાં જેટલી વાર લાગે એટલો વીતરાગ કેવળજ્ઞાની બનવામાં વિલંબ થાય. આ સુચવે છે કે-

(૧) અનાસંગ દશા કેટલી બધી સૂક્ષ્મ કોટિની લાવવાની હોય છે કે એમાં તીર્થકર ભગવાન જેવાને પણ વિલંબ થાય છે. ત્યાં આપણી કઈ સાધના પર ગુમાન રાખી શકીએ કે હું પામી ગયો, મારા જેવી સાધના કોણ કરે છે? હું કેવો સારો બની ગયો છું?

(૨) અનાસગંદશા કેટલી બધી ઉચ્ચકોટિની છે કે એ લાવ્યા વિના બીજ કોઈ પણ સાધના-સુકૃતથી જંપ વાળીને બેસાય નહિ. તેમજ એમાંય ઉચ્ચ ઉચ્ચ કષ્ટ હોય છે તેથી નીચેની કક્ષાની એ દશા આવીનેય સંતોષ વળાય નહિ.

(૩) બીજ બધીય સાધના કરવા છિતાં આ અનાસક્ત દશા લાવ્યા વિના ચાલે નહિ. અર્થાત્ દરેક સાધના કરતાં આ દશાનું લક્ષ રાખવું પડે કે એની ભૂમિકા પણ સર્જાઈ રહી છે ને?

(૪) અનાસંગ સાધનામાં સાધના પર પણ આસંગ-આસક્ત નથી, તો પછી એ સ્થિતિએ પહોંચવા માટે પહેલાં જગતનાં ભાવો-પદાર્થો અને પોતાની કાયા-ઇન્દ્રિયો-અહંત્વ ઉપરથી કેટલું આસક્તિ કાપતા ચાલવું જોઈએ.

આમ આત્મહિતના વિકાસ માટે ધર્મસાધના-સુકૃત-સદ્ગુણોનું (૧) અહંત્વ નહિ, (૨) સંતોષ નહિ, સાધના સાથે (૩) અનાસક્ત ભાવની ભૂમિકાનું નિર્માણ અવશ્ય કરાય, અને એ માટે (૪) કાયા-માયાની આસક્તિ તોડતા ચાલવું જોઈએ.

આ ચોથી વાત પર ખૂબ લક્ષ રાખવાની જરૂર છે. નાની દેવદર્શનની પણ સાધના કરતા હોઈએ તોય એની સાથે આ અવશ્ય કરવાનું કે કાયા-માયા પ્રત્યેના આકર્ષણ કંઈક તો મોળા પડે જે; દુનિયાના પદાર્થ ઉપરના રાગ-દ્રેષ્ણને ધક્કો લાગે જે. દરેક સાધનામાં આ જરૂરી તત્ત્વ છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૬, તા. ૧૭-૧૦-૧૯૭૦

## ૧૧૩ પ્રભુના નામની શીતલતા

ઉપા. શ્રી. યશેવિજ્યજી મહારાજ પ્રભુને સ્તવનાં કરતા કહે છે,  
‘શીતલતાગુણો હોડ કરત તુમ, ચંદન કહાં બિચારા;  
નામે હિ તુમ પાપ હરત હો, વાંકુ ઘસત ઘસારા,’

અર્થાત્ પ્રભુ! શીતલતાગુણમાં ચંદન તમારી સાથે શી હોડ કરી શકતુંતું? કેમ કે તમે તો તમારા નામમાત્રથી પણ તાપ હરી શીતલતા કરો છો ત્યારે એ ચંદન ઘસાયા પછી શીતલતા કરે છે.

કવિનું આ કથન એક સૂચન એ કરે છે કે પ્રભુનું નામ એ રીતે સંભારો કે જેથી અંતરમાં શીતલતાનો ઠંડકનો શેરડો પડે, કથાયના ને રાગ-દ્રેષ્ણના તાપ શાંત થાય.

એટલું ધ્યાનમાં રહે કે જીવને તાપ અકળામણ જે થાય છે એ કોઈ બાધ્ય પ્રતિકૂળતાના ઘરની નથી, કિન્તુ એના પ્રત્યેના દ્રેષ્ણના અને અનુકૂળ પ્રત્યેના રાગના ઘરની છે. જો અનુકૂળ ચીજ પર રાગ નથી, પ્રતિકૂળ પર દ્રેષ્ણ નથી, તો અનુકૂળ બગડુયા પર કોઈ અકળામણ નહિ થાય. પતિને પત્ની રીસાય તો અકળામણ ન થાય? ના, કેટલીક વાર પતિ પત્નીની રીસ પર એને મનાવવામાં મોજ માણો છે એટલે અકળામણનો સંબંધ બાધ્ય પ્રતિકૂળ સાથે ન રહ્યો.

બસ, આટલું સમજાઈ જાય કે ‘તાપ અકળામણ મુખ્ય તો અંતરના કોઈ રાગ દ્રેષ્ણ વગેરેને લીધે છે,’ તો પછી એ રાગાદિના તાપ પ્રભુના નામથી મિટવા પર શ્રદ્ધા કેમ ન થાય? પૈસા ગુમાવ્યા, સંતાપ થયો, તો પ્રભુનું નામ લેતા પૈસા આવી જઈને સંતાપ મટી જાય એમ નહિ, (કેમકે એમાં તો ફરીથી પાછા પૈસા જઈ સંતાપ થવાનો ભય ઊભો રહે,) કિન્તુ એ પૈસાના રાગનો તાપ પ્રભુના નામથી મટે; પછી પૈસા ગુમાવ્યા પર સંતાપ ન થાય.

તો સવાલ એ થાય કે પ્રભુનું નામ લેવા માત્રથી રાગનો તાપ શી રીતે મટે?

આનો જવાબ ૨-૩ દિશાનથી સ્પષ્ટ થશે. ચંડકોશિક સાપને વીર પ્રભુએ ડાખ્યો કર્યા પછી કીડીઓએ વીધવા માંડચો, આનો કેટલો બધો તાપ-ત્રાસ? છિતાં ચંડકોશિકે પ્રભુનામની રટણા રાખી તો એને એવી ઠંડક આવી કે મનને એમ થયું કે મારે શરીર સાથે શો સંબંધ છે? મારે તો પ્રભુની સાથે સંબંધ છે. પ્રભુના શરીરને મેં જેરી બટકા ભર્યા, તો મારા પ્રભુએ શરીરની પરવા નહોતી કરી, તો

પછી પ્રભુના સેવક મારે પણ દેહની શી પરવા ? આમ કીડીઓ પર દ્રેષ્ણનો તાપ ઉઠવા જ ન દીધો. પ્રભુનામની આ શીતલતા.

ચંદનબાળાના પિતા રાજ લાર્ડમાં મર્યાદ, રાજ્ય ગયું, માતા સાથે એને સિપાઈ ઉપાડી જાય છે. સિપાઈના ‘તને હું પત્ની બનાવીશ,’ એમ કહેવા પર માતા જીબ કચડીને મરી. સિપાઈએ પછી ચંદનાને બજારમાં ધનાશેઠને વેચ્યો; એમાં વળી ધનાશેઠની હિંધણું પત્ની મૂળાંથી ચંદનાનું માથું મુંડાવી પગમાં બેડી નાખી ભોયરામાં પૂરી; જ્યાં ત્રાણ દિવસ ભૂખી તરસી રહેવું પડ્યું. આમ ચંદના પર કેટલા હુઃખ ? ત્યાં શું મનને એમ ન થાય કે હાય ! બાપ ગયા, મા ગઈ, રાજ્ય ગયું, પછીય અહીં ધનાશેઠને ત્યાં શાંતિ ન મળી ? આ મજેનો કેશકલાપ કપાઈ જઈ ભોંયરે બેડીએ જકડાવાનું આવ્યું ? મારે ધરનું કોઈ નહિ એટલે આ ? આવા કોઈ ઓશિયાળા નહિ, રૂદન નહિ, સંતાપ નહિ, પણ ત્રાણ દિવસ-રાત મહાવીર પ્રભુનું નામ જપવા પર મહા શીતલતા, શાંતિ. તેથી તો ત્રાણ દિવસે પત્તો મળતાં ધનાશેઠ ત્યાં આવી ‘હાય ! દિકરી ! તારી આ દશા ?’ બોલતાં ધૂસકે રડી પડ્યા, તો ચંદના એમને આશ્વાસન આપે છે, “રુવો શું કામ ? મારે તો મારા પ્રભુનું નામ અંડ રટવાની, ભારે અનુકૂળતા એને મજા થઈ, એમાં હુઃખ શું ? પ્રભુનામની કેવી શીતલતા ?

પાલક પાપીએ મુનિસુવ્રત ભગવાનના શિષ્ય ખંધકસૂરિના ૪૮૮ શિષ્યોને ઘાણીમાં પીલી નાખ્યા પછી બાળમુનિનો વારો આવ્યો. એ ગભરાયા નહિ. પૂર્વ મુનિઓનાં, પરાકમ જોઈ એમને શૂરાતન ચડ્યું, તે ઘાણીમાં જાતે ફૂદી પડ્યા. પીલાતાં શરીર ભયંકર છુંદા થઈ રહ્યું છે, કેટલો અતિ ભયંકર ત્રાસ ? પરંતુ એમણે જાણું ભણેલા નહિ છતાં, મુનિસુવ્રત પ્રભુનું નામ રટ્યા કર્યું. એ નામે એવી શીતલતા આપી અંતરના દ્રેષ્ણનો તાપ ખત્મ કર્યો કે પાલક પર એમને દ્રેષ ન જાગ્યો, હાયવોયનો તાપ ન અડ્યો. ભગવાનના નામની કેવી લગન લગાડી કે બસ જાણો મન બોલે છે, ‘અહાહા ! કેવું ઘારું પ્રભુનું નામ ! મુનિસુવ્રતનાથ ! મુનિસુવ્રતનાથ !..... મારે પ્રભુ સાથે સંબંધ; શરીર સાથે શો સંબંધ ? પ્રભુનામ સાથે સંબંધ, શરીર પીડા સાથે શો સંબંધ ?’ આમ પ્રભુના નામથી, દિલમાં એવી ઠંડક થઈ ગઈ કે કારમી વેદનાના તાપ ઉઠ્યા જ નહિ, ખેદ ન થયો, ધ્યાનમાં ચડી મોક્ષે ગયા.

બસ, જળબર શ્રદ્ધા સાથે પ્રભુનું નામ રટાય તો અંતરના તાપ મિટાવી અલોકિક શીતલતા મળે છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૮, તા. ૧૪-૧૧-૧૯૭૦

## ૧૧૪ સમ્યકૃત્વના પ લક્ષણના ઉત્પત્તિક્રમના રહસ્ય

(લેખાંક-૧)

શ્રી તત્ત્વાર્થ મહાશાસ્ત્રે સમ્યગ્દર્શનનાં પાંચ લક્ષણ શમ-સંવેગ-નિર્વેદ-અનુક્રમા-આસ્તિક્ય બતાવી, એમની ઉત્પત્તિનો કમ ઊલટો યાને પશ્ચાનુપૂર્વથી કહ્યો. અર્થાત્ પહેલાં આસ્તિક્ય મગટે, પછી અનુક્રમા પછી નિર્વેદ, પછી સંવેગ, એને પછી શમ-પ્રશમ ઉત્પન્ન થાય, એમ કહ્યું.

ત્યારે અહીં વિચારણીય બને છે કે શું આસ્તિક્ય વિના અનુક્રમા ન આવે ? અનુક્રમા વિના નિર્વેદ ?...આ ઉત્પત્તિક્રમનાં રહસ્ય શાં છે ?

અલખત આસ્તિક્યના અર્થમાં, ‘આત્માનું આત્માના બંધ-મોક્ષનું અસ્તિત્વ માને તે આસ્તિક, એ હિસાબે આત્માદિના અસ્તિત્વની માન્યતા એવો અર્થ લેતાં તો સ્વાત્પાવિક છે કે આવાં આસ્તિક્ય વિના જ્યાં જીવતાત્વ માનવું જ નથી તો પછી જીવની અનુક્રમા યાને દ્યાની વાત જ શી હોય ? માટે આસ્તિક્ય પછી અનુક્રમા આવે એ બરાબર છે, એમ લાગે.

પરંતુ આ પાંચ લક્ષણમાંના ‘આસ્તિક્ય’ નો માત્ર, આટલો જ અર્થ નથી, કિન્તુ એ અર્થ કર્યો, કે- ‘જે જિન ભાખ્યું તે નવિ અન્યથા, એહવો જે દઢ રંગ, એ આસ્તિક્ય લક્ષણ પાંચમું...’ ‘તમેવ સચ્ચ ણિસસંક, જં જિણેહિ પવેઝ્યિ’ આ શ્રદ્ધા એ આસ્તિક્ય. ‘વીતરાગ સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવંતે ભાખ્યું તે જ સાચું; તે સાચું જ, જરાય શંકાસ્પદ નહિ.’ આ શ્રદ્ધારૂપી, આ દઢ, રંગરૂપી આસ્તિક્ય આવ્યા વિના શું અનુક્રમા ન આવે ? તો પછી મેઘકુમારના જીવ હાથીને કાંઈ એવું આસ્તિક્ય તો હતું નહિ, તો એને સસલાની અનુક્રમા શી રીતે આવી ? અનુક્રમા આવી છે એવા શાસ્ત્ર અસ્ત્ર એ.

શ્રી શાતાથ્યયન નામના ‘શ્રી ભગવતીજ’ પાંચમા અંગસૂત્ર પછીના અંગસૂત્રમાં શ્રી મહાવીર પરમાત્મા, મેઘકુમાર મુનિને દીક્ષાની પહેલી રાતે પોતાના સંથારામાં મુનિઓના ચરણની ૨૪ ભરાવા પર કંટાળીને ઘરે જવાનો વિચાર આવતાં, મુનિને કહે છે ‘તું પૂર્વ ભવ યાદ કર તું હાથી; તેં સસલાની દ્યા કરેલી એ દ્યા કેવી તારણહાર ?

તાએ પાણાણુક્પાએ, ‘પરિત્તી કાઓ સંસારો’  
તે જીવદ્યાથી તેં સંસારભ્રમણ મર્યાદિત કરી દીધું.

આ ટંકશાળી ગણધરવચનથી હાથીને, જિનવચનની શ્રદ્ધા નહિ મળેલી છતાં જીવની દયા આવી હતી એ હકીકત છે; તો પછી અહીં તત્ત્વાર્થ સૂત્ર-કથિત શમસંવેગ...આસ્તિક્યમાં ઉત્પત્તિક્રમ ઊલટો લઈ, ‘આસ્તિક્ય’ (જિનવચન-શ્રદ્ધા) પછી જ અનુકૂંપા આવે’ એમ કેમ કહ્યું ?

આનું સમાધાન, એ હોઈ શકે કે,-

(૧) આ પાંચ લક્ષણમાં ‘અનુકૂંપા’ એકલી દ્રવ્યદ્યારૂપ નહિ, કિન્તુ દ્રવ્યદ્યા-ભાવદ્યા બંને સ્વરૂપ લેવી છે. ‘દ્રવ્યદ્યા’ એટલે ભૂખ-તરસ-અપમાન-મારપીટ પ્રાણનાશ વગેરે દ્રવ્યદ્યાઓ દૂર કરવાની ઈચ્છા. પ્રસ્તુતમાં સસ્લાના ગ્રાણ બચાવ્યા એ દ્રવ્યદ્યા. ભાવદ્યા એટલે જિનેશ્વર ભગવાને કહેલ પાપ-અધર્મ-કણાય-દુઃખુદ્ધિ-ભૂલ-અસમાધિ-દુર્ધ્યાન વગેરેથી બચાવવાની ઈચ્છા. આ પરથી સ્પષ્ટ છે કે પહેલી જિનવચનશ્રદ્ધા આવે તો એના પર જિને કહેલા પાપો દુઃખરૂપ લાગે ને એ પાપોથી બચાવવાની ઈચ્છા આવે. એ વિના દયાની વાતેય શી ? માટે પહેલાં જિનવચનશ્રદ્ધારૂપ આસ્તિક્ય આવે, પછી દ્રવ્ય-ભાવ અનુકૂંપા જન્મે, એ કમ કહ્યો.

(૨) આ કમનું બીજું સમાધાન એ હોય કે અનુકૂંપા લક્ષણ એવું લેવું છે કે જે વળી આગળ નિર્વેદ, સંવેગ પ્રશન ઉત્પન્ન કરે. ત્યારે, હાથીના જીવને સસ્લા પર દયા તો થઈ, પરંતુ એ દયા પર ત્યાં એને નિર્વેદ કયાં જાગ્યો છે ! ‘નારક ચારક સમજીવ ઉભયો,- ચાહે નીકળવું નિર્વેદ તે,’ અર્થાત્ ભવને સંસારને નરકાગર કારાગર સમાન સમજ એના પર ઉભયો, ઉદ્ઘેગ થાય. એને એમાંથી નીકળવા ચાહે એનું નામ નિર્વેદ, વૈરાગ્ય. એવો સંસારવૈરાગ્ય હાથીને નથી જાગ્યો. તેથી એ અનુકૂંપા સમ્યકૃત્વનાં લક્ષણરૂપ અનુકૂંપામાં સમાવેશ પામતી ન ગણી શકાય.

આ બે સમાધાન પરથી સૂચિત થાય છે કે (૧) સમ્યકૃત્વના ઘરની દ્રવ્યદ્યા ભાવદ્યાથી ભિશ્રિત જોઈએ. દા.ત. ભૂખ્યા ભિખારીને ખાવા અન્ન વગેરે આપવાની ત્યાં દયા કરીએ ત્યાં મનને થાય કે આ બિયારો ભૂખથી વિહૂવળ છે, અસમાધિમાં છે. તો લાવ એને ખાવા આપું, તેથી એના ચિન્તને શાંતિ થાય, એની વિહૂવળતા-અસમાધિ-દુર્ધ્યાન મટે, ઓછું થાય. આમ અસમાધિનું ભાવદ્યાઓ મિટાવવાની ઈચ્છા આવી એ ભાવદ્યા થઈ. અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે છતી શક્તિએ આવા પ્રસંગમાં દ્રવ્યદ્યા ન કરાય, તો એમાં ભાવદ્યાની પણ ઉપેક્ષા થઈ ગણાય, ને એના બદલે એને અસમાધિ રહે એમાં મારે શું ?’ એવી કઠોરતા આવે; તેરાપણે માન્યતા દ્રવ્યદ્યાને અધર્મ-મનાવી જાણ્યે-અજાણ્યે આ ભયંકર દોષને વહેરે છે.

(૨) સીદાતા સાધર્મિકને ટેકો કર્યો, એથી એ વેપારમાં આગળ વધ્યો, ને ભાગ્ય ખૂલતાં લાખો રૂપિયા કમાયો; ત્યાં જો આપણને દ્રવ્યભક્તિ સાથે ભાવદ્યા

જાગ્રત હોય, તો એ લૌકિક સમૃદ્ધિની કમાણીની અનુમોદના ન કરાય કે ‘આ સારું કમાયો;’ કેમકે એમાં તેના રાગાદિ ભાવદ્યાખ વધી રહ્યા છે. અલબત્ત ત્યાં ઈર્ઝ કે દુઃખ ન કરાય કે ‘આ કયાં કમાયો ?’ કિન્તુ એ કમાઈ પર દૃષ્ટિ ન લઈ જતાં વિચાર આવે તો એટલો આવવો જોઈએ કે ‘આને તે વખતે અસમાધિ ટળી એ સારું થયું. હવે એ બહુ રાગ-લોભ-મૂર્ખા-આરંભ-વિષયોના પાપમાં યાને ભાવદ્યાખમાં ન પડે અને સારાં સુકૃત કરે, ષટ્કાય જીવ-વિરાધનામય ધંધા બંધ કરે, રાગાદિ પાપ ઘટાડી દેવ-ગુરુ-ધર્મની સુંદર આરાધના પ્રાભાવના જમાવે અને એ રીતે પોતાનું આત્મહિત સાથે તો સારું.’

જિનવચન-સર્વજ્ઞવચનની શ્રદ્ધા વિના આ ભાવદ્યા આવવી મુશ્કેલ છે. સર્વજ્ઞવચન જ આ શિખવાએ છે; બાકી અસર્વજ્ઞના શાસ્ત્ર બીજાની લૌકિક સમૃદ્ધિ પર ખુશીને પાપરૂપ નહિ સમજાવે. તેથી જ ‘એના રાગાદિ પાપરૂપ ભાવદ્યાખ ટળો,’-એવી કરુણા ક્યાંથી શીખવે ?

(૩) અનુકૂંપા જાગવા પર નિર્વેદ જાગે. ‘એનું કારણ એ છે કે અનુકૂંપા સામાનાં દ્રવ્ય ભાવદ્યાખ યાને ભૂખ-રોગાદિ તથા પાપ-અધર્મ’ આદિ સહન ન થવાથી થાય છે, અને એ દુઃખ મૂળમાં સંસારનાં કારણો છે, તેથી સંસાર ખરાબ લાગે, એના પર જ્લાનિ-ઉદ્ઘેગ-અરુચિ થાય એનું નામ નિર્વેદ. આમ અનુકૂંપા થવા સાથે નિર્વેદ સહેજ થાય.

“દ્રવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૮, તા. ૨૧-૧૧-૧૯૭૦

૧૧૫ (લેખાંક-૨)

સમ્યકૃત્વના ૫ લક્ષણમાં પહેલાં આસ્તિક્ય (જિનવચનશ્રદ્ધા) ઉત્પન્ન થયા પછી દ્રવ્ય-ભાવ-અનુકૂંપા જન્મે. એમાં (૧) દ્રવ્યદ્યા, ભાવદ્યાથી ભિશ્રિત જોઈએ, તેથી જ દ્રવ્યદ્યાની ઉપેક્ષા કે અપલાપ ન કરાય, તેમજ (૨) દ્રવ્યદ્યા થવા ઉપર સામાને લૌકિક સમૃદ્ધિ વધે એની અનુમોદના ન કરતાં ભાવદ્યાનો વિચાર જોઈએ, વળી (૩) અનુકૂંપા પર નિર્વેદ વૈરાગ્ય જાગવો જોઈએ; કેમકે અનુકૂંપા દુઃખ પર ને દુઃખ સંસારના કારણો માટે સંસાર ખરાબ, આમ ત્રણ રહસ્ય જોયાં. હવે ચોથું રહસ્ય્ય,-

(૪) જ્યાં દ્રવ્યદ્યા કરવાનો પ્રસંગ ન હોય પરંતુ ભાવદ્યાને અવકાશ હોય, દા.ત. કોઈ પાપ, દુઃખુદ્ધિ કે કણાયમાં ચડ્યો હોય, ત્યાં એના પર દ્રેષ નહિ, કિન્તુ ભાવદ્યા કરવી જોઈએ, ‘એ બિયારો જીવને સદ્બુદ્ધિ મળો, એનો કણાય નાણ થઈ એને ઉપશમ મળો’ એવી કોઈ કરુણામય ભાવના થવી જોઈએ.

૨૩૨

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

આનું એક કારણ એ છે કે ભાવ-અનુકૂળ માત્ર બીજા જીવની કરવાની છે એવું નથી પરંતુ પોતાના આત્માની ય કરવાની છે. એથી, જો પોતે બીજાના પાપ દુર્ભુદ્ધિ કે કષાય જોઈ એ જીવ પર દેખ કરવા જીય તો પોતાને સ્વેચ્છાથી એ દેખરૂપી ભાવદૃષ્ટમાં ઘસડવાનું થાય, ત્યાં પોતાની દ્વારા ઉડી જીય. કદાચ દેખ થઈ આવવા જીય તો ખરી રીતે પોતાની ઉપર દ્વારા લાવવી જોઈએ કે અરેરે ! હું ક્યાં ભૂલ્યો ? સામાના દોષે ક્યાં હું જીતે દેખાદિ દોષમાં પડ્યો ? મારા દિલમાં ઉપશમભાવ રહે. જેથી-હવેથી બીજાનાં પાપ આદિ દોષ પર હું જીતે દેખાદિ દોષમાં ન પડું, ‘આ સ્વાનુકૂળ્યા પ્રગટે. અને જિનવચનની શક્તા કરાવે,

આમ જિનવચનની શક્તા અર્થાત્ આસ્તિક્ય પદ્ધી અનુકૂળપાલક્ષણનો જે ઉત્પત્તિક્રમ બતાવ્યો એ આપણને પ્રેરે છે કે સાચી શક્તા થઈ હોય તો આ સ્વપરની ભાવ-અનુકૂળ લાવો; તેમજ એ માટે જરૂરી અને શક્ય-દ્રવ્યદ્વારા ન ચૂકો. ભૂખે મરતાને શક્તિ છતાં અન્ન ન દેવાથી એની અસમાધિ પર ભાવદ્વારા કરવાનું ગુમાવાય છે, કઠોરતા આવે છે.

પ્ર.- તો પદ્ધી સાધુ કેમ ભૂખ્યા બિભારીને અન્ન આપતા નથી ?

૩.- સાધુ અને ગૃહસ્થની કક્ષામાં ફરક છે, તેથી ગૃહસ્થના આત્મરોગ પરની દવા સાધુને ન ચાવે. ગૃહસ્થ પરિગ્રહ લઈને બેઠો છે, તેથી એ જો ઉચ્ચિત દ્રવ્યદ્વારા ચૂકે તો એટલી એની પરિગ્રહમૂર્ચણનો રોગ ન કપાય. પરિગ્રહમાંથી દે તો મૂર્ચણ કપાય ને ? અવસર આવ્યે છતી શક્તિએ ન દે તો પોતાનો મૂર્ચણ રોગ એમજ ઉભો રહેવાથી પોતાની ભાવદ્વારા ગઈ, તેમજ સામાની અસમાધિ ન ટાળવાથી સામાની ભાવદ્વારા ગઈ, ને એની ઉપેક્ષામાં પોતાને કઠોરતા થઈ એમાં પણ પોતાની ભાવદ્વારા ગઈ. આમ દ્રવ્યદ્વારા ઉડાડવામાં સામાની એક અને પોતાની બે ભાવદ્વારા ગુમાવી.

ત્યારે સાધુની સ્થિતિ જુદી છે સાધુ અપરિગ્રહી છે એટલે પોતાનો પરિગ્રહરોગ કાપવાનો સવાલ ઉભો નથી થતો. પરિગ્રહ નથી એટલે ક્યાંથી દે ?

પ્ર.- પણ અન્ન વસ્ત્ર વહોરી લાવીને તો ભૂખ્યાને ટાડે થથરતાને આપી શકે ને ?

૩.- કિન્તુ પહેલાં તો એ લાવે એટલે પરિગ્રહ ઉભો થાય. ધ્યાનમાં રહે કે પોતાના માટે અતિ જરૂરી અન્ન વસ્ત્ર વહોરી લાવે એ તો સંયમસાધનામાં ઉપયોગી દેહની અનિવાર્ય જરૂરીયાત છે; નહિતર અન્ન વિના દેછ ટકે નહિ, તો સંયમ શી રીતે પાળે ? એમ વસ્ત્ર વિના ઠંડીમાં ચિત્તસ્વસ્થતા સમાધિ ન રહે, તેમ શીલ લજજા ન રહે ત્યાં સંયમ-સ્વાધ્યાયાદિમાં ચિત્ત શી રીતે સ્થિર રહે ? એટલે પોતાના

માટે અત્યન્ત જરૂરી અન્ન વસ્ત્ર લાવે એ સંયમપોષક હોઈ પરિગ્રહરૂપ નથી. પણ એ સિવાયના જિનપૂજાર્થે કે શ્રાવક સહાય અને હુઃખિતદ્વારા અર્થે લાવે ત્યાં લાવવામાં પરિગ્રહ થાય. પરિગ્રહનો સર્વથા ત્યાગ હોઈ એવું લાવવાનું નહિ પદ્ધી દ્રવ્યદાનનો સવાલ જ નથી ઉભો થતો.

પ્ર.- પણ ભૂખ્યાની અસમાધિ તરફ ઉપેક્ષા કરવાથી સાધુને કઠોરતા આવે ને ?

૩.- ના સાધુની દષ્ટિ બહુ વિકસિત છે, એ તો ભૂખ્યાની અસમાધિની જેમ પેટ ભરીને ભોજનની મોજ કરનારના રાગનીય અસમાધિ જુએ છે એટલે એમને તો શું ભૂખ્યા કે શું ભરેલા, શું નિર્ધન કે શું ધનવાન, બધાની અસમાધિની દ્વારા ખાય છે, અને ચિત્તવે છે કે આ બિચારા જીવો આ રાગ-દેખ અને એના કારણોથી ધૂટે તો સાંદું ? આ એક યા બીજા પ્રકારનાં કર્મથી પીડાતા જીવોના મૂળપાયાના કર્મરોગ હટે તો સાંદું ! આમ, સાધુની ભાવદ્વારા મોટી છે.

સારાંશ, દ્રવ્યદ્વારાની શક્તિવાળાએ શક્તિ અનુસાર દ્રવ્યદ્વારા ન ચૂકાય નહિતર ભાવદ્વારા ચૂકવાનું થાય. તેમ દ્રવ્યદ્વારા ભાવદ્વારાથી યુક્ત જોઈએ. પાંચ લક્ષણના કમનું આ એક સમાધાન.

બીજા સમાધાનમાં અનુકૂળ જગ્યા પર નિર્વેદ જાગે. નિર્વેદ એટલે ભવવૈરાગ્ય. હાથીને સસલાની દ્વારા વખતે એ નહોતો થયો.

પ્ર.- ભર્તૃહરી જેવાને તો આસ્તિક્ય યાને જિનવચન શક્તા વિના વૈરાગ્ય નિર્વેદ હતો તો કમ ક્યાં રહ્યો કે પહેલા આસ્તિક્ય આવે પદ્ધી જ નિર્વેદની ઉત્પત્તિ થાય ?

૩.- ભર્તૃહરી વગેરેનો નિર્વેદ સભ્યક્તવનાં લક્ષણ રૂપ નથી. સમકિતનનું નિર્વેદ-લક્ષણ આ ‘ભવને કારાગાર કે નરકાગાર સમજી એથી ઉભગીને એથી ધૂટવા ચાહે તે નિર્વેદ. અહીં ભવ એટલે માત્ર આરંભ-પરિગ્રહ, બંગલા-બગીચા કે ધન-પરિવાર જ નહિ, કિન્તુ એ બધાનો પ્રતિજ્ઞાપૂર્વક સર્વત્યાગ નહિ, સર્વવિરતિ નહિ, એ અવિરતિ પણ ભવ. એનાથી ધૂટવા ચાહે તે નિર્વેદ, ભર્તૃહરી જેવાને સર્વજ્ઞશાસન નહિ મળેલું, તેથી આ ‘અવિરતિ’ સમજેલાજ નહિ, તેથી એનાથી ધૂટવાની ઈચ્છારૂપ નિર્વેદ ક્યાં આવે ?

સારાંશ આસ્તિક્ય પદ્ધી અનુકૂળ જનમે, એના પર નિર્વેદ જાગે. જીવોના અસમાધિ-રાગદ્રેષ-કષાયાદિ ભાવદૃષ્ટભોંગ અંગે ભાવદ્વારા આવે એટલે સહેજે મનને થાય કે સંસાર આ હુઃખદ ભાવ હુઃખોથી ભરેલો છે,

તોબા એનાથી; તો ક્યારે હું એથી ધૂટું, આમ અનુકૂળ પર નિર્વેદ પ્રગટે.

## ૧૧૬ સહિષ્ણુતા-સહનવૃત્તિના અદ્ભુત લાભ

મનુષ્ય માત્ર સુખને ચાહે છે. પરંતુ સુખ ચિત્તની સ્વસ્થતા વિના યાને કલેશાપીડિત ચિત્તદશમાં અનુભવાતું નથી, ચિત્તમાં કલેશ-અસ્વસ્થતા પ્રગટવાનું કારણ અસહિષ્ણુતા છે, અ-સહનવૃત્તિ છે. મનને જરાક અણગમતું અ-માફક અઠીક આવ્યું, એ શાંતિથી (૧) સહી લેવાનું (૨) બરદાસ્ત કરી લેવાનું, કે (૩) કોઈ દાઢિએ સારા રૂપનું માની લેવાનું, પોષાતું નથી, એટલે મન અ-સહિષ્ણુ બને છે તેથી મનમાં કલેશ થાય છે.

ત્યારે જો આવી પેદે પ્રતિકૂળ સંયોગ શાંતિથી સહી લેવાની વાત ન હોય. તો પછી હાથે કરીને કષ્ટ પ્રતિકૂળ ઊભું કરીને સહન કરવાની વૃત્તિની તો વાતેય શી ? કેમ આમ ? ચિત્તમાં એવું સત્ત્વ નથી કે જે આપત્તિ-કષ્ટ અગવડ વખતે ચિત્તને સ્થિર અ-વિકૃત અ-વિકારી રાખી શકે; આનું કારણ ચિત્ત સુંવાળાશ અને સુખશીલતાનું લંપટ છે. બીજી બાજુ પુણ્ય એટલું પ્રબળ નથી કે કોઈ વાતની પ્રતિકૂળતા-અગવડ અપ્રિયસંયોગ ન જ ઊભા થાય. એ થતા સુંવાળું સુખશીલ મન કલેશમાં પડવાનું. કલેશ એટલે સુખ-શાન્તિનો લોપ; પછી ભલેને મોટી રાજ્યસંપત્તિ કે લાખો-કરોડો રૂપિયાની સંપત્તિ મળી હોય.

આ સ્થિતિ અટકાવવાનો ઉત્તમ ઉપાય સહિષ્ણુતા-સહનવૃત્તિની કેળવણી છે. આમાં કેટલા બધા લાભ છે એ જોઈએ. જેથી સહિષ્ણુતા-સહનવૃત્તિને જીવનસૂત્ર બનાવી દેવાય.

(૧) સહર્ષ સહન કરવામાં આત્મામાં સત્ત્વ અને સ્થિરતા-સ્થિતપ્રજ્ઞતા ગુણનું ઘડતર થાય છે, જેના પર ઉપર-ઉપરના ગુણસ્થાનક અને પરાકાષાએ વીતરાગ બનાવનાર ક્ષપકશ્રેણી લાધે છે. સુંવાળા રહેવામાં પ્રસંગે પ્રસંગે ચંચળતા, સત્ત્વનાશ અને કષાયોથી જાંખા મહિન થવાનું બને છે.

(૨) સહનવૃત્તિમાં ક્ષમા ધર્મની અને સમાધિ (સ્વસ્થતા) સુખની આરાધના થાય છે, ઉકળાટમાં અસમાધિ આવે છે.

(૩) સામનો કરવામાં સામાનું આપણા પર જે હેત સદ્ગ્ભાવ ઘવાય તે સહન કરવામાં અટકે છે, ઊલટું પ્રેમ વધે છે.

(૪) આપણી સહનવૃત્તિથી સામાને અંતે પસ્તાવો થઈ સુધરવા તક મળે છે.

(૫) સહન કરી લેવામાં પાપકર્માની નિર્જરા થાય છે.

(૬) સહિષ્ણુતા લોકમાં યશ ફેલાવે છે.

(૭) ઉકળાટના લીધે શરીર અને પાચન પર બૂરી અસર, મનમાં તામસભાવ અને આર્તધ્યાન, તથા આત્માની ઉપર તિર્યંગતિનાં કર્મોનો બંધ થાય; એ બધું સહનવૃત્તિમાં અટકે છે.

(૮) ખમી ખાવામાં રોગા અટકી, સલાહસંપીને રહેવામાં અનેક લાભ અને અવસરે સહાય-સહાનુભૂતિ મળે છે. ઉકળાટમાં કદાચ સામા પર અસદ્દ આરોપ ચડાવવાનું મહાપાપ થાય છે.

(૯) સહન કરી લેવાના ગુણથી આપત્તિ અને અંતકાળ વખતે સારી સમાધિ સુલભ બને છે, આ બધું મોટો લાભ છે.

સહનવૃત્તિ એ તો જીવનદીપક છે, ત્યારે અસહિષ્ણુતા એ અંધારું છે.

મનને પૂછવું કે જીવનમાં અજવાણું કરવું છે ? કે અંધારામાં અથડાવું છે ? અજવાસ કરવો હોય તો સહન કરવાની વૃત્તિ રાખ, આ ‘વૃત્તિ’ સમજો એટલે માત્ર આવી પડેલું સહી લેવું એટલું જ નહિ, કિન્તુ કષ્ટ ઊભું કરીને સહન કરવાની લાલસા રહે, દા.ત. પેસાની તંગી છે, છતાં થોડામાંથી થોડું આપીને પણ સાધર્મિકભક્તિ, પાઠશાળાના બાળકોની ભક્તિ, દેવભક્તિ ગુરુભક્તિ, પરોપકાર વગેરે કરવાનું કષ્ટ ઊભું કરીને સહી લેવાય. એમ, પ્રત-નિયમ-તપસ્યા થાય એ અને સમયની તંગીમાં પણ સમય કાઢીને શાસ્ત્ર સ્વાધ્યાય કરાય. એ શું સમજીને ? હાથે કરીને કષ્ટ ઊભું કરીને સહન કરવાની વૃત્તિથી ‘ચાલો જુગજુના સુખશીલતા-પ્રમાણી વૃત્તિ સામે સહન કરવાનું મળશે,’ એ સમજીને.

આ સહનવૃત્તિ ન કેળવતાં સુંવાળા થવામાં સંતાપ-હૃદ્ધર્યાન કોટે વળગવાના.

પુણ્ય કાચું છે એટલે એક યા બીજી રીતે કાંઈ ને કાંઈ પ્રતિકૂળ બનવાનું, એક યા બીજી આપત્તિ આવવાની; એ વખતે સુંવાળા સ્વભાવમાં હૃદ્ધર્યાન-સંકલ્પવિકલ્પ અને સંતાપ કોટે વળગે એ સહજ છે. અસહિષ્ણુતામાં કેટલીક વાર બીજા પર ખોટા આરોપ, રોષ, રગડો થશે. એમાં સામાના સદ્ગ્ભાવ ગુમાવવાનું થાય

સામાનો સદ્ગ્ભાવ ગુમાવવામાં અશાન્તિ અને અવસરે નિઃસહાયતા :-

ત્યારે હુનિયામાં પ્રેમ-સદ્ગ્ભાવ મેળવવા, ટકાવી રાખવા, એ જરૂરી છે. એથી (૧) પહેલાં તો આપણા દિલમાં જ ભારે શાન્તિ રહે છે, તેમજ (૨) એ પ્રેમપાત્ર-સદ્ગ્ભાવપાત્ર અવસરે કામ લાગે છે. માબાપથી ભાઈઓથી જુદાઈ કરનાર આ સમજતા નથી એટલે અવસરે સીદાય છે, લોહીના આંસુ સારે છે.

તાત્પર્ય, જીવનમાં જેમ બીજા બીજા સૂત્ર ધરી રાખ્યા હોય છે, એમ, સહિષ્ણુતા-સહનવૃત્તિને જીવન-સૂત્ર બનાવી દેવું જોઈએ, બીજા સૂત્રોમાં કેટલાક તો અહિતકારી બને છે, ત્યારે આ સૂત્ર મંગળમય હિત સાધી આપે છે.

## ૧૧૭ મા-બાપનો ઉપકાર: સાસુ-વહુ કેમ ન ગગાડે ?

જૈન શાસ્ત્રો કહે છે,-માતા પિતાનો ઉપકાર એટલો બધો છે કે એનો બદલો કશાથી વળી શકે નહિ, સિવાય કે પુત્ર એમને સમ્યક્તવાદિ ધર્મ પમાડે. મા બાપે પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી, પછી ભલે ગરીબ સાધનોથી, ડિન્તુ પુત્રની એવી કટોકટીમાં એને ઉછેર્યો છે કે પુત્ર પદીથી લાખોની સંપત્તિ અને તનતોડ સેવા આપે તો ય તે વિસાતમાં નથી. અલબંત એમને ધર્મ પમાડે એ પેલા ઉપકાર કરતાં અધિક કિંમતી છે.

પુત્રની કટોકટી વખતે માબાપ તરફથી કરાયેલ એટલાં ઊંચા ઉપકારોની સામે પુત્રની ફરજ છે કે પોતે તો એમની ઊંચી સેવા-ભક્તિ-બહુ આદર કરે જ ડિન્તુ પોતાની પત્ની પણ એ જ કરે. એની જગાએ પત્ની, અગર પોતે, અથવા બંને જણા માબાપ સાથે જો રગડો કરે, તો એમને ભાનબાન ખરું કે ‘આ માબાપનો મારા પર કેટલો બધો ઉપકાર છે ? કેટલા અરમાનથી એમણે મને ઉછેર્યો હશે ?’ એક આજકાલ લાવેલી સ્થીની ખાતર એમના હૈયાના તાર તોડી નાખું એમાં એમના જીવને કેટલું દુઃખ થાય ? કેટલો વિશ્વાસધાત લાગે ? આમાં માણસાઈ છે ? કુદરત એનો બદલો આપ્યા વિના રહેશે ?

પ્ર.- પરંતુ મા-બાપ વહુ સાથે કચકચ કરે તો એ બિચારી કેટલું સહન કરી શકે ? બાપનું ઘર મૂકીને અહીં આવેલી એ જો કચકચિયા માબાપ સાથે દિકરો ય ભળી જાય તો એનો બિચારીનો બેલી કોણા ?

૩.- આનો ઉત્તર જરાક તાત્ત્વિક લાગશે, પણ બહુ વ્યવહારુ ઉત્તર છે. એક હાથે તાલી ન પડે. કચકચની સામે કચકચ વિના એ કચકચ લાંબી ન ચાલે. નવી આવેલી વહુની શું ફરજ નથી કે ‘જો મને પતિ તરફથી ભરચક સંસારસુખ મળવાનાં છે, તો એના કમીશન, તરીકે સાસુ-સસરાની આટલી કચકચ બરદાસ્ત કરી લેવી જોઈએ ? સાસુ-સસરાએ જન્મ આપી વર્ષો સુધી કષ્ટ વેઠીને અને કેટલાય હેતના વરસાદ વરસાવી તૈયાર કરેલો દીકરો, મને મનમાન્યા પતિ તરીકે આઈતો માલ મળ્યો; તો એ તૈયાર કરનાર સાસુ-સસરાના તો કેટલાય ગુણ ગાવા જોઈએ, કેટલો બધો ઉપકાર માનવો જોઈએ અને ઉપકારના બદલામાં સેવા માગવી જોઈએ’ એવું કાંઈ આજની-વહુઓ કરે છે ખરી ? સાસરે આવી ત્યારથી જો એ કરે, તો તો

સાસુ-સસરા પોતાની દીકરીને ભૂલી જાય-દીકરીથી વહુ પ્રેમાળ વહુ લાગે. દીકરી માબાપના એટલા ગુણ ન ગાતી હોય, એટલો ઉપકાર ન માનતી હોય, ઉપકારના બદલામાં સેવાનું ન માગતી હોય, જે આ સમજદાર વહુ કરતી હોય, એવું બને.

પરંતુ દીકરો પત્ની આવ્યાં બરાબર એને આવું શીખવે તો ને ? એ જો એને શીખવે કે જો, આ રૂઢા પ્રતાપ તારા માબાપના કે એમણે કેટલાંય કષ્ટ વેઠીને તને ઉછેરી તૈયાર કરી મને આપી એમ રૂડાં પ્રતાપ મારા માતા પિતાના કે એમણે મને તૈયાર કરી તારા એક મનગમતા પતિ તરીકે બનાવ્યો. મારી બધી હોશિયારી, આવડત, અને કાયા સુદ્ધા જે તને સુખ આપવાની છે, એ બધું મૂળ માતાપિતાનું સર્જન છે. એ બધું મારા બા બાપુજીનું દાન છે. માટે એમ ન વિચારીશ કે તને તો તારા માતાપિતાએ ઉછેરી મોટી કરી એટલે એમનો ઉપકાર છે; પણ મારા બા-બાપુજીએ તારું શું કર્યું છે તે આમનો ઉપકાર ગણાય ? આવું ન વિચારીશ. એમ તો મેં ય તારા પર શો ઉપકાર કર્યો છે ? છતાં કેમ મને તું બહુ માને છે ? એટલા જ માટે ને કે હું તને જીવનભર સંભાળવાનો છું, ને તને સુખ આપવાનો છું. તો એ હું તો બા-બાપુજીના ઉપકારે તૈયાર થઈ તને મળ્યો ત્યારે ને ? માટે મારા કરતાં ય બા-બાપુજીના ઉપર તારું વહુ-બહુમાન જોઈએ. વળી જીવનમાં જો બીજાનાં માન-હેત લેવાની ઈચ્છા છે, તો સહન કરવાની પણ ઈચ્છા જોઈએ. સહન કરવું એ પણ મહાન કર્તવ્ય છે. એ અદા કરીશું તો સારા સુખી થઈશું...”

આ શિક્ષણ...પહેલેથી હોય, અને પત્ની કદાચ એ કાન પર નથી ધરતી એમ દેખાય, તો નોટિસ હોય કે ‘જો મારા જનમથી ઉપકારી માતા-પિતા પર તને માન નહિ, તો મને તારા ઉપર માન નહિ રહે,’ જો આવી ધમકી હોય તો એથી ઉઠને ય પેલી સમજ જાય. એ ય સમજે તો ખરીને કે અહીંથી રીસાઈ મા-બાપને ધરે (પિયેર) ચાલી જઈશ તો લાં કેટલો વખત ખંટાવાની ? છેવટે તો પતિ જ શરાણ કર્યા વિના ચાલવાનું છે ?

બીજી વાત એ છે કે જીવનમાં સ્વેચ્છાએ સહન કરવું એ બહુ લાભદાયી છે, એથી સારું ઘડતર થાય છે. સત્ત્વ વધે છે, એ સમજ સહન કરવાનું સૂત્ર નથી પકડાતું, એટલે વિનય-પ્રેમ બહુમાનને યોગ્ય સ્થાન સામે પણ સામનો કરી કલેશના આંધણ મૂકાય છે, ચિત્ત સદા ઉદ્દેશમાં રહે છે. સહન કરવાનું સૂત્ર પકડી રખાય તો ય સાસુ-વહુના ઝગડાં ન થાય. તેમ ઉપર કંબું તેમ વહુ મનમાન્યા પતિને તૈયાર કરવાનો સાસુ-સસરાનો અનહદ ઉપકાર માની સેવા તત્પર ને બહુમાન તત્પર રહે તો પણ ઝગડાને સ્થાને મહાન સુખ અને યશ પામે.

## ૧૧૮ આપણને ભગવાનની કઈ દયા ખપે ?

ભગવાનને માનનારા ધર્મો ભગવાનની કરુણા માને છે. (૧) લૌકિક ધર્મોમાં (i) ભારતીય જૈનેતર ધર્મો ભગવાનને જગત્કર્તા માની ભગવાન જીવોને હવા પાણી, પ્રકાશ અન્ન ફળકૂળ વગેરે આપવાની કરુણા કરી એમ માને છે. લૌકિક ધર્મોમાં (ii) પાશ્ચાત્ય ધર્મ કહે છે કે જગત ઉપર ભગવાનનું સાપ્રાજ્ય ચાલે છે, ત્યારે અને તે ન્યાયપુરસ્સર ચાલતું હોવાથી જીવોને ન્યાય મળે છે એ ભગવાનની કરુણા છે ! ત્યારે (૨) લોકોતર જૈનધર્મ કહે છે કે જીવને ભગવાનનાં આલંબને એક શુભ ભાવ પણ આવે એમાં ય ભગવાનની કરુણા છે. એટલે શુભભાવમૂલક સુગતિ વગેરે પુણ્યાઈ મળે; યાવત્ મોક્ષ મળે એમાં તો સુતરાં ભગવાનની કરુણા છે, અર્થાત્ ભગવાનનો અચિંત્ય પ્રભાવ છે.

અહીં સવાલ આટલો છે કે ‘આપણને ભગવાનની કઈ કરુણા કઈ દયા ખપે ? ક્યો દ્યાની આપણને જંખના છે ? (૧) ભગવાનની દયાથી પુણ્યાઈ અને તેના દ્વારા ધન-માલ-પરિવાર-પ્રતિષ્ઠાદિ મળે એવી દ્યાનો ખપ છે ? કે (૨) ભગવાનની દયાથી શુભ ભાવ, અને ઉદારતા-ગંભીરતા-સહિષ્ણુતા-સંયમાદિ મળે, એવી દ્યાનો ? ભગવાનને ભજીને શું માગીએ છીએ શું ઈચ્છાએ છીએ ?

‘મારે જરા પૈસાની તંગી છે, તે પૈસા ઢીક મળો. શરીર બિમાર છે, તે સારું થાઓ. પરિવાર વાંકો છે તે અનુકૂળ વર્તો. શ્રીમંત છું, ભણ્યો છું, તો લોકમાં જશ ફેલાઓ...આવી આવી પ્રભુની દયા જોઈએ છે ? કે

દરિદ્રતામાં, બિમારીમાં, સ્નેહીની વાંકાશમાં મારા મનને સમાપ્ત રહે, સદ્બુદ્ધિ બની રહો, સહિષ્ણુતા સારી રહો. શ્રીમંતાઈમાં વિદ્વત્તામાં ય ઉચ્ચ ધર્મશદ્ધા બની રહો, નન્દતા રહો, પરોપકાર કરવાનું મળો, બધીય અવસ્થામાં પ્રભુ ! તારી જોરદાર ભક્તિ બની રહો, સાહુસેવા બની રહો, શાસ્ત્રપરિચય ખૂબ રહો, ત્યાગ-તપ-સંયમ ખૂબ મળો...’ આવી દયા જોઈએ છે ?

આમ તો મોક્ષ જઈ બેઠેલા વીતરાગ પરમાભા હાથોહાથ કરું આપતા નથી કે ત્યાં બેઠા આપણા માટે કાંઈ કરતા-કરાવતા નથી; કિન્તુ એમનું આલંબન ધરવાથી અચિંત્ય સિદ્ધિઓ થાય છે. કમઠના કાણમાંથી નીકળેલા સાપ નવકારના ધ્યાનમાં ચચ્ચો અર્થાત્ એણે અરિહંતપ્રભુનું આલંબન ધર્યું તો એ મરીને નાગકુમાર-દેવલોકનો ઈન્દ્ર ધરણેન્દ્ર બન્યો ! નાગકેતુને પુણ્યપૂજા કરતાં સાપ ઉસેલો, છતાં અરિહંત ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખમૂત (ભાગ-૪)

પ્રભુનાં આલંબને પ્રભુનું ધ્યાન ધરતા નાગકેતુ કેવળજ્ઞાન પામ્યા ! એ જ પ્રભુનો પ્રભાવ, પ્રભુની દયા, પ્રભુની કરુણા કહેવાય, કે પ્રભુનાં આલંબનના પ્રભાવે ઉન્નતિ ગ્રાપ થાય.

તો પ્રભુની કઈ દયા ખપે છે ? ઈન્દ્રપણા સુધીની સમૃદ્ધિ-સત્તા-સન્માન મળે એવી દયા ? કે સહિષ્ણુતાદિ સદ્ગુણો અને સમ્યક્તવ-સંયમ-કેવળજ્ઞાન મળે એવી ?

જેવી દ્યાની ધગશ-જંખના-રુચિ હોય, એવી આત્માની બહિરાત્મદશા કે અંતરાત્મદશા નક્કી થાય છે. બહિરાત્મદશા એ કે જેમાં જીવ બાબ્ય કાયાની અને કાયા ઈન્દ્રિયોને અનુકૂળ પદાર્થો ધન માલ-કુટુંબાદિની જાહેરજલાલીનો જ ખપી હોય. અંતરાત્મદશા એ, કે જેમાં જીવને અંદરના આત્માની અને આત્માને હિતકર દયા-દાન-શીલ, અહિંસા-સંયમ-તપ, દેવગુરુ ભક્તિ-વૈરાગ્ય-ઉપશમ વગેરે વસ્તુની રુચિ અભિલાષા હોય. બહિરાત્માને માત્ર આ જનમનો જ વિચાર હોય છે, પરલોકનો કોઈ વિચાર જ નહિ. અંતરાત્મદશાવાળાને નજર સામે પરલોક જ મુખ્ય હોય છે, આ જનમનાં સુખ ઓછાં મળ્યાં, ઓછાં ભોગવાયા કે કષે વેઠવા પડ્યા એની પરવા નહિ.

બસ, જેવી આત્મદશા, તેવી પ્રભુની દયા માગવાનું મન થાય છે, તેવી દ્યાની અપેક્ષા રહે છે. દા.ત. બાબ્યદશાવાળાને પેસા ઓછા મળ્યા તો મનને લાગે છે કે પ્રભુની દયા ઓછી છે;’ ‘એ દયા કેમ વધુ વરસે’ એવી ઈચ્છા રહે છે. પેસા સારા મળ્યા તો ખુશી થાય છે, અને માને છે કે ‘પ્રભુની સારી મહેરબાની છે.’ અને દયા-દાનાદિ સુકૃતો ને ઉદારતા-સમતા-સહિષ્ણુતાદિ સદ્ગુણો ઓછા વધુ મળ્યા એના પર મદાર નથી રહેતો, એની પરવા હોતી નથી.

ખરી રીતે પ્રભુની આવી જ બાબ્યની દ્યાની અપેક્ષા દિલને અધમ બનેલું રાખે છે, મોહમૂઢ સ્વાર્થરસિયું અને રાગાદિ દોષોભર્યું રાખે છે. એથી ભવના ફેરા ઓછા કરવાને બદલે વધારવાનું થાય છે.

જો આપણે આસ્તિક હોઈએ, અંતરાત્મા બનવું હોય, તો (૧) પ્રભુની એ દયા માગવી જોઈએ કે જેમાં આપણામાં ઉત્તમ સુકૃતો સદ્ગુણો અને ધર્મસાધનાઓ ખીલે. વળી (૨) એ ખીલવા ઉપર જ એમ લાગે કે ચાલો પ્રભુની મારા પર સારી મહેર વરસી, પછી ભલે પેસા ઓછા મળ્યા, પરિવાર-ખાનપાન વગેરે સારા ન મળ્યા.’ પ્રભુની આ દ્યાની દષ્ટિ પ્રભુના સાચા ભક્ત બનાવે છે. અને જીવને દોષ દુષ્ટ્યોના તથા મોહ-સ્વાર્થમાયા વગેરેના નરકાગારમાંથી ઊંચા ઊંચ્યે છે.

## ૧૧૬ સંતોષનું સ્વરૂપ : સંપત્તિ પચાવવાની આવડત

કહેવત છે કે ‘સંતોષી નર સદા સુખી, સંતોષ વિના સુખ નહિ. સંતોષ જેવું કોઈ સુખ નહિ. છતાં જીવની પાગલતા જગતના પદાર્થો અને જગતની વાહવાહમાં સુખ જુએ છે, એ જોવા પર એની પાઇળ ધબે છે. મળ્યું છે એ જોવું નથી. નથી મળ્યું એ જોતા રહેવું છે. એની ખાતર દિલ બગાડવું છે, ને રકમબંધ પાપ કરવા છે. જીવન આમ જ પુરું થઈ જાય છે. અને અંતકાળે બધું ખોવાઈ જતું દેખાવા પર દુઃખનો પાર નથી રહેતો. નજર સામે જીવનભરના પાપાચરણ ભૂતની જેમ ખડાં થાય છે. જીવનમાં માણેલાં સુખ વરાળની જેમ ઊરી ગયાનું દેખાય છે, અને અંતકાળનું આવી પડેલું દુઃખ મોટી શિલા જેવું માથે પડતું ગભરાવી મૂકે છે મરીને કેવા અવતારે જઈ કેવા કીડા-મકોડ કે કસાઈના બકરાના જાલિમ દુઃખમાં ઊતરી જવું પડશે, એનો હાઉ ખડો થાય છે. આ બધું ય શાના પર ? મૂળમાં સુખ દુનિયાના પદાર્થ અને દુનિયાની વાહવાહમાં દેખ્યું પણ સંતોષમાં નહિ, એના પર સરવાળે દુઃખના તુંગરા જોવાના રહે છે.

ત્યારે સંતોષીની આત્મદશા વિચારવા જેવી છે. ‘સંતોષી’ એટલે મળ્યા સામે જુએ, ન મળ્યા સામે નહિ; મળેલું ઘણું મળ્યું માને, પોતાની લાયકાતથી વધુ મળેલું છે એમ માને. કેટલાક કહે છે ‘આપણે તો બહુ ધાંધલ કરતા નથી, મળે એ લઈએ છીએ. ભાણામાં આવે એ ખાઈએ છીએ બસ એમાં જ સંતોષ.’ અલ્યા પણ ન મળેલું કોણ લઈ શકે છે ? ભાણામાં ન આવેલું કોણ ખાય છે ? ‘મળે એ લઈએ’ એમાં માપ ખરું કે કેટલા સુધી મળેલું લેવાનું ? મળે એ ખાવામાં નિયમન ખરું કે આટલી જ ચીજો ખાવાની ? ના, જેટલું મળે એટલું ખપે, જેટલું મળે એટલું ખાવાનું. આ સંતોષ કહેવાય ? તો પછી અ-સંતોષ શાને કહેવાનો ? માનેલા આ સંતોષમાં તો જીવની તૃષ્ણાને ને ભૂખને કોઈ મર્યાદા જ નથી રહેતી, ક્યારે ય એમાં કાપ મૂકવાનું ને એનો અંત લાવવાનું જ રહેતું નથી.

સંતોષ તો એનું નામ કે જ્યાં તૃષ્ણા પર લાલસા પર ને ભૂખ પર અંકુશ રખાય, કાપ મુકાય કે મારે આટલાથી વધુ ન ખપે અને એટલાની અંદરમાં ય જે મળે એ ઘણું લાગે, પોતાની લાયકાતથી વધુ લાગે.

લાયકાત એટલે પચાવવાની લાયકાત. દુન્યવી પદાર્થો અને સન્માન વાહવાહ એ કાચા પારા જેવા છે; એ પચાવતાં ન આવડે તો ફૂટી નીકળે. મોટા માંધાતા સુભુમ-બ્રહ્મદંત જેવા ચકવર્તીઓ જે એને ન પચાવી શક્યા એ મરી મરીને નરકમાં સિધાવ્યા. રાવજાને બળ મળ્યું, સત્તા મળી, પણ એને પચાવી ન શક્યો તો અંતે પોતાના જ ચકથી ગલથ્યેદ પામી ચોથી નરકમાં પટકાયો.

‘પચાવવું’ એટલે (૧) દુન્યવી માલ અને માન મળવા ઉપર છકી ન જવું, (૨) એનાથી જીવનની વડાઈ ન માનવી, (૩) એના પર રોષ-રોઝ પ્રપંચ ન કરવા, (૪) મળ્યું ઓદ્ધુ માની અસંતોષ કરી ધોડાધોડ ન કરવી. પચાવવું એટલે મળેલું ઘણું મળ્યું માનવું, એને કાચો પારો સમજવો, એને ને એના ભોગને તુચ્છ માની એમાં જીવનની બરબાદી દેખવી, એનાથી જે કાંઈ પરમાર્થ યાને દયા-દાન-શીલ-તપ-ભગવદ્ભક્તિ-સત્સંગ થાય, જે કાંઈ કૃતજ્ઞતા અને પરોપકાર થાય, એટલું જ લેખે લાગ્યું માનવું, એમાં જ જીવનની વડાઈ માનવી, સફળતા ગણવી. માટે જ મળ્યા પર રોષ-રોઝ પ્રપંચ અને એના જ વિકલ્યો વિચારો અને આર્થિયાનને તિલાંજલિ આપવી.

મનને એમ લાગ્યા કરે કે ‘આ બધું હું ન કરું ત્યાં સુધી મળેલા માલ અને માન મેં પચાવ્યા ક્યાં ગણાય ? એ પચાવવાની પૂરી લાયકાત નથી ને મળ્યા છે, એનો અર્થ જ એ કે મને મળેલું મારી લાયકાત કરતાં વધારે મળ્યું છે, ઘણું મળ્યું છે, એથી અધિકનો કોઈ અભખરો મારે રાખવો નથી, જે છે તે બરાબર છે’ આવું લાગ્યા કરે તો એ સંતોષ આવ્યો ગણાય.

સુખ આવા સંતોષમાં જ છે, હીરામાણેક કે સોનાના ડેરમાં નહિ, કરન્સીના ભરેલા કબાટમાં નહિ. મમ્મા શેઠ પાસે એવું ઘણું હતું પણ સુખી નહોતો. પુણિયા શ્રાવક પાસે લગભગ કશું નહોતું છતાં મહાસુખી હતો. કારણ ? આ જ કે મમ્માણને સંતોષ નહોતો, પુણિયાને સંતોષ હતો.

કોઈ આપણને પૂછો ‘શું પસંદ છે ? મમ્માણના સોના-હીરાના ડેર ? કે પુણિયાનો સંતોષ ? બેમાંથી શું ઈચ્છો ? શું મળે તો તમે સુખી ? તો શું કહીએ ? જે કહીએ એના પર આપણી બુદ્ધિનો વિકાસ કે વિકાર સાબિત થાય છે. સુખ કે દુઃખનું સ્વામિત્વ પૂરવાર થાય છે.

## ૧૨૦ ધારણીમાતાએ ચંદનાની ચિંતા કેમ ન કરી ?

ચંદનબાળાનું મૂળ નામ વસુમતી. એની માતા ધારણી રાજરાણી છતાં રાજ્ય પર શત્રુનું આકમણ આવ્યું, પતિ હાર્યો, એક સિપાઈ ધારણી અને વસુમતીને પકડીને ચાલ્યો. જંગલ વચ્ચે સિપાઈ ધારણીને કહે ‘ચિંતા ન કરીશ. હું તને મારી પત્ની બનાવી બરાબર સાચવીશ.’ ધારણીને પોતાના શીલ પર ભયની વાત પણ અસહ્ય લાગી, તરત ત્યાં જ એણે જીભ કચડીને આપધાત કર્યો.

અહીં સવાલ થાય કે ધારણીને પોતાના શીલનો વિચાર રહ્યો તો પુત્રી વસુમતીના શીલની ચિંતા કેમ ન થઈ કે ‘હું કદાચ મરું તો પછી આ બિચારીનું શીલ કેમ સચવાશે? અથવા આ હલકા માણસના પનારે પડશે તો?’ આવો કોઈ વિચાર કરવા એ કેમ ન થોભી, ને એકદમ જ કેમ આપધાત કર્યો? શું પોતાના સ્વાર્થમાં સંતાનના હિતનો વિચાર નહિ કરવાનો?

(૧) આનું સમાધાન એ છે કે સંતાનના હિતનો વિચાર જરૂર કરવાનો, પણ પોતાનું ગુમાવીને નહિ. પોતાની ઉપર એવી આપત્તિ આવી હોય કે જેમાં પોતાના આત્મહિતનું સત્યાનાશ નીકળે એમ હોય તો પહેલું એ અટકાવવું જોઈએ.

માટે તો ભગવાન શ્રી મુનિસત્રતસ્વામીએ ૫૦૦ શિષ્યોને લઈને એમના બેનના દેશમાં જવામાં સંમતિ ન દર્શાવી. અલબત્ત ભલે એમાં શિષ્યો બધા જ આરાધક થાય એમ હતા એટલે સીધા મોક્ષ જ્યા એવું હતું, કિન્તુ ખંધકસૂરિ પોતે વિરાધક થાય એમ હતા, પાપી પાલકના અન્યાય પર એમને ગુસ્સો ચેડે એવું હતું એટલે પ્રભુ એમાં શા માટે સંમતિ દર્શાવી? તાત્પર્ય, પોતાનું ખોઈને બીજાની ચિંતા નહિ કરવાની.

એમ અહીં માતાને લાગ્યું કે આ સિપાઈના બોલવા પર હવે હું વિલંબ કરું તો મારા શીલ પર ભય છે, તેથી દીકરીની ચિંતામાં મારે મારું શીલ નહિ ગુમાવવાનું.

(૨) બીજું સમાધાન એ છે કે ‘એણે પુત્રી વસુમતીને એવી કેળવી છે કે એને ખાતરી છે કે આ દીકરી શીલ ગુમાવે એવી નથી; તેમ હલકા માણસના પનારે પડે તો ય ધર્મ છોડે એમ નથી.’ પછી એની ચિંતા કરતી બેસી શું કામ પોતાના શીલ પર ભયને નોતરે?

(૩) વળી ધારણી એવી મહાસતી હતી કે એને કુશીલની આગાહી પણ સાંભળવી અસહ્ય હતી, માટે એણે તરત જ જીભ કચડી આપધાત કર્યો. જેમ ધનનો બહુ પ્રેમી કૃપણ ધન જવાની આગાહી દેખતા મરવા જેવો થઈ જાય છે અગર મરે છે, એમ શીલના અત્યંત પ્રેમીને એવું કેમ ન થાય?

આમાં પહેલા સમાધાનમાંથી આ શીખવા મળે છે કે પરોપકારની એવી ઘેલણા ન જોઈએ કે જેમાં આપણું પોતાનું હિત વટાઈ જાય. ‘ધર બાળીને તીરથ ન થાય. એનો અર્થ આ છે કે પોતાના આત્મ-હિતને સળગાવી મૂકીને પરોપકાર ન થાય દા.ત. આજે નકસલવાદીઓ ભારે તોફાન કરે છે, એમને આપણે સુધારી શકતા હોઈએ તો તો બરાબર છે. પરંતુ સુધારી શકતા ન હોઈએ અને એમ વિચારીએ કે ‘આવાઓને સાગાઓને તો કરપીણ મોતે મારવા જોઈએ જેથી લોક સુખી રહે’ તો તે પરોપકારનો વિચાર ખોટો છે; કેમકે એમાં આપણાને તીવ્ર કષાય અને રૌદ્રધ્યાન લાગવાથી આપણું હિત બહુ બગડે છે.

બીજા સમાધાનમાંથી એ શીખવા મળે છે કે આપણે આપણા સંતાનોને દેવ-ગુરુ-ધર્મની મુખ્યપણે સેવા, શીલ-સંયમ-સદાચાર, દ્યા-સત્ય-નીતિ, વૈરાઘ્ય-કૃત્સના પરોપકાર, સહિષ્ણુતા-ઉદારતા-ગંભીરતા વગેરે વગેરેની એવી હિતશિક્ષા વારંવાર દેવી જોઈએ ને એવો ધરખમ અભ્યાસ પડાવવો જોઈએ કે એ મોટા થયે એવા પાકા ગુણવાળા બન્યા રહે.

શ્રાવક-શ્રાવિકા આ નહિ શીખવે તો બીજું કોણ શીખવવાનું છે? ધણું ધણું સહન કરનાર ભગવાન મહાવીર સ્વામીના સેવક થઈને જો આપણે આ ન શીખવીએ તો આપણો પછી આ જગતમાં ધડો કેટલો થવાનો? શ્રાવકને ત્યાં અવતરેલા જીવો તો સમજો કે પૂર્વની સાધનાથી એ વિશ્વાસે અહીં અવતર્યા છે કે ‘એમને સાધનામાં-આગળ વેગ મળશે’ હવે જો એમને એ રીતે વેગ ન આપાય તો કેવો વિશ્વાસધાત થાય? બાલપણથી જ આ સદ્ગુણોની અને ધર્મની કેળવણી જોઈએ. નહિતર મોટા થયે દુનિયાની હવા લાગ્યા પછી અને વાસનાઓ જાગી ગયા પછી સારો અભ્યાસ પડાવવો ધણો ધણો કઠિન છે.

## ૧૨૧ ભક્તિ એ મુક્તિની દૂતી કેવી રીતે ?

પરમાત્મભક્તિ એ મુક્તિની દૂતી છે. અનાદિ અનંત અનંત કાળથી જીવ કર્મ અને મોહવશ પોતાની ભવ્ય મુક્ત અવસ્થા જોવા પામ્યો નથી. કર્મની શુંખલાઓથી જકડાયો રહેલો કર્મથી મુક્ત દર્શાનો અનુભવ ક્યાંથી કરી શકે ? મુક્તિ પોતાની જ સુંદર અવસ્થા છે. સુંદરી છે, પણ એ રીસાઈ બેકી જીવના સામુંય જોતી નથી અરે ! પોતાની સખીને દૂતીને ય એ મોકલી કોઈ સંદેશો ય પાઠવતી નથી. અનેના દૂતી ય જો જીવ પાસે આવે તો જીવને સહેજ આશ્વાસન મળે કે ચાલો હવે કાંક રસ્તો ખૂલ્યો, મારી મુક્તિ સુંદરીએ દૂતી મોકલી છે, તો એ મારા તરફ કાંઈક સન્મુખ થઈ કાંક વળવાળી બની છે. હવે જો હું આ દૂતીને બરાબર ખીલવાયી દઉં, વિશ્વાસ પૂરેપૂરો પમાડી દઉં તો દૂતી તરફથી એને સંદેશો પહોંચતા એ પણ પ્રસન્ન થઈ મને આવી બેટશે, યા મને પોતાની તરફ આકર્ષ લેશે.

મોટી રાજકુમારીઓને આવું બનતું. પોતે એવી ખૂબ જ વિશ્વાસપાત્ર દૂતી રાખતી કે એ કોઈ રાજકુમારને બરાબર ચકાસી યોગ્ય જોઈને એના સંદેશા-સમાચાર લઈ આવતી, તો રાજકુમારી એ રાજકુમારને વરતી, રાજકુમાર પણ દૂતીને પોતાની યોગ્યતા દેખાડવા સારી રીતે આવર્ણ લેતા.

બસ અહીં મુક્તિ-રાજકુમારીને એવી વિશ્વાસપાત્ર દૂતી પરમાત્મભક્તિ છે, એને આપણે બરાબર આવર્ણ એટલે સમજો કે એના સંદેશા સમાચાર મુક્તિસુંદરી પાસે પહોંચા અને અનાદિ અનંતકાળથી રીસાઈ બેઠેલી મુક્તિકુમારી આપણી સન્મુખ થઈ. દૂતી-પરમાત્મભક્તિને આપણે આવર્ણએ એટલે કે એને ખૂબ ખીલવીએ, ખીલવતાં ખીલવતાં એ આપણામાં આત્મસાત્ર થઈ જાય. એ બનતા તો મુક્તિકુમારી આપણને તરત વરી લે.

આનું કારણ સ્પષ્ટ છે. પરમાત્મભક્તિને ખૂબ ખૂબ ખીલવીએ એનો અર્થ એ છે કે દ્રવ્યભક્તિપૂજા અને ભાવભક્તિ-ગુણગાન ખૂબ વધારતા જઈએ, દ્રવ્યભક્તિમાં આપણાં કિંમતી કિંમતી દ્રવ્યો જેવાં કે કેશર - ચંદન-બરાસ-વરખ-બાદલું-ટીકી-રેશમ-ધૂપ-દીપ-ધી-મુલાયમ અંગલુંઘણા વગેરે વગેરે હોશે હોશે વાપરીએ, એ વાપરી વાપરીને ઊંચા લેખે લાગ્યા માનીએ, કેમકે એ દ્રવ્યો કોઈ કુપાત્ર કે સામાન્ય પાત્રમાં નહિ, સામાન્ય વિશેષ સુપાત્રમાં ય નહિ કિન્તુ પરમપાત્રમાં અપાઈ રહ્યા છે. એથી એ દ્રવ્યોનો ઉત્તમોત્તમ વિનિયોગ થયો ગણાય. એથી મનને હોશ-હરખ-ઉલ્લાસનો પાર ન હોય.

આ તો જ બને કે પરમાત્માથી વધીને કશું કિમતી કશું ખારું ન લાગે. વાત પણ સાચી કે હલકી યોનિઓમાં રહડતા ભિખારી જેવો આપણે જે પરમાત્માના પ્રભાવે આ ઉચ્ચ ભવ અને સધળી વાતની પુણ્યાઈ પામ્યા, એ પ્રભુની ઉપર તો સહજ છે કે ઓવારી જવાય. અપાર પ્રેમ થાય, એમની સેવા-ભક્તિમાં ખૂબ વરસાવી દેવાય. ભિખારીને કોઈ કરોડપતિ કરી દે તો એના પર ભિખારી કેવો ઓવારી જાય ? કેટલો પ્રેમ અને કેવી સેવા કરે ? આમ દ્રવ્યભક્તિને ખૂબ ખીલવાય એ ભક્તિ મુક્તિની દૂતીને જ ખીલવી કહેવાય ને એ મુક્તિને અવશ્ય આકર્ષે. એવી ભક્તિ કરવામાં ધનની મૂર્ખા ઊતરે, ધન કરતાં પ્રભુને વિશેષ બાલા કરવાનું થાય. એમ, જેમ જેમ વધુ ને વધુ ધનભોગ આપી પ્રભુભક્તિ થાય તેમ તેમ દિલ ધનથી ખસી પ્રભુમાં વધુ-વધુ જોડાતું જાય, દિલમાં ધન કરતા પ્રભુ વધારે ને વધારે આત્મસાત્ર થતા જાય. એક દિવસ એવો આવે કે પરમાત્મા સર્વેસર્વ આત્મસાત્ર થતા આત્મા પરમાત્મા બની જાય, મુક્તિ એને વરી લે.

જેવું દ્રવ્યભક્તિથી એવું ભાવભક્તિથી પણ વીતરાગ પ્રભુની સાથે આત્મસાત્ર થવાનું છે, પ્રભુને દિલમાં આત્મસાત્ર કરવાના છે. પ્રભુના ભક્તિ-ગુણગાન અનેરી ચીજ છે. એમાંય સંગીતમય ભક્તિ વળી એક વિશેષ વસ્તુ છે, અને તે પ્રાચીન ભાવભર્યા સ્તવનો-સ્તુતિઓથી સુંદર ઉત્કલ્સે છે. મંદિરમાં સાદા ભાવે ગયા હોઈએ, પરંતુ ઢબસર અને અર્થનું લક્ષ રાખીને પ્રાચીન સ્તવન ગાવા યા સાંભળવા માંડીએ છીએ એટલે પ્રભુભક્તિના ભાવ ઊંઘણતા થાય છે, એ અનુભવસિદ્ધ છે. એમાં સંવેગ-વૈરાગ્ય ને વીતરાગ પર પ્રેમની રંગત જામે છે, મુક્તિની સન્મુખતા થાય છે. આમ ભાવભક્તિ એ મુક્તિની દૂતીનું અદ્ભુત કામ કરે છે.

પ્રાર્થના-ગીતો-ભક્તિગીતો દુનિયાના બીજા ધર્મોમાં ય ઢગલો જોવા મળે છે, પરંતુ નમુંથણું શક્સતવ, કલ્યાણમંદિર વગેરે તથા ગુજરાતી પ્રાચીન સ્તવનોમાં પ્રભુના જે ગુણગાન ભક્તિ-પ્રાર્થના ભરેલ છે તે લોકોત્તર છે. આ દરેકની ગાથાઓના ભાવોની કરીબદ્ધ સંકલના યાદ કરીએ તો એથી પરમાત્મા પર ચિંતન ભાષણ અને ધ્યાનની શક્તિ સુંદર ખીલે છે. એ માટે એકેક સ્તવનના ભાવ કરીબદ્ધ તૈયાર કરી લખી લઈને કંદસ્થ કરી રાખવા જોઈએ. બસ, પછી એનું વારંવાર સ્મરણ મનને અનેક પાપવિકલ્પોથી બચાવી લઈ એ ભાવોમાં અને પ્રભુભક્તિમાં જ રોક્યું રાખે છે. એથી મન-પવિત્ર અને પ્રસન્ન બને છે,

**‘મનઃ પ્રસન્તામેતિ પૂજ્યમાને જિનેશ્વરે !’**

એટલે એ સ્તવના-ભક્તિથી પ્રભુની વધુ ને વધુ નિકટ થવાય છે. ત્યારે શ્રેષ્ઠ ભક્તિ જિનાજ્ઞાપાલન; એથી તો ઠેઠ વીતરાગતા સુધી પહોંચાય એ સહજ છે. એમ ભક્તિ એ મુક્તિની દૂતી બને છે.

## ૧૨૨ પરોપકાર કરો છતાં સ્વોપકાર કદી ન ભૂલો

હલ્લ-વિહલ્લને પિતા શ્રોણિકે અવધિજ્ઞાની સેચનક હાથી ભેટ આપેલ. શ્રોણિકને બળાત્કારે પડાવી લેવો હતો તેથી હલ્લ વિહલ્લ હાથી લઈને ચેટકરાજ (ચેડા મહારાજ)ના શરણે ગયેલા. કોણિક લડવા આવ્યો. હલ્લ, વિહલ્લ અંધારી રાતનો લાભ લે છે. હાથી અવધિજ્ઞાનથી અંધારે બધું દેખી શકે છે, તેથી એના પર બેસીને રાતના દુશ્મનની છાવણીમાં જઈ ઉપદ્રવ કરી આવે છે. શ્રોણિકને તપાસ કરાવતા લાગ્યું કે ‘કોઈ હાથી પર બેસીને આવે છે,’ તેથી એણે નગરકિલ્લાની બહાર ખાઈ ખોદાવી એમાં ધગધગતા અંગારા ભરાવ્યા, અને એના ઉપર રેતી નખાવી દીધી.

હવે રાતે હાથી કિલ્લાની બહાર નીકળતાં અવધિજ્ઞાનથી પેલી રેતીની નીચે અંગારા જુઓ છે. તેથી ખાઈના કાંઠેથી પાછો વળી ગયો. હાથીની ઉપર બેઠેલા હલ્લ-વિહલ્લને અંગારાની ખબર નથી એટલે હાથીને વારંવાર હઠ કરીને આગળ જવા પ્રેરે છે, પણ હાથી જઈ જઈને પાછો વળે છે. અંતે હાથીએ આગ્રહ જોઈ સુંદરી બંનેને નીચે ઉતારી પોતે ચાલ્યો રેતી પર, પડ્યો અંદર. ભડકા ઉઠ્યા. મરીને નરકે ગયો. હલ્લ-વિહલ્લને ભારે પસ્તાવો થયો વિચારે છે ‘જો પ્રભુ મહાવીરદેવ મળે તો દીક્ષા લઈએ. દેવતાએ ઉઠાવી પ્રભુ પાસે મૂક્યા; એમણે દીક્ષા દીધી, કલ્યાણ સાધ્યું.

અહીં સવાલ એ છે કે સેચનક હાથીએ માલિક દૂરાગ્રહી થવા છતાં એમની પ્રત્યે વફાદારી જાળવી અને એમના અજ્ઞાન પર એમની દયા કરી એમને બચાવી લીધા, પરોપકાર કર્યો, તો પછી એ નરકે કેમ ગયો? અને હલ્લ વિહલ્લની સદ્ગતિ કેમ થઈ?

આનો ઉત્તર એ છે કે (૧) પરોપકાર માત્રથી બચાવ નથી મળતો; તેમ (૨) આશ્રિત જીવના નાશમાં અજ્ઞાનતાથી નિમિત્ત બનવાનું પાપ કરવા માત્ર પર દુર્ગતિ નથી નક્કી થતી. કિન્તુ (૧) પરોપકાર કરવા છતાં જો પોતે કોઈ દુર્ઘાનિ-હાયવોય-કખાયના પાપમાં પરી જાય તો દુર્ગતિ સરજાય છે. ત્યારે, (૨) આશ્રિતનો ઘાત નીપજવામાં અજ્ઞાયે નિમિત્ત બનવા છતાં ભારે પશ્ચાત્તાપ અને સંયમસાધના સાથે ઉચ્ચ ભાવના અને ઉત્તમ શુભધ્યાનમાં ચડી જાય તો સદ્ગતિ મળે છે.

આ ઉપરથી એ શીખવા મળે છે કે પરોપકાર તારક છે જરૂર, કિન્તુ એથી

હવે દુર્ઘાનિ અને કખાય કરવાનો હક નથી મળતો. એમ કરવામાં તો સ્વોપકાર હણાય છે. સ્વોપકારમાં પરોપકાર સમાય; કિન્તુ પરોપકારમાં સ્વોપકાર સમાવાનો નિયમ નહિ. એનો અર્થ એ, કે પરોપકાર કરનારે સ્વોપકાર તો સાચવવો જ પડે.

૫૦૦ મુનિ ધાણીમાં પીલાતાં, એમને નિર્યામણા કરાવી મોકલવાનો ભારે પરોપકાર કરનાર ખંધકસૂરિ પોતે પીલાતા પાલકપાપી પર દેખમાં ચડ્યા તો સંસારમાં અટકી ગયા, ત્યારે ઝાંઝરિયા મુનિનો ઘાતક રાજ ધોર પશ્ચાત્તાપ અને દુષ્કૃત ગર્ભ સાથે પ્રચંડ વૈરાગ્ય ભાવનામાં ચડ્યો ત્યાં જ કેવળજ્ઞાન પામ્યો. કદાચ ઝાંઝરિયા મુનિ કપાતા કખાયમાં ચડ્યા હોત તો એ સંસારમાં અટકી જાત, પણ ઘાતક રાજ કખાય વોસિરાવી કેવળજ્ઞાન પામ્યા તે સંસારમાં ન અટકત.

રાગ-દ્રેષ્ટ-કામ-કોધ-લોભ, મદ-માયા વગેરેને તિલાંજલિ આપવી, દુર્ઘાનને બંધ કરવું, હિસાદ પાપોને વોસિરાવવા, અરિહંત-સાધુ, જિનધર્મની ઊંચી ઉપાસના કરવી, એ સ્વોપકાર છે. એને ભૂલીને પરોપકાર કરાય તે જાતને તારી શકે નહિ. અલબત છતી શક્તિએ પરોપકારની ઉપેક્ષા નહિ કરવાની; પણ શક્તિ ન હોય અને ન કરાય, છતાં જો સ્વોપકાર બરાબર કરાય, તો તે તારણહાર છે.

આ ઝેનધર્મનાં રહસ્યને સમજવામાં આવે તો સેચનક હાથી પરોપકાર કરવા છતાં કેમ નરકે ગયો એનો ભેદ ઉક્લી જાય. એણે પરોપકાર કર્યો ખરો, કિન્તુ ખાઈમાં બળી મરવાનું આવ્યું ત્યાં તીવ્ર કોધ અને રૌદ્રધ્યાનમાં ચડી ગયો, ‘આ મારા મૂઢમાલિકે હઠાત્રેહથી મને ખાઈ પર ચલાવ્યો? તે પાપી દુશ્મને ખાઈમાં ગુપ્ત અંગારા રાખવાનો આ પ્રપંચ કર્યો? હરામી! તું જો મારા હાથમાં આવે તો...’ આવાં કોઈક દુર્ઘાનમાં ચડવાથી એ પટકાયો નરકમાં.

ખૂબી કેવી છે કે સ્વોપકાર એટલે ઉપશમભાવ. જગત પ્રત્યે ઉદાસીનભાવ, એ ભૂલાય છે ત્યારે પોતે પૂર્વ સારા ભાવે કરેલા પરોપકારની હવે અનુમોદના ભૂલાય છે, અને સાચું કર્યું-કરાયું ધૂળધાણી થાય છે. ‘હું જો કખાય-દુર્ઘાન કરવાનો હક નથી મળતો’ આ બરાબર લક્ષમાં રહે. આપણા કખાય આપણાને દે જ છે. સામાના ગુના પર પણ આપણું દુર્ઘાન આપણાને અશુભ કર્મ બંધાવે જ છે, આ સ્વનો અપકાર થાય છે. માટે સ્વોપકાર કદી ભૂલવા જેવો નથી, પરોપકાર કરીને પણ એ ન ભૂલાય.

## ૧૨૩ જીવનમાં શાન્તિ કેમ મળો ?

આજે ચારે કોર અશાન્તિના ભડકા સળગે છે. કોઈને કોઈ, તો બીજાને બીજા પ્રકારની અશાન્તિ સળગાવી રહી છે. પોતાને જ હમણા એક પ્રકારની અશાન્તિ તો ઘરી પછી વળી બીજા પ્રકારની અશાન્તિ સંતાપી રહી છે.

દિલમાં અશાન્તિ છે શી રીતે ખબર પડે ? એ કચવાટ ફરિયાદ દીનતા ધમધમાટ વગેરેથી જણાઈ આવે છે. ચિત્ત શાન્ત પ્રશાન્ત હોય તો કચવાટ શા માટે થાય ? બીજાની આગળ રોદણું કે ધમધમાટ શા સારું કરાય ? દિલમાં ગરબડ છે, ભય છે, ઉકળાટ છે માટે તો એ બધું કરાય છે.

શ્રીમંતને ભય છે કે આજના સમાજવાદનાં નારામાં ધન-ધંધા પર ક્યાંક ભારે ચોંટ આવશે તો ? ગરીબને કકળાટ છે નવી નવી કાનુની જીવનમાં મોંઘવારી વધી રહી છે, રાજનેતાઓને ભય છે કે જો ચાલુ પ્રવાહમાં વહેતા ન રહીએ, બેળી પીપુડી ન વગાડીએ તો રખે નવી ચૂટણીમાં પદબ્રષ્ટ થવાય !

આ તો મોટી વાતો. લોકના જીવનમાં પણ પતિને પત્ની તરફથી, પત્નીને પતિ તરફથી, બાપને દીકરા તરફથી, દીકરાને બાપ તરફથી, એમ વેપારી-દલાલ-ધરાક અને શેઠ નોકર વગેરેને એક બીજા તરફથી કાંઈ ને કાંઈ અગવડ કલેશ કષ્ટ લાગ્યા કરે છે. જરા જરામાં ચિત્ત અશાન્ત બને છે એટલું જ નહિ, પણ ખાનપાન ચીજ-વસ્તુ માન-મોભો વગેરે અંગે પણ ચિત્તમાં અશાન્તિ ઊઠતાં વાર નથી લાગતી.

આ તો હકીકતની વાત થઈ. સવાલ એ છે કે શું જિંદગી આખી આમ અશાન્તિમાં જ પસાર કરવાની ? શું અશાન્તિ એ જીવન સાથે પ્રાણની જેમ નિર્ધારિત થઈ ગયેલી વસ્તુ છે ? જીવતા છીએ ત્યાં સુધી પ્રાણ ચાલ્યા જ કરે એ જેમ સહજ સ્વાભાવિક, એમ જીવતા છીએ ત્યાં સુધી શું અશાન્તિ ચાલે જ એ સહજ સ્વાભાવિક છે ?

ના, અશાન્તિ જો સહજ-સ્વાભાવિક હોત તો, એવા વિરલ (ઓછા) પણ મહાન આત્માઓ છે કે જે સદા શાન્તિ અનુભવે છે એ કેમ બને ? પોતાના ય જીવનમાં ક્યારેક થોડી પણ શાન્તિનો અનુભવ થાય છે. એ શી રીતે બને ? તાત્પર્ય અશાન્તિ જીવન સાથે પ્રાણની જેમ જકડાયેલી સહજ વસ્તુ નથી.

અશાન્તિ આપણો જ ઊભી કરીએ છીએ. સંયોગો તો નિમિત્તમાત્ર છે. એ સંયોગોને આપણો જેવો રંગ જેવો ભાવ આપીએ છીએ, જેવી દસ્તિ જોઈએ છીએ, એવો શાન્તિ કે અશાન્તિનો ભાવ ઊભો થાય છે. દા.ત. પકવાન્ જમવા મળ્યા, એને જો એ રીતે જોયું કે ‘વાહ ક્યારેક મળે એવું આ સરસ જમણ મફતમાં મળ્યું’ તો ત્યાં એના પર અનહદ રાગ, ખાવાની વિહૂવળતા ‘દબાય એટલું દાબો’ એવી લાલસા; વગેરેની અશાન્તિ ઊભી થવાની. એના બદલે જો એ પકવાન્ વધુ રાગ કરાવી મારનારા છે’ એ દસ્તિ જોઈ એનાથી સાવધ રહેવાનો ભાવ ઊભો કર્યો તો પેલી રાગાદિની અશાન્તિ નહિ ઊભી થાય.

એમ દા.ત. ભાઈએ ભાગ માટે ઝગડો ઊભો કર્યો, ત્યાં એને જો એ દસ્તિ જોયું કે ‘આ અન્યાય કરે છે, ધરનો બહાર ફજેતો કરે છે.’ તો ચિત્તમાં અશાન્તિ ઊભી થવાની. એના બદલે જો એ દસ્તિ જોયું કે ‘આ આપણાં કર્મની બળવતા સૂચ્યે છે, પુણ્યની દુર્બળતા દેખાડે છે,’ તો મનને થશે કે કર્મના નિર્ધારિત લેખ સામે ઝજુમવું ખોઢું. પુણ્યનાં નાણાં પ્રમાણો જ માલ મળે, પુણ્ય દુબણું પડ્યું છે તો હવે પુણ્યાઈ વધારવા દે. ભાઈ વધુ લઈ જાય અને હું ઉદારતા રાખ્યું ઝગડો ન કરું, એમાં પણ મારી પુણ્યાઈ વધે છે.’ થયું, આમાં-ચિત્તને શાન્તિ રહેશે.

આજના રાજકીય વાતાવરણ અને સરકારી કાયદામાં પણ જો આપણાં કર્મની બળવતાની દસ્તિ રખાય તો એ વિચારાય કે ‘કર્મ તો એમનું ધાર્યું કરવાના, પરંતુ હું એ ગડમથલમાં મારા આત્માની ચિંતા જ ભૂલી જઉં છું. માટે કર્મની ચાલને ચાલવા દે, હું મારું આત્મહિત વધુ સંભાળું’ આમ અશાન્તિ ટાળી શાન્તિ સર કરી શકાય. આત્મહિત સાધવા માટે આ વધુ અનુકૂળ છે એમ સમજને પણ શાન્તિ રાખી શકાય.

સારાંશ જીવનમાં શાન્તિ અનુભવવા સંયોગોને તત્ત્વની દસ્તિ જોવાની ટેવ રાખવી અને આત્મહિતને જીવનમાં મુખ્ય બનાવવું એ અતિ આવશ્યક છે.

## ૧૨૪ શું ભગવાન આપણા પનારે પડ્યા છે ?

કોઈના પનારે પડવું પડે એ માણસને કેટલું બધું દુઃખ અને અપમાનજનક લાગે છે ? પોતે મોટો શ્રીમંત હોય, છતાં જો લક્ષો-પક્ષાધાત કે એવો કોઈ રોગ યા અક્ષમાતથી હાથ કે પગનો છેદ યા આંખનો અંધાપો આવી ગયો, તો પછી પત્તીના કે છોકરાના પનારે પડવાનો અવસર આવી લાગે છે. એમાં એને જે વેઠવું પડે છે, જે ખમી ખાવું પડે છે, એના દુઃખનો એને પાર નથી રહેતો, ત્યારે એને લાગે છે કે આ જેના પનારે પડવું પડે છે અને જે ગ્રાસ આપી રહ્યા છે એ કેવા પાપિષ ! આ પનારે પડવું ખોટું આના કરતાં જીવન પૂરું થઈ જાય તો સારું.

માત્ર આમાં જ નહિ પણ દુનિયાના બીજા ક્ષેત્રોમાં ય પનારે પડવું અકસ્માતનું લાગે છે. નોકરને શેઠ એવો તોરી મિજાજ ને ગાળો બોલનારો મળ્યો હોય, બીજે નોકરી મળે એમ લાગતું ન હોય તો એને શેઠને પનારે પડ્યા જેવું લાગે છે, અને એ મિજાજ ગાળ વગરે એને જરાય ગમતું નથી મનને એમ થાય છે કે આ કેવો પાપિષો ! આના કરતાં ધરે બેસવું સારું.’ એક માર્કેટમાં એક ગુમાસ્તો દુકાને મોડો ગયો, શેઠે તડકાવ્યો ‘નોકરો કરવો છે કે મફત પાડાની જેમ પગાર ખાવો છે ? કેમ મોડા આવ્યા ?’ ગુમાસ્તો કહે ‘સાહેબ ધરે બેરી બિમાર પડી હતી, તે દવા લાવવામાં દવાખાને ભીડ હતી તેથી મોંનું થયું’, શેઠ તરત કહે છે ‘પગાર ખાવા છે ન બેરી બિમારનાં બહાના કાઢવા છે ? બેરી મરી કેમ ન ગઈ ? ગુમાસ્તો સમસમી રહ્યો, શું બોલે ? બોલવા જાય કે ‘શેઠ જરા ધ્યાન રાખીને બોલો તો સારું બેરી મરવાનું સંભળાવો છો ?’ તો તો શેઠ નોકરીથી નીચે જ ઉતારી મૂકે. કહી દે ‘સારું જાવ ધરે બેસો બેરીનું સાચવી રાખજો નોકરીએ આવતા નહિ.’ આમ નોકરી તૂટે તો ઝટ બીજે નોકરી મળે એમ ન હોય, તેથી રોટલાં ખર્ચ પણ ક્યાંથી કાઢે ? એટલે ચુપ રહી શેઠને પનારે પડ્યાનું વેઠી લેવું પડે પણ એની ભારે ઘડ્યા હોય; ને શેઠ પાપી લાગે.

આનું પનારે પડવાનું તો કેટલે ય ડેકાણો બને છે. છોકરો-ઉદ્ધત પાકે; કાઢી મૂકાય એમ હોય નહિ ત્યારે મા-બાપને લાગે છે કે આ ક્યા આવા, પાપિયાના પનારે પડ્યા ? એમ છોકરાના હાથમાં દુકાન આવી ગઈ હોય બાપ અપંગ જેવો બન્યો હોય અને છોકરો એને કાંઈ દાદ દેતો ન હોય, વ્યવહારના ઘણા પ્રસંગે બાપે

પહેલાં જે ઔચિત્ય અને આવશ્યક જાળવ્યું હોય તે હવે છોકરો પોતાના રાજ્યમાં જાળવવા દેતો ન હોય ત્યારે બાપને એમ થાય કે ક્યાં આ પાપીના પનારે પડ્યો ? આજાં કરતાં વાંઝીયો રહ્યો હોત તો સારું.’ એવું માતાને મિજાજ વઠકણી પુત્રવધુના પનારે પડતા ભારે દુઃખ થાય છે. એમ પતિને પત્તીના કે પત્તીને પતિના પનારે પડ્યાનું ભારે દુઃખ રહે છે, અને ત્રાસ વર્તાવનારા સામા પાપી લાગે છે.

એમ ભાઈ જો ભાઈના પનારે પડ્યો હોય, ભાગીદાર બીજા ભાગીદારના પનારે પડ્યો હોય, શેઠ ગુમાસ્તાધારાને લીધે કાઢી ન શકાય એવા કોઈ મિજાજ મેનેજર વગેરેના પનારે પડ્યો હોય, ગુરુ શિષ્યના પનારે પડ્યા હોય, સંસ્થાનો પ્રમુખ તોરી સેકેટરીના પનારે અને શિક્ષક કોઈ નાલાયક વિદ્યાર્થીના પનારે પડ્યો હોય... આમ જ્યાં જ્યાં પનારે પડવાનું થાય છે ત્યાં ત્યાં ‘આજા કરતાં આમાંથી છૂટીએ તો સારું; આ કેવા પાપિષ છે કે આપણે સીધા અને સેવાકારી છિતાં દબડાવે હેરાન કરે છે’...એમ થાય છે તો સંસાર એટલે ક્યાંક ને ક્યાંક પનારે પડવાનું ક્યાં નથી બનતું ?

છતાં ખૂબી એવી છે કે આમ છિતાં પોતાને મૂળભૂત એવા સંસાર પર વૈરાગ્ય નથી થતો, કે સંતાનને કોઈકના પનારે પડવું પડે એવી સ્થિતિથી જ દૂર રાખવાનો વિચાર નથી રહેતો ! અસ્તુ.

અહીં વિચાર આ કરવો છે કે શું ભગવાન આપણા પનારે પડ્યા હોય એવું આપણું વર્તન નથી ? આપણે મંદિરના ટ્રસ્ટી કે કારભારી હોઈએ તો મંદિરની વ્યવસ્થા આપણને અનુકૂળ પડે એ રીતે કરીએ છીએ ? કે આપણે પૈસાનો ભોગ આપી, કષ્ટ વેઠી, સમય કાઢીને પણ ભગવાનનું ભારે બહુમાન થાય, ભારે શોભા થાય, ભારે પૂજાભક્તિ વધે, સહેજ પણ પ્રભુની આશાતના ન થાય, પ્રભુના ભક્તોની અવગણના ન થાય, એ રીતે વ્યવસ્થા કરીએ છીએ ? વહીવટદાર બનીને આપણો લેશ પણ સ્વાર્થ ન સધાય, ઉલટું કદાચ આપણે વેઠવું પડે એ રીતે પણ મંદિરની વસ્તુ અને દ્રવ્યની રક્ષા-વૃદ્ધિ શોભા કરીએ ? દેવદ્રવ્યની ઉધરણી ન પતતી હોય, તો શરમ મૂકીને સામા પાસેથી તકાદો કરીએ ખરા ? કાયદેસર કરવું પડે તો તે ય પગલા લઈએ ખરા ? જો ના, તો એ ખોટ કોને ? એ ગેરવ્યવસ્થા કોની ? ભગવાનની ને ? એનો અર્થ ભગવાન આપણા પનારે જ પડ્યા ગણાય ને ?

એમ આપણે દર્શન-પૂજા કરવા જઈએ છીએ દર્શનમાં આડા ઊભા રહી

બીજાને ભગવાનનાં દર્શન અટકાવતા હોઈએ, પૂજનમાં જલદી પતાવવા ભગવાનનું વાશી કેશર મુલાયમ મોટા લચબચ ભીના કપડાથી ન ઉતારતાં વાળાંચુંચીથી કૂચડાની જેમ ઘસઘસ કરી ઉતારતા હોઈએ, દૂધમાં પાણી ઠોક ઠોક કરીને પ્રકાલ કરતા હોઈએ, તિલકમાં પતલા રેલા ઉતરે એવા કેશર-સુખડથી પૂજા, તે પણ ‘આ મારી માશીના છ તિલક, આ મારા મામાના છ તિલક...’ એમ ક્યાંય સુધી તિલકો કરતાં રહી બીજાને પૂજાનો અંતરાય કરતા હોઈએ, ચૈત્યવંદનમાં મોટા ધારાં પાડીને બોલતા બીજાની સ્તવનભક્તિ દ્બાવવાનું કરતા હોઈએ, મંદિરની થાળી-વાટકી-ધૂપિયું ચામર વગેરે ગમે તેમ રેઢિયાળની જેમ ફેક્ટાં-મૂકતાં હોઈએ, તો આ બધું ભગવાનનું જ છે ને ? એમાં ભગવાન આપણા પનારે પડ્યા એટલે જ આપણે આમ ચલાવીએ છીએ ને ? પૂર્વે કહું તેમ આપણે કોઈના પનારે પડ્યા હોઈએ તો કેવું લાગે સામે કેવો પાપિષ લાગે છે ? તો ભગવાનને આપણા પનારે પાડતા દિલને કાંઈ લાગે ખરું ? આપણે ધોર પાપિષ થઈએ છીએ એવું લાગે ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૨૦, તા. ૬-૨-૧૯૭૧

## ૧૨૫ ક્ષપકશ્રેણિ અને વીતરાગભાવ કેમ આવે ?

ભવવાસમાં અપાર જન્મ-મરણથી ભટકતા આપણે હવે એનો કંટાળો આવે છે ? શરમ આવે છે ? ભય લાગે છે ? જો કંટાળો શરમ ભય લાગતા હોય તો આપણે સાચા આસ્તિક છીએ. પરંતુ એવા આસ્તિક બન્યા પછી પણ હવે શું કરવું છે ? પાછો એ જ જન્મ-મરણમય ભવવાસને ઊભો રાખવો છે કે બંધ કરવો છે ? આ પ્રશ્ન આસ્તિકના સામે વારંવાર આવે.

ભવવાસ મૂળ રાગના કારણે છે. અર્થ-કામ, રસ-અદ્વિ-શાતા, આહાર-વિષ-પરિશ્રીહ વગેરે પરના રાગનાં જ કારણે ક્રીધાદિ અનેક કષાયો અને હિંસાદિ પાપો ચાલે છે; ને તેથી જ ભવવાસ અકબંધ ઊભો રહે છે. એ તો વીતરાગ બની રાગનો સંદર્ભ નાશ કરાય તો જ ભવવાસમાંથી કાયમી છૂટકારો મળે. આ વીતરાગભાવની પ્રાપ્તિ ક્ષપકશ્રેણિથી મળે છે. ‘ક્ષપકશ્રેણિ’ એટલે કર્માની ક્ષપજા યાને ક્ષય કરતા આવવાની ક્રમબદ્ધ પ્રક્રિયા. આ ક્ષપજાની પ્રક્રિયા શરૂ કરી એટલે આત્મા ક્ષપક બન્યો કહેવાય.

આ ક્ષપકશ્રેણિ વખતે આત્મામાં શુભ અધ્યવસાય યાને સંયમના અધ્યવસાય

ચડતા વેગે હોય છે એ ત્રીજા ‘સામર્થ્યોગ’ નામના યોગથી પ્રાપ્ત થયેલા અપૂર્વ સામર્થ્ય પર પ્રગટે છે.

આ સૂચવે છે કે વીતરાગભાવને પમાડનારી ક્ષપકશ્રેણિએ પહોંચવા માટે શુભ ભાવોને ખૂબ ઉલ્લભિત કરવાના હોય છે. જો એ એવા ને એવા સ્થિર ઊભા હોય તો કાંઈ ઊંચા સામર્થ્યોગ અને ક્ષપકશ્રેણિ પર પહોંચાય નહિ, એ તો એ શુભ ભાવોને ઉલ્લભિત કરવા પડે, ઊછળતા કરવા પડે, એમાં ઊછળો-વેગ-વૃદ્ધિ લાવવી પડે તે પણ માત્ર એકવાર ઊછળો લાભાથી ન ચાલે, કિન્તુ એના પર ભાવ અધિક અધિક ઊછળતા કરવા પડે. ત્યારે ગુણસ્થાનકમાં ઊંચે ઊંચે ચડતાં એવું સામર્થ્ય પ્રગટી આવે કે જેના બળ પર સામર્થ્યોગ પ્રાપ્ત થઈ એના દ્વારા વળી ભાવવૃદ્ધિ કરતાં કરતાં કર્માની ક્ષપજા થવા માટે, તે ઠેઠ મોહનીયકર્મ સર્વથા નષ્ટ થયે વીતરાગભાવે પહોંચી જવાય.

આ પરથી સમજાય એવું છે કે ત્યારે પ્રાથમિક અવસ્થાની નાની મોટી કોઈ પણ ધર્મસાધના કરતી વેળા ક્યું લક્ષ રાખવું પડે ? આ જ કે એમાં શુભ ભાવને ઊછળતા રાખવા જોઈએ. તો જ આ ભાવને ઊછળતા રાખવાનો દીર્ઘ કાળનો અભ્યાસ એક દિવસ એક ઘરી એવી લાવી મૂકે કે જ્યાં ઊંચી કોટિના ભાવના ઊછળતા વેગ પર સામર્થ્યોગ ક્ષપકશ્રેણિ અને વીતરાગભાવ પ્રાપ્ત થાય.

૨-૫ મિનિટના દેવદર્શન કરો કે કલાકભરની પ્રભુપૂજા કરો. બે પૈસાનું દાન કરો કે હજારો રૂપિયાનો ખર્ચ કરી મોટું ધર્મકાર્ય કરો નાનો બિયાસણનો તપ કરો, યા ઉપવાસ-દ્રષ્ટ-અદ્ધમ વગેરે તપ કરો, બધે જ ભાવ ઊછળતા રાખવા પડે. સામાયિક પ્રતિકમણ, પોષધ ઉપધાન, શ્રાવકના બાર પ્રત કે સાધુના પાંચ મહાપ્રત ભગવાનની એક પૂજા, યા મોટો અહીં મહોત્સવ, બે સાર્ધમિકને યાત્રા કે મોટી સંધ્યાત્રા,...વગેરે જે કોઈ સાધના કરાય એમાં ભાવ ઊછળતાં રાખવા જોઈએ. તો જ શુભ ભાવના ઊછળાનો અભ્યાસ પડે; જે અભ્યાસ કોઈક વાર વીતરાગભાવને પમાડનારા ઉચ્ચ શુભભાવના ઊછળાને સુલભ કરી આપે.

નાગકેતુને પુષ્પપૂજા કરતાં સર્પદંશ થયો એમાં શી રીતે વીતરાગ સર્વજ્ઞ બન્યા ? કહો, શુભ ભાવ ઊછળતા ચાલ્યા એમાં ઉચ્ચ શુભ ભાવે ચડ્યા, ને એય ઊછળતા ચાલ્યા, એમાં સામર્થ્યોગ વગેરે પ્રાપ્ત થતાં એમ બની આવ્યું-પરંતુ આ ભાવના ઊછળા ય એની પૂર્વ જીવનભર જે ધર્મસાધનાઓ પ્રાપ્ત થતાં એમ બની આવ્યું પરંતુ આ ભાવના ઊછળા ય એની પૂર્વ જીવનભર જે ધર્મસાધનાઓ કરતી હતી તે ઊછળતા ભાવ સાથે કરતી હશે એના અભ્યાસની અહીં આવાં સર્પદંશ જેવા પ્રસંગે ઉચ્ચ શુભ ભાવ અને એમાંય ઊછળાને સરળ બની ગયો.

આ શુભ ભાવની ખૂબી એ છે કે માત્ર ધર્મપ્રવૃત્તિ જ નહિ, કિન્તુ સાંસારિક પ્રવૃત્તિ યા આરામ, અવકાશ, કુરસદના વખતે પણ કેળવી શકાય. દા.ત. ખાતાંય કોઈ બિચારો ઉડતો જીવ ભોજન પર ન બેસી ચોંટી જાય' એવી દયા અને સાવધાનીનો ભાવ, યા ભોજનની વસ્તુનો રાગ મારી ન જાય એ માટે વિષયવ્યુદ્ધા-વિષયવૈરાગ્યનો ભાવ, ત્યારી તપસ્વી ધનના આણગારની અનુમોદનનો ભાવ,...વગેરેને ઉછળતા રાખી શકાય.

વાત આ છે કે ભાવ માત્ર શુભ નહિ, કિન્તુ એ ઉછળતા હોવા જોઈએ, શુભભાવનો ઉછળો ચાલતો રાખવો પડે. સાંસારિક પ્રવૃત્તિમાં પણ આવા ભાવના ઉછળા ભરત ચક્કવર્તીએ રાખ્યાં હશે, એટલે તો એના બહુ બહુ અભ્યાસે આરિસાભવનમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ ઉછળતા ચાલ્યા અને વીતરાગભાવે પહોંચી ક્ષણમાં કેવળજ્ઞાન પામ્યા ને? પછી એ ઉછળા વૈરાગ્યભાવના હો, પિતા પ્રભુ પ્રત્યેની ભક્તિના હો, યા સંપૂર્ણ અહિસા માટેના હો, ગમે તે પણ શુભ ભાવના ઉછળા રહેતા હશે તેથી અવસરે એ ઉછળી વીતરાગભાવે પહોંચ્યો.

બસ, જૈનશાસન સાથે મળેલા આ ઉચ્ચ ભવમાં જીવન આવું ભનાવવાનું છે કે શું સંસારકારભાર કે શું ધર્મ-પ્રવૃત્તિ બધે જ શુભ ભાવ ઉછળતા રાખીએ. ટૂંકા પ્રભુદર્શન કે ધૂટી ૧૨ નવકારની નવકારવાળીમાં પણ ભાવ-ઉછળતા રાખવાના. મનને એમ થાય કે વાહ! શ્રેણિક સુલસા વગેરેએ અરિહંતપ્રભુને અને પંચ પરમેષ્ઠાને પોતાના હૈયે કેટલું ઊંચું સ્થાન આપેલું કે એ હફ્યમાં પ્રભુની પ્રત્યે ભક્તિના ભવ્ય ઉછળા આવતા હતા! ત્યારે પ્રભુ અને પરમેષ્ઠા પણ કેવા ઊંચા પરાકમવાળા! કેટકેટલા ઉચ્ચ અનેક ગુણવાળા! આમને હું પામ્યો! મારો ય આથી ધન્ય અવતાર! ...આવા આવા વિચારથી ભાવ ઉછળતા કરી શકાય.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૮-૧૯, અંક-૨૧, તા. ૧૩-૨-૧૯૭૧

## ૧૨૬ પુણ્ય વટાવી ક્ષાયો ખરીદવાનો મૂર્ખ ધંધો

સંસારની લીલા અજબ છે. સારું મનગમતું મળે છે પુણ્યની હુંડી પર; પરંતુ જીવ એના દ્વારા એક યા બીજા ક્ષાયની ખરીદી કરે છે, જેથી સંસાર પાછો અખંડ ધારાએ જોરમાં વહે છે; કેમકે સંસારનું મૂળ ક્ષાયો છે.

ગંગા સિંહુના મૂળ હંમેશા ભરેલા પદ્મ સરોવરમાં છે; તો એમાંથી એ

શાશ્વત વદ્યા કરે છે. એમ સંસારના મૂળ ક્ષાયમાં, અને અનાદિ અનંત કાળથી એ ક્ષાયો અખંડ ઉભા છે તેથી એમાંથી સંસાર પણ અનાદિ કાળથી વદ્યો આવે છે. એમ, સંસારને વૃક્ષની ઉપમાં આપી, અનું મૂળ ક્ષાયો કર્યા છે. ક્ષાયો જ્યાં સુધી લીલા સિંચાયેલા ત્યાં સુધી સંસાર લીલોછભ.

સંસાર એટલે કર્મયોગ-કર્મસંયોગનું કારણ ક્ષાય અને યોગ છે. એમાં પણ ‘યોગ’ યાને મન વચનકાયાની પ્રવૃત્તિ એટલે વિચાર-વાણી-વર્તીવ એ ક્ષાયના આધારે ચાલતા હોય તો જ ભવવર્ધક યાને સંસાર-પોષક કર્મસંયોગનું કારણ બને છે. એટલે સંસારવર્ધક કર્મસંયોગનું મૂળ કારણ ક્ષાયો છે. અહીં ક્ષાયોમાં નોક્ષાય ભય-શોક-હર્ષ કામ વગેરે અંતર્ગત ગણી લેવાના છે. તેથી-ક્ષાયો તરીકે કામ-કોધ-લોભ, માન-મદ-માયા, હર્ષ-શોક-ઉદ્ઘેગ, હાસ્ય-ભય-હુગંધા, રાગ-દ્રેષ-વૈર-હિંધા, દીનતા-સંતાપ, આસક્તિ-મમતા-અભિનિવેશ વગેરે વગેરે આવે એ સંસારનું મૂળ છે.

હવે જીવનમાં એ તપાસવા જેવું છે કે પુણ્યે અનેક જાતની સુખ-સગવડ-સમૃદ્ધિ-માન-પાન વિષયો પ્રતિષ્ઠાપરિવાર વગેરે જે મજું ને મળે છે એના પર આ ક્ષાયોમાંના એક યા બીજાનું પોષણ કેવું થાય છે.

દા.ત. પૈસા કમાયો પુણ્ય વટાવ્યું, હવે શું કરશે? સારા કમાયો તો અભિમાન અને ઓછા મજ્યાં તો ઉદ્ઘેગ-દીનતા કરે છે. એમ કમાડી પર જો સંધરી રાખવાની વૃત્તિ છે તો મમતા અને ભોગવવાની લેશ્યા છે તો ભોગના રાગ આસક્તિ કરે છે. આ બધાય માન-ઉદ્ઘેગ-મમતા-આસક્તિ એ ક્ષાયના પ્રકાર છે. પુણ્ય વટાવીને શું કર્યું? ક્ષાયોની જ ખરીદી ને?

એમ પુણ્યે સારા ખાન-પાન મજ્યા કરે છે તો એના પર રાગ આસક્તિ અભિમાન થાય છે ‘આપણો તો આવું જ ખાઈએ, ગટરકલાસ નહિ.’ આ રસગારવ છે અભિમાન છે.

એવી રીતે પુણ્યે રૂપાળી પત્ની મળી તો એમ થોડું જ થાય છે કે રૂપાળા છે પરંતુ ધર્મની લેશ્યા વિનાની છે. તેથી મને મોહમાં ડૂબાડશે; માટે મોહને અત્યારથી રોકું? યા પત્ની ધર્મિષ મળી છે તો એવું થોડું જ થાય છે ચાલો હવે આની પ્રેરણા અને સહકારથી ધર્મ સારી રીતે કરશું. બ્રહ્મચર્ય સંયમ સારા પાળવાનું મળશે? કદાચ ઉપર ઉપરથી દેખાય કે એ ધર્મ છે માટે આનંદ છે, કિન્તુ અંદરમાં ઉત્તરી જુએ તો જણાય કે એ એક સારા સાધભીકના રાગ કરતાં સ્નેહરાગને પોષે છે; અને પત્ની પરનો સ્નેહરાગ કામરાગને પોષ છે. એટલે અહીં શું કર્યું? પુણ્ય વટાવી સારી પત્ની મેળવીને ક્ષાય (સ્નેહરાગ-કામરાગ) ખરીદા.

એમ, સારી ચીજવસ્તુ ફ્લેટ-ફરનીયર આદિ કે સારી સુખ શાતા દા.ત. ઉનાળામાં એરકન્ડીશન રૂમ યા આબુની હવાની શાતા મળવા પર મનને જો એમ થાય કે ‘આપણે તો ભાઈ ! આતું જ ખપે, મુફ્લીસથી ન ચાલે, તો આ શું કર્યું ?’ ઋદ્ધિગારવ-શાતાગારવ; અને એ અભિમાન છે, ત્યાં એવા ઋદ્ધિ શાતાની આસક્તિ છે. એટલે આ પુષ્ય વટાવી ઋદ્ધિ-શાતા મેળવીને શું કર્યું ? માન અને લોભ કષાયની ખરીદી. ગરમ સ્વાદિષ્ટ ચહા પુષ્યથી રોજ મળે છે. પણ ત્યાં પુષ્ય વટાવી એ ચહા મેળવવા પર ખરીદી શાની ? દરેક દરેક ગરમાગરમ ચહાના કપ પર ‘વાહ ! સારી ટેસ્ટકુલ અને સરસ ગરમાગરમ !’ એવો ગૃહ્ણિ-આસક્તિનો ભાવ જાગે છે, અર્થાત્ કષાયની જ ખરીદી થાય છે. ત્યાં કયાંય વૈરાગ્ય છે ?

પાસે પૈસા છે. ગરજુ નોકર અને લાલચુ પત્ની પુત્રાદિ મખ્યા છે, તેથી વાતવાતમાં સત્તા અજમાવવાનું અને ધમધમાટ કરવાનું, દબાવવાનું, ઉતારી પાડવાનું કરાય છે, પુષ્ય છે ત્યાંસુધી સામેથી સવાશેરી ધમધમાટ વગેરે નથી આવતા, ત્યાં શું કર્યું ? પુષ્ય વટાવી પૈસા-સત્તા-દબામણી મેળવીને અભિમાન-ગુર્સો અને ગાઢ ધનમૂળ્યાર્થી કષાય ખરીદ્યા. પુષ્ય વટાવીને આજ ખરીદવાનું ?

બે અક્ષર લખતા કે બોલતાં આવડે છે, ત્યાં મારા જેવો કોણ છે ? ફ્લાણાને શું રાખ આવડે છે ? ફ્લાણાનું ભલે ને લોક બહુ વાંચે, લોક બહુ સાંભળે, પણ લોકો ગમાર છે,’...વગેરે વગેરે ભાવો જાગે, એ શું કર્યું ? પુષ્ય વટાવી લેખન-ભાષણી શક્તિ મેળવીને કષાયો ખરીદવાનો ધંધો ! અથવા એ જ શક્તિથી સાધુને ધર્મકાર્યકર્તાઓને કે ધર્મના આચાર-અનુષ્ઠાનોને નિંદવાનું ઉતારી પાડવાનું અને લોકમાં એમના પ્રત્યે બેદિલી કરવવાનું કરાય, તો એ પણ શાનો ધંધો ? પુષ્ય વટાવી વટાવીને અભિમાન ખરીદવાનો ‘હું જ બધુ સમજું છું. આ બધા મૂર્ખ છે.’ એવો ઠેકો લોક અધર્મ પામે એવી ધિક્કાઈ, વગેરે કષાયો ખરીદવાનો જ ધંધો ને ?

બસ, સાવધાન થવા જેવું છે. નાની કે મોટી સગવડ-સાધન-અનુકૂળતા મળવામાં એટલું એટલું પુષ્ય તો વટાવાય જ છે. પરંતુ પાછું એના પર કષાય ખરીદવાનો જો ધંધો કરાય, તો એ એ સગવડાઈ પુષ્યાઈ નહિ પામેલા કરતાં મહા ક્રમન્સિબી છે. એથી કુસંસ્કારપોષણ, કર્મબંધ અને ભવવૃદ્ધિ થાય છે. એવા કષાયના કુસંસ્કાર પુષ્ય થવા પર આગળ એ જ કરવા માટેના હલકા ભવ મળે છે’ ત્યાં એ કરીને વધુ ખરાબ દુર્ગતિમાં ધકેલવવાનું થાય છે. કેવી દુઃખ પરંપરા !

તેથી એ કષાયોના બદલે કર્મતત્ત્વના જિનવચનની શ્રદ્ધા, નભ્રતા, ક્ષમા, વૈરાગ્ય, સુકૃતમનોરથ સુકૃતપ્રયત્ન...કરવા જેવા છે. પુષ્ય વટાવીને મળેલા માલ

પર કષાય રોકી સુકૃતસદ્ગુણો વધારીને પુષ્યની ભરતી ન કરીએ ? પુષ્યાનુંધી પુષ્યની ભરતી કરે તે જ સાચો પુષ્યશાળી અને તે કષાયની ખરીદી બંધ કરવા પર જ થાય. બાકી કષાયો ભર્યે જઈ પુષ્યને સફાયટ કરતો હોય તે પુષ્યશાળી શાનો ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખમૂત”

વર્ષ-૧૮, અંક-૨૨, તા. ૨૭-૨-૧૯૭૧

## ૧૨૭ જીવનની પાંચ ખરાબી અને દુશ્મનનો માલ (લેખાંક-૧)

આજના જીવનમાં સ્વાર્થિતતા અહંત્વ, વિલાસ, ઈઝર્સ અને લોકસંશા એ પાંચે પાકો કબજો જમાવ્યો છે. એથી માનવજીતિને વરદાનરૂપ પરાર્થવૃત્તિ, નભ્રતા, સંયમ, ગુણાનુરૂપ અને સર્વજ્ઞવચન-શ્રદ્ધાને હથય-પ્રવેશ મળતો નથી. આ પરાર્થવૃત્તિ વગેરે આ માનવને વરદાન છે. પુષ્યનો ઉદ્ય જાણો કહે છે કે ‘લે લે આ તને એવા મધ્યમ સંયોગ અને બુદ્ધિશક્તિ આપું છું કે એમાં તને નરકાગાર જેવા ઘોર ત્રાસ નહિ દેવલોક જેવા માદક ભોગસાધન નહિ, કે કીડા-પશુ જેવી અજ્ઞાનતા નહિ જેથી તું સ્વાર્થિતતા વગેરેમાં ભૂલો પડી જાય.’ અહીં તો તને એવા સુંદર સંયોગો છે જેના યોગે તું પરાર્થવૃત્તિ પરનું ભલું કરવાની મનોદશા રાખી શકે, નિરહંકાર-નભ્રતા રાખી શકે, સંયમ કેળવી શકે, બીજાના ગુણ બીજાનું સારું જોઈ પ્રસન્ન રહી શકે, અને વીતરાગ સર્વજ્ઞ ભગવાનનાં વચન પર અટલ શ્રદ્ધા કેળવી શકે; ને આ કરે તો તારો આ અમૂલ્ય દુર્લભ માનવ અવતાર મખ્યો લેખે લાગી જાય મહાન સફળતા પ્રાપ્ત કરી જાય.

### સ્વાર્થિતતાદિના કારણ

માણસ આ વરદાનરૂપ પરાર્થવૃત્તિ પરોપકાર વગેરે કેમ ભૂલે છે ? કેમ સ્વાર્થિતતાદિનાં દૂષ્યો રહે છે ? (૧) સ્વાર્થિતતાનું કારણ એ છે એને એમ લાગે છે કે આ બધું મેં મહેનત કરીને પરસેવા ઉતારીને યા ભાગ્યજોગે મળી ગયું છે તે શું બહાર બીજાને લુંટાવી દેવા માટે ? સારું શરીર મખ્યું છે તે શું બીજાઓ માટે મહિતનું ઘસી નાખવા માટે ? આમ સ્વાર્થમૂઢતા જ ખડી રહે છે.

(૨) એમ, સ્વાભિમાન-મદા-અહંકાર પણ એવા જ જીવંત રહેવાનું કારણ એ છે કે પોતે ગમે તેવો નપાવટ નિર્ણયી હોય છિતાં માને છે કે મારું ઊંચુ મહત્વ છે આ સામાઓ તો રડુસ છે.

(3) ત્યારે વિલાસી વૃત્તિ સજાગ રહ્યા કરે એમાં નવાઈ નથી; કેમકે અનાદિ મૂઢ્ટાવશ કેવળ કાયા ઈન્દ્રિયોની ઉપલક્ષિયા આનંદની કારમી ભૂખ છે, અને ગમે તેવા તકલાદી પુણ્યથી પણ ભલે ઢીકરા ને એઠવાડ જેવા વિષયો હોય, પણ એ મળી જાય છે. પછી ઉપલક્ષિયા આનંદનો ભૂખારવો વરુની માફિક એના પર તૂટી પડે એ સહજ છે.

(4) તેમ, ઈર્ધ્યી પાવરધી રહેવાનું કારણ બીજાના હુઃખ ને બીજાની કચ્ચામાણની તુલનામાં જ પોતાને ઊંચા સુખ અને ઉન્નતિ-જોઈએ છે. તેથી બીજાને ઊંચુ હોય એ સહન નથી થતું.

(5) ત્યારે લોકસંશ્નાની પરવશતા એટલા માટે ચાલ્યા કરે છે કે એને એમ લાગે છે કે (૧) જે લોકની વચ્ચે રહીએ છીએ એમાં સારાં ન દેખાઈએ વાહવાહ ન મળે તો જીવતા શું આવડયું ? આ એક લોકસંશ્ના (૨) તેમ નજરે દેખાતા આટલા બધા લોકો કાંઈ મૂર્ખ છે તે ખોટા રસે જતા હોય ? એ બધા સમજુને જ બધું કરે છે ને સુખી પણ થાય છે. માટે આપણે પણ લોકની સાથે ચાલો, ને જશ લો. આ બીજી લોકસંશ્ના.

આમ, પોતાની ચીજ પોતાના માટે તો લેખે લાગી, અને બીજમાં એ જતાં વેડફાઈ ગઈ એવી ગણતરી પર સ્વાર્થમૂઢ્તા, જાતનાં જ મૂલ્યાંકન પર મદ, ઈન્દ્રિયોના વિષયોની કારમી ભૂખ અને એના, ઉપલક્ષિયા આનંદના જ રસ પર વિલાસ, પરની અધોદશા સાથે પોતાને ઉન્નતિ મળે તો જ મજા, એવી વૃત્તિ પર ઈર્ધ્યી અને લોકની આરાધનાની વૃત્તિ પર લોકસંશ્ના જીવનમાં જગમગતા રહે છે.

પરંતુ જીવને ત્યાં ભાન નથી કે,

‘આ પાંચે દુર્ગુણ છે. ને એ સરેલા પાયા પર ઊભા છે.

(૧) જે ધન-શરીરાદિ મળ્યા પર સ્વાર્થ ઘેલો બને છે એ નાશવંત છે, કર્મવશ જોતજોતામાં એ ઊરી જવાનો છે. અનંતા પૂર્વજોના એ સાફ થઈ ગયા. તું શી વિસાતમાં છે ? તું ય કર્મ-પરાધીન જીવડો છે એ કર્મ અહીં તારા જીવતાં ય ધન શરીરાદિને બગાડી નાખવા સમર્થ છે. એવી નાશવંત અને કર્મધીન વસ્તુ પર શું એ બુદ્ધિ કરવી કે ‘આ મારું મારા માટે જ છે ? ને બીજમાં જાય તો વેડફાઈ જાય ? અરે ! ખરી રીતે તો તારા ઉપભોગમાં ગયું એ વેડફાયું ને બીજાના કામમાં આવ્યું એ લેખે લાગ્યું કહેવાય. કેમકે બીજાઓ ઠરતાં કુદરતના બદલાના ન્યાયે તને ઠરવાનું મળશે. સ્વભોગથી પુણ્યોપાર્જન નહિ પણ પરોપકારથી જ પુણ્ય ઉપાર્જન થાય, નાશવંતમાંથી એમ અવિનાશી લાભ ઊભો થાય. પણ સ્વાર્થમૂઢને આની ગમ નથી. તેથી શી રીતે એ સ્વાર્થ ગૌણ કરી પરોપકારમાં લાગે ?

(૨) ત્યારે સ્વાભિમાન-મદ-અહંકાર રાખનારને એ ભાન નથી કે ‘તારું શું મહત્વ છે ? તું તો એક કર્મનો અદનો ગુલામ છે. વિકરાળ કાળનો શિકાર છે. દોષ- દુર્ગુણોનો ભંડાર છે. એક નોકર કે ભિભારી પણ તારા કરતાં માનકપાય અને બીજા દાવપેચ વગેરે લાવનારાં કર્મનો એવો ગુલામ નથી; એવો કર્મ ગુલામ તું શાનો મદ કરે ? ગુલામને મદ અહંકાર કરવાનો અધિકાર નથી; કરે તો લાજે.’’ મદાંધને અભિમાનીને આ ભાન નથી, તેથી શી રીતે એ નામ નિરભિમાની બની શકે ?

(૩) તેમ વિલાસી એ જોતો નથી કે “આ વિષયોના આનંદ તો ઉપલક્ષિયા છે, માટે તો એમાં પડેલી દુનિયાને રોદણાં ને પોક ચાલુ છે. એ આનંદ સંયોગ-પરિસ્થિતિ-સમય-ભાગ્ય વગેરેની અપેક્ષા પર આધાર રાખનારા છે ને સંયોગાદિને ફરતાં વાર શી ? ત્યાં પછી એને આધીન આનંદ કર્યાં રહેવાનો ? સ્થિર આનંદ તો સંયમમાં છે.” વિલાસીને આ ભાન નહિ તેથી શું કામ વિલાસને મૂકી સંયમમાં આવે ?

(૪) તો, ઈર્ધ્યાથી બળનારાને એ જોવું નથી કે “બીજા હુઃખી નીચા અને કચડાપેલા હોય તો જ તારું સુખ એ સુખ, ઉન્નતિ એ ઉન્નતિ, એવું માનવામાં ભીત ભૂલે છે. એથી તો તને છિતાં સુખે ને છિતી ઉન્નતિએ શાંતિ નહિ, સંતાપ રહે છે. રંડચો તો રુએ પણ માંડચો ય રુએ ? તને મળ્યું છિતાંય તારે બળવાનું ? ઠરવાનું નહિ ? ઊલટું બીજાનું સારું બીજાનું ઊંચુ જોઈને તું દરીશ તો તારો આનંદ શાંતિ વધી જશો માટે માપવું રહેવા દે કે મને બીજા કરતાં વધુ સારું મળ્યું છે ને ? બીજાને નીચું છે ને ? આ અપેક્ષા ખોટી છે. નિર્ભેણ સ્વર્ણ આનંદ નિરપેક્ષતામાં છે” આ ન જુએ એ ઈર્ધ્યી મૂકી ગુણાનુરાગ શી રીતે લાવે ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૂત”

વર્ષ-૧૯, અંક-૨૩, તા. ૬-૩-૧૯૭૧

૧૨૮ (લેખાંક-૨)

ત્યારે સર્વજ્ઞ ભગવાનના વચનની આરાધના મૂકી લોકની આરાધનામાં જીવ તણાય છે. ત્યાં એને જોવું નથી કે આ લોક તો અજ્ઞાન છે, એ જે કરે છે જે રસે ચાલ્યા જાય છે એમાં સુખી થાય છે ? ક્યાં-શાંતિ અનુભવે છે ? જો એમ હોત તો વાતવાતમાં સંતાપ શાના કરે ? રોદણાં શું કામ રોવત ? કોઈની ચાપલુસી દીનતા ખૂશામત શું કામ કરત ? એ બધું કરે છે એ જ સૂચવે છે કે એમના માર્ગે સુખ-શાંતિ નથી. તેથી ‘ઘણાએ કર્યું તે આપણે કરવું, એ ન્યાય જ ખોટો છે

અનંતંજ્ઞાનીએ કહ્યું, તે કરવું એ જ ન્યાય સાચો.

વળી આવાં મૂઢ અજ્ઞાન પ-પ૦ લોકોનો યશ લઈ લોકોની શાબાશી લઈ તારું કહ્યું દાળદર ફિટવાનું છે ? એ શાબાશી આપનાર ક્યાં તને કામમાં આવે છે ? દુઃખમાં તને કયા લોક મદદ કરવા આવે છે ? કોણ પડ્યે ઉત્ત્મા રહે છે ? ત્યારે એવાની શાબાશી અને જશ લઈ લીધાથી કહ્યું પુણ બંધાઈ પરલોકે ઓથ મળે એવી છે ?

આવી પોકળ શાબાશીનો મોહ ન કરતાં અનંતંજ્ઞાની સર્વજ્ઞ ભગવાનના વચનની શ્રદ્ધા અને વચન પર મદાર રાખી આગળ વધાય તો અનંતા સિદ્ધ ભગવાનની શાબાશી મળે છે. સિદ્ધ ભગવાનની શાબાશી એટલે એમના કેવળજ્ઞાનમાં આપણું સારું ચિત્ર પડે એ, એ જુએ કે ‘આ આત્મા હવે સુધારો પામતો જાય છે. સારો બનતો જાય છે.’ તો આવી અનંતા સિદ્ધ ભગવાનની શાબાશી શી ખોટી ? એ લાવનાર કોણ ? લોકના રહે ચાલવાનું નહિ પણ સર્વજ્ઞવચન-મુજબના રહે ચાલવાનું એ લાવે એ શું ખોટું ?

લોકસંજ્ઞાના રહે ચાલવામાં તો અનંતાનાંત કાળથી લોકમાં જ ભયો, ભટકતો રહ્યો. એમાંથી બહાર નીકળે તો જ લોકોત્તર લોકોત્તમ સિદ્ધ ભગવંતોમાં મળવાનું અને સ્થિર થવાનું આવે. લોકસંજ્ઞાની બહાર નીકળી જવાનું સર્વજ્ઞ ભગવાનના વચનને જ પકડીને વચનનું જ આલંબન રાખીને જવાથી થાય.

લોકસંજ્ઞામાં તણાનારને આ કાંઈ જોવું વિચારવું નથી. મોટા ભેજાબાજ ઈન્દ્રભૂતિ-હરિભદ્ર-સ્થૂલભદ્ર વગેરેએ, મોટા વૈભવી કૃષ્ણ વાસુદેવ-સનતુકુમાર ચક્રવર્તી-શાલિભદ્ર વગેરેએ, તથા મહાસતીઓ સુલસા-ચંદ્રભાગા-મદનરેખા વગેરેએ આ જ કર્યું એ પણ જોવું નથી એને લોકસંજ્ઞા પડતી મૂકી સર્વજ્ઞવચનની પૂઠે લાગી જવાનું કૃથી બને ?

આ પાંચે ખરાબી, સ્વાર્થધિતા, અહંત્વ, વિલાસ ઈચ્છા અને લોકસંજ્ઞા-પુણ્યયોગે મળેલા દુન્યવી માલ અને મગજ ઉપર ચાલ્યા કરે છે. દુન્યવી ધન માલની પૂઠે સ્વાર્થમૂઢ બનાય છે, અને અહંત્વ કરાય છે, અનુકૂળ વિષયો પર વિલાસ સુઝે છે, મગજ મન મળવા ઉપર ઈચ્છા અને લોકસંજ્ઞા રખાય છે. પરંતુ અહીં સમજવા જોવું છે કે આ માલ વિષયો-મનમગજ એ બધું જ કર્મનો માલ છે, પુણ્યકર્મની લીલા છે ત્યારે કર્મ એ આત્માના દુશ્મન છે. એટલે સ્વાર્થ-મૂઢતા વગેરે ખરાબીઓ જેના પર પોષાય છે એ બધો કર્મનો યાને દુશ્મનનો માલ કહેવાય; અને દુશ્મનનો માલ તો ઝેર ભર્યો હોય.

સત્યાગ્રહની ચળવળમાં કે આજાઈ મળ્યા પછી એવા કોક આગેવાન દુશ્મનના છૂપા ઝેરના ભોજન ખાઈ ઘસાઈ મર્યા. દુશ્મનના માલ ઝેર મિશ્રિત હોય; તેથી તાંકો માણસ એ દેખાવામાં સારાં પણ જોઈને રાજ ન થાય, અને રાજ થાય તો મરે, કહે છે, લાલબહાડુરશાસ્ત્રીજી આર્યસંસ્કૃતિના હિમાયતી તે તાસ્કંદ ગયા ત્યારે સામ્યવાદી રસાલો એમની સેવામાં રહેતો; પાછા વળી શક્યા એ ?

દુન્યવી ધન-માલ-વિષયો યાવત્તુ કાયા અને મન એ બધું દુશ્મન કર્મનો માલ છે. ઝેરમિશ્રિત લાહુ જેવો એ ઝેરભર્યો માલ છે. આ જો લક્ષમાં રહે તો શું એવા ઝેરી માલ પાછળ સ્વાર્થમૂઢ બનાય ? કે પરાર્થરસિક પરોપકારી બનાય ? અહંત્વ કરાય કે નમ્ર અને નિરભિમાની બનાય ? શું વિલાસી બનવાનું ? કે બને તેટલો સંયમ કેળવવાનો ? ઈચ્છાથી સળગતા રહેવાનું ? કે ગુણાનુરાગી અને પ્રમોદ ભાવનાવાળા બન્યા રહેવાનું ? લોકસંજ્ઞામાં તણાવાનું કે સર્વજ્ઞવચનના રાહે ચાલવાનું ? દુશ્મનના ઝેરી માલ મળવા પર શું કરવું ઉચિત છે ?

એટલું વિચારવા જેવું છે કે અહીં આપણે એ ઝેરી માલ પર સ્વાર્થમૂઢ અહંકારી વગેરે બનીએ એમાં કોઈ રોકવા આવનાર નથી, પરંતુ પછી આત્માની અંદરમાં ઝેર પજથ્યા પર દશા કઈ ? કુદરત એ સ્વાર્થમૂઢતાદિનો બદલો કેવો વાળે ? જગતના બનાવો સ્વાર્થધિતા વગેરેના કેવાં ફળ બતાવે છે ?

પુણ્યના માલ એ કર્મ દુશ્મનના માલ ઝેર ભર્યા છે, ઝેર છે એવું જો આબેહુબ થયા કરે, તો ‘એના પર સ્વાર્થમૂઢ વગેરે શું થવું ?’ એમ મનને થાય. અને માનવજીવનમાં વરદાનભૂત પરાર્થવૃત્તિ પરોપકારરસ, નિરભિમાનતા, સંયમ, પરસુખતોષ, અને સર્વજ્ઞવચનશર્દ્વા બને તેટલા વધુ ને વધુ પ્રમાણમાં કેળવતા જવાય.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૂત”

વર્ષ-૧૮, અંક-૨૪, તા. ૨૭-૩-૧૯૭૧

## ૧૨૮ દર્શનની બલિહારી સામગ્રીમાં સમ્યગ્દર્શન

(લેખાંક-૧)

સામગ્રીમાં સમ્યગ્ દર્શન એટલે કે સાચું યથાર્થ દર્શન કરતાં આવડે તો માણસના ઘણા દુઃખ ઓછા થઈ જાય, ઘણી સમસ્યાઓ ઊકલી જાય. દર્શનની જ બલિહારી છે. વસ્તુ બનાવને કેવા સ્વરૂપે જીવાય છે એના પર ચિત્તને શાંતિ યા

અશાંતિ સુર્તિ કે સુસ્તી, ધીરતાં કે અધીરાઈ, સંતોષ યા સંકોચ, ટાઢક કે બળતરા થાય છે.

દા.ત. કોઈ દિલહુઃખનાં સમયે બહારથી મે'માન આવ્યો ત્યાં જો એ જોવાય કે 'લ્યો આ હુઃખ વધારનાર આવ્યા; અહીં તો ચિંતા સંતાપમાં અમે શેકાઈ રહ્યા છીએ, હવે પાછા આમના ખાનપાન-સરભરા સાચવવાની ચિંતા કરો, તો ત્યાં ચિત્તને અશાંતિ થાય છે. પરંતુ જો એમ જોવાય કે 'વાહ આ ઠીક આવી ગયા આમની સાથે વાતચીત અને આમની સલાહ-સૂચનામાં મારું દિલહુઃખ ઓદ્ધું થશે' તો મનને શાંતિ મળે છે.

એમ કોઈ ધર્મનું કાર્ય આવ્યું ત્યાં જો એમ જોવાય કે, 'લ્યો પાછો આ ખર્ચ કરવાનો આવ્યો તો ચિત્તને સુસ્તી ચેત છે; પણ જો એમ જોવાય કે આ પાપખાતામાં મારા પુણ્ય વરાવી મળેલી લક્ષ્મી ઘણી તણાઈ જાય છે, એમાં પુણ્યખાતે જમાં કરાવવાનો પ્રસંગ મળ્યો તો ચિત્તને સુર્તિનો અનુભવ થાય.

એમ ખબર પડી કે આપણું કોઈ વાંકું બોલે છે, એના પર જો એમ જોવાય કે હે? આ વાંકું બોલે છે? તો તો જો એને ન રોકું અગર સાંભળનારાને મારું સારું ને એનું ખરાબ ન સમજાવું તો તો આ મારી વિરુદ્ધ કેટલું ય પ્રચારે, તો ચિત્તને અધીરાઈ વધવાની પણ જો એમ જોવાય કે 'મારું વાંકું બોલે છે, તો એ મારા અશુભ કર્મને ઉદ્ય ભોગવી ક્ષય પામવાનો અવસર મળ્યો, આવો આવો હે અશુભ કર્મો! અહીં જ ઉદ્યમાં આવો એટલો મારે કચરો અહીં જ ઓછા થઈ જાય. વળી આવા અશુભની સામે મારે દેવ-ગુરુ-સાધર્મિક વગેરેનું સીધું પ્રશંસાત્મક બોલવાની સૂજ પડી જેથી પૂર્વ ભવનાં મારા વાંકાં બોલના પરિમાર્જન થાય' આવું જો જોવાય તો ચિત્તને ધીરતા રહે.

એમ, દા.ત. શેઠ તરફથી બીજા કરતાં આપણને માન ઓદ્ધું મળ્યું, ત્યાં જો એમ જોવાય કે શેઠનો આ કેવો પક્ષપાત છે? 'તો મનને ઓદ્ધું આવી મન સંકુચિત બનશે. પરંતુ જો એ રીતે જોવાય કે આટલોય આપણો પુણ્યોદ્ય છે કે શેઠ સામું જુએ છે માન આપે છે,' અગર માન નથી આપતા આપણને નથી બોલવતા, તો સારું થયું કે એમણે મને દેવ-ગુરુ-સાધર્મિકને માન આપવાનું હૈયે બહુમાન વધારવાનું અને ધર્મસેહના બોલ બોલવાનું સૂજાડ્યું,' તો ચિત્તને સંતોષ થાય. અથવા એમ જોવાય કે મને માન નથી મળતું એ એક રીતે સારું છે કે હું અભિમાનમાં ન તણાઉં, માનના દુન્યવી સુખમાં અંધ બેફિકર ના બની જાઉં, નહિતર આ માનપાન તો ભગવાનને ભૂલાવી દે'

એમ, રોગ આવ્યો ત્યાં જો એમ જોવાય કે 'આ હવે મારાં કેટલાંય કામ અટકશે,' તો ચિત્તને બળતરા થવાની, રોગના હુઃખ ઉપરાત્મન હુઃખ વધવાનું. પણ જો એમ જોવાય કે ચાલો આશ્રવ (પાપ વેપાર) ખાતામાંથી આટલી છૂટી મળી. જીવ આમ નહોતો જપતો, તો આમાં હરવાનું મળ્યું. 'તો ચિત્તને ટાઢક વળશે. એમ રોગ ઓછો થતાં જોવાય કે 'ચાલો શુભોદયના ચિદ્ધન દેખાય છે,' તો ચિત્તને ટાઢક ત્યારે જો 'હજ્જ્ય રોગ ઊભો છે' એમ જોવાય તો મનને ઓદ્ધું આવશે. બળતરા થશે.

બસ, વસ્તુને કે બનાવને કેવી રીતે જુઓ છો એનું કેવું દર્શન કરો છો, એના પર શાંતિ અશાંતિ વગેરે ઊભા થાય છે, દર્શનની બલિહારી છે.

એમ આ માનવભવે જે સગવડ-સામગ્રી મળી છે, એના પણ દર્શનની રીત ઉપર ઉન્નતિ કે અવનતિનો આધાર છે. જો એને સુખની સામગ્રી તરીકે જોઈ તો અવનતિને આમંત્રાણ મળે છે. એના બદલે જો એને ધર્મસામગ્રી તરીકે જોવાય તો ઉન્નતિને અવકાશ મળે છે.

દા.ત. મનમાન્યા પૈસા મળ્યાં, ત્યાં જો જોવાય કે 'ચાલો-સારું સુખસાધન મળ્યું, સારા પૈસા મળ્યા,' તો એના પર આર્તધ્યાન અને ષટ્કાય જીવોના આરંભ-સંમારંભમય કાર્યો કરવાના મનોરથ અભિમાન, કૃપણતા, ધર્મમાં ન ખરચાઈ જાય એની તકેદારી વગેરે વગેરે કેટલુંય ઊભુ થશે. એ બધું આત્માની અવનતિરૂપ છે, અવનતિ કરનારું છે.

પણ જો એમ જોવાય કે 'ચાલો આ પૈસા એ ધર્મસામગ્રી સારી મળી, હવે પેટની-કુંઠુંબની ચિંતા મટી, એટલે દેવદર્શન-પૂજા-સામાચિક, જિનવાણી શ્રવણ વગેરે ધર્મસાધના નિરાંતે થશે, 'તો એ જોવાથી શુભધ્યાન, આરંભથી બચવાના વિચાર દેવ-ગુરુને ભજતાં અભિમાનાદિ કષાયોની મંદતા દાનાદિમાં ઉદારતાા, ધર્મમાં સારું ખર્ચવાની ભાવના વગેરે ખીલશે, કેમકે પુણ્યે મળેલાને ધર્મસામગ્રી માની છે.

સારાંશ, અનુકૂળ વસ્તુ કે બનાવને સુખરૂપ યા સુખસામગ્રીરૂપ જોવામાં પતન છે. એ મિથ્યા દર્શન છે; ત્યારે ધર્મસામગ્રી તરીકે જોવામાં ઉત્થાન છે. એ સામગ્રીમાં સમ્યગ્દર્શન છે.

ગત લેખમાં એ જોયું કે મળેલી અહીં સામગ્રીને જો સુખસાધન તરીકે જોઈએ છીએ તો પછી એના પર અનેક દોપો દુષ્કૃત્યો ઉભા થાય છે; ત્યારે જો એને ધર્મસાધન તરીકે જોઈએ તો એ જ સામગ્રી પર આત્મહિત સાધવાનું બને છે. આ હક્કિકતને જુદા જુદા દણાન્તથી જોઈએ, જેથી ક્યાં શું કર્તવ્ય છે એ સમજાય.

પહેલા નંબરમાં, વિશ્વમાં દેખાતા નાના મોટા અનેકનેક પ્રાણીઓની વચ્ચે આપણને શ્રેષ્ઠ કોટિનો માનવ-અવતાર મળ્યો છે, એને જો સુખનું સાધન મળ્યું સમજવામાં આવે, તો એ જ રૂંડા અવતાર પર કેટકેટલા રૂંડાં કામ થાય છે, કૂદી બુદ્ધિ ધરાય છે, કૂદો દોષકચરો સંધર્યે જવાય છે. આજે દેખાય છે કે મનુષ્યો બીજા પ્રાણીઓ કરતાં વિશિષ્ટ સ્વાધીનતા-બુદ્ધિ-સામર્થ્ય-આવડત પર જીવોની બેફામ હિસા કરી રહ્યા છે, અનીતિ-અત્યાચાર આચરી રહ્યા છે, હુરાચારની નવનવી રીતરસમો ફેલાવી રહ્યા છે, એમ, માણસના મનને થાય છે કે હું મનુષ્ય હું તે શું જનાવરની જેમ અનાજ કે શાકભાજી સીધી ખાઈ જાઉં? હું તો એની સુંદર વાનીઓ કરીને ખાઉં,’ તાત્પર્ય, વિષયો કેળવીને સંસ્કારીને રૂડા બનાવીને ભોગવવામાં મનુષ્યપણાની વડાઈ દેખાય છે.

ખરી રીતે મનુષ્યપણું-માનવભવ આવા સુખોનું સાધન નહિ, પણ એક યા બીજી ધર્મ-આરાધનાનું જ સાધન દેખાયા કરવું જોઈએ જેથી અયોગ્ય કોટિના કે વધુ પડતા સુખોને બદલે સુંદર સદાચારો અને સંયમન-નિયમનોની લગની વિચારણા ઉદ્ઘમ બની રહે.

એમ પાંચે ઈન્દ્રિયો સારી મળી તે સુખસાધન તરીકે નહિ પણ સુંદર અને સંયમના સાધન તરીકે દેખાયા કરે દા.ત. આંખ મળી એ પરસ્તી જોવા કે સ્વસ્ત્રીના ય અંગોપાંગ જોવા માટે નહિ, કિન્તુ ધરાર એ નજર સામે આવે છતાં ય એને ન જોવાનો સંયમ કેળવવા માટે હોવાનું લાગ્યા કરે. અંધમાણસને આ સંયમ શો રાખવાનો? આંખ છે તો જ સંયમન કેળવી શકાય. એમ છાપાં, રેઝિયો, ફેન્સી પ્લાસ્ટિક બનાવટો, મોટર, પિક્ચરો વગેરે ધણું સામે આવે પણ ઈન્દ્રિયોને એમાં ન જોડવાના સંયમનની આરાધના કરવા મળી છે એમ લાગ્યા કરે; સુંદરો આરાધવા મળી હોવાનું લાગ્યા કરે.

આંખ સારી મળી તો તે પરમાત્માના તીર્થો અને સદ્ગુરુઓના દર્શન,

શાસ્ત્રવાંચન, ચાલતાં ફરતાં જીવ ન મરે એની જતના તથા ભક્ષાભક્ષ આદિના વિવેક કરવાનું સારું સાધન મળી એમ લાગ્યા કરે; એટલે એવાં સુંદર સાધવાનું મુખ્ય બની રહે.

જીબ સારી મળી તો તે અભક્ષ યા સુંદર રસો આરોગવાનું સાધન નહિ, તેમ નિંદા અસત્ય ઈષ્યાળું કે પરને દુઃખદાયી યા પાપવચન બોલવા માટે નહિ, પરંતુ રસ-આહારના સંયમનાનું સાધન મળી, તથા સારાં સ્તોત્ર સત્તવન સજાય બોલવાનું સત્ય, ગુણાનુવાદકારી અને અનેકવિધ ધર્મવચન બોલવાનું સાધન મળી.

આવું બીજી ઈન્દ્રિયોમાં પણ લાગ્યા કરે. એમ પૈસાટકા-માલમિલકત સુખનાં નહિ પણ સુંદરનાં સાધન તરીકે દેખાયા કરે. દા.ત. મોટર મળી તો પાપ-આશ્રવો સેવવા નહિ, પણ મંહિરો તીર્થોની ફરસના માટે મળી, સંધસેવાના કાર્ય કરવા માટે મળી, મોટર વિનાના સાધર્મિકોની કોઈ અગવડ ટાળવા સારું મળી, એમ દેખાયા કરે.

એમ, મન સારું મળ્યું, બુદ્ધિ શક્તિ સારી મળી તો તે કચરાપણી વિચારો કરવા માટે નહિ, કોધાદિ કખાયો અને કાળી લેશ્યામાં ચડવા માટે નહિ, કે આરંભસમારંભ-જુઠ-અનીતિના યા આહાર-વિષય-પરિગ્રહ પાપોના વિચાર કરવા માટે નહિ, કિન્તુ નક્કર તત્ત્વવિચારણા, દયા-સત્ય-મૈત્રી આદિ ગુણોના મનોરથ, ક્ષમા-મૂદુતા-લધુતા વગેરે ધર્મના ચિંતન કરવા માટે મળ્યાનું ડગલે પગલે લાગ્યા કરે.

એમ, કોઈ પ્રતિકૂલ વસ્તુ આવી ગઈ, કે પ્રતિકૂણ કાંઈ બન્યું, તો દેખાય કે આ મારી ધીરજ માપવાનું સમતા કેળવવાનું સાધન આવ્યું. દુઃખ રોગ-આપત્તિ આવી તો એ દુઃખસાધન નહિ પણ કર્મક્ષયનું સાધન લાગે. મનને એમ લાગે કે આમ તો કાંઈ કર્મ ખપાવવા માટે હું દુઃખ કષ્ટ વહેરવા જતો નથી, પણ જો આ આવી જ પડ્યું છે, તો તે એટલાં પાપ કર્મ ખપાવવા માટેનું સાધન છે, સત્ત્વ કેળવવા-ખીલવવાનું સુંદર સાધન છે; એટલા આશ્રવસેવનની દોઢધામ અને રાગ-આસક્તિ વગેરેની અસ્થિરિત ધારા અટકાવવાનું સાધન મળ્યું.

સારાંશ, અનુકૂળ-પ્રતિકૂણ સંયોગ સામગ્રી સંયમન-સુંદર-સત્ત્વવૃત્તિનાં સાધન તરીકે દેખાયા કરવી જોઈએ.

## ૧૩૧ કોધાદિ છ કષાયના ત્યાગ માટે વિચારણા

(૧) કોધના ઉદ્યનો નિરોધ અને ઉદીર્ણ કોધનું નિષ્ફળ કરણ એ વિચારણા ભાવના કરવાથી થાય, કે (૧) જીવ ! ધ્યાન રાખજો. આ બહારનું બગડ્યું છે કે બગડ્શે, તે તો તારા પોતાનાં અશુભ કર્મના લીધે; પરંતુ હવે તું કોધ કરીને તારા આત્માના પરલોકનું ન બગાડીશ. પેલું તારા હાથમાં નથી, આ તારા હાથની વાત છે. (૨) કોધ કરવાથી સામાનો કોધ વધી આગ સળ્યો છે; એમાં નુકશાન વધે છે. (૩) ‘સવે જીવા કુમ્મવસ’ એ હિસાબે સામો જીવ બિચારો કર્મને પરાધીન છે. એના પર ગુસ્સો શો કરવો ? એ તો દયાપાત્ર છે, માટે એની કરુણા ચિંતવવા જેવી છે, એના પર ગુસ્સો કરવા જેવો નહિ; કેમકે આમેય અજુગતું આચરવાથી કર્મનો માર ખાવાનો છે, તો એના પર વળી વધુ જુલમ શો કરવો ? (૪) મારે બહારનું બગડ્યું એ તો પરનું બગડ્યું, મારા આત્માનું કશું બગડ્યું નથી. એની પુણ્યાઈ, એનો ધર્મ અને એની સત્તાગત અનંત જ્ઞાનાદિ-સમૃદ્ધિ તો જે છે તે જ છે, એમાં સામો કાંઈ બગાડી શકતો નથી. પછી કોધ શા સારું કરવો ? (૫) કોધ કરવાથી મહાવીર પ્રભુના સંતાનપણાને કલંક લાગે છે, (૬) અણમોલ જિન શાસન પામેલું એણે જ્યા છે, (૭) આજ સુધી સેવેલા-ધર્મની સમજ ઘવાય છે. (૮) મારા કરતાં સો-હજાર લાખગુણી આપદામાં મહાપુરુષોએ કોધ નથી કર્યો, મહાવીર પ્રભુના કાનમાં ખીલા ઢોકાયા; સુકોશલ મુનિને વાધણે ફાડી ખાધા; ગજસુકુમાળના માથે સગડી મૂકાઈ છતાં એમણે લેશ માત્ર ગુસ્સો નથી કર્યો. (૯) અનંતકાળથી અનેક બીજા ભવમાં કોધને કોધની સંશાને પુષ્ટ કરવાનું કર્યું છે, પણ હવે આ ઊંચા માનવભવમાં ય ફરી એને પુષ્ટ કરવાનું કરીશ તો પછી એનું શોષણ કરવાનું, એનામાં છાસ કરવાનું, ઘસારો કરવાનું કયાં ભવમાં અને ક્યારે કરીશ ? (૧૦) કોધથી ચંડકોશિયા જીવ સાધુની જેમ ભવોની પરંપરા ચાલશે એ કેમ પોષાય ? (૧૧) કોધથી મન તામસી બને છે, સત્ત્વ ગુમાવી નિઃસત્ત્વ બને છે, અને તામસભાવની બીજા શુભ ભાવો પર ખરાબ અસર પડે છે. તેમજ અહીં સત્ત્વ હણાયાથી મહા સુકૃતના-ગુણસ્થાનક વૃદ્ધિના, તથા ક્ષપકશ્રેણિદાયી પરમસત્ત્વથી જનિત અપૂર્વ-કરણ-મહાસમાધિના પાયાભૂત સત્ત્વ પર ધા પડે છે. (૧૨) કોધ કરવાં જતાં ઔદ્ઘિકભાવ યાને મોહની આજ્ઞા પાળવા-પોષવાનું થાય, ત્યારે કોધને

અટકાવવાથી સુંદર ક્ષાયોપશમિક ભાવ યાને જિનની આજ્ઞા પાળવાનો લાભ મળે છે...’વગેરે વિચારવાથી અને દિલમાં ભાવિત કરવાથી, કોધના ઉદ્યને રોકી શકાય. વળી (૧૩) સામાનો કઠોર શર્જ જ કલ્પો ને ? ગાળ તો નથી દીધી ને ? ગાળ દીધી, તો બીજું તો કાંઈ બગાડ્યું નથી ને ? બગાડ્યું છે, પણ પ્રહાર તો નથી કર્યો ને ? પ્રહાર કર્યો, પરંતુ મને મારી તો નથી નાખ્યો ને ? મારી નાખે છે, પણ મારી અંતરની ધર્મ પરિણતિનો નાશ તો નથી જ કરી શકતો. એ તો હું જીતે જ નાશ કરું તો જ થાય, બાકી કોઈની એનો નાશ કરવાની તાકાત નથી, અને એ સલામત છે પછી મારું વાસ્તવિક કશું બગાડતું નથી. તો મારે શા સારું સામા પર ગુસ્સો કરવો ? એમ કહી અંતરમાં ભભૂકેલા કોધને નિષ્ફળ કરાય.

(૨) એમ, માન કષાયને રોકવા ઉપરોક્તમાંથી કેટલીય વિચારણા કામ લાગે. ઉપરાત એ વિચારાય કે (૧) અનંતજ્ઞાન, મહાન અવધિજ્ઞાન કે ૧૪ પૂર્વશુત-જ્ઞાન, તથા મહાપુણ્યાઈ મહાશક્તિ ધરનારાઓએ કે મહાસુકૃત કરનારાઓએ પણ અભિમાન નથી કર્યો તો હું શાના પર માન કરું ? (૨) અનંતા કર્મથી દબાયેલા શુલામ એવા મારે કયાં મોઢે અભિમાન કરવા ? (૩) મેં કયા એવા મહા સુકૃત મહા પરોપકાર કર્યો છે ? કયા એવા મહાન ગુણો મેળવ્યા છે ? કંઈ મહાતપ-સંયમની સાધના કરી છે ? મેં મનોવૃત્તિ પર કયો વિજય મેળવ્યો છે કે હું અભિમાન કરું ? (૪) અભિમાન જો બાધ્ય વૈભવ સત્તા-સંભાન આદિ પર થાય છે, તો વિચારવું કે ચક્કવતીની આગળ એ શી વિસાતમાં છે ?’ અને જો આંતરિકજ્ઞાન-તપ-વગેરે ઉપર થવા જ્યા છે, તો વિચારાય એ પૂર્વે પુરુષોની જ્ઞાન સમૃદ્ધિ-તપ સમૃદ્ધિ આગળ શી વિસાતમાં છે કે હું અભિમાન કરું. (૫) રાજા રાવણની જેમ અભિમાનથી અંતે પછિડાવવાનું થાય છે. એના કરતા માન ન કરવામાં શોભા અને શાંતિ રહે છે... વગેરે વિચારી માન-મદદ-અહકારને રોકવા. મનમાં માન ઊઠ્યું હોય તો ય એને સફળ ન થવા દેવું એના પર ભવા ચેઢે, અભિમાનના શર્જ બોલાય, સામાનો તિરસ્કાર નિંદા થાય, જીત વડાઈ થાય, મુખ મુદ્રા અને ચાલ વગેરે માનભરી બને, ઈત્યાદિ ફળ ન બેસવા દેવું. એમ ઉદ્ય પામેલા માનને નિષ્ફળ કરાય.

(૩) માયાના ઉદ્યને રોકવા ઉપરોક્તમાંની કેટલીક વિચારણા ઉપરાત એ વિચારવું કે, (૧) માયા તો સંસારની ભવોની માતા છે તેથી માતાની જેમ મારા ભવોને જન્મ આપશે તેમ મારા દોષોને પોષશે, (૨) માયા સેવવામાં પાછળ પસ્તાવો થવાનું ઓછું બને છે. તેથી એમાં સભ્યકૃતવનો નાશ થાય છે. (૩)

માયાથી સંગ્રહે વગેરે પોતાના જ માણસોનો વિશ્વાસ પ્રેમ ગુમાવવાનું થાય છે. તેમ લોક-વિશ્વાસ પણ ગુમાવાય છે. (૪) માયાને લીધે સ્ત્રીવેદ કે તિર્યંગ ગતિ ઉપાજીઈ નીચે ગબડવું પડે છે. (૫) મહારાજિની સંપન્નોએ પણ માયાથી આપદા નથી રોકી બચાવ નથી કર્યા તો હું શા માટે માયા કરું? એથી મને શો બહુ મોટો બચાવ મળવાનો લાભ મળવાનો હતો? (૬) માયા એ દારુ જેવું વસન છે, કરતાં કરતાં વધે છે... વગેરે વિચારી માયાને અને માયાના ફળરૂપ બાબુ તેવા માયાવી બોલચાલને અટકાવી શકાય.

(૪) લોભ કખાયના ત્યાગ માટે ઉપરોક્તમાંની કેટલીક વિચારણા કરવાં ઉપરાંત વિચારાય કે (૧) લોભ એ રાગ-મમતા-તૃષ્ણા-લાલસા-આકર્ષણ-આસક્રિત લંપટતા વગેરેમાંનાં કોઈ પણ રૂપે જાગે છે, રહે છે, ને એ આત્માનો શુદ્ધ ગુણ નહિ પણ વિકાર છે, રોગ છે, ઉપાધિ છે, વળગાડ છે, એ શા માટે વહેરું? (૨) અનંતા કાળથી મૂળપાયામાં આ લોભના રૂપક પર જ અનેકાનેક દોષો પોષાતા આ સંસાર લાંબો લચક ચાલ્યો છે. એવાને ઓળખ્યા પછી આવકાર શા? (૩) ‘ઈચ્છા હું આગાસ સમ અંગાંતા’ લોભનો પાર નથી લોભનો ખાડો પૂરવા જાય તેમ વધે છે. ઊંડો થતો જાય છે. (૪) બાબુના કરવા જતાં અનું મૂલ્યાંકન થઈ પોતાના આત્માનું મૂલ્ય ઓછું અંકવાનું થાય છે. મનને આત્મા કરતાં જડનું મહત્વ વધુ લાગે છે. આત્માનું મહત્વ ઓછું અંકાયાથી એના હિતનો વિચાર ગૌણ બની જાય છે. (૫) ‘સર્વ ગુણ વિનાશક લોભઃ,’ લોભ એ સર્વ ગુણોનો નાશક બને છે (૬) ‘પાપનો બાપ લોભ’ના લીધે આરંભ સમારંભ જુઠ ચોરી વગેરે કેટલાય પાપ આચરવા પડે છે... ઈત્યાદિ ઈત્યાદિ વિચારવા ભાવવાથી લોભના ઉદ્યને રોકી શકાય તેમ અંતરમાં ઉદ્ય પામેલ લોભને નિષ્ફળ કરવા માટે એની લાંબી વિચારણા ન કરાય, તેમ વાણી અને કાચા તથા ઈન્ડ્રિયોની લોભ-રાગ વશ થતી પ્રવૃત્તિ અટકાવાય.

આ રીતે કોથ-માન-માયા-લોભનો ઉદ્ય નિરોધ અને નિષ્ફળીકરણરૂપે ત્યાગ કરવામાં આવે એ જ ક્ષમા મુદુતા ઋજુતા-મુક્તિ. (આમાં ઈર્ઝ્ય-ભય-અસહિષ્ણુતા-દ્રેષ-હર્ષ ખેદ વગેરે દોષોનો ત્યાગ કરવાનું પણ સમજી લેવાનું) એમ ક્ષમાદિના અભ્યાસમાં આગળ વધતાં એ સિદ્ધ થાય ત્યારે એ શુક્લધ્યાન માટે આલંબનરૂપ બને છે. ક્ષમાદિમાં સ્થિર રહેવાથી એના આલંબને શુક્લધ્યાનમાં ચદી શકાય છે, કેમકે આ ધ્યાન સૂક્ષ્મ પદાર્થના બહુ સ્થિર ચિહ્નન રૂપ છે. એ જો ક્ષમાદિની સ્થિરતા ન હોય અર્થાત્ કોધાદિના સચોટ ઢં ત્યાગ ન હોય, તો કોધાદિના ઉદ્ઘાસી ટકી શકે નહિ. માટે એના સંપૂર્ણ ત્યાગના પ્રયત્ન જરૂરી છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૨૭, તા. ૧૭-૪-૧૯૭૧

૧૩૨

## ‘ધ્યાનશતક’ શાસ્ત્રપરિચય અને ધ્યાનનું મહત્વ

જીવનમાં મન ધણું કામ કરે છે. અનાદિ સંસ્કારોમાં વૃદ્ધિ કે ડ્રાસ અને ભવાતંરો માટે સારા નરસા સંસ્કારોનો વારસો મન તૈયાર કરે છે. સુખદુઃખ મોટાભાગે મનની કલ્પના પર જીવે છે, શુભ-અશુભ કર્મબંધ કે કર્મક્ષય મનના આધારે થાય છે. મોક્ષમાર્ગનો પ્રારંભ મનની સ્વચ્છ દિશી શરૂ થાય છે. ધર્મનો આધાર મનના ઉપયોગ પર છે. બીજાઓ સાથેના વ્યવહારમાં આપણું મન જે ભારે, તો મુશ્કેલી લાગે, ને મન જો ફોરું તો ભલું ભલું લાગે છે. મન અનુકૂળને પ્રતિકૂળ લગાડ ને પ્રતિકૂળને અનુકૂળ લગાડ છે...આમ મનનું કાયક્ષેત્ર મોટું છે.

આ મન કેવા વલણ વિકલ્પો અને ધ્યાનમાં ચેતે તો કુસંસ્કારની વૃદ્ધિ અને વારસાની તૈયારી થાય દુઃખ જ દુઃખ લાગે, પાપ કર્મબંધ ને પુણ્યનાશ થાય, ભારે ધર્મકષ્ટ વેઠવા છતાં મોક્ષમાર્ગમાં સ્થાન નહિ, ધર્મક્રિયામાં છતાં ધર્મ નહિ, બીજાઓ સાથેના વ્યવહારમાં મુશ્કેલીનો અનુભવ થાય, અને વાતે વાતે પ્રતિકૂળતાનો અનુભવ થયા કરે; વાતે વાતે મનને ઓછું આવ્યા કરે, એથી ઊલટું મન કેવા વલણ-વિકલ્પો-ધ્યાનમાં ચડવાથી કુસંસ્કારનાશ-સુસંસ્કારધંતર થાય, પાપનાશ-પુણ્યવૃદ્ધિ નીપણે, મોક્ષમાર્ગમાં સ્થાન મળે, આંતર ધર્મપરિણિતિ નક્કી થાય, બીજાઓ સાથેના વ્યવહારમાં સૌ સારાનો અનુભવ અને પ્રતિકૂળતામાં પણ અનુકૂળતાનો અનુભવ થાય, ‘વાતે વાતે સ્હુર્તિ રહ્યા કરે...આ જાણવાની બહુ જરૂર છે.

માણસ તો આનો જીણવટથી જાણકાર બની જાય અને એ પ્રમાણે મનને સારા વલણ-વિકલ્પ ધ્યાનમાં જ રાખે તો કર્મયોગે મળેલા નરકાગાર જેવા પણ સંયોગોમાં સ્વર્ગાય આનંદ-મસ્તી અનુભવી શકે; નહિતર સારા સંયોગો છતાં રોદણાં-શોક-સંતાપમાં સળગવાનું થાય. આ જાણકારી માટે ‘ધ્યાનશતક’ શાસ્ત્ર એક અતિ ઉત્તમ સાધન છે. એ પૂર્વધર મહર્ષિ વિશેખાવશ્યકભાષ્યાદિ રચયિતા આચાર્ય ભગવંત શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહારાજની કૃતિ છે.

૧૦૫ ગાથાના ‘ધ્યાનશતક’ શાસ્ત્રમાં મનની અવસ્થાઓ સ્વરૂપ અને પ્રકારો, શુભ-અશુભ ધ્યાનના લક્ષણ, લિંગ, લેશ્યા, ફળ, અશુભ ધ્યાનની ભયંકરતા, શુભ ધ્યાનની ભૂમિકા સર્જવાની ઉપાયભૂત સાધનાઓ, શુભ ધ્યાનને યોગ્ય દેશ-કાળ-મુદ્રા, ધ્યાન લાગવાને અનુકૂળ આલંબનો, શુભ ધ્યાનના વિષયો (ધ્યેય) નો વિસ્તાર

અને અધિકારી, શુભ ધ્યાન અટકતાં જરૂરી ચિંતન (અનુપ્રેક્ષા)... ઈત્યાદિ ઈત્યાદિ ભરયક વિષયો ભરેલા છે.

આ ગ્રાહૃત શાસ્ત્રના સંક્ષિપ્ત, નિર્દેશોને સંસ્કૃત ટીકામાં સમર્થ શાસ્ત્રકાર આચાર્ય પુરંદર શ્રી હરિભક્તસૂરીશ્વરજી મહારાજે સારાં સ્પષ્ટ કર્યા છે, કહેવાય કે ગ્રન્થરૂપી ફિલ્મનું એમણે ટીકારૂપી એન્નાર્જમેન્ટ કર્યું છે. એ વિના તો મૂળના શબ્દસંકેપમાંથી અર્થવિસ્તાર સમજવો કઠિન હતો. આ ટીકાનો સહારો લઈ ગુજરાતી ભાષામાં અનભિજ્ઞ જીવોને સમજાય એ રીતે આ વિવેચન આલેખવામાં આવ્યું છે. એમાં ઉપર્યુક્ત વિષયોને સમજાવતાં જીવન-ઉપયોગી અનેક પદાર્થનું નિરૂપણ કરાયું છે. જેવું કે,-

આર્તધ્યાનના વિવેચનમાં, જીવના ઉપયોગમાં આવતી ૮ પૂર્ણગલવર્ગણા, આર્તધ્યાનના દાખલા, ભૂત-ભવિષ્યનું પણ આર્તધ્યાન, દિનભરના આર્તધ્યાનના પ્રસંગો, સુખ એ સુખાભાસ, વેદના વખતે આર્તધ્યાન રોકવાના ઉપાય, જીવન જીવતાં ૪ સાવધાની. ઔષ્ણ કરતાં રાખવા યોગ્ય શુભ ઉદ્દેશો, તપ-સંયમથી સાંસારિક દુઃખનો નાશ કેવી રીતે? મોકણી ઈચ્છાથી ચિત્તવિશુદ્ધિ કેમ? આર્તધ્યાનના બાધ્ય લક્ષણોનું વિસ્તૃત સ્વરૂપ, એથી વર્તમાન જીવન કેટલું પામર કંગળ છે એનું ચિત્રામણ; એકંદરે આ બધું જ્ઞાણીને ઘ્યાલ આવે છે કે જીવન ક્યાં ક્યાં કેવા કેવા જ્ઞાત-અજ્ઞાત ભરયક આર્તધ્યાન પર ચાલે છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૨૮, તા. ૨૪-૪-૧૯૭૧

### ૧૩૩ સંચય-ભાગચાર્ય માટે ખાતા વહેંચી લો

સ્વતંત્ર આત્મતત્ત્વને માનનાર સમજે છે કે આત્માનું સ્વરૂપ જડ પૌર્ણગલિક પદાર્થના સ્વરૂપ કરતાં તદન જુદી જાતનું છે. આત્માના સ્વરૂપમાં શુદ્ધ જ્ઞાન-દર્શન યાને જ્ઞેય વસ્તુને માત્ર જોવી જ્ઞાણવી એટલું જ છે. દર્પણની માફક જ્ઞાનમાં વસ્તુનું પ્રતિબિંబ પડે એટલું માત્ર; બાકી રાગ-દ્વેષ હિસા પરિગ્રહાદિ નહિ. દર્પણમાં એના પર ફૂલહાર ચડાવનાર સામે આવે, કે એને તોડનાર ધોકો લઈ સામે આવે તો દર્પણ એનું પ્રતિબિંబ દેખાડે છે. પરંતુ ક્યાં રાગ દ્વેષ કે નાચંકુદ યા હિસાદિ તોફાન કરે છે?

જો એમણે આત્માનું આ સ્વતંત્ર શુદ્ધ જ્ઞાન સ્વરૂપ નિશ્ચિતપણે માનનારા છીએ તો જડના સ્વતંત્ર સારા શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ સ્વરૂપ પર આકર્ષવાની કરે છે.

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૨૭૧

નરસા પ્રત્યે નાક મયકોડવાની શી જરૂર? જડ ઈન્દ્રિયોને એ શાતા-અશાતા આપે એમાં આત્માએ લહેવાઈ જવાનું શું કામ? શી ખુશી-નાખુશી માનવી? આપણે તો ઈન્દ્રિયોને કહી શકીએ કે “તું જડ; તને જડ શબ્દ-રૂપ-રસ વગેરેથી શાતા-અશાતા ઠંડક-ઉકળાટ લાગે એમાં રાગ-દ્વેષ કરી મારું શું ભલુ થયું? મારે ને તમો જડને ક્યાં મેળ છે? મારું ખાતું સ્વતંત્ર છે, તમારું સ્વતંત્ર છે તેથી મારે તમને એવા સારા વિષયો મેળવી આપવાની કે નરસા આવેલાથી ગભરાવાની વેઠ કરવાની શી જરૂર?”

આ ભાવના ખૂબ અને ઊંડા વારંવારના ચિંતનથી આત્મસાત્ત કરવાનું કરીએ, તો જડ પદાર્થ પ્રત્યે અને ઈન્દ્રિયો પ્રત્યે એક પ્રકારની નફરત, ઉદાસીનભાવ અલિપ્તભાવ ઉભો થાય છ. પછી દા.ત. મોટી રૂપસુંદરી કે ખાવાની ચીજ સામે આવે છતાં અંતરમાં ચોખ્ખો હિસાબ તરવરે કે મારાથી તદન જુદા સ્વરૂપની ઈન્દ્રિયોના તર્ફણે કરવાની જરૂર નથી હું તો શુદ્ધ જ્ઞાનાદિમય સ્વરૂપવાળો; માટે એ જડ રૂપ-રસમાં માથું મારવાનું હોય નહિ.” આ હાર્દિક ભાવનાથી એ રૂપસુંદરી આદિથી અલિપ્ત રહેવાય; કામના વિકાર દબાવાય. મનને જટ થાય કે “સ્પર્શનેન્દ્રિયના ગિલગિલિયામાં હું શું કામ પડું? મારું સ્વરૂપ શુદ્ધ જ્ઞાનાદિ કરવાનું એટલે કે નિર્વિકાર રહી માત્ર વસ્તુ જ્ઞાણવાનું. શું કામ ઈન્દ્રિયોની ખાણજ માથે વહોરી મારે દુખણ પડનું? મારે વિહૂવળ વિકારી થવું? શા માટે મારે વિષયસંગ્રહ-વિષયસંપર્કની ચેષ્ટા કરવી?

બ્રહ્મચર્યના પાલન માટે અને પરસ્તી કે સ્વસ્તીનાં રાગભર્ય દર્શનથી દૂર રહેવા સારું આ વિચારણાને દિલમાં ખૂબ ભાવિત કરવી જોઈએ, એથી ગમતા રસ ગીત વગેરે વિષયોથી પણ અલિપ્ત રહેવા બળ મળે છે.

આટલું ધ્યાનમાં રહે કે આત્માને જડથી તદન જુદા સ્વરૂપવાળો અને જડને આત્માથી બિલકુલ જુદા સ્વરૂપવાળું વારંવાર ચિંતવ્યા કરવું પડે; અને જયારે ઈન્દ્રિયોની સામે કે વિચારણામાં જડ વિષયોનું આકમણ થાય પ્રવેશ થાય, ત્યારે ત્યારે વિશેષે કરીને ઉપરોક્ત ભાવના દિલમાં સ્કુર્યા કરવી જોઈએ. એનું કારણ એ છે કે અનંતાનંત કાળથી ભૂલા પેટલા અને મોહ-અજ્ઞાનના અંધારામાં આથડતા તથા જડ-વિષયોથી અનંત વાર લહેવાઈ રહેનારા આત્માને એના એટલા બધા ગાઢ સંસ્કાર છે, કે અહીં ચેતન-જડના સ્વતંત્ર જુદા જ ખાતા-હિસાબની જરા જેવી ભાવના વિસારે પડી કે તરત આ અનાદિરૂપ સંસ્કારો પાવરધા બનનવા અને તોફાન જમાવવા તૈયાર જ છે, આત્માને ભૂલો પાડી વિષયમૂઢ બનાવતાં વાર નહિ. એટલે જ ઉપરોક્ત ભાવના સતત જગતી રાખવાની જરૂર છે. એ જો રહે તો જડ વિષયો મુઆ પડ્યા છે. આત્મા ધરણ ધરણ ઈષ્ટવિષયના સંપર્કથી બચી શકે.

૨૭૨

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

કેટલાક અજ્ઞાનતાથી એવું સમજે છે કે ‘યુવાની પછી કામભોગ ન કરવામાં આવે તો તેથી નુકસાન થાય છે, શરીર બગડે છે, મન બગડે છે. વિષયભોગની તો સહજ લગાણી છે’ પરંતુ આ સમજ ખોટી છે; એ આત્મા અને જડ ઈદ્રિયવિષયોના તદ્દન જુદાં સ્વરૂપ નહિ વિચારવાના લીધે છે. બંનેના સ્વરૂપનું મિશ્રણ શંભુમેળો કર્યા કરવાના હિસાબે ખોટી સમજમાં તણવાવાનું થાય છે. નહિતર આત્માના સ્વરૂપની તદ્દન જુદાઈ વિચાર્યા કરવાથી અને એને દિલ પર લેવાથી આ ભ્રમણા ન ઊભી રહે. જેવી રીતે દા.ત. કોઈ આલીશાન બંગલો કે મોટર નજર સામે આવે તો એને ધારી ધારીને ન જોવામાં કે ન ખુશી થવામાં આત્માને યા દેહને કશું નુકશાન નથી. એમ મીઠો ખાદ્ય પદાર્થ નજર સામે આવ્યો છ્ટાં એ ન ખાવાથી આત્માને કાંઈ નુકશાન કે કરમાવાનું હોતું નથી. શરીરના પોષણ ટકાવ માટે જેમ ભોજન જરૂરી છે, એમ એ રૂપાળા દર્શન-સ્પર્શન જરૂરી નથી. નહિતર આઠ દિવસ ભૂષ્યા રહેતાં શરીર હુબણું પડે એમ પત્ની સુવાવડમાં ગઈ ને દિવસો સુધી એમ જ સ્પર્શન ન મળ્યાં તો કાયા કેમ હુબળી નથી પડતી? ઊલદું રૂપાળો તગડો બાબો જોઈ જોઈ લોહી વધે છે તે કેમ બને?

તાત્પર્ય, સંયમ-બ્રહ્મચર્ય એ તો માનવ જીવનમાં અલંકાર છે સ્વાસ્થ્ય છે નીરોગીતા છે, સત્ત્વ વિકાસ છે. આ ઉત્તમ જીવનમાં આનો ઉત્તમ લાભ ન ગુમાવવા માટે બળ કેળવવા આત્મા અને જડનાં ખાતા વહેંચી લેવા જોઈએ.

(૧) આત્માના ખાતામાં શુદ્ધ-જ્ઞાન-દર્શન, નિર્વિકારપણે માત્ર જોવા-જ્ઞાવાનું; અને (૨) જડના ખાતામાં શબ્દ-રૂપ-રસાદિ. પછી આત્માએ જડના ખાતાં ને કારભાર પોતાના માથે લેવાની, ને એમાં સંડોવાવાની જરૂર નહિ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૨૮, તા. ૧-૫-૧૯૭૧

### ૧૩૪ દુઃખનાં રોદણાં કેમ અટકે ?

આજના દેશકાળમાં ઊભી થયેલી પરિસ્થિતિમાં અજ્ઞાનતાએ મોટા ભાગના માનવોને રોતા બનાવ્યા છે. એક મનુષ્ય બીજાને મળે છે ત્યારે બંનેને કાંઈ ને કાંઈ રોદું ગાવાનું હોય છે, અરસપરસ કોઈ ને કોઈ ફરિયાદ નોંધવવાની, આ અમુક બગડી ગયું ને અમુક ખરાબ થઈ રહ્યું છે, એવી પોક મૂકવાની હોય છે... કાં તો પોતાના શરીરની યા કુટુંબની કે મકાન વગેરેની માંડશે, અથવા સમાજમાં ફલાણા ને ફીકણાના રોફની રોખની કૃપણતા વગેરે માંડશે; યા તો એ રોશે કે વખત કેટલો ખરાબ આવ્યો? કેટલી સજજડ મોંઘવારી? અમલદારો કેટલા લાંઘખાઉ? કેવા

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૨૭૩

હજારો-લાખો રૂ. ચાંઉ કરનારા? ટેક્ષોનો કેવો ભયંકર માર? રાજનૈતિક પાર્ટીઓમાં કેવું લાલચૂડાપણું કે અજ્ઞાન હિસાબ-લેખા?....

તાત્પર્ય, રાજ્યો રોવે છે, માંડશો રોવે છે; ગરીબ રોવે છે, તવંગર રોવે છે; ભાષેલો રોવે છે, અભણ રોવે છે; નાસ્તિક રોવે છે, ને આસ્તિક પણ રોવે છે.

ત્યારે સવાલ થાય કે સંયોગ-પરિસ્થિતિ ખરાબ હોય તેથી શું હુઃખ ન લાગે? બીજાની આગળ હુઃખનું હૈયું ઢાલવવાનું મન ન થાય?

પણ અહીં એ જોવાનું છે કે જીવન કશું જીવવાની મજા ગણાય? કેવું જીવવાને સારું ગણાય? હુઃખ લગાડ્યા કરવાનું જીવન? કે પ્રસન્નતા-પ્રશાંતતા માણવવાનું જીવન? હુઃખ ઊભાં રહે અને શું ખાલી શબ્દમાત્રથી એને બીજા આગળ ઢાલવવાનું જીવન જીવવાની મજા? કે હૈયેથી હુઃખ જ કાઢી નાખી બીજા આગળ એના અને આપણા દિલને કોઈ પ્રસન્નતા પ્રકૃતિલિતતા-પ્રશાંતતા વધે એવી વાત કરવાનું જીવન જીવવાની મજા? કેવું જીવન જીવવાની મજા? જીવન જીવવાના તો છીએ જ, હુઃખડા બહુ લાગે છે, તેથી કોઈ મરી જવાના નથી. પણ વિચારવાનું આ છે કે જીવન કેવી પદ્ધતિનું જીવવાને સારું ગણાય? રોદણાનું જીવન સારું? કે પ્રસન્નતા અને પ્રશાંતતા માણવવાનું જીવન આવકારદાયક?

સંયોગ બગડી ગયા, પરિસ્થિતિ બગડી ગઈ એનું હુઃખ જ હુઃખ લગાડ્યા કર્યા એથી શું વળ્યું? બીજાની આગળ એ રોયા એથી શું વળ્યું? પોતાના મનમાં હુઃખ લગાડ્યા કરવાથી અને બીજાની આગળ હુઃખ રોયા કરવાથી કેટલા નુકસાન?

(૧) પહેલું તો જીવને રોદણાની કુટેવ પડી જાય છે. તેથી પછી (૨) જીવનભર એ જ ચાલ્યા કરે છે, અને (૩) જીવનના અંતે પણ એ જ ઊભું હોય છે. એથી (૪) અહીં છતે બીજા અનેક વાતના સારા સંયોગે, એના બિચારાના ભાગે પ્રસન્નતા-પ્રશાંતતા જાતે જોવાની નહિ. અને (૫) બીજા આગળ ગાવાની વાત જ મળે નહિ, એટલે (૬) છતે સુખે સુખ ગયું. વધારામાં (૭) આ હુઃખડાની પાછળ રકમબંધ નીતરતા આર્તધ્યાન, એથી (૮) એના અથળક પાપસંસ્કારોનો સંધરો, તથા (૯) તિર્યચગતિના પાપકર્માનો ખડકલો થયા જ કરવાનો. પછી (૧૧) એને પરલોક કેવો મળે? પરલોકમાં એ પાપસંસ્કારો જીવન કેવાં કેવાં પાપથી ભર્યું આવે? ને (૧૧) અહીંના આત્મા પર ખડકેલા પાપકર્મો ઉદ્યમાં આવતાં કેવા કેવા હુઃખ-ત્રાસ-રિબામણ? આમ, હુઃખ લગાડ્યા કરવાથી અહીંનું ને પરલોકનું બનેનું કેટકેટલું બગડે છે! કેટલા નુકસાન અનર્થ?

૨૭૪

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

ત्यारे जो हुःभ जराय न लगाडतां हंमेशा प्रसन्नता-प्रकृतिता-प्रशांतता राखे तो ए अनर्थी वहोरवा न पडे उपरथी लाभ थाय छे वधारामां. ज्ञवन फोरुं प्रकाशमय ज्ञववा जेवुं लागे, पेलामां तो ज्ञवन भारे, अंधकारमय अने कंटाणाज्ञनक लागे.

सवाल आ थाय के खराब संयोग बनाव परिस्थितिमां प्रसन्नता-प्रशांतता रहे केवी रीते ?

आनो ज्ञवाब आ छे के (१) आ संयोगादिमां सारुं तत्व शुं शुं छे ? तेमज आपणने आ खराब संयोगादि सिवाय बीजुं सारुं शुं शुं मणेलुं छे ? ए जोवानुं; तो अठणक सारुं देखाशे अने एथी प्रसन्नता खीली उठशे, मन शांत प्रशांत बनी जशे.

खराब संयोगमां सारां तत्व ए, के (१) ज्ञवने सारी स्थितिनुं अभिमान चउतुं रहेत ते अटकशे; (२) खराबने शांतिथी सही लेतां आत्मानो महाकिंमती सत्त्वगुण विकसतो जशे; (३) खराब भोगवी लेवामां एटला पापकर्मना क्यरा साझ थशे; (४) भगवान अने धर्म सहेलाईथी याद आवशे अने धर्मने वधारवानुं मन थशे; (५) खराबने देखीने ‘संसार आवो ज छे’ ए समज पर वैराग्य वधशे... खराब संयोगमां आ सारां तत्व छे.

आपणने खराब संयोग-परिस्थिति सिवाय मणेलनुं बीजुं सारुं ए ज्ञेई शकाय, के (१) दुओ मनुष्यबव महाकिंमती मण्यो छे, ए अनेक गुण-सुरूत धर्मनुं उच्च पात्र छे; ए गुणादि कमाववा माटे अनुपम साधन हाथमां छे; (२) महामोँव्हरो नवकारमंत्र रटवानुं हजु हाथमां छे; (३) देवाधिदेव, सुगुरु, सम्यक् शास्त्र, तीर्थ, संघ वगेरे एवुं मण्युं छे के जेनो जगतमां जोटो नथी. (४) क्षमादि, मैत्री आदि, अहिंसा आदिनी महानतानी समज, ने ए पाणी शकाय एवी सुंदर चित्तशक्ति मणी छे. अज्ञान पशु होत तो आ समजवानी वातेय शी ? (५) तत्त्वोनुं ज्ञान सारुं मण्युं ने हजु मणी शके छे. (६) एकेक शुभ कर्मने लઈने बीजुं बीजुं सारुं धणुं आपणी पासे छे.

त्यारे शुं आ बंने प्रकारनुं अनेरुं सारुं जोवानुं कशुं छे ज नहि, ते खराब संयोग-बनाव-परिस्थितिनां हुःभ ज लगाड्या करवा ? सारुं गावानुं कशुं छे ज नहि ते रोद्धां ज रोया करवा ? ज्ञवन आवकारदायक तो ए के जे उपरोक्त सारां तत्व अने बीज अनेक सारी प्राप्ति ज ज्ञेई ज्ञेई प्रसन्नता-प्रशांतभर्यु ज्ञवानुं होय. ज्ञवन आवुं ज्ञववानी मजा कहेवाय.

“दिव्य-दर्शन”-“अग्रलेखामृत”

वर्ष-१८, अंक-३०, ता. ८-५-१९७१

## १३५ घोडो दोडे रे साहिब वाजमां

महोपाध्याय श्री यशोविजयज्ञ महाराजे भगवान श्री पञ्चप्रभस्वामीना स्ववनमां गायुं के

‘वीतरागशुं रे नेह ते एक पधो, क्रीजे कवण प्रकारज्ञ;  
घोडो दोडे रे साहिब वाजमां, मन नाणे असवारज्ञ  
-सुगुण सनेहा रे कहिय न वीसरे.

आनी पहेलानी गाथाओमां कहुं भगवान मोक्षमां जै दूर वस्या त्यांथी क्रोई पत्र आवतो नथी, के टपाल-व्यवहारनो मार्ग त्यां जतो नथी; तेम अहींथी मोडे संदेशो लई क्रोई त्यां ज्ञय अने पाणो आवे एवुं बनतुं नथी. तो प्रभु साथे संबंध केवी रीते राखवो ? त्यारे एमने पडतांय मूकाय एम नथी; केमके ए एवा सुगुण स्नेही छे के कटीय विसर्या न विसराय.

छतां एक रस्तो छे के भले पत्रव्यवहार संदेश-व्यवहार न रहे, तो पश परस्पर स्नेह संबंध रहे तो य धणुं काम थाय एवुं छे. किन्तु मुश्केली ए छे के प्रभु वीतराग होई राग स्नेह करता नथी, तो पछी मारे एकलाए एमना पर स्नेह करवो रह्यो ते एक पाक्षिक स्नेह शी रीते बने ? बापनो स्नेह देखाय तो दीकराने बाप पर स्नेह रहे, पतिनो पत्नी पर ग्रेम होय तो पत्नीने पति पर स्नेह रहे, पश ते विना पुत्र के पत्नीने स्नेह केवी रीते करवो फावे ? एमां तो समय-शक्तिनो अपव्यय थाय. एम वीतराग साथे स्नेह करवानो एटले एमनी भक्तिमां तेमज बीजा दानमां धन व्यय करवानो, ग्रत-तपमां सुख-शरीरनो खर्च करवानो, अने वीतराग तो कोई एथी स्नेह करे नहि, रीझे नहि, तो पछी ए बधो पुङ्यनो माल एमनी पाइण खरयी नाभवानो शो अर्थ ?

कवि आना ज्ञवाबमां कहे छे ‘घोडो दोडे रे साहिब वाजमां, मन नाणे असवारो ज्ञ’

क्रोई मोटा राजा-महाराजा-शेर शाहुकारनो सारो ज्ञतिवान घोडो होय अने एने शरत-हरिष्ठाई-यात्रामां काढ्यो होय त्यारे ए स्वामिनी भक्तिमां वाजिंत्रना तानथी हणहणी उठेलो दोडे छे. त्यां एने सवारनी कांઈ पडी नथी, सवारना एमने य ए जोवा नथी रहेतो, अनुं काम तो स्वामिनी भक्तिमां सौथी आगण दोडवानुं, एज एक लक्ष्य अने एमां एने यश मणे छे, स्वामिने त्यां ऊँचुं स्थान

મળે છે. ધોડો દોડે છે ત્યાં એ જોવા નથી રહેતો કે ‘મારો સવાર કે સ્વામી મારા પર પ્રેમ કરે છે કે નહિ ? મને ઈનામ આપશે કે નહિ ? છતાં યશ ઈનામ મળે જ છે.

બસ એ રીતે વીતરાગ-પ્રભુ આપણા પર સ્નેહ કરે છે કે નહિ, એ આપણે નથી જોવાનું. આપણું કામ તો શાસ્ત્ર વચનરૂપી વાજિતના નાદથી પ્રેરણા પામી સ્વામી વીતરાગની ભક્તિના કાર્યમાં દોડવાનું. ત્યાં એ જોવાનું નહિ કે ‘સ્વામી સ્નેહ રાખે છે કે નહિ, પ્રેમ કરે છે કે નહિ ?’ અને જો આ ભક્તિકાર્યમાં દોડવા જઈએ તો અંતે અમર યશ-ઈનામ મળવાનાં જ છે. કારણ કે આ સ્વામિનો ચિત્તામણિરતની જેમ પ્રભાવ જ એવો છે કે એમની ઉપાસનામાં દોડનારને ચમત્કારિક લાભ થાય છે.

અથવા જેમ રાજી સાહેબની સવારી નીકળે એમાં આગળ એના ધોડેસવાર હોય ત્યાં એ રાજાના ધોડા દોડતી વખતે જોવા નથી રહેતા કે ‘હું દોડું ને આ મારો સવાર પરી જશે તો ?’ ના, એ તો સ્વારે જ ધ્યાન રાખીને બેસવાનું કે જેથી પડાય નહિ; એમ ધોડારૂપી આપણી પ્રભુભક્તિએ દોડવાનું, ભક્તિએ એ નહિ જોવાનું કે ‘આ ભક્તિ પર ચેદેલો જીવ કંક વિષયસુખ મળતાં એના મોહમાં પડશે તો ?’

ના, એ તો જીવે જ ધ્યાન રાખવાનું કે વિષયસુખના મોહમાં પડાય નહિ. બાકી તો ભક્તિએ દોડવા જવાનું. પછી કદાચ ભક્તિના ફળમાં સુખ-સમૃદ્ધિ મળશે તો પણ વીતરાગની ચોક્કબી શુદ્ધ ભક્તિના સંસ્કાર એનો મોહ નહિ થવા દે, કિન્તુ એ જ શુદ્ધ ભક્તિને આગળ વધારશે.

તાત્પર્ય ‘વીતરાગ પ્રભુ અમારા પર સ્નેહ કરે છે કે નહિ, અમને દર્શન આપે છે કે નહિ. અમને બોલાવે છે કે નહિ, અમારું સાંભળશે કે નહિ,’ આવો આવો કશો વિચાર કરવાનો નહિ; માત્ર એ જ આ વિશ્વમાં સર્વોત્કૃષ્ટ પુરુષ છે, પુરુષોત્તમ છે, લોકોત્તર ગુણગણના ભંડાર છે, સર્વોત્તમ જીવનથી એ શ્રેષ્ઠ આલંબન છે, અનન્ય અને યથાર્થ તત્ત્વદાતા-માર્ગદાતા છે, ઈત્યાદિ વિચાર કરી ‘એ જ પરમોપાસ્ય છે, એ જ રાગ-ભક્તિ-આસ્થા-ભહુમાનનું અનન્ય પાત્ર છે.’ એવા નિર્ધાર સાથે એમની ભક્તિ કર્યે જવાની; એમનાથી જ હુંફ માનવાની, એમનાથી જ આશાસન લેવાનું, એમનામાં જ લીન બનવાનું. માટે જ કવિએ કહ્યું, ‘સાચી ભક્તિ રે ભાવનરસ કહ્યો.’ અર્થાત્ વીતરાગ પરમાત્મા ઉપરની સાચી ભક્તિ એ કે આપણો આત્મા એમનાથી ભાવિત થઈ જાય, એ પ્રભુના વચન, પ્રભુના આદર્શ, પ્રભુના તત્ત્વથી રંગાઈ જાય. મનનું વલણ, અભિપ્રાય, ઈચ્છાઓ મનોરથો વિચારો-વિકલ્પો એનાથી ભાવિત હોય, વાસિત હોય, શુદ્ધ નિઃસ્વાર્થ પ્રભુભક્તિ આ ભાવિતતા ઊભી કરી આપે છે, માટે એ ભાવનરસ છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૧, તા. ૧૫-૫-૧૯૭૧

### ૧૩૬ જીવનના હિસાબ પર સુખ-દુઃખ અને સંત-શોતાનપણું

જીવનમાં જોઈશું તો દેખાશે કે મોટા ભાગના સુખના કે દુઃખના અનુભવ, જીવનમાં જોવા હિસાબ માંડી મુક્કા હોય છે, એને અનુસાર થયા કરે છે. ખરેખરું અશુભ કર્મના ઉદ્યનું દુઃખ તો થોડું હોય, પણ માનસિક ગણતરી જો એવી કે ‘જીવન તો પૂર્ણ સુખ બર્યું જોઈએ ત્યાં ક્યાં આ લોથ આવી ?’ તો એ થોડું પણ દુઃખ હિલને બહુ ઉંઘ્યા કરવાનું બાળ્યા કરવાનું. એમ, ખરેખર બાધ્ય સુખસાધન સામાન્ય મળ્યું હોય, છતાં જો મનનો હિસાબ એવો કે ‘મારે તો મહાપાપો મહાકખાપો અને મહાદુર્ભૂષણોથી બચવાનું જોઈએ; તે આ બાધ્યના ઓદ્ધા જમેલામાં સારું સચવાય છે, એવું મોટા સરંજામમાં ન બનત,’ તો આ હિસાબ પર ખૂબ સુખ-શાન્તિનો અનુભવ થાય.

હિસાબ કેવો માંડી મૂકીએ છીએ, એના પર સુખના કે દુઃખના ગુણાકાર પણ થાય છે, યા સુખમાં દુઃખ, દુઃખમાં સુખ અનુભવાય છે. દા.ત. ખીસામાંથી રૂ. ૧૦) ની નોટ પડી ગઈ, ત્યાં જો હિસાબ એ જ માંડી રાખ્યો હતો કે ‘મારો એક પૈસો પણ ફોગટ પડી જવો ન જોઈએ,’ તો મનને ધાણું ધાણું દુઃખ થશે. પરંતુ જો હિસાબ એમ માંડી રાખ્યો હોય કે ‘આ મળવાનું કે ભેગું કરેલું ટકવાનું યા કામમાં જ આવવાનું ભાગ્યને આધીન છે, મારી ઈચ્છા કે હોશિયારીને આધીન નહિ,’ તો લાગશે કે ‘આ પડી ગયેલા ૧૦ રૂ. મારા ભાગ્યના નહિ હોય તેથી ગયા; એટલે દુઃખ નહિ લાગે પણ એ જવા સાથે એટલું મારું કમભાગ્ય પણ લેતા ગયા, એટલો પાપકર્મનો કચરો ઓછો થયો,’ આવા હિસાબ પર દુઃખમાં સુખ લાગશે. અથવા ‘સારું થયું ખીસામાં રૂ. ૧૦૦)ની નોટ નહોતી, નહિતર એ ય પડી જાત. એ હિસાબે તો મારે રૂ. ૮૦) બચ્યાં.’ એ ગણતરી પર સુખનો અનુભવ થશે.

‘મને બિમારી જરાય ન ફાલે,’-એ હિસાબ પર રોગ જશે તો નહિ, પણ ઊલટું રોગ પર રોદણાં થયા કરશે. ‘આ તો તકલેદી પુણ્યના જીવન છે, તેથી બધી વાતે સરખાઈ ન ચાલે, બિમારી વગેરે પણ હોય,’ આ હિસાબ માંડી રાખ્યા હોય એના ચિત્તને શાન્તિ રહેવાની.

સગાં-સ્નેહી વાંકા મણ્યા છે, ત્યાં જો પહેલેથી હિસાબ એવો માંડી રાખ્યો હોય કે ‘બધાએ મને અનુકૂળ જ વર્તવું જોઈએ, મારા પર સ્નેહ-સદ્ગ્રાવ જ રાખવો જોઈએ,’ તો ચિત્તને પેલાની વાંકાશ પર વાતે વાતે કલેશ રહે પણ જો

હિસાબ એવો મંડાય કે ‘આ જીવનમાં જે પૈસા-માન-પ્રતિજ્ઞાની કમાઈ કરવાની છે, તેના કરતાં વિશેષ તો ક્ષમા-સમતા-પ્રભુસ્મરણની કમાઈ કરવાની છે.’ તો અહીં સગાં-સેહીની વાંકાશ ઉપર આનંદ થશે કે ‘ચાલો, આમ કાંઈ સારાસારીમાં ક્ષમા-સમતા કેળવવાનો અવસર નહોતો, તે આ સગાની વાંકાશમાં કેળવવાનો અવસર મળ્યો. વળી આ વાંકાશ જોઈને તો પ્રભુને યાદ કરું કે ‘પ્રભુ ! તને પૂર્વે ભજવામાં ખામી રાખેલ તેથી આ વાંકાશ મળી. માટે હવે એ ખામી દૂર કરું,’ તને વિશેષ ભરું, સારું થયું સેહીએ તને યાદ કરાયો. વળી પ્રભુ ! તું મારે બહુ સીધો અને ઉત્તમોત્તમ મળ્યો છે એની જો હુંફ રાખું, તો આ વાંકાશ પર મારે શું રોવાનું ?

હિસાબ કેવા માંડી મૂક્યા છે કે માંડીએ છીએ એના પર માત્ર સુખી-દુઃખી શું પણ સંત કે શેતાન બનાય છે.

દા.ત. ખાનપાન સારું ન મળ્યું કે કપડાં ફેન્સી ન મળ્યાં, પત્ની ખુબસુરત અને અત્યંત પ્રેમવાળી ન મળી, હવે જો ત્યાં હિસાબ માત્ર ઈન્દ્રિય-તર્પણના ને ઈન્દ્રિયોની ઉજ્જાહીના જ માંડી મૂક્યા હશે, તો મનમા કેઈ ખોટા વિચાર ચાલશે, જ્યાં લાગ મળશે ત્યાં ધાડ પાડવાનું કરાશે, ગુસ્સો-ઉદ્ઘેગ-હુષ્ટતા આચારશે. આ બધું શું છે ? સંતપણું ? ના, શેતાનિયત છે. ઈન્દ્રિયોના પોષણના જ હિસાબવાળાને તો પત્ની પિયેર જાય એ ગમતું નથી, અરે ! આજે તો અંતરાય પાળે એ પાલવતું નથી. પછી એ શી શી શેતાનિયત નહિ કરે ?

ઈન્દ્રિયોના જ તર્પણના હિસાબ માંડી મૂક્યા હોય એને વાસનાઓના જાગરણ પણ જલદી થાય છે, અને એ વાસના યોગ્ય વિષય ન મળતા કાળી વિચારધારા ચાલે છે, અયોગ્ય રીતે વાસના મિટાવવા મથે છે. ભક્ષય-અભક્ષય, ગમ્યાગમ્ય, સુચેષા-કુચેષા કશું જોતો નથી...આ બધું શું છે ? શેતાનપણું.

પરંતુ જો હિસાબ એવા માંડીને દિલમાં સતત રમતા રાખ્યા હોય કે ‘મારો આ ઉચ્ચ અવતાર ચક્ષુ વગેરે ઈન્દ્રિયોને તો ભૂખે મારવા માટે છે, ઈન્દ્રિયોના ખૂબ દમન-સંયમન માટે છે, અને આત્માના તૃપ્તિ-બ્રહ્મચર્ય તથા જ્ઞાન-ઉપશમ આદિ ગુણોના અભ્યાસ માટે છે.’ જો આ હિસાબ માંડી રાખ્યો હોય તો વાસનાની કે કષાયોની ખણજ ઉઠે જ નહિ, એવું વાતાવરણ જમાવાય, ખણજ ઉઠતાં જ વિચારાય કે ‘જીવ ! જો જે આ અનાદિની આગને બળતણ ન આપ્યા કરીશ. શું મારે આવા રૂડાં ધર્મસહિત અવતારે ઈન્દ્રિયોને પોખ્યા જ કરવી ? ખરજ ખાય્યા જ કરવી ? મન કષાયોથી બગાડવા જ કરવું ? ના, હવે તો મારે આંતરિક તૃપ્તિ અને વિષયવિરામ જ ખપે.’

સારાંશ, આત્મસમૃદ્ધ વધારવાની હિસાબ પર સંતપણું આવે ને ઈન્દ્રિયો-મનનાં તર્પણના હિસાબ પર શેતાન બનાય.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૨, તા. ૨૨-૫-૧૯૭૧

## ૧૩૭ કર્મ ખટકે છે, પણ કબાંડ ખટકે છે ?

(લેખાંક-૧)

ધર્મસ્ય ફલમિચ્છન્તિ ધર્મ નેચ્છન્તિ માનવાઃ ।

ફલં પાપસ્ય નેચ્છન્તિ પાપં કુર્વન્તિ સાદરાઃ ॥

માણસ સુખ ઈચ્છે છે, સુખ એ ધર્મનું ફળ છે તો ‘સુખને ચાહનારે ધર્મને ચાહવો જોઈએ, પરંતુ સંસારની ઉંધાઈ કે માણસ ધર્મને નથી ચાહતો. બીજુબાજુ કોઈ દુઃખ પસંદ નથી કરતું, દુઃખ એ પાપનું ફળ છે, તો પાપ પણ પસંદ ન કરાય, પરંતુ હકીકિતમાં પાપ હોંશે હોંશે કરે છે. સંસારની આ કેવી વિચિત્રતા ? સુખ જોઈએ, ધર્મ ન જોઈએ, દુઃખ ન જોઈએ, પાપ હોંશે જોઈએ.’

દુકાન પરથી માલ જોઈતો હોય, પરંતુ પૈસા આપવાની ઈચ્છા જ ન હોય, તો એની માલની માગણી અન્યાયી ઉઠાવગીરીની માગણી ગણાય. રોગ ન જોઈતો હોય, પણ રોગના કારણ છોડવા ન હોય તો એની આરોગ્યની માગણી અન્યાયી માગણી કહેવાય. નોકરી પૂરી ભરવી નથી અને તૃપ્તિ માત્ર પગાર બરાબર જોઈતો હોય, જુના દેવામાંથી કશું પાછું આપવું નથી. અને નવી સારી રકમ ઉછીની જોઈએ છે, તો એ ગેર-વ્યાજબી છે. એવી રીતે સુખ જોઈએ છે, પણ સુખ લાવનાર ધર્મ નથી જોઈતો, તેમ દુઃખ નથી જોઈતું, તિન્તુ દુઃખ લાવનાર પાપ સારી રીતે કરવા છે, તો એ સુખ અને દુઃખભાવની માગણી અન્યાયી માગણી છે, ગેરવ્યાજબી ઈચ્છા છે.

આપણા જીવનમાં તપાસવા જેવું છે કે જેટલી સુખની લોહુપતા છે, સુખ પસંદ છે, સુખ માટે દોડધામ છે એટલી ધર્મની જંખના-તાલાવેલી છે ? ધર્મ પસંદ છે ? ધર્મ ખાતર દોડધામ છે ? એમ દુઃખથી ગભરામણ છે, દુઃખ જરાય પસંદ નથી, દુઃખ હટાવવા કાળી મહેનત છે, એવી હિસાદિ અને કોધાદિ પાપથી ગભરાવાનું છે ? એ પાપ લેશ પણ પસંદ નથી ? જીવનમાંથી પાપ હટાવવા કાળી મહેનત ખરી ?

સંસારની આ ભુલભુલામણી છે, મોહમૂઢતા-અજ્ઞાનતાનો આ કેફ-નશો છે કે સુખ-દુઃખની ચિંતા ચોવીસે કલાક, પણ ધર્મ કેમ આવે, પાપ કેમ ઓછા થાય એની ચિંતા એક કલાક પણ નહિ. પાછી આ મૂઢતાને મૂઢતા ય સમજવી નથી, કોરા સુખદુઃખની ચિંતાને હોશિયારી માનવી છે, આમાં માણસ પશુના ધોરણથી

ઉંચો શી રીતે આવે ? પશુનું ય ઘોરણ આ છે કે ‘સુખ માટે દોડ દુઃખથી ભાગ’ એ લેશ્યા ખરી, પરંતુ ‘લાવ ધર્મ કરું, ને પાપ છોડું,’ એવી લેશ પણ વિચારણા જ નહિ. અગર માણસ પણ જો આ જ લેશ્યા-લગન રાખતો હોય તો એ પશુની કક્ષાએ જ ઉભો ? કે એના કરતાં ઉંચી કક્ષાએ ચડ્યો ?

જીવનમાં જોવા જેવું છે કે પૈસા પરિવાર પ્રતિષ્ઠા ખાનપાન રંગરાગ વગેરે સુખોની ચિંતા લગની પ્રવૃત્તિ જેટલી રહે છે એના કરતાં વધુ પ્રમાણમાં સુખના હેતુભૂત જિનભક્તિ સાધુસેવા શાસ્ત્રશ્રદ્ધા તથા દાન, શીલ, વ્રત, તપસ્યા, મૈત્રી આદિ શુભ ભાવો વગેરે ધર્મની ધગશ-લગન અને પ્રવૃત્તિ રહે. સાથે સુખ-સગવડ મળ્યે જવા પર વારંવાર ધર્મનો દેવ-ગુરુનો ઉપકાર યાદ આવે. યાદ આવ્યા કરે કે ‘રૂડાં પ્રતાપ મારા દેવ-ગુરુ-ધર્મના કે આ સુખ મળ્યું, આ સગવડ થઈ, પ્રભુ ! તમારો હું આભાર માનું હું કે આ તમારા પ્રભાવે જ મનગમતું થઈ આવ્યું.’ આ જો વારંવાર આભાર-લાગણી થયા કરે તો નવા ધર્મસેવન માટે તત્પરતા રહે. માત્ર ‘મારે પુણ્યનો ઉદ્ય છે કે આ મળ્યું.’ એટલું યાદ કર્યે ન ચાલે. એકલું પુણ્ય યાદ કરવામાં પુણ્ય વધારનાર ધર્મ વધારવાનો ખ્યાલ નહિ આવે.

એમ જ્યાં દુઃખ-અગવડ-આપત્તિ આવી કે તરત યાદ આવે કે ‘આ મારા જ પૂર્વ પાપાચરણનું ફળ છે.’ તેથી દુઃખ-અગવડ-આપત્તિ હટાવવાની ચિંતા અને પ્રયત્ન કરતાં વધુ પ્રમાણમાં જીવનમાંથી પાપ કાઢવાની કાળજી અને પ્રવૃત્તિ રહે.

ધર્મ જીવને દુઃખ આવે છે ત્યારે હજુ એના મનને એમ થાય છે કે ‘આમાં બીજા કોઈને દોષ નથી, મારા કર્મનો દોષ છે, પરંતુ સાથે એવું ઓદ્ધું થાય છે કે ‘આ મારાં પૂર્વ પાપસેવનને લીધે છે, માટે જીવનમાંથી પાપ ઓછા કરું.’ આવી ચટપટી ન થવાને લીધે ‘મારે કર્મનો દોષ, મારા કર્મનો દોષ,’ એમ રોદણાં અને ગરીબદાપણું આવે છે, કર્મ પર વિકાર છૂટે છે. પરંતુ પાપાચરણ પર વિકાર તથા પોતાના એવા પાપી આત્મા ઉપર વિકાર અને ‘લાવ ત્યારે હવે પાપ તોડી નાખું, પાપને ફગાવી દઉં,’ એવું સત્ત્વ ને એવી અદ્ભુત ઈચ્છા નથી જણકી ઉંઠતી.

આના પર આ દ્યાનત વિચારાય, કે કુમારી છોકરી માતાને આવીને કહે ‘મા ! આ મારું પેટ કેમ ઊંચું થયું ?’ તો માતા શું કહે ? શું એમ કહે કે ‘હશે બેન ! તારા કર્મ એવા ?’ ના, એ તો તરત કહે ‘લુચ્યી ! તો કયાંય કબાંનું કરી આવી હશે.’ છોકરી પણ જો ખાનદાન હોય અને આવેશ શરમ-ાંધળિયાવશ આવું પાપ થઈ ગયું હોય તો પછી એ શું કરે ? ‘મારા કર્મ એવા, એમાં બીજાનો શો દોષ ?’ આવા રોદણાં અને ગરીબદાપણું કરે ? કે સત્ત્વ વિકસાવે કે ‘મરી જાઉ પણ હવે જિંદગીમાં કદી કબાંનું ન કરું.’

એમ આપણે કર્મને દોષ દઈને રાંકની પેઠે દુઃખ સહન કરીએ, પણ એ ન જોઈએ કે ‘આ પૂર્વે જીવનમાં પાપના કબાંનું કરેલા, તેથી આ પેટ ઊંચું થવા જેવી પીડા આવી, પણ હવે પાપના કબાંનું વોસિરાવું, તોડી નાખું પાપની વૃત્તિ,’ મનને જો આવું ન થાય તો પેલી છોકરીના જેવી મૂઢ્યતા જ ગણાય ? કે બીજું કાંઈ ? જેમ છોકરી એટલી સારી કે સામાનો દોષ ન કાઢતાં પોતાના કર્મનો દોષ કાઢ્યો, એમ આપણે એટલા સારા કે બીજાનો નહિ પણ આપણા કર્મનો દોષ જોઈએ, પરંતુ તેથી વધ્યું શું ? ખરેખર કર્મ ખટકે એના કરતા પૂર્વના પાપાચરણનું કબાંનું વધારે ખટકવું જોઈએ. છોકરીને જો એકલાં કર્મ ખટકે, તો પરણ્યા પછી નવું કબાંનું અટકે ? ના, કેમકે હવે તો એ ઢંકાઈ જવાનું છે; એમ કર્મ ખટકે પણ પાપકબાંનું ન ખટકે તો પુણ્યના ઉદ્ય પાવરધા થયા પછી નવાં પાપકબાંનું અટકે ? ના, કેમ કે હવે આ પુણ્યોદયમાં એના પાસા પોબાર થવાના છે.

બસ, ખરું ધર્મિપણું લાવવું હોય તો દુઃખમાં કર્મ ખટકે એના કરતાં પાપકબાંનું ખૂબ જોરદાર ખટકવાનું કરવું જોઈએ. એ માટે શું કરવું તે હવે પછી.-

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૩, તા. ૨૮-૫-૧૯૭૧

૧૩૮ (લેખાંક-૨)

દુઃખમાં બીજાને દોષ ન દઈએ. આપણા કર્મનો દોષ જોઈએ એ ઉત્તમ છે; કિન્તુ સાથે એ કર્મને ઉભા કરનાર પૂર્વનાં પાપ કબાંનું પર ફિટકાર છૂટવો જોઈએ; જેમ, ખાનદાન કુમારીને એકવાર ગમે તે રીતે ભૂલ થઈ ગયે પેટ ઊંચું થતાં માત્ર કર્મ નહિ પણ પોતે કરેલ કબાંનું ઉપર ફિટકાર છૂટે; અને પછી પોતે શીલ-સદાચારનાં ઊંચા કર્તવ્યમાં લાગે.

જો કર્મ કરતાં વિશેષ પૂર્વના પાપાચરણ પર ફિટકાર છૂટે, તો પછી હવે અહીં નવા પાપકબાંનું બંધ કરી સુકૃત-સદાચારણ-સદ્ગુણ માટે વિશેષ રૂપે થવા જોઈએ. તો હવે આ નક્કી કરી લેવા જેવું છે કે કેવા કેવા દુઃખમાં વિશેષ કરીને કેવાં કેવાં સુકૃત-સદાચારણ-સદ્ગુણ આદરવાનું લક્ષ અને પ્રયત્ન રાખવા ? અહીં થોડા દ્યાનતથી આ જોઈએ,-

દા.ત. આપણું કોઈએ અપમાન કર્યું, ત્યાં એ તો જરૂર વિચાર આવે કે આમાં સામાનો દોષ નથી, પરંતુ મારા કર્મનો જ દોષ છે; પરંતુ એથી વિશેષ લક્ષમાં એ આવે કે ‘પૂર્વે મેં બીજાનોને આદર-માન આપવાને બદલે અપમાન તિરસ્કાર-અનાદર કર્યો હશે તેથી આજે મારે આ તિરસ્કાર-અનાદર જોવાનો વખત

આવ્યો, તો હું હવે બીજાઓને માન-આદર-આવકાર આપતો ચાલું. એમ વિચારી જાતે જીવનમાં બીજાના અપમાન-અનાદર કરવાનું બંધ કરી દઈ, એમને માન-આદર-આવકાર આપવાનાં.

એવી રીતે આ પણ વિચાર છે કે ‘પૂર્વજન્મમાં મે અરિહંત પરમાત્માની ભક્તિ નથી કરી, યા ઓછી કરી છે, તેથી આ અપમાન પરાભવ જોવા પડે છે માટે હવે એ ખામી પૂરી કરું, દેવ-ગુરુની ખૂબ ભક્તિ કરું. સારું થયું આ અપમાને મને જાગતો કર્યો મને અરિહંત ભગવાન અને સુસાધુઓની ભક્તિમાં પૂર્વે રાખેલ ખામી તરફ દાણ કરાવી’ આમ વિચારીને દેવ-ગુરુની ભક્તિ આદર ને એમનાં ગુણગાન-સ્મરણ વગેરેમાં ખૂબ ઉત્સાહથી પ્રવર્તે. જો એકલું એટલું જ મન વાળ્યું હોય કે ‘આ અપમાનમાં સામાનો દોષ નથી, દોષ મારા કર્મનો છે. મારાં કર્મ એવા એટલે આવું બને,’ જો આટલું જ મન વાળ્યું હોય તો ત્યાં જીવનમાં બીજાને માન આદર આપવાનું સદ્ગુરુચરણ કે જિનભક્તિ-સાધુસેવા કરવાનાં સુષ્પૃત યા બીજા ધર્મસુષ્પૃતો વધારવાનું કર્યાં બને ?

એવી રીતે દા.ત. આજે ભારે મૌંઘવારી, ટેક્ષ ને બીજી હાડમારીઓ ખૂબ આવી, ત્યાં જો આટલું જ વિચારે કે ‘આમાં કોઈનો દોષ નથી, દોષ મારા કર્મનો છે, તો અલબાત્ત એમાં અવિવેકી સરકાર, સરકારી લાંઘિયા ઓફિસરો, લુચ્યા લોભી વેપારીઓ વગેરેને ગાળ દેવાનું કે એના પર દ્રેષ્ટ કરવાનું મન નહિ થાય, કિન્તુ બીજું સારું સક્રિય કાંઈ કરવાનું નહિ સ્ફૂરે. ત્યારે જો ત્યાં એમ વિચારાય કે આ મૌંઘવારી વગેરે હાડમારીઓ મેં પૂર્વ ભવોમાં બીજાને દાન-સહાયતા-સત્કાર આપવાને બદલે અનીતિથી બીજાનું પડાવી લેવાનું દ્રોહ કરવાનું કે એકલી સ્વાર્થમાયા અને કૃપણતા રમવાનું કરેલું હશે, દેવ-ગુરુ સંધ-તીર્થ વગેરેની એવી ભક્તિ અવગણવાનું રાખેલું હશે. તેથી આવી ઊભી છે, મારા પાપકબાડાનું આ ફળ છે. માટે હવે પાપકબાડાં તો સંદર્ભ બંધ કરી દઉં, અને ઉત્તમ સુષ્પૃત સદ્ગુરુચરણમાં દાન-પરોપકાર-પ્રામાણિકતા-પરગજુતા તથા દેવ-ગુરુ-સંધ-શાસ્ત્ર વગેરેની ભક્તિ કરતો ચાલું.

એવી રીતે દા.ત. શરીર સારું રહેતું નથી ખાંધું પચતું નથી, ખૂબ લાગતી નથી, કોઈ રોગ પીડ્યા કરે છે, ધંધામાં ફાવટ નથી, ત્યાં પણ માત્ર કર્મને દોષ દઈ બેસી રહેવાનું નહિ, કિન્તુ ત્યાં મનને એમ થાય કે આમાંથી કારણભૂત મારાં પૂર્વભવના પાપકબાડાં છે, જીવોની દ્યા કરી નથી, અભયદાન દીધા નથી, હિંસાની ચિંતા જ નહિ રાખીને આંખ મીઠીને કામો કર્યા છે, અનાચાર સેવ્યાં છે, અભક્ષ્ય ખાધા છે, રાતના ચગર્યા છે, પ્રત નિયમ આદર્યા નથી, યથેચ્છ પાપ ખુલ્લાં રાખ્યાં ભુવનભાનું એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

છે, આચર્યા છે, એનું પરિણામ છે; માટે હવે ચેતું. આ રોગ વગેરેએ ઠીક મારું ધ્યાન જેચ્યું, તેથી હવે જીવોની ખૂબ દ્યા કરતો રહું, અભયદાન દેતો રહું, કામકાજમાં જ્યથા અહિસાનો યત્ન રાખતો રહું, અભક્ષ્ય ત્યાગ જ રાખું, ભક્ષ્યમાં પણ નિયમન સંકોચ કરું, શક્યતાએ રાત્રિભોજન બંધ જ રાખું, શીલ-સદ્ગુરુચરણ કરક પાણું, અનેક પ્રકારનાં પ્રત નિયમ આદરું...’ આ દાણ રહેવાથી જીવનમાં સક્રિય ધર્મ-સાધના જગમગવા લાગે.

એમ પરિવારકલેશ, નોકરની ઉદ્ધતાઈ, પુત્ર પત્ની-કુટુંબીના રોઝ, બહાર નિંદા-અપશય વગેરે કોઈ જાતનાં દુઃખની સામે કારણ તરીકે પૂર્વ ભવના પાપકબાડાં દેખાય, બીજા પર દ્રેષ્ટ ધમધમાટ, રોઝ ઈર્યા, પરદોષપ્રેક્ષણ વિલાસ, માયા લોભ એકલી સાંસારિક ગડમથલ વગેરે વગેરે કેટલુંય ધ્યાનમાં આવે, મનને એમ થાય કે આવું જ બધું પૂર્વે કરેલું તેથી જ આ દુઃખો પીડી રવા છે. માટે હવે પાપકબાડાં બંધ કરી મૈત્રી-કરુણા-ગુણાનુરાગ-ગુણદાણિ, પરદોષ-ઉપેક્ષા, વૈરાગ્ય, ત્યાગ-સંયમ ક્ષમા લધુભાવ-સરળભાવ-સંતોષ આત્મહિતપ્રવૃત્તિ વગેરે વગેરે ખૂબ કરતો રહું, સામેથી દબામણી આવે એને સહર્ષ સહન કરતો ચાલું. પણ સામનો ન કરું; સામા સ્વાર્થી હોય કિન્તુ હું ઉદાર રહું, સામે તુચ્છ વ્યવહાર દેખાતા હોય છતાં હું વિશાળ પેટ રાખું..., જિનભક્તિ, સાધુસેવા ખૂબ કરું, પ્રત-નિયમ તપસ્યા ખૂબ કરું...’

સારાંશ, વર્તમાન દુઃખો પર કોઈને દોષ ન દેતા, તેમજ માત્ર પૂર્વ કર્મનો દોષ જોઈ ન બેસી રહેતાં, પૂર્વના પાપકબાડાનો પ્રતાપ દેખવાનો, અને હવે એને રદ કરવા માટે જીવનને સુષ્પૃત-સદ્ગુરુ-સદ્ગુરુચરણ તથા ધાર્મિક કાર્યો-પ્રવૃત્તિઓથી ભરચક ભરતા રહેવાનું.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૯, અંક-૩૪, તા. ૫-૬-૧૯૭૧

### ૧૩૮ ધર્મપ્રેમની કેટલી જરૂર ?

આપણને ધર્મનો પ્રેમ છે ? ધર્મ ગમે છે ? આ સવાલ આવે ત્યાં આપણે ઝટ હા કહી દઈએ છીએ. પરતુ આપણે ધર્મપ્રેમ હોવાનો જે દાવો રાખીએ છીએ એવી જો ખરેખર વસ્તુસ્થિતિ નહિ હોય તો ઠગાવાનું થશે. આપણું મન આપણને મનાવે કે મને ધર્મપ્રેમ છે, ને ખરેખર એમ હોય નહિ તો એ માનવું બ્રમજા છે; અને એવી બ્રમજામાં રહે, દિવલમાં ખરેખરો ધર્મપ્રેમ ઊભો કરવા અને સારો ૨૮૪ ભુવનભાનું એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

જમાવવા જે કરવું જરૂરી છે, તે કરવાનું રહી જશે. ત્યારે આ પાયાની વસ્તુ ધર્મપ્રેમ ઊભો કર્યા વિના જ આખીય જિંદગી વહી જાય તે ઠેઠ પૂર્ણવિરામે પહોંચી જાય, એ કેટલી બધી શોચનીય દશા ?

ધર્મપ્રેમ એ આત્મોન્તતિની પાયાની વસ્તુ છે. કીટ-પશુ જેવા જીવનમાંથી બહાર નીકળી ઉન્તતિના રાહે ચાલવાનું શુદ્ધ ધર્મપ્રેમથી શરૂ થાય છે. શુદ્ધ ધર્મપ્રેમ જગાવો એટલે ઉન્તતિનો પ્રારંભ થયો ગણાય. પછી જ ધર્મની બધી ય સાધનાઓ આત્માને મોક્ષ તરફ આગળ વધારનારી બની શકે. બાકી ધર્મપ્રેમ વિનાની ધર્મસાધનાઓ તો જીવને ભવમાં જ ભમતો રાખનારી બને છે.

માટે મૂળમાં ધર્મનો પ્રેમ જગાવવાની જરૂર છે; એ એવો જાગે કે ત્યાં સંસારની સર્વ સંપત્તિ કરતાં ધર્મનું વિશેષ મહત્વ લાગે, ઉંચુ મૂલ્યાંકન થાય, ‘ઉંચુ મૂલ્યાંકન એટલે મને ધર્મ ગમે છે’ એવું મનને લાગે ત્યાં મનને આ પૂછવું કે તો પછી ધર્મ હુન્યવી સમૃદ્ધિ-સત્તા-સંન્માન કરતાં મહાકિમતી લાગે છે ??

શુદ્ધ ધર્મ અને સમૃદ્ધિ બંને ગમે એવું ન બને ? ના, ‘ધર્મ’ શબ્દનો અર્થ એ છે કે હિંસાદિ પાપ અને પાપસાધનો કરતાં વિરુદ્ધ વસ્તુ. દા.ત. સત્ય એટલે અસત્યથી વિરુદ્ધ ચીજ. પછી જેમ સત્ય અને અસત્ય બંને ગમે એવું ન બને, એમ ધર્મ અને પાપ બંને ગમતા ન બની શકે. જો ધર્મ કિમતી લાગે છે તો પાપની ને પાપના સાધનની કશી કિમત ન લાગે; ધર્મ કર્યો અને પૈસા મળ્યા, પરંતુ જો એ પૈસા કિમતી લાગશે તો ત્યાં ધર્મ કિમતી નહિ લાગે; તેથી એ પૈસા દાનમાં ઉદ્ઘાળવાનું મન નહિ થાય; ને અગર મન થશે તો અધિક પૈસા સંન્માનાદિ મળે એ માટે. તેથી ત્યાં કિમતી તો પૈસા જ રહ્યા, ધર્મ નહિ. એટલે ધર્મ કિમતી લગડવા ધર્મ આગળ પાપ-પાપસાધનો કિમત વિનાના લાગવા જોઈએ. ધર્મકિમતી લાગે તો જ ધર્મ ગયો ગણાય, ધર્મપ્રેમ જાગ્યો ગણાય.

જીવનમાં પાપસાધનાઓથી બચવા ધર્મસાધનાની જરૂર છે. જેટલા ધર્મસાધનામાં રહીએ એટલા પાપસાધનાથી બચાય. પરંતુ ધર્મસાધનાનો સુકાની ધર્મપ્રેમ જોઈએ. ધર્મસાધનાને ચલાવનાર ધર્મપ્રેમ હોય. સુકાની સ્વરૂપ ધર્મપ્રેમથી જ હંકારેલી સાધનાની નાવ ભરપાર કરી આપે. એના બદલે જો ભળતો સુકાની હોય તો એ ભવસાગરમાં ફેરવ્યા કરે.

દા.ત. સારા દાનધર્મથી કે તપની યા ચારિત્રધર્મની સાધના કરી પરંતુ તે હુન્યવી વિષયસુખ-માનપાન લેવા માટે કરી, તો ત્યાં સાધનાનો સુકાની આ સુખનો પ્રેમ બન્યો; એ ભળતો સુકાની ગણાય, ને એ જીવને ભવમાં ઝૂબતો જ રાખે. સાધના ભલે ને ધર્મની કરી, પરંતુ અંતરમાં ધર્મપ્રેમને બદલે વિષયસુખનો રાગ

સંસારને જ પોષે, ભવના ફેરા અકબંધ રાખે. અનંતી ધર્મસાધનાઓ એમ જ ધર્મપ્રેમ વિના માત્ર વિષયરાગથી જીવને ભવમાં ભટકતો રાખી એળે ગઈ. માટે પાયામાં શુદ્ધ ધર્મપ્રેમ જરૂરી છે.

‘શુદ્ધ ધર્મપ્રેમ’ એટલે પાપસાધનભૂત કોઈ સુખસંપત્તિ-સંન્માનના પ્રેમથી ધર્મનો પ્રેમ નહિ, કિંતુ સ્વતંત્ર ધર્મપ્રેમ, પાપ અને પાપસાધનનાં અણગમા સાથેનો ધર્મપ્રેમ. એવા ધર્મપ્રેમથી ધર્મસાધના કરવાની. પછી પૂછવામાં આવે કે ‘કેમ દેવદર્શનપૂજા કરો છો ? કેમ મોટું દાન કરો છો ? તપ કરો છો ? કેમ શંખેશર પાર્શ્વનાથની આરાધના કરો છો છો ? ...’ તો આ બધાનો જવાબ એક જ કે ‘મને ધર્મ ગમે છે માટે આ કરું છું’ મનમાં પણ એ જ રાખવાનું કે ‘જીવનમાં ધર્મ જ કરત્વ છે, તો લાવ બને તેટલો વધુ ધર્મ કરું.’ પરંતુ એ નહિ કે ‘આનાથી પૈસેટકે સુખી રહીએ, સમાજમાં સારું માન મળે, આપણી તકી લાગી નામ અમર થઈ જાય, બજારમાં તડાકો લાગી જાય’ આવો કોઈ જ ઉદેશ નહિ જોઈએ.

ધર્મસાધના કરતાં એવા પૈસાટકા-નામનાકીર્તિ-વિષયસુખનો ઉદેશ રાખવામાં તો મુખ્ય અનો જ પ્રેમ તરવરતો હોય છે, ધર્મ તરીકે ધર્મનો પ્રેમ નહિ. તો શુદ્ધ ધર્મના પ્રેમ વિનાને ધર્મ ગમ્યા વિના એ ધર્મસાધના કરે છે ? હા, અલબત્ત ધર્મ ત્યાં ગમતો દેખાય એ તો મૂળમાં માત્ર પેલા પૈસા વગેરે ગમતા હોઈ એના એક સાધન તરીકે ધર્મ ગમે છે. તેથી પૈસાદિ પૂરતા મળ્યા પછી ‘ગરજ સરી વેદ વેરી’ ની જેમ ધર્મને પડતો મૂકે છે, અરે ! કોઈ દાનની ટીપ વગેરે માટે આવે તો એ દુશ્મન લાગે છે.

એટલે આ સાવધાની જરૂર છે કે ધર્મ હુન્યાનાં સુખ માટે ના ગમાડીએ, ધર્મને કોઈ હુન્યવી વિષયસુખ સગવડ, સંન્માન-પ્રતિજ્ઞા વગેરેનું Medium સાધન ન બનાવીએ. ધર્મ કરીએ તે આ કશાના માટે નહિ. ત્યાં મન કહે કે” આ પાપસાધનો પોષવા માટે ચિંતામણિથી પણ અધિક એવા ધર્મને શા માટે વેચ્યું ? બાબ્ય સુખસાધનો તો પૂર્વ કર્મનુસાર આવે છે, જાય છે, તેથી એના રાગ ખાતર ધર્મને શા માટે વેચ્યું ? બાબ્ય સુખસાધનો તો પૂર્વ કર્મનુસાર આવે છે, જાય છે, તેથી એના રાગ ખાતર ધર્મનો રાગ ગૌણ ન કરું; એ ગમે છે માટે એના સારું ધર્મ ગમે’ એવું ન રાખું. ધર્મથી ભવના ફેરા મિટે, જન્મમરણની વિટંબણા ટળે, અહીંનું જીવન પશુજીવન ન બને; માટે મને ધર્મ ગમે, એવું રાખું” આ રીતે શુદ્ધ ધર્મપ્રેમ ઊભો કરવાનો છે.

હવે આ વિચારવાનું છે કે આવો ધર્મપ્રેમ જાગ્યો છે અનું માપ શેના પર નીકળે ?

૧૪૦

## ધર્મપ્રેમ માપવાની પારાશીશી

આપણને ખરેખર ધર્મપ્રેમ છે એ તપાસવાની જરૂર છે; કેમકે ધર્મ જ તારણહાર છે, શાન્તિદાતા છે, આપત્તિમાં પણ મહાન આશાસનભૂત છે. હૈયે ધર્મનો પ્રેમ જાગતો હોય તો જ ધર્મની હૈયા સાથે સગાઈ થાય. તેથી માપવું પડે કે હૈયામાં ધર્મપ્રેમ છે?

‘ધર્મપ્રેમ’ એટલે ધર્મરાગ, વીતરાગ સર્વજ્ઞ ભગવાનના ધર્મશાસન પ્રત્યે રાગ. એ જો છે તો શાસનના અંગો પ્રત્યે પણ પ્રેમ-રાગ-મલકાટ હોવો જોઈએ. ‘શાસનના અંગો’ એટલે શાસનપતિ તીર્થકર ભગવાનનું નામ, ભગવાનની મૂર્તિ, મંદિર, તીર્થ, શાસનના આરાધક સાધુ-સાધ્વી-શાવક-શાવિકા, શાસનનાં શાસ્ત્રો-આચારો-અનુષ્ઠાનો પ્રત વિધાનો વગેરે વગેરે. શાસનના અંગો પર જો રાગ નથી, પ્રેમ નથી એ જોતાં કે સાંભળતા મલકાટ નથી થતો, તો પછી શાસન પર ધર્મ પર પ્રેમ શો?

ધર્મપ્રેમ માપવાની આ પારાશીશી છે કે ધર્મના ઉપરોક્ત અંગો પર મલકાટ કેટલો થાય છે.

‘ઉપમિતિ-ભવપ્રપંચા’ કથામાં પ્રારંભે દ્રમકભિખારીનું દિશાન્ત આપીને એ બતાવ્યું છે કે જેવી રીતે ભિખારીને રજવાડામાં પ્રવેશ મળ્યો ત્યાં એના પર સુસ્થિત રાજેશ્વરની કૃપા દાસ્તિ પડી એનું કારણ એ ભિખારીને રજવાડાની વસ્તુઓ જોઈ હૈયે આશ્રયભર્યા આનંદનો મલકાટ થયો, આંખો પ્રફુલ્લિત થઈ, મનને લાગ્યું કે ‘અહો ! બહાર ક્યાંય ક્યારે ય જોવા ન મળ્યું એવું આ કેટલું બધું અદ્ભુત છે !’ એ મલકાટ પરથી ત્યાંના અધિકારીએ નક્કી કર્યું કે ભિખારીને રજવાડા પર ખરેખર પ્રેમ ઊપજ્યો છે અને આના પર રાજેશ્વરની કૃપા દાસ્તિ પડી છે, તેથી અહીં પ્રવેશ મળ્યો છે તે યોગ્ય છે,’ એવી રીતે સંસારી જીવને જો પરમાત્માના શાસનરૂપી રજવાડાના અંગો જોઈ અપૂર્વ જોવા મળ્યાના આશ્રય સાથે આનંદ-મલકાટ થાય તો આચાર્ય એ પરથી નક્કી કરે છે કે ‘આ જીવને શાસન પર ખરેખર પ્રેમ યાને ધર્મપ્રેમ ઊપજ્યો છે, અને આના પર પરમાત્માની કૃપાદાસ્તિ પડી છે, તેમજ આને જેનશાસનમાં યોગ્ય પ્રવેશ મળ્યો છે.

‘ઉપમિતિ’ શાસ્ત્રનાં આ કથન પરથી સૂચિત થાય છે કે શાસન પર પ્રેમ યાને ધર્મપ્રેમ ખરેખર જાગ્યો હોય તો એને શાસનના અંગો જોઈ-સાંભળી હૈયે ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૨૮૭

મહા આનંદ-મલકાટ થાય. ત્યારે જો કશો આનંદ-મલકાટ થતો નથી, ને ઉપરથી એના બદલે ઉદ્દેગ ઈર્ઝા સુગ અરુચિ વગેરે થતું હોય, તો અંતરમાં ધર્મપ્રેમ કર્યાં રહ્યો ?

અહીં મનને સહેજ ચમકારો લાગશે કે શું શાસનના અંગો પર વળી અરુચિ ઉદ્દેગ થતા હશે ? પરંતુ આપણાં જીવનને તપાસવાની જરૂર છે. જીવનમાં જોઈશું તો દેખાશે કે કોઈ વાર સ્વાર્થ, અસહિષ્ણુતા, અહંત્વ, યા સ્વમાનરક્ષાની તમન્ના અથવા બીજા કોઈ દોષના લીધે ધર્મના અંગ ઉપર અરુચિ ઉદ્દેગ વગેરે સુધૂરી આવે છે.

દા.ત. પુત્રે ઉપવાસ કર્યો અને માતાએ એના પર કક્ષાટ કર્યો ત્યાં બાપને એ ઉપવાસ પર અરુચિ થવા સંભવ છે. પોતે કોઈ દાન કર્યું ને કુટુંબીએ એના પર કલેશ કર્યો તો પોતાને એ દાન પર અભાવ થવાનો પ્રસંગ બને. યા સાધર્મિકવાત્સલ્યનું જમાણ કર્યું ને ચાર જણે એના પર ટીકાટિપ્પણ કરી તો સાધર્મિકવાત્સલ્ય પર જેદ થવા સંભવ છે. અથવા છોકરો સામાયિકમાં બેઠો ને બાપને લાગ્યું કે હજુ એણે શાળાનું લેસન તૈયાર નથી કર્યું તો એને સામાયિક પર અરુચિ થવા સંભવ છે. સંઘમાં કોઈ ટીપ-ફાળો કરવામાં આવ્યો અને પોતાને એમાં રૂપિયા લખાવવાનું મન નથી પણ આગેવાન આગ્રહ કરે છે તો એ વખતે એ ટીપ ઉપર અભાવ થવા સંભવ છે. એમ તીર્થમાં મુનિમે જુદા જુદા ખાતામાં નોંધાવવા આગ્રહ કર્યો ને પોતાને મન નથી તો ય ધર્મ ખાતા પર અરુચિ થવા સંભવ છે.

આમ જો ધર્મના અંગ પર અરુચિ થાય છે, તો એ વખતે મૂળમાં ધર્મપ્રેમ જાગતો છે કે કેમ એ વિચારવું પડે. ખરેખર ધર્મપ્રેમ જળહળતો હોય તો ધર્મના અંગ પર અરુચિ ન થાય. અરુચિ-દ્રેષ્ટ કદાચ આહું બોલનાર-વર્તનાર વ્યક્તિ પર થવા જાય, પરંતુ ધર્મની વસ્તુ ઉપર તો પ્રેમ જ બન્યો રહે. માટે આ સાવધાની હંમેશા બની રહેવી જોઈએ કે જો ધર્મ ગમે છે તો કદી ધર્મની વસ્તુ પર અરુચિ ન થાય, એટલું જ નહિ પણ આનંદ-મલકાટ રહે.

મેતારજ મુનિના જીવે પૂર્વભવમાં સાધુપણે ‘ગુરુએ ચારિત્ર સારું આઘું, પણ પરાણે આઘું તે ખોટું’ આટલું જ વિચાર્યુ એમાં હુર્લભભોધિ થયા, ભવાંતરે ધર્મ જલ્દી ન મળે એવું પાપ બાંધ્યુ. કારણ ? અમુક સંયોગમાં પાપથી છોડાવવાની ખાસ દયાની દાસ્તિએ પરાણે ચારિત્રદાન એ ધર્મની જ એક વસ્તુ ગણાય, ધર્મનું અંગ કહેવાય. એના પર અરુચિ. એટલે ધર્મ પર અરુચિ એનું ફળ એવું જ આવીને ઊભું રહે.

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

આજે જ્યારે સાંસારિક વસ્તુઓ ઘણી વધી ગઈ છે અને એના પર પ્રેમ થાય છે, તો પછી ધર્મી જીવને આ અત્યંત જરૂરી છે કે ધાર્મિક વસ્તુઓ, ધર્મના અંગ, મૂર્તિ-મંદિર ઉપાશ્રય, જૈન આચારો, ધર્મની વિવિધ કિયાઓ, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા, વ્રતનિયમો, વિધિ વગેરે વગેરે પર ખૂબ પ્રેમ રહ્યા કરે; એથીજ ધર્મનો ખરેખરો પ્રેમ થયાનું સાબિત થાય, તેમજ ન થયો હોય તો જાગે, અને વધે. ધર્મપ્રેમ માપવાની પારાશીશી ધર્મના અંગોનો પ્રેમ. એ જેટલો વધુ એટલો ધર્મપ્રેમ વધુ. સારાંશ, ધર્મ ગમતો રાખવો છે ? તો ધર્મના અંગ ખૂબ ગમતા રાખો.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૬, તા. ૧૮-૬-૧૯૭૧

## ૧૪૧ પરમાત્મા અંગો જેનો અને અજેનોની માન્યતાનું ફળ

પરમાત્મા-ઈશ્વર-પરમેશ્વરને માનનારા અનેક ધર્મો છે; જૈનધર્મ પણ માને છે, અજૈન ધર્મો પણ માને છે. પરંતુ અજૈન ધર્મો પરમાત્માને સર્વશક્તિમાન સર્વસર્જક સર્વસંચાલક અને અનાદિ સિદ્ધ માને છે. એ કહે કે જેણે આવું મોટું વિશ્વ બનાવ્યું એમની શક્તિ અપરંપાર છે, અને એ જ સમસ્ત વિશ્વનું સંચાલન કરે છે, પૃથ્વી અન્ન પાણી હવા સૂર્ય ચંદ્ર પહણો જાડપાન ધાન્ય વગેરે સર્જને એમણે આપણા પર અનુપમ ઉપકાર કર્યો છે. વળી એમની ઈચ્છા વિના એક પાંદડુ પણ હાલતું નથી. એ કાંઈ પણ કરવાને થતું અટકાવવાને, અને સંહરવા-ફેરવાને સમર્થ છે. આવા પ્રભુના અચિત્ય ભહિમાને સમજ એમના ઉપકારને વારંવાર યાદ કરવો જોઈએ. એમનું શરણ સ્વીકારવું જોઈએ, આપણાં સમસ્ત કૃત્ય એમને સમર્પિત કરવાં જોઈએ. માનવું જોઈએ કે કશું કરવાનું આપણું શું ગજું ? એ તો જગન્નિયન્તા કરે છે માટે થાય છે. આપણાં કર્તૃતવનું અભિમાન ખોટું છે.’

આમ પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા અનુભવે છે. પરમાત્માની અચિત્ય શક્તિ જોઈ નમ્ર બની જાય છે, અને એમના સર્વ કર્તૃત્વ આગળ પોતાને કર્તાપણાનું અભિમાન થતું અટકાવે છે.

પરંતુ આ માન્યતામાં અનેક આપત્તિ છે, દા.ત. વિશ્વસર્જનની શક્તિ માની એના પર અહો કેવું વિશ્વ બનાવ્યું ?’ એમ મુખ થવામાં ગર્ભિત રીતે વિશ્વનું આકર્ષણ રહે છે. જો એનું આકર્ષણ ન હોય તો એ બનાવનાર ઉપર ઓવારી જવાનું શાનું થાય ? ઉકરડાનું આપણાને આકર્ષણ નથી તો એનો ગમે તેટલો ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૨૮૮

મોટો પણ ઠગ કરનાર પર ઓવારી જવાતું નથી. ઉધાન પર આકર્ષણ છે તો બહુ મોટા ઉધાનને ઊભું કરનાર પર મુખ થવાય છે. એમ પરમેશ્વર પર વિશ્વસર્જક તરીકે ઓવારી જવામાં વિશ્વ પર આકર્ષણ સાબિત થાય છે. ત્યારે જો જડ વિશ્વ ઉપર આકર્ષણ રહે તો એ રાગ જીવને વૈરાગ્ય ન જળહળવા દે, વીતરાગતા ન પામવા દે.

બીજું પરમાત્માને હવા પાણી અનાજ પ્રકાશ વગેરે આપનારા તરીકે ઉપકારી માનવામાં સ્વાર્થરસ પોષાય છે. ભગવાન કેમ સારાં ? તો કે અમને અનુકૂળ હવા પાણી પ્રકાશ વગેરે આપે છે માટે. આમ સ્વાર્થરસથી ભગવાનને માનવા જતાં ભય એ છે કે જ્યાં આપણો સ્વાર્થ ભંગાયો ત્યાં ભગવાન પર ઉદ્દેગ થશે ! દા.ત. ‘ભગવાનની મોટી મહેરબાની કે મને પુત્ર આપ્યો,’ એમ પ્રભુ પર બહુમાન કરવા જતાં જો નથી ને એ પુત્ર મરી ગયો તો ભગવાનને ઠપકો દેવાનું મન થશે કે ‘પ્રભુ ! આ તેં શુ કર્યું ? મારા આંખની કીકી લઈ લીધી ?’ એમ વરસાદ નહિ પડ્યો તો ય પ્રભુ પર ઈતરાજી થવાની. સારાંશ ભગવાન આપણાને દુન્યવી સુખ આપનાર છે માટે ઉપકારી છે, માન્ય છે, એમ કરવામાં નર્યો સ્વાર્થરસ પોષાય છે.

ત્યારે ભગવાનને સર્વશક્તિમાન માનવા જતાં જો એ બધું કરવા-સંહરવા-ફેરવા સમર્થ છે, તો મોટી આપત્તિ આ છે કે તો પછી પ્રભુ જીવોને પાપ કરતાં કેમ અટકાવતા નથી ? શું પ્રભુની શક્તિ નથી ? તો પછી સર્વ શક્તિમાન ક્યાં રહ્યાં ? એમ, ભગવાનને અનાદિસિદ્ધ માનવામાં કોઈ યુક્તિ નથી, કોઈ એમનું ચોક્કસ સ્વરૂપ નથી. વિશ્વની વસ્તુઓનાં સર્જનમાં જીવોનાં કર્મ પ્રધાનપણે કામ કરે છે એ તો માનવું જ પડે છે, પછી ભગવાનમાં કર્તૃત્વ શું ? કર્તા તો સ્વતંત્ર હોય, પોતાની ઈચ્છા મુજબ સર્જન કરી શકે. અહીં તો જીવનાં કર્મ વાંકા હોય અથવા ઊંઘ વેતરણ કરવા બેઠો હોય તો ઈશ્વરની સારી ઈચ્છા કાંઈ કામ નથી આવતી. પછી એ કર્તા શાના ? એમ જીવ પાપબુદ્ધિ અને પાપપુરુષાર્થથી હિંસાદિ કરવા તૈયાર થયો હોય તો ત્યાં ઈશ્વરની ભલી ઈચ્છા કામ નથી કરતી, પછી એ સ્વતંત્ર કર્તા શી રીતે ?

તાત્પર્ય, ઈતરધર્મો પરમાત્માને માને છે તે શક્તિ યા જડસ્વાર્થના પૂરક તરીકે અને અનાદિ, પરંતુ એમાં અનેક અસંગતતાઓ છે.

ત્યારે જૈનધર્મ પરમાત્માને (૧) બહિરાત્મ ને અંતરાત્મ ભાવમાંથી નીકળી પૂર્ણ અને શુદ્ધ જ્ઞાનમય યાને પરમ આત્મભાવ પામેલા, તથા (૨) જગતને વિશ્વતત્વનો તથા પરમાત્મભાવ પામવાના માર્ગનો પ્રકાશ આપનારા તરીકે માને છે.

૨૮૦

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

આમાં (૧) કોઈ એક અનાદિ-સિદ્ધ પરમાત્માની યુક્તિરહિત માન્યતા નથી. પરંતુ અનાદિ અનંત કાળમાં અનંત પરમાત્મા થઈ ગયા અને ભવિષ્યમાં થશે એવી યુક્તિસિદ્ધ માન્યતા છે. વળી (૨) એ જગતકર્તા નથી તેથી સર્જનમાં અજ્ઞાન સર્જન રાગ-દ્રેષ્ટ, બાળચેષ્ટા ‘પરમ’ યાને શુદ્ધ આત્મત્વની અને સ્વતંત્ર કર્તૃત્વની હાનિ, વગરે દોષો નથી. તેમજ (૩) જીવો ઈશ્વરને જડસ્વાર્થના ઉપકારક તરીકે માની સ્વાર્થ-ભંગમાં ઈશ્વર પ્રત્યે સંભવિત બેદ દ્રેષ્ટમાં પડે એ આપત્તિ પણ નથી.

જૈન મતાનુસાર પરમાત્મા વીતરાગ સર્વજ્ઞ બનવામાં આદર્શ જીવન જીવી ગયેલા છે તેથી એ સાધકને મહાન આલંબનભૂત બને છે. એવા જ પરમાત્માના જાપ-મરણ-ગુણગાન-પૂજા-ભક્તિ-દર્શન-વંદન વગેરેથી કલ્યાણ થાય છે. તેથી એમનો અચિત્ય અનંત પ્રભાવ છે, ઉપકાર છે. વળી એ સર્વજ્ઞ હોઈ વિશ્વના જીવ-અજ્ઞાત, પુષ્ય-પાપ, આશ્રવ-સંવર, બંધનિર્જરા-મોક્ષ એ નવ તત્ત્વોનો યથાર્થ પ્રકાશ આપી જીવને પોતાનું અને વિશ્વનું સાચું ભાન કરાવે છે, તેમજ જન્મ-મરણમય આ સંસારની વિટબણામાંથી છૂટી મોક્ષ પામવાનો સમ્યગદર્શન-જ્ઞાન-યારિતમય માર્ગ આપે છે, માટે પણ પરમાત્મા પરમ ઉપકારી છે.

તાત્પર્ય જૈનધર્મમાં પરમાત્માની ગુણપૂજા છે, જડસ્વાર્થપૂરક શક્તિની પૂજા નહિ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૭, તા. ૨૬-૬-૧૯૭૧

## ૧૪૨ તેમ શ્રાવક માબાપ છો ?

સંસારમાં માબાપ બનવું સહેલું છે, પરંતુ ધર્મ માબાપ શ્રાવક માબાપ બનવું અધ્યરું છે; કેમકે એમાં ‘માબાપ’ એટલે સંતાનના માત્ર જનમદાતા તરીકે નહિ તેમ માત્ર ખાનપાનાદિથી પાલક તરીકે નહિ, કિન્તુ એક ધર્મ શ્રાવક વાલી તરીકેનું મુખ્ય કર્તવ્ય બજાવવનાર બનવું પડે છે. તેમ અગર કોઈના માતાપિતા હો તો આ પ્રશ્ન છે કે તેમ એના શ્રાવક માબાપ છો ? અર્થાત એની પ્રત્યે ધર્મ શ્રાવક વાલી તરીકેનું મુખ્ય કર્તવ્ય બજાવતા રહો છો ? ‘મુખ્ય’ કર્તવ્ય એટલે બીજાં પાલન-પોષણના કર્તવ્ય તો બજાવતા રહેવાય, પરંતુ મુખ્ય લક્ષ એના પર નહિ, કિન્તુ ધર્મ શ્રાવક વાલી તરીકેનાં કર્તવ્ય પર.

જો આ મુખ્ય કર્તવ્ય બજાવાતું હોય તો એની સંતાન પર અદ્ભુત અસર

પડે છે, સંતાન ધાર્યા કરતાં વધુ સંસ્કારી ધર્મશ્રદ્ધાણું ધર્મત્વા બને છે. આનો એક તાજેતરમાં હ્યાત દાખલો જાણવા મળ્યો.

એક ત્રણ વર્ષનું બાળક એની માતા સાથે એક દિવસ મોસાળ ગયેલ. ત્યાં એના દાદા રાત્રે જમતા હતા તે જોઈ આ માત્ર ત્રણ વર્ષનું બાળક કહે ‘દાદા ! રાત્રે ખાય તે નારકીએ જાય. તમે કેમ રાત્રે ખાઓ છો ?’

બીજા એક પ્રસંગે ઘરે એની નાની બેનને તાવ આવવાથી રાત્રે એની માતાએ દવા આપવા માંડી ત્યારે તરત જ આ બાળક કહે ‘મમ્મી ! દાદા તો કહેતા હતા કે રાત્રે દવા પણ ન ખવાય, તો તું બેબીને રાતના દવા કેમ આપે છે ?’ માતા શરમાઈ ગઈ અને દવા આપવાનું મોકુફ રાખ્યું.

આ નાની બેન પણ એવી સંસ્કારવાળી છે કે રાત્રે લાઈટના લીધે જીવાતો આવે તો એ જોઈને તરતજ જીવરક્ષાર્થે લાઈટ બંધ કરાવે છે. જીવો પર દ્યાભાવ એવો કે દર રવિવારે બાળકો પારધીના પાંજરાઓમાંથી પૈસા આપીને ચકલી પોપટ કબૂતર છોડાવી ખુશીખુશી થઈ જાય છે. ધરમાં ક્યાંય વચ્ચમાં જીવાત ફરતી જુએ તો નવામાં નવો ચરવળો લાવી એનાથી સાચવીને પૂંજી જીવાતને બાજુએ મૂકી દે છે; તથા ફરનીયર પર વડિલ બેસવા જતા હોય અને આ બાળકો ત્યાં જો જીવાત દેખે યા રસ્તે ચાલતાં જીવ દેખે તો વડિલને બતાવી એને બચાવવામાં નિમિત્ત બને છે. એટલું જ નહિ પણ વડિલોનેય ઈર્યાસભિત્તિ યાને જોઈને ચાલવા બેસવાનો ઉપયોગ કરાવે છે,

બાળકના કોડ કેવા કે દ્યાનો પ્રસંગ આવે ત્યાં કહે છે કે ‘શાંતિદાદાએ પૂરવ જનમમાં જીવ બચાવેલ તેથી ભગવાન થયા તો હું પણ જીવને બચાવું છું તેથી ભગવાન થવાનો છું.’ પિતૃપક્ષ-મોસાળ પક્ષના દાદીમાઓને પાલીતાણામાં વર્ષાત્પનું પારણું થયું તેને વારંવાર યાદ કરી કહે છે કે ‘શ્રેયાંસુક્મારે આદિદાદાને પારણું કરાવ્યું તેમ હું પણ મારી બહેનને પારણું કરાવીશ.’

આ બાળક દોઢ વરસની ઉમરથી જ્યાં જ્યાં યાત્રાએ ગયો ત્યાં ત્યાંના મૂળનાયક ભગવાનનું આજે પણ સુંદર વર્ણન કરી શકે છે, દા.ત. કહે છે કે ‘આબુ પર આદિ દાદા, અચલગઢ પર સોનાના દાદા...’ વળી બોલે કે હું પણ આકાશને અડે એટલું ઊંચુ દેરાસર બંધાવી સોનાના ભગવાન પધરાવીશ, હીરાના ભગવાન પધરાવીશ !

રોજ દેરાસરે પૂજા કરવા જતી વખતે રસ્તામાં બેઠેલા બિખારીઓને પૈસા આપે છે ને કહે છે કે ‘સંભવદાદાએ પૂરવભવમાં ગરીબોને દાન કરેલું તેથી

ભગવાન બન્યા, તો હું પણ આ દાનથી ભગવાન બનવાનો જ છું, મોટો થયા પછી બધા ગરીબોને દાન કરવાનો.’

આ બાળકને કહેવામાં આવેલી ધર્મકથાઓ યાદ રહી જાય છે, ને પાછો પોતે તે કહી બતાવે છે, ને ખૂબી એ કે એના કહેવામાં દરેક વાર્તાના અંતે બધાને એ દીક્ષા અને મોક્ષમાં લઈ જાય છે. દીક્ષા અને મોક્ષ એના પ્રિય શબ્દ છે; દિવસમાં ૫-૬ વાર તો એના મૌંમા મોક્ષ શબ્દ હોય જ. ચિત્રમાં સિદ્ધશિલાનું નાનું સરખું ટપકું હોય તો શોધી કાઢવાનો, કહેવાનો ને ‘જુઓ આ મોક્ષ.’

બાળકની આ વાતો પર કેટલાકને એમ થાય કે ‘એ તો શીખવાદેલું બોલે, પરંતુ એક તો ખુશી થવા જેવું એ, કે અપશબ્દો યા નટ-નટીના નામ કે પિક્ચરની વાતોને બદલે આવા પવિત્ર શબ્દો અને પવિત્ર વાર્તા આ ઉંમરથી જુબે ચેદે છે ને ? તેમ, બીજું એ છે કે શબ્દો તો હજુય બોલતા આવે, પરંતુ કઠિન આચાર પાળવા મોટાને જે કઠિન પડે છે એ આ બાળક રાજુરાજુ થઈને પાળે છે. દા.ત.

એક વાર ધરમાં શરૂંજ્ય યાત્રાએ જવાની વાત ચાલી ત્યારે ૪ વર્ષનો આ બાળક દોડ સંકલ્પ પૂર્વક ઊંચેથી બોલ્યો ‘પણ્ણા ! આ વખતે હું બાઈ પાસે બિલકુલ તેડાવવાનો નથી;’ ને ખરેખર પાલીતાણે જઈ તેડાનારી બાઈ સાથે છતાં એ જરાય થાક વિના આખોય ગિરિરાજ પગે ચાલીને ચડી ગયો; ને ભાવપૂર્વક દાદાની પૂજા કરી.

બંને બાળકો ભાઈ-બેને જનમથી રાતે ભોજન કર્યા નથી, દૂધ પાણી સિવાય કાંઈ લીધું નથી, અને દોડ વર્ધની વયથી રાત્રિભોજન ત્યાગ, રાત્રે દૂધ પણ નથી લીધું. કોઈ રાત્રે મિઠાઈથી લલચાવે તો ય તે ખાવાની વાત નહિ, નાની બાળકી વળી સાંજના કદાચ લાઈટ કરી, તો જાતે ખાય નહિ ને વડિલને ય ખાવાની ના કહે. પછી એને ઘણું સમજાવે કે હજુ સૂર્ય છે, આથ્યો નથી, ત્યારે જ તે ખાય. આમ આચારપાલન પર મક્કમતા એ આ સંસ્કારિત બાળકો અંદરની સૂર્ય વિના ન દાખવી શકે.

કઠિન આચારનાં પાલન આ વયે સહેલા નથી. પરંતુ આમાં પૂર્વભવના સંસ્કાર ઉપરાંત આ ભવના માતાપિતાદિ વડિલોની સાંદું ઘડતર કરવાની ચીવટ કાળજી ખૂબ કામ કરે છે. આ દણાંતમાં ખૂબી એ છે કે બાળકના દાદા અને પિતા ડબલ ગ્રેજ્યુએટ છે, માતા ગ્રેજ્યુએટ છે છતાં ધર્મના ખૂબ શ્રદ્ધાળું, તથા આખું કુટુંબ જૈન આચારબદ્ધ જીવન જીવે છે. માતા હજુ પણ પાઠશાળે જઈ પાંચમા કર્મગ્રંથનું અધ્યયન કરે છે. ધરમાં બાળકને રાતના ધર્મગીતો તથા ધર્મકથાઓ સંભળાવવાની વડિલોને ટેવ છે. ધરમાં સંદર્ભ રાત્રિભોજન બંધ. તે સૂર્યાસ્ત પછી

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

૨૮૩

મે'માન માટે પણ ચૂલો સળગાવવાનો નહિ, રાત્રિભોજન નહિ, વાશી, કંદમૂળ વિદળ વગેરે અભક્ષ્યોનો સંદર્ભ ત્યાગ, પૂજા, સામાયિક, સ્વાધ્યાય આદિ ચાલે છે. ધરમાં જૈન ઈતિહાસના પ્રસંગોના ચિત્રો, પ્રતિમાઓ, ધર્મગીતો, ધર્મચર્ચા વગેરેથી વાતાવરણ પવિત્ર રહે છે. બાળકો પરહિતરકત અને ધર્મસંસ્કારી બન્યા રહે એની કાળજી લેવાય છે. સારાંશ, જૈન કુટુંબોમાં માતાપિતા વગેરે વડિલો જો શ્રાવક ધર્મના આચાર જીવતા બને, ને શ્રાવક વડિલ તરીકેના મુખ્ય કર્તવ્ય બજ્જાવનાર બને તો સંતાનો પર અદ્ભુત અસર પડે. તમે શ્રાવક મા બાપ છો, કે જૈનતર મા બાપ ? જો શ્રાવક મા બાપ છો તો ઉપરોક્તમાંનું તમારામાં કેટલું છે ? ને હવે કેટલું વધારશો ? એજ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૩૮, તા. ૧૦-૭-૧૯૭૧

### ૧૪૩ વાંકાનેરના આંગણે ‘ધ્યાન-શતક’ મહિશાસ્ત્રનું બહુમાન

જૈન દર્શનના ધ્યાન વિષયના અદ્ભુત ગ્રન્થરતન ‘ધ્યાનશતક’નું ગંભીર રહસ્યો ભરેલાં ગુજરાતી વિવેચનનું પ્રથમ પ્રકાશન

(નિવેદક :- જેદાલાલ અભેયંદ વોરા અધ્યાપક : વાંકાનેર)

પરમપૂર્જ્ય સિદ્ધાન્તમહોદ્ધિ કર્મશાસ્ત્રનિષ્ણાત સ્વ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરતન ન્યાયનિપુણ મહાતપસ્વી પૂ.પ. શ્રી ભાનુવિજ્યજી મહારાજશ્રીની તેજસ્વી કલમે આજ સુધીમાં સમર્થ શાસ્ત્રકાર આચાર્યપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.કૃત ‘લલિત વિસ્તરા’ ગ્રન્થ ઉપર ગુજરાતી વિવેચન ‘પરમતેજ’ ભાગ. ૧-૨, તથા હિન્દી વિવેચન, ‘પ્રકાશ’, શ્રી ‘પંચસૂત્ર’ની હારિભદ્રીયટીકા ઉપર ‘ઉચ્ચ પ્રકાશના પંથે’ અદ્ભુત વિવેચન ગ્રન્થો લખાઈ બહાર પડેલ છે. આ વર્ષે પૂર્વધરમહર્ષિ વિશેષાવશ્યક ભાાચાહિ-ગ્રન્થ રચયિતા પૂર્વધરમહર્ષિ શ્રી જિનભદ્રગણી ક્ષમાશમણ કૃત ‘ધ્યાનશતક’ ગ્રન્થની શ્રી હારિભદ્રીયટીકાના આધારે પૂ. પંચાસજી મહારાજની ચિંતનશીલ કલમે આ ગુજરાતી વિવેચન લખવામાં આવેલ છે, જેનું અતેના શ્રી સંઘે જ્ઞાનપૂજન દ્વારા બહુમાન કરી ગૌરવ વધાર્યું છે. બહુમાન-સભામાં આ પ્રમાણે પરિચય અપાયેલ,-

આ ગ્રન્થનો ઉદ્ઘાત :- “પૂ. પંચાસજી મ. શ્રીના શિષ્યરતો પૂ. તપસ્વી મુનિરાજ શ્રી મહિપ્રભવિજ્યજી મ. તથા વ્યાખ્યાતા ત્યાગી પૂ. મુનિરાજ શ્રી રાજેન્દ્રવિજ્યજી મ. શ્રી નું ૨૦૨૪નું ચાર્ટર્ડમાસ ગ્રાંગધા થતાં, તેઓશ્રીની પ્રેરણા ૨૮૪ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

પામી જૈન તપગય્યસંધ-તરફથી પૂ. સાધુ-સાધીજી ભગવંતોને જીવનમાં ઉપયોગી થાય તેવા સ્વાધ્યાયગ્રંથ માટે જ્ઞાનપાતામાંથી રકમ મંજૂર કરાઈ, અને બીજી બાજુ પૂ. ગુરુદેવશ્રીને ‘ધ્યાનશતક’ ગ્રંથ ઉપર વિવેચના લખવાની નમ્ર અરજ કરાઈ. પૂ. પંન્યાસજી મ. શ્રી એ કલકત્તામાં વર્ધમાન આંયબિલતપ ૧૦૦મી ઓળખીના તપમાં તથા અનેકવિધ શાસનહિતની પ્રવૃત્તિઓ વચ્ચે અમૂલ્ય સમયના ભોગે આ વિવેચના તૈયાર કરી ભબ્યજીવો ઉપર મહાન અનુગ્રહ કરેલ છે, ‘દિવ્યદર્શન’ સંસ્થા તરફથી આ ગ્રંથનું પ્રકાશન કાળજી પૂર્વક તૈયાર કરાવવામાં આવ્યું છે. આપણા સદ્ગુરૂએ પૂ. પ્રભર તપસ્વી મુનિરાજ શ્રી મણિપ્રભવિજયજી મ. શ્રી ની પાવન નિશામાં આ ગ્રંથના બહુમાનનો લાભ મળેલ છે. સાથે-સાથે આ ગ્રંથનું સ્વાધ્યાય-મનન કરી અશુભ-ધ્યાનથી આત્માને બચાવી લઈ શુભધ્યાનમાં લીનતા વધે તેવો સતત પ્રયત્ન સૌચે કરવાની અનુકૂળતા થઈ છે.

ધાસના ઢગલા ઉપર તડકો જ્યારે પડે છે, ત્યારે ધાસ ગરમ થાય છે પણ બળતું નથી; પરન્તુ સૂર્યના કિરણો ઉપર મેનિન્ફાઈંગ જ્લાસ ધરવામાં આવતાં કિરણોનું એકીકરણ થઈ અભિ પ્રદીપ થાય છે, અને એ ધાસના ગંજને બાળી ભસ્માભૂત કરી નાખે છે. તેવી જ રીતે ચિત્તને સ્થિર અને વિશુદ્ધ કરતાં કરતાં શુક્લ ધ્યાનનાં મેનિન્ફાઈંગ જ્લાસમાં મનનું એક વસ્તુપદાર્થમાં એકીકરણ થતાં ધ્યાનાન્નિ વડે અશુદ્ધ આત્માનો કર્મભળ બળીને નિર્જરીને ક્ષય પામી જાય છે, અને આત્મા વીતરાગ-સર્વજ્ઞ બને છે. આ છે શુભ ધ્યાનની કેળવણીનું ફળ; જ્યારે, ચક્કવર્તી જેવાં સંક્ષીપ્તચેન્દ્રિય જીવો એ મનને રોક્ર પરિણામે હિંસાદિના ભાવમાં સ્થિર કરતાં, એમ તંદુલમત્સ્યાદિ જેવા જીવો જ મી નરકે ચાલ્યા જાય છે. આર્તધ્યાને તિર્યંગતિના પાપ મળે છે.

મોક્ષનું અતિનિકટ અસાધારણ કારણ શુક્લ ધ્યાન છે, અને તે ધર્મધ્યાનના ખૂબ જ અભ્યાસથી સાધ્ય છે, શુભધર્મધ્યાનના અભ્યાસ માટે અને પારાવાર નુકશાનકારી અશુભ આર્ત-રૌદ્રધ્યાનથી બચવા માટે આ ગ્રંથનું અધ્યયન અમલીકરણ સાથે કરવા જેવું છે. આત્મા ધારે તો આ બાજુ મનને વાળી સ્થિર-શુદ્ધ કરી શકે છે. ધ્યેય શુદ્ધિ સાથે ધ્યાતાએ ધર્મધ્યાનમાં એકરસ-એકાકાર થતાં થતાં શુક્લધ્યાનમાં પ્રવેશ કરવાનો હોય છે. આ ધ્યાનના પ્રભાવે આત્માની અનંતી ઋદ્ધિ પ્રગટતા વાર લાગતી નથી.

૧૦૫ ગાથાના ‘ધ્યાન શતક’ શાસ્ત્રમાં મનની અવસ્થાઓ, ધ્યાનનું સ્વરૂપ અને પ્રકારો, શુભ-અશુભ ધ્યાનના લક્ષણ, લિંગ, લેશ્યા, ફળ, અશુભ ધ્યાનની ભયંકરતા, શુભધ્યાનની ભૂમિકા સર્જવાની ઉપાયભૂત સાધનાઓ, શુભધ્યાનને યોગ્ય ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૪)

દેશ-કાળ-મુદ્રાદિ તથાં ધ્યેયવિષયો-અધિકારી,...ઈત્યાદિ ભરચુક પદાર્થોનો સમાવેશ છે, જે ગ્રંથની પ્રસ્તાવના વાંચવાથી જ્યાલમાં આવશે. આજ ગ્રંથના આધારે મેટ્રીક-કોલેજના વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષાપતનમાં વાચનારૂપે અપાયેલ પ્રવચનોને ‘ધ્યાન અને જીવન’ નામના પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. બન્ને ગ્રંથો મનનીય છે. કિંમત રૂ. ૩) છે.

પ્રાપ્તિસ્થાન : - દિવ્યદર્શન કાર્યાલય, ૮૬૮ કાળુશીની પોળ, કાલુપુર, અમદાવાદ -૧

પૂજ્ય સાધુ-સાધીજીના મ. શ્રીને ખાસ સ્વાધ્યાયાર્થે ધ્યાનશતક ગ્રંથ શ્રી પ્રાંગધા જૈન તપગય્ય સંધ તરફથી ભેટ મોકલાશે.”

(‘ધ્યાન-શતક’ શાસ્ત્ર વિવેચન ગ્રંથની પ્રકાશન-પ્રેરણા માટે શ્રી પ્રાંગધા સંધનો અને અનુમોદના બહુમાન સમારોહ માટે શ્રી વાંકાનેર સંધનો અમે આભાર માનીએ છીએ. શ્રી ચતુર્વિધ સંધને નિત્ય જીવનમાં અત્યન્ત ઉપયોગી ધ્યાન-વિજ્ઞાન સમજવા અને સક્રિય કરવા આ શાસ્ત્ર સમર્થ છે, ને અનન્ય છે, એથી દરેક ભાવ્યાત્મા અનું સૂક્ષ્મ અને સંગીન અધ્યયન કરશે એવી અમે આશા રાખીએ છીએ. તંત્રી)

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૪૦, તા. ૧૭-૭-૧૯૭૧

૧૪૪

## પાપના સંતાપ છતાં પાપ કેમ અટકતા નથી ?

(લેખાંક-૧)

ધર્મશ્રદ્ધાવાળા જીવને પોતાના જીવનમાં ઊઠી આવતી કામવાસનાઓ કે કોધાદિકષાયો અથવા આચરાઈ જતા દુષ્કૃત્યો જેવાં કે અસત્ય-અનીતિ-દૃપરસાદિ ગૃદ્ધિ અને જીવધાતક આરંભસમારંભાદિ માટે સંતાપ-બળાપો-જ્લાનિ થયા કરે છે. એ ઝંખે છે કે આ પાપો કેમ અટકે; પરંતુ પ્રસંગે કે નિમિત્ત મળ્યે જીવ આ પાપોમાં તણાઈ જાય છે, ને પછી એ લાચારી-ખેદ-સંતાપ અનુભવે છે. જીવનમાં આવું ઘણી વાર અનુભવવા છતાં એથી બચવા માટે જાણે નિરૂપાયતા લાગે છે, ને સાથે પરલોકનો ભય રહ્યા કરે છે.

અલબત્ત જેને ધર્મશ્રદ્ધા નથી એને આવો કશો સંતાપ-ખેદ-લાચારી કે પરલોકભય ઊઠો નથી. એ તો એમજ સમજે છે કે “આ ભવ મીઠા, પરલોક કોણે દીઠા ? સુખ મળ્યું છે તો કાં ન ભોગવી લઈએ ? વાસના તો કુદરતી લાગણી

છે. કોધ વગેરે તો અવસરે કરવા જ પડે...આજના યુગમાં જૂઠ અનીતિ વગેરે વિના ચાલે જ કેમ ? મોટા કારખાના વગેરેના આરંભ-સમારંભથી તો લોકમાં ઉદ્ઘોગપતિ શેઠ તરીકેની નામના મળે છે..." આવા નાસ્તિકતાના હિસાબવાળાને એ પાપોના ખેદ શાના ? ને 'પરલોકમાં મારું શું થશે ?' એવા ભય પણ શાના ?

ત્યારે ધર્મની શ્રદ્ધાનું અહીં માપ નીકળે છે કે દિલમાં કામવાસનાઓ-કષાયો-હુક્ક્યો વગેરેના ભારે સંતાપ રહ્યા કરે છે ? જો હા, તો ધર્મની શ્રદ્ધા સાચી; ને તે ય જેટલો ભારે સંતાપ એટલી પ્રબળ ધર્મશ્રદ્ધા. બાકી જો એવા સંતાપ કાંઈ થતા જ નથી, તો દાનાદિ ધર્મ કરવા છતાં ધર્મની શ્રદ્ધાના વાંધા. તો પછી પ્રશ્ન થાય કે દાનાદિ ધર્મ કેમ કરે છે ? ઉત્તરમાં, એ કારણ લોકવાહવાહની ભૂખ વગેરે લૌકિક કામના હોય છે.

ધર્મશ્રદ્ધાનો અર્થ આ, કે ધર્મ ગમે. ધર્મ એટલા માટે ગમે કે પાપ નથી ગમતા; કારણ કે પાપથી જનમ-મરણની વિટંબણા લાંબી થાય છે. હવે જો પાપ નથી ગમતા, તો સહજ છે કે થઈ જતાં પાપો માટે ખેદ-સંતાપ લાયારી થયા જ કરે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધર્મનું આ રહસ્ય છે. તેથી સાચી ધર્મશ્રદ્ધા ઊભી કરવી હોય તો પાપોનો સંતાપ થવો જોઈએ; અને ધર્મશ્રદ્ધા ધર્મપ્રીતિ માટે પાપોનો સંતાપ રહ્યા જ કરવો જોઈએ.

હવે સવાલ આ છે કે ધર્મશ્રદ્ધાવાળાને પાપોનો સંતાપ છતાં પાપાચરણ કેમ અટકું નથી ? દા.ત. સંસારસુખ માણ્યે વરસો થયા. છતાં પત્તી જો હાજર છે તો બ્રહ્મચર્ય પાળવું કેમ કઠિન પડે છે ? કેમ વાસનાનું પાપ પોષાયા કરે છે ? તે ય એ પોષા પછી ભારે સંતાપ થવા છતાંય ફરીથી પાછું એ પાપમાં કેમ તણાઈ જવાય છે ? એમ, ખરાબ આદતમાં પડેલાની ય સંતાપ છતાં એવી હુદ્દશા કેમ ? એમ કોધ કરી કરીને બળાપો થયા છતાં પાછો નિમિત્ત મળતાં કોધનો ઉછાળો કેમ ? એવી રીતે અસત્ય-અનીતિ-માયા, રસગૂદ્ધિ, વધુ પડતો આરંભ-સમારંભ વગેરે કોઈ પાપોના સંતાપ છતાં આચરણ કેમ ચાલુ ?

ખૂબી તો એ, કે ધર્મશ્રદ્ધાનું હોવાથી સાધુસમાગમ સેવે છે, એમના વ્યાખ્યાન સાંભળે છે, ધર્મનાં પુસ્તકો પણ વાંચે છે, બની શકતી ધર્મસાધના ય કરે છે, છતાં પાપો ન અટકે એનું કારણ શું ? અહીં કારણ તરીકે 'મારે એવા પાપકર્મનો ઉદ્ય' એમ માની લેવા માત્રથી ઉદ્ધાર શી રીતે થવાનો ? ત્યારે પાપનાં નિમિત્તોથી આધા રહેવાય તો પાપથી બચાય; પરંતુ કેટલાંક નિમિત્ત દા.ત. વાસનાનું નિમિત્ત પત્તી વગેરેથી તો દૂર રહી શકાય એમ ન હોય, પછી શું પાપ અટકવાનાં જ નહિ ?

પાપ ન અટકવાનાં બે કારણનો અહીં વિચાર કરવો છે, એ પરથી પાપ અટકવવાના ઉપાયનો વિચાર પણ સરળ બનશે. એ વિચાર હવે પછીના લેખમાં.

"દિવ્ય-દર્શન"-“અગ્રલેખમૂત”

વર્ષ-૧૮, અંક-૪૧, તા. ૨૪-૭-૧૯૭૧

(૧૪૫) (લેખાંક-૨)

કેટલાકને દેવદર્શનાદિ ધર્મસાધના ચાલુ છતાં પાપ ન અટકવાનું કારણ, અને વ્યાખ્યાન-શ્રવણ નથી, એ છે. પરંતુ જેને આ છે છતાં ય પાપ નથી અટકતા એનું કારણ, (૧) બહુ બાધ્ય પ્રવૃત્તિ ને બાધ્ય ભાવનું જોર છે, તથા (૨) જીવનમાં અનુભૂત શુભ ભાવો અને સુકૃતોની અનુમોદનાનું સતત વહેણ નથી, એ છે.

ગૃહસ્થને અમુક સમય નોકરી-ધ્યાનમાં ધ્યાન આપવું પડે કે ભાડેલા સાધુને વ્યાખ્યાન યા જિજ્ઞાસુને તત્ત્વ-સમજ આપવી તે તેમજ બંનેને ખાનપાનાદિ અને આચાર-પ્રવૃત્તિ અનિવાર્ય છે, પરંતુ બાકીના સમયમાં સ્વાત્મસાધનાને બદલે બીજી ગ્રીજા પ્રવૃત્તિ કરે એમાં પ્રાય: બાધ્યભાવ પોષાય છે. પરોપકારની પ્રવૃત્તિ પણ શુદ્ધ સ્વાત્મહિતસાધનાની દિષ્ટિ જીવંત રાખીને હોય તો તે હજુ બાધ્યભાવથી બચે, નહિતર એ ય બાધ્ય ભાવને પોષનારી બને.

બાધ્યભાવનો અર્થ આ કે જ્યાં પોતાના આત્માનું આત્મદોષોનું કે આત્મહિતનું સાવ વિસ્મરણ હોય.

એવા પરોપકારની પ્રવૃત્તિ લઈ બેઠેલા કેટલાંયમાં આ દેખાય છે કે એમને પોતાના આત્મામાં અનેકાનેક અહંક-ઈશ્વર-વાસના, વૈર-વિરોધ-દીનતા, અ-વાત્સલ્ય, એષણાઓ વગેરે દોષો ખદબદતા હોય પણ એ તરફ જોવાની હુરસદ નથી, સુધારવાના ધરખમ પ્રયત્ન નથી. પછી એ પરોપકારની સારી પણ દેખાતી પ્રવૃત્તિ એમના પોતાના માટે બાધ્યભાવ નથી તો બીજું શું છે ?

બાકી મોજશોખ, વાતોચીતો, નિંદા, કુથલી, બિનજરૂરી હરવા-ફરવાનું, કે આરામી, સુખશીલતા કે ઈન્ડ્રિયોની ગમતા-વિષયોમાં દોષામ અને આજાગમતાથી ભાગાભાગ, યા હું પદ-માયા-તૃષ્ણા-વગેરેની વિચારણા-વિકલ્પો-વર્તાવ, એ બધું તો નગદ બાધ્યભાવ છે જ, આત્માથી બહારમાં ભટકવાનું છે જ; સ્વાત્માના હિત-અહિતનો આમાં કોઈ વિચારસરખો રહેતો નથી. પરંતુ માનેલા પરોપકારમાં ય આવું બને એ બાધ્યભાવ છે.

આમ બાધ્યભાવની પ્રવૃત્તિમાં બહુ રહેનાર જીવ ભલે બીજી બાજુ ધર્મશ્રદ્ધાવાળો હોય, ને ધર્મ-સાધના પણ કરતો હોય, છતાં પૂર્વે કહેલ તે મુજબ પાપના સંતાપ

ઇતાં પાપથી બચી શકતો નથી, પાપમ્રવૃત્તિને અટકાવી શકતો નથી. કોઈને કામની વાસના, કોઈને રસની લાલસા, કોઈને પૈસાટકા કે માનમર્તબાની એપણા, તો બીજાને વળી કોથ યા મદ, પાપાચરણમાં ઘસડે છે. આમ સાધુસમાગમ સેવે, વ્યાખ્યાન સાંભળે યા જાતે કરે એટલે એ પાપમ્રવૃત્તિનો સંતાપ પણ થાય, ફરીથી એ ન કરવાની ધારણા પણ કરે, પરંતુ નિમિત્ત કે પ્રસંગ મળતાં પાછો પાપાચરણમાં પડે છે. આનું એક કારણ આ બાધ્યભાવની બહુ પ્રવૃત્તિ છે.

સવાલ થાય કે બાધ્યભાવની બહુ પ્રવૃત્તિ સ્વાત્માનું ને સ્વાત્મદોષોનું વિસ્મરણ રખાવે છે, તેથી સ્વાત્મચિંતાના, સ્વદોષ નિરીક્ષણાના, ને સ્વદોષનિવારણાની ઝંખના-તમન્નાના સંસ્કાર નખાતા નથી, તેથી એવું આત્મબળ ઊભું થતું નથી. સંસ્કાર બાધના, બાધ ચિંતાના અને અભિમાનાદિ કષાયબળના નખાયે જાય છે, પછી સ્વાભાવિક એ છે કે પેલા સ્વાત્મચિંતાદિના અને આત્મબળનાં સંસ્કારજીથના અભાવે અવસરે પાપમ્રવૃત્તિથી બચી શકે નહિ, એને અટકાવી શકે નહિ. પાપથી બચાવનાર એ સુસંસ્કાર જીથ છે, એથી ઊભું થયેલ આત્મબળ છે.

વ્યાખ્યાન સાંભળનાર ધણાનું આ રોદણું સાંભળવા મળે છે કે ‘સાંભળીએ છીએ ત્યારે તો ખરેખર દિલને લાગી જાય છે, પણ પછીથી પાછો કેમ કામ કે કોથ કે લોભ વગેરે ચડી બેસે છે? કેમ આત્મા નિર્બળ રહી પાપ અટકતા નથી? પરંતુ ત્યાં જો એ જોશે તો ટેખાશે કે બાધની બહુ પ્રવૃત્તિ આ નખાઈ ઊભી રાખે છે. પૂર્વ કથ્યા તેવા સુસંસ્કારોનો જીથના અભાવે આત્મબળ જ ઊભું થતું નથી, પછી પ્રસંગ પર દુશ્મનથી શી રીતે બચી શકે?

સ્વાત્મચિંતાના સંસ્કાર, સ્વાત્મનિરીક્ષણ અને સ્વદોષનિરીક્ષણાની ટેવના સંસ્કાર, તથા પરમાત્મા અને મહાન આત્માઓના જીવન-પરાક્રમોની તુલનામાં પોતે ક્યાં ઊભો છે એ વારંવાર જોવાની આદતના સંસ્કાર ખૂબ એકત્રિત કરવામાં આવે તો એવું આત્મબળ ઊભું થાય કે જે એને પ્રસંગે પાપો, વાસના અને કષાય વગેરેથી બચાવી શકે, વગેરેને અટકાવવા સામર્થ્ય આપે, પરંતુ બાધ્યભાવની બહુ પ્રવૃત્તિમાં પડેલાને આ સારું સંસ્કારજીથ ક્યાંથી ઊભું થાય?

ત્યારે, ધર્મશ્રદ્ધાળું અને પાપસંતાપવાળાને એ વાસના-કષાય તેમજ અસત્યાદિ પાપ પ્રવૃત્તિ અટકાવવા માટે આ એક ઉપાય થયો કે એણો જીવનમાંથી બાધ્યભાવની બહુ પ્રવૃત્તિ ઓછી કરી નાખી ઉપરોક્ત સંસ્કારજીથ ઊભું કરવું જોઈએ. હવે બીજી ઉપાયનો વિચાર.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૪૨, તા. ૩૧-૭-૧૯૭૧

(૧૪૬) (લેખાંક-૩)

ધર્મશ્રદ્ધા અને પાપસંતાપ ઇતાં ફરી ફરી પાપ થઈ જાય છે એનું એક કારણ બાધ્યભાવની બહુ પ્રવૃત્તિ હોવાનું જોયું. બીજું કારણ આ છે કે જીવનમાં સુકૃતોની જોરદાર અનુમોદનાના તથા અનૂભૂત શુભભાવના સંસ્મરણનાં સતત વહેણ નથી. તેથી પણ ઉપયોગી સંસ્કારબળ અને આત્મબળ ઊભું થતું નથી એટલે એ નિર્બળતામાં પાપનો સામનો કરી એને ઊભું થતું અટકાવી શકતું નથી.

લગભગ દરેક ધર્મશ્રદ્ધાળુને અનુભવ હશે કે પોતાની કોઈ ધર્મસાધના વખતે યા બીજાની ધર્મસાધના જોઈને અથવા ધાર્મિક વાંચન કે શ્રવણ વખતે સુંદર ભાવ જાગ્યા હોય છે. એમ મહાવીરગ્રભુના યા બીજા તીર્થકર ભગવાનના તથા પૂર્વના મહાપુરુષોનાં પરાક્રમોના પ્રસંગો સાંભળીને કે વાંચીને દિલમાં અદ્ભુત શુભભાવ જાગ્યા હોય છે.

પરંતુ પછીથી એ સ્વસુકૃતો તેમજ પરસુકૃતોની વારંવાર અનુમોદનાનાં અને એ શુભભાવનાં સ્મરણનાં વહેણ ચાલુ નથી હોતા તેથી પણ પાપ અટકાવવાનું આત્મબળ ઊભું થતું નથી. ઊભંડું એ અનુમોદન સંસ્મરણના વહેણ નહિ, એટલે વિષયસુખાનુભવ, તેમજ ધન-માલ, સારી સ્ત્રી સારા પુત્રપુત્રી-પરિવાર, અનુકૂળ મકાન-દુકાન-વેપાર-નોકરી તેમજ માન-સન્માન-પ્રતિજ્ઞા તથા લગનાદિ પ્રસંગ વગેરેની અનુમોદનાનાં વહેણ ચાલુ રહે છે. મનને વારંવાર એ બધું સારું પાખ્યાનો આનંદ રહે છે. ત્યાં પાપો અટકાવવાનું આત્મબળ ક્યાંથી ઊભું થાય?

દા.ત. સિદ્ધગિરિ શિખરજી વગેરે તીર્થ ફરસવા મલ્યા, ત્યાં પ્રભુનાં દર્શને અપૂર્વ આહ્વાદ અનુભવ્યો, પ્રભુપૂજા-ભક્તિમાં અપૂર્વ આનંદ આવ્યો પરંતુ પછી એ સુકૃતની તથા એ શુભભાવની વારંવાર અનુમોદના સંસ્મરણ ક્યાં છે? કદાચ ત્યાં જ પાછો ઊતરતાં બીજા તીજા વિચાર, વાતો અને આનંદમાં એનું વિસ્મરણ હોય છે! તો પછી ધરભેગા થયે જંજાળમાં ગુંથાયે એના વારંવાર સ્મરણ-અનુમોદન શાનાં? ત્યારે જો એ વીતરાગ પ્રભુના શાંત સુધારસર્વા મુખ-નયની વારંવાર અનુમોદના નહિ, એ જોયાના ભાવોલ્લાસના આનંદ-અનુમોદનાં વહેણ ચાલુ નહિ, તો સહેજ છે કે વહાલી અનુકૂળ પત્તીનાં મુખ-શરીર-અંગો જોઈ આનંદ રહેવાનો, પછી એ કામવાસનાનાં પાપથી શે બચે?

એમ, જો એ પ્રભુપૂજા-ભક્તિની ને એ વખતના ભાવની સતત અનુમોદના નહિ, તો સારી નોકરી કે વેપાર અને બીજી સંસારપ્રવૃત્તિના આનંદમા જીવ માચ્યો રહેવાનો; તેથી એક યા બીજી પાપપ્રવૃત્તિથી શી રીતે બચે ?

એમ, પ્રભુ યા અન્ય મહાપુરુષોનાં પરાકરમની સતત અનુમોદના જો નહિ તો મન રોફ-રોષ-લોભ વગેરેથી આવતી ફાવટના આનંદ અનુભવશો ત્યાં પછી અવસરે એવા કોધાદિ કષાયના પાપને શી રીતે અટકાવી શકે ? એમ કોઈ સામાયિક પોષધ યા બીજી ધર્મપ્રવૃત્તિનો આનંદ અનુભવ્યા છતાં પછીથી એની અનુમોદના ચાલુ નહિ, તો આરંભ-સમારંભ, જીઠ અનીતિ વગેરેના આનંદમાં જીવ દૂધ્યો રહેવાનો. પછી એવા પ્રસંગે એ પાપને શે અટકાવી શકે ?

એવી રીતે ક્યારેક કરેલ તપનો આનંદ અનુભવ્યા છતાં પછી એની અનુમોદના વારંવાર નહિ, તો ખાનપાનાદિના આનંદમાં રાચ્યો રહેવાનો. પછી અવસરે એ એના પાપને શું અટકાવી શકે ?

સુકૃતની સાચી અનુમોદનાનો આનંદ આ છે કે એ સુકૃતની સામેના દુષ્કૃત તરફ અભાવ થાય, બેદ થાય. જો જીવ બચાવ્યાનો વારંવાર આનંદ છે તો જીવ મરે ત્યાં જિન્નતા થાય. વીતરાગના દર્શને હરખ થાય છે તો મોહમૂઢના દર્શન પર દિલ ન લાગે. તપની વારંવાર સાચી અનુમોદના હોય તો ખાનપાન પ્રત્યે ઉધરંગ-ઉમળકા ન હોય. મૈત્રી કરુણા-ગુણાનુરાગ, સત્ય-સંયમ-સમતા, સામાયિક-પોષધ-પ્રતિકમણ વગેરેની જો સતત સાચી અનુમોદના હોય તો વેર-વિરોધ-નિર્દ્યતા-ધીર્ઘ અસત્ય-અસંયમ-મમતા, સંસાર-વ્યાપાર-અવિરતિ, વાતો-કુથલી-વિલાસ વગેરે પ્રત્યે સહેજે અભાવ થાય જ, થવો જ જોઈએ.

એટલે જીવનમાં કરેલ સુકૃતો માટે વારંવાર અનુમોદન થાય, આનંદ ઊભરાય, દા.ત. કે “અહો ! તે દિવસે પ્રભુદર્શન-પૂજનમાં કેવા સુંદર ભાવ જગેલા ! પ્રભુ કેવા મજ્યા ! પેલા તપમાં ખાવાની વેઠ ટયાનો કેટલો બધો આનંદ આવેલો ! વ્યાખ્યાનમાં અમુક સાંભળવા મળેલું ત્યારે એનો કેટલો બધો હરખ જગેલ ?....” આવા આનંદ એ વખતના ભાવ યાદ કરી જો વારંવાર થયા કરે, તો એના સુસંસ્કાર વધતા જાય. એનું બળ વધતાં સામે દુષ્કૃતો-પાપો પ્રત્યે અભાવ-દુર્ભિવના સંસ્કાર પણ વધવાના. એથી એવું આત્મબળ ઊભું થાય કે પછી પ્રસંગ આવતાં પણ દુષ્કૃતના સેવનથી બચી શકે, દુષ્કૃતને અટકાવી શકે.

તાત્પર્ય આ છે કે જીવનમાં વારંવાર સુકૃતો અને શુભભાવો તથા સદ્ગુણિયારોનાં

અનુમોદન-સંસ્કરણ ચાલુ રહેવા જોઈએ; કોઈ સારાં દાન, તીર્થયાત્રા, પરમાત્મભક્તિ, પ્રવચનશ્રવણ, પરોપકાર, તપસ્યા, સુંદર ભાવના, પ્રતનિયમ વગેરે વખતે દિલમાં થયેલ અદ્ભુત ભાવ અને આનંદ વારંવાર યાદ કરી કરીને મનને એમ થયા કરે કે (૧) અહો ! અમુક પ્રસંગે કેવા કેવા સુંદર ભાવ જગેલા ! (૨) પ્રભુ શ્રી મહાવીર ભગવાનના જીવનના અમુક અમુક પ્રસંગ તેમજ બીજા મહાપુરુષોનાં પરાકરમ સાંભળતા હૈયે કેવા કેવા ભાવ ઊછળેલા ? એ વારંવાર યાદ કરવામાં આવે. એ સ્વ-પરના સુકૃતો તથા એ આચર્યા-સાંભળ્યા વખતના ભાવના સંસ્કરણ ચાલ્યા જ કરે. એથી પાપપ્રસંગોનાં આકર્ષણ પ્રલોભન ધંજાં મોળા પરી જાય. પછી પ્રસંગે પાપને ઊઠું અટકાવવાનું સરળ બને. જીવનમાંથી વાસનાના કષાયોના તથા આરંભ-જીઠ-આદિના પાપ ઓછા કરવા આ બીજો અદ્ભુત ઊપાય છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખમૂત”

૧૯૭, અંક-૪૩, તા. ૭-૧૯૭૧

## ૧૪૭ વીતરાગ પ્રભુની મૂર્તિમાં બે પ્રકારની નયનમુદ્રા અને એમાંથી બે પ્રેરણા

(લેખાંક-૧)

ક્ષત્રિયકુંડ નગર કે જ્યાં પરમાત્મા શ્રી મહાવીરસ્વામી ભગવાનનો જન્મ થયેલો તે નગર હાલ બિહાર પ્રાંતમાં લઘવાડ નજીકમાં લાગે છે. પરંતુ નામ પલટાઈ ગયું છે; કિન્તુ એની પાસે ક્ષત્રિયકુંડ પછાડ ઉપર ૨૦૦૦ વર્ષ જુની શ્રી મહાવીરભગવાનની ભવ્ય શ્યામમૂર્તિ છે. મુખની મુદ્રા અલૌકિક છે, અને ખાસ કરીને નયન અનેરી કોટિના છે; બ્રમર સહેજ ઊંચા અને ચક્ષુ ખુલ્લી અને નીચી છે. આવી બીજી પણ પ્રાચીન મૂર્તિઓ ગુજારોમાં તથા પટણા મ્યુઝીયમ વગેરેમાં જોવા મળે છે.

આ નમણાં નયનનાં ધ્યાનપૂર્વક દર્શન કરતા એમ ભાસે છે કે પ્રભુ વીતરાગ સર્વજ્ઞ અને મોક્ષનિકટ બન્યા એટલે આત્મસ્વરૂપ બન્યા; અથવા મોક્ષ જીવના અવસરે છેલ્યું શૈલેશીકરણ કરી કાયાદિયોગથી તદ્દન રહિત થયા ત્યારે જેમ કાયા પર્યકાસને સ્થિર થઈ, તેમ ચક્ષુ-અવયવ સહેજ નીચે ઢળેલા બન્યા, અને આત્મ-

પ્રદેશો સહજ સ્વભાવમાં સ્થિર થઈ ગયા. શુક્લધ્યાનના છેલ્લા બે પ્રકારનું આ જ કાર્ય હોય છે કે મન-વચન-કાયાને સ્થિર નિષ્ઠિક કરી દેવા. એ હિસાબે જ ચક્ષુની નમણી અવસ્થા. બાકી ત્યાં દિશિ નીચી રાખીને કોઈ એકાગ્ર - ચિંતનરૂપ ધ્યાન કરવાનું નથી હોતુ; કેમકે જેમને કેવળજ્ઞાનથી સમસ્ત કાળના સર્વપદાર્થ-પયાર્થ-સાક્ષાત્ દેખાય છે, એમને કશું અણજ્ઞાણ ચિંતવવાનું રહેતું જ નથી. ધરની અંદર બેઠા સૂર્ય દેખાતો ન હોય ત્યાં ચિંતન હોય કે ‘સૂર્ય આવા પ્રકાશવાળો;’ પરંતુ ધરની બહાર મેદાનમાં જ્યાં સૂર્ય ચક્ષુ સામે હોય ત્યાં એનું ચિંતન શું ? એ તો અગમગ દેખાઈ જ રહ્યો છે, એમ સર્વજ્ઞને ચિંતન-ધ્યાન હોય નહિ.

એટલા જ માટે જે બુદ્ધની મૂર્તિની જેમ અરિહંતની મૂર્તિમાં ધ્યાનસ્થ ચક્ષુ પસંદ કરે છે, એમણે સમજજું જોઈએ કે એકાગ્રચિંતનરૂપ ધ્યાન-અવસ્થા એ તો અપૂર્ણ અવસ્થા છે, અસર્વજ્ઞ-અવસ્થા છે. જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન પ્રગટ ન થયું હોય ત્યાં સુધી ચિંતનરૂપ ધ્યાન કરવાનું હોય; પણ બધું જ પ્રત્યક્ષ થઈ ગયા પછી એ હોય નહિ.

આમ છીતાં ક્ષત્રિયકુંડ પહાડ પરની મૂર્તિ જેવી પ્રાચીન મૂર્તિઓમાં ચક્ષુનો સહેજ નીચો ઢાળ જે દેખાય છે એ ચિંતનરૂપ ધ્યાનના ધરનો નહિ, કિન્તુ આત્મા-સ્વ-સ્વરૂપમાં સ્થિર કરવાનાં હિસાબે જેમ બીજાં અવયવોને સહજરૂપમાં છોડી દીધાં એમ ચક્ષુ અવયવને પણ સહજરૂપમાં નીચો મુકી દીધો.

આવા બિંબ-નયનનાં દર્શનથી આપણાને આત્મસ્વરૂપમાં ઠરવાની અને મનને બાધ્ય જંજાળ કે કાયા પરની આપણિ-આપદાર્થી તદ્દન અલિપ્ન રાખવાની પ્રેરણા મળે છે. એથી, બહાર ગમે તેટલી જંજાળ-ઉપાધિ-વિટંબણા હોય કે કાયામાં રોગ-અગવડ-અસૌંદર્ય હોય છતાં આપણે ખુલ્લી ચક્ષુએ દિશિ નીચી હદ્દ્ય પર ઢાળી દઈ વિચારી શકીએ કે ‘હું અસલ તો શુદ્ધ જ્ઞાનાદિમય અને અખંડ અભગ્ન પ્રદેશવાળો આત્મા છું; મારે બહાર સાથે શી લેવા દેવા ? બાધ્ય સંયોગો અનંતી વાર નિરનિરણા આવ્યા ને ગયા, નરક-તિર્યંચગતિમાં જુલમીઓના હાથે કાયાના ટૂકડા થઈ જવાના પ્રસંગે આવ્યાં છતાં મારો આત્મા એટલે કે ‘હું તો એનો એ જ અખંડ અને ચૈતન્યવાન ઊભો છું બસ, હું મારામાં લીન છું, બાધ્યથી મારામાં કશું નવું વધતું કે ઘટતું નથી.’ પ્રભુના દર્શને આ પ્રેરણા મળે.

આ યાદ રાખવા જીવું છે બાધ્યથી આત્મામાં કશું વધતું-ઘટતું નથી. પુસ્તકથી જ્ઞાન વધતું દેખાય તે પણ ખરેખર તો આત્માની અંદરમાં જે છે તે જ બહાર પ્રગટ થાય છે, પણ બહારથી કશું જ્ઞાન આત્મામાં નવું આવતું નથી. બહારના ઈન્દ્રિયોના

વિષયોથી આત્મામાં સુખ ઉપજતું દેખાય તે પણ ખરેખર તો આત્માને કર્મનો વ્યાપ્તિ લાગ્યો છે એ કર્મનો વિપાક છે. એમાં મોહનીય કર્મના યોગે આત્માને ખોટી ખણજ ઊભી થઈ એનો વિષયસંપર્કથી પ્રતિકારમાત્ર થાય છે, અર્થાત્ ખણજની કામયલાઉ શાન્તિનો અનુભવ છે. એટલે એ કાંઈ આત્મામાં કોઈ નવી સુખોત્પત્તિ નથી. ખરેખર તો આત્મામાં અનેરું સ્વાધીન અસાંયોગિક અનંત સુખ છે. હાલ તે કર્મના આવરણથી ઢંકાયેલું પડ્યું છે. અનુત્તર વિમાનવાસી દેવોને ખણજો નથી ઊઠતી, તેથી વિષયોના સંપર્ક કરવાના રહેતા નથી; છતાં એમને ઊંચી શાતાના સુખનો અનુભવ છે. પણ એને એ સુખુદ્ધ દેવો કર્મવ્યાપિનો વિપાકમાત્ર દેખે છે, પણ આત્મામાં બહારથી નવું કશું સુખ આવતું દેખતા નથી.

તાત્પર્ય, તીર્થકર પરમાત્માની પ્રાચીન મૂર્તિમાંની સહેજ ફળતી આંખ પરથી આ પ્રેરણા લેવાની છે કે ‘પ્રભુએ આંખ નીચી ઢાળી દઈને આત્મસ્વરૂપમાં જ સ્થિર થવાનું કર્યું એમ મારે પણ આત્મસ્વરૂપમાં સ્થિર થવું છે, લીન થવું છે. એના અનંત જ્ઞાન-વીર્ય-વીર્ય-સુખને જોવાનો પ્રયત્ન કરું. એ જ જોતો બેસું બહારની આપત્ર-વિપત્ત આવે ને જાય, મારે એની સાથે શી નિસ્બત ? શી લેવા દેવા ? એમ જગતમાં ઘણું ય બને, મારે એની ય સાથે શો સંબંધ ? એની શી અવસર મારે લેવી ? હું મારામાં જ છું.’

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૮, અંક-૪૪, તા. ૧૪-૮-૧૯૭૧

૧૪૮ (લેખાંક-૨)

ગયા લેખમાં એક પ્રકારની પ્રાચીન જિનમૂર્તિઓમાં નમણી નયનમુદ્રા અને એમાંથી લેવાની પ્રેરણા વિચારી. હવે બીજા પ્રકારની પ્રાચીન જિનમૂર્તિઓની નયનમુદ્રા અને એમાંથી લેવાની પ્રેરણા વિચારીએ.

આજે સંપ્રતિ રાજાના બિંબો તરીકે અને બીજી જે કેટલીક પ્રાચીન મૂર્તિઓ મળે છે, એમાં ચક્ષુની મુદ્રા ખુલ્લી અને બરાબર વચ્ચમાં કીકીવાળી સીધી જોવા મળે છે. જેમ નમણી ચક્ષુ આત્માની આત્મસ્વરૂપમાં સ્થિરતાને સૂચવે છે, એમ સીધી ચક્ષુ વીતરાગ ભાવે દર્શાવે છે.

સામાન્ય રીતે માણસની કીકી દીલની અંદરના ભાવ મુજબ ઊંચી નીચી વગેરે ગોઠવાઈ જાય છે. દીલમાં દીનતા આવે, પછી ચાદ્ય એ પૈસા વગેરેની

માગણી માટે હોય કે કોઈ દરદની પીડાને લીધે હોય, અથવા કામપાત્ર પ્રત્યે કામવાસનાની શુલામીના ધરની હોય, પરંતુ એ વખતે કીડી નીચી ઢળતી હોય છે; ત્યારે ગુસ્સામાં કે અભિમાનમાં કીડી ઉપર ચેલી દેખાય છે. એમ કટાક મારવામાં કે કોઈ માયાના ભાવમાં કીડી ખુલા તરફ વળેલી દેખાય છે. તાત્પર્ય ચક્ષુની ચારે તરફ જાણે મોહના સુભટો ગોઠવાઈ જઈ કીડિને પોતાના તરફ જેંચે છે. કિન્તુ વીતરાગ પ્રભુને કોઈ જ મોહના ભાવ નથી, તેથી કીડિને એવું જેંચાવાનું રહેતું નથી. એટલે કીડી બરાબર મધ્યમાં રહેલી હોય છે, મધ્યસ્થ સ્થિતિમાં હોય છે.

આ ઉપરથી જિનમૂર્તિની આવી નયનમુક્રા એમ સૂચવે છે કે પ્રભુ જાણે જગતનું દર્શન વીતરાગભાવે કરી રહ્યા છે. અલબટ એમને કેવળજ્ઞાનથીજ બધું સ્પષ્ટ પ્રત્યક્ષ છે. તેથી ચક્ષુથી કશું જોવાનું રહેતું નથી, પરંતુ આપણે પ્રભુના દર્શન કરીએ ત્યારે ચક્ષુના સ્થાને કેવળજ્ઞાનની જ્યોતી જોવાની, અને “એ કેવળજ્ઞાન જગતનું દર્શન કરે છે. પરંતુ વીતરાગભાવે જગતનું દર્શન કરે છે,” એમ કીડિની મધ્યસ્થ સ્થિતિ પર વિચારવાનું. આ વિચાર પરથી આપણા જીવન માટે વીતરાગભાવના દર્શનની અને શ્રવણ-સ્મરણ વગેરેની પ્રેરણા મેળવવાની.

‘પ્રભુ વીતરાગભાવે દર્શન કરે છે’ એ વિચારતાં આ ચિંતવાનું કે પ્રભુની જ્ઞાનદિષ્ટમાં મોટા ઈન્દ્ર જેવા ભક્તિ કરનારા ય આવે છે અને પ્રભુ છબ્બસ્થ અવસ્થામાં ઘોર ઉપસર્ગ કરનારા અનાડીઓ કે સર્વજ્ઞ તીર્થકર અવસ્થામાં પ્રભુની ભારે નિંદા કરનારા મિથ્યાદિષ્ટાઓ ય આવે છે. પ્રભુ એ બંને વર્ગને રાગ કે દેખ, વિના જુએ છે. એમ પ્રભુના જ્ઞાનમાં હીરા-માણેકના દેર કે દિવ્ય આભૂતઃષો ય દેખાય છે તેમ ધૂળના ધફા ય દેખાય છે; મોટા નંદનવનના ઉદ્ઘાનેય કૈવલ્યદિષ્ટ સામે સ્પષ્ટ દેખાય, તેમ મહાગંધાતા સરેલા ઉકરડા ય દેખાય, રૂપાળી દેવાંગનાઓ ય દેખાય અને ગંધા મોં વાળી કદરૂપી ભૂંડઃષો ય દેખાય. પરંતુ પ્રભુને એ બધાનું દર્શન રાગ-દેખ વિનાનું યાને વીતરાગભાવનું હોય છે; એમાં એક જુથ સારું કે કિંમતી નહિ, તો બીજું ખરાબ કે ગટરકલાસ નહિ. એમને તો માત્ર એ દરેકનું એના રૂપ-રસાદિ ગુણો તથા સ્વ-પર-પર્યાયો સહિત તટસ્થ દર્શન યાને કોઈપણ જાતના રાગદ્વેષ હર્ષબેદ આદિવિકારો વિનાનું નિર્વિકાર દર્શન કરવાનું. તે પણ વર્તમાનના તેમજ ભૂતકાળના અને ભવિષ્યકાળનાં ગુણો-પર્યાયોનું પણ સાથે પ્રત્યક્ષ દર્શન. આમાં પછી, દા.ત. વર્તમાનમાં હીરાના સુંદર રૂપવાળા કણ ભૂતકાળમાં ક્યારેક વિષાના ગંદા રૂપાદિવાળા હોવાનું આજે આબેહૂબ દેખાય ત્યાં શું સારું

ખોટુ લાગે ? શા રાગ કે દેખ થાય ? નજર સામે જ ગટરના પાણીને કોલસી વગેરેથી શુદ્ધ કરેલું દેખાય એ પીવાનું થોડું જ મન થાય ?

સારાંશ, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા જગતને નિર્વિકારપણે વીતરાગતા સાથે જુએ છે, એ આપણે એમની મધ્યસ્થ કીડિનાં દર્શન કરતાં જોવાનું છે, અને એમાંથી આપણે એવાં દર્શનની પ્રેરણા લેવાની છે.

આ ‘દર્શન’ એટલે માત્ર જોવાનું એટલું જ નહિ, કિન્તુ સાંભળવાનું, સુંધવાનું, ચાખવાનું કે સ્પર્શવાનું, અને કાંઈ પણ યાદ કરવાનુંય થાય, એ બધું ‘દર્શન’ સમજવાનું છે. આ કરતી વખતે દિલમાં રાગ-દેખ-હર્ષ-બેદ-ગર્વ-દીનતા વગેરે કશા વિકાર ન ઉઠે એવો પ્રયત્ન રાખવાનો છે. જગતની વચ્ચમાં છીએ, ઈન્દ્રિયો ખુલ્લી છે, મન કામ કરતું રહે છે, એટલે જગતની વસ્તુઓ સંપર્કમાં આવવાની ને આત્માને એનું દર્શન થવાનું; ત્યાં સાચવાનું આટલું કે આપણે બને તેટલા અલિપ્ત, નરો વા કુંજરો વા, નિર્વિકાર, અનાસકત રહેવાનું છે. એ રહેતાં આવડે એનો પ્રભાવ અદ્ભુત છે; એ સ્વર્ગાર્થ દેવતાઓના આનંદને પણ લંઘી જાપ એવો આનંદ દેખાડે છે.

બંને પ્રકારની પ્રભુનયનની મુદ્રામાંથી બે પ્રકારની ઉપરોક્ત પ્રેરણા લેવા જેવી છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૂત”

વર્ષ-૧૮, અંક-૪૭, ૪૮, તા. ૨૧-૧૯૭૭

## ૧૪૮ બંગાળી માનવોનાં દુઃખ અને અનુકંપા

વિલાસી સાધનોમાં અંજાઈ ગયેલો અને વિલાસલંપટ બની ધૂમ ખર્ચ કરનારો આજનો માનવ સંયમ-સાદાઈ અને પરમાર્થ-પરોપકાર ગુમાવી બેઠો છે, આર્ય સંસ્કૃતિનું ખૂન કરી રહ્યો છે, નવી નવી મુંઘ પ્રજાને અનાર્ય રીતરસમો તરફ ધસ્તી રહ્યો છે. અને મન સંયમ અને પરોપકારથી જીવનારા પોતાના પૂર્વજીનું ગૌરવ નથી, પરલોકનો ભય નથી, મહર્ષિઓનાં ધર્મશાસ્ત્રોનું બંધન નથી. એવા માનવને સાવધાન કરવા માટે શિબિરસંચાલક ભાઈશ્રી કુમારપાણનો નજર દેખ્યો બંગાળી નિર્વાસિતોની ભયંકર દુર્દ્શાનો અહેવાલ ઉપયોગી હોઈ અતે રજૂ કરવામાં આવે છે.

એ પાકિસ્તાની સરહદ પર પ. બંગાળના બોયરા ગામથી લખે છે કે મારી સાથે તું કોલેજિયન શિબિર વિદ્યાર્થીઓ છે. મારુંગાના નૌતમભાઈ ઘડિયાળી અને એમના ૪૮મી વર્ધમાન આંબેલ તપ ઓળી કરી રહેલ ધર્મપત્ની કોકિલાબેન વગેરે કુલ ૧૦ જણા છે અમારી સામે જ નદી કિનારે પાકિસ્તાન છે. ત્યાં હજારો સૈનિકો ફાયરિંગ કરી રહ્યા છે. હજારો બંગાળી ત્યાંથી સર્વસ્વ છોડીને નિરાધારપણે આવી રહ્યા છે, એમની હદ્યવિદારક દુઃખભરી પરિસ્થિતિનું વર્ણન લખવા સમય નથી. લોકોને આફિત અસહ્ય છે. સેંકડો લોક થાક-રોગ-કોલેરાથી મરી રહ્યા છે. મરનારનાં સર્ગાં પાસે સાધન નથી તેથી મડાં એમજ મૂકીને ચાલ્યા જાય છે. ડેસા ડેસી નાના બાળકો હજારોની સંખ્યામાં બેહાલ ભૂખ્યા રખી રહ્યા છે, રોડ પર કેટલાય બેભાન પડ્યા છે, દવા નથી ખોરાક નથી, કપડાં ચિંથરેહાલ છે; સાધન બધાં લૂંટાઈ ગયા છે. જોતાં આપણી આંખોના પાણી સુકાતા નથી. સમાચાર પત્રોની વિગત કરતાં વાસ્તવિક સ્થિતિ હજારગુણી ખરાબ છે.

અહીં આવવાનું સદ્ભાગ્ય એ રીતે બન્યું કે હું તાં ૧૫-૭ ‘૭૧ બોડેલી હતો ત્યાંથી મુંબઈ મારા એક મિત્રને પત્ર લખી આ બાબત પર માત્ર ધ્યાન દોર્યું હતું, પૈસા માણ્યા નહોતા, પણ જેવો હું મુંબઈ આવ્યો કે એમણે મને બોલાવી રૂ. ૫૦) હજાર આપી તરત કામ કરવા જવા કહ્યું અમે અહીં આવ્યા; જોયું કે બીજી સંસ્થાઓ તો કામ કરી રહી છે, માત્ર કોઈ જૈન સંસ્થા નહિં. અમે શ્રી વર્ધમાન જૈન કલ્યાણ કેન્દ્ર મુંબઈના નામે કામ પ્રારંભી દીધું. દિવસોના દિવસો છૂપાઈ-સંતાઈ ને પાક સૈનિકોથી માંડ જીવતા બચ્ચિને ચાલી આવતા આ નિરાધાર મહાદુઃખી લોકોને અમો ખોરાક કપડાં વાસણ રોકડ બ્લેન્કેટ આદિ જરૂરિયાત મુજબ આપીએ છીએ; ત્યારે એમના જે અંતરના આશીર્વાદ મળે છે એને હું મોટી કમાઈ માનું હું. ઉદાર દાતા પોતે અતે જોવા આવ્યા, જોઈને ખૂબ પ્રસન્ન થાય, વિશેષ કરવાની ભાવના જગ્યી. મુંબઈ આ સમાચાર જતાં શ્રી કાન્નિલાલ ઉજ્મલાલના એક સંબંધી ભાઈ સામેથી ઊઠીને આવી એમને આ કામ માટે રૂ. ૧૦) હજાર આપી ગયા.

અમો તા. ૮ મી એ નીકળી રાયપુર ‘માના’ કેમ્પમાં જઈશું ત્યાંના મૂર્તિપૂજક સ્થાનકવાસી સંધ સ્ટેશન પર આવી ખાસ આમંત્રાણ આપી ગયેલ છે. ત્યાં પણ રૂ.૨૫) હજાર જેવું થોડુંક કામ કરી મુંબઈ જઈશું.”

કલકત્તાથી ગયેલ એક શિબિર વિદ્યાર્થી લખે છે ‘પૂર્વ પાકિસ્તાનમાંથી નીકળી આવતા માણસો પાસે ખાવાનું નથી, એક પણ વાસણ નથી, અંગ ઢાંક્યા સિવાયનું કષ્પું નથી, એમની ટળવળતી સ્થિતિ હદ્ય દ્રાવક છે. મેં જોયું કુમારપાળભાઈ અને સાથેનાઓ પોતાનો ખ્યાલ કર્યા વગર રાતના ૧૨ વાગ્યા સુધી નિરાશ્રિતોમાં ફરી ફરીને કપડું, પાઉરોટી, પોંઆગોળ, વાસણ બચ્ચાઓને બિસ્કિટ વગેરે વહેંચતા, બિમારને દવાઓ આપતા, કલકત્તાની ગુજરાતી રીલીફ સોસાયટીને કુમારપાળભાઈએ સમજાવ્યાથી એણે ઉપયોગી વસ્તુઓના ગોદામ ત્રણ દિવસમાં ખાલી કરી આપેલ. કુમારપાળભાઈ અને નૌતમભાઈની સેવા જોઈ હું તો દિંગ થઈ ગયો.’

રાયપુર કેમ્પનો હેવાલ આપતાં શ્રી કુમારપાળ લખે છે કે, ‘અત્રે ‘માના’ કેમ્પમાં ૧ લાખ ૩૪ હજાર શરણાર્થી છે. કેમ્પ લશકરી માણસોનાં હાથમાં છે કમાને જાતે ફરીને અમને લોકોની ભયંકર દુઃખમય દશા બતાવી. રાયપુર કલેક્ટરના પત્ની શ્રીમતી પ્રીતિ ત્રિપાઠી બહુ ઉમદા ધર્મભાવનાવાળા, એમનો સહયોગ અમને સારો મળ્યો.

લોકો લાદીના ટૂકડા પર કે હથેલીમાં ખાવાનું મળે તે ખાય છે. અહીં ૫૦૦૦ નિરાશ્રિત બેનો છે. તેમના અંગ ઉપર માત્ર એક જ સાડી. એ પણ ચીંથરેહાલ થયેલી (અંદર ચણીયો-બ્લાઉઝ નહિં). તેથી એ બેનો શરમ ખાતર કે મર્યાદા સાચવવા ઊભી પણ થતી નથી કે ટેન્ટ બહાર આવતી નથી. અમોએ પાંચ હજાર સાડી તાત્કાલિક આપવાનું વચ્ચે આપી દીધું. અમારી પાસે પૈસા હતા નહિં, સાડીના રૂ. ૩૫ થી ૪૦ હજાર લાગી જાય, અમારી પાસે ૨૦ હજાર વધ્યા હતા. પૂર્વના મોટી રકમના દાતાને મુંબઈ જઈ વાત કરી એમણે કહ્યું ‘તું ખરીદી ફરીને મોકલી આપ.’ ખરીદીને અમે જાતે વહેંચી આવશું.

બંગાળના લોકોની કંગાલીયત યાતનાઓ, આફિતો અને દુઃખો દારુણ છે. લાખો લોકો રોડ પર પડ્યા છે. ચાલી ચાલીને જેમના પગ સૂકી ગયા છે; પગ અકડાઈ ગયા છે, ખાવાનું જોયું નથી, મોતથી બચી ગઈ છે એવી કેટલીક બહેનો તો ભારતની ધરતી પર પગ મુક્તાં બેહોશ થઈને ફળી પડે છે. ગર્ભિણીને રીલિવરીઓ રસ્તા પર થઈ જાય છે. નીચે કાદવ અને ઉપરથી ભારે વરસાદ દુઃખ ભારે કરે છે.

પશુથી પણ બદતર જીવન આ માનવોનું આજે છે. રોગના ભોગ દિવસના સેંકડો લોકો બની રહ્યા છે. દવા અને ડોક્ટરો સુધી પહોંચી શકતા નથી. જેમની પાસે ખાવા માટે કંઈ નથી એ દવા ખાવા કર્યાંથી જાય? શી રીતે જાય? મરી ગયેલાને કુટુંબીઓ રોડની બાજુમાં પાણીમાં કે ગમે ત્યાં નાખી દે. એ શબ્દ સરે ગંધાય અને રોગચાળો વધુ ફેલાવે.

મરેલા સમજને ફેંકી દેવાતામાંથી પણ જીવતા મળી આવે છે. એક નાનું બાળક અને વૃદ્ધ ડોશી એ રીતે મરેલા સમજ એમનાં સગાં છોરી ગયેલાં. જે આજે પણ સારવાર અપાયા પછી જીવતાં છે. હવે એ બાળકને કયા મા-બાપને સોંપવું? એ ડોસીને કયા દીકરા કે વહુ પાસે મુકવી? આવાં માબાપ વિનાના હજારો બાળકો, નિરાધાર સ્ત્રીઓ, વૃદ્ધ ડોસા ડોસીઓ ફૂટબોલની જેમ ઘકે ચડી રહી છે. દૂધ પાયું. તે રોતી જ રહી અને મારી સામે જોતી રહી. આખી કટોરી દૂધ પી ગઈ. કોણ જાણે કેટલા દિવસનું અને દુઃખ હશે? કેટલા દિવસની ભૂખ હશે?

એક રસ્તા પર પડેલી ડોસી પાસે ગયા તે બેસી શકવા માટે અસમર્થ હતી. એના ચાલી ચાલીને પગ ભરાઈ ગયા હતા. મેં દૂધના પાવડરમાં ખાંડ નાખી દૂધ બનાવીને કટોરી ભરીને ચમચીથી દૂધ પાયું. તે રોતી જ રહી અને મારી સામે જોતી રહી. આખી કટોરી દૂધ પી ગઈ. કોણ જાણે કેટલા દિવસનું અને દુઃખ હશે?

પછી એ ડોસીએ સૂતાં સૂતાં હાથ લંબાવ્યો. એના ભાગેલા ડબલા તરફ અને પૌંચા અને ગોળના પેકેટને હાથમાં લઈ મને ઈશારાથી ‘તું આ ખા’ એમ કહેવા લાગી. જે પૌંચા અમે રસ્તે જતાં બે ચાર દિવસ પહેલાં આપેલા. આ જાણતાં અને એની મમતાં જોતાં મારી આંખ ભીની થઈ ગઈ. રડી પડ્યો હું ઢીલો પડ્યો. કાળજું કંપી ઉઠ્યું. એક ધાવણીમાં એની સંભાળપૂર્વક ભરતી કરાવી આપી. એક મુંગો પણ મજબૂત આશીર્વદ મળ્યાનો ભારે આનંદ થયો.

એક વાર રસ્તા પર એક બાઈ જેના પતિની અત્યાચારી પાકિસ્તાન સેનાએ હત્યા કરેલી. ત્રણ બાળકો સાથે હતા. ૧૫ વર્ષની યુવાન છોકરી, ૧૦ વર્ષ આસપાસનો છોકરો અને એક નાનું બાળક કમ્મરમાં, છોકરીના માથે કાટ લાગી ગયેલો લોખંડનો ડબ્બો હતો. જે એની પૂરી મિલકત હતી. એમાં શું હતું તે

જોવાની હિંમત ન હતી? છોકરાને કોલેરા કે મરડો થયો હશે. શું દર્દ હતું તે હું સમજ ન શક્યો પણ શરીરમાંથી લોહી જાડા વાટે નીકળી ગયેલું. નીકળવાનું ચાલુ હતું. કોણ એની દવા કરે? કોણ એને રોગથી બચાવે? આ બાળકને લઈ બેઠેલું કુટુંબ મારી નજરે પડ્યું. હું પાસે ગયો. પૂછપરછ કરી અમારી સાથે બંગલા ભાષાના જાણકાર દ્રાયવરો હતા. જે હિંદી સારી રીતે જાણતા. દ્રાયવરોની સેવા પણ ગજબ રહી. બાળકની દવા માટે મને ખાસ મન થયું. મેં મારી ગાડી ત્યાંથી ૧૫ માઈલ ‘બનગાંવ’ છે ત્યાં દોડાવી. મને દવાઓનો અનુભવ હોવાથી ‘મેકાઝિફોમ’ ગોળી લીધી. ઘણી મુશ્કેલી અને રખડપદ્ધી પછી દવા મેળવવાનો આનંદ અનુભવતો હું તો સ્થાનપર પાછો આવ્યો ત્યારે તે કુટુંબ કોણ જાણે કયાં ચાલ્યું ગયું. એ ઘણા પ્રયત્ને ન મળ્યું. શું થયું તે બાળકનું? તે હું જાણતો નથી. મને ભારે આધ્યાત્મ થયો.

આજે પણ એ ગોળી એમ જ પડેલી જોતાં. આંખમાંથી આંસુ વહાવી દે છે શું થયું એ કુટુંબનું? શા હાલ થરો એ બાળકના?

ખાનદાન અને સુધી કુટુંબો પણ હજારોની સંખ્યામાં ચાલી આવ્યા છે આવી રહ્યા છે. આપણે આપવા હાથ લંબાવીએ પણ એ ખાનદાની ભર્યા હાથ લાંબો કરતા સો વાર વિચારે છે. ખાવાની ચીજ કે રોકડ રકમ હાથ જોડી વિનંતી પૂર્વક વિનવીએ ત્યારે હાથમાં પકડે છે.

કેટલાક તો ચીજ આપીએ ત્યારે રડી ઉઠે અને લેવાની ના પાડી દે. કારણ પૂછતાં કહે અમારી પાસે ખરીદવા પૈસા નથી. ત્યારે અમો ખુલાસો કરતા કે ભાઈ આ ચીજના પૈસા લેવાના નથી. તમને અતિથિ તરીકે આપીએ છીએ.

અમે એક પ્રશ્ન બંગાળીમાં કરતા.

કોથે બાડી? ગામ કર્યું? કયાં?

બધા કહેતા

“જય બંગલા.” (ફરીદપુર, જેસોર જિલ્લાઓના નામ)

શા માટે આવ્યા? તો કહેતા ‘ભય પાયલા’ ભય લાગ્યો.

પાક સેનાના અત્યાચારો, સ્થાનિક લોકોની લુંઠથી ભયભીત થઈ નાસી છૂટતા.

૧૩-૧૪ દિવસનો પ્રવાસ યાદગાર અને આંસુ ભર્યો બની ગયો. માનવી કુદરત સામે કેટલો વામન-નાનો છે તે સ્પષ્ટ સમજાયું. માનવદુઃખ જોઈને દ્રવે નહિ તો માનવ શાનો? આવા પ્રસંગો આપણી ચાદર બેચીને આપણાને જાગ્રત કરે છે. કહે છે કે માનવ તું અભિમાન ન કર! પાપનો ભય અને ડર રાખ. આજે આ લોકોનો છે તેવો દિવસ આવતી કાલે તારો ન બને તે માટે નમ્ર બન. આત્મ આલોચના કર. પાપોથી પાછો હઠ. સુકૃત્યોમાં પ્રવૃત્ત બન. દુષ્કૃત્યોથી નિવૃત્ત થા.

:: નોંધપોથી ::

---

---

---

---

---

---

---

---

---

---

---

---

---

---

---

---

---

---

---

---

---

---

---

## :: અનુક્રમણિકા ::

| ક્રમ | વર્ષ | અંક | વિષય   |
|------|------|-----|--|
| ૧.   | ૧૬   | ૨૬  | પ્રિસ્તી ધર્મ-પ્રચાર સામે ચેતો                   |
| ૨.   | ૧૬   | ૨૭  | હદ્યમાં પ્રભુનું ભક્તિશી સ્થાપન                  |
| ૩.   | ૧૬   | ૨૮  | ભવનિર્વદ્ધનો એક નક્કર સહિય ઉપાય                  |
| ૪.   | ૧૬   | ૨૯  | નિશ્ચયદાટિનો હુદુપયોગ                            |
| ૫.   | ૧૬   | ૩૦  | નિશ્ચયદાટિનો સહૃદ્યોગ                            |
| ૬.   | ૧૬   | ૩૧  | નિશ્ચયદાટિ કેવી રીતે કેળવવી ?                    |
| ૭.   | ૧૬   | ૩૨  | અધ્યવસાયનું મહત્વ અને આલંબનનું મૂલ્યાંકન         |
| ૮.   | ૧૬   | ૩૩  | અધ્યવસાયનું મહત્વ અને... (લે.૨)                  |
| ૯.   | ૧૬   | ૩૪  | મહાશાંતિનો એક અદ્ભુત પ્રયોગ                      |
| ૧૦.  | ૧૬   | ૩૫  | દોપોની વિઠેબલા ટાળવા અદ્ભુત ઉપાય                 |
| ૧૧.  | ૧૬   | ૩૬  | મુનિશ્રી ચન્દ્રશરવિજયજી કાન્જાભાઈ સાથે વાર્તાવાપ |
| ૧૨.  | ૧૬   | ૩૭  | આત્માની ઉન્નતિ ક્યાં અટકે છે ?                   |
| ૧૩.  | ૧૬   | ૩૮  | આત્માના મહાવને કેમ લાગુ કરવું ?                  |
| ૧૪.  | ૧૬   | ૩૯  | મન એવિકાસનું સાધન છે                             |
| ૧૫.  | ૧૬   | ૪૦  | ઠિન્ડ્યોના વિજાળનું તાત્પર્ય પ્રોયોજન            |
| ૧૬.  | ૧૬   | ૪૧  | સમ્પર્કવામાં વૈરાગ્યનું સ્થાન                    |
| ૧૭.  | ૧૬   | ૪૨  | સમ્પર્કવામાં વૈરાગ્યનું સ્થાન (લે.૨)             |
| ૧૮.  | ૧૭   | ૨   | અરિંદતની ઉપાસનાનો ઉપાય                           |
| ૧૯.  | ૧૭   | ૩   | આસ્લિટક-નાસ્લિટકનું માપ શાના પર ?                |
| ૨૦.  | ૧૭   | ૪   | અખય સુખના લવથી સર્વ ભૂલ કેમ લાગે ?               |
| ૨૧.  | ૧૭   | ૫   | કાળવળ્યિ લલી પંથ નિધાળશું                        |
| ૨૨.  | ૧૭   | ૬   | કાળવળ્યિ લલી પંથ નિધાળશું (લે.૨)                 |
| ૨૩.  | ૧૭   | ૭   | મોક્ષમાં શું સુખ ? શું કરવાનું ?                 |
| ૨૪.  | ૧૭   | ૮   | દીર સ્વત્ત રરાય ના ગ્રાંબે...                    |
| ૨૫.  | ૧૭   | ૯   | દાનથર્ય પહેલો કેમ ?                              |
| ૨૬.  | ૧૭   | ૧૦  | વીતરાગના દર્શન ભક્તિભાવથી...                     |
| ૨૭.  | ૧૭   | ૧૧  | ભવપ્રવાહ કેમ સતત ચાહું ?                         |
| ૨૮.  | ૧૭   | ૧૨  | અનંતના પ્રવાસે                                   |
| ૨૯.  | ૧૭   | ૧૩  | બ્રહ્મયર્થ પાળવું કેમ સહેલું ?                   |
| ૩૦.  | ૧૭   | ૧૪  | બ્રહ્મયર્થ પાળવું કેમ સહેલું ? (લે.૨)            |
| ૩૧.  | ૧૭   | ૧૫  | બાલ તપ કેમ જરૂરી ?                               |
| ૩૨.  | ૧૭   | ૧૬  | ખોટા વિચારોથી બચવા અદ્ભુત ઉપાય                   |
| ૩૩.  | ૧૭   | ૧૭  | ખોટા વિચારોથી બચવા અદ્ભુત ઉપાય (લે.૨)            |
| ૩૪.  | ૧૭   | ૧૮  | પ્રભુનામની જરીબુઝીનો ઉપયોગ                       |
| ૩૫.  | ૧૭   | ૧૯  | બ્રહ્મયર્થ-પાલન માટે મનનું મૂલ્યાંકન             |
| ૩૬.  | ૧૭   | ૨૦  | તકલાદી આનંદ અને સંતાપ                            |
| ૩૭.  | ૧૭   | ૨૧  | તકલાદી આનંદ અને સંતાપ... (લે.૨)                  |
| ૩૮.  | ૧૭   | ૨૨  | તકલાદી આનંદ અને સંતાપ... (લે.૩)                  |
| ૩૯.  | ૧૭   | ૨૪  | અંતરાગ શરૂ લોભ કેમ દાખાવાય                       |
| ૪૦.  | ૧૭   | ૨૬  | અંતરાગ શરૂ લોભ કેમ દાખાવાય (લે.૨)                |
| ૪૧.  | ૧૭   | ૨૩  | પ્રતિકમણ એ મહાયોગ                                |
| ૪૨.  | ૧૭   | ૨૪  | પ્રતિકમણ એ મહાયોગ (લે.૨)                         |
| ૪૩.  | ૧૭   | ૨૭  | આત્મા અને મોક્ષ માટે પ્રમાણાં...                 |
| ૪૪.  | ૧૭   | ૨૮  | આત્મા અને મોક્ષ માટે પ્રમાણ... (લે.૨)            |
| ૪૫.  | ૧૭   | ૨૯  | આજના માનસમાં ભૂત સર્વ ધર્મ સમાન                  |
| ૪૬.  | ૧૭   | ૩૦  | આજના માનસમાં ભૂત સર્વ ધર્મ સમાન (લે.૨)           |
| ૪૭.  | ૧૭   | ૩૧  | આજના માનસમાં ભૂત સર્વ ધર્મ સમાન (લે.૩)           |
| ૪૮.  | ૧૭   | ૩૨  | સંતાપ-દ્રેગ ટાળવાથો અદ્ભુત ઉપાય                  |
| ૪૯.  | ૧૭   | ૩૩  | દિવ્યભૂમિમાં પ્રવેશ કેમ ?                        |

| ક્રમ | વર્ષ | અંક | વિષય  |
|------|------|-----|---|
| ૫૦.  | ૧૭   | ૩૪  | જિનવાણી-શ્રવણનું મહત્વ...                           |
| ૫૧.  | ૧૭   | ૩૬  | અકલ્યાણભિન્નથી દૂર રહો                              |
| ૫૨.  | ૧૭   | ૩૭  | મંગી તેતલાપુત્ર હુણી કેમ ?                          |
| ૫૩.  | ૧૭   | ૪૧  | મંગી તેતલાપુત્ર હુણી કેમ ? (લે.૨)                   |
| ૫૪.  | ૧૭   | ૪૨  | ધર્મવૃક્ષની ભૂમિ : ત્રિવિધ યોગ્ય પ્રવર્તન           |
| ૫૫.  | ૧૭   | ૩૮  | મનનું યોગ્ય પ્રવર્તન                                |
| ૫૬.  | ૧૭   | ૪૨  | અદ્ભુત થાન યોગભર્યું પ્રભુર્દ્ધન                    |
| ૫૭.  | ૧૭   | ૪૩  | અદ્ભુત થાન યોગભર્યું પ્રભુર્દ્ધન (લે.૨)             |
| ૫૮.  | ૧૭   | ૪૪  | આત્મારોગ હટાવા બે જગીલુણી                           |
| ૫૯.  | ૧૭   | ૪૫  | 'પ્રેરક અવસર જિનવરુ'                                |
| ૬૦.  | ૧૭   | ૪૬  | પરના ખેલ ઉપર લંઘવાઈ ન જવાય                          |
| ૬૧.  | ૧૭   | ૪૭  | મનની કમાણેરી  |
| ૬૨.  | ૧૭   | ૪૮  | કામ-કાખાંદિ રોકવા એક નક્કર ઉપાય                     |
| ૬૩.  | ૧૮   | ૨   | નિષ્ફળ-નકારા વિચારોનો અતિ વિદ્યકર રોગ               |
| ૬૪.  | ૧૮   | ૩   | ગુદસ્થ બલારથી સુખી, સાધુ અંદરથી સુખી                |
| ૬૫.  | ૧૮   | ૪   | નિત્ય પ્રસન્નતાનો એક ઉપાય                           |
| ૬૬.  | ૧૮   | ૫   | મનુષ્ય ઠેવો લીનભારી કોક્ષ ?                         |
| ૬૭.  | ૧૮   | ૬   | શું પેસા બચ્ચા વિન પ્રભુભક્તિ ન થાય ?               |
| ૬૮.  | ૧૮   | ૭   | બીજાની પુષ્યાર્થનાં અંજામણાં શા માટે મરવું ?        |
| ૬૯.  | ૧૮   | ૮   | બીજાની પુષ્યાર્થનાં અંજામણાં શા માટે મરવું ? (લે.૨) |
| ૭૦.  | ૧૮   | ૯   | વિચાર-વાણી-વત્તર્વ પર અંકુશ કેમ આવે ?               |
| ૭૧.  | ૧૮   | ૧૦  | શુદ્ધલયાની પ્રક્રિયા પરથી એક ટિશા સૂચન              |
| ૭૨.  | ૧૮   | ૧૧  | અનંત દેહ ખાતર આત્માને ચૂસ્યો                        |
| ૭૩.  | ૧૮   | ૧૨  | ધર્મ શું મોક્ષની શું ઈચ્છાથી કરવાનો ?               |
| ૭૪.  | ૧૮   | ૧૩  | દુઃખ શાશી ? પેસા દાબી રાખીને ધર્મ મમતા ન વધે        |
| ૭૫.  | ૧૮   | ૧૪  | મદ-હુદ્દા-નેંદ્રા-વિક્ષા એ ભયંકર...                 |
| ૭૬.  | ૧૮   | ૧૫  | વિકાસ શો ? ધર્મ કરાય, પણ વિકાસ ક્યારે ?             |
| ૭૭.  | ૧૮   | ૧૬  | વિકાસ શો ? ધર્મ કરાય, પણ વિકાસ ક્યારે ? (લે.૨)      |
| ૭૮.  | ૧૮   | ૧૭  | આપણે આત્મારી થીએ ?                                  |
| ૭૯.  | ૧૮   | ૧૮  | સંપ્રમાણ સૌંદર્ય : બ્રહ્મયર્થની ટાક્ક               |
| ૮૦.  | ૧૮   | ૧૯  | નિર્મળ ટિલ માટે એક સુંદર ચાવી                       |
| ૮૧.  | ૧૮   | ૨૦  | 'સેવાધર્મ' : પરમગાહન : કેમ ?                        |
| ૮૨.  | ૧૮   | ૨૧  | 'સેવાધર્મ' : પરમગાહન : કેમ ? (લે.૨)                 |
| ૮૩.  | ૧૮   | ૨૨  | દિલ ઉમદા રાખવા ચાર પ્રક્રિયા ...                    |
| ૮૪.  | ૧૮   | ૨૩  | દિલ ઉમદા રાખવા ચાર પ્રક્રિયા ... (લે.૨)             |
| ૮૫.  | ૧૮   | ૨૪  | શુદ્ધ અવસ્થા શુભ અવસ્થાની પ્રવૃત્તિથી આવે           |
| ૮૬.  | ૧૮   | ૨૬  | અતેજરૂરી દિનિની નિર્મળતા અને શાસ્ત્ર શ્રવણ          |
| ૮૭.  | ૧૮   | ૨૭  | જિનવરસની વિશેષતાઓ કઈ ?                              |
| ૮૮.  | ૧૮   | ૨૮  | ધર્મચિત્તની કેમ વિકસે ?                             |
| ૮૯.  | ૧૮   | ૨૯  | પ્રતિકૂળ વેઠાં એ પણ એક અનિવાર્ય સાધના               |
| ૯૦.  | ૧૮   | ૩૦  | પરચિતા અખમાખમ કેમ ?                                 |
| ૯૧.  | ૧૮   | ૩૧  | ક્રમા-બ્રહ્મયર્થ આદિની બે સુંદર ચાવી                |
| ૯૨.  | ૧૮   | ૩૨  | ક્રમા-બ્રહ્મયર્થ આદિની બે સુંદર ચાવી (લે.૨)         |
| ૯૩.  | ૧૮   | ૩૩  | વીતરાગની સાચી ઉપાસના માટે જરૂરી તત્ત્વ              |
| ૯૪.  | ૧૮   | ૩૪  | ધર્મશ્રદ્ધનાં તે મહાન સૂત્ર                         |
| ૯૫.  | ૧૮   | ૩૪  | વત્માન હાડમારીઓ : એંચાં હુંકણું સાધન                |
| ૯૬.  | ૧૮   | ૩૬  | વાસનાઓ મોદી પાડવા એક વિચારણા                        |
| ૯૭.  | ૧૮   | ૩૭  | કુવાદો કુખરોં કેમ ભયંકર ? : સુંદર...                |
| ૯૮.  | ૧૮   | ૩૮  | કુવાદો કુખરોં કેમ ભયંકર ? : સુંદર... (લે.૨)         |
| ૯૯.  | ૧૮   | ૩૯  | જીવનમાં પરલોક માટે કાંઈ જોગવાઈ કરો છો ?             |

| પે.ન. |
|-------|
| ૧૦૦   |
| ૧૦૨   |
| ૧૦૪   |
| ૧૦૭   |
| ૧૦૮   |
| ૧૧૦   |
| ૧૧૨   |
| ૧૧૪   |
| ૧૧૬   |
| ૧૧૮   |
| ૧૨૦   |
| ૧૨૨   |
| ૧૨૪   |
| ૧૨૬   |
| ૧૨૮   |
| ૧૩૦   |
| ૧૩૨   |
| ૧૩૪   |
| ૧૩૬   |
| ૧૩૮   |
| ૧૪૦   |
| ૧૪૨   |
| ૧૪૪   |
| ૧૪૬   |
| ૧૪૮   |
| ૧૪૯   |
| ૧૫૧   |
| ૧૫૩   |
| ૧૫૫   |
| ૧૫૭   |
| ૧૫૯   |
| ૧૬૧   |
| ૧૬૩   |
| ૧૬૫   |
| ૧૬૭   |
| ૧૬૯   |
| ૧૭૧   |
| ૧૭૩   |
| ૧૭૫   |
| ૧૭૭   |
| ૧૭૯   |
| ૧૮૧   |
| ૧૮૩   |
| ૧૮૫   |
| ૧૮૭   |
| ૧૮૯   |
| ૧૯૧   |
| ૧૯૩   |
| ૧૯૫   |
| ૧૯૭   |
| ૧૯૯   |
| ૨૦૧   |
| ૨૦૩   |
| ૨૦૫   |
| ૨૦૭   |
| ૨૦૯   |
| ૨૧૧   |
| ૨૧૩   |
| ૨૧૫   |
| ૨૧૭   |
| ૨૧૯   |
| ૨૨૧   |
| ૨૨૩   |
| ૨૨૫   |
| ૨૨૭   |
| ૨૨૯   |
| ૨૩૧   |
| ૨૩૩   |
| ૨૩૫   |
| ૨૩૭   |
| ૨૩૯   |
| ૨૪૧   |
| ૨૪૩   |
| ૨૪૫   |
| ૨૪૭   |
| ૨૪૯   |
| ૨૫૧   |
| ૨૫૩   |
| ૨૫૫   |
| ૨૫૭   |
| ૨૫૯   |
| ૨૬૧   |
| ૨૬૩   |
| ૨૬૫   |
| ૨૬૭   |
| ૨૬૯   |
| ૨૭૧   |
| ૨૭૩   |
| ૨૭૫   |
| ૨૭૭   |
| ૨૭૯   |
| ૨૮૧   |
| ૨૮૩   |
| ૨૮૫   |
| ૨૮૭   |
| ૨૮૯   |
| ૨૯૧   |
| ૨૯૩   |
| ૨૯૫   |
| ૨૯૭   |
| ૨૯૯   |
| ૨૧૦૧  |
| ૨૧૦૩  |
| ૨૧૦૫  |
| ૨૧૦૭  |
| ૨૧૦૯  |
| ૨૧૧૧  |
| ૨૧૧૩  |
| ૨૧૧૫  |
| ૨૧૧૭  |
| ૨૧૧૯  |
| ૨૧૨૧  |
| ૨૧૨૩  |
| ૨૧૨૫  |
| ૨૧૨૭  |
| ૨૧૨૯  |
| ૨૧૩૧  |
| ૨૧૩૩  |
| ૨૧૩૫  |
| ૨૧૩૭  |
| ૨૧૩૯  |
| ૨૧૪૧  |
| ૨૧૪૩  |
| ૨૧૪૫  |
| ૨૧૪૭  |
| ૨૧૪૯  |
| ૨૧૫૧  |
| ૨૧૫૩  |
| ૨૧૫૫  |
| ૨૧૫૭  |
| ૨૧૫૯  |
| ૨૧૬૧  |
| ૨૧૬૩  |
| ૨૧૬૫  |
| ૨૧૬૭  |
| ૨૧૬૯  |
| ૨૧૭૧  |
| ૨૧૭૩  |
| ૨૧૭૫  |
| ૨૧૭૭  |
| ૨૧૭૯  |
| ૨૧૮૧  |
|       |

|      |      |       |   |       |
|------|------|-------|---|-------|
| ૧૦૦. | ૧૮   | ૪૦    | આચાર પહેલો ? કે વિચાર ?<br>વિષય                       | ૨૦૧   |
| ક્રમ | વર્ષ | અંક   |   | પે.ન. |
| ૧૦૧. | ૧૮   | ૪૧    | 'દિલ અટડો તોરા ચરણ કમળમે'                             | ૨૦૩   |
| ૧૦૨. | ૧૮   | ૪૨    | 'દિલ અટડો તોરા ચરણ કમળમે' (લ.૨)                       | ૨૦૪   |
| ૧૦૩. | ૧૮   | ૪૩    | ભવસ્થિતિ-પરિપાક : ચાર શરણનો ચમત્કાર                   | ૨૦૫   |
| ૧૦૪. | ૧૮   | ૪૪    | જીવન પર મનોદશાની અસર                                  | ૨૦૬   |
| ૧૦૫. | ૧૮   | ૪૫    | 'શીલ'ની વિરુદ્ધમાં વર્તમાન દલીલોના રહિયા              | ૨૧૧   |
| ૧૦૬. | ૧૮   | ૪૬    | પ્રભુના દર્શની રોમાચ ખડ કેમ થાય ?                     | ૨૧૩   |
| ૧૦૭. | ૧૮   | ૪૭/૪૮ | આજના કાળને આપું : વાસનાથી રક્ષાનો ઉપાય                | ૨૧૪   |
| ૧૦૮. | ૧૮   | ૧     | મુનિશ્રી વિશ્વધનવિજ્યજીની સમાપ્તિ                     | ૨૧૭   |
| ૧૦૯. | ૧૮   | ૨     | ક્રાયાને સુખ એ વિટંબાજી                               | ૨૧૭   |
| ૧૧૦. | ૧૮   | ૩     | કર્મની ભ્રમણામાં પુરુષાર્થનો નાશ ન કરો                | ૨૧૮   |
| ૧૧૧. | ૧૮   | ૪     | ગુપ્ત બંડાર અને એની ચાવી                              | ૨૨૧   |
| ૧૧૨. | ૧૮   | ૫     | દરેક સાધનામાં જરૂરી તત્ત્વ                            | ૨૨૪   |
| ૧૧૩. | ૧૮   | ૬     | પ્રભુના નામની શીતલતા                                  | ૨૨૬   |
| ૧૧૪. | ૧૮   | ૮     | સયકવના પ લક્ષ્ણનાં ઉત્પત્તિકમના રહસ્ય                 | ૨૨૮   |
| ૧૧૫. | ૧૮   | ૯     | સયકવના પ લક્ષ્ણનાં... (લ.૨)                           | ૨૩૦   |
| ૧૧૬. | ૧૮   | ૧૦    | સહિષ્ણુતા-સહનવૃત્તિના અદ્ભુત લાભ                      | ૨૩૩   |
| ૧૧૭. | ૧૮   | ૧૧    | મા-બાપનો ઉપકાર : સાસુ-વહુ કેમ ન જરૂરે ?               | ૨૩૪   |
| ૧૧૮. | ૧૮   | ૧૩    | આપણને ભગવાનની કઈ દયા બધે ?                            | ૨૩૭   |
| ૧૧૯. | ૧૮   | ૧૪    | સંખેચનું સ્વરૂપ : સંપત્તિ પચાવવાની આવકાત              | ૨૩૮   |
| ૧૨૦. | ૧૮   | ૧૫    | ધાર્યકીયતાનો ચંદ્નાની ચિત્ત કેમ ન કરી ?               | ૨૪૧   |
| ૧૨૧. | ૧૮   | ૧૬    | ભક્તિ એ મુજિની દૂઠી કેવી રીતે ?                       | ૨૪૩   |
| ૧૨૨. | ૧૮   | ૧૭    | પરોપકાર કરો છતાં સ્પોપકાર કરી ન ભૂલો                  | ૨૪૪   |
| ૧૨૩. | ૧૮   | ૧૮    | જીવનમાં શાન્તિ કેમ મળે ?                              | ૨૪૭   |
| ૧૨૪. | ૧૮   | ૧૯    | શું ભગવાન આપણા પનારે પડ્યા છે ?                       | ૨૪૮   |
| ૧૨૫. | ૧૮   | ૨૧    | શપકશ્રેષ્ઠ અને વીતરાગભાવ કેમ આવે ?                    | ૨૫૧   |
| ૧૨૬. | ૧૮   | ૨૨    | જીવનની પાંચ ખરાબી...                                  | ૨૫૬   |
| ૧૨૭. | ૧૮   | ૨૩    | જીવનની પાંચ ખરાબી... (લ.૨)                            | ૨૫૮   |
| ૧૨૮. | ૧૮   | ૨૪    | દર્શનની બલિહારી સામગ્રીમાં સભ્યગદ્ધન                  | ૨૬૧   |
| ૧૨૯. | ૧૮   | ૨૫    | દર્શનની બલિહારી સામગ્રીમાં... (લ.૨)                   | ૨૬૩   |
| ૧૩૦. | ૧૮   | ૨૬    | કોખાહિ ૪ કથ્યનન ત્યાગ માટે વિચારણા                    | ૨૬૪   |
| ૧૩૧. | ૧૮   | ૨૭    | 'ધ્યાનશતક' શાલ્કાપરિચય અને ધ્યાનનું મહત્વ             | ૨૬૮   |
| ૧૩૨. | ૧૮   | ૨૮    | સંયમ-બ્રહ્મયર્થ માટે ખાતા વહેંચી લો                   | ૨૬૯   |
| ૧૩૩. | ૧૮   | ૨૯    | દુઃખના રોદણા કેમ અરૂરે ?                              | ૨૭૧   |
| ૧૩૪. | ૧૮   | ૩૦    | ધોરો ધોરો રે સાહિબ વાજમાં                             | ૨૭૪   |
| ૧૩૫. | ૧૮   | ૩૧    | જીવનના હિસ્સાબ પર સુખ-દુઃખ...                         | ૨૭૬   |
| ૧૩૬. | ૧૮   | ૩૨    | કર્મ ખટકે છે, પણ કબાહું ખટકે છે ?                     | ૨૭૮   |
| ૧૩૭. | ૧૮   | ૩૩    | કર્મ ખટકે છે, પણ કબાહું ખટકે છે ? (લ.૨)               | ૨૮૦   |
| ૧૩૮. | ૧૮   | ૩૪    | ધર્મપ્રેમની કટલી જરૂર ?                               | ૨૮૨   |
| ૧૩૯. | ૧૮   | ૩૪    | ધર્મપ્રેમ માપવાની પારાશીશી                            | ૨૮૪   |
| ૧૪૦. | ૧૮   | ૩૬    | પરમાત્મા અંગે જેનો અને અજૈનોની માન્યતાનું ફળ          | ૨૮૭   |
| ૧૪૧. | ૧૮   | ૩૭    | તમે શ્રાવક માબાપ છો ?                                 | ૨૮૯   |
| ૧૪૨. | ૧૮   | ૩૮    | વાંકાનેરણા આગણે 'ધ્યાન-શતક'નું બહુમાન                 | ૨૯૨   |
| ૧૪૩. | ૧૮   | ૪૦    | પાપના સંતાપ છતાં પાપ કેમ અટકતા નથી ?                  | ૨૯૪   |
| ૧૪૪. | ૧૮   | ૪૧    | પાપના સંતાપ છતાં પાપ કેમ અટકતા નથી ? (લ.૨)            | ૨૯૬   |
| ૧૪૫. | ૧૮   | ૪૨    | પાપના સંતાપ છતાં પાપ કેમ અટકતા નથી ? (લ.૩)            | ૨૯૮   |
| ૧૪૬. | ૧૮   | ૪૩    | વીતરાગ પ્રભુની મૂર્તિમાં બે પ્રકારની નથન મુદ્રા       | ૩૦૦   |
| ૧૪૭. | ૧૮   | ૪૪    | વીતરાગ પ્રભુની મૂર્તિમાં બે પ્રકારની નથન મુદ્રા (લ.૨) | ૩૦૨   |
| ૧૪૮. | ૧૮   | ૪૭,૪૮ | બંગાળી માનવોનાં દુઃખ અને અનુકૂળ્યા                    | ૩૦૪   |